


શ્રી પદ્મનંદિ-પંચવિંશાતિ



આચાર્યવર શ્રી પદ્મનંદિસ્વામી

પ્રકાશક :

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦



ભગવાનશ્રીકુંદુંકું-કહાન-જૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૮૭



શ્રીમત્પત્રનંદિ-આચાર્ય વિરચિત

શ્રી

પ્રમનંદિ-પંચવિંશતિ

(ધાર્મિક અને નેતિક રૂપ પ્રકરણોનો સંગ્રહ)

પં બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીના હિન્દી અનુવાદનું
ગુજરાતી ભાષાંતર

૨૬૦ વિંશતિ.

—: ભાષાંતરકાર :—

બાં ગ્રજલાલ તિરધરલાલ શાહ
વઠવાણ શહેર



—: પ્રકાશક :—

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૨]

પ્રથમ આવૃત્તિ ૧૦૦૦
દ્વિતીય આવૃત્તિ ૧૦૦૦

વીર સં. ૨૫૨૫
વીર સં ૨૫૭૪

વિ. સ. ૨૦૫૫
વિ. સ. ૨૦૬૪

શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ (ગુજરાતી)ના

* સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા *

શ્રી કુંદકુંદ-કહાન દિગંબર જૈન મુમુક્ષુમંડળ ટ્રસ્ટ,
પાલ્લા-સાંતાઙ્ગ

આ શાસ્ત્રની પડતર કિંમત રૂ. ૮૫=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂ. ૮૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦ % શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રત્નલાલ શાહ-પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતાં, આ ગ્રંથની વેચાણ કિંમત રૂ. ૪૦=૦૦ રાખવામાં આવી છે.


કિંમત : રૂ. ૪૦=૦૦



મુદ્રક :

કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ,
સોનગઢ ૩૬૪૨૫૦ (02846) 244081

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦



પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદગુરુદેવ શ્રી કાનકુલ્દેવ માં

Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250

‘પદ્મનંદિ-પંચવિંશતિ’ના પ્રકાશન પ્રસંગે

પ્રકાશકીય નિવેદન

આ ‘પદ્મનંદિ-પંચવિંશતિ’ (ગુજરાતી ભાષાંતર સહિત) પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે. આ ગ્રંથની રચના વિકમની ૧૧મી સદીમાં થઈ હોય તેમ સંભવે છે. અનેક જૂની પ્રતોના આધારે પ્રોઠ એ. એન. ઉપાધ્યે અને પ્રોઠ હીરાલાલ જૈને આ ગ્રન્થનું સંપાદન કરેલ અને તેનો હિંદી ભાષામાં અનુવાદ પં. બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીએ કરેલ, જે ‘જીવરાજ ગ્રંથમાલા’માં પ્રકાશિત થયેલ તેના ઉપરથી આ ગુજરાતી ભાષાંતર બ્રાહ્મ રજલાલ ગિરધરલાલ શાહે (વઢવાણ શહેર) કરી આપેલ છે. બ્રહ્મચારી ભાઈ શ્રી વજુભાઈએ આ ઉપરાંત બીજાં અનેક શાસ્ત્રોનાં ભાષાંતર નિસ્પૃહપણે કરેલ છે. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.

આ શાસ્ત્રના શ્લોકનાં, ઉક્કરણ અનેક દિગંબર શાસ્ત્રોમાં જોવામાં આવે છે, તેથી એમ ફલિત થાય છે કે તેમના પછી થયેલ દિગંબર સંતોષે આ શાસ્ત્રને આધારભૂત ગણ્યું છે. વર્તમાનમાં પણ આ શાસ્ત્રના અનેક શ્લોકો વિદ્વાર્ગમાં અતિશય પ્રચાલિત છે.

પ્રસ્તુત શાસ્ત્ર પદ્મનંદિસ્વામી વિરચિત છલ્લીસ લઘુ ગ્રંથોનો સંગ્રહ છે. પ્રત્યેક ગ્રંથમાં વિષયને અનુસરીને નેતિક અને ધાર્મિક શીરે વિષયનું માર્ભિક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેનો રસાસ્વાદ સ્વાધ્યાયપૂર્વક કરવા વાયકવળને ભલામણ છે. પ્રતિપાદનની શૈલી ધણી જ સરળ અને રૂચિકર છે. બે સ્તુતિ (૧૩-૧૪) પ્રાકૃત ભાષામાં રચેલી છે. બાકીની તમામ રચના સંસ્કૃત શ્લોકોમાં છે. કુલ ૮૮૮ પદોનો સંગ્રહ આ ગ્રંથમાં છે.

આ ગ્રન્થ, શ્રી જીવરાજ ગ્રંથમાલા પ્રકાશિત હિંદી અનુવાદ પરથી, ગુજરાતી મુમુક્ષુ સમાજને માતૃભાષામાં સમજી શકાય તે હેતુથી, પ્રકાશિત કરવામાં આવેલ છે, તેથી ઉક્ત ગ્રંથમાલાના અધિકારીવર્ગનો તથા હિંદી અનુવાદકનો આભાર માનવામાં આવે છે. ગુજરાતી ભાષાંતર સહિત આ શાસ્ત્ર પ્રથમવાર આ પહેલાં શ્રી વીતરાગ સત્તાસ્હિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.

પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના તથા તદ્દ્વબ્દકન પ્રશમભૂતિ પૂજ્ય બહેનશ્રી યંપાબેનના ધર્મોપકારપ્રતાપે મુમુક્ષુ સમાજમાં અધ્યાત્મતત્ત્વની રૂચિનો પ્રસાર ધણો થયેલ છે. મુમુક્ષુઓની રૂચિના પોષણ અર્થે આ ટ્રસ્ટ દ્વારા અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોનાં પ્રકાશનનું કાર્ય અવિરતપણે પ્રવર્તી રહ્યું છે. તે અંતર્ગત શ્રી ‘પદ્મનંદિ-પંચવિંશતિ’ ગુજરાતી ભાષાંતરની આ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે. વર્તમાનમાં જે કંઈ પભાવના, અને અનેક જીવોની આધ્યાત્મિક વિષયમાં રૂચિ થઈ છે તે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય ભગવતી માતા (બહેનશ્રી યંપાબેન)ના ધર્મોપકારને જ આભારી છે.

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૪]

અંતમાં આ પવિત્ર શાસ્ત્ર—“જેને આત્મજ્ઞ સત્ત્પુરુષ શ્રી રાજચંદ્રજીએ ‘વનશાસ્ત્ર’ કહ્યું છે”—નો સ્વાધ્યાય કરી મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ પામે એ જ ભાવના.

દશલક્ષણપર્યુષણપવ
વિ. સં. ૨૦૫૫

સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)



પ્રકાશકીય નિવેદન

(દ્વિતીય આવૃત્તિ પ્રસંગે)

આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ખપી જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે. આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.

વિ. સં. ૨૦૬૪
કારતક સુદ એકમ

સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)



વિષય-સૂચી

વિષય	શલોક	પૃષ્ઠાંક
૧. ધર્મોપદેશામૃત	૧-૧૮૮ ૧ થી ૬૮	
આદિ જિનેન્દ્રનું સ્મરણ	૧-૪	૧-૩
શાન્તિનાથનું સ્મરણ	૫	૪
ધર્મોપદેશા જિનદેવનું સ્મરણ	૬	૪
ધર્મનું સ્વરૂપ અને તેના ભેદ	૭	૪
ધર્મના મૂળભૂત દ્યા ધારણાની પ્રેરણા	૮	૫
પ્રાણીઓના વધમાં પિતૃ આદિના વધનો દોષ સંભવે છે	૯	૬
જીવનનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે	૧૦	૬
દ્યા વિના દાન, તપ અને ધ્યાનાદિ નિર્થક છે	૧૧	૭
મુનિધર્મનું આલંબન સદ્ગુહસ્થ છે	૧૨	૭
ગૃહસ્થાશ્રમનું સ્વરૂપ	૧૩	૮
ગૃહસ્થધર્મના અગિયાર સ્થાનોનો નિર્દેશ	૧૪	૮
સમસ્ત પ્રતિવિધાન વ્યસનોના પરિત્યાગ ઉપર નિર્ભર છે	૧૫	૮
મહાપાપસ્વરૂપ સાત વ્યસનોનો નામ નિર્દેશ	૧૬	૧૦
ધૂત (જીગાર) સર્વ વ્યસનોમાં મુખ્ય છે	૧૭-૧૮	૧૦-૧૧
માંસનું સ્વરૂપ અને તેના ભક્ષણમાં નિર્દ્યતા	૧૯-૨૦	૧૧-૧૨
મદનું સ્વરૂપ અને મદધાનથી થતી હાનિ	૨૧-૨૨	૧૨-૧૩
ધોબીની શિલા સમાન વેશયાઓ નરકનું દ્વાર છે	૨૩-૨૪	૧૩-૧૪
શિકારમાં નિર્દ્યતાથી દીન હીન પ્રાણીઓનો વર્થ વધ		
કરવામાં આવે છે	૨૫-૨૬	૧૪-૧૫
પરવધ અને દગાબાળનું ફળ પરભવમાં તે જ રીતે ભોગવવું પડે છે	૨૭-૨૮	૧૫
પરખી અને પરધનના અનુરાગથી થતી હાનિ	૨૯-૩૦	૧૬
ઉકન ધૂતાદિ સાત વ્યસનોને કારણે કષ્ટ પ્રાપ્ત થયેલ		
યુધિષ્ઠિર આદિના ઉદાહરણ	૩૧	૧૭
વ્યસન સાત જ નથી બીજા પણ અનેક છે	૩૨	૨૨
વ્યસનોથી થતી હાનિ બતાવીને તેમનાથી વિમુખ રહેવાની પ્રેરણા	૩૩	૨૨
મિથ્યાદાસ્તિ આદિનો સંગ છોડીને સત્પુરુષોના સંગની પ્રેરણા	૩૪-૩૫	૨૩
કણિકાળમાં દુષ્ટોની વચ્ચે સાધુજ્ઞનોનું (સજજનોનું) જીવિત રહેવું મુશ્કેલ છે. ત૬	૩૬	૨૪
દુર્જનની સંગતિની અપેક્ષાએ તો મરવું સારું છે	૩૭	૨૪

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૬]

વિષય	શલોક	પૃષ્ઠાંક
મુનિધર્મનું સ્વરૂપ	૩૮	૨૪
ચેતન આત્માને છોડી પરમાં અનુરૂપ કર્મબંધનું કારણ છે.	૩૯	૨૫
મૂળગુણો વિના ઉત્તરગુણોના પાલનનો પ્રયત્ન ધાતક છે.	૪૦	૨૫
વખના દોષ દેખાઈને દિગંબરત્વની પ્રશંસા	૪૧	૨૬
કેશલોચ વૈરાગ્યાદિને વધારનાર છે.	૪૨	૨૬
સ્થિતિભોજનની પ્રતિજ્ઞા	૪૩	૨૭
સમતાભાવ	૪૪-૪૫	૨૭-૨૮
પ્રમાદ રહિત થઈને એકાન્તવાસની પ્રતિજ્ઞા	૪૬	૨૮
સંસારનું સ્વરૂપ જોઈને હર્ષ-વિષાદની વ્યર્થતા	૪૭	૨૮
રાગ-દ્વેષના પરિત્યાગ વિના સંવર અને નિર્જરા સંભવિત નથી	૪૮	૨૮
સંસારસમુદ્રથી પાર થવાની સામગ્રી	૪૯	૨૮
મોહને કૃશ કર્યા વિના તપ આદિનો કલેશ સહેવો વ્યર્થ છે.	૫૦	૩૦
જે કષાયોનો નિગ્રહ કરતો નથી તેના પરિષહ સહેવા માયાચાર છે.	૫૧	૩૦
સમસ્ત અનર્થોનું કારણ અર્થ (ધન) જ છે.	૫૨	૩૧
શય્યા માટે ધાસ આદિની પણ અપેક્ષા રાખવાથી નિર્ગ્રન્થપણું		
નાશ પામે છે.	૫૩	૩૧
કોધાદિથી કદાચિત્ અને પરિશ્રહથી શાશ્વત કર્મનો બંધ થાય છે.	૫૪	૩૧
મોક્ષની પણ અભિલાષા તેની પ્રાપ્તિમાં બાધક છે.	૫૫	૩૨
પરિશ્રહાદિની નિંદા	૫૬	૩૨
સાધુ પ્રશંસા	૫૭-૫૮	૩૩
આચાર્યનું સ્વરૂપ	૫૯-૬૦	૩૩-૩૪
ઉપાધ્યાયનું સ્વરૂપ	૬૧	૩૪
સાધુઓનું સ્વરૂપ અને તેમની સહનશીલતા	૬૨-૬૬	૩૫-૩૬
આત્મજ્ઞાન વિના કરવામાં આવેલ કાયકલેશ ધાચરહિત ખેતરની		
રક્ષા કરવા સમાન વ્યર્થ છે.	૬૭	૩૭
મુનિઓની પૂજા જિનાગમ અને જિનપૂજાની જેમ જ ફળપ્રદ છે.	૬૮	૩૭
તીર્થનું સ્વરૂપ	૬૯	૩૮
રત્નત્રયધારક મુનિનો તિરસ્કાર કરનાર નરકના પાત્ર થાય છે.	૭૦	૩૮
મુનિઓની સ્તુતિ અસંભવ છે.	૭૧	૩૮
વ્યવહારસમ્યંદર્શનાદિનું સ્વરૂપ અને તે ત્રણે વિના મુક્તિની અસંભવના.....	૭૨-૭૬	૩૬-૪૧
સમ્યંદર્શન વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા કહેવાય છે.	૭૭	૪૧

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૭]

વિષય	શલોક	પૃષ્ઠાંક
રત્નત્રય પ્રશંસા	૭૮	૪૨
ઉક્ત સમ્યગ્દર્શનાદિ આત્મસ્વરૂપ છે	૭૯	૪૨
શુદ્ધનયનું આત્મતત્ત્વ અખંડ છે	૮૦	૪૨
નિશ્ચય સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ	૮૧	૪૩
ઉત્તમ ક્ષમાનું સ્વરૂપ	૮૨	૪૩
કોધ મુનિધર્મનો વિધાતક છે	૮૩	૪૪
કોધના કારણો ઉપરિથિત થતાં મુનિજન શું વિચાર કરે છે	૮૪-૮૬	૪૪-૪૫
માર્દવ ધર્મનું સ્વરૂપ	૮૭-૮૮	૪૫-૪૬
આર્જવ ધર્મનું સ્વરૂપ	૮૯-૯૦	૪૬
સત્ય વચનનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા	૯૧-૯૩	૪૭
શૌચ ધર્મનું સ્વરૂપ અને બાહ્ય શૌચનું અકિંચિત્કરપણું	૯૪-૯૫	૪૮
સંયમનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા	૯૬-૯૭	૪૮-૪૯
તપનું સ્વરૂપ અને તેની ઉપાદેયતા	૯૮-૧૦૦	૪૯-૫૧
ત્યાગ અને આકિંચન્યનું સ્વરૂપ	૧૦૧	૫૧
મુનિઓની દુર્લભતા	૧૦૨	૫૨
મમતવના અભાવમાં શરીર અને શાસ્ત્ર આદિને પરિગ્રહ કરી શકતો નથી ૧૦૩	૫૨	
ભ્રાન્તચર્યાનું સ્વરૂપ અને તેના ધારકોની પ્રશંસા	૧૦૪-૫	૫૩
આ દસ ધર્મ મોક્ષમહેલમાં જવા માટે નીસરણીના પગથિયા સમાન છે. ૧૦૬	૫૪	
સ્વાસ્થ્યનું સ્વરૂપ	૧૦૭	૫૪
ચિદૂપનું સ્વરૂપ	૧૦૮	૫૫
મુક્તિનું સ્વરૂપ	૧૦૯	૫૫
અતીન્દ્રિય આત્મા સંબંધી કાંઈક કહેવાની પ્રતિશા	૧૧૦	૫૫
શુંગારાદિ પ્રધાન કાવ્ય અને તેમની રચના કરનાર કવિઓની નિન્દા..... ૧૧૧-૧૩	૫૬-૫૭	
શ્રી શરીરનું સ્વરૂપ	૧૧૪-૧૫	૫૭
શ્રીની ભયંકરતા..... ૧૧૬-૧૮	૫૮	
મોહનો મહિમા દેખાડી તેના ત્યાગનો ઉપદેશ..... ૧૧૮-૨૩	૫૮-૬૦	
વીતરાગ અને સર્વજ્ઞ આપતનું જ વચન પ્રમાણ હોઈ શકે છે, તેમના વચનમાં સંદેહ કરવો એ મૂર્ખાઈ છે..... ૧૨૪-૨૫	૬૧	
અનેક ભેદ-પ્રભેદરૂપ સમસ્ત શુતમાં આત્માને જ ઉપાદેય કર્યો છે. ૧૨૬-૨૭.....	૬૨	
પરોક્ષ પદાર્થના વિષયમાં જિનવચનને પ્રમાણ માનવું જોઈએ	૧૨૮	૬૩
જ્ઞાનનો મહિમા	૧૨૯-૩૧	૬૩-૬૪

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૮]

વિષય	શલોક	પૃષ્ઠાંક
અર્થપરિશાનનું કારણ જિનવાણી છે	૧૩૨	૬૫
આત્માનું જ નામ ધર્મ છે	૧૩૩	૬૫
માધ્યમિક આદિ અન્ય વાદીઓ દ્વારા કલિપ્ત આત્માના સ્વરૂપનો		
નિર્દેશ કરીને તેના યથાર્થ સ્વરૂપનું દિગંદર્શન	૧૩૪	૬૬
આત્માના અસ્તિત્વની સિક્કિ.....	૧૩૫-૩૬	૬૭-૬૮
અન્ય વાદીઓ દ્વારા પરિકલ્પિત આત્માના વ્યાપકત્વ આદિનું નિરાકરણ ..	૧૩૭	૬૮
આત્માનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ	૧૩૮	૭૦
તે આત્માનું સ્વરૂપ નય-પ્રમાણાદિનો આશ્રયથી ગ્રહણ કરવું જોઈએ	૧૩૯	૭૧
રાગ-દ્વેષના પરિત્યાગનો ઉપદેશ	૧૪૦-૧૪૪	૭૩-૭૫
પરમાત્મા આ જ શરીરની અંદર સ્થિત છે	૧૪૬	૭૫
પર પદાર્થોમાં ઈષ્ટાનિષ્ટ કલ્પનાનો નિષેધ	૧૪૭-૪૮	૭૬
તત્ત્વવિત્ત કોણ છે?	૧૪૯	૭૭
સુખ-દુઃખનો અવિવેક	૧૫૧	૭૭
આત્માને પરથી ભિન્ન સમજવો એ જ સમસ્ત ઉપદેશનું રહસ્ય છે	૧૫૨	૭૭
યોગીનું સ્વરૂપ	૧૫૩	૭૮
પરથી ભિન્ન આત્મતત્ત્વનો વિચાર અને તેનું ફળ	૧૫૪-૬૧	૭૮-૮૨
ગુરુનો ઉપદેશ દ્વિત્ય અમૃત સમાન છે	૧૬૨	૮૨
યોગી-પથિકોનું સ્વરૂપ અને તેમને નમર્સ્કાર	૧૬૩	૮૩
તે ધર્મનું વર્ણન કેવળી જ કરી શકે છે	૧૬૪	૮૩
આ ધર્મ-રસાયણ મિથ્યાત્વાદ બંધકારણોનો પરિત્યાગ કરતાં		
જ પ્રાપ્ત થઈ શકે છે	૧૬૫	૮૩
મનુષ્ય પર્યાય અને ઉત્તમ કુળ આદિ દુર્લભ છે, તો પછી તે		
પામીને પણ ધર્મ ન કરવો એ મૂર્ખાઈ છે	૧૬૬-૬૮	૮૪-૮૫
શરીરને સ્વસ્થ અને આયુષ્યને દીર્ઘ સમજને ભવિષ્યમાં ધર્માચારણ		
કરવાનો વિચાર કરવો તે નિતાન્ત જડતા છે	૧૭૦	૮૫
અવસ્થા સાથે ઘણું કરીને તૃપ્તા પણ વધે જ છે	૧૭૧-૭૨	૮૬
પરીવર્તનશીલ સંસારમાં જીવન અને ધનાદિની નશ્ચરતા	૧૭૩-૭૬	૮૭-૮૮
મૃત્યુ અનિવાર્ય હોવાથી વિવેકીજનો તેને માટે શોક કરતા નથી	૧૭૭	૮૮
ધર્મનું ફળ	૧૭૮-૮૧	૮૮-૯૦
ધર્મની રક્ષાથી જ આત્મરક્ષા સંભવે છે	૧૮૨-૮૩	૯૦-૯૧
ધર્મનો મહિમા	૧૮૪-૯૬	૯૧-૯૬
પ્રકરણના અંતે ગ્રન્થકારની ગુરુ પાસે વર યાચના	૧૯૭	૯૭

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૮]

વિષય	શલોક	પૃષ્ઠાંક
ધર્માપદેશામૃત-પાનની પ્રેરણા	૧૮૮	૮૭
૨. દાનોપદેશના	૧-૫૪	૬૬-૧૨૨
ક્રત-તીર્થના પ્રવર્તક આદિ જિનેન્દ્ર અને દાન-તીર્થના પ્રવર્તક		
શ્રેયાંસ રાજાનું સ્મરણ	૧	૮૮.
શ્રેયાંસ રાજાની પ્રશંસા	૨-૩	૧૦૦
લોભી જીવોના ઉદ્ધાર અર્થે દાનોપદેશની પ્રતિજ્ઞા	૪	૧૦૧
સત્પાત્રદાન મોહનો નાશ કરીને મનુષ્યને સદ્ગૃહસ્થ બનાવે છે	૫-૬	૧૦૧
ધનની સફળતા દાનમાં છે	૭	૧૦૨
સત્પાત્રદાનથી દ્રવ્ય વડના બીજ સમાન વધે જ છે	૮	૧૦૩
ભક્તિથી આપવામાં આવેલું દાન દાતા અને પાત્ર બન્નેને		
માટે હિતકર થાય છે	૯	૧૦૩
દાનનો મહિમા	૧૦-૧૬	૧૦૩-૧૦૬
સત્પાત્રદાન વિના ગૃહસ્થ જીવન નિષ્ફળ છે	૧૭	૧૦૬
દાન વિના વૈભવની નિષ્ફળતાનાં ઉદાહરણ	૧૮	૧૦૭
દાન વશીકરણ મંત્ર સમાન છે	૧૯	૧૦૭
દાનજનિત પુષ્યની રાજ્ય લક્ષ્મી સાથે તુલના	૨૦	૧૦૭
દાન વિના મનુષ્યભવની વિફળતા	૨૧-૨૨	૧૦૮
દાન રહિત વૈભવની અપેક્ષાએ તો નિર્ધનતા જ શ્રેષ્ઠ છે	૨૩	૧૦૮
દાન વિના ગૃહસ્થાશ્રમની વ્યર્થતા	૨૪-૨૫	૧૦૮
સત્પાત્રદાન પરલોક્યાત્રામાં નાશ્તા સમાન છે	૨૬	૧૧૦
દાનનો સંકલ્પ માત્ર પણ પુષ્યવર્ધક છે	૨૭	૧૧૦
પાત્ર આવતાં દાનાદિથી તેનું સંન્માન ન કરવું એ અશિષ્ટતા છે	૨૮	૧૧૦
દાન વિનાનો દિવસ પુત્રના મૃત્યુદિનથી પણ ખરાબ છે	૨૯	૧૧૧
ધર્મના નિમિત્તે થતા સર્વ વિકલ્પો દાનથી જ સફળ થાય છે	૩૦	૧૧૧
દાન વિના પણ પોતાને દાની તરીકે પ્રગટ કરનાર મહાન		
હુઃખું પાત્ર થાય છે	૩૧	૧૧૨
પોતાની સમ્પત્તિ અનુસાર ગૃહસ્થે થોડું ધાણું દાન દેવું જોઈએ	૩૨	૧૧૨
દાનની અનુમોદનાથી મિથ્યાદેષી પણ પણ ઉત્તમ ભોગભૂમિ પ્રાપ્ત કરે છે. તે	૩૩	૧૧૩
દાનરહિત મનુષ્યના અવિવેકનું ઉદાહરણ	૩૪-૩૬	૧૧૩-૧૧૪
જે ધન દાનના ઉપયોગમાં આવે છે તે જ ધન વાસ્તવમાં પોતાનું છે	૩૭	૧૧૪
ધનનો ક્ષય પુષ્યના ક્ષયથી થાય છે, નહિ કે દાનથી	૩૮	૧૧૪
લાભ બધા જ ઉત્તમ ગુણોનો ધાતક છે	૩૯	૧૧૪

વિષય	શલોક	પૃષ્ઠાંક
દાનથી જેની કીર્તિનો ફેલાવો થયો નથી તે જીવવા છતાં મૃતક સમાન છે.... ૪૦	૧૧૬	
મનુષ્યભવની સફળતા દાનમાં છે, અન્યથા ઉદ્દર્પૂર્તિ તો ફૂતરા પણ કરે છે.. ૪૧	૧૧૬	
દાન સિવાય અન્ય પ્રકારે કરવામાં આવતો ધનનો ઉપયોગ કષ્ટદાયક છે ૪૨	૧૧૭	
પ્રાણી સાથે પરલોકમાં ધર્મ જ જાય છે, નહિ કે ધન..... ૪૩	૧૧૭	
સર્વ અભિષ્ટ સામગ્રી પાત્રદાનથી જ પ્રાપ્ત થાય છે ૪૪	૧૧૮	
જે વ્યક્તિ ધનનો સંચય અને પુત્રવિવાહાદિ લક્ષ્યમાં રાખીને ભવિષ્યમાં		
દાનની ભાવના રાખે છે તેના જેવો મૂર્ખ બીજો નથી..... ૪૫	૧૧૮	
કૃપણ ગૃહસ્થથી તો કાગડો પણ સારો છે	૪૬	૧૧૮
કૃપણના ધનની સ્થિરતા ઉપર ગ્રન્થકારની કલ્પના..... ૪૭	૧૧૯	
ઉત્તમ પાત્ર આદિનું સ્વરૂપ અને તેમને આપેલા દાનનું ફળ	૪૮-૪૯.... ૧૧૯-૧૨૦	
દાનના ચાર ભેદ	૫૦	૧૨૦
જિનાલય માટે કરવામાં આવેલું ભૂમિદાન સંસ્કૃતિની સ્થિરતાનું કારણ છે ૫૧	૧૨૦	
કૃપણને દાનનો ઉપદેશ રૂચતો નથી, તે તો આસન્નભવયને જ પ્રીતિ		
ઉત્પન્ન કરે છે	૫૨-૫૩	૧૨૧
પ્રકરણના અંતે ગુરુ વીરનન્દીના ઉપકારનું સ્મરણ	૫૪	૧૨૨
૩. અનિત્યાપંચાશત્	૧-૫૫ ૧૨૩-૧૪૭	
પ્રકરણના આરંભમાં જિનનું સ્મરણ	૧	૧૨૩
શરીરનું સ્વરૂપ અને તેની અસ્થિરતા..... ૨-૩	૧૨૩-૧૨૪	
શરીરાદિ સ્વભાવથી અસ્થિર હોવાથી તેમનો હર્ષ-શોક માનવો યોગ્ય નથી... ૪-૩૦..... ૧૨૪-૧૩૫	૧૨૪-૧૩૫	
યમ સર્વત્ર વિઘમાન છે. ૩૧	૧૩૬	
ઉદ્ય પ્રાપ્ત કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે	૩૨	૧૩૬
દૈવની પ્રબળતાનું ઉદાહરણ	૩૩	૧૩૭
મૃત્યુનો ગ્રાસ થવા છતાં પણ અંગાની જીવો સ્થિરતાનો		
અનુભવ કરે છે. ૩૪-૩૧.... ૧૩૭-૧૪૦		
સંસારની પરીવર્તનશીલતા જોઈને ગર્વનો અવસર રહેતો નથી..... ૪૨-૪૩	૧૪૧	
મનુષ્ય સમ્પત્તિ માટે કેવા અનર્થ કરે છે	૪૪	૧૪૨
શોકથી થનારી હાનિનું દિગદર્શન..... ૪૫	૧૪૨	
આપત્તિસ્વરૂપ સંસારમાં વિષાદ કરવો ઉચ્ચિત નથી..... ૪૬	૧૪૩	
જીવનાદિને નશ્ચર દેખીને પણ આત્મહિત ન કરવું એ પાગલપણાનું		
સૂચક છે	૪૭	૧૪૩
મૃત્યુ પાસે કોઈ પણ પ્રયત્ન ચાલતો નથી	૪૮	૧૪૪

વિષય	શલોક	પૃષ્ઠાંક
મનુષ્ય શ્રી-પુત્રાદિમાં ‘મારા-મારા’ કરતો થકો કાળનો કોળિયો બની જાય છે.....	૪૮	૧૪૪
દિવસોને મૃત્યુ દ્વારા વિભક્ત આયુષ્યના ખંડ જ જાણવા જોઈએ.....	૪૦	૧૪૪
બીજાની તો શી વાત? ઈન્દ્ર અને ચન્દ્ર પણ મૃત્યના ગ્રાસ બને છે સંયોગ-વિયોગ અને જન્મ-મરણાદિ અવિનાભાવી છે	૪૧	૧૪૪
દેવની પ્રબળતા જોઈને ધર્મમાં રત થવું જોઈએ અનિત્ય પંચાશત્ર જયવંત હો.....	૪૨	૧૪૪
૪૩. એકત્વસપ્તતિ	૧-૮૦	૧૪૮-૧૭૦
પરમાત્મા અને ચિદાત્મક જ્યોતિને નમસ્કાર	૧-૩	૧૪૮
ચિત્તત્વ પ્રત્યેક પ્રાણીમાં છે, પણ અજ્ઞાતી તેને જાણતા નથી..... અનેક શાસ્ત્રોને જાણનાર પણ તેને કાણ્ણમાં સ્થિત	૪	૧૪૯
અનિની જેમ જાણતા નથી	૫	૧૪૯
કેટલાક સમજાવવા છીતાં પણ તેનો સ્વીકાર નથી કરતા	૬	૧૪૯
કેટલાક અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપનું એકાન્તરૂપે ગ્રહણ કરીને જન્માંધ પુરુષોની જેમ નાણ થાય છે.....	૭	૧૪૯
કેટલાક થોડુંક જાણીને પણ તેનું અમિમાન વશે ગ્રહણ કરતા નથી..... લોકોએ ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે.....	૮	૧૫૦
ક્યો ધર્મ યથાર્થ છે	૯૦	૧૫૧
ચૈતન્યનું જ્ઞાન અને તેનો સંયોગ દુર્લભ છે	૧૧	૧૫૧
ભવ્ય જીવ પાંચ લભિયાઓ પામીને મોક્ષમાર્ગમાં સ્થિત થાય છે	૧૨	૧૫૧
મુક્તિના કારણભૂત સમ્યગદર્શનાદિનું સ્વરૂપ	૧૩-૧૪	૧૫૩
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમ્યગદર્શનાદિ લિભન ન હોતાં		
અખંડ આત્મસ્વરૂપ છે.....	૧૫	૧૫૩
પ્રમાણ, નય અને નિક્ષેપ અર્વાચીન પદમાં ઉપયોગી છે	૧૬	૧૫૩
નિશ્ચય અને વ્યવહાર દર્શિમાં આત્માવલોકન.....	૧૭	૧૫૪
જે એક અખંડ આત્માને જાણો છે તે જ મુક્તિ પામે છે	૧૮-૧૯	૧૫૪
કેવળજ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા જ જાણવા દેખવા યોગ્ય છે	૨૦-૨૧	૧૫૪-૧૫૫
યોગી ગુરુ ઉપદેશથી આત્માને જાણીને કૃતકૃત્ય થઈ જાય છે	૨૨	૧૫૫
જે પ્રેમથી તે પરમ જ્યોતિની વાત પણ સાંભળો છે તે મુક્તિનું		
ભાજન ભવ્ય છે એમ સમજવું જોઈએ.....	૨૩	૧૫૫
જે કર્મથી લિભન એક આત્માને જાણે છે તે તેનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૨૪	૨૪	૧૫૫
પરનો સંબંધ બંધનું કારણ છે	૨૫	૧૫૬

વિષય	શલોક	પૃષ્ઠાંક
કર્મના અભાવમાં આત્મા એવો શાન્ત થઈ જાય છે જેવો		
વાયુના અભાવમાં સમુદ્ર ૨૬ ૧૫૬		
આત્મ-પરનો વિચાર ૨૭-૩૮ ૧૫૬-૧૫૮		
તે જ આત્મજ્યોતિ શાન-દર્શનાદિરૂપ સર્વસ્વ છે ૩૯-૫૨ ૧૬૦-૧૬૩		
મોક્ષની પણ ઈચ્છા મોક્ષપ્રાપ્તિમાં બાધક છે ૫૩ ૧૬૩		
ભવ્ય જીવે ચૈતન્યસ્વરૂપ આત્માનો વિચાર કરી જન્મપરંપરા		
નાચ કરવી જોઈએ ૫૪-૫૭ ૧૬૩-૧૬૪		
અનેક રૂપોને પ્રાપ્ત તે પરમજ્યોતિનું વર્ણન કરવું સંભવ નથી ૫૮-૬૧ ૧૬૪-૧૬૫		
જે જીવ તે આત્મતત્ત્વનો વિચાર જ કરે છે તે દેવો દ્વારા પૂજાય છે ૬૨ ૧૬૬		
સર્વજ્ઞાદેવે તે પરમજ્યોતિની પ્રાપ્તિનો ઉપાય સામ્યભાવ બતાવ્યો છે ૬૩ ૧૬૬		
સામ્યના સમાનાર્થક નામ અને તેનું સ્વરૂપ ૬૪-૬૮ ૧૬૬-૧૬૭		
સમતા-સરોવરના આરાધક આત્મ-હંસને નમસ્કાર ૭૦ ૧૬૭		
જ્ઞાની જીવને તાપકારી મૃત્યુ પણ અમૃત (મોક્ષ)ના સંગનું કારણ છે ૭૧ ૧૬૮		
વિવેક વિના મનુષ્ય પર્યાય આદિની વ્યર્થતા ૭૨ ૧૬૮		
વિવેકનું સ્વરૂપ ૭૩ ૧૬૮		
વિવેકી જીવને સંસારમાં બધું જ દુઃખરૂપ પ્રતિભાસે છે ૭૪ ૧૬૮		
વિવેકી જીવને હેય શું છે અને ઉપાદેય શું છે? ૭૫ ૧૬૯		
હું કયા સ્વરૂપે છું ૭૬ ૧૬૯		
એકત્વ સપ્તતિને ગંગા નદીની ઉપમા ૭૭ ૧૬૯		
તે એકત્વ સપ્તતિ સંસાર-સમુદ્રથી પાર થવામાં પુલ સમાન છે ૭૮ ૧૬૯		
મને કર્મ અને તત્કૃત વિકૃતિ આદિ સર્વ આત્માથી ભિન્ન પ્રતિભાસે છે ૭૯ ૧૭૦		
એકત્વ સપ્તતિના અભ્યાસ આદિનું ફળ ૮૦ ૧૭૦		
પ. યતિભાવનાષ્ટક	૧-૮	૧૭૧-૧૭૪
મોહકર્મજનિત વિકલ્પોથી રહિત મુનિ જયવંત હો ૧ ૧૭૧		
મુનિ શું વિચાર કરે છે ૨-૪ ૧૭૧-૧૭૨		
કૃતિ કોણ કહેવાય છે ૫ ૧૭૨		
અતુ વિશેષ અનુસાર કષ્ટ સહન કરનાર શાન્ત મુનિઓના		
માર્ગ જવાની અભિલાષા ૬ ૧૭૩		
ઉત્કૃષ્ટ સમાધિનું સ્વરૂપ અને તેના ધારક ૭ ૧૭૩		
અંતસ્તત્વના જ્ઞાતા તે મુનિ આપણને શાન્તિનું નિમિત્ત થાવ ૮ ૧૭૪		
યતિભાવનાષ્ટકના અભ્યાસનું ફળ ૮ ૧૭૪		

વિષય	શલોક	પૃષ્ઠાંક
૬. ઉપાસક સંસ્કાર		૧-૬૨ ૧૭૫-૧૮૨
ધર્મસ્થિતિના કારણભૂત આદિ જિનેજ અને શ્રેયાંસ રાજાનું સમરણ ૧	૧૭૫	
ધર્મનું સ્વરૂપ ૨	૧૭૫	
દીર્ઘતર સંસાર કોનો છે? ૩	૧૭૫	
ધર્મના બે ભેદ અને તેના સ્વામી ૪	૧૭૬	
ગૃહસ્થ ધર્મના હેતુ કેમ મનાય છે? ૫	૧૭૬	
કળિકાળમાં, જિનાલય, મુનિઓની સ્થિતિ અને દાનધર્મનું		
મૂળ કારણ શ્રાવક છે ૬	૧૭૬	
ગૃહસ્થોના છ કર્મ ૭	૧૭૬	
સામાયિક પ્રતનું સ્વરૂપ ૮	૧૭૬	
સામાયિક માટે સાત વ્યસનોનો ત્યાગ આવશ્યક ૯-૧૦	૧૭૭	
વ્યસનીને ધર્માન્વેષણની યોગ્યતા હોતી નથી ૧૧	૧૭૭	
સાત નરકોએ જાણે પોતાની સમૃદ્ધિ માટે એક એક		
વ્યસનની નિમણૂંક કરી છે ૧૨	૧૭૭	
પાપરૂપ રાજાએ ધર્મશરૂના વિનાશ માટે પોતાનું રાજ્ય સાત		
વ્યસનો વડે સાત અંગરૂપ બનાવ્યું છે ૧૩	૧૭૮	
ભક્તિથી જિનદર્શનાદિ કરનાર સ્વયં વંદનીય થઈ જાય છે ૧૪	૧૭૮	
જિનદર્શનાદિ ન કરનારાઓનું જીવવું વ્યર્થ છે ૧૫	૧૭૮	
ઉપાસકોએ પ્રાતઃકાળે અને ત્યારપછી શું કરવું જોઈએ ૧૬-૧૭	૧૭૮-૧૭૯	
જ્ઞાન-લોચનની પ્રાપ્તિના કારણભૂત ગુરુઓની ઉપાસના ૧૮-૧૯	૧૭૯	
ચક્ષુ અને કાન સહિત હોવા છતાં પણ આંધળા અને બહેરા કોણ છે ૨૦-૨૧	૧૭૯-૧૮૦	
દેશવત સફળ કર્યારે થાય છે ૨૨	૧૮૦	
આઠ મૂળગુણો અને બાર ઉત્તર ગુણોનો નિર્દેશ ૨૩-૨૪	૧૮૦-૧૮૧	
પર્વોમાં શું કરવું જોઈએ ૨૫	૧૮૨	
શ્રાવકે એવા દેશાદ્ધિનો આશ્રય ન કરવો જોઈએ કે જ્યાં સમ્યક્ત		
અને પ્રત સુરક્ષિત ન રહી શકે ૨૬	૧૮૨	
ભોગોપભોગપરિમાણની વિધેયતા ૨૭	૧૮૩	
રત્નત્રયનું પાલન એવી રીતે કરવું કે જેથી જન્માન્તરમાં		
તત્વશ્રદ્ધાન વૃદ્ધિગત થાય ૨૮	૧૮૩	
ઉપાસકે યથાયોગ્ય પરમેષ્ઠા, રત્નત્રય અને તેના ધારકોનો		
વિનય કરવો જોઈએ ૨૯	૧૮૩	
વિનયને મોક્ષનું દ્વાર કહેવામાં આવે છે ૩૦	૧૮૩	

વિષય	શલોક	પૃષ્ઠાંક
ઉપાસકે દાન પણ કરવું જોઈએ	૩૧	૧૮૪
દાન વિના ગૃહસ્થ જીવન કેવું છે	૩૨-૩૪	૧૮૪-૧૮૫
સાધમીઓમાં વાત્સલ્ય વિના ધર્મ સંભવતો નથી	૩૬	૧૮૫
દ્યા વિના ધર્મ સંભવતો નથી	૩૭	૧૮૫
દ્યાનો મહિમા	૩૮-૩૯ ...	૧૮૫-૧૮૬
મુનિ અને શ્રાવકોના ત્રત એક માત્ર અહિંસાની સિદ્ધિ માટે છે	૪૦	૧૮૬
કેવળ પ્રાણી પીડન જ પાપ નથી, પરંતુ તેનો સંકલ્પે ય પાપ છે	૪૧	૧૮૬
બાર અનુપ્રેક્ષાઓનું સ્વરૂપ અને તેમના ચિંતનની પ્રેરણા	૪૨-૪૮ ...	૧૮૬-૧૯૧
દસ બેદરૂપ ધર્મના સેવનની પ્રેરણા	૪૯	૧૯૧
મોક્ષપ્રાપ્તિ માટે અંતસ્તાત્વ અને બહિસ્તાત્વ બન્નેનો જ આશ્રય લેવો જોઈએ .	૬૦	૧૯૧
આત્માનું સ્વરૂપ અને તેના ચિંતનની પ્રેરણા	૬૧	૧૯૧
ઉપાસક સંસ્કારના અનુષ્ઠાનથી અતિશય નિર્મળ ધર્મની પ્રાપ્તિ થાય છે	૬૨	૧૯૨
૭. દેશવ્રતોધોત્તન		૧-૨૭ . ૧૯૩-૨૦૪
ધર્મોપદેશમાં સર્વજ્ઞા જ વચન પ્રમાણ છે	૧	૧૯૩
સમ્યગદાસ્તિ એક હોય તોપણ પ્રશંસનીય છે, મિથ્યાદાસ્તિ ધારણા		
હોય તો પણ નહીં	૨	૧૯૩
મોક્ષવૃક્ષનું બીજ સમ્યગદર્શન અને સંસારવૃક્ષનું બીજ મિથ્યાદર્શન છે	૩	૧૯૪
દેશવ્રત કઈ અવસ્થામાં ગ્રહણ કરવું યોગ્ય છે	૪	૧૯૪
ઉપાસક દ્વારા અનુષ્ઠાય સમસ્ત ત્રતવિધાન	૫	૧૯૪
પ્રતી ગૃહસ્થનું સ્વરૂપ	૬	૧૯૪
દેશવ્રતીના દેવારાધનાદિ કાર્યોમાં દાન પ્રમુખ છે	૭	૧૯૪
આહારાદિ ચતુર્વિધ દાનનું સ્વરૂપ અને તેની આવશ્યકતા	૮-૧૧	૧૯૬-૧૯૭
સર્વ દાનોમાં અભયદાન મુખ્ય કેમ છે	૧૧-૧૨ ...	૧૯૭-૧૯૮
પાપથી ઉપર્જિત ધનનો સદૃપ્યોગ દાન છે	૧૩-૧૪	૧૯૮
પાત્રોના ઉપર્યોગમાં આવનારું ધન જ સુખપ્રદ છે	૧૪	૧૯૯
દાન પરંપરાએ મોક્ષનું પણ કારણ છે	૧૬-૧૭ ...	૧૯૯-૨૦૦
જિનદર્શનાદિ વિના ગૃહસ્થાશ્રમ પથ્થરની નાવ જેવો છે	૧૮	૨૦૦
દાતા ગૃહસ્થ ચિન્તામણિ આદિથી શ્રેષ્ઠ છે	૧૯	૨૦૦
ધર્મસ્થિતિની કારણભૂત જિનપ્રતિમા અને જિનભવનના નિર્માણની આવશ્યકતા	૨૦-૨૩ ...	૨૦૧-૨૦૨
અણુવતો ધારણ કરવાથી સ્વર્ગ-મોક્ષ પ્રાપ્ત થાય છે	૨૪	૨૦૩

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગાઠ - ૩૬૪૨૫૦

[૧૫]

વિષય	શલોક	પૃષ્ઠાંક
ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉપાદેય અને બાકીના હેય છે	૨૫	૨૦૩
અશુત્રતો અને મહાશ્રતોથી એક માત્ર મોક્ષ જ સાધ્ય છે.....	૨૬	૨૦૪
દેશપ્રતોદોતન જ્યવંત હો.....	૨૭	૨૦૪
૮. સિદ્ધ સ્તુતિ	૧-૨૮	૨૦૫-૨૧૮
અવિધિજ્ઞાનીઓને પણ અવિધયભૂત સિદ્ધોનું વર્ણન અશક્ય છે	૧	૨૦૫
નમસ્કારપૂર્વક સિદ્ધો પાસે મંગળ યાચના	૨-૪	૨૦૫-૨૦૬
આત્માને સર્વવ્યાપક કેમ કહેવામાં આવે છે	૫	૨૦૭
આઠ કર્મોના ક્ષયથી પ્રગટ થનાર ગુણોનો નિર્દેશ	૬	૨૦૭
કર્માની દુઃખપ્રદત્તા	૭	૨૦૮
જ્યારે એકેન્દ્રિયાદિ જીવ પણ ઉત્તરોત્તર હીન કર્માવરણથી		
અધિક સુખ અને જ્ઞાનથી સંયુક્ત છે, તો કર્મથી સર્વથા		
રહિત સિદ્ધ પૂર્ણ સુખ અને જ્ઞાન સંયુક્ત કેમ ન હોય?	૮-૧૦	૨૦૮-૨૦૯
કર્મજન્ય કુધા આદિના અભાવમાં સિદ્ધ સંદાય તૃપ્ત રહે છે.....	૧૧	૨૧૦
સિદ્ધજ્યોતિના આરાધનથી યોગી સ્વયં પણ સિદ્ધ થઈ જાય છે	૧૨	૨૧૦
સિદ્ધજ્યોતિની વિવિધરૂપતા	૧૩	૨૧૧
અનેકાત સિદ્ધાન્તનું અવગાહન કરનાર જ સિદ્ધાત્માનું રહસ્ય		
જાગ્રી શકે છે	૧૪	૨૧૧
તત્ત્વજ્ઞ અને અતત્ત્વજ્ઞની દેશ્ચિ કઈ રીતે શુદ્ધ અને અશુદ્ધ પદ કરે છે	૧૫-૧૭	૨૧૨-૨૧૩
સાંગ્રોપાંગ શુતના અભ્યાસનું ફળ સિદ્ધત્વની પ્રાપ્તિ છે	૧૮	૨૧૩
આ સિદ્ધોનું વર્ણન મારે માટે મોક્ષમહેલ ઉપર ચડવા માટે		
નિસરણી જેવું છે	૧૯	૨૧૪
મુક્તાત્મસ્વરૂપ તેજનું સ્વરૂપ	૨૦	૨૧૪
નય-નિક્ષેપાદિના આશ્રિત વિવરણ રહિત સિદ્ધ જ્યવંત હો	૨૧	૨૧૪
સિદ્ધસ્વરૂપના જાગ્રાકાર સાચ્ચાજ્ઞયને પણ તૃપ્ત સમાન તુચ્છ સમજે છે	૨૨	૨૧૪
સિદ્ધોનું સ્મરણ કરનાર પણ વંદનીય છે	૨૩	૨૧૫
બુદ્ધિમાનોમાં અગ્રણી કોણ છે, એ માટે બાળનું ઉદાહરણ	૨૪	૨૧૬
સિદ્ધાત્મજ્ઞાનથી શૂન્ય શાચ્ચાન્તરોનું જ્ઞાન વર્થ છે	૨૫	૨૧૬
અનંત જ્ઞાન-દર્શનથી સમ્પન્ન સિદ્ધો પાસે શિવસુખની યાચના	૨૬	૨૧૭
આત્માને ગૃહની ઉપમા	૨૭	૨૧૭
સિદ્ધોની જ ગતિ આદિ અભીષ્ટ છે	૨૮	૨૧૮
સિદ્ધોની આ સુતિ કેવળ ભક્તિવશ કરવામાં આવી છે	૨૯	૨૧૮

વિષય	શલોક	પૃષ્ઠાંક
E. આલોચના	૧-૩૩	૨૧૮-૨૩૩
મનથી પરમાત્મસ્વરૂપનું ચિંતન કરતાં અભીષ્ટની પ્રાપ્તિમાં બાધા		
આવી શક્તી નથી ૧ ૨૧૮		
સત્પુરુષો જિનચરણોની આરાધના કેમ કરે છે ૨ ૨૧૮		
જિનસેવાથી સંસાર-શત્રુનો ભય રહેતો નથી ૩ ૨૨૦		
ત્રણો લોકોમાં સારભૂત એક પરમાત્મા જ છે ૪ ૨૨૦		
અનન્ત ચતુષ્ય સ્વરૂપ પરમાત્માને જાડી લીધા પછી કાંઈ		
જાણવાનું બાડી રહેતું નથી ૫ ૨૨૦		
એક માત્ર પરમાત્માને શરણો જવાથી બધું જ સિદ્ધ થાય છે ૬ ૨૨૧		
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનારૂપ નવ સ્થાનો		
દ્વારા કરવામાં આવેલું પાપ મિથ્યા થાવ ૭ ૨૨૧		
સર્વજ્ઞ જિન જાણતા હોવા છતાં પણ દોષોની આલોચના		
આત્મશુદ્ધિ માટે કરવામાં આવે છે ૮-૯ ૨૨૨		
આગમાનુસાર અસંખ્યાતનું પ્રાયશ્ચિત સંભવ નથી ૧૦ ૨૨૨		
જ નિસ્પૃહતાપૂર્વક ભગવાનને ઠેખે છે તે ભગવાનની નિકટ		
પહોંચી જાય છે ૧૧ ૨૨૩		
મનનું નિયંત્રણ અતિશય કઠણ છે ૧૨-૧૪ ૨૨૩-૨૩૪		
મન ભગવાન સિવાય બાબુ પદાર્થો તરફ કેમ જાય છે ૧૫ ૨૨૫		
સર્વ કર્મોમાં મોહ જ અતિશય બળવાન છે ૧૬ ૨૨૫		
જગતને ક્ષણભંગુર જોઈને મન પરમાત્મા તરફ લગાડવું જોઈએ ૧૭ ૨૨૬		
અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગનું કાર્ય ૧૮ ૨૨૬		
હું જે જ્યોતિસ્વરૂપ છું તે કેવી છે? ૧૯ ૨૨૭		
જીવ અને પરમાત્મા વચ્ચે ભેદ કરનાર કર્મ છે ૨૦ ૨૨૭		
શરીર અને તેનાથી સંબંધ ઈન્દ્રિયો તથા રોગ આદિ પુદ્ગલસ્વરૂપ		
છે જે આત્માથી સર્વથા ભિન્ન છે ૨૧-૨૪ ૨૨૮-૨૨૯		
ધર્માદિ પાંચ દ્રવ્યોમાં એક પુદ્ગલ જ રાગ-દ્રેષને વશે કર્મ-નોકર્મરૂપ		
થઈને જીવનું અહિત કર્યા કરે છે ૨૫-૨૬ ૨૨૯-૨૩૦		
સાચું સુખ બાબુ વિકલ્પો છોડીને આત્મસન્મુખ થવાથી થાય છે ૨૭-૨૮ ૨૩૦		
વાસ્તવમાં દેટબુદ્ધિ જ સંસાર અને અદેત જ મોક્ષ છે ૨૯ ૨૩૧		
આ કણિકાળમાં ચારિત્રનું પરિપાલન ન થઈ શકવાથી આપની		
ભક્તિ જ સંસારમાંથી મારો ઉદ્ધાર કરે ૩૦ ૨૩૧		

વિષય	શલોક	પૃષ્ઠાંક
મુક્તિપ્રદ મોક્ષમાર્ગ પૂર્ણ કરવાની પ્રાર્થના.....	૩૧	૨૩૨
વીરનાની ગુરુના સહુપદેશથી મને ત્રણ લોકનું રાજ્ય પણ અભીષ્ટ નથી	૩૨	૨૩૨
આલોચનાના અભ્યાસનું ફળ	૩૩	૨૩૨
૧૦. સદ્ગોધયન્દોદય	૧-૫૦	૨૩૪-૨૪૬
અપરિમિત અને અનિર્વચનીય અનેક ધર્માત્મક ચિત્તત્વ જ્યવંત હો	૧-૨	૨૩૪
મુક્તિ-હંતીના અભિલાષી હંસને નમસ્કાર	૩	૨૩૫
ચિત્સ્વરૂપનો મહિમા	૪-૭	૨૩૫-૨૩૬
મન પોતાના મરણના ભયથી પરમાત્મામાં સ્થિત થતું નથી	૮	૨૩૬
અજ્ઞાની આત્મગત તત્ત્વને અન્યત્ર દેખે છે	૯-૧૦	૨૩૭
પ્રતીતિ રહિત તપસ્વી નાટકના પાત્ર જેવા છે	૧૧	૨૩૭
ભવભ્રમણનું કારણ અનેક ધર્માત્મક ચિત્તત્વને અંધ-હસ્તિ-ન્યાયથી		
જાણવું તે છે	૧૨	૨૩૮
આત્માની અનેકધર્માત્મકતા	૧૩-૧૪	૨૩૮
સ્વાભાવિક ચેતનાના આશ્રયે જીવ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે	૧૫	૨૩૯
આત્મસરૂપની પ્રાપ્તિનો ઉપાય	૧૬-૨૦	૨૩૯-૨૪૦
યોગીને સુખ-દુઃખની કલ્પના કેમ નથી થતી	૨૧	૨૪૦
મનની ગતિ નિરાલંબ થતાં અજ્ઞાન બાધક થતું નથી	૨૨	૨૪૦
રોગ અને જરા આદિ શરીરાશ્રિત છે, આત્માશ્રિત નથી	૨૩-૨૪	૨૪૧
યોગનો મહિમા	૨૬	૨૪૧
આત્માનું રમણીય પદ શુદ્ધ બોધ છે	૨૭	૨૪૨
આત્મબોધરૂપ તીર્થમાં સ્નાન કરવાથી અભ્યંતર મળ નાચ થાય છે	૨૮	૨૪૨
ચિત્ત સમુદ્રના તટના આરાધનથી રત્નોનો સંચય અવશ્ય થાય છે	૨૯	૨૪૨
સમ્યગદર્શનાદિરૂપ રત્નત્રય નિશ્ચયથી એક જ છે	૩૦	૨૪૩
સમ્યગદર્શનાદિરૂપ બાળોનું ફળ	૩૧	૨૪૩
મુનિની વૃત્તિ કેવી હોય છે	૩૨	૨૪૪
સમીચીન સમાધિનું ફળ	૩૩-૩૪	૨૪૪
યોગની કલ્પવૃક્ષ સાથે સમાનતા	૩૫	૨૪૪
જ્યાં સુધી પરમાત્મબોધ થતો નથી ત્યાં સુધી જ શુતનું પરિશીળન હોય છે ...	૩૬	૨૪૫
ચિત્રદીપ મોહાન્યકારનો કચારે નાશ કરે છે	૩૭	૨૪૫
બાદ શાસ્ત્રોમાં વિચરનારી બુદ્ધિ દુરાચારિણી શ્રી જેવી છે	૩૮	૨૪૫
ગુરુના ઉપદેશનો પ્રભાવ	૩૯-૪૦	૨૪૬

વિષય	શલોક	પૃષ્ઠાંક
યોગસિદ્ધિનું કારણ સામ્યભાવ છે	૪૧	૨૪૬
પરમાત્માનું કેવળ નામસ્મરણ પણ અનેક જન્મોના પાપ નાચ કરે છે	૪૨	૨૪૬
યોગીનાયક કોણ?	૪૩	૨૪૭
યોગીએ સ્વ-પરને સમાન દેખવા જોઈએ.....	૪૪	૨૪૭
અજ્ઞાનીના વિકારો દેખીને યોગી કૃષ્ણ થતા નથી	૪૫	૨૪૭
આ શાસ્ત્ર ભાગવાથી પ્રબોધ પ્રાપ્ત થાય છે	૪૬	૨૪૭
પદ્મનાન્દીરૂપ ચન્દ્રથી કરવામાં આવેલી રમણીયતા જ્યવંત હો.....	૪૭	૨૪૮
યોગીનું સ્વરૂપ	૪૮	૨૪૮
ગુરુદ્વારા ઉપદિષ્ટ તત્ત્વ હદ્યસ્થ થતાં મને કોઈનો ભય નથી.....	૪૯	૨૪૮
સદ્ગોધયન્નોદ્ય જ્યવંત હો	૫૦	૨૪૯
૧૧. નિશ્ચયપંચાશત્	૧-૬૨	૨૫૦-૨૬૭
ચિન્મયજ્યોતિ જ્યવંત હો.....	૧-૩	૨૫૦
મોહાન્ધકારના નાશક ગુરુ જ્યવંત હો.....	૪	૨૫૧
સાયું સુખ દુઃસાધ્ય મુક્તિમાં છે	૫	૨૫૧
શુદ્ધ આત્મજ્યોતિની ઉપલબ્ધ સુલભ નથી	૬	૨૫૧
આત્મબોધની અપેક્ષાએ તેનો અનુભવ વિશેષ દુર્લભ છે	૭	૨૫૧
વ્યવહાર અને શુદ્ધનયનું સ્વરૂપ અને તેમનું પ્રયોજન	૮-૧૦	૨૫૨
મુખ્ય અને ઉપચાર વિવરણોને જાણવાના ઉપાયભૂત હોવાથી જ		
વ્યવહાર પૂજ્ય છે	૧૧	૨૫૨
રત્નત્રયનું સ્વરૂપ અને તેનું આત્મા સાથે અભિનન્પણું	૧૨-૧૪	૨૫૩
સમ્યાદર્શનાદિરૂપ બાળોની સફળતા	૧૫	૨૫૩
સમ્યાજ્ઞાન વિના સાધુ વનમાં સ્થિત વૃક્ષની જેમ સિદ્ધ થઈ શકતા નથી ...	૧૬	૨૫૪
શુદ્ધનયનિષ્ઠ કોણ હોય છે	૧૭	૨૫૪
શુદ્ધ અને અશુદ્ધ નયોનું કાર્ય	૧૮	૨૫૪
રત્નત્રયની પૂર્ણતા થતાં જન્મપરંપરા ચાલુ રહી શકતી નથી	૧૯	૨૫૫
ચિત્તતરણા નાશનો ઉપાય	૨૦	૨૫૫
કર્મરૂપ ક્રીયડ બેદશાહનરૂપ કંતકફળથી નાચ થાય છે	૨૧	૨૫૫
શરીર, તદાશ્રિત રોગાદિ અને કર્મકૃત કોધાદિ વિકારોની આત્માથી બિન્નતા	૨૨-૨૪	૨૫૫-૨૫૮
સર્વ ચિન્તા ત્યાજ્ય છે, આ બુદ્ધિ દ્વારા આવિષ્કૃત તત્ત્વ		
ચૈતન્ય-સમુદ્રને શીંઘ વધારે છે	૩૫	૨૫૮
મારું સ્વરૂપ આવું છે	૩૬	૨૫૮
બન્ધના કારણભૂત મનના નિયંત્રણથી તે, તે બંધનથી મુક્ત કરી દેશે	૩૭	૨૫૮

વિષય	શલોક	પૃષ્ઠાંક
મનુષ્યરૂપી વૃક્ષને પામીને અમૃત-ફળ ગ્રહણ કરવું યોગ્ય છે	૩૮	૨૬૦
યોગીઓનું નિર્દોષ મન અજ્ઞાનાંધકારને નષ્ટ કરે છે	૩૯	૨૬૦
યોગી ક્યારે સિદ્ધ થાય છે	૪૦	૨૬૧
આત્મસ્વરૂપનો વિચાર	૪૧-૬૦	૨૬૧-૨૬૬
નિશ્ચય પંચાશત્ક રચવાનો ઉલ્લેખ	૬૧	૨૬૭
ચિત્તમાં આત્મતત્ત્વ સ્થિત હોતાં ઈન્દ્રની સંપદાનું પ્રયોજન રહેતું નથી.....	૬૨	૨૬૭
૧૨. બ્રહ્મચર્યરક્ષાવર્તિ	૧-૨૨	૨૬૮-૨૭૭
કામવિજેતા યતિઓને નમસ્કાર	૧	૨૬૮
બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓનું સ્વરૂપ	૨	૨૬૮
જો બ્રહ્મચર્યની બાબતમાં સ્વજ્ઞમાં કોઈ દોષ ઉત્પન્ન હોય તો પણ		
રાત્રિ વિભાગાનુસાર મુનિએ તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ	૩	૨૬૮
બ્રહ્મચર્યની રક્ષા મનના સંયમથી જ થાય છે	૪	૨૬૮
બાધ્ય અને અભ્યંતર બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેમનું કાર્ય	૫	૨૭૦
પોતાના પ્રતોની વિધિના રક્ષણ માટે મુનિએ સ્વી માત્રનો		
પરિત્યાગ કરવો જોઈએ	૬	૨૭૦
સ્વીની વાર્તા પણ મુનિધર્મને નષ્ટ કરનાર છે	૭	૨૭૦
રાગપૂર્વક સ્વીમુખનું અવલોકન અને સમરણ પ્રતિષ્ઠા, યશ અને		
તપ આદિને નષ્ટ કરનાર છે	૮-૯	૨૭૧
મુનિને કોઈ પણ સ્વીની પ્રાપ્તિની સંભાવના ન રહેવાથી તદ્વિષયક		
અનુરૂગ છોડવો જ જોઈએ	૧૦	૨૭૨
શ્રાવક સ્વીરૂપ ગૃહથી ગૃહસ્થ અને મુનિ તેના પરિત્યાગથી		
બ્રહ્મચારી (અજગાર) થાય છે	૧૧	૨૭૨
સ્વીનું અસ્થિર સૌન્દર્ય મૂર્ખ મનુષ્યોને જ આનંદજનક થાય છે	૧૨-૧૪	૨૭૩
સ્વીનું શરીર ધૂણાસ્પદ છે	૧૫	૨૭૪
સ્વીના વિષયમાં અનુરૂગવર્ધક કાવ્ય રચનાર કવિ કેવી રીતે		
પ્રશંસનીય કહેવાય?	૧૬-૧૭	૨૭૪-૨૭૫
જો પરધનરૂપ સ્વીની અભિલાષા ન કરનાર ગૃહસ્થ દેવ કહેવાય છે		
તો મુનિ કેમ દેવોનો દેવ ન હોય?	૧૮	૨૭૫
સુખ અને સુખાભાસ	૧૯	૨૭૫
સ્વીનો પરિત્યાગ કરનાર સાધુઓને પુણ્યાત્મા મનુષ્યો પણ નમસ્કાર કરે છે ૨૦	૨૦	૨૭૬
તપનું અનુષ્ઠાન મનુષ્ય પર્યાયમાં જ સંભવ છે	૨૧	૨૭૬

વિષય	શલોક	પૃષ્ઠાંક
ગ્રન્થકાર દ્વારા કામરોગની નાશકબતી (બ્રહ્મચર્યરક્ષાબતી)ના સેવનની પ્રેરણા ૨૨	૨૭૭	
૧૩. ઋષભ સ્તોત્ર	૧-૬૧	૨૭૮-૨૯૬
નામિરાજના પુત્ર ઋષભ જિનેન્દ્ર જ્યવંત હો.....	૧	૨૭૮
ઋષભ જિનેન્દ્રના દર્શનાદિ પુણ્યાત્મા જ્ઞાતો દ્વારા જ કરવામાં આવે છે	૨	૨૭૮
જિનદર્શનનું માણાત્મ્ય	૩	૨૭૮
જિનેન્દ્રની સુતિ કરવી અસંભવ છે	૪	૨૭૯
જિનના નામસ્મરણથી પણ અભીષ્ટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.....	૫	૨૭૯
ઋષભ જિનેન્દ્ર સર્વાર્થસિદ્ધમાંથી અવતીર્ણ થતાં તેનું		
સૌભાગ્ય નષ્ટ થઈ ગયું હતું	૬	૨૭૯
પૃથ્વીની 'વસુમતી' નામની સાર્થકતા.....	૭	૨૮૦
પુત્રવતી શ્રીઓમાં મરુદેવીની શ્રેષ્ઠતા	૮	૨૮૦
ઈન્દ્રના નિનિમેષ સહસ્ર નેત્રોની સફળતા	૯	૨૮૦
સૂર્ય આદિ જ્યોતિષી મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે	૧૦	૨૮૧
મેરુ ઉપર જન્માભિષેક	૧૧-૧૨	૨૮૧
કલ્પવૃક્ષો નષ્ટ થઈ જતાં તેમનું કાર્ય એક ઋષભજિનેન્દ્ર જ પૂર્ણ કર્યું	૧૩	૨૮૧
પૃથ્વીની રોમાંચકતા	૧૪	૨૮૨
ઋષભજિનેન્દ્રની વિરક્તતા અને પૃથ્વીનો પરિત્યાગ	૧૫-૧૬	૨૮૨-૨૮૩
ધ્યાનમાં અવસ્થિત ઋષભ જિનેન્દ્રની શોભા	૧૭-૧૮	૨૮૩
ધાતિયતુષ્કનો ક્ષય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ	૧૯	૨૮૪
ધાતિયતુષ્કના અભાવમાં અધાતિ ચતુષ્કની અવસ્થા	૨૦	૨૮૪
સમવસરણ અને ત્યાં સ્થિત જિનેન્દ્રની શોભા	૨૧-૨૨	૨૮૪
આઠ પ્રાતિહાર્યોની શોભા	૨૩-૩૦	૨૮૫-૨૮૭
જિનવાણીનો મહિમા	૩૧-૩૪	૨૮૮-૨૮૯
નયોનો પ્રભાવ	૩૫	૨૮૯
જિનેન્દ્રની સુતિમાં બૃહસ્પતિ આદિ પણ અસમર્થ છે	૩૬	૨૯૦
પ્રભુ દ્વારા પ્રકાશિત પથના પથિક નિરૂપદ્રવ મોક્ષનો લાભ કરે છે	૩૭	૨૯૦
મોક્ષનિધિ સામે અન્ય સર્વ નિવિઓ તુચ્છ છે	૩૮	૨૯૦
જિનેન્દ્રોક્ત ધર્મની અન્ય ધર્મ કરતાં વિશેષતા	૩૯-૪૦	૨૯૦
જિનના નખ-કેશ ન વધવામાં ગ્રન્થકારની કલ્યાણ	૪૧	૨૯૧
ત્રણો લોકના જનો અને ઈન્દ્રનું નેત્ર દ્વારા જિનેન્દ્રદર્શન	૪૨-૪૩	૨૯૧
દેવો દ્વારા પ્રભુચરણોની નીચે સુવર્ણકમળોની રચના	૪૪	૨૯૨

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

[૨૧]

વિષય	શલોક	પૃષ્ઠાંક
મૃગે ચન્દ્ર (મૃગાંક)નો આશ્રય કેમ લીધો?	૪૫	૨૮૨
કમળા કમળમાં નહિ પણ જિનચરણોમાં રહે છે	૪૬	૨૮૨
જિનેન્દ્રના દેખીઓનો અપરાધ પોતાનો છે	૪૭	૨૮૨
જિનેન્દ્રની સુતિ અને નમસ્કારનો પ્રભાવ	૪૮-૫૦	૨૮૩
બ્રહ્મા વિષ્ણુ આદિ નામ આપના જ છે	૫૧	૨૮૩
જિનેન્દ્રનો મહિમા	૫૨-૫૭	૨૮૪-૨૮૫
જિનેન્દ્રની સુતિ શક્ય નથી	૫૮-૫૯	૨૮૫-૨૮૬
સુતિના અંતે જિનચરણોના પ્રસાદની પ્રાર્થના	૬૦	૨૮૬
૧૪. જિનદર્શનસ્તવન	૧-૩૪	૨૬૭-૩૦૪
(જિનદર્શનનો મહિમા)		
૧૫. શ્રુતદેવતા સુતિ	૧-૩૧	૩૦૬-૩૧૬
સરસ્વતીના ચરણ કમળ જયવંત હો	૧	૩૦૬
સરસ્વતીના પ્રસાદથી તેના સ્તવનની પ્રતિજ્ઞા અને પોતાની અસમર્થતા	૨-૪	૩૦૬-૩૦૭
સરસ્વતીની દીપકથી વિશેષતા	૫	૩૦૭
સરસ્વતીના માર્ગની વિશેષતા	૬	૩૦૮
સરસ્વતીના પ્રભાવથી મોક્ષપદ પણ શીંગ પ્રાપ્ત થઈ જાય છે	૭	૩૦૮
સરસ્વતી વિના શાનની પ્રાપ્તિ સંભવ નથી	૮-૯	૩૦૯
સરસ્વતી વિના પ્રાપ્ત મનુષ્ય પર્યાય એમને એમ જ નાશ પામે છે	૧૦	૩૦૯
સરસ્વતીની પ્રસન્નતા વિના તત્ત્વનિશ્ચય થતો નથી	૧૧	૩૦૯
મોક્ષપદ સરસ્વતીના આશ્રયથી જ પ્રાપ્ત થાય છે	૧૨-૧૩	૩૧૦
સરસ્વતીનો અન્ય પણ મહિમા	૧૪-૨૮	૩૧૦-૩૧૫
કાવ્ય રચનામાં સરસ્વતીનો પ્રસાદ જ કામ કરે છે	૨૯	૩૧૬
સરસ્વતીનું આ સ્તોત્ર ભષવાનું ફળ	૩૦	૩૧૬
સરસ્વતીના સ્તવનમાં અસમર્થ હોવાથી ક્ષમા યાચના	૩૧	૩૧૬
૧૬. સ્વયંભૂસુતુતિ	૧-૨૪	૩૧૦-૩૨૪
(ઋષભાદિ મહાવીરાજ તીર્થકરોનું ગુણકીર્તન)		
૧૭. સુપ્રભાતાટક	૧-૮	૩૨૫-૩૨૯
ધાતિકર્મોનો નાશ કરીને સ્થિર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રને નમસ્કાર ૧	૩૨૫	૩૨૫
જિનેન્દ્રના સુપ્રભાતના સ્તવનની પ્રતિજ્ઞા	૨	૩૨૫
અહીંતું પરમેષ્ઠિના સુપ્રભાતનું સ્વરૂપ અને તેની સુતિ	૩-૮	૩૨૬-૩૨૮

વિષય	શલોક	પૃષ્ઠાંક
૧૮. શાન્તિનાથ સ્તોત્ર	૧-૬	૩૩૦-૩૩૪
ત્રણ છિન્નાદિરૂપ આઠ પ્રાતિહાર્યોના આશ્રયથી ભગવાન (શાન્તિનાથ તીર્થકરની સુતિ)	૧-૮	૩૩૦-૩૩૩
જે સુતિ ઈન્જ્રાદિ પણ કરી શકતા નથી તે મેં ભક્તિવશ કરી છે	૮	૩૩૪
૧૯. જિનપૂજાષક	૧-૧૦	૩૩૫-૩૩૬
જળ, ચંદનાદિ આઠ દ્રવ્યો વડે પૂજા અને તેના ફળનો ઉલ્લેખ	૧-૮	૩૩૫-૩૩૮
પુણ્યાંજલિ આપવી.....	૮	૩૩૮
વીતરાગજિનની પૂજા કેવળ આત્મકલ્યાણ માટે કરવામાં આવે છે	૧૦	૩૩૮
૨૦. કરણાષક	૧-૮	૩૪૦-૩૪૨
(પોતાની ઉપર દયા કરીને જન્મપરંપરાથી મુક્ત કરવાની પ્રાર્થના)		
૨૧. કિયાકંડચૂલિકા	૧-૮	૩૪૩-૩૪૦
દોષોએ જિનેન્દ્રમાં સ્થાન ન પામીને જાણો ગર્વથી જ તેમને છોડી દીધા ૧	૧	૩૪૩
સુતિ કરવાની અસમર્થતા પ્રગટ કરીને ભક્તિની પ્રમુખતા અને તેનું ફળ ... ૨-૭	૨-૭	૩૪૩-૩૪૫
રત્નત્રયની યાચના.....	૮	૩૪૬
આપના ચરણ-કમળ પામીને હું કૃતાર્થ થઈ ગયો	૮	૩૪૬
અભિમાન કે પ્રમાદવશ થઈને જે રત્નત્રય આદિ વિષયમાં અપરાધ થયો છે તે મિથ્યા હો	૧૦	૩૪૭
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનાથી જે પ્રાણીઓને પીડા થઈ છે તે મિથ્યા હો	૧૧	૩૪૭
મન, વચન અને કાયા દ્વારા ઉપાર્જિત મારું કર્મ આપના પાદ સ્મરણથી નાશને પ્રાપ્ત થાવ	૧૨	૩૪૭
સર્વજનું વચન પ્રમાણ છે	૧૩	૩૪૮
મન, વચન અને કાયાની વિકળતાથી જે સુતિમાં ન્યૂનતા થઈ છે તેને હે વાણી! તું ક્ષમા કર	૧૪	૩૪૮
આ અભીષ્ટ ફળ આપનાર કિયાકંડરૂપ કલ્પવૃક્ષનું એક પત્ર છે	૧૫	૩૪૮
કિયાકંડ સંબંધી આ ચૂલિકા ભાણવાથી અપૂર્વ કિયા પૂર્ણ થાય છે	૧૬	૩૪૮
જિન ભગવાનના શરણમાં જવાથી સંસાર નાટ થાય છે.....	૧૭	૩૪૮
મેં આપની પાસે આ વાચાળતા કેવળ ભક્તિવશ કરી છે	૧૮	૩૪૦
૨૨. એકત્વદશક	૧-૧૧	૩૪૧-૩૪૩
પરમજ્યોતિના કથનની પ્રતિજ્ઞા	૧	૩૪૧

વિષય	શલોક	પૃષ્ઠાંક
જે આત્મતત્ત્વને જાણો છે તે બીજાઓના સ્વયં આરાધ્ય બની જાય છે ૨	૩૪૧	
એકત્વના જ્ઞાતા અનેક કર્મથી પણ ઉત્તુતા નથી..... ૩	૩૪૧	
ચૈતન્યની એકતાનું જ્ઞાન દુર્લભ છે, પણ મુક્તિદાતા તે જ છે ૪	૩૪૨	
જે યથાર્થ સુખ મોક્ષમાં છે તે સંસારમાં અસંભવ છે ૫	૩૪૨	
ગુરુના ઉપદેશથી અમને મોક્ષપદ જ પ્રિય છે ૬	૩૪૨	
અસ્તિથર સ્વર્ગસુખ મોહોદ્યરૂપ વિષથી વાય છે..... ૭	૩૪૨	
આ લોકમાં જે આત્મોનુખ રહે છે તે પરલોકમાં પણ તેવા રહે છે ૮	૩૪૨	
વીતરાગ માર્ગ પ્રવૃત્ત યોગીને મોક્ષસુખની પ્રાપ્તિમાં કોઈ પણ બાધક થઈ શકતું નથી	૩૪૩	
આ ભાવના પદના ચિન્તનથી મોક્ષ ગ્રાપ્ત થાય છે	૧૦	૩૪૩
ધર્મ રહેતાં મૃત્યુનો ભય રહેતો નથી..... ૧૧	૩૪૩	
૨૩. પરમાર્થવિંશતિ	૧-૨૦	૩૪૪-૩૬૪
આત્માનું અદ્વૈત જ્યવંત હો	૧	૩૪૪
અનન્તચુષ્ટયરૂપ સ્વસ્થતાની વંદના..... ૨	૩૪૪	
એકત્વની રિષ્ટિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય છે	૩	૩૪૫
અદ્વૈત તરફ જુકાવ થતાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ નાટ થઈ જાય છે	૪	૩૪૫
હું ચૈતન્યસ્વરૂપ છું, કર્મજનિત કોધાદિ બિન્ન છે..... ૫	૩૪૬	
જો એકત્વમાં મન સંલગ્ન હોય તો તીવ્ર તપ ન હોવા છતાં		
પણ અભીષ્ટસિદ્ધ થાય છે	૬	૩૪૬
કર્મો સાથે એકમેક હોવા છતાં પણ હું તે પરમજ્યોતિસ્વરૂપ જ છું	૭	૩૪૬
લક્ષ્મીના મદથી ઉન્મત રાજાઓનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે ૮	૩૪૭	
હદ્યમાં ગુરુવયને જાગૃત રહેતાં આપત્તિમાં ખેદ થતો નથી..... ૯	૩૪૮	
ગુરુ દ્વારા પ્રકાશિત પથ પર ચાલવાથી નિર્વાણપુર ગ્રાપ્ત થાય છે	૧૦	૩૪૮
કર્મને આત્માથી બિન્ન સમજનારાઓને સુખદુઃખનો વિકલ્પ જ થતો નથી.. ૧૧	૩૪૮	
દેવ અને જિનપ્રતિમા આદિનું આરાધન વ્યવહારમાર્ગમાં જ થાય છે	૧૨	૩૪૯
જો મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ તો પછી કોઈ ગમે એટલું કષ		
દે, તેનો તેને ભય રહેતો નથી..... ૧૩	૩૬૦	
સર્વશક્તિમાન આત્મા-પ્રભુ સંસારને નાટ કરીને સમાન દેખે છે	૧૪	૩૬૦
આત્માની એકતાને જાણનાર પાપથી લિપ્ત થતો નથી	૧૫	૩૬૧
ગુરુના પાદપ્રસાદથી નિર્ગ્રન્થતા પ્રાપ્ત કરી લીધા પછી ઈન્દ્રિયસુખ		
દુઃખરૂપ જ પ્રતીત થાય છે	૧૬	૩૬૧

વિષય	શલોક	પૃષ્ઠાંક
નિર્ગંધતાજ્ઞય આનંદ સામે ઈન્દ્રિયસુખનું સ્મરણ પણ થતું નથી ૧૭ ૩૬૧		
મોહના નિમિત્તે થનારી મોક્ષની પણ અભિલાષા સિદ્ધિમાં બાધક થાય છે. ૧૮ ૩૬૨		
ચિદૂપના ચિત્તનમાં બીજી તો શું, શરીર સાથે પણ પ્રીતિ રહેલી નથી..... ૧૯ ૩૬૨		
શુદ્ધનયથી તત્ત્વ અનિર્વચનીય છે ૨૦ ૩૬૩		
૨૪. શરીરાષ્ટક	૧-૮	૩૬૫-૩૬૬
(શરીરના સ્વભાવનું નિરૂપણ)		
૨૫. સ્નાનાષ્ટક	૧-૮	૩૭૦-૩૭૪
મળ-મૂત્રાદિથી પરિપૂર્ણ શરીર સદા અશુદ્ધ અને આત્મા સ્વભાવથી		
પવિત્ર છે, માટે બન્ને પ્રકારે સ્નાન વર્થ છે..... ૧-૨ ૩૭૦		
સત્પુરુષોનું સ્નાન વિવેક છે જે ભિથ્યાત્વાદિરૂપ અભ્યંતર મળને નાચ કરે છે ઉ ૩૭૧		
સમીચીન પરમાત્મારૂપ તીર્થોમાં સ્નાન કરવું તે જ શ્રેષ્ઠ છે ૪ ૩૭૨		
જેમણે શાનરૂપ સમુદ્ર જોયો નથી તેઓ જ ગંગા આદિ		
તીર્થભાસોમાં સ્નાન કરે છે ૫ ૩૭૨		
મનુષ્ય શરીરને શુદ્ધ કરી શકનાર કોઈપણ તીર્થ સંભવ નથી ૬ ૩૭૨		
ક્પૂરાદિનો લેપ કરવા છતાં પણ શરીર સ્વભાવથી દુર્ગંધ જ છોડે છે ૭ ૩૭૩		
ભવ્ય જીવ આ સ્નાનાષ્ટક સાંભળીને સુખી થાવ ૮ ૩૭૩		
૨૬. બ્રહ્મયાર્થક	૧-૮	૩૭૫-૩૭૮
મૈથુન સંસારવૃદ્ધિનું કારણ છે ૧ ૩૭૫		
મૈથુનકર્મમાં પશુઓ રત રહેવાથી તેને પશુકર્મ કહેવામાં આવે છે ૨ ૩૭૫		
જો મૈથુન પોતાની સ્ત્રી સાથે પણ સારું હોય તો તેનો		
પર્વોમાં ત્યાગ શા માટે કરવામાં આવત? ૩ ૩૭૬		
અપવિત્ર મૈથુનસુખમાં વિવેકી જીવને અનુરાગ થતો નથી ૪ ૩૭૬		
અપવિત્ર મૈથુન અનુરાગનું કારણ મોહ છે ૫ ૩૭૬		
મૈથુન સંયમનો ઘાતક છે ૬ ૩૭૭		
મૈથુનમાં પ્રવૃત્તિ પાપના કારણે થાય છે ૭ ૩૭૭		
વિષયસુખ વિષ સદ્ગત છે ૮ ૩૭૭		
આ બ્રહ્મયાર્થકનું નિરૂપણ મુમુક્ષુ જીવો માટે કરવામાં આવ્યું છે ૯ ૩૭૮		



ॐ

॥ નમઃ સિદ્ધેભ્યો: ॥

શ્રીમદ્ પદ્મનાન્દિ વિરચિત

પદ્મનાન્દિ-પંચવિંશાતિ:

૧. ધર્માપરેશામૃતમ्

(સ્નાધરા)

કાયોત્સર્ગાયતાઙ્ગો જયતિ જિનપતિર્નાભિસૂનુર્મહાત્મા
મધ્યાહ્નને યસ્ય ભાસ્વાનુપરિ પરિગતો રાજતિ સ્મોગ્રમૂર્તિઃ ।
ચક્રં કર્મન્ધનાનામતિબુદ્ધ દહતો દૂરમૌદાસ્યવાત-
સ્ફૂર્જત્સદ્ધયાનવહ્નેરિવ રુચિરતરઃ પ્રોદ્ધતો વિસ્કુલિઙ્ગઃ ॥૧॥

અનુવાદ : કાયોત્સર્ગના નિભિત્તે જેમનું શરીર લંબાયેલું છે એવા નાભિરાયના પુત્ર મહાત્મા આદિનાથ જિનેન્દ્ર જ્યવંત હો, જેમના ઉપર પ્રાપ્ત થયેલ મધ્યાહ્નનો તેજસ્વી સૂર્ય એવો શોભે છે જાણે કર્મરૂપી ઈન્ધનના સમૂહને અતિશયપણે બાળનાર અને ઉદાસીનતારૂપ વાયુના નિભિત્તે પ્રગટ થયેલ સમીચીન ધ્યાનરૂપી અનિની તેજસ્વી ચિનગારી જ ઉત્પન્ન થઈ હોય.

વિશેષાર્થ : ભગવાન આદિનાથ જિનેન્દ્રની ધ્યાનાવસ્થામાં તેમની ઉપર જે મધ્યાહ્ન કાળનો તેજસ્વી સૂર્ય આવતો હતો તે વિષયમાં ગ્રંથકાર ઉત્થેકા કરે છે કે તે સૂર્ય ન હતો

પણ જાણે કે સમતાભાવથી આઠ કર્મરૂપી ઈન્ધનને જલાવવા માટે ઈચ્છુક થઈને ભગવાન આદિનાથ જિનેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ધ્યાનરૂપી અજિનનો તણખો જ ઉત્પન્ન થયો હતો. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

નો કિંચિત્કરકાર્યમસ્તિ ગમનપ્રાપ્યં ન કિંચિત્ દશો-
ઈશ્યં યસ્ય ન કર્ણયો: કિમપિ હિ શ્રોતવ્યમષ્યસ્તિ ન ।
તેનાલમ્બિતપાળિરુજ્જિતગતિનાસાગ્રદ્ઘટી રહઃ
સંપ્રાસોડતિનિરાકુલો વિજયતે ધ્યાનૈકતાનો જિન: ॥૨॥

અનુવાદ : હાથથી કરવા યોગ્ય કોઈ પણ કાર્ય બાકી ન રહેવાથી જેમણે પોતાના બન્ને હાથ નીચે લટકાવી દીધા હતા, ગમન કરીને મેળવવા યોગ્ય કાંઈ પણ કાર્ય ન રહેવાથી જે ગમનરહિત થઈ ગયા હતા. આંખો વડે જોવા યોગ્ય કોઈ પણ વસ્તુ ન રહેવાથી જેઓ પોતાની દષ્ટિ નાકની આણી ઉપર ઠેરવતા હતા, તથા કાનને સાંભળવા યોગ્ય કાંઈ પણ બાકી ન રહેવાથી જે આકુળતા રહિત થઈને એકાન્ત સ્થાનમાં રહ્યા હતા; એવા તે ધ્યાનમાં એકાગ્રચિત થયેલા જિન ભગવાન જ્યવંત હો.

વિશેષાર્થ : અન્ય સમસ્ત પદાર્થો તરફથી ચિંતા ખસેડીને કોઈ એક જ પદાર્થ તરફ તેને નિયમિત કરવી, તેને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન ક્યાંક એકાંત સ્થાનમાં જ કરી શકાય છે. જો ઉક્ત ધ્યાન કાયોત્સર્વિડે કરવામાં આવે તો તેમાં બન્ને હાથ નીચે લટકતા રાખી દષ્ટિ નાકની આણી ઉપર રાખવામાં આવે છે. આ ધ્યાનની અવસ્થા લક્ષમાં રાખીને જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે તે વખતે જિન ભગવાનને ન હાથ વડે કરવા યોગ્ય કાંઈ કાર્ય બાકી કહ્યું હતું, ન ગમન વડે પ્રાપ્ત કરવા યોગ્ય ધનાદિની અભિલાષા શેષ હતી ન કોઈ પણ દશ્ય તેમની આંખોને રચિકર બાકી રહ્યું હતું અને ન કોઈ ગીત આદિ પણ તેમના કાનને મુંધ કરે એવું બાકી રહ્યું હતું. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

રાગો યસ્ય ન વિદ્યતે ક્વचિદપિ પ્રધસ્તસંગ્રહાત्
અસ્ત્રાદે: પરિવર્જનાત્ર ચ બુધૈર્દ્વૈષોડપિ સંભાવ્યતે ।
તસ્માત્સામ્યમથાત્મબોધનમતો જાતઃ ક્ષયઃ કર્મણા-
માનન્દાદિગુણાશ્રયસ્તુ નિયતં સોડહન્સદા પાતુ વઃ ॥૩॥

અનુવાદ : જે અરિહંત પરમેષીને પરિગ્રહરૂપી પિશાચ રહિત થઈ જવાને

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૩

લીધે કોઈ પણ ઈન્દ્રિય વિષયમાં રાગ નથી, ત્રિશૂળ આદિ આયુધ રહિત હોવાને લીધે ઉક્ત અરિહંત પરમેષ્ઠીને વિદ્વાનો દ્વારા દેખની પણ સંભાવના કરી શકતી નથી. તેથી રાગ-દ્રેષ રહિત થઈ જવાને લીધે તેમને સમતાભાવ પ્રગટ્યો છે, અને આ સમતાભાવ પ્રગટવાથી તેમને આત્મજ્ઞાન તથા તેનાથી તેમને કર્માનો વિયોગ થયો છે. માટે કર્માના ક્ષયથી જે અરિહંત પરમેષ્ઠી અનંત સુખ આદિ ગુણોનો આશ્રય પામ્યા છે. તે અરિહંત પરમેષ્ઠી સર્વદા તમારી રક્ષા કરો. ૩.

(શાર્ડૂલવિક્રીડિત)

ઇન્દ્રસ્ય પ્રણતસ્ય શેખરશિખારત્નાર્કભાસા નખ-
શ્રેણીતેક્ષણવિમ્બશુભદલિભૃદ્રૂરોલ્લસત્પાટલમ् ।
શ્રીસિદ્ધાઙ્કિર્યુગં જિનસ્ય દધદયમ્ભોજસામ્યં રજ-
સ્ત્યક્તં જાડ્યહરં પરં ભવતુ નશ્રેતોર્પિતં શર્મણે ॥૪॥

અનુવાદ : જે જિન ભગવાનના શ્રેષ્ઠ બન્ને ચરણ નમસ્કાર કરતી વખતે નમેલા ઈન્દ્રના મુગટની કલગીમાં જડેલા રત્નરૂપી સૂર્યના પ્રકાશથી કાંઈક ધવલતા સહિત લાલ વર્ણના છે તથા જે નખોમાં પડતા ઈન્દ્રના નેત્રોના પ્રતિબિંબરૂપ ભમરોને ધારણ કરે છે, જે શોભાના સ્થાનરૂપ છે તેથી જે કમળની ઉપમા ધારણ કરવા છતાં પણ ધૂળના સંસર્ગ વિનાના હોઈને જડતાને (અજ્ઞાનને) હરનાર છે; તે બન્ને ચરણો અમારા ચિત્તમાં સ્થિર થઈને સુખના કારણ થાવ.

વિશેષાર્થ : અહીં જિનભગવાનના ચરણોને કમળની ઉપમા આપતાં એમ બતાવ્યું છે કે જેમ કમળ પાટલ (કાંઈક સફેદ સાથે લાલ) વર્ણનું હોય છે તેમ જિન ભગવાનના ચરણોમાં જ્યારે ઈન્દ્ર નમસ્કાર કરતા હતા ત્યારે તેના મુકુટમાં જડેલા રત્નની છાયા તેના ઉપર પડતી હતી તેથી તે પણ કમળની જેમ પાટલ વર્ણના થઈ જતા હતા. જો કમળમાં ભમરા રહે છે તો જિન ભગવાનના પગના નખોમાં પણ નમસ્કાર કરતા ઈન્દ્રના નેત્ર પ્રતિબિંબરૂપ ભમરા વિદ્યમાન હતા. કમળ જો શ્રી (લક્ષ્મી)નું સ્થાન મનાય છે તો તે જિન ચરણ પણ શ્રી (શોભા)નું સ્થાન હતા. આમ કમળની ઉપમા ધારણ કરવા છતાં પણ જિનચરણોમાં તેનાથી કાંઈક અધિક વિશેષતા હતી. જેમ કે—કમળ તો રજ અર્થાત્ પરાગ સહિત હોય છે પણ જિનચરણ તે રજ (ધૂળ)ના સંપર્કથી સદા રહિત હતા. એવી જ રીતે કમળ જડતા (અચેતનપણું) ધારણ કરે છે પરંતુ જિનચરણ તે જડતા(અજ્ઞાન)ને નષ્ટ કરનાર હતા. ૪.

(માલિની)

જયતિ જગદધીશઃ શાન્તિનાથો યદીયં
સ્મૃતમણિ હિ જનાનાં પાપતાપોપશાન્ત્યૈ ।
વિબુધકુલકિરીટપ્રસ્ફુરન્નીલરત્ન-
દ્યુતિચલમધુપાલીચુમ્બિતં પાદપદ્મમ् ॥૫॥

અનુવાદ : દેવોના સમૂહોના મુકુટોમાં પ્રકાશમાન નીલરત્નોની કાંતિરૂપી ચંચળ ભમરાઓની પંક્તિથી સ્પર્શાયેલા જે શાન્તિનાથ જિનેન્દ્રના ચરણકમળ સ્મરણ કરવા માત્રથી જ લોકોના પાપરૂપ સંતાપને દૂર કરે છે તે લોકના અધિનાયક ભગવાન શાન્તિનાથ જિનેન્દ્ર જ્યવંત હો. ૫.

(માલિની)

સ જયતિ જિનદેવઃ સર્વવિદ્વિશ્વનાથો
વિતથવચનહેતુક્રોધલોભાદ્વિમુક્તઃ ।
શિવપુરપથપાન્થપ્રાણિપાથેયમુચ્ચૈ-
ર્જનિતપરમશર્મા યેન ધર્મોઽભ્યધાયિ ॥૬॥

અનુવાદ : જે જિન ભગવાન અસત્ય ભાષણના કારણરૂપ કોધ અને લોભ આદિથી રહિત છે અને જોશે મોક્ષપુરીના માર્ગ ચાલતા મુસાફરોને નાસ્તારૂપ તેમ જ ઉત્તમ સુખ ઉત્પન્ન કરનાર એવા ધર્મનો ઉપદેશ આપ્યો છે તે સમસ્ત પદાર્થોને જાણનાર ત્રણ લોકના અધિપતિ જિનદેવ જ્યવંત હો. ૬.

(શાર્ડૂલવિક્રીડિત)

ધર્મો જીવદ્યા ગૃહસ્થશમિનોર્ભેદાદ્વિધા ચ ત્રયં
રત્નાનાં પરમં તથા દશવિધોત્કૃષ્ટક્ષમાદિસ્તતઃ ।
મોહોદ્રભૂતવિકલ્પજાલરહિતા વાગસર્ઝોજ્ઞિતા
શુદ્ધાનન્દમયાત્મનઃ પરિણતિર્ધર્માખ્યયા ગીયતે ॥૭॥

અનુવાદ : પ્રાણીઓ ઉપર દ્યાભાવ રાખવો તે ધર્મનું સ્વરૂપ છે. તે ધર્મ

ગૃહસ્થ (શ્રાવક) અને મુનિના ભેદથી બે પ્રકારનો છે. તે જ ધર્મ સમ્યાદર્શન, સમ્યાશાન અને સમ્યક્યારિત્રણ ઉત્કૃષ્ટ રત્નત્રયના ભેદથી ત્રણ પ્રકારનો તથા ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ આદિના ભેદથી દસ પ્રકારનો પણ છે. પરંતુ નિશ્ચયથી તો મોહના નિમિત્તે ઉત્પન્ન થતાં માનસિક વિકલ્પોથી તથા વચ્ચન અને શરીરના સંસર્ગથી પણ રહિત જે શુદ્ધ આનંદરૂપ આત્માની પરિણાતિ થાય છે તેને જ ‘ધર્મ’ નામે કહેવામાં આવે છે.

વિશેષાર્થ : પ્રાણીઓ ઉપર દ્યાભાવ રાખવો, રત્નત્રય ધારણ કરવા, તથા ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનું પરિપાલન કરવું; એ બધું વ્યવહારધર્મનું સ્વરૂપ છે. નિશ્ચયધર્મ તો શુદ્ધ આનંદમય આત્માની પરિણાતિને જ કહેવામાં આવે છે. ૭.

(શાર્ડૂલવિક્રીડિત)

આદ્ય સદ્ગ્રતસંચયસ્ય જનની સૌખ્યસ્ય સત્સંપદાં
મૂલં ધર્મતરોરનશ્વરપદારોહૈકનિઃશ્રેણિકા ।
કાર્ય સદ્ગ્રિહિઙ્ગિષુ ગ્રથમતો નિત્ય દ્યા ધાર્મિકૈ:
ધિદ્ધનામાષ્યપદયસ્ય તસ્ય ચ પરં સર્વત્ર શૂન્ય દિશઃ ॥૮॥

અનુવાદ : અહીં ધર્માત્મા સજ્જનોએ સૌથી પહેલાં પ્રાણીઓના વિષયમાં સદાય દ્યા રાખવી જોઈએ, કેમકે તે દ્યા સમીયીન વ્રતો, સુખ અને ઉત્કૃષ્ટ સંપદાઓની મુખ્ય જનની અર્થાત્ ઉત્પાદક છે; ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, તથા અવિનશ્વર પદ અર્થાત્ મોક્ષ મહેલમાં ચડવાની અપૂર્વ નિસરણીનું કામ કરે છે. નિર્દ્ય પુરુષનું નામ લેવું પણ નિન્દ્ય છે, તેના માટે બધે દિશાઓ શૂન્ય જેવી છે.

વિશેષાર્થ : જેવી રીતે મૂળ વિના વૃક્ષની સ્થિતિ ટકતી નથી તેવી જ રીતે પ્રાણીદ્યા વિના ધર્મની સ્થિતિ પણ રહી શકતી નથી. તેથી તે ધર્મરૂપી વૃક્ષના મૂળ સમાન છે. એ સિવાય પ્રાણીદ્યા થતાં જ ઉત્તમ વ્રત, સુખ અને સમીયીન સંપદાઓ તથા અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે; માટે જ ધર્માત્માઓનું એ ગ્રથમ કર્તવ્ય છે કે તે સમસ્ત પ્રાણીધારીઓ પ્રત્યે દ્યાભાવ રાખે. જે પ્રાણી નિર્દ્યતાથી જીવધાતની પ્રવૃત્તિ કરે છે તેનું નામ લેવું પણ ખરાબ સમજવામાં આવે છે. તેને ક્યાંય પણ સુખ સામગ્રી પ્રાપ્ત થવાની નથી. તેથી સત્પુરુષોને આ પહેલો ઉપદેશ છે કે તેમણે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દ્યાયુક્ત આચરણ કરવું. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

સંસારે ભ્રમતશ્ચિરં તનુભૂતઃ કે કે ન પિત્રાદયો
જાતાસ્તદ્ધમાશ્રિતેન ખલુ તે સર્વે ભવન્ત્યાહતાઃ ।
પુંસાત્માપિ હતો યદત્ર નિહતો જન્માન્તરેષુ ધ્રુવમ्
હન્તારં પ્રતિહન્તિ હન્ત બહુશઃ સંસ્કારતો નુ ક્રુદ્ધઃ ॥૧॥

અનુવાદ : સંસારમાં ચિરકાળથી પરિભ્રમણ કરનાર પ્રાણીને કચા કચા જીવ પિતા, માતા, ભાઈ આદિ નથી થયા? તેથી તે જીવોના ધાતમાં પ્રવર્તતો પ્રાણી નિશ્ચયથી તે બધાને મારે છે. આશ્રય તો એ છે કે તે પોતે પોતાનો પણ ધાત કરે છે. આ ભવમાં જે બીજા દ્વારા મરાયો છે તે નિશ્ચયથી અન્ય ભવમાં કોધની વાસનાથી પોતાના તે ધાતકનો અનેકવાર ધાત કરે છે, એ ખેદની વાત છે.

વિશેષાર્થ : જન્મ-મરણનું નામ સંસાર છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને બિન્ન-બિન્ન ભવોમાં ધણાખરા જીવો માતા-પિતા આદિ સંબંધો પામ્યા છે. તેથી જે પ્રાણી નિર્દ્યથી થઈને તે જીવોનો ધાત કરે છે તે પોતાના માતા-પિતા આદિનો જ ધાત કરે છે. બીજું તો શું કહીએ, કોધી જીવ આત્મધાત પણ કરી બેસે છે. આ કોધની વાસનાથી આ જન્મમાં કોઈ અન્ય પ્રાણી દ્વારા મરાયેલો જીવ પોતાના તે ધાતકનો જન્માન્તરોમાં અનેકવાર ધાત કરે છે. તેથી અહીં એમ ઉપદેશ આપવામાં આવ્યો છે કે જે કોધ અનેક પાપોનો જનક છે તેનો પરિત્યાગ કરીને જીવદ્યામાં પ્રવૃત્ત થવું જોઈએ. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

તૈલોક્યપ્રભુભાવતો ઽપિ સરૂજો ઽથેકં નિજ જીવિતં
પ્રેયસ્તેન બિના સ કસ્ય ભવિતેત્યાકાંક્ષતઃ પ્રાણિઃ ।
નિઃશેષબ્રતશીલનિર્મલગુણધારાત્તતો નિશ્ચિતં
જન્તોર્જીવિતદાનતસ્ત્રભુવને સર્વપ્રદાનં લઘુ ॥૧૦॥

અનુવાદ : રોગી પ્રાણીને પણ ત્રણે લોકની પ્રભુતાની અપેક્ષાએ એક માત્ર પોતાનું જીવન જ પ્રિય હોય છે. કારણ એ છે કે તે વિચારે છે કે જીવન નષ્ટ થઈ ગયા પછી તે ત્રણે લોકોની પ્રભુતા ભલા કોને પ્રાપ્ત થવાની? નિશ્ચયથી તે જીવનદાન સમસ્ત વ્રત, શીલ અને અન્ય અન્ય નિર્મળ ગુણોના આધારભૂત છે તેથી

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૭

જ લોકમાં જીવને જીવનદાનની અપેક્ષાએ અન્ય સમસ્ત સંપત્તિ આદિનું દાન પણ તુચ્છ મનાય છે.

વિશેખાર્થ : પ્રાણોનો ધાત કરવામાં આવતાં જો કોઈને ત્રણ લોકનું પ્રભુત્વ પણ પ્રાપ્ત થતું હોય તો તે તેને નહિ ચાહે, પરંતુ પોતાના જીવનની જ અપેક્ષા કરશે. કારણ કે તે સમજે છે કે જીવનનો ધાત થયા પછી છેવટે તેને ભોગવશે કોણા? તે સિવાય ત્રતિ, શીલ, સંયમ અને તપ આદિનો આધાર ઉક્ત જીવનદાન જ છે તેથી બીજા બધા દાનોની અપેક્ષાએ જીવનદાન ને જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ૧૦.

(શાર્દૂલવિક્રીડિત)

સ્વર्गાયાત્રતિનાઽપિ સાર્દ્રમનસः શ્રેયસ્કરી કેવલા
સર્વપ્રાણિદયા તયા તુ રહિતઃ પાપસ્તપસ્થો�પિ વા ।
તદાનં બહુ દીયતાં તપસિ વા ચેતશ્ચિરં ધીયતાં
ધ્યાનં વા ક્રિયતાં જના ન સફલં કિંચિદ્યાવર્જિતમ् ॥૧૧॥

અનુવાદ : જેનું ચિત્ત દ્યાથી બિંજાયેલું છે તે જો પ્રતરહિત હોય તોપણ તેની કલ્યાણ કારિણી એક માત્ર સર્વપ્રાણીદયા સ્વર્ગની પ્રાપ્તિનું નિમિત્ત થાય છે. એનાથી ઉલ્લું ઉક્ત પ્રાણીદયાથી રહિત પ્રાણી તપમાં સ્થિત હોવા છતાં પણ પાપિષ્ઠ મનાય છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ! ભલે તમે ધણું દાન ધો, ભલે લાંબો સમય ચિત્તને તપમાં લગાડો અથવા ભલે ધ્યાન પણ કરો, પરંતુ દ્યા વિના તે બધું નિષ્ફળ જશે. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

સત્તાઃ સર્વસુરાસુરેન્દ્રમહિતં મુક્તે: પરં કારણं
રત્નાનાં દધતિ ત્રયં ત્રિભુવનપ્રદ્યોતિ કાયે સતિ ।
વૃત્તિસ્તસ્ય યદવ્રતઃ: પરમયા ભક્ત્યાર્પિતાજ્ઞાયતે
તેષાં સદ્ગૃહમેધિનાં ગુણવતાં ધર્મો ન કસ્ય પ્રિય: ॥૧૨॥

અનુવાદ : જે રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિત્ર) સર્વ સુરેન્દ્રો અને અસુરેન્દ્રો દ્વારા પૂજ્ય છે, મોક્ષનું અદ્વિતીય કારણ છે અને ત્રણે લોકને

[પદ્મનાન્દિ-પંચવિંશતિ:

પ્રકાશિત કરનાર છે તેને મુનિઓ શરીર હોય ત્યારે જ ધારણ કરે છે. તે શરીરની સ્થિતિ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવામાં આવેલ જે સદ્ગુહસ્થોના અજ્ઞાની રહે છે તે ગુણવાન સદ્ગુહસ્થો (શ્રાવકો)નો ધર્મ ભલા કોને પ્રિય ન લાગે? અર્થાત્ સર્વને પ્રિય લાગે. ૧૨.

(સ્નાધરા)

આરાધ્યન્તે જિનેન્દ્રા ગુરુષુ ચ વિનતિર્ધાર્મિકૈ: પ્રીતિરુચૈ:
પાત્રેભ્યો દાનમાપન્તિહતજનકૃતે તત્ત્વ કારુણ્યબુદ્ધ્યા ।
તત્ત્વાભ્યાસઃ સ્વકીયગ્રતરતિરમલં દર્શનં યત્ર પૂજ્યં
તર્ફાર્હસ્થં બુધાનામિતરદિહ પુનર્દુઃખદો મોહપાશઃ ॥૧૩॥

અનુવાદ : જે ગૃહસ્થ અવસ્થામાં જિનેન્દ્રોની આરાધના કરાય છે, નિર્થથ ગુરુઓના વિષયમાં વિનયયુક્ત વ્યવહાર કરાય છે, ધર્માત્મા પુરુષો પ્રત્યે અતિશય વાત્સલ્ય ભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દ્યાબુદ્ધિથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીળન કરવામાં આવે છે, પોતાના પ્રતો પ્રત્યે અર્થાત્ ગૃહસ્થ ધર્મ પ્રત્યે પ્રેમ રાખવામાં આવે છે, તથા નિર્મળ સમ્યગ્દર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવસ્થા વિદ્વાનોને પૂજ્ય છે. અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજીણ જ છે. ૧૩.

(શાર્દૂલવિક્રીડિત)

આદૌ દર્શનમુન્તરં વ્રતમિતઃ સામાયિકં પ્રોષધ—
સ્ત્યાગશૈવ સચિત્તવસ્તુનિ દિવાભુક્તં તથા બ્રહ્મ ચ ।
નારભ્રો ન પરિગ્રહોઽનનુમતિર્નોદિષ્ટમેકાદશ
સ્થાનાનીતિ ગૃહિત્રતે વ્યસનિતાત્યાગસ્તદાયઃ સ્મૃતઃ ॥૧૪॥

અનુવાદ : સર્વ ઉન્નતિને પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન, ત્યાર પછી પ્રત, ત્યાર પછી કમ પ્રમાણે સામાયિક, પ્રોષધોપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ, દિવસે ભોજન કરવું અર્થાત્ રાત્રિભોજનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મર્થ ધારણ કરવું, આરંભ ન કરવો, પરિગ્રહ ન રાખવો, ગૃહસ્થના કાર્યોમાં સંભતિ ન આપવી, ઉદ્દિષ્ટ ભોજન ગ્રહણ ન

કરવું; આ રીતે આ શ્રાવકધર્મમાં અગિયાર પ્રતિમાઓ કહેવામાં આવી છે. તે બધાની શરૂઆતમાં જૂાર વગેરે વ્યસનોનો ત્યાગ કહેવામાં આવ્યો છે.

વિશેષાર્થ : સકળ ચારિત્ર અને વિકળ ચારિત્રના ભેદથી ચારિત્ર બે પ્રકારનું છે. એમાં સકળ ચારિત્ર મુનિઓને અને વિકળ ચારિત્ર શ્રાવકોને હોય છે. તેમાં શ્રાવકોની નીચે પ્રમાણે અગિયાર શ્રેષ્ઠીઓ (પ્રતિમાઓ) છે. દર્શન, પ્રતિમાઓ, પ્રૌષ્ઠધોપવાસ, સચિતાત્યાગ, દિવાભુક્તિ, બ્રહ્મયર્થ, આરંભત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટ ત્યાગ. (૧) વિશુદ્ધ સમ્યગ્દર્શન સાથે સંસાર, શરીર અને ઇન્દ્રિયના વિષયભોગોથી વિરક્ત થઈને પાક્ષિક શ્રાવકના આચાર સન્મુખ થવું તેનું નામ દર્શન પ્રતિમા છે. (૨) માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ ત્રણ શલ્યથી રહિત થઈને અતિચાર રહિત પાંચ અણુવ્રત અને સાત શીલત્રતોને ધારણ કરવા તે પ્રત પ્રતિમા કહેવાય છે. (૩) નિયમિત સમય સુધી હિંસાદિ પાંચે પાપોનો પૂર્ણરીતે ત્યાગ કરીને અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનો તથા સંસાર અને મોક્ષના સ્વરૂપ આદિનો વિચાર કરવો, તેને સામાયિક કહે છે. ત્રીજી પ્રતિમાધારી શ્રાવક તે સવારે, બપોરે અને સાંજે નિયમિત રૂપે કરે છે. (૪) પ્રત્યેક આઠમ અને ચૌદશો સોણ પહોર સુધી ચાર પ્રકારના ભોજન (અશન, પાન, ખાદ્ય અને લેહ)ના પરિત્યાગનું નામ પ્રૌષ્ઠધોપવાસ છે. અહીં પ્રૌષ્ઠ શબ્દનો અર્થ એકાશન અને ઉપવાસનો અર્થ સર્વ પ્રકારના ભોજનનો પરિત્યાગ છે. જેમ કે-જો આઠમને દિવસે પ્રૌષ્ઠધોપવાસ કરવાનો હોય તો સાતમના દિવસે એકાશન કરીને આઠમે ઉપવાસ કરવો જોઈએ અને ત્યાર પછી નોમે પણ એકાશન જ કરવું જોઈએ. પ્રૌષ્ઠધોપવાસના સમયે હિંસાદિ પાપ સહિત શરીરશૂંગારાદિનો પણ ત્યાગ કરવો અનિવાર્ય હોય છે. (૫) જે વનસ્પતિઓ નિગોદના જીવથી વાપ્ત હોય તેના ત્યાગને સચિતાત્યાગ કહેવામાં આવે છે. (૬) રાત્રે ભોજનનો પરિત્યાગ કરીને દિવસે જ ભોજન કરવાનો નિયમ કરવો, એ દિવાભુક્તિપ્રતિમા કહેવાય છે. કેટલાક આચાર્યાના અભિપ્રાય પ્રમાણે દિવસે મૈથુનના પરિત્યાગને દિવાભુક્તિ (ધર્મ પ્રતિમા) કહે છે. (૭) શરીરના સ્વભાવનો વિચાર કરીને કામભોગથી વિરક્ત થવાનું નામ બ્રહ્મયર્થ પ્રતિમા છે. (૮) કૃષિ અને વેપાર આદિ આરંભના પરિત્યાગને આરંભત્યાગ પ્રતિમા કહે છે. (૯) ધન-ધાન્યાદિરૂપ દસ પ્રકારના બાદ્ય પરિગ્રહમાં મમતવબુદ્ધિ છોડીને સંતોષનો અનુભવ કરવો, તેને પરિગ્રહત્યાગપ્રતિમા કહે છે. (૧૦) આરંભ પરિગ્રહ અને આ લોક સંબંધી અન્ય કાર્યોના વિષયમાં સંમતિ ન ટેવાનું નામ અનુમતિત્યાગ છે. (૧૧) ગૃહવાસ છોડીને ભિક્ષાવૃત્તિથી ભોજન કરતાં ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરવો તેને ઉદ્દિષ્ટત્યાગ કહેવામાં આવે છે. આ પ્રતિમાઓમાં પૂર્વની પ્રતિમાઓનો નિર્વાહ થતાં જ આગળની પ્રતિમામાં પરિપૂર્ણતા થાય છે, અન્યથા નહીં. ૧૪.

(શાર્દૂલવિક્રીડિત)

યત્પ્રોક્તं પ્રતિમાભિરાભિરભિતો વિસ્તારિભિ: સૂરિભિ:
જ્ઞાતવ્યं તદુપાસકાધ્યયનતો ગેહિવ્રતં વિસ્તરાત् ।

તત્ત્વાપિ વ્યસનોજ્ઞનં યદિ તદ્ધ્યાસૂત્રતે ઽત્ત્રૈવ યત્તુ
તન્મૂલઃ સકલઃ સતાં બ્રતવિધિર્યાતિ પ્રતિષ્ઠાં પરામ્ભ ॥૧૫॥

અનુવાદ : આ પ્રતિમાઓ દ્વારા જે ગૃહસ્થ બ્રત (વિકળ ચારિત્ર)નું અહીં આચાર્યોએ વિસ્તારપૂર્વક કથન કર્યું છે તેને જો અધિક વિસ્તારથી જાણવું હોય તો ઉપાસકાધ્યયન અંગમાંથી જાણવું જોઈએ. ત્યાં પણ જે વ્યસનનો પરિત્યાગ બતાવવામાં આવ્યો છે તેનો નિર્દેશ અહીં પણ કરી દેવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે સાધુઓના સમસ્ત બ્રત વિધાનાદિની ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા વ્યસનોના પરિત્યાગ ઉપર જ આધાર રાખે છે. ૧૫.

(અનુષ્ટુપ)

ધૂતમાંસસુરાવેશ્યાખેટચૌર્યપરાઙ્મનાઃ ।
મહાપાપાનિ સસ્પેતિ વ્યસનાનિ ત્યજેદબુધઃ ॥૧૬॥

અનુવાદ : જુગાર, માંસ, મધ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરલ્લી; આ રીતે આ સાત મહાપાપરૂપ વ્યસન છે. બુદ્ધિમાન પુરુષે આ બધાનો ત્યાગ કરવો જોઈએ.

વિશેષાર્થ : ખરાબ ટેવને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન સાત છે—૧ જુગાર ૨મવો, ૨ માંસ ભક્ષણ કરવું, ઉ દારૂ પીવો, ૪ વેશ્યા સાથે સંબંધ રાખવો, ૫ શિકાર કરવો (મૃગ વગેરે પશુઓના ધાતમાં આનંદ માનવો), ૬ ચોરી કરવી અને ૭ અન્યની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખવો. આ સાતે વ્યસન મહાપાપ ઉત્પન્ન કરનાર છે, તેથી વિવેકી જીવે એનો પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. ૧૬.

(માલિની)

ભવનમિદમકીર્તશ્રૌર્યવેશ્યાદિસર્વ-
વ્યસનપતિરશેષાપન્ત્રિધિ: પાપબીજમ્ભ ।
વિષમનરકમાર્ગોષ્ઘગ્રયાયીતિ મત્વા
ક ઇહ વિશદબુદ્ધિર્ધૂતમઙ્ગીકરોતિ ॥૧૭॥

અનુવાદ : આ જુગાર નિંદાનું સ્થાન છે, ચોરી અને વેશ્યા આદિ અન્ય સર્વ વ્યસનોમાં મુખ્ય છે, સમસ્ત આપત્તિઓનું સ્થાન છે, પાપનું કારણ છે તથા દુઃખાયક નરકના માર્ગોમાં અગ્રગામી છે; આ રીતે જાણીને અહીં લોકમાં ક્યો નિર્મળ બુદ્ધિનો

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૧૧

ધારક મનુષ્ય ઉપર્યુક્ત જુગારનો સ્વીકાર કરે છે? અર્થાત् નથી કરતો. જે દુર્ભુદ્ધિ મનુષ્ય છે તે જ આ અનેક આપત્તિઓના ઉત્પાદક જુગારને અપનાવે છે, વિવેકી મનુષ્ય નહિ. ૧૭.

(શાર્દૂલવિક્રીડિત)

ક્વાકીર્તિઃ કવ દરિદ્રતા કવ વિપદઃ કવ ક્રોધલોભાદય:
 ચૌર્યાદિવ્યસનં કવ ચ કવ નરકે દુઃખં મૃતાનાં નૃણામ् ।
 ચેતશ્રેદ્ગુરુમોહતો ન રમતે ઘૂતે વદન્યુત્ત્રત-
 પ્રજ્ઞા યદ્ભુવિ દુર્ણયેષુ નિખિલેષેતદ્ધુરિ સ્મર્યતે ॥૧૮॥

અનુવાદ : જે ચિત્ત મહામોહથી જુગારમાં રમતું ન હોય તો પછી અપયશ અથવા નિંદા ક્યાંથી થઈ શકે? ગરીબાઈ ક્યાં રહે? વિપત્તિઓ ક્યાંથી આવે? કોધ અને લોભ આદિ કષાયો ક્યાંથી ઉત્પન્ન થાય? ચોરી આદિ અન્ય અન્ય વસન ક્યાં રહે? તથા મરીને નરકોમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? (અર્થાત् જુગારથી વિરક્ત થયેલ મનુષ્યને ઉપર્યુક્ત આપત્તિઓમાંથી કોઈ પણ આપત્તિ પ્રાપ્ત થતી નથી.) આમ ઉન્તત બુદ્ધિવાળા વિદ્વાનો કહે છે. તે યોગ્ય જ છે કેમ કે સમસ્ત બુરા વ્યસનોમાં આ જુગાર ગાડાની ધરી (ધોંસરી) સમાન મુખ્ય મનાય છે. ૧૮.

(સ્નાધરા)

વીભત્સુ પ્રાણિધાતોદ્વમશુચિ કૃમિસ્થાનમશ્લાધ્યમૂલં
 હસ્તેનાક્ષણાપિ શવયં યદિહ ન મહતાં સ્પ્રષ્ટુમાલોકિતું ચ ।
 તન્માંસં ભક્ષ્યમેતદ્વચનમપિ સતાં ગર્હિતં યસ્ય સાક્ષાત्
 પાપં તસ્યાત્ર પુંસો ભુવિ ભવતિ કિયત્કા ગતિર્વા ન વિદ્યઃ ॥૧૯૧॥

અનુવાદ : જે માંસ ધૃષ્ણા ઉત્પન્ન કરે છે, મૃગ આદિ પ્રાણીઓના ધાતથી ઉત્પન્ન થાય છે, અપવિત્ર છે, કૃમિ આદિ ક્ષુદ્ર જંતુઓનું સ્થાન છે, જેની ઉત્પત્તિ નિંદનીય છે, તથા મહાપુરુષ જેનો હાથથી સ્પર્શ કરતા નથી અને આંખથી જેને દેખતા પણ નથી ‘તે માંસ ખાવા યોગ્ય છે’ એવું કહેવું પણ સજજનોને માટે નિંદા જનક છે. તો પછી એવું અપવિત્ર માંસ જે પુરુષ સાક્ષાત્ ખાય છે તેને અહીં લોકમાં કેટલું પાપ થાય છે તથા તેની કેવી હાલત થાય છે, એ વાત અમે જાણતા નથી.

વિશેષાર્થ : —માંસ પ્રથમ તો મૂગ આદિ મૂંગા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થાય છે બીજું તેમાં અસંખ્ય અન્ય ત્રસ જીવ પણ ઉત્પન્ન થઈ જાય છે જેની હિંસા થવી અનિવાર્ય છે. આ કારણે તેના ભક્ષણમાં હિંસા જનિત પાપનું થવું અવશ્યંભાવી છે. માટે સજ્જન મનુષ્ય તેનો કેવળ પરિત્યાગ જ નથી કરતા, પણ તેનો તેઓ હાથથી સ્પર્શ કરવો અને આંખે દેખવું પણ ખરાબ સમજે છે. માંસભક્ષક જીવોની દુર્ગતિ અનિવાર્ય છે. ૧૮.

(શિખરણી)

ગતો જ્ઞાતિઃ કશ્ચિદ્બહિરપિ ન યદેતિ સહસા
શિરો હત્વા હત્વા કલુષિતમના રોદિતિ જનઃ ।
પરેષામુલ્કૃત્ય પ્રકટિતમુખં ખાદતિ પલં
કલે રે નિર્વિણા વયમિહ ભવચ્ચિત્રચરિતૈः ॥૨૦॥

અનુવાદ : જો કોઈ પોતાનો સંબંધી પોતાના ઠેકાણેથી બહાર જઈને શીંગ આવતો નથી તો મનુષ્ય મનમાં વ્યાકુળ થતો થકો વારંવાર માથું પીટીને રોવે છે. તે જ મનુષ્ય અન્ય મૂગ આદિ પ્રાણીઓનું માંસ કાપીને પોતાનું મુખ પહોળું કરીને ખાય છે. હે કળિ કણ! અહીં અમે તારી આ વિચિત્ર પ્રવૃત્તિઓથી નિર્વેદ પામ્યા છીએ.

વિશેષાર્થ : જ્યારે પોતાના કોઈ ઈષ્ટ સગા સંબંધી કાર્યવશ કર્યાંય બહાર જાય છે અને જો તે સમયસર ઘેર પાછા આવતા નથી તો આ માણસ અનિષ્ટની આશંકાથી વ્યાકુળ થઈને માથું દીવાલ વગેરે સાથે પછાડીને રૂદ્ધ કરે છે. પાછો તે જ માણસ જે અન્ય પશુ-પક્ષીઓને મારીને તેમની માતા આદિથી સદા માટે વિયોગ કરાવીને માંસભક્ષણમાં અનુરક્ત થાય છે, એ આ કળિકણનો જ પ્રભાવ છે. કણની આવી પ્રવૃત્તિઓથી વિવેકી જનોનું ચિત્ત વિરક્ત થાય તે સ્વાભાવિક છે. ૨૦

(માલિની)

સકલપુરુષર્ધર્મબ્રંશકાર્યત્ર જન્મ-
ન્યધિકમધિકમગ્રે યત્પરં દુઃખહેતુઃ ।
તદપિ ન યદિ મદ્યં ત્યજ્યતે બુદ્ધિમદ્ધિ:
સ્વહિતમિહ કિમન્યત્કર્મ ધર્માય કાર્યમ् ॥૨૧॥

અનુવાદ : જે દારૂ આ જન્મમાં સમસ્ત પુરુષાર્થો (ધર્મ, અર્થ અને કામ)નો નાશ કરનાર છે અને પદ્ધીના જન્મમાં અતિ દુઃખનું કારણ છે તે મદ્ય જો બુદ્ધિમાન

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૧૩

મનુષ્ય છોડતા નથી તો પછી અહીં લોકમાં ધર્મ માટે પોતાને હિતકારક બીજું કચું કામ કરવા યોગ્ય છે? કોઈ નહીં. અર્થાત્ મધ્ય પીનાર મનુષ્ય એવું કોઈ પણ પવિત્ર કામ કરી શકતો નથી જે તેને માટે આત્મહિતકારી હોય.

વિશોધાર્થ : શરાબી મનુષ્ય ન તો ધર્મકાર્ય કરી શકે છે કે ન અર્થ ઉપાર્જન કરી શકે છે અને ન યથેચ્છ ભોગ પણ ભોગવી શકે છે. આવી રીતે તે આ ભવમાં ત્રણે પુરુષાર્થથી રહિત થાય છે. પરભવમાં તે મધજનિત દોષોથી નરકાદિ દુર્ગતિઓમાં પડીને અસહ્ય દુઃખ પણ ભોગવે છે. આ જ વિચારથી બુદ્ધિમાન મનુષ્ય તેનો સદાને માટે પરિત્યાગ કરે છે. ૨૧.

(મન્દાક્રાન્તા)

આસ્તામેતદ્યદિહ જનર્ણિ વલ્લભાં મન્યમાના
નિન્યાશ્રેષ્ટા વિદધતિ જના નિસ્ત્રપાઃ પીતમધાઃ ।
તત્રાધિક્યં પથિ નિપત્તિતા યત્કિરત્સારમેયાદ-
વક્ત્રે મૂત્રં મધુરમધુરં ભાષમાણાઃ પિબન્તિ ॥૨૨॥

અનુવાદ : દાઢિયો નિર્બજજ થઈને અહીં જે માતાને પત્ની સમજને નિન્દનીય યેષા (સંભોગ આદિ) કરે છે એ તો દૂર રહો. પણ અધિક ખેદની વાત તો એ છે કે માર્ગમાં પડેલા તેમના મુખમાં ઝૂતરા મૂતરે છે અને તેઓ તેને અતિશય મધુર કહીને પીધા કરે છે. ૨૨.

(શાર્દૂલવિક્રોદિત)

યા ખાદન્તિ પલં પિબન્તિ ચ સુરાં જલ્પન્તિ મિથ્યાવચઃ:
સ્નિહાન્તિ દ્રવિણાર્થમેવ વિદધત્વર્થપ્રતિષ્ઠાક્ષતિમ् ।
નીચાનામપિ દૂરવક્રમનસઃ પાપાત્મિકાઃ કુર્વતે
લાલાપાનમહર્નિંશં ન નરકં વેશ્યા વિહાયાપરમ् ॥૨૩॥

અનુવાદ : મનમાં અન્યન્ત કુટિલતા ધારણ કરનારી જે પાપિષ વેશ્યાઓ માંસ ખાય છે, શરાબ પીએ છે, અસત્ય વચન બોલે છે, કેવળ ધનપ્રાપ્તિ માટે જ સ્નેહ કરે છે. ધન અને પ્રતિષ્ઠા એ બન્નેનોય નાશ કરે છે તથા જે વેશ્યાઓ નીચ પુરુષોની પણ લાળ પીએ છે. તે વેશ્યાઓ સિવાય બીજું કોઈ નરક નથી. અર્થાત્ તે વેશ્યાઓ નરકગતિની પ્રાપ્તિના કારણ છે. ૨૩.

(આર્યા)

**રજકશિલાસદ્વશીભિઃ કુર્કર્કર્પરસમાનચરિતાભિઃ ।
ગણિકાભિર્યદિ સંગઃ કૃતમિહ પરલોકવાતાભિઃ ॥૨૪॥**

અનુવાદ : જે વેશ્યાઓ ધોખીના કપડા ધોવાની શિલા સમાન છે તથા જેમનું આચરણ કુતરાના હાડકા સમાન છે એવી વેશ્યાઓનો જો સંગ કરવામાં આવે તો પછી અહીં પરભવની વાતોથી બસ થાવ.

વિશેષાર્થ : જેવી રીતે ધોખીના પત્થર ઉપર સારા ખરાબ બધી જાતના કપડા ધોવામાં આવે છે તથા જેમ એક હાડકાના ટૂકડાને અનેક કૂતરા બેંચે છે તેવી જ રીતે જે વેશ્યાઓ સાથે જીંચ અને નીચ બધી જાતના માણસો સંબંધ રાખે છે તે વેશ્યાઓમાં અનુરક્ત રહેવાથી આ ભવમાં ધન અને પ્રતિષ્ઠાનો નાશ થાય છે તથા પરભવમાં નરકાદિનું મહાન કષ્ટ ભોગવતું પડે છે. તેથી આ ભવ અને પરભવમાં આત્મ-કલ્યાણ ઈચ્છનારા સત્યુરૂષોએ વેશ્યા વ્યસનનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૪.

(સ્નાધરા)

યા દુદુહૈકવિતા વનમધિવસતિ ત્રાતૃસંબન્ધહીના
ભીતિર્યસ્યાં સ્વભાવાદ્શનધૃતતૃણા નાપરાધં કરોતિ ।
વધ્યાલં સાપિ યાસ્મિન્ નનુ મૃગવનિતામાંસપિણપ્રલોભાત्
આખેટેઽસ્મિન્રતાનામિહ કિમુ ન કિમન્યત્ર નો યદ્ધિસ્લૂપમ् ॥૨૫॥

અનુવાદ : જે હરણી દુઃખદાયક એક માત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી વનમાં રહે છે, રક્ષકના સંબંધ વિનાની છે અર્થાત્ જેને કોઈ રક્ષક નથી, જેને સ્વભાવથી જ ભય રહે છે તથા જે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી અર્થાત્ ઘાસ થકી કોઈનો અપરાધ કરતી નથી; આશ્રય છે કે તે પણ મૃગની સ્ત્રી અર્થાત્ હરણી માંસ પિંડના લોભથી જે મૃગયાના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગયા (શિકાર)માં આસક્ત મનુષ્યોને આ લોકમાં અને પરલોકમાં ક્યું પાપ થતું નથી?

વિશેષાર્થ : એ એક પ્રાચીન પદ્ધતિ છે કે જે શત્રુ દાંતણે ઘાસનું તણખલું રાખીને સામે આવે તેને વીર પુરુષો પરાજિત સમજીને છોડી દેતા હતા, પછી તેમની ઉપર તેઓ શક્ત પ્રહાર કરતા નહિ. પરંતુ બેદ એ વાતનો છે કે શિકારીઓ એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓનો પણ ઘાત કરે છે જે ઘાસનું ભક્ષણ કરતાં મુખમાં તૃશુ દબાવી રહે છે. એ જ ભાવ ‘દર્શનધૃતતૃણા’ આ પદ્ધારા ગ્રંથકારે અહીં સૂચય્યો છે. ૨૫.

(માલિની)

તનુરપિ યદિ લગ્ના કીટિકા સ્યાચ્છરીરે
ભવતિ તરલચક્ષુબ્રાકુલો યઃ સ લોકઃ ।
કથમિહ મૃગયાસાનન્દમુત્ખાતશસ્ત્રો
મૃગમકૃતવિકારં જ્ઞાતદુઃખોડપિ હન્તિ ॥૨૬॥

અનુવાદ : જ્યારે પોતાના શરીરમાં નાનકડી કીડી કે જંતુ ચડી જાય ત્યારે તે મનુષ્ય વ્યાકુળ થઈને ચપળ નેત્રોથી તેને આમતેમ શોધે છે. પાછો તે જ મનુષ્ય પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર આનંદની ખોજમાં કોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શાશ્વતાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? ૨૬.

(શાર્દૂલવિક્રીડિત)

યો યેનૈવ હતઃ સ તં હિ બહુશો હન્ત્યેવ યૈર્વજિતો
નૂં વજ્યયતે સ તાનપિ ભૃંશં જન્માન્તરે ઽષ્ટત્ર ચ ।
સ્ત્રીબાલાદિજનાદપિ સ્ફુર્તમિદં શાસ્ત્રાદપિ શ્રૂયતે
નિત્યં વજ્યનહિસનોજ્ઞનવિધૌ લોકાઃ કુતો મુહ્યત ॥૨૭॥

અનુવાદ : જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાને મારનાર તે મનુષ્યને પણ અનેક વાર મારે જ છે. એવી જ રીતે જે પ્રાણી બીજા લોકો દ્વારા છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માન્તરમાં અને આ જન્મમાં પણ અવશ્ય છો છે. આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમ જ શાશ્વત પાસેથી પણ સ્પષ્ટપણે સાંભળવામાં આવે છે. છતાં લોકો હંમેશાં દગ્ધાબાળ અને હિંસાનો ત્યાગ કરવામાં કેમ મોહ પામે છે? અર્થાત્ તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો પરિત્યાગ સદા માટે અવશ્ય કરી દેવો જોઈએ. ૨૭.

(શાર્દૂલવિક્રીડિત)

અર્થાદૌ પ્રચુરપજ્યરચનૈર્યે વજ્યયન્તે પરાનુ
નૂં તે નરકં વ્રજન્તિ પુરતઃ પાપવ્રજાદન્યતઃ ।

**પ્રાણઃ પ્રાણિષુ તત્ત્વિબન્ધનતયા તિષ્ઠન્તિ નષે ધને
યાવાન્ દુઃખભરો નરે ન મરણે તાવાનિહ પ્રાયશઃ ॥૨૮॥**

અનુવાદ : જે મનુષ્ય ધન આદિ ક્રમાવામાં અનેક પ્રપંચો રથીને બીજાઓને છેતર્યા કરે છે તેઓ નિશ્ચયથી તે પાપના પ્રભાવથી બીજાઓની સામે જ નરકમાં જાય છે. કારણ એ છે કે પ્રાણીઓમાં પ્રાણ ધનના નિમિત જ રહે છે, ધન નષ્ટ થઈ જતાં મનુષ્યને જેટલું અધિક દુઃખ થાય છે તેટલું ધણું કરીને મરતી વખતે પણ થતું નથી. ૨૮.

(શાર્દૂલવિક્રીડિત)

**ચિન્તાવ્યાકુલતાભયારતિમતિભ્રંશાતિદાહભ્રમ—
કૃતૃષ્ણાહતિરોગદુઃખમરણન્યેતાન્યહો આસતામ् ।
યાન્યત્રૈવ પરાઙ્મનાહિતમતેસ્તદ્ભૂરિ દુઃખં ચિરં
શ્વભે ભાવિ યદગ્નિદીપિતવપુરોહાઙ્મનાલિઙ્ગનાત् ॥૨૯॥**

અનુવાદ : પરશ્રીમાં અનુરાગબુદ્ધિ રાખનાર વ્યક્તિને જે આ જન્મમાં ચિંતા, આકુળતા, ભય, દ્વેષભાવ, બુદ્ધિનો વિનાશ, અત્યન્ત સંતાપ, ભ્રાંતિ, ભૂખ, તરસ, આધાત, રોગ વેદના અને મરણરૂપ દુઃખ પ્રાપ્ત થાય છે; એ તો દૂર રહો, પરંતુ પરશ્રી સેવનજનિત પાપના પ્રભાવથી અન્ય જન્મમાં નરકગતિ પ્રાપ્ત થતાં અજિનમાં તપાવેલા લોહમય સ્ત્રીઓના આલિંગનથી જે ચિરકાળ સુધી ધણું દુઃખ પ્રાપ્ત થવાનું છે તે તરફ પણ તેનું ધ્યાન જતું નથી, એ કેટલા આશ્ર્યની વાત છે. ૨૯.

(શાર્દૂલવિક્રીડિત)

**ધિક્ તત્પૌરુષમાસતામનુચિતાસ્તા બુદ્ધયસ્તે ગુણઃ
મા ભૂન્મિત્રસહાયસંપદપિ સા તજ્ઞન્મ યાતુ ક્ષયમ् ।
લોકાનામિહ યેષુ સત્સુ ભવતિ વ્યામોહમુદ્રાઙ્કિતં
સ્વપ્રે ઽપિ સ્થિતિલઙ્ઘનાત્પરધનસ્ત્રીષુ પ્રસક્તં મનઃ ॥૩૦॥**

અનુવાદ : જે પૌરુષ આદિ હોતાં લોકોનું વ્યામોહ પામેલું મન મર્યાદાનું ઉલ્લંઘન કરીને સ્વખમાં પણ પરધન અને પરશ્રીઓમાં આસક્ત થાય છે તે પૌરુષને ધિક્કાર છે તે અયોગ્ય વિચાર અને તે અયોગ્ય ગુણ દૂર જ રહો, એવા

અધિકાર-૧ : ધર્મપદેશામૃત]

૧૭

મિત્રોની સહાયતારૂપ સંપત્તિ પણ પ્રાપ્ત ન થાવ તથા તે જન્મ પણ નાશ પામો. અભિપ્રાય એ છે કે જો ઉપર્યુક્ત સામગ્રી હોતાં લોકોનું મન લોકમર્યાદા છોડીને પરધન અને પરસ્થીમાં આસક્ત થાય છે તો તે બધી સામગ્રી ધિક્કારવા યોગ્ય છે. ૩૦.

(શાર્દૂલવિક્રીદિત)

દૂતાદ્રમસુતः પલાદિહ બકો મદ્યાદ્યરોર્નન્દનાઃ
ચારુઃ કામુકયા મૃગાન્તકતયા સ બ્રહ્મદત્તો નૃપઃ ।
ચૌર્યત્વાચ્છિવભૂતિરન્યવનિતાદોષાદ્શાસ્યો હઠાત्
એકૈકબ્યસનાહતા ઇતિ જનાઃ સર્વેન્ કો નશ્યતિ ॥૩૧॥

અનુવાદ : અહીં જુગારથી યુધિષ્ઠિર, માંસથી બક રાજા, મધ્યથી યાદવો, વેશ્યાસેવનથી ચારુદત્ત, મૃગોના વિનાશરૂપ શિકારથી બ્રહ્મદત્ત રાજા, ચોરીથી શિવભૂતિ પ્રાત્માશ તથા પરસ્થીદોષથી રાવણ; આ રીતે એક એક વ્યસનના સેવનથી આ સાતેય જણ મહાન કષ્ટ પામ્યા છે. તો પછી જે બધા વ્યસનોનું સેવન કરે છે તેનો વિનાશ કેમ ન થાય? અવશ્ય થાય.

વિશેષાર્થ : ‘યત્ પુસ્ : શ્રેયસ : વ્યસ્યતિ તત્ વ્યસનમ्’ અર્થાત् જે મનુષ્યોને કલ્યાણના માર્ગથી ભષ્ટ કરીને દુઃખ પ્રાપ્ત કરાવે છે તેને વ્યસન કહેવામાં આવે છે. આવા વ્યસન મુખ્યપણે સાત છે. તેમનું વર્ણન આગળ થઈ ગયું છે. એમાંથી કેવળ એક એક વ્યસનમાં જ તત્પર રહેવાથી જે યુધિષ્ઠિર આદિ મહાન દુઃખ પામ્યા છે, તેમના નામોનો નિર્દેશ માત્ર અહીં કરવામાં આવ્યો છે. સંક્ષેપમાં તેમની કથા આ રીતે છે.

૧. યુધિષ્ઠિર :—હસ્તિનાપુરમાં ધૂતરાજ નામના એક પ્રસિદ્ધ રાજા હતા. તેને અંબિકા, અંબાલિકા અને અંબા નામની ત્રણ રાણીઓ હતી. એમાંથી અંબિકાથી ધૂતરાધ્ર, અંબાલિકાથી પાંડુ અને અંબાથી વિદુર ઉત્પન્ન થયા હતા. એમાં ધૂતરાધ્રને દુર્યોધન આદિ સો પુત્ર તથા પાંડુને યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નઞ્ચલ અને સહદેવ નામના પાંચ પુત્ર હતા. પાંડુ રાજા સ્વર્ગવાસી થયા પછી કૌરવો અને પાંડવોમાં રાજ્ય નિમિત્તે પરસ્પર વિવાદ થવા લાગ્યો હતો. એક વખત યુધિષ્ઠિર દુર્યોધન સાથે ધૂતકીડા કરવા તૈયાર થયા. તેઓ તેમાં બધી સંપત્તિ હારી ગયા. અંતે તેમણે દ્રોપદી આદિને પણ દાવમાં મૂકી અને દુર્યોધનને એને પણ જીતી લીધી. તેથી દ્રોપદીને અપમાનિત થવું પડ્યું તથા કુંતી અને દ્રોપદી સાથે પાંચે ભાઈઓને બાર વર્ષ સુધી વનમાં રહેવું પડ્યું. તે સિવાય તેમને જુગારના વ્યસનને કારણે બીજા પણ અનેક દુઃખ સહેવા પડ્યા.

૨. બકરાજા : —કુશાગ્રપુરમાં ભૂપાળ નામનો રાજા હતો. તેની પતીનું નામ લક્ષ્મીમતી હતું. એમને બક નામનો એક પુત્ર હતો જે માંસભક્ષણનો બહુ લોલુપી હતો. રાજા દર વર્ષ અષ્ટાલિકા પર્વ આવતાં જીવહિંસા ન કરવાની ઘોષણા કરાવતા હતા. તેણે માંસભક્ષી પોતાના પુત્રની પ્રાર્થનાથી કેવળ એક પ્રાણીની હિંસાની છૂટ આપીને તેને પણ બીજા પ્રાણીની હિંસા ન કરવાનો નિયમ કરાવ્યો હતો. તે પ્રમાણે જ તેણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એક વખતે રસોઈયો માંસ મૂડીને કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ચાલ્યો ગયો હતો. એટલામાં એક બિલાડી તે માંસ ખાઈ ગઈ હતી. રસોઈયાને તેથી ખૂબ ચિંતા થઈ, તે વ્યાકુળ થઈને માંસની શોધમાં શહેરની બહાર ગયો. તેણે એક મરેલા બાળકને જમીનમાં દાટા જોયું. તક મેળવીને તે તેને કાઢી લાખ્યો અને તેનું માંસ રાંધીને બક રાજકુમારને ખવરાવી દીધું, તે દિવસનું માંસ તેને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું. બકે કોઈ પણ ઉપાયે રસોઈયા પસેથી યથાર્થ સ્થિતિ જાણી લીધી. તેણે દરરોજ આ જ પ્રકારનું માંસ ખવરાવવા માટે રસોઈયાને ફરજ પાડી. બિચારો રસોઈયો રોજ ચણા અને લાડુ વગેરે લઈને જતો અને કોઈ એક બાળકને ફોસલાવીને લઈ આવતો. તેથી નગરમાં બાળકો ઘટવા માંડયા. નગરજનો તેથી ખૂબ ચિંતાતુર થઈ ગયા હતા. છેવટે એક દિવસે તે રસોઈયાને બાળક સાથે પકડી લેવામાં આવ્યો. લોકોએ તેને ટીકા પાટુ મારવાનું શરૂ કરી દીધું. તેથી ગમ્ભરાઈને તેણે સાચી વસ્તુ જણાવી દીધી. તે દરમ્યાન પિતા દીક્ષિત થઈ જવાથી બકને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ ગઈ હતી. નગરજનોએ મળીને તેને રાજ્યથી ભાષ્ટ કર્યો. તે શહેરની બહાર રહીને મરેલા મનુષ્યોના મડદા ખાવા લાગ્યો. જ્યારે કોઈવાર તેને જો જીવતો માણસ મળી જતો તો તે તેને પણ ખાઈ જતો. લોકો તેને રાક્ષસ કહેવા લાગ્યો હતા. છેવટે તેને કોઈ રીતે વસુદેવે મારી નાખ્યો હતો. તેને માંસ ભક્ષણના વ્યસનથી આ રીતે દુઃખ સહેવું પડ્યું.

૩ યાદવ : —કોઈ વખતે ભગવાન નેમિનાથ જિનેશ્વરનું સમવસરણ ગિરનાર પર્વત ઉપર આવ્યું હતું. તે વખતે અનેક નગરજનો તેમને વંદન કરવા અને તેમનો ઉપદેશ શ્રવણ કરવા માટે ગિરનાર પર્વત ઉપર પહોંચ્યા હતા, ધર્મશ્રવણના અંતે બળદેવે પૂછ્યું કે ભગવન્! આ દ્વારકાપુરી કુબેરે બનાવી છે. તેનો નાશ કર્યારે અને કેવી રીતે થશે? ઉત્તરમાં ભગવાન નેમિજિન બોલ્યા કે આ નગર મધ્યના નિમિત્તે બાર વર્ષમાં દીપાયનકુમાર દ્વારા ભસ્મીભૂત થશે. આ સાંભળીને રોહિણીનો ભાઈ દીપાયનકુમાર દીક્ષિત થઈ ગયો અને આ અવધિ પૂરી કરવા માટે પૂર્વદેશમાં જઈને તપ કરવા લાગ્યો. ત્યાર પછી તે દીપાયનકુમાર ભ્રમથી ‘હવે બાર વર્ષ વીતી ગયા’ એમ સમજીને ફરીથી પાછો આવી ગયો અને દ્વારકાની બહાર પર્વત પાસે તપ કરવા લાગ્યો. અહીં જિનવચન અનુસાર મધ્યને દ્વારકાદહનનું કારણ સમજીને કૃષ્ણે પ્રજાને મધ્ય અને તેની સાધનસામગ્રીને પણ દૂર ફેંકી ટેવાનો આદેશ આપ્યો હતો. તે પ્રમાણે દારૂ પીનારાઓએ મધ્ય અને તેના સાધનો કાંદંબ પર્વત પાસે એક ખાડામાં ફેંકી દીધા હતા. એ જ સમયે શંબુ આદિ રાજકુમારો વનકીડા માટે ત્યાં ગયા હતા. તેમણે તરસથી પીડાઈને પહેલા ફેંકી દીધેલ તે મધ્યને

પાણી સમજને પી ગયા. તેથી ઉન્મત થઈને તે નાચતા ગાતા દ્વારકા તરફ પાછા આવી રહ્યા હતા. તેમણે માર્ગમાં દ્વિપાયન મુનિને ઉભેલા જોઈને તેમને દ્વારિકાના બાળનાર સમજને તેમના ઉપર પથર ફેંકવા શરૂ કર્યા. જેથી કોધવશ મરણ પામીને તે અભિનુકુમાર દેવ થયા. તેણે ચારે બાજુથી દ્વારિકાપુરીને અભિનથી પ્રજળવિલ કરી દીધી. આ દુર્ઘટનામાં કૃષ્ણ અને બળદેવ સિવાય બીજું કોઈ પણ પ્રાણી જીવિત રહી શક્યું નહિ. આ બધું મધ્યપાનના દોષથી થયું હતું.

૪. ચારુદત :—ચંપાપુરીમાં એક ભાનુદત નામના શેડ હતા. તેમની પત્નીનું નામ સુભદ્રા હતું. આ બન્નેની યુવાન અવસ્થા પુત્ર વિના જ વીતી ગઈ. ત્યાર પછી તેમને એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ ચારુદત રાખવામાં આવ્યું, તેને બાળપણમાં જ અશુદ્ધતની દીક્ષા આપવામાં આવી હતી. તેનો વિવાહ મામા સર્વાર્થની પુત્રી મિત્રવતી સાથે થયો હતો. ચારુદતને શાસ્ત્રનું વ્યસન હતું, તેથી પત્ની પ્રત્યે તેને જરા પણ પ્રેમ નહોતો. ચારુદતની માતાએ તેને કામભોગમાં આસક્ત કરવા માટે રૂદ્રદતા (ચારુદતના કાકા) ને પ્રેરણા કરી. તે કોઈ પણ બહાને ચારુદતને કલિંગસેના વેશ્યાને ત્યાં લઈ ગયો. તેને એક વસન્તસેના નામની સુંદર પુત્રી હતી. ચારુદતને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો. તેનામાં આસક્ત હોવાથી કલિંગસેનાએ વસન્તસેના સાથે ચારુદતના લગ્ન કરી દીધા હતા. તે વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રહ્યો. તેનામાં અત્યંત આસક્ત હોવાથી જ્યારે ચારુદતે કદી માતા, પિતા અને પત્નીને પણ યાદ ન કરી તો પછી બીજા કામની બાબતમાં શું કહેવાય? આ દરમ્યાન કલિંગસેનાને ત્યાં ચારુદતના ઘરેથી સોણ કરોડ દીનાર આવી ગઈ હતી. ત્યાર પછી જ્યારે કલિંગસેનાએ મિત્રવતીના આભૂષણો પણ આવતા જોયા ત્યારે તેણે વસન્તસેનાને ધનહીન ચારુદતને છોડી દેવાનું કહ્યું. માતાના આ વચનો સાંત્બળીને વસન્તસેનાને અત્યાર દુઃખ થયું. તેણે કહ્યું હે માતા! ચારુદત સિવાય હું કુબેર જેવા સંપત્તિવાન બીજા પુરુષને ચાહતી નથી. માતાએ પુત્રીનો દુરાગ્રહ જોઈને અન્ય ઉપાય વડે ચારુદતને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તેણે ઘેર જઈને દુઃખમાં સમય વીતાવતી માતા અને પત્નીને જોઈ તેમને આશ્ચાસન આપીને ચારુદત ધન મેળવવા માટે બીજા દેશમાં ચાલ્યો ગયો. તે અનેક દેશો અને દીપોમાં ગયો, પરંતુ બધે તેને મહાન કષ્ટોનો સામનો કરવો પડ્યો. અંતે તે પૂર્વના ઉપકારી બે દેવોની સહાયથી મહાન વૈભવ સહિત ચંપાપુરીમાં પાછો આવી ગયો. તેણે વસન્તસેનાને પોતાને ઘેર બોલાવી લીધી. પછી મિત્રવતી અને વસન્તસેના આદિ સાથે સુખપૂર્વક કેટલોક કાળ વીતાવીને ચારુદતે જિનદીક્ષા લઈ લીધી. આ રીતે તપશ્ચરણ કરતો થકો તે મરણ પામીને સર્વાર્થસિદ્ધિમાં દેવ થયો. જે વેશ્યા વ્યસનને કારણે ચારુદતને અનેક કષ્ટ સહન કરવા પડ્યા તેને વિવેકી જીવોએ સદાને માટે છોડી દેવા જોઈએ.

૫. બ્રહ્મદત :—ઉજ્જયિની નગરીમાં એક બ્રહ્મદત નામનો રાજા હતો. તે મૃગયા (શિકાર)ના વ્યસનમાં અત્યંત આસક્ત હતો. કોઈ વખતે તે શિકાર માટે વનમાં ગયો હતો. તેણે ત્યાં એક શિલા ઉપર ધ્યાન સ્થિત મુનિને જોયા. તેથી તેનું શિકારનું કામ નિષ્ફળ થઈ ગયું. તે બીજે દિવસે પણ ઉક્ત વનમાં શિકાર કરવા માટે ગયો, પરંતુ મુનિના પ્રભાવથી ફરીથી પણ તેને

આ કાર્યમાં સફળતા ન મળી. આ રીતે તે કેટલાય દિવસ ત્યાં ગયો, પરંતુ તેને આ કાર્યમાં સફળતા ન મળી શકી. તેથી તેને મુનિ ઉપર અતિશય કોષ ઉત્પન્ન થયો. કોઈ એક દિવસ જ્યારે મુનિ આહાર માટે નગરમાં ગયા હતા ત્યારે બ્રહ્મદત્તે અવસર જોઈને તે શિલાને અગ્નિશી બાળી નાખી. એ દરમ્યાન મુનિરાજ પણ ત્યાં પાછા આવ્યા અને ઝડપથી તે બળતી શિલા ઉપર બેસી ગયા. તેમણે ધ્યાન છોડ્યું નહિ, તેથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ અંતઃકૃત કેવળી થઈને મુક્તિ પામ્યા. અહીં બ્રહ્મદત્ત રાજા શિકારના વ્યસન અને મુનિના તીવ્રદેષના કારણે સાતમી નરકમાં નારકી થયો. ત્યાર પછી વચ્ચે વચ્ચે કૂર હિંસક તિર્યચ થઈને કુમપૂર્વક છઢી અને પાંચમી આદિ બાકીની નરકભૂમિમાં પણ ગયો. શિકારના વ્યસનમાં આસકત હોવાથી પ્રાણીઓને આવા જ ભયાનક કષ્ટ સહન કરવા પડે છે.

૬. શિવભૂતિ :—બનારસ નગરમાં રાજા જ્યસિંહ રાજ્ય કરતો હતો. રાણીનું નામ જ્યાવતી હતું. આ રાજાને એક શિવભૂતિ નામનો પૂરોહિત હતો. તે પોતાના સત્યવાદિતાને કારણે પૃથ્વી પર ‘સત્યઘોષ’ નામે પ્રસિદ્ધ થઈ ગયો હતો. તેણે પોતાની યજ્ઞોપવીતમાં એક છરી બાંધી રાખી હતી. તે કહ્યા કરતો કે જો હું કદાચ જૂદું બોલું તો આ છરીથી મારી જીભ કાપી નાખીશ. આ વિશ્વાસથી ધણા માણસો એની પાસે સાચવવા માટે પોતાનું ધન રાખતા હતા. કોઈ એક દિવસે પદ્મપુરથી એક ધનપાળ નામનો શેઠ આવ્યો અને એની પાસે પોતાના અત્યંત કિંમતી ચાર રત્નો રાખીને વ્યાપાર માટે પરદેશમાં ચાલ્યો ગયો. તે બાર વર્ષ વિદેશમાં રહીને અને ધણું ધન કમાઈને પાછો આવી રહ્યો હતો. રસ્તામાં તેની નાવ દૂબી ગઈ અને બધું ધન નાશ પામ્યું. આ રીતે તે ધનહીન થઈને બનારસ પાછો પહોંચ્યો. તેણે શિવભૂતિ પૂરોહિત પાસે પોતાના ચાર રત્નો પાછા માણ્યાં. પુરોહિતે ગાંડો ગણાવીને તેને ધરમાંથી બહાર કઢાવી મૂક્યો. ગાંડો સમજીને જ તેની વાત રાજા વગેરે કોઈએ પણ ન સાંભળી. એક દિવસ રાણીએ તેની વાત સાંભળવા માટે રાજાને આગ્રહ કર્યો. રાજાએ તેને પાગલ કહ્યો તે સાંભળીને રાણીએ કહ્યું કે પાગલ તે નથી પણ તમે જ છો. ત્યાર પછી રાજાની આજા પ્રમાણે રાણીએ તેને માટે કંઈક ઉપાય વિચાર્યો. તેણે પુરોહિત સાથે જુગાર રમતાં તેની વીંટી અને છરી સહિત યજ્ઞોપવીત પણ જીતી લીધી અને તેને ઓળખાણની નિશાની તરીકે પુરોહિતની સ્ત્રી પાસે મોકલીને તે ચારેય રત્નો મંગાવી લીધા. રાજાને શિવભૂતિના આ વ્યવહારથી ખૂબ હુઃખ થયું. રાજાએ તેને છાણનું ભક્ષણ, મુષ્ટિઓનો પ્રહાર અથવા પોતાના દ્રવ્યનું સમર્પણ આ ત્રણમાંથી કોઈ પણ એક દંડ સહન કરવાની ફરજ પાડી. તે પ્રમાણે તે છાણ ખાવા તૈયાર થયો પરંતુ ખાઈ ન શક્યો. તેથી મુષ્ટિના પ્રહારની ઈચ્છા પ્રગટ કરી. તે પ્રમાણે મહિલાઓ મુષ્ટિઓનો પ્રહાર કરતાં તે મરી ગયો અને રાજાના ભંડારમાં સર્પ થયો. આ રીતે તેને ચોરીના વ્યસનના કારણે આ કષ્ટ સહન કરવું પડ્યું.

૭. રાવણ :—કોઈ સમયે અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને ચાર પત્ની હતી. કૌશલ્યા, સુમિત્રા, કેકેયી અને સુપ્રભા. એમને કમશા: આ ચાર પુત્ર ઉત્પન્ન

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૨૧

થયા હતા. રામચન્દ્ર, લક્ષ્મણ, ભરત અને શત્રુંદ. એક દિવસ રાજા દશરથને પોતાનો વાળ સહેદ દેખાયો. તેથી તેમને ઘણો વૈરાગ્ય થયો. તેમણે રામચંદ્રને રાજ્ય આપીને જિનદીકા લેવાનો નિશ્ચય કર્યો. પિતાની સાથે ભરતનો પણ દીક્ષા લેવાનો વિચાર જાણીને તેની માતા કેકેયી બહુ દુઃખી થઈ. તેણીએ એનો એક ઉપાય વિચારીને રાજા દશરથ પાસે પૂર્વે આપાયેલું વરદાન માગ્યું. રાજાનો સ્વીકાર મેળવીને તેણે ભરતને રાજ્ય આપવાની ઈચ્છા પ્રગટ કરી. રાજા વિચારમાં પડી ગયા. તેમને ખેદભિન્ન જોઈને રામચંદ્ર મંત્રીઓને તેનું કારણ પૂછ્યું અને તેમની પાસેથી ઉપર્યુક્ત સમાચાર જાણીને પોતે જ ભરતને પ્રસન્નતાથી રાજ્યતિલક કરી દીધું. ત્યાર પછી ‘મારા અહીં રહેવાથી ભરતની પ્રતિષ્ઠા નહિ રહી શકે’ આ વિચારથી તે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યાથી બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે જતાં તેઓ દંડકવનની મધ્યમાં પહોંચીને ત્યાં સ્થિર થયા. અહીં વનની શોભા જોતાં લક્ષ્મણ આમ તેમ ધૂમી રહ્યા હતા. તેમને એક વાંસોના સમૂહમાં લટકતું એક ખડુગ (ચન્દ્રહાસ) જોવામાં આવ્યું. તેમણે જડપીને તે હાથમાં લઈ લીધું અને પરીક્ષા માટે તે જ વાંસના સમૂહ ઉપર ચલાવ્યું. તેથી વાસના સમૂહ સાથે તેની અંદર બેઠેલા શંખૂકુમારનું મસ્તક કપાઈને જુદું થઈ ગયું. આ શંખૂકુમાર જ તેને અહીં બેસીને બાર વર્ષથી સિદ્ધ કરી રહ્યો હતો. આ ઘટનાના થોડા જ સમય પછી ખરદૂષણની પત્તી અને શંખૂકની માતા સૂર્પનખા ત્યાં આવી પહોંચી. પુત્રની આવી દશા જોઈને તે વિલાપ કરતી આમ તેમ શત્રુની શોધ કરવા લાગી. તે થોડે જ દૂર રામચંદ્ર અને લક્ષ્મણને જોઈને તેમના રૂપ ઉપર મોહિત થઈ ગઈ. તેણીએ એ માટે બંનેને પ્રાર્થના કરી, પરંતુ જ્યારે બંનેમાંથી કોઈએ પણ તેનો સ્વીકાર ન કર્યો ત્યારે તે પોતાનું શરીર વિકૃત કરીને ખરદૂષણ પાસે પહોંચી અને તેને યુદ્ધ માટે ઉત્તેજિત કર્યો. ખરદૂષણ પણ પોતાના સાણા રાવણને એને સૂચના કરાવીને યુદ્ધ માટે નીકળી પડ્યો. સેના સહિત ખરદૂષણને આવતો જોઈને લક્ષ્મણ પણ યુદ્ધ માટે ચાલી નીકળ્યો. તે જતી વખતે રામચંદ્રને એમ કહેતા ગયા કે હું વિપત્તિગ્રસ્ત થઈને સિંહનાદ કરું તો જ તમે મારી સહાય માટે આવજો, નહિ તો અહીં સ્થિત રહીને સીતાની રક્ષા કરજો. એ દરમાન પુષ્પકવિમાનમાં બેસીને રાવણ પણ ખરદૂષણની મદદ માટે લંકાથી અહીં આવી રહ્યો હતો. તે અહીં સીતાને બેઠેલી જોઈને તેના રૂપ ઉપર મોહિત થઈ ગયો અને તેને ઉપાડી જવાનો ઉપાય વિચારવા લાગ્યો, તેણે ખાસ વિદ્યાથી જાણીને થોડે દૂરથી સિંહનાદ કર્યો. તેથી રામચંદ્ર લક્ષ્મણને આપત્તિમાં પડેલા સમજીને તેમને મદદ કરવા માટે ચાલ્યા ગયા. આ રીતે રાવણ તક મેળવીને સીતાને હરીને લઈ ગયો. આ તરફ લક્ષ્મણ ખરદૂષણને મારીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તે અક્ષમાત્ર રામચંદ્રને આ તરફ આવતા જોઈને ખૂબ ચિન્તાતુર થયા. તેણે તરત જ રામચંદ્રને પાછા જવા માટે કહ્યું. તેમને પાછા ફરતાં ત્યાં સીતા જોવામાં આવી નહિ. તેથી તે બહુ વ્યાકુળ થયા. થોડી વારમાં લક્ષ્મણ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેમને સુશ્રીવ આદિ વિદ્યાધરોનો પરિયય થયો. કોઈ પણ ઉપાયે હનુમાન લંકા પહોંચી ગયા. તેમણે ત્યાં રાવણના બગીચામાં બેઠેલા સીતાને અત્યંત વ્યાકુળ જોઈને આશ્વાસન આપ્યું અને તરત જ પાછા આવીને રામચંદ્રને બધી

હકીકત કહી સંભળાવી. અંતે યુદ્ધની તૈયારી કરીને રામયંત્ર સેના સહિત લંકા જઈ પહોંચ્યા. તેમણે સીતાને પાછી આપવા માટે રાવણને બહુ સમજાવ્યો પણ તે સીતાને પાછી આપવા તૈયાર થયો નહિ. તેને આવી રીતે પરખીમાં આસકત જોઈને તેનો પોતાનો ભાઈ વિભીષણ પણ રીસાઈને રામયંત્રની સેનામાં આવી ભય્યો. છેવટે બન્ને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું, જેમાં રાવણના અનેક કુટુંબીઓ અને તે પોતે પણ માર્યો ગયો. પરખીના મોહથી રાવણની બુદ્ધિ નાશ પામી હતી, તેથી તેને બીજા હિતેચ્છક માણસોના પ્રિય વચ્ચનો પણ અપ્રિય જ લાગ્યા અને અંતે તેને આ જાતનું દુઃખ સહન કરવું પડ્યું. ૩૧.

(આર્યા)

ન પરમિયન્તિ ભવન્તિ વ્યસનાન્યપરાણ્યપિ પ્રભૂતાનિ ।
ત્વક્ત્વા સત્યથમપથપ્રવૃત્તયઃ ક્ષુદ્રબુદ્ધીનામ् ॥૩૨॥

અનુવાદ : કેવળ આટલા (સાત) જ વ્યસન નથી, પણ બીજા ય ઘણા વ્યસનો છે કારણ કે અલ્યમતિ મનુષ્ય સમીચીન માર્ગ છોડીને કુત્સિત માર્ગમાં પ્રવૃત્ત થયા કરે છે.

વિશેખાર્થ : જે અસત્ પ્રવૃત્તિઓ મનુષ્યને સન્માર્ગથી ભટ કરે છે તેમનું નામ વ્યસન છે. એવા વ્યસન ઘણા હોઈ શકે છે. તેમની આ સાતની સંખ્યા સ્થૂળપણે જ નક્કી કરવામાં આવી છે. કારણ કે મંદબુદ્ધ મનુષ્ય સન્માર્ગથી ચ્યુત થઈને વિવિધ રીતે કુમાર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેમની આ બધી પ્રવૃત્તિઓ વ્યસનમાં જ સમાયેલી તેથી વ્યસનોની આ સાતની સંખ્યા સ્થૂળરૂપે જ સમજવી જોઈએ. ૩૨.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વાણિ વ્યસનાનિ દુર્ગતિપથાઃ સ્વર્ગાપવર્ગાર્ગલાઃ
વગ્રાણિ વ્રતપર્વતેષુ વિષમાઃ સંસારિણાં શત્રવઃ ।
પ્રારમ્ભે મધુરેષુ પાકકટુકેષ્વેતેષુ સદ્ગ્રીધનૈ:
કર્તવ્યા ન મતિર્મનાગપિ હિતં વાજ્ઞાદ્વિરત્રાત્મનઃ ॥૩૩॥

અનુવાદ :—બધા વ્યસનો નરકાદિ દુર્ગતિઓના કારણ હોઈને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં આગળિયા સમાન છે, એ સિવાય તે વ્રતરૂપી પર્વતોને નષ્ટ કરવા માટે વજ જેવા હોઈને સંસારી જીવો માટે દુર્દ્દ શત્રુ સમાન જ છે. આ વ્યસનો જો કે શરૂઆતમાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે કડવા જ છે. તેથી જ અહીં

અધિકાર-૧ : ધર્માપદેશામૃત]

૨૩

આત્મહિતની ઈચ્છા રાખનાર બુદ્ધિમાન પુરુષોએ આ વ્યસનોમાં જરા પણ બુદ્ધિ ન લગાવવી જોઈએ. ઉત્ત.

(વસંતતિલકા)

મિથ્યાદ્વાદાં વિસદ્ધશાં ચ પથચ્યુતાનાં
માયાવિનાં વ્યસનિનાં ચ ખલાત્મનાં ચ ।
સંગ વિમુજ્ચત બુધાઃ કુરુતોત્તમાનાં
ગન્તું મતિર્યદિ સમુન્નતમાર્ગ એવ ॥૩૪॥

અનુવાદ : જો ઉત્તમ માર્ગમાં જ ગમન કરવાની અભિલાષા હોય તો બુદ્ધિમાન પુરુષોનું એ આવશ્યક કર્તવ્ય છે કે તે મિથ્યાદ્વાદિઓ, વિસદ્ધશો અર્થાત્ વિરુદ્ધ ધર્મના અનુયાયીઓ, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલાઓ, માયાચારીઓ, વ્યસનના પ્રેમીઓ તથા દુષ્ટ જનોનો સંગ છોડીને ઉત્તમ પુરુષોનો સત્સંગ કરે . ઉત્ત.

(વસંતતિલકા)

સ્નિગ્ધેરપિ બ્રજત મા સહ સંગમેભિ:
ક્ષુદ્રૈ: કદાચિદપિ પશ્યત સર્ષપાણામ् ।
સ્નેહો ઽપિ સંગતિકૃતઃ ખલતાશ્રિતાનાં.
લોકસ્ય પાત્યાતિ નિશ્ચિતમશ્રુ નેત્રાત્ ॥૩૫॥

અનુવાદ : ઉપર્યુક્ત મિથ્યાદ્વાદિ આદિ તુચ્છ જીવો જો પોતાના સર્ગા પણ હોય તો પણ તેમનો સંગ કદી યે ન કરવો જોઈએ. જુઓ, ખલતા (તેલ નીકળી ગયા પછી પ્રાપ્ત થનાર સરસવની ખોળરૂપ અવસ્થા, બીજા પક્ષે દુષ્ટતા)નો આશ્રય કરનાર ક્ષુદ્ર સરસવના દાણાનો સ્નેહ (તેલ) પણ સંગ પામીને નિશ્ચયથી લોકોની આંખમાંથી આંસુ પડાવે છે.

વિશેખાર્થ : જેમ નાના હોવા છતાં સરસવના દાણામાંથી નીકળેલ સ્નેહ (તેલ)ના સંયોગથી તેની તીક્ષ્ણતાને કારણે માણસની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે તેવી જ રીતે ઉપર્યુક્ત ક્ષુદ્ર મિથ્યાદ્વાદિ આદિ દુષ્ટ પુરુષોના સ્નેહ (પ્રેમ, સંગ)થી થનાર ઐહિક અને પારલૌકિક દુઃખનો અનુભવ કરનાર પ્રાણીની પણ આંખોમાંથી પશ્યાત્તાપને કારણે આંસુ નીકળવા લાગે છે. તેથી આત્મહિત ઈચ્છનાર જીવોએ આવા દુષ્ટ મનુષ્યોના સંગનો પરિત્યાગ કરવો જ જોઈએ . ઉપ.

(શિખરિણી)

કલાવેક: સાધુભર્વતિ કથમણ્યત્ર ભુવને
સ ચાદ્રાતઃ ક્ષુદ્રૈ: કથમકરુણૈર્જીવતિ ચિરમૂ ।
અતિગ્રીષ્મે શુષ્પ્યત્સરસિ વિચરચ્છુચરતાં
બકોટાનામાગે તરલશફરી ગચ્છતિ કિયત્ર ॥૩૬॥

અનુવાદ : આ લોકમાં કળિકાળના પ્રભાવથી ખૂબ મુશ્કેલીથી એકાદ જ સાધુ હોય છે. તે પણ જ્યાં નિર્દ્ય દુષ્પ પુરુષો દ્વારા સતાવાય ત્યાં ભલા કેવી રીતે ચિરકાળ જીવિત રહી શકે? અર્થાત् રહી શકતા નથી. યોગ્ય જ છે-જ્યારે આકરા ઉનાળામાં તળાવનું પાણી સૂકાવા માંડે છે ત્યારે ચાંચ હલાવીને ચાલતા બગલાઓ આગળ ચંચળ માછલી કેટલો સમય સુધી ચાલી શકે? અર્થાત् બહુ લાંબા સમય સુધી તે ચાલી શકતી નથી, પણ તેના દ્વારા મારીને ખવાઈ જાય છે. ઉદ્દેશ.

(માલિની)

ઇહ વરમનુભૂતં ભૂરિ દારિદ્રુઃખં
વરમતિવિકરાલે કાલવકત્રે પ્રવેશઃ ।
ભવતુ વરમિતો ઽપિ કલેશજાલં વિશાલં
ન ચ ખલજનયોગાજીવિતં વા ધનं વા ॥૩૭॥

અનુવાદ : સંસારમાં ગરીબાઈના ભારે દુઃખનો અનુભવ કરવો ક્યાંય સારો છે, એવી જ રીતે અત્યંત ભયાનક મૃત્યુના મુખમાં પ્રવેશ કરવો પણ ક્યાંય સારો છો, એ જો અહીં બીજા પણ અતિશય કષ્ટ પ્રાપ્ત થાય છે તો તે પણ ભલે થાવ; પરંતુ દુષ્ટોના સંબંધથી જીવન અથવા ધન ચાહું શ્રેષ્ઠ નથી. ઉદ્દેશ.

(શાર્દૂલવિક્રીડિત)

આચારો દશર્થમસંયમતપોમૂલોત્તરાખ્યા ગુણા:
મિથ્યામોહમદોજ્ઞાનં શમદમધ્યાનાપ્રમાદસ્થિતિઃ ।
વैરાગ્યં સમયોપબૃમહણગુણા રત્નત્રયં નિર્મલં
પર્યન્તે ચ સમાધિરક્ષયપદાનન્દાય ધર્મો યતે: ॥૩૮॥

અનુવાદ : જ્ઞાનાચારાદિ સ્વરૂપ પાંચ પ્રકારના આચાર; ઉત્તમ ક્ષમાદિરૂપ દસ પ્રકારના ધર્મ; સંયમ, તપ તથા મૂળગુણ અને ઉત્તરગુણ; મિથ્યાત્વ, મોહ અને મદનો પરિત્યાગ; કષાયોનું શમન, ઈન્દ્રિયોનું દમન, ધ્યાન, પ્રમાદ રહિત અવસ્થાન, સંસાર, શરીર અને ઈન્દ્રિયવિષયોથી વિરક્તિ; ધર્મને વધારનાર અનેક ગુણ, નિર્મણ રત્નત્રય, તથા અંતે સમાધિમરણ; આ બધા મુનિના ધર્મો છે જે અવિનશ્વર મોક્ષપદના આનંદ (અવ્યાબાધ સુખ)નું કારણ છે. ઉ૮.

(शार्दूलविक्रीडि)

सं शुद्धं प्रविहाय चिदूगुणमयं भ्रान्त्याणुमात्रे ऽपि यत्
 संबन्धाय मतिः परे भवति तद्बन्धाय मूढात्मनः ।
 तस्मात्याज्यमशेषमेव महतामेतच्छरीरादिकं
 तत्कालादिविनादियुक्तिं इदं तत्यागकर्म ब्रतम् ॥३९॥

અનુવાદ : યૈતન્ય ગુણસ્વરૂપ શુદ્ધ આત્માને છોડીને ભાંતિથી જે અજ્ઞાની જીવની બુદ્ધિ પરમાણુ પ્રમાણ પણ બાબ્ય વસ્તુવિષયક સંયોગ માટે હોય છે તે તેના કર્મબંધનું કારણ થાય છે. તેથી મહાન પુરુષોએ આ શરીર આદિ સર્વનો ત્યાગ કર્ણાદિ વિના પ્રથમ યુક્તિએ કરવો જોઈએ. આ ત્યાગકર્મ વ્રત છે.

વિશોધાર્થ : આનો અભિપ્રાય એ છે કે શરીર આદિ જે કોઈ બાધ્ય પદાર્થ છે તેમાં મમતવખુદ્ધિ રાખીને તેમના સંયોગ આદિ માટે જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી કર્મનો બંધ થાય છે અને પછી આનાથી જીવ પરાધીનતાને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ઉપાદેય સમજીને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેનાથી કર્મબંધનો અભાવ થઈને જીવને સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. તેથી અહીં એ ઉપદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી ઉપર્યુક્ત શરીર આદિ રત્નત્રયની પરિપૂર્ણતામાં સહાય કરે છે ત્યાં સુધી જ મમતવખુદ્ધિ છોડીને શુદ્ધ આહાર આદિ દ્વારા તેમનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ જ્યારે તે અસાધ્ય રોગાદિના કારણે ઉક્ત રત્નત્રયની પૂર્ણતામાં બાધક બની જાય છે ત્યારે તેના નાશ થવાના કાળ આદિની અપેક્ષા ન કરતાં ધર્મની રક્ષા કરતાં સંલ્લેખના વિધિથી તેમનો ત્યાગ કરી દેવો જોઈએ. એ જ ત્યાગકર્મની વિશોષતા છે. ઉદ્દ.

(शार्दूलविक्रीडि)

मुक्त्वा मूलगुणान् यतेर्विदधतः शेषेषु यत्नं परं
दण्डो मूलहरो भवत्यविरतं पूजादिकं वाज्ञतः ।

એકं પ્રાપ્તમરે: પ્રહારમતુલં હિતા શિરચ્છેદકં
રક્ષત્યદ્ગુલિકોટિખણ્ડનકરં કો ઇન્યો રણે બુદ્ધિમાન् ॥૪૦॥

અનુવાદ : મૂળગુણો છોડીને કેવળ બાકીના ઉત્તરગુણોના પરિપાલનમાં જ પ્રયત્ન કરનાર તથા નિરંતર પૂજા આદિની ઈચ્છા રાખનાર સાધુનો આ પ્રયત્ન મૂળધાતક થશે. કારણ કે ઉત્તર ગુણોમાં દેછતા આ મૂળ ગુણોના નિમિત્તે જ પ્રાપ્ત થાય છે તેથી આ તેનો પ્રયત્ન એવો છે કે જેમ કોઈ મૂર્ખ સુભટ પોતાના મસ્તકનું છેદન કરનાર શત્રુના અનુપમ પ્રહારની પરવા ન કરતા કેવળ આંગળીના અગ્રભાગના ખંડન કરનાર પ્રહારથી જ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. ૪૦.

(શાર્દૂલવિક્રીડિત)

મ્લાને ક્ષાલનતઃ કૃતઃ કૃતજલાદ્યારમ્ભતઃ સંયમો
નષ્ટે વ્યાકુલચિત્તતાથ મહતામપ્યન્યતઃ પ્રાર્થનમ् ।
કૌપીનેઽપિ હૃતે પરૈશ્ચ ઝાટિતિ ક્રોધઃ સમુત્પદ્યતે
તત્ત્ત્વિત્યં શુચિ રાગહત્ત શમવતાં વસ્ત્રં કકુમ્મણ્ડલમ् ॥૪૧॥

અનુવાદ : વસ્ત્ર મલિન થતાં તેને ધોવા માટે પાણી, સોડા, સાખુ વગેરેનો આરંભ કરવો પડે છે અને આ હાલતમાં સંયમનો ઘાત થવો અવશ્યંભાવી છે તે સિવાય તે વસ્ત્ર નાશ પામતાં મહાન પુરુષોનું મન પણ વ્યાકુળ થઈ જાય છે તેથી બીજા પાસે તે મેળવવા માટે પ્રાર્થના કરવી પડે છે. જો બીજાઓ દ્વારા કેવળ લંગોટીનું જ અપહરણ કરવામાં આવે તો ઝટ કોધ ઉત્પન્ન થાય છે. આ જ કારણે મુનિઓ સદા પવિત્ર અને રાગભાવને દૂર કરનાર દિશાઓના સમૂહરૂપ અવિનશ્શર વસ્ત્ર (દિગંબરપણા)નો આશ્રય લે છે. ૪૧.

(શાર્દૂલવિક્રીડિત)

કાકિન્યા અપિ સંગ્રહો ન વિહિતઃ ક્ષૌરં યયા કાર્યતે
ચિત્તક્ષેપકૃદસ્ત્રમાત્રમપિ વા તત્સિદ્ધ્યે નાશ્રિતમ् ।
હિંસાહેતુરહો જટાદ્યપિ તથા યૂકાભિરગ્રાર્થનૈ:
વૈરાગ્યાદિવિવર્ધનાય યતિભિ: કેશેષુ લોચઃ કૃતઃ ॥૪૨॥

અનુવાદ : મુનિઓ કોડી માત્ર પણ ધનનો સંગ્રહ કરતા નથી, કે જેથી મુંડન કાર્ય કરાવી શકાય; અથવા ઉક્ત મુંડન કાર્ય સિદ્ધ કરવા માટે તેઓ અસ્તરો, કાતર વગેરે ઓજારનો પણ આશ્રય લેતા નથી કેમ કે તેનાથી ચિત્તમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ જટા ધારણા કરી લેતા હોય એ પણ શક્ય નથી કેમકે એ અવસ્થામાં તેમાં ઉત્પન્ન થનાર જૂ આદિ જંતુઓની હિંસા ટાળી શકાતી નથી. તેથી અયાચકૃવૃત્તિ ધારણા કરનાર સાધુઓ વૈરાગ્ય આદિ ગુણ વધારવા માટે વાળનો લોચ કરે છે. ૪૨.

(શાર્દૂલવિક્રીડિત)

યાવન્મે સ્થિતિભોજને ઽસ્તિ દેઠતા પાણ્યોશ્ચ સંયોજને
ભુજે તાવદહં રહાસ્યથ વિધાવેષા પ્રતિજ્ઞા યતે: ।
કાયે ઽપ્યસ્પૃહચેતસો ઽન્યવિધિષુ ગ્રોલાસિનઃ સન્મતે:
ન હેતેન દિવિ સ્થિરિન નરકે સંપદ્યતે તદ્વિના ॥૪૩॥

અનુવાદ : જ્યાં સુધી મારામાં ઊભા રહીને ભોજન કરવાની દેઠતા છે તથા બન્ને હાથ જોડવાની પણ દેઠતા છે ત્યાં સુધી હું ભોજન કરીશ, નહિ તો ભોજનનો પરિત્યાગ કરીને ભોજન વિના જ રહીશ; આ રીતે જે યતિ પ્રતિજ્ઞાપૂર્વક પોતાના નિયમમાં દેઢ રહે છે તેનું ચિત્ત શરીરમાં નિઃસ્પૃહ થઈ જાય છે. તેથી તે સદ્બુદ્ધિમાન સાધુ સમાધિમરણના નિયમોમાં આનંદનો અનુભવ કરે છે. આ રીતે મરીને તે સ્વર્ગમાં સ્થિત થાય છે તથા આનાથી વિપરીત આચરણ કરનાર બીજા સાધુ નરકમાં સ્થિત થાય છે. ૪૪.

(શાર્દૂલવિક્રીડિત)

એકસ્યાપિ મમત્વમાત્મવપુષઃ સ્યાત્સંસૃતે: કારણं
કા બાહ્યાર્થકથા પ્રથીયસિ તપસ્યારાધ્યમાને ઽપિ ચ ।
તદ્વાસ્યાં હરિચન્દને ઽપિ ચ સમઃ સંશ્લિષ્ટતો ઽપ્યઙ્ગતો
ભિન્નं સ્વં સ્વયમેકમાત્મનિ ધૃતં પશ્યત્યજસ્તં મુનિઃ ॥૪૪॥

અનુવાદ : મહાન તપનું આરાધન કરવા છતાં પણ જો એક માત્ર પોતાના શરીરમાં જ રહેવાવાળો મમત્વભાવ સંસારનું કારણ થાય છે તો ભલા પ્રત્યક્ષ જુદા દેખાતા અન્ય બાધ્ય પદાર્થોના વિષયમાં શું કહેવું? અર્થાત્ તેમના મોહથી તો સંસાર પરિભ્રમણ થશે જ. તેથી મુનિઓ નિરંતર કુહાડી અને હરિત ચંદન એ બન્નેમાંય

સમભાવ ધારણ કરતાં આત્મા સાથે સંયોગ પામેલ શરીરથી ભિન્ન એક માત્ર આત્માને જ આત્મામાં ધારણ કરીને તેની ભિન્નતાનું સ્વયં અવલોકન કરે છે. ૪૪.

(શિખરિણી)

તૃણ વા રત્ન વા રિપુરથ પરં મિત્રમથવા
સુખં વા દુઃખં વા પિતૃવનમહો સૌધમથવા ।
સુતિર્વા નિન્દા વા મરણમથવા જીવિતમથ
સુફું નિર્ગથાનાં દ્વયમપિ સમં શાન્તમનસામુ ॥૪૫॥

અનુવાદ : જેમનું મન શાન્ત થઈ ગયું છે એવા નિર્ગથ મુનિઓને ધાસ અને રત્ન, શત્રુ અને ઉત્તમ ભિત્ર, સુખ અને દુઃખ, સ્મશાન અને મહેલ, સ્તુતિ અને નિંદા તથા મરણ અને જીવન; આ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં સ્પષ્ટપણે સમાનબુદ્ધિ હોય છે. અભિપ્રાય એ છે કે તેઓ તૃણ અને શત્રુ આદિ અનિષ્ટ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ રાખતા નથી તથા તેમનાથી વિપરીત રત્ન અને ભિત્ર આદિ ઈષ્ટ પદાર્થોમાં રાગબુદ્ધિ પણ રાખતા નથી, પરંતુ બન્નોમાં સમજે છે. ૪૫.

(માલિની)

વયમિહ નિજયૂથભ્રષ્ટસારઙ્ગકલ્પા:
પરપરિચયમીતા: કવાપિ કિંચિત્ત્રામઃ ।
વિજનમિહ વસામો ન બ્રજામઃ પ્રમાદં
સ્વકૃતમનુભવામો યત્ર તત્ત્રોપવિષ્ટા: ॥૪૬॥

અનુવાદ : મુનિ વિચાર કરે છે કે અહીં અમે પોતાના સમૂહમાંથી જુદા પડી ગયેલા મૃગ જેવા છીએ. તેથી તેની જેમ જ અમે પણ બીજાના પરિયથી ભયભીત થઈને ક્રયાંય પણ (કોઈ શ્રાવકને ત્યાં) કાંઈક ભોજન કરીએ છીએ, અહીં એકાન્ત સ્થાનમાં નિવાસ કરીએ છીએ, પ્રમાદ કરતા નથી, તથા કોઈ પણ જગ્યાએ રહીને પોતે કરેલા શુભ અથવા અશુભ કર્મનો અનુભવ કરીએ છીએ. ૪૬.

(માલિની)

કતિ ન કતિ ન વારાન્ભૂપતિર્ભૂરિભૂતિ:
કતિ ન કતિ ન વારાનત્ર જાતોઽસ્મિ કીટઃ ।

**નિયતમિતિ ન કસ્યાષ્યસ્તિ સૌખ્યં ન દુઃખં
જગતિ તરલસુપે કિં મુદા કિં શુચા વા ॥૪૭॥**

અનુવાદ : હું કેટલીક વાર બહુ સંપત્તિવાન રાજા નથી થયો? અર્થાત् અનેક વાર અત્યંત વૈભવશાળી રાજા પણ થયો છું. આનાથી ઉલ્લંઘ કેટલીયે વાર હું તુચ્છ જંતુ પણ નથી થયો? અર્થાત् અનેક ભવોમાં હું તુચ્છ જંતુ પણ થઈ ચુક્યો છું. આ પરિવર્તનશીલ સંસારમાં કોઈને ય ન તો સુખ નિયત છે અને ન દુઃખે ય નિયત છે. એવી દશામાં હર્ષ અથવા વિષાદ કરવાથી શું લાભ છે? કાંઈ પણ નહિ.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ પ્રાણી કોઈ વાર તો મહા વૈભવશાળી રાજા થાય છે અને કોઈ વાર અનેક દુઃખ સહનાર તુચ્છ જંતુ પણ થાય છે. આથી એ નિશ્ચિત છે કે કોઈ પણ પ્રાણી સદા સુખી અથવા દુઃખી રહી શકતું નથી. પરંતુ કોઈ વાર તે સુખી પણ થાય છે અને કોઈ વાર દુઃખી પણ એવી અવસ્થામાં વિવેકી મનુષ્ય ન તો સુખમાં રાગ કરે છે અને ન દુઃખમાં દેખ. ૪૭.

(પૃષ્ઠી)

**પ્રતિક્ષણમિદં હદિ સ્થિતમતિપ્રશાન્તાત્મનો
મુનેર્ભવતિ સંવરઃ પરમશુદ્ધિહેતુર્ધુવમ્ ।
રજઃ ખલુ પુરાતનં ગલતિ નો નવં ઢૌકતે
તતો ઽતિનિકં ભવેદમૃતધામ દુઃખોજીતમ્ ॥૪૮॥**

અનુવાદ : જેમનો આત્મા અત્યંત શાંત થઈ ગયો છે એવા મુનિના હૃદયમાં સદાય ઉપર્યુક્ત વિચાર સ્થિત રહે છે. તેથી તેમને અવશ્યમેવ અતિશય વિશુદ્ધિના કારણરૂપ સંવર થાય છે, જેનાથી નિયમથી પૂર્વકર્મની નિર્જરા થાય છે અને નવા કર્મનું આગમન પણ થતું નથી. માટે જ ઉક્ત મુનિને દુઃખોથી રહિત અને ઉત્તમ સુખના સ્થાનભૂત જે મોક્ષપદ છે તે અત્યંત નિકટ થઈ જાય છે. ૪૮.

(શિખરિણી)

**પ્રબોધો નીરસ્થં પ્રવહણમમન્દં પૃથુતપઃ
સુવાયુર્યે: પ્રાસ્તો ગુરુગણસહાયા: પ્રણયિનઃ ।
કિયન્માત્રસ્તેષાં ભવજલધિરેષો�સ્ય ચ પર:
કિયદૂરે પારઃ સ્ફુરતિ મહતામુદ્યમયુતામ્ ॥૪૯॥**

આનુવાદ : જે મુનિઓને સમ્યગ્જ્ઞાનરૂપી છિદ્ર રહિત અને શીંગ ગતિવાળું જહાજ પ્રાપ્ત થયું છે, જેમણે વિપુલ તપસ્વરૂપ ઉત્તમ વાયુની પણ પ્રાપ્તિ કરી લીધી છે તથા સ્નેહી ગુરુજનો જેમના સહાયક છે; એવા ઉધમશી મહામુનિઓને આ સંસાર-સમુદ્ર કેવડોક મોટો છે? અર્થાત્ તે તેમને તુચ્છ જ જણાય છે. તથા તેમને માટે તેનો બીજો કિનારો કેટલો દૂર છે? અર્થાત્ કાંઈ પણ દૂર નથી.

વિશોધાર્થ : જેમ અનુભવી ચાલકોથી સંચાલિત, છિદ્રવિનાનું, શીંગગામી અને અનુકૂળ પવનવાળા જહાજમાં ગમન કરનાર મનુષ્યોને અત્યંત ગંભીર અને અપાર સમુદ્ર પણ તુચ્છ જ લાગે છે તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ જે મહામુનિઓએ નિર્દોષ ઉત્કૃષ્ટ સમ્યગ્જ્ઞાન સાથે વિપુલ તપ પણ પ્રાપ્ત કરી લીધું છે તથા સ્નેહી ગુરુઓ જેમના માર્ગદર્શક છે તેમને માટે આ સંસાર-સમુદ્રથી પાર થવું કાંઈ પણ કઠિન નથી. ૪૮.

(વસંતતિલકા)

અભ્યસ્યતાન્તરદૃશં કિભુ લોકભક્ત્યા
મોહં કૃશીકુરુત કિં વપુષા કૃશેન ।
એતદ્રદ્યં યદિ ન કિં બહુભર્નિયોગૈ:
કલેશૈશ્વ કિં કિમપરૈ: પ્રચુરૈસ્તપોભિ: ॥૫૦॥

આનુવાદ : હે મુનિઓ! સમ્યગ્જ્ઞાનરૂપ અભ્યંતર નેત્રનો અભ્યાસ કરો, તમારે લોકભક્તિનું કાંઈ પણ પ્રયોજન નથી. તે સિવાય તમે મોહને કૃશ કરો, કેવળ શરીરને કૃશ કરવાથી કાંઈ પણ લાભ નથી. કારણ કે જો ઉક્ત બન્ને નહિ હોય તો પછી તેમના વિના ઘણા યમ-નિયમોથી, કાયકલેશોથી અને બીજા પ્રચુર તપોથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. ૫૦.

(વંશસ્થ)

જુગુપ્સતે સંસૃતિમત્ત્ર માયયા
તિતિક્ષતે પ્રાપ્તપરીષહાનપિ ।
ન ચેન્મુનિર્દૃષ્ટકષાયનિગ્રહા-
ચ્ચિકિત્સતિ સ્વાન્તમઘપ્રશાન્તયે ॥૫૧॥

આનુવાદ : જો મુનિ પાપની શાંતિ માટે દુષ્ટ કખાયોનો નિગ્રહ કરીને પોતાના મનનો ઉપચાર કરતો નથી અર્થાત્ તેને નિર્મળ કરતો નથી તે એમ સમજવું જોઈએ કે તે જે સંસારની ધૂણા કરે છે અને પરિષહો પણ સહન કરે છે તે કેવળ માયાચારથી

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૩૧

જ એમ કરે છે, નહિ કે અંતરની પ્રેરણાથી. ૫૧.

(શાર્દૂલવિક્રીડિત)

હિંસા પ્રાણિષુ કલ્પષં ભવતિ સા ગ્રારમ્ભતઃ સો ઽર્થતઃ
તસ્માદેવ ભયાદયો ઽપિ નિતરાં દીર્ઘા તતઃ સંસૃતિઃ ।
તત્ત્રાસાતમશેષમર્થત ઇદં મત્વેતિ યસ્ત્યક્તવાન्
મુક્ત્યર્થી પુનર્ર્થમાશ્રિતવતા તેનાહતઃ સત્યથઃ ॥૫૨॥

અનુવાદ : પ્રાણીઓની હિંસા પાપ ઉત્પન્ન કરે છે, તે હિંસા પ્રકૃષ્ટ આરંભથી થાય છે, તે આરંભ ધનના નિમિત્તે થાય છે, તે ધનથી જ ભયાદિ ઉત્પન્ન થાય છે તથા ઉક્ત ભયાદિથી સંસાર અતિશય દીર્ઘ બને છે. આ રીતે આ સમસ્ત દુઃખનું કારણ ધન જ છે. એમ સમજુને જે મોક્ષાભિલાષી મુનિઓ ધનનો પરિત્યાગ કરી દીધો છે તે જો ફરીથી ઉક્ત ધનનો આશ્રય લે છે તો સમજવું જોઈએ કે તેણે મોક્ષમાર્ગનો નાશ કર્યો છે. ૫૨.

(શાર્દૂલવિક્રીડિત)

દુર્ધાનાર્થમવદ્યકારણમહો નિર્ગન્થતાહાનયે
શયાહેતુ તૃણાદ્યપિ પ્રશમિનાં લજ્જાકરં સ્વીકૃતમ् ।
યત્તત્કિં ન ગૃહસ્થયોગ્યમપરં સ્વર્ણાદિકં સાંપ્રતં
નિર્ગન્થેષ્વપિ ચેત્તદસ્તિ નિતરાં પ્રાયઃ પ્રવિષ્ટઃ કલિઃ ॥૫૩॥

અનુવાદ : જો શયાના નિમિત્ત સ્વીકારવામાં આવેલ લજ્જાજનક તૃણ આદિ પણ મુનિઓને આર્ત-રૌદ્રસ્વરૂપ દુર્ધ્યાન અને પાપનું કારણ હોઈને તેમનું નિર્ગન્થપણું (નિષ્પરિશ્રેષ્ઠપણું) નાચ કરે છે તો પછી ગૃહસ્થને યોગ્ય અન્ય સુવર્ણ આદિ શું તે નિર્ગન્થપણાના ધાતક નહિ થાય? અવશ્ય થશે. વળી જો વર્તમાનમાં નિર્ગન્થ કહેવાતા મુનિઓને પણ ઉપર્યુક્ત ગૃહસ્થ યોગ્ય સુવર્ણ આદિ પરિશ્રેષ્ઠ રહે છે તો સમજવું જોઈએ કે ધણું કરીને કળિકાળનો પ્રવેશ થઈ ગયો છે. ૫૩.

(આર્યા)

કાદચિત્કો બન્ધઃ ક્રોધાદેઃ કર્મણઃ સદા સંગાતુ ।
નાતઃ કવાપિ કદાચિત્પરિગ્રહહવતાં સિદ્ધિ ॥૫૪॥

અનુવાદ : કોધાદિ કખાયોના નિમિત્તે જે બંધ થાય છે તે કદાચિત્ હોય છે અર્થાત્ કોઈ વાર થાય છે અને કોઈ વાર નથી પણ થતો. પરંતુ પરિગ્રહના નિમિત્તે જે બંધ થાય છે તે સદા કાળ થાય છે તેથી જે સાધુઓ પરિગ્રહરૂપી ગ્રહથી પીડાયેલા છે તેમને કચાંય અને કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ૫૪.

(ઇન્દ્રવજ્ઞા)

મોક્ષેઽપિ મોહાદભિલાષદોષો
વિશેષતો મોક્ષનિષેધકારી ।
યતસ્તતો ઽધ્યાત્મરતો મુમુક્ષુ-
ભવિત્વ કિમન્યત્ર કૃતાભિલાષઃ ॥૫૫॥

અનુવાદ : જ્યાં અજ્ઞાનથી મોક્ષના વિષયમાં પણ કરવામાં આવતી અભિલાષા દોષરૂપ હોઈને વિશેષરૂપે મોક્ષની નિષેધક હોય છે તો શું પોતાના શુદ્ધ આત્મામાં લીન થયેલ મોક્ષના અભિલાષી સાધુ સ્વી-પુત્ર-મિત્રાદિ રૂપ અન્ય બાધ્ય વસ્તુઓની અભિલાષા કરશે? અર્થાત્ કદી નહિ કરે. ૫૫.

(પૃષ્ઠી)

પરિગ્રહવતાં શિવं યદિ તદાનલઃ શીતલો
યદીન્દ્રિયસુખં સુખં તદિહ કાલકૂટઃ સુધા ।
સ્થિરા યદિ તનુસ્તદા સ્થિરતરં તડિઙ્ગમ્બરં
ભવેઽત્ર રમણીયતા યદિ તદિન્દ્રજાલે�પિ ચ ॥૫૬॥

અનુવાદ : જો પરિગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અનિન પણ શીતળ થઈ શકે, જો ઈન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો તે ઈન્દ્રજાળમાં પણ હોઈ શકે.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જેમ અનિનું શીતળ હોવું અસંભવ છે. તેવી જ રીતે પરિગ્રહથી કલ્યાણ થવું પણ અસંભવ જ છે. એવી જ રીતે જેમ વિષ કદી અમૃત થઈ શકતું નથી; આકાશમાં ચંચળ વિજળી કદી સ્થિર રહી શકતી નથી અને ઈન્દ્રજાળ કદી રમણીય

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૩૩

હોઈ શકતું નથી; તેમ કુમશઃ ઈન્દ્રિયસુખ કદી સુખ થઈ શકતું નથી, શરીર કદી સ્થિર રહી શકતું નથી અને આ સંસાર કદી રમણીય હોઈ શકતો નથી. ૫૬.

(માલિની)

સ્મરમણિ હદિ યેષાં ધ્યાનવહિપ્રદીપે
સકલભુવનમલ્લાં દહ્યમાનં વિલોક્ય ।
કૃતભિય ઇવ નષ્ટાસ્તે કષાયા ન તસ્મિન્
પુનરાપિ હિ સમીયુઃ સાધવસ્તે જયન્તિ ॥૫૭॥

અનુવાદ : જે મુનિઓના ધ્યાનરૂપી અજિનથી પ્રજ્વલિત હદ્યમાં ત્રિલોકવિજયી કામદેવને પણ બળતો જોઈને જાણે અતિશય ભયભીત થયેલા કષાયો એવી રીતે નષ્ટ થઈ ગયા કે તેમાં તે ફરીથી પ્રવેશી ન શક્યા, તે મુનિઓ જ્યવંત વર્તે છે. ૫૭.

(ઉપેન્દ્રવજ્ઞા)

અનર્થરત્નત્રયસંપદોऽપિ નિર્ગ્રન્થતાયાઃ પદમદ્વિતીયમ् ।
અપિ પ્રશાન્તાઃ સ્મરવૈરિવધા વैધવ્યદાસ્તે ગુરવો નમસ્યાઃ ॥૫૮॥

અનુવાદ : જે ગુરુ અમૂલ્ય રત્નત્રયસ્વરૂપ સંપત્તિયુક્ત હોવા છતાં પણ નિર્ગ્રન્થપણાનું અનુપમ પદ પામ્યા છે તથા જે અત્યંત શાન્ત હોવા છતાં પણ કામદેવરૂપ શત્રુની પત્નીને વૈધવ્ય પ્રાપ્ત કરાવનાર છે, તે ગુરુ નમસ્કાર કરવા યોગ્ય છે.

વિશેષાર્થ : જે અમૂલ્ય ત્રણ રત્નો સહિત હોય તે નિર્ગ્રથ (દરિદ્ર) હોઈ શકે નહિ એવી જ રીતે જે પ્રશાન્ત હોય-કોધાદિ વિકારોથી રહિત હોય-તે શત્રુ પત્નીને વિધવા બનાવી શકે નહિ. આ રીતે અહીં વિરોધાભાસ પ્રગટ કરીને તેનો પરિહાર કરતાં ગ્રંથકાર એમ બતાવે છે કે જે ગુરુ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિતરૂપ અનુપમ રત્નત્રયના ધારક થઈને નિર્ગ્રથ-મૂર્ખરહિત થયા થકા દિગંબરત્વ-અવસ્થાને પ્રાપ્ત થયા છે; તથા જે અશાન્તિના કારણભૂત કોધાદિ કષાયોને નષ્ટ કરીને કામવાસનાથી રહિત થઈ ગયા છે તે ગુરુઓને નમસ્કાર કરવા જોઈએ. ૫૮.

(શાર્ડૂલવિક્રીડિત)

યે સ્વાચારમપારસૌખ્યસુતરોર્વાજં પરં પજ્વધા ।
સદ્ગોધાઃ સ્વયમાચરન્તિ ચ પરાનાચારયન્ત્યેવ ચ ।

ગ્રન્થગ્રન્થવિમુક્તમુક્તિપદવીં પ્રાપ્તાશ્ યૈઃ પ્રાપિતાઃ
તે રત્નત્રયધારિણઃ શિવસુખં કુર્વન્તુ નઃ સૂર્યઃ ॥૫૧॥

અનુવાદ : જે વિવેકી આચાર્ય અપરિમિત સુખરૂપી ઉત્તમ વૃક્ષના બીજભૂત પોતાના પાંચ પ્રકારના (જ્ઞાન, દર્શન, તપ, વીર્ય અને ચારિત્ર) ઉત્કૃષ્ટ આચારનું સ્વયં પાલન કરે છે તથા અન્ય શિષ્યાદિકોને પણ પાલન કરાવે છે જે પરિગ્રહરૂપી ગાંઠ રહિત એવા મોક્ષમાર્ગને સ્વયં પ્રાપ્ત થઈ ચુક્યા છે તથા જેમણે અન્ય આત્મહિતેષીઓને પણ ઉક્ત મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તે રત્નત્રયના ધારક આચાર્ય પરમેષ્ઠી અમને મોક્ષસુખ પ્રદાન કરે. ૫૮.

(વસંતતિલકા)

ભ્રાન્તિપ્રદેષુ બહુવર્ત્મસુ જન્મકક્ષે
પન્થાનમેકમમૃતસ્ય પરં નયન્તિ ।
યે લોકમુત્ત્રતથિયઃ પ્રણમામિ તેભ્યઃ
તેનાયહં જિગમિષુર્ગુર્નાયકેભ્યઃ ॥૬૦॥

અનુવાદ : જે ઉન્નતબુદ્ધિના ધારક આચાર્ય આ જન્મ-મરણ સ્વરૂપ સંસારરૂપી વનમાં ભાન્તિ ઉત્પન્ન કરનાર અનેક માર્ગ હોવા છીતાં પણ બીજા માણસોને કેવળ મોક્ષના માર્ગ જ લઈ જાય છે તે અન્ય મુનિઓને સન્માર્ગ લઈ જનાર આચાર્યાને હું પણ તે જ માર્ગ જવાનો ઈચ્છુક હોઈને નમસ્કાર કરું છું. ૬૦.

(શાર્ડૂલવિક્રીડિત)

શિષ્યાણામપહાય મોહપટલં કાલેન દીર્ઘેણ ય-
આતં સ્યાત્પદલાચ્છિતોઽવ્વલવચોદિવ્યાજ્જનેન સ્ફુટમ् ।
યે કુર્વન્તિ દૃશં પરામતિતરાં સર્વાવલોકશમાં
લોકે કારણમન્તરેણ ભિષજાસ્તે પાન્તુ નો ઽધ્યાપકાઃ ॥૬૧॥

અનુવાદ : જે લોકમાં અકારણ (નિસ્વાર્થ) વૈદ્ય સમાન હોઈને શિષ્યોના ચિરકાળથી ઉત્પન્ન થયેલ અજ્ઞાન સમૂહનો નાશ કરીને ‘સ્યાત્’ પદથી ચિહ્નિત અર્થાતું અનેકાજાતમય નિર્મળ વચ્ચનરૂપી દિવ્ય અંજનથી તેમની અત્યંત શ્રેષ્ઠ દૃષ્ટિને સ્પષ્ટપણે

અધિકાર-૧ : ધર્મપદેશામૃત]

૩૫

સમસ્ત પદાર્થને દેખવામાં સમર્થ કરી દે છે તે ઉપાધ્યાય પરમેષ્ઠી અમારી રક્ષા કરો. ૬૧.

(શાર્ડૂલવિક્રીડિત)

ઉન્મુચ્યાલયબન્ધનાદપિ દ્વાત્કાયે ઽપિ વીતસ્પૃહા-
શ્ક્રિતે મોહવિકલ્પજાલમપિ યદુર્ભેદમન્તસ્તમઃ ।
ભેદાયાસ્ય હિ સાધયન્તિ તદહો જ્યોતિર્જિતાક્રગ્રભં
યે સદ્ગોધમયં ભવન્તુ ભવતાં તે સાધવઃ શ્રેયસે ॥૬૨॥

અનુવાદ : જે મજબૂત ગૃહરૂપી બંધનથી છૂટીને પોતાના શરીરના વિષયમાં પણ નિસ્પૃહ (મમત્વરહિત) થઈ ચુક્યા છે તથા જે મનમાં સ્થિત દુર્ભેદ (મુશ્કેલીથી નષ્ટ કરાય તેવું) મોહજનિત વિકલ્પ સમૂહરૂપી અભ્યંતર અંધકારને નષ્ટ કરવા માટે સૂર્યના તેજને પણ જીતનાર એવી ઉત્તમ જ્ઞાનરૂપી જ્યોતિને સિદ્ધ કરવામાં તત્પર છે તે સાધુઓ આપનું કલ્યાણ કરો. ૬૨.

(વસંતતિલકા)

વત્રે પત્તયાપિ ભયદ્રુતવિશ્લોક-
મુક્તાધ્વનિ પ્રશમિનો ન ચલન્તિ યોગાત્ ।
બોધપ્રદીપહતમોહમહાન્ધકારા: ॥૬૩॥
સમ્યગ્દશઃ કિમુત શેષપરીષહેષુ ॥૬૩॥

અનુવાદ : ભયથી શીધતાપૂર્વક ભાગનાર સમસ્ત જનસમૂહ દ્વારા જેનો માર્ગ છોડી દેવામાં આવે છે એવું વજ પડતાં પણ જે મુનિઓ સમાધિમાંથી વિચલિત થતા નથી. તે જ્ઞાનરૂપી દીપક દ્વારા અજ્ઞાનરૂપી ઘોર અંધકારનો નાશ કરનાર સમ્યગ્દશિ મુનિઓ શું બાકીના પરીષહો આવતાં વિચલિત થઈ શકે? કઢી નહિ. ૬૩.

(શાર્ડૂલવિક્રીડિત)

પ્રોદ્યત્તિગ્મકરોગ્રતેજસિ લસચ્ચણાનિલોદ્યદિશિ
સ્ફારીભૂતસુતમ્ભૂમિરજસિ પ્રક્ષીણનદ્યભ્ભસિ ।
ગ્રીષ્મે યે ગુરુમેદિનીગ્રાશિરસિ જ્યોતિર્નિધાયોરસિ
ધ્વાન્તધ્વંસકરં વસન્તિ મુનયસ્તે સન્તુ નઃ શ્રેયસે ॥૬૪॥

અનુવાદ : જે શ્રીખકાળ ઉગતા સૂર્યના કિરણોના તીક્ષણ તેજથી સંયુક્ત હોય છે, જેમાં તીક્ષણ પવન (લૂ)થી દિશાઓ પરિપૂર્ણ થઈ જાય છે, જેમાં અત્યંત સંતપ્ત થયેલી પૃથ્વીની ધૂળ અધિક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા જેમાં નદીઓનાં જળ સુકાઈ જાય છે તે શ્રીખ કાળમાં જે મુનિઓ હદ્યમાં અજ્ઞાન અંધકારને નષ્ટ કરનાર જ્ઞાનજ્યોતિને ધારણ કરીને મહાપર્વતના શિખર ઉપર નિવાસ કરે છે તે મુનિઓ અમારું કુલ્યાણ કરો. ૬૪.

(શાર્ડૂલવિક્રીડિત)

તे वः पान्तु मुमुक्षवः कृतरवैरब्दैरतिश्यामलैः
शश्वद्वारिवमद्विरविधिविषयक्षारत्वदोषादिव ।
काले मञ्जदिले पतद्वरिकुले धावद्धुनीसंकुले
झज्जावातविसंस्थुले तरुतले तिष्ठन्ति ये साधवः ॥૬૫॥

અનુવાદ : જે વર્ષાકાળમાં ગર્જના કરતાં, અતિશય કાળા તથા સમુદ્રના ક્ષારત્વ (ખારાશ)ના દોષથી જ જાણે હમેશાં પાણી વરસાવનારા એવા વાદળાઓ દ્વારા પૃથ્વી જળમાં ઝૂખવા લાગે છે, જેમાં પાણીના પ્રબળ પ્રવાહથી પર્વતોના સમૂહ પડવા લાગે છે, જે વેગથી વહેતી નદીઓથી વ્યાપ્ત હોય છે તથા જે ઝંજાવાતથી (જળમિશ્રિત તીક્ષણ વાયુથી) સંયુક્ત હોય છે. એવા તે વર્ષાકાળમાં જે મોક્ષની ઈચ્છાવાળા સાધુઓ વૃક્ષની નીચે સ્થિત રહે છે તે અમારી રક્ષા કરો. ૬૫.

(શાર્ડૂલવિક્રીડિત)

म्लायत्कोकनदे गलत्कपिमदे भ्रश्यद् द्रुमौघच्छदे
हર्षद्रोमदरिके हिमऋतावत्यन्तदुःखप्रदे ।
ये तिष्ठन्ति चतुष्पथे पृथुतपःसौधस्थिताः साधवः
ध्यानोष्मग्रहतोग्रंशैत्यविधुरास्ते मे विदध्युः श्रियम् ॥૬૬॥

અનુવાદ : જે ઋતુમાં કમળ કરમાવા લાગે છે, વાંદરાનું અભિમાન નાશ પામે છે, વૃક્ષો ઉપરથી પાંડા નાશ પામે છે તથા ઢંડીથી ગરીબોના રૂંવાટા કંપી ઉઠે છે; તે અત્યંત દુઃખ આપનારી શિયાળાની ઋતુમાં વિશાળ તપરૂપી મહેલમાં સ્થિત અને ધ્યાનરૂપી ઉષ્ણતાથી નષ્ટ કરવામાં આવેલ તીક્ષણ ઢંડીથી રહિત જે સાધુ ચોકમાં સ્થિત રહે છે તે સાધુઓ મને લક્ષ્મી આપો. ૬૬.

(वसंततिलका)

कालत्रये बहिरवस्थितिजातवर्षा-
 शीतातप्रमुखसंघटितोग्रदुःखे ।
 आत्मप्रबोधविकले सकलो ऽपि काय-
 क्लेशो वृथा वृत्तिरिवोज्जितशालिवप्रे ॥६७॥

અનુવાદ : જે સાધુ ત્રણો ઋતુઓમાં ઘર છોડીને બહાર રહેવાથી ઉત્પન્ન થયેલ વર્ષા, હંડી અને ગરમી આદિનું તીવ્ર દુઃખ સહન કરે છે તે જો તે ત્રણ ઋતુઓમાં અધ્યાત્મજ્ઞાનથી રહિત હોય છે તો તેમનો આ બધો ય કાયકલેશ એવો જ નિષ્ફળ છે જેવું અનાજ્ઞા છોડ વિનાના ખેતરમાં વાંસ અને કાંટા આદિથી વાડનું રચવું નિષ્ફળ છે. ૬૭.

(शार्दूलविक्रीडि॒त)

संप्रत्यस्ति न केवली किल कलौ त्रैलोक्यचूडामणिः
 तद्वाचः परमासते ऽत्र भरतक्षेत्रे जगद्ग्योतिकाः ।
 सद्रुतत्रयधारिणो यतिवरास्तासां समालम्बनं
 तत्पूजा जिनवाचि पूजनमतः साक्षाज्जिनः पूजितः ॥६८॥

અનુવાદ : અત્યારે આ કણિકાળ (પંચમકાળ)માં ભરતક્ષેત્રમાં જો કે ત્રણે લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠભૂત કેવળી ભગવાન વિરાજમાન નથી છતાં પણ લોકને પ્રકાશિત કરનાર તેમના વચન તો અહીં વિદ્યમાન છે જ અને તે વચનોના આશ્રયરૂપ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ ઉત્તમ રત્નત્રયના ધારક શ્રેષ્ઠ મુનિરાજ છે, તેથી ઉક્ત મુનિઓની પૂજા વાસ્તવમાં જિનવચનોની જ પૂજા છે અને એનાથી પ્રત્યક્ષમાં જિન ભગવાનની જ પૂજા કરવામાં આવી છે એમ સમજું જોઈએ.

વિશોધાર્થ : આ પંચમ કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં સાક્ષાત્ કેવળી વિદ્યમાન હોતા નથી છતાં પણ જીવોના અજ્ઞાન અંધકારને હરનાર તેમના વચનો (જિનાગમ) પરંપરાથી પ્રાપ્ત છે જ. તે વચનોના જ્ઞાતા શ્રેષ્ઠ મુનિઓ જ છે તેથી તેઓ પૂજનીય છે. આ રીતે કરવામાં આવેલી ઉક્ત મુનિઓની પૂજાથી જિનાગમની પૂજા અને એનાથી સાક્ષાત્ જિન ભગવાનની જ પૂજા કરાઈ છે એમ સમજવું જોઈએ. ૬૮.

(શાર્ડૂલવિક્રીડિત)

સ્પૃષ્ટા યત્ર મહી તદ્દ્જાગ્રિકમલેસ્તત્રૈતિ સત્તીર્થતાં
તેભ્યસ્તે ઽપિ સુરા: કૃતાભ્જલિપુટા નિત્યં નમસ્કૃવતે ।
તત્ત્વામસ્મૃતિમાત્રતો�પિ જનતા નિષ્કલ્પષા જાયતે
યે જૈના યત્યશ્ચિદાત્મનિ પરં સ્નેહં સમાતન્વતે ॥૬૯॥

અનુવાદ : જે જૈન મુનિ શાન દર્શન સ્વરૂપ ચૈતન્યમય આત્મામાં ઉત્કૃષ્ટ સ્નેહ કરે છે તેમના ચરણકભળો દ્વારા જ્યાં પૃથ્વીનો સ્પર્શ થાય છે ત્યાંની તે પૃથ્વી ઉત્તમ તીર્થ બની જાય છે, તેમને બન્ને હાથ જોડીને દેવો પણ નિત્ય નમસ્કાર કરે છે તથા તેમના નામના સ્મરણમાત્રથી જ જનસમૂહ પાપરહિત થઈ જાય છે. ૬૮.

(શાર્ડૂલવિક્રીડિત)

સમ્યગ્દર્શનબોધવૃત્તનિચિત: શાન્તઃ શિવૈષી મુનિ-
ર્મન્દૈ: સ્યાદવધીરિતો ઽપિ વિશદ: સામ્યં યદાલમ્બતે ।
આત્મા તैર્વિહતો યદત્ત્ર વિષમધ્વાન્તશ્રિતે નિશ્ચિતં
સંપાતો ભવિતોગ્રદુ:ખનરકે તેષામકલ્યાણિનામુ ॥૭૦॥

અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિતથી સંપન્ન, શાન્ત અને આત્મકલ્યાણ (મોક્ષ)ના અભિલાષી મુનિ અજ્ઞાનીઓ દ્વારા નિરસ્કૃત થઈને ય સમતા (વીતરાગતા)નો જ આશ્રય લે છે તેથી તે તો નિર્મળ જ રહે છે પણ તેમ કરવાથી તે અજ્ઞાનીઓ જ પોતાના આત્માનો ધાત કરે છે કારણ કે કલ્યાણમાર્ગથી ભ્રષ્ટ થયેલા તે અજ્ઞાનીઓનું ગાઢ અંધકારથી વ્યાપ્ત અને તીવ્ર દુઃખોથી સંયુક્ત એવા નરકમાં નિયમથી પતન થશે. ૭૦.

(સ્નાધરા)

માનુષ્યં પ્રાપ્ય પુણ્યાત્મપ્રશમમુપણતા રોગવદ્રોગજાતં
મત્વા ગત્વા વનાન્તં દાશિ વિદિ ચરણે યે સ્થિતાઃ સંગમુક્તાઃ ।
કઃ સ્તોતા વાક્યથાતિક્રમણપદુગુણૈરાશ્રિતાનાં મુનીનાં
સ્તોતવ્યાસ્તે મહદ્બિર્ભુવિ ય ઇહ તદ્દ્જાગ્રિદ્વયે ભક્તિભાજઃ ॥૭૧॥

અનુવાદ : જે મુનિ પુણ્યના પ્રભાવથી મનુષ્ય ભવ પામીને શાન્તિ પામ્યા

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૩૮

થકા ઈન્દ્રિયજનિત ભોગોને રોગ સમાન કષદાયક સમજી લે છે અને તેથી જે ગૃહથી વનની મધ્યમાં જઈને સમસ્ત પરિગ્રહથી રહિત થયા થકા સમ્યંદર્શન, સમ્યંજ્ઞાન અને સમ્યક્યારિત્રમાં સ્થિત થઈ જાય છે; વચનઅગોચર એવા ઉત્તમોત્તમ ગુણોના આશ્રયભૂત તે મુનિઓની સ્તુતિ કરવામાં કયો સ્તુતિકાર સમર્થ છે? કોઈ પણ નહિ. જે મનુષ્યો ઉક્ત મુનિઓના બન્ને ચરણોમાં અનુરાગ કરે છે તે અહીં પૃથ્વી ઉપર મહાપુરુષો દ્વારા સ્તુતિ કરવાને યોગ્ય છે. ૭૧.

(શાર્ડૂલવિક્રીડિત)

તત્ત્વાર્થાપ્તપોભૃતાં યતિવરાઃ શ્રદ્ધાનમાહૃદ્દર્શાં
જ્ઞાનં જાનદનૂનમપ્રતિહતં સ્વાર્થાવસંદેહવત્તુ ।
ચારિત્રં વિરતિઃ પ્રમાદવિલસત્કર્માસ્ત્રવાદ્યોગિનાં
એતન્મુક્તિપથસ્વયં ચ પરમો ધર્મો ભવચ્છેદકઃ ॥૭૨॥

અનુવાદ : આ રીતે મુનિના આચારધર્મનું નિરૂપણ થયું. સાત તત્ત્વ, દેવ અને ગુરુનું શ્રદ્ધાન કરવું; એને મુનિઓમાં શ્રેષ્ઠ ગાણધર આદિ સમ્યંદર્શન કહે છે. સ્વ અને પર પદાર્થ બન્નેની ન્યૂનતા, બાધા અને સંદેહ રહિત થઈને જે જાણો છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. યોગિઓના પ્રમાદથી થતા કર્માસ્ત્રવથી રહિત થઈ જવાનું નામ ચારિત્ર છે. આ ત્રણો મોક્ષના માર્ગ છે. આ જ ત્રણોને ઉત્તમ ધર્મ કહેવામાં આવે છે જે સંસારનો વિનાશક થાય છે. ૭૨.

(માલિની)

હૃદયભુવિ દ્વારેકં બીજમુસ્તં ત્વશઙ્કા-
પ્રભુતિગુણસદમ્ભઃસારણી સિત્ક્રમુચ્ચૈઃ ।
ભવદવગમશાખશ્રારુચારિત્ર પુષ્પ-
સ્તરસ્મૃતફલેન પ્રીણયત્યાશુ ભવ્યમ् ॥૭૩॥

અનુવાદ : હૃદયરૂપી પૃથ્વીમાં વાવેલું એક સમ્યંદર્શનરૂપી બીજ નિઃશાંકિત આદિ આઠ અંગરવરૂપ ઉત્તમ જગ્યાથી પરિપૂર્ણ નાની નદી દ્વારા અતિશય સીંચાઈને ઉત્પન્ન થયેલી સમ્યંજ્ઞાનરૂપી શાખાઓ અને મનોહર સમ્યક્યારિતરૂપી પુષ્પોથી સંપન્ન થતું થર્કું વૃક્ષરૂપે પરિણમે છે, જે ભવ્યજીવને તરત જ મોક્ષરૂપી ફળ આપીને પ્રસન્ન કરે છે. ૭૩.

(માલિની)

દ્વાગવગમચરિત્રાલંકૃતઃ સિદ્ધિપાત્ર
 લઘુરપિ ન ગુરુઃ સ્થાદન્યથાત્વે કદાચિત् ।
 સુફુટમવગતમાર્ગો યાતિ મન્દોડપિ ગચ્છ-
 બ્રહ્મિતપદમન્યો નૈવ તૂર્ણો ઽપિ જન્તુઃ ॥૭૪॥

અનુવાદ : સમ્યગુર્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રથી વિભૂષિત પુરુષ જો તપ આદિ અન્ય ગુણોમાં મંદ પણ હોય તોય તે સિદ્ધિને પાત્ર છે અર્થાત્ તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એનાથી વિપરીત જો રત્નત્રય રહિત પુરુષ અન્ય ગુણોમાં મહાનું પણ હોય તોય તે કદ્દી યે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ્ય જ છે-સ્પષ્ટ રીતે માર્ગથી પરિચિત મનુષ્ય જો ચાલવામાં મંદ પણ હોય તોય તે ધીરે ધીરે ચાલીને ઈચ્છિત સ્થાને પહોંચી જાય છે. પણ એનાથી વિપરીત જે અન્ય મનુષ્ય માર્ગથી અજાણ છે તે ચાલવામાં ખૂબ ઝડપી હોય તો પણ ઈચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ૭૪.

(માલિની)

વનશિખિનિ મૃતો ઽન્થઃ સંચરનું બાઢમંડળિ-
 દ્વિત્યવિકલમૂર્તિવીક્ષમાણો ઽપિ ખજ્જઃ ।
 અપિ સનયનપાદો ઽશ્રદ્ધાનશ્ચ તસ્માદ-
 દ્વાગવગમચરિતૈ: સિદ્ધિઃ ॥૭૫॥

અનુવાદ : દાવાનળથી સણગતા વનમાં શીધ ગમન કરનાર અંધ મનુષ્ય મરી જાય છે, તેવી જ રીતે બન્ને પગ વિનાનો લંગડો માણસ દાવાનળને જોતો હોવા છતાં પણ ચાલવામાં અસમર્થ હોવાથી બળીને મરી જાય છે. અજિનનો વિશ્વાસ ન કરનાર મનુષ્ય નેત્ર અને પગ સંયુક્ત હોવા છતાં પણ ઉક્ત દાવાનળમાં ભસ્મ થઈ જાય છે. તેથી જ સમ્યગુર્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ ત્રણેની એકતાને પ્રાપ્ત થતાં જ તેમનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ નક્કી સમજવું જોઈએ.

વિશેષાર્થ : જેવી રીતે ઉક્ત ત્રણે મનુષ્યોમાં એક જણ તો આંખોથી અજિન દેખીને અને

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૪૧

ભાગવામાં સમર્થ હોવા છતાં પણ કેવળ અવિશ્વાસને કારણે મરે છે, બીજો (આંધળો) માણસ અજિનનું શાન ન હોવાથી મૃત્યુ પામે છે, તથા ત્રીજો (લંગડો) માણસ અજિનનો વિશ્વાસ કરીને અને તેને જાણીને પણ ચાલવામાં અસમર્થ હોવાથી જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. તેવી જ રીતે શાન અને ચારિત્રરહિત જે પ્રાણી તત્ત્વાર્થનું કેવળ શ્રદ્ધાન કરે છે, શ્રદ્ધાન અને ચારિત્રથી રહિત જેને એક માત્ર તત્ત્વાર્થનું પરિજ્ઞાન જ છે અથવા શ્રદ્ધા અને શાન રહિત જે જીવ કેવળ ચારિત્રનું જ પરિપાલન કરે છે; એ ત્રણમાંથી કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તે તો આ ત્રણેની એકતામાં જ પ્રાપ્ત થઈ શકે છે. ૭૫.

(માલિની)

બહુભિરપિ કિમન્યૈઃ પ્રસ્તરै રત્નસંজૈ-
વૃપુષિ જનિતરખેદૈભારકારિત્વયોગાત્ |
હતદુરિતતમોભિશ્રારલૈરનર્થ્યૈ-
સ્ત્રીભિરપિ કુરુતાત્માલંકૃતિં દર્શનાયૈ: ॥૭૬॥

અનુવાદ : ‘રત્ન’ સંજ્ઞા ધારણ કરનાર અન્ય ધણા પથ્યરોથી શું લાભ? કારણ કે ભારયુક્ત હોવાથી તેમના દ્વારા કેવળ શરીરમાં ખેદ જ ઉત્પન્ન થાય છે. તેથી પાપરૂપ અંધકારને નાચ કરનાર સમ્યગ્દર્શનાદિરૂપ અમૃત્યુ ત્રણેય સુંદર રત્નોથી પોતાના આત્માને વિભૂષિત કરવો જોઈએ. ૭૬.

(માલિની)

જયતિ સુખનિધાનं મોક્ષવૃક્ષૈકબીજં
સકલમલવિમુક્તં દર્શનં યદ્વિના સ્યાત् ।
મતિરપિ કુમતિર્નું દુશ્શરિત્રં ચરિત્રં
ભવતિ મનુજજન્મ પ્રાપ્તમપ્રાતમેવ ॥૭૭॥

અનુવાદ : જે સમ્યગ્દર્શન વિના શાન ભિથ્યાશાન અને ચારિત્ર ભિથ્યાચારિત્ર રહ્યા કરે છે તે સુખના સ્થાનભૂત, મોક્ષરૂપી વૃક્ષના અદ્વિતીય બીજરૂપ તથા સમસ્ત દોષરહિત સમ્યગ્દર્શન જ્યવંત વર્તો છે. ઉક્ત સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ પણ નહિ પ્રાપ્ત થવા બરાબર જ રહે છે. [કારણ કે મનુષ્ય જન્મની સફળતા સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ હોઈ શકે છે, પણ તેને તો પ્રાપ્ત કર્યું નથી.] ૭૭.

(આર્યા)

ભવભુજગનાગદમની દુઃখમહાદાવશમનજલવૃષ્ટિઃ ।
મુક્તિસુખામૃતસરસી જયતિ દ્વગાદિત્રયી સમ્યક્ ॥૭૮॥

અનુવાદ : જે સમ્યગદર્શન આદિ ત્રણ રત સંસારરૂપી સર્પનું દમન કરવા માટે નાગદમની સમાન છે, દુઃખરૂપી દાવાનળને શાન્ત કરવા માટે જળવૃષ્ટિ સમાન છે તથા મોક્ષસુખરૂપ અમૃતના તળાવ સમાન છે; તે સમ્યગદર્શનાદિ ત્રણ રત સારી રીતે જયવંત વર્તો છે. ૭૮.

(માલિની)

વચનવિરચિતૈવોત્પદ્યતે ભેદબુદ્ધિ-
દ્વગવગમચરિત્રાણ્યાત્મનઃ સ્વં સ્વરૂપમ् ।
અનુપચરિતમેતચેતનૈકર્ત્વભાવં
બ્રજતિ વિષયભાવં યોગિનાં યોગદાષ્ટે: ॥૭૯॥

અનુવાદ : સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આ ત્રણે આત્માના પોતાના સ્વરૂપ છે. આમાં જે ભિન્નતાની બુદ્ધિ થાય છે તે કેવળ શબ્દજનિત જ હોય છે-વાસ્તવમાં તે ત્રણે અભિન્ન જ છે. આત્માનું આ સ્વરૂપ ઉપચારરહિત અર્થાત્ પરમાર્થભૂત અને ચેતના જ છે એક સ્વભાવ જેનો ઓવું થયું થકું યોગીજનોની યોગરૂપ દેખિના વિષયપણાને પામે છે અર્થાત્ તેનું અવલોકન યોગીઓ જ પોતાની યોગદાષ્ટિથી કરી શકે છે. ૭૯.

(ઉપેન્દ્રવજ્ઞા)

નિરૂપ્ય તત્ત્વं સ્થિરતામુપાગતા
મતિઃ સતાં શુદ્ધનયાવલમ્બિની ।
અખણ્ડમેકં વિશદં ચિદાત્મકં
નિરન્તરં પશ્યતિ તત્પરં મહઃ ॥૮૦॥

અનુવાદ : શુદ્ધનયનો આશ્રય લેનારી સાહુઓની બુદ્ધિ તત્પરનું નિરૂપણ કરીને સ્થિરતાને પામતી થકી નિરંતર, અખણ્ડ, એક, નિર્મળ અને ચેતનસ્વરૂપ તે ઉત્કૃષ્ટ જ્યોતિનું જ અવલોકન કરે છે. ૮૦.

(સ્થાધર)

દાયિર્નિર્ણાતિરાત્માહ્યવિશદમહસ્યત્ર બોધઃ પ્રબોધઃ
શુદ્ધં ચારિત્રમત્ર સ્થિતિરિતિ યુગપદ્બન્ધવિધ્વંસકારિ ।
બાહ્યં બાહ્યાર્થમેવ ત્રિત્યમપિ પરં સ્યાચ્છુભો વાશુભો વા
બન્ધઃ સંસારમેવં શ્રુતાનિપુણાધિયઃ સાધવર્સ્તં વર્દન્તિ ॥૮૧॥

અનુવાદ : આત્મા નામના નિર્મળ તેજનો નિર્જય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ આત્મરૂપમાં રૂચિ ઉત્પન્ન થવાનું નામ સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થવાને સમ્યક્ક્યારિત્ર કહે છે. આ ત્રણો એક સાથે ઉત્પન્ન થઈને બંધનો વિનાશ કરે છે. બાહ્ય રત્નત્રય કેવળ બાહ્ય પદાર્થો (જીવાજીવાદિ)ને જ વિષય કરે છે અને તેનાથી શુભ અથવા અશુભ કર્મનો બંધ થાય છે જે સંસાર પરિભ્રમાણનું જ કારણ છે. આ રીતે આગમના જાણકાર સાધુઓ નિરૂપણ કરે છે.

વિશેષાર્થ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ક્યારિત્ર આ ત્રણોમાંથી પ્રત્યેક વ્યવહાર અને નિશ્ચયના ભેદથી બંધે પ્રકારના છે. એમાં જીવાદિક સાત તત્ત્વોના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેમના સ્વરૂપને જાણવાનું નામ વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે. અશુભ ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થવાને વ્યવહાર સમ્યક્ક્યારિત્ર કહેવાય છે. દેહાદિથી ભિન્ન આત્મામાં રૂચિ થવાનું નામ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે જ દેહાદિથી ભિન્ન આત્માના સ્વરૂપના અવબોધને નિશ્ચય સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં લીન રહેવાને નિશ્ચય સમ્યક્ક્યારિત્ર કહે છે. એમાં વ્યવહાર રત્નત્રય શુભ અને અશુભ કર્માના બંધનું કારણ હોવાથી સ્વર્ગાદિ અભ્યુદ્યનું નિમિત થાય છે. પરંતુ નિશ્ચય રત્નત્રય શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્માના બંધને નષ્ટ કરીને મોક્ષસુખનું કારણ થાય છે. ૮૧.

(માલિની)

જડજનકૃતબાધાક્રોશહાસાપ્રિયાદા-
વપિ સતિ ન વિકારં યન્મનો યાતિ સાધોઃ ।
અમલવિપુલવિત્તે રુત્તમા સા ક્ષમાદૌ
શિવપથપથિકાનાં સત્તસહાયત્વમેતિ ॥૮૨॥

અનુવાદ : આ રીતે રત્નત્રયના સ્વરૂપનું નિરૂપણ થયું. અજ્ઞાની જનો દ્વારા

શારીરિક બાધા, અપશબ્દોનો પ્રયોગ, હાસ્ય અને બીજા પણ અપ્રિય કાર્ય કરવા છતાં જે નિર્મણ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુનું મન કોધાદિ વિકારને પ્રાપ્ત થતું નથી તેને ઉત્તમ ક્ષમા કહે છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિક જનોને સર્વ પ્રથમ સહાયક થાય છે. ૮૨.

(વસંતતિલકા)

શ્રામણ્યપુણ્યતરુચુગુણૌધશાખા—
પત્રપ્રસૂનનિચિતો ઽપિ ફલાન્યદત્ત્વા ।
યાતિ ક્ષયં ક્ષણત એવ ઘનોગ્રકોપ—
દાવાનલાત્ ત્યજત તં યતયો ઽતિદૂરમ् ॥૮૩॥

અનુવાદ : મુનિધર્મરૂપી પવિત્ર વૃક્ષ ઉન્ત ગુણોના સમૂહરૂપ ડાળીઓ, પાંડા અને ઝૂલોથી પરિપૂર્ણ થયું થકું પણ ફળો ન આપતાં અતિશય તીવ્ર કોધરૂપી દાવાનિથી ક્ષણમાત્રમાં જ નાશ પામી જાય છે. તેથી હે મુનિજનો, આપ તે કોધને દૂરથી જ છોડી ધો. ૮૩.

(શાર્દૂલવિક્રીડિત)

તિષ્ઠામો વયમુજ્જ્વલેન મનસા રાગાદિદોષોજ્જીતા:
લોકઃ કિંચિદપિ સ્વકીયહૃદયે સ્વેચ્છાવરો મન્યતામ् ।
સાધ્યા શુદ્ધિરિહાત્મનઃ શમવતામત્રાપરેણ દ્વિષા
મિત્રેણાપિ કિમુ સ્વચેષિતફલં સ્વાર્થઃ સ્વયં લપ્સ્યતે ॥૮૪॥

અનુવાદ : અમે રાગાદિ દોષોથી રહિત થઈને વિશુદ્ધ મનથી સ્થિર થઈએ છીએ. એને યથેચું આચરણ કરનારા લોકો પોતાના હદ્યમાં ગમે તેમ માને. લોકમાં શાન્તિના અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. તેમને અહીં બીજા શત્રુ અથવા ભિત્રનું પણ શું પ્રયોજન છે? તે (શત્રુ કે ભિત્ર) તો પોતાના કરેલા કાર્ય અનુસાર સ્વયં જ ફળ પ્રાપ્ત કરશે. ૮૪.

(સ્ત્રાધરા)

દોષાનાઘુષ્ય લોકે મમ ભવતુ સુખી દુર્જનશ્રેદ્ધનાર્થી
તત્સર્વસ્વં ગૃહીત્વા સ્ત્રીય સહસા જીવિતં સ્થાનમન્યઃ ।

મધ્યસ્થસ્ત્વેવમેવાખિલમિહ જગજ્ઞાયતાં સૌખ્યરાશિ:
મત્તો માભૂદસૌખ્યં કથમપિ ભવિનઃ કસ્યચિત્પૂત્કરોમિ ॥૮૫॥

અનુવાદ : જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાવ અને જે મધ્યસ્થ છે-રાગદ્વેષરહિત છે-તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો. મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું ઊંચા સ્વરે કહું છું. ૮૫.

(શાર્ડૂલવિક્રીડિત)

કિ જાનાસિ ન વીતરાગમખિલતૈલોક્યચૂડામણિં
કિં તદ્ર્ભર્મ સમાશ્રિતં ન ભવતા કિં વા ન લોકો જડઃ ।
મિથ્યાદ્વિભરસજ્જનૈરપટુભિઃ કિંચિત્કૃતોપદ્રવાત્
યત્કર્માર્જનહેતુમરિથરતયા બાધાં મનો મન્યસે ॥૮૬॥

અનુવાદ : હે મન! શું તું સમ્પૂર્ણ ત્રણો લોકમાં ચૂડામણિ સમાન એવા શ્રેષ્ઠ વીતરાગ જિનને નથી જાણતું? શું તેં વીતરાગકથિત ધર્મનો આશ્રય નથી લીધો? શું જડસમૂહ જડ અર્થાત્ અજ્ઞાની નથી? કે જેથી તું મિથ્યાદેષ્ટિ અને અજ્ઞાની દુષ્પુરુષો દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવોથી પણ વિચલિત થઈને બાધા સમજે છે કે જે કર્માસ્તવનું કારણ છે. ૮૬.

(વસંતતિલકા)

ધર્માઙ્ગમેતદિહ માર્દવનામધેય
જાત્યાદિગર્વપરિહારમુશન્તિ સત્તઃ ।
તદ્વાર્યતે કિમુ ન બોધદશા સમસ્તં
સ્વપ્રેન્દ્રજાલસદ્દશ જગદીક્ષમાણૈ: ॥૮૭॥

અનુવાદ : જાતિ અને કુળ આદિનો ગર્વ ન કરવો, એને સજ્જન પુરુષો માર્દવ

નામનો ધર્મ બતાવે છે. એ ધર્મનું અંગ છે. જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વખન અથવા ઈન્ડ્રજાળ સમાન દેખનાર સાધુઓ શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા? અવશ્ય ધારણ કરે છે. ૮૭.

(શાર્દૂલવિક્રીડિત)

કાસ્થા સદ્ગાનિ સુન્દરેઽપિ પરિતો દન્દહ્યામાનાનિભિ:
કાયાદૌ તુ જરાદિભિ: પ્રતિદિનં ગચ્છત્યવસ્થાન્તરમ્ ।
ઇત્યાલોચયતો હંડિ પ્રશ્નમિનઃ શાશ્વાદ્વિવેકોઽચ્ચલે
ગર્વસ્યાવસરઃ કુતો ઽત્ર ઘટતે ભાવેષુ સર્વેષ્વપિ ॥૮૮॥

અનુવાદ : સર્વ તરફથી અતિશય સળગતી અજિનાંથી ખંડેરરૂપ બીજી અવસ્થાને પ્રાપ્ત થનાર સુન્દર ગૃહ સમાન પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા બીજી (જીર્ણ) અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાધ્ય પદાર્થોમાં નિત્યતાનો વિશ્વાસ કેવી રીતે કરી શકાય? અર્થાત્ કરી શકતો નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના વિવેક્યુક્ત નિર્ભળ હૃદયમાં જાતિ, કુળ અને જ્ઞાન આદિ સર્વ પદાર્થોના વિષયમાં અભિમાન કરવાનો અવસર કયાંથી પ્રાપ્ત થઈ શકે? અર્થાત્ પ્રાપ્ત થઈ શકતો નથી. ૮૮.

(આર્યા)

હંડિ યત્તદ્વાચિ બહિઃ ફલતિ તદેવાર્જવં ભવત્યેતત્ત્ર ।
ધર્મો નિકૃતિરધર્મો દ્વાવિહ સુરસદ્ધનરકપથૌ ॥૮૯॥

અનુવાદ : જે વિચાર હૃદયમાં રહ્યો હોય તે જ વચનમાં રહે તથા તે જ બહાર પરિણમે અર્થાત્ શરીર વડે પણ તે પ્રમાણે જ કાર્ય કરવામાં આવે, તે આર્જવ ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગ્ધો દેવો, એ અધર્મ છે. આ બંને અહીં કમશઃ દેવગતિ અને નરકગતિના કારણ છે. ૮૯.

(શાર્દૂલવિક્રીડિત)

માયિત્વં કુરુતે કૃતં સકૃદાપિ ચ્છાયાવિદ્યાતં ગુણે-
ષાજાતેર્યમિનોર્જિતેષ્વિહ ગુરુક્લોશૈ: સમાદિષ્વલમ્ ।

સર્વે તત્ત્વ યદાસતે ઽતિનિભૂતાઃ ક્રોધાદયસ્તત્ત્વત-
સ્તત્વાપં બત યેન દુર્ગતિપથે જીવશ્રિરં પ્રાય્યતિ ॥૧૦॥

અનુવાદ : અહીં લોકમાં એક વાર પણ કરવામાં આવેલો ક્રપટ વ્યવહાર જન્મથી માંડીને ભારે કષ્ટોથી ઉપાર્જિત મુનિના સમ (રાગ-દ્વેષની નિવૃત્તિ) આદિ ગુણોનો અતિશય છાયાવિઘાત કરે છે, અર્થાત્ ઉક્ત માયાચારથી સમ આદિ ગુણોની છાયા પણ બાકી રહેતી નથી-તે મૂળમાંથી નાચ થઈ જાય છે, કારણ કે તે ક્રપટપૂર્ણ વ્યવહારમાં વાસ્તવમાં ક્રોધાદિ બધા જ દુર્ગુણ પરિપૂર્ણ થઈને રહે છે. ખેદ છે કે તે ક્રપટવ્યવહાર એવું પાપ છે કે જેના કારણે આ જીવ નરકાદિ દુર્ગતિઓના માર્ગમાં ચિર કાળ સુધી પરિભ્રમણ કરે છે. ૮૦.

(આર્યા)

સ્વપરહિતમેવ મુનિભર્મિતમમૃતસમં સદૈવ સત્યં ચ ।
વત્તબ્યં વચનમથ પ્રવિધેયં ધીધનેર્મૌનમ् ॥૧૧॥

અનુવાદ : મુનિઓએ સદાય એવું સત્ય વચન બોલવું જોઈએ જે પોતાને અને પરને પણ હિતકારી હોય, પરિમિત હોય, તથા અમૃત સમાન મધુર હોય જો કદાચ આવું સત્ય વચન બોલવામાં બાધા જણાય તો એવી હાલતમાં બુદ્ધિરૂપ ધનને ધારણ કરનાર તે મુનિઓએ મૌનનું જ અવલંબન લેવું જોઈએ. ૮૧.

(આર્યા)

સતિ સન્તિ બ્રતાન્યેવ સૂનૃતે વચસિ સ્થિતે ।
ભવત્યારાધિતા સદ્ગ્રિજગત્પૂજ્યા ચ ભારતી ॥૧૨॥

અનુવાદ : સત્ય વચનની સ્થિતિ થતાં જ વ્રત થાય છે તેથી સજજન પુરુષ જગત્ પૂજ્ય તે સત્ય વચનની આરાધના કરે છે. ૮૨.

(શાર્દૂલવિક્રીણિત)

આસ્તામેતદમુત્ત્ર સૂનૃતવચાઃ કાલેન યલ્લપ્સ્યતે
સદ્ભૂપત્વસુરત્વસંસૃતિસરિત્યારાસ્પિમુખ્યં ફલમ् ।
યત્ત્રાપ્રોતિ યશઃ શશાઙ્કવિશદં શિષ્ટેસુ યન્માન્યતાં
તત્સાધુત્વમિહૈવ જન્મનિ પરં તત્કેન સંવર્ણયતે ॥૧૩॥

અનુવાદ : સત્ય વચન બોલનાર પ્રાણી સમયાનુસાર પરલોકમાં ઉત્તમ રાજ્ય, દેવ પર્યાય અને સંસારરૂપી નદીના પારની પ્રાપ્તિ અર્થાત્ મોક્ષપદરૂપ પ્રમુખ ફળ પામશે એ તો દૂર રહો. પણ તે આ જ ભવમાં જે ચંદ્ર સમાન નિર્મળ યશ, સજજન પુરુષોમાં પ્રતિષ્ઠા અને સાધુતા પ્રાપ્ત કરે છે; તેનું વર્ણન કોણા કરી શકે છે? અર્થાત્ કોઈ નહીં. ૮૩.

(આર્યા)

યત્પરદારાર્થાદિષુ જન્તુષુ નિઃસ્પૃહમહિંસકં ચેતઃ ।
દુશ્છેદ્યાન્તર્મલહત્તરેવ શૌચં પરં નાચ્યત્ ॥૧૪॥

અનુવાદ : જે ચિત્ત પરલ્લી અને પરધનની અભિલાષા ન કરતું થકું ષટ્કાય જીવોની હિંસાથી રહિત થઈ જાય છે, તેને જ દુર્ભેદ્ય અભ્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ શૌચધર્મ કહેવામાં આવે છે. એનાથી બિન્ન બીજો કોઈ શૌચ ધર્મ હોઈ શકતો નથી. ૮૪.

(શાર્ડ્લાવિક્રીડિત)

ગઙ્ગાસાગરપુષ્કરાદિષુ સદા તીર્થેષુ સર્વેષપિ
સ્નાતસ્યાપિ ન જાયતે તનુભૂતઃ પ્રાયો વિશુદ્ધિઃ પરા ।
મિથ્યાત્વાદિમલીમસં યદિ મનો બાહ્ય ડતિશુદ્ધોદકૈ-
ધૌતઃ કિં બહુશો ડપિ શુદ્ધ્યતિ સુરાપૂરપૂરો ઘટઃ ॥૧૫॥

અનુવાદ : જો પ્રાણીનું મન મિથ્યાત્વ આદિ દોષોથી મલિન થઈ રહ્યું હોય તો ગંગા, સમુદ્ર અને પુષ્કર આદિ બધા તીર્થોમાં સદા સ્નાન કરવા છતાં પણ ઘણું કરીને તે અતિશય વિશુદ્ધ થઈ શકતું નથી. તે યોગ્ય જ છે—મદના પ્રવાહથી પરિપૂર્ણ ઘટ જો બહારથી અતિશય વિશુદ્ધ પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ શું તે શુદ્ધ થઈ શકે છે? અર્થાત્ થઈ શકતો નથી.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જો મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ય ઉત્તમ શૌચ હોઈ શકે છે. પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય તો ગંગા આદિ અનેક તીર્થોમાં વારંવાર સ્નાન કરવા છતાં પણ શૌચધર્મ કદી ય હોઈ શકતો નથી. ૮૫.

(આર્યા)

જન્તુકૃપાર્દિતમનસઃ સમિતિષુ સાધોઃ પ્રવર્તમાનસ્ય ।
પ્રાણેન્દ્રિયપરિહારં સંયમમાહુર્મહામુનયઃ ॥૧૬॥

અનુવાદ : જેમનું મન જીવોની અનુકંપાથી ભીજાયેલું છે તથા જે ઈર્યાભાષા આદિ પાંચ સમિતિઓમાં પ્રવર્તમાન છે એવા સાધુ દ્વારા જે છકાય જીવોની રક્ષા અને પોતાની ઈન્દ્રિયોનું દમન કરવામાં આવે છે તેને ગણધરદેવ આદિ મહામુનિઓ સંયમ કહે છે. ૮૬.

(શાર્ડૂલવિક્રીદિત)

માનુષ્ય કિલ દુર્લભ ભવભૂતસ્તત્રાપિ જાત્યાદય-
સ્તોષેવાપ્સવચઃશ્રુતિઃ સ્થિતિરતસ્તસ્યાશ્ર દ્વારોધને ।
પ્રાપ્તે તે અતિનિર્મલે અપિ પરં સ્યાતાં ન યેનોજ્ઞિતે
સ્વર્મોક્ષૈકફળપ્રદે સ ચ કર્થ ન શ્લાઘ્યતે સંયમઃ ॥૧૭॥

અનુવાદ : આ સંસારી પ્રાણીને મનુષ્ય ભવ પ્રાપ્ત થવો અત્યંત કઠણ છે, જો મનુષ્યભવ પ્રાપ્ત પણ થઈ જાય તો તેમાં ય ઉત્તમ જીતિ આદિ મળવાં કઠણ છે, ઉત્તમ જીતિ આદિ પ્રાપ્ત થાય તો જિનવાણીનું શ્રવણ દુર્લભ છે, જિનવાણીનું શ્રવણ મળવા છતાં પણ લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. જો અત્યંત નિર્મળ તે બન્ને પણ પ્રાપ્ત થઈ જાય તો જે સંયમ વિના તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ આપી શકતા નથી એવો તે સંયમ કેમ પ્રશંસનીય ન હોય? અર્થાત્ તે અવશ્યમેવ પ્રશંસાને યોગ્ય છે. ૮૭.

(આર્યા)

કર્મમલવિલયહેતોર્બોધદશા તપ્યતે તપઃ પ્રોક્તમ् ।
તદ્ દ્વેધા દ્વાદશધા જન્મામ્બુધિયાનપાત્રમિદમ् ॥૧૮॥

અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર સાધુ દ્વારા જે કર્મરૂપી મેલ દૂર કરવા માટે તપવામાં આવે છે તેને તપ કહેલ છે. તે બાબ્ય અને અભ્યંતરના ભેદથી બે પ્રકારનું તથા અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે. આ તપ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે.

વિશોધાર્થ : જે કર્મોનો ક્ષય કરવાના ઉદેશથી તપવામાં આવે છે તેને તપ કહે છે. તે બાબ્ય અને અભ્યંતરના ભેદથી બે પ્રકારનું છે. જે તપ બાબ્ય દ્રવ્યની અપેક્ષા રાખે છે તથા ભીજા દ્વારા પ્રત્યક્ષરૂપે દેખી શકાય છે તે બાબ્ય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે છ ભેદ છે.

૧. અનશન—સંયમ આદિની સિદ્ધિ માટે ચાર પ્રકારના (અન્, પેય, ખાદ્ય અને લેહા) આહારનો પરિત્યાગ કરવો. ૨. અવમૌદ્ય—ભત્રીસ કોળિયા પ્રમાણ સ્વાત્માવિક આહારમાંથી એક-બે-ત્રણ આદિ કોળિયા ઓછા કરીને એક કોળિયા સુધી ગ્રહણ કરવો, ૩. વૃત્તિપરિસંઘાન—ગૃહપ્રમાણ તથા દાતા અને ભોજન આદિનો નિયમ કરવો. ગૃહપ્રમાણ—જેમ કે આજે હું બે ધેર જ જઈશ. જો એમાં આહાર પ્રાપ્ત થશે તો લઈશ, નહિ તો (બે કરતાં વધારે ધેર જઈને) નહિ. એ જ રીતે દાતા આદિના વિષયમાં પણ સમજવું જોઈએ. ૪. રસપરિત્યાગ—દૂધ, દહી, ધી, તેલ, ગોળ અને મીહું આ છ રસોમાંથી એક બે વગેરે રસોનો ત્યાગ કરવો અથવા તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુર રસોમાંથી એક બે વગેરે રસોનો પરિત્યાગ કરવો. ૫. વિવિકન શય્યાસન-જંતુઓની પીડાથી રહિત નિર્જન શૂન્ય ગૃહ આદિમાં શય્યા કે આસન માંડવું (સૂવું કે બેસવું). ૬. કાયકલેશ-તડકામાં, વૃક્ષના મૂળમાં અથવા ખુલ્લા મેદાનમાં સ્થિત રહીને ધ્યાન કરવું.

જે તપ મનને નિયમમાં રાખે છે તેને અભ્યંતર તપ કહે છે. તેના પણ નીચે પ્રમાણે છ બેદ છે.

૧. પ્રાયશ્રિત—પ્રમાદથી ઉત્પન્ન થયેલા દોષો દૂર કરવા. ૨. વિનય-પૂજ્ય પુરુષોમાં આદરભાવ રાખવો. ૩. વૈયાવૃત્ય-શરીરની યોષાથી અથવા અન્ય દ્રવ્યથી રોગી અને વૃદ્ધ આદિ સાધુઓની સેવા કરવી. ૪. સ્વાધ્યાય-આળસ છોડીને જ્ઞાનનો અભ્યાસ કરવો. તે વાચના, પૃથ્બના, અનુપ્રેક્ષા, આભનાય અને ધર્માપદેશના બેદથી પાંચ પ્રકારે છે.—૧. નિર્દોષ ગ્રન્થ, અર્થ અને બન્નેયનું પ્રદાન કરવું તેને વાચના કહેવામાં આવે છે. ૨. સંશય દૂર કરવા માટે વિશિષ્ટ વિદ્વાનોને પૂછવું તેને પૃથ્બના કહે છે. ૩. જાણોલા પદાર્થનો મનથી વિચાર કરવો તેનું નામ અનુપ્રેક્ષા છે. ૪. શુદ્ધ ઉચ્ચારણ સાથે પાઠનું પરિશીળન કરવું તેનું નામ આભનાય છે. ૫. ધર્મકથા વગેરે અનુષ્ઠાનને ધર્માપદેશ કહેવામાં આવે છે. ૬. વ્યુત્સર્ગ-અહંકાર અને મમકારનો ત્યાગ કરવો. ૬. ધ્યાન-ચિત્તને આમ તેમથી ખસેડીને કોઈ એક પદાર્થના ચિન્તનમાં લગાવવું. ૮૮.

(પૃથ્બી)

કષાયવિષયોદ્ભટપ્રચુરતસ્કરૌઘો હહત્ત
તપઃસુભટતાડિતો વિઘટતે યતો દુર્જયઃ ।
અતો હિ નિરૂપદ્રવશ્રરતિ તેન ધર્મશ્રિયા
યતિઃ સમુપલક્ષિતઃ પથિ વિમુક્તિપુર્યાઃ સુખમ् ॥૧૧॥

અનુવાદ : જે કોધાદિ કષાયો અને પંચેન્દ્રિય વિષયોરૂપ ઉદ્ભટ અને અનેક ચોરોનો સમુદ્દરાય ધારી મુશ્કેલીથી જીતી શકાય છે તે તપરૂપી સુભટ દ્વારા બળપૂર્વક

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૫૧

માર ખાઈને નાશ પામે છે. તેથી જ તપ અને ધર્મરૂપ લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષ નગરીના માર્ગ સર્વ પ્રકારના વિધન-બાધાઓથી રહિત થઈને સુખેથી ગમન કરે છે.

વિશેષાર્થ : જેમ ચોરોનો સમુદ્દર માર્ગમાં ચાલતા પથિક જનોના ધનનું અપહરણ કરીને તેમને આગળ જવામાં બાધા પહોંચાડે છે તેવી જ રીતે કોધાદિ કષાયો અને પંચેન્દ્રિય વિષય-ભોગ મોક્ષમાર્ગ ચાલનાર સત્પુરુષોના સમ્યગ્દર્શનાદિરૂપ ધનનું અપહરણ કરીને તેમને આગળ જવામાં બાધક થાય છે. ઉપર્યુક્ત ચોરોનો સમુદ્દર જેમ કોઈ શક્તિશાળી સુભટથી પીડિત થઈને જ્યાં ત્યાં નાસી જાય છે તેવી જ રીતે તપ દ્વારા તે વિષય કષાયો પણ નષ્ટ કરાય છે. તેથી ચોર ન રહેવાથી જેમ પથિક જન નિરૂપદ્રવ થઈને માર્ગમાં ગમન કરે છે તેવી જ રીતે વિષય કષાયોનો નાશ થવાથી સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન સાધુઓ પણ નિર્બાધપણે મોક્ષમાર્ગ ગમન કરે છે. ૮૮.

(મન્દાક્રાન્તા)

મિથ્યાત્વાર્દેર્યદિહ ભવિતા દુઃખમુગ્રં તપોભ્યો
જાતં તસ્માદુદકકણિકૈકેવ સર્વાદ્વિનીરાત્ ।
સ્તોકં તેન પ્રભવમખિલં કૃચ્છ્લલદ્યે નરત્વે
યદેતર્હિ સ્ખલતિ તદહો કા ક્ષતર્જીવ તે સ્યાત્ ॥૧૦૦॥

અનુવાદ : લોકમાં મિથ્યાત્વ આદિના નિમિતે જે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું છે તેની અપેક્ષાએ તપથી ઉત્પન્ન થતું દુઃખ એટલું અલ્ય હોય છે જેટલું સમુક્રના સંપૂર્ણ જીણની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. તે તપથી બધું જ (સમતા આદિ) પ્રગટે છે. તેથી હે જીવ! કઠિનાર્થી પ્રાપ્ત થતી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થતા છતાં પણ જો તું આ વખતે તપથી ભાષ્ટ થશે તો તને કેટલી હાનિ થશે એ જાણો છે? અર્થાત્ તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ૧૦૦.

(શાર્દૂલવિક્રીડિત)

વ્યાખ્યા યત્ ક્રિયતે શ્રુતસ્ય યત્યે યદીયતે પુસ્તકં
સ્થાનં સંયમસાધનાદિકમણિ ગ્રીત્યા સદાચારિણા ।
સ ત્યાગો વપુરાદિનર્મમતયા નો કિંચનાસ્તે યતે-
રાકિંચન્યમિદં ચ સંસ્તિહરો ધર્મઃ સતાં સંમતઃ ॥૧૦૧॥

અનુવાદ : સદાચારી પુરુષ દ્વારા મુનિને જે પ્રેમપૂર્વક આગમનું વ્યાખ્યાન

કરવામાં આવે છે, પુસ્તક આપવામાં આવે છે તથા સંયમના સાધનભૂત પીંઠી આદિ પણ આપવામાં આવે છે તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીર આદિમાં મમત્વબુદ્ધિ ન રહેવાથી મુનિની પાસે જે કિંચિત માત્ર પણ પરિગ્રહ રહેતો નથી તેનું નામ ઉત્તમ આકિંયન્ય ધર્મ છે. સજ્જન પુરુષોને ઈચ્છિત તે ધર્મ સંસારનો નાશ કરનાર છે. ૧૦૧.

(શિખરિણિ)

વિમોહા મોક્ષાય સ્વહિતનિરતાશ્રાંતચરિતા:
ગૃહાદિ ત્યક્ત્વા યે વિદધતિ તપસ્તેજપિ વિરલાઃ ।
તપસ્યન્તો ઽન્યસ્મિન્નપિ યમિનિ શાસ્ત્રાદિ દદતઃ
સહાયાઃ સ્યુર્યે તે જગતિ યતયો દુર્લભતરાઃ ॥૧૦૨॥

અનુવાદ : મોહ રહિત, પોતાના આત્મહિતમાં લવલીન અને ઉત્તમ ચારિત્રથી સંયુક્ત જે મુનિઓ મોક્ષપ્રાપ્તિ માટે ઘર આદિ છોડીને તપ કરે છે તે પણ વિરલ છે અર્થાત્ બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતાં થકાં અન્ય મુનિને પણ શાશ્વાદિ આપીને તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. ૧૦૨.

(શિખરિણિ)

પરં મત્વા સર્વ પરિહતમશેષં શ્રુતવિદા
વપુઃપુસ્તાદ્યાસ્તે તદપિ નિકટં ચેદિતિ મતિઃ ।
મમત્વાભાવે તત્સદપિ ન સદન્યત્ર ઘટતે
જિનેન્દ્રાજ્ઞાભઙ્ગો ભવતિ ચ હઠાત્કલમષમૃષે: ॥૧૦૩॥

અનુવાદ : આગમના જાણકાર મુનિએ સમસ્ત બાધ્ય વસ્તુઓને પર અર્થાત્ આત્માથી ભિન્ન જાણીને તે બધાનો ત્યાગ કરી દીધો છે. છતાં પણ જ્યારે શરીર અને પુસ્તકાદિ તેમની પાસે રહે છે તો એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે કહી શકાય. જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને જોકે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વભાવ રહેતો નથી તેથી જ તેઓ વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન સમાન જ છે. હા, જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૫૩

મમત્વભાવ હોય તો પછી તે નિષ્પરિણહી કહી શકતા નથી. અને એવી અવસ્થામાં તેને સમસ્ત પરિણહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય છે કે જેથી તેને બળપૂર્વક પાપબંધ થાય છે. ૧૦૩.

(સ્નાનધરા)

યત્સંગાધારમેતશ્વલતિ લઘુ ચ યત્તીક્ષણદુઃખૌઘધારં
મૃત્યિણીભૂતભૂતં કૃતબહુવિકૃતિભ્રાન્તિ સંસારચક્રમ् ।
તા નિત્યં યન્મુમુક્ષુર્યતિરમલમતિઃ શાન્તમોહઃ ગ્રપશ્યે-
ઝામીઃ પુત્રીઃસવિત્રીરિવ હરિણદ્વશસ્તત્પરં બ્રહ્મચર્યમ् ॥૧૦૪॥

અનુવાદ : જે તીવ્ર દુઃખોના સમૂહરૂપ ધારા સહિત છે, જેના પ્રભાવથી પ્રાણી માટીના પિંડાની જેમ ધૂમે છે અને જે અનેક વિકાર રૂપ ભ્રમ કરનાર છે એવું આ સંસારરૂપી ચક જે સ્ત્રીઓના આધારે શીધતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી સ્ત્રીઓને, મોહને ઉપશાન્ત કરનાર, મોક્ષના અભિલાષી, નિર્ભળ બુદ્ધિવાળા મુનિ સદા બહેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે.

વિશેષાર્થ :—અહીં સંસારમાં ચકનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે આ કારણે—જેમ ચક (કુંભારનો ચાકડો) ખીલીના આધારે ચાલે છે તેવી જ રીતે આ સંસારચક (સંસાર પરિભ્રમણ) સ્ત્રીઓના આધારે ચાલે છે. ચકમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચકમાં જે અનેક દુઃખોનો સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. કુંભારના ચાકડા ઉપર જેમ માટીનો પિંડો પરિભ્રમણ કરે છે તેમ આ સંસારચક ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો ધૂમતા ધૂમતા માટીના પિંડમાંથી અનેક વિકારો—શકોર, ઘડો, કુંદુ વગેરેને ઉત્પન્ન કરે છે તેવી જ રીતે આ સંસારચક પણ અનેક વિકારો—જીવની નરનારકાદ્વિરૂપ પર્યાયોને ઉત્પન્ન કરીને તેમને ધૂમાવે છે. તાત્પર્ય એ છે કે સંસારપરિભ્રમણના કારણભૂત સ્ત્રીઓ છે તેમના વિષયનો અનુરાગ છે. તે સ્ત્રીઓને અવસ્થાવિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમજીને તેમના પ્રત્યે અનુરાગ ન કરવો એ બ્રહ્મચર્ય છે જે તે સંસારચકથી જીવોની રક્ષા કરે છે. ૧૦૪.

(માલિની)

અવિરતમિહ તાવત્યુણ્યભાજો મનુષ્યાઃ
હદિ વિરચિતરાગાઃ કામિનીનાં વસન્તિ ।
કથમપિ ન પુનસ્તા જાતુ યેષાં તદદ્ગ્રી
પ્રતિદિનમતિનપ્રાસ્તે ઽપિ નિત્યં સ્તુવન્તિ ॥૧૦૫॥

અનુવાદ : લોકમાં પુષ્યવાન પુરુષો રાગ ઉત્પન્ન કરીને નિરંતર શ્રીઓના હદ્યમાં નિવાસ કરે છે. એ પુષ્યવાન પુરુષો પણ, જે મુનિઓના હદ્યમાં તે શ્રીઓ કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી તે મુનિઓના ચરણની પ્રતિદિન અત્યંત નમ્ર બનીને નિત્ય સુતિ કરે છે. ૧૦૫.

(સ્થાધરા)

વैરाग्यत्यागदारुद्धयकृતरचना ચારુનિશ્રેणિકા यૈ:
 પાદસ્થાનૈરૂદ્ધારેર્દશભિરનુગતા નિશ્શ્લોજ્ઞાનદષ્ટે: ।
 યોગ્યા સ્યાદારુલ્ક્ષો: શિવપદસદનં ગન્તુમિત્યેષુ કેષાં
 નો ધર્મેષુ ત્રિલોકીપતિભિરાપિ સદા સ્તૂયમાનેષુ હૃષિઃ ॥૧૦૬॥

અનુવાદ : વैરાગ્ય અને ત્યાગરૂપ બે લાકડાથી બનાવેલી સુન્દર નિસરણી જે દસ મહાન સ્થિર પગથિયાવાળી હોઈને મોક્ષ-મહેલમાં જવા માટે ચડવાની અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. ત્રણલોકના અધિપતિઓ (ઈન્દ્ર, ધરનેન્દ્ર અને ચક્રવર્તી) દ્વારા સ્તૂયમાન તે દસ ધર્માના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ ન થાય? ૧૦૬.

નિ:શેષામલશીલસદ્ગુણમયીમત્યન્તસામ્યસ્થિતાં
 વન્દે તાં પરમાત્મન: પ્રણયિનીં કૃત્યાન્તગાં સ્વસ્થતામ્ ।
 યત્રાન્તચતુષ્યામૃતસરિત્યાત્માનમન્તર્ગતં
 ન પ્રાપ્નોતિ જરાદિદુઃખહશિખ: સંસારદાવાનલ: ॥૧૦૭॥

અનુવાદ : જે સ્વસ્થતા નિર્મળ સમસ્ત શીલ અને સમીયીન ગુણોથી રચાયેલી છે, અત્યંત સમતાભાવ ઉપર સ્થિત છે તથા કાર્યના અંતને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ ચુકી છે; તે પરમાત્માની પ્રિયાસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું. અનંત ચતુષ્યરૂપ અમૃતની નદી સમાન તે સ્વસ્થતામાં સ્થિત આત્માને વૃદ્ધત્વ આદિરૂપ હુઃસહ જવાળાઓથી સંયુક્ત એવા સંસારરૂપી દાવાનલ (જંગલની આગ) પ્રાપ્ત થતો નથી. ૧૦૭.

(શાર્ડૂલવિક્રીડિત)

આયાતે ઽનુભવं ભવારિમથને નિર્મુક્તમૂર્ત્યાશ્રયે
શુદ્ધે ઽન્યાદશિ સોમસૂર્યહૃતભુક્તાન્તેરનન્તપ્રભે ।
યસ્મિન્નસ્તમુપૈતિ ચિત્રમચિરાન્નિઃશેષવસ્ત્વન્તરં
તદ્વન્દે વિપુલપ્રમોદસદનં ચિદ્રૂપમેકં મહઃ ॥૧૦૮॥

અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજ સંસારરૂપી શત્રુને મથનાર છે, રૂપ, રસ,
ગંધ, સ્પર્શરૂપ મૂર્તિના આશ્રય રહિત અર્થાત् અમૂર્તિક છે, શુદ્ધ છે, અનુપમ છે
તથા ચન્દ્ર, સૂર્ય અને અગ્નિની પ્રભાની અપેક્ષાએ અનંતગુણી પ્રભાથી યુક્ત છે;
તે ચૈતન્યરૂપ તેજનો અનુભવ થઈ જતાં આશ્રય છે કે અન્ય સમસ્ત પર પદાર્થ
શીંગ જ નાણ થઈ જાય છે અર્થાત્ તેમનો પછી વિકલ્પ જ રહેતો નથી. અતિશય
આનંદ ઉત્પન્ન કરનાર તે એક ચૈતન્યરૂપ તેજને હું નમસ્કાર કરું છું. ૧૦૮.

(શાર્ડૂલવિક્રીડિત)

જાતિર્યાતિ ન યત્ર યત્ર ચ મૃતો મૃત્યુર્જરા જર્જરા
જાતા યત્ર ન કર્મકાયઘટના નો વાગ્ ન ચ વ્યાધયઃ ।
યત્રાત્મૈવ પરં ચકાસ્તિ વિશદજ્ઞાનૈકમૂર્તિઃ પ્રભુ-
ર્નિત્યં તત્પદમાશ્રિતા નિરૂપમાઃ સિદ્ધાઃ સદા પાન્તુ વઃ ॥૧૦૯॥

અનુવાદ : જે મોક્ષપદમાં જન્મ થતો નથી, મૃત્યુ મરી ગયું છે, જરા જીર્ણ
થઈ ગઈ છે, કર્મ અને શરીરનો સંબંધ રહ્યો નથી, વચન નથી, વ્યાધિઓ પણ બાકી
રહી નથી, જ્યાં કેવળ નિર્મણજ્ઞાનરૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી
આત્મા જ સદા પ્રકાશમાન છે; તે મોક્ષપદ પામેલા અનુપમ સિદ્ધ પરમેષ્ઠી સર્વદા
આપની રક્ષા કરો. ૧૦૯.

(શાર્ડૂલવિક્રીડિત)

દુર્લક્ષ્યે ઽપિ ચિદાત્મનિ શ્રુતબલાત् કિંचિત્સ્વસંવેદનાત्
બ્રૂમઃ કિંચિદિહ પ્રબોધનિધિભર્ગાદ્યં ન કિંચિચ્છલમ્ ।
મોહે રાજનિ કર્મણામતિતરાં પ્રૌઢાન્તરાયે રિપૌ
દૃગ્બોધાવરણદ્વયે સતિ મતિસ્તાદ્વક્તો માદ્શામ ॥૧૧૦॥

અનુવાદ : જો કે ચૈતન્યસ્વરૂપ આત્મા અદેશ્ય છે છતાં પણ શાલ્યના બળથી થતા કંઈક સ્વાનુભવથી પણ અહીં તેના સંબંધમાં કંઈક નિરૂપણ કરીએ છીએ. સમ્યજ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનોએ આમાં કંઈ છળ નહીં સમજવું જોઈએ. કારણ કે સર્વ કર્માના અધિપતિસ્વરૂપ મોહ, શક્તિશાળી અંતરાયરૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન હોય ત્યારે મારા જેવા અલ્યજ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ કૃયાંથી હોઈ શકે? ૧૧૦.

(શાર્ડૂલવિક્રીદિત)

વિદ્બન્મન્યતયા સદસ્યતિતરામુદ્દણવાગ્ડમ્બરા:
શૃઙ્ગારાદિરસૈ: પ્રમોદજનકં બ્યાખ્યાનમાત્રાત્મતે ।
યે તે ચ પ્રતિસદ્ગ્ય સન્તિ બહ્વો બ્યામોહવિસ્તારિણો
યેભ્યસ્તત્પરમાત્મતત્ત્વવિષયં જ્ઞાનં તુ તે દુર્લભાઃ ॥૧૧૧॥

અનુવાદ : વિદ્બતાના અભિમાનથી સભામાં અત્યંત ઉંડંડ વચનોનો આડંબર કરનારા જે કવિઓ શુંગારાદિ રસો દ્વારા બીજાઓને આનંદ ઉત્પન્ન કરનાર વ્યાખ્યાનનો વિસ્તાર કરીને તેમને મુખ કરે છે તે કવિઓ તો અહીં ઘરે ઘરે અનેક છે. પણ જેમની પાસેથી પરમાત્મતત્ત્વ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો દુર્લભ જ છે. ૧૧૧.

(શાર્ડૂલવિક્રીદિત)

આપદ્રેતુષુ રાગરોષનિકૃતપ્રાયેષુ દોષેષ્ઠલં
મોહાત્મસર્વજનસ્ય ચેતસિ સદા સત્સુ સ્વભાવાદપિ ।
તત્ત્રાશાય ચ સંવિદે ચ ફલવત્કાવ્યં કવેર્જાયિતે
શૃઙ્ગારાદિરસં તુ સર્વજગતો મોહાય દુઃખાય ચ ॥૧૧૨॥

અનુવાદ : જે રાગ, કોધ અને માયા આદિ દોષ અત્યંત દુઃખના કારણભૂત છે તે તો મોહને વશ થયેલા સ્વભાવથી જ સર્વદા સર્વ જીવોના ચિત્તમાં નિવાસ કરે છે. ઉક્ત દોષોનો નાશ કરવા તથા સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રચવામાં આવેલું કવિનું કાવ્ય સફળ થાય છે. એનાથી વિપરીત શુંગારાદિ રસપ્રધાન કાવ્ય તો સર્વ જીવોને મોહ અને દુઃખ જ ઉત્પન્ન કરનાર થાય છે. ૧૧૨.

(વસંતતિલકા)

કાલાદાપિ પ્રસૃતમોહમહાન્ધકારે
 માર્ગ ન પશ્યતિ જનો જગતિ પ્રશસ્તમ્ |
 કુદ્રાઃ ક્ષિપન્તિ દૃશિ દુઃશ્રુતિધૂલિમસ્ય
 ન સ્યાત્કર્થં ગતિરનિશ્ચિતદુઃપથેષુ ॥૧૧૩॥

અનુવાદ : કાળના પ્રભાવથી જ્યાં મોહરૂપ મહાન અંધકાર ફેલાયેલો છે એવા આ લોકમાં મનુષ્ય ઉત્તમ માર્ગ જોઈ શકતો નથી. તે સિવાય નીચ મિથ્યાદેષિ જીવો તેની આંખમાં મિથ્યા ઉપદેશરૂપ ધૂળ પણ ફેંકે છે. તો પછી એવી હાલતમાં તેનું ગમન અનિશ્ચિત ખોટા માર્ગ કેમ ન થાય? અર્થાત્ અવશ્ય થાય. ૧૧૩.

(શાર્ડૂલવિક્રીડિત)

વિષ્ણુત્રક્રિમિસંકુલે કૃતઘૃણૌરત્રાદિભિઃ પૂરિતે
 શુક્રાસૃગ્વરયોષિતામપિ તનુર્માતુઃ કુગર્ભે ઽજનિ ।
 સાપિ વિલાષરસાદિધાતુકલિતા પૂર્ણા મલાઘૈરહો
 ચિત્રં ચન્દ્રમુખીતિ જાતમતિભર્વિદ્વિરાવર્ણતે ॥૧૧૪॥

અનુવાદ : જે માતાની કુત્સિત કુક્ષિ વિષ્ટા, મૂત્ર અને તુચ્છ જંતુઓથી વ્યાપ્ત તથા ધૃતાજનક આંતરડા આદિથી પરિપૂર્ણ છે એવી તે કૂખમાં ઉત્તમ સ્ત્રીઓનું પણ વીર્ય અને રજથી નિર્ભિત શરીર ઉત્પન્ન થયું છે. તે ઉત્તમ સ્ત્રી પણ કલેશજનક રસ આદિ ધાતુઓથી યુક્ત અને મળ આદિથી પરિપૂર્ણ છે. છતાં પણ આશ્રય છે કે તેને પ્રતિભાશાળી વિદ્વાન् ચન્દ્રમુખી (ચન્દ્ર જેવા મુખવાળી) બતાવે છે. ૧૧૪.

(શિખરણી)

કચા યુકાવાસા મુહમજિનબદ્વાસ્થિનિચયઃ
 કુચૌ માંસોચ્છાયૌ જઠરમપિ વિષાદિધાટિકા ।
 મલોત્સર્ગે યત્ત્રં જઘનમબલાયાઃ ક્રમયુગં
 તદાધારસ્થૂળે કિમિહ કિલ રાગાય મહતામ્ ॥૧૧૫॥

અનુવાદ : જે સ્ત્રીના વાળ જૂ ના સ્થાનરૂપ છે, મુખ ચામડાથી સમ્બદ્ધ

હડકાના સમૂહથી સંયુક્ત છે. સતન માંસથી ઉન્ત છે. ઉદર પણ વિષા આદિના તુચ્છ ઘડા સમાન છે જીવન મળ છોડવાના યંત્ર સમાન છે અને બને પગ તે યંત્રના આધારભૂત સ્તંભો સમાન છે; આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. ૧૧૫.

(દૃતવિલાસિત)

પરમધર્મનદાજ્ઞનમીનકાન् શશિમુહીબડિશેન સમુદ્ધતાન् ।

અતિસમુલ્લસિતે રતિમુમુરે પચતિ હા હતકઃ સ્મરધીવરઃ ॥૧૧૬॥

અનુવાદ : હત્યારો કામદેવરૂપી માછીમાર ઉત્તમ ધર્મરૂપી નદીમાંથી મનુષ્યોરૂપી માછલીઓને સ્ત્રી રૂપ કંટા દ્વારા કાઢીને તેમને અત્યંત બળનારી અનુરાગરૂપી અજિનમાં રંધે છે, એ ઘણા ખેદની વાત છે.

વિશેષાર્થ : જેમ માછીમાર કંટા દ્વારા નદીમાંથી માછલીઓ કાઢીને તેમને અજિનમાં રંધે છે તે જ પ્રમાણે કામદેવ (ભોગાભિવાધા) પણ મનુષ્યોને સ્ત્રીઓ દ્વારા ધર્મથી ભષ્ટ કરીને તેમને વિષયભોગોથી સંતપ્ત કરે છે. ૧૧૬.

(શાર્દૂલવિક્રીડિત)

યેનેદं જગદાપદમ્બુધિગતં કુર્વાત મોહો હઠાત्

યેનૈતે પ્રતિજન્તુ હન્તુમનસઃ ક્રોધાદયો દુર્જ્યાઃ ।

યેન ભ્રાતરિયં ચ સંસૃતિ સરિત્સંજાયતે દુસ્તરા

તજ્જાનીહિ સમસ્તદોषવિષમં સ્ત્રીસૂપમેતદ્રધ્યુવમ् ॥૧૧૭॥

અનુવાદ :—જે સ્ત્રીના સૌન્દર્યના પ્રભાવથી આ મોહ જગતના પ્રાણીઓને બળપૂર્વક આપત્તિરૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવે છે, જેના દ્વારા આ દુર્જ્ય કોધ આદિ શત્રુ પ્રત્યેક પ્રાણીના ઘાતમાં તત્પર રહે છે તથા જેના દ્વારા આ સંસારરૂપી નદી પાર કરવી અશક્ય બની જાય છે. હે ભાઈ! તું તે સ્ત્રીના સૌન્દર્યને નિશ્ચયથી સમસ્ત દોષોવાળું હોવાને કારણે કષ્ટદાયક સમજ. ૧૧૭.

(શાર્દૂલવિક્રીડિત)

મોહબ્યાધભટેન સંસૃતિવને મુગ્ધૈણબન્ધાપદે
પાશાઃ પદ્માઙ્ગલોચનાદિવિષયાઃ સર્વત્ર સર્જીકૃતાઃ ।

મુખધાસ્તત્ર પતન્તિ તાનપિ વરાનાસ્થાય વાજ્ઞાન્યહો
હા કષ્ટં પરજન્મને ઽપિ ન વિદઃ ક્ષાપીતિ ધિઙ્ગુર્ખતામુ ॥૧૧૮॥

અનુવાદ :—સુભટ મોહરૂપી પારધીએ સંસારરૂપી વનમાં મૂર્ખજનરૂપી મૃગોને બન્ધન- જનિત આપત્તિમાં ધકેલવા માટે સર્વત્ર કમળ સમાન નેત્રોવાળી શ્રી આદિ વિષયરૂપી જાળો તૈયાર કરી લીધી છે. આ મૂર્ખ પ્રાણી તે ઈન્દ્રિય વિષયરૂપી જાળમાં ફસાઈ જાય છે અને તે વિષય ભોગોને ઉત્તમ અને સ્થાયી સમજને પરલોકમાં પણ તેમની ઈચ્છા કરે છે, એ ઘણા ખેદની વાત છે. પરંતુ વિદ્વાનું પુરુષ તેમની અભિલાષા આ લોક અને પરલોકમાંથી ક્ષાયાંય પણ કરતા નથી. તે મૂર્ખતાને ધિક્કાર છે. ૧૧૮.

(શાર્દૂલવિક્રીડિત)

એતન્મોહદ્દકપ્રયોગવિહિતભ્રાન્તિભ્રમચ્છક્ષુષા
પશ્યત્યેષ જનો ઽસમજસમસદ્બુધિર્ધુવં બ્યાપદે ।
અયેતાનુ વિષયાનનન્તનરકક્લોશપ્રદાનસ્થિરાનુ
યત્ શશ્વત્સુખસાગરાનિવ સતશ્રેતઃપ્રિયાનુ મન્યતે ॥૧૧૯॥

અનુવાદ : આ દુર્બુદ્ધિ મનુષ્ય મોહરૂપી ઠગના પ્રયોગથી કરવામાં આવેલી આન્તિથી ભ્રમિત થયેલી આંખો દ્વારા આ વિષયસુખને વિપરીત દેખે છે અર્થાત્ તે દુઃખદાયક વિષયસુખને સુખદાયક માને છે. પરંતુ વાસ્તવમાં તે નિશ્ચયથી આપત્તિજનક જ છે. જે આ વિષયભોગ નરકમાં અનંત દુઃખ આપનાર અને અસ્થિર છે તેમને તે સર્વદા ચિત્તને પ્રિય લાગનારા સુખના સમુદ્ર સમાન માને છે. ૧૧૯.

(શાર્દૂલવિક્રીડિત)

સંસારે ઽત્ર ઘનાટવીપરિસરે મોહદ્દકઃ કામિની-
ક્રોધાદ્યાશ્ તદીયપેટકમિદં તત્સંનિધૌ જાયતે ।
પ્રાણી તદ્વિહિતપ્રયોગવિકલસ્તદ્બશ્યતામાગતો
ન સ્વં ચેતયતે લભેત વિપદં જ્ઞાતુઃ પ્રભો: કથ્યતામુ ॥૧૨૦॥

અનુવાદ : સધન વનની અંત્ય ભૂમિ સમાન આ સંસારમાં મોહરૂપ ઠગ વિદ્યમાન છે. શ્રી અને કોધાદિ ક્ષાપયો તેની પેટી સમાન છે અર્થાત્ તેઓ તેના પ્રબળ

સહાયક છે. કારણ કે એ તેના (મોહના) રહેવાથી જ રહે છે. ઉક્ત મોહદ્વારા કરવામાં આવેલા પ્રયોગથી વ્યાકુળ થયેલ પ્રાણી તેને વશ થઈને પોતાના આત્મસ્વરૂપનો વિચાર કરતા નથી, તેથી તે વિપત્તિને પ્રાપ્ત થાય છે. તે મોહરૂપ ઠગથી પ્રાણીની રક્ષા કરનાર જાતા પ્રભુ (સર્વદા) છે તેથી જ તે જાતા પ્રભુની જ પ્રાર્થના કરવી. ૧૨૦.

(શાર્ડૂલવિક્રીડિત)

ઐશ્વર્યાદિગુણપ્રકાશનતયા મૂળ હિ યે કુર્વતે
સર્વેષાં ટિરિટિલિતાનિ પુરતઃ પશ્યન્તિ નો બ્યાપદઃ ।
વિદ્યુલ્લોલમપિ સ્થિરં પરમપિ સ્વં પુત્રદારાદિકં
મન્યન્તે યદહો તદત્ત્ર વિષમં મોહપ્રભોઃ શાસનમ્ ॥૧૨૧॥

અનુવાદ : જે મૂર્ખજનો પોતાના ઐશ્વર્ય આદિ ગુણો પ્રકટ કરવાના વિચારથી અન્ય સર્વ મનુષ્યોની ઠેકડી ઉડાડ્યા કરે છે તેઓ ભવિષ્યમાં આવનારી આપત્તિઓને જોતા નથી. આશ્ર્ય છે કે જે પુત્ર અને પત્ની આદિ વિજળી સમાન ચંચળ (અસ્થિર) છે તેમને તે લોકો સ્થિર ભાને છે તથા પ્રત્યક્ષ પર (ભિન્ન) દેખાવા છતાં તેમને સ્વકીય સમજે છે આ મોહરૂપી રાજાનું વિષમ શાસન છે. ૧૨૧.

(શિખરણી)

ક યામઃ કિં કુર્મઃ કથમિહ સુખં કિં ચ ભવિતા
કુતો લભ્યા લક્ષ્મીઃ ક ઇહ નૃપતિઃ સેવ્યત ઇતિ ।
વિકલ્પાનાં જાલં જડયતિ મનઃ પશ્યત સતાં
અપિ જ્ઞાતાર્થનામિહ મહદહો મોહચરિતમ્ ॥૧૨૨॥

અનુવાદ : અમે ક્યાં જઈએ, શું કરીએ, અહીં સુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને શું થશે? લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? અના માટે ક્યા રાજાની સેવા કરવી? ઈત્યાદિ વિકલ્પોનો સમૂહ અહીં તત્ત્વજ્ઞ સજજન પુરુષોના મનને પણ જરૂર બનાવી દે છે, એ શોચનીય છે. આ બધી મોહની મહાલીલા છે. ૧૨૨.

(શિખરિણી)

વિહાય વ્યામોહં ધનસદનતન્વાદિવિષયે
કુરુધ્વં તત્ત્વી કિમપિ નિજકાર્ય એવત બુધાઃ ।

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૬૧

ન યેનેદં જન્મ પ્રભવતિ સુનૃત્વાદિઘટના
પુનઃ સ્યાત્ર સ્યાદ્વા કિમપરવચોડમ્બરશતૈઃ ॥૧૨૩॥

અનુવાદ :—હે વિદ્વદ્જનો! ધન, મહેલ અને શરીર આદિના વિષયમાં મમત્વબુદ્ધિ છોડીને શીଘ્રતાથી કંઈ પણ પોતાનું એવું કાર્ય કરો કે જેથી આ જન્મ ફરીથી પ્રાપ્ત ન કરવો પડે. બીજા સેંકડો વચ્ચેનોના બાબ્ય ડોળથી તમારું કંઈ પણ ઈષ્ટ સિદ્ધ થવાનું નથી. આ જે તમને ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ સ્વહિત સાધક સામગ્રી પ્રાપ્ત થઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે અથવા નહિ થાય એ કંઈ નક્કી નથી. અર્થાત્ તેનું ફરી પ્રાપ્ત થવું બહુ જ કઠણ છે. ૧૨૩.

(સ્નાધરા)

વાચસ્તસ્ય પ્રમાણં ય ઇહ જિનપતિઃ સર્વવિદીતરાગો
રાગદ્વેષાદિદોષૈરૂપહતમનસો નેતરસ્યાનૃતત્વાત् ।
એતન્નિશ્ચિત્ય ચિતે શ્રયત બત બુધા વિશ્વતત્ત્વોપલબ્ધૌ
મુક્તેર્મૂલં તમેકં ભ્રમત કિમુ બહુષન્ધવદુઃપથેષુ ॥૧૨૪॥

અનુવાદ : અહીં જે જિનેન્દ્રદેવ સર્વજ્ઞ થયા થકા રાગ-દ્વેષરહિત છે તેનું વચ્ચેન પ્રમાણ (સત્ય) છે. એનાથી વિપરીત જેનું અંતઃકરણ રાગ-દ્વેષાદિથી દુષ્પિત છે એવા અન્ય કોઈનું વચ્ચેન પ્રમાણ હોઈ શકતું નથી કારણ કે તે સત્યથી રહિત છે એવો મનમાં નિશ્ચય કરીને હે બુદ્ધિમાન્ સજજનો! જે સર્વજ્ઞ થઈ જવાથી મુક્તિનું મૂળ કારણ છે તે જ એક જિનેન્દ્રદેવનો તમે સમસ્ત તત્ત્વોના પરિજ્ઞાન માટે આશ્રય કરો, આંધળાની જેમ અનેક કુમાર્ગોમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી. ૧૨૪.

(વસંતતિલકા)

યઃ કલ્પયેત્ કિમપિ સર્વવિદોપિ વાચિ
સંદિગ્ય તત્ત્વમસમજ્જસમાત્મબુદ્ધ્યા ।
ખે પત્રિણાં વિચરતાં સુદૃશેક્ષિતાનાં
સંખ્યાં પ્રતિ ગ્રવિદ્ધાતિ સ વાદમન્થઃ ॥૧૨૫॥

અનુવાદ : જે સર્વજ્ઞના પણ વચ્ચેનમાં સંદેહ કરીને પોતાની બુદ્ધિથી તત્ત્વના વિષયમાં અન્યથા કંઈક કલ્પના કરે છે તે અજ્ઞાની પુરુષ નિર્મળ નેત્રોવાળા

પુરુષદ્વારા જોવામાં આવેલ આકાશમાં વિહરતા પક્ષીઓની સંખ્યાની બાબતમાં વિવાદ કરનાર આંધળા સમાન આચરણ કરે છે. ૧૨૫.

(ઇન્દ્રવજ્ઞા)

ઉત્ત જિનૈર્દ્વાદશભેદભઙ્ગ શ્રુતં, તતો બાહ્યમનત્તભેદમ् ।

તસ્મિન્ત્રુપાદેયતયા ચિદાત્મા, તતઃ પરં હેયતયાભ્યધાયિ ॥૧૨૬॥

અનુવાદ : જિનદેવે અંગશ્રુતના બાર તથા અંગ બાહ્યના અનંત ભેદ બતાવ્યા છે. આ બન્નેય પ્રકારના શ્રુતમાં ચેતન આત્માને ગ્રાહ્યરૂપે અને તેનાથી લિન્ન પર પદાર્થોને હેયરૂપે બતાવેલ છે.

વિશેષાર્થ : મતિજ્ઞાનના નિમિત્તે જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે આ શ્રુતના મૂળમાં બે ભેદ છે—અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. આમાં અંગપ્રવિષ્ટના નીચે પ્રમાણે બાર ભેદ છે—૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગ ૪. સમવાયાંગ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપિતાંગ ૬. શાતૃધર્મકથાંગ ૭. ઉપાસકાધ્યયનાંગ ૮. અંતકૃતદશાંગ ૯. અનુતરૌપ્યપાદિકદશાંગ ૧૦. પ્રશ્નવ્યાકરણાંગ ૧૧. વિપાકસૂત્રાંગ અને ૧૨. દેષ્ટિવાદાંગ આમાં દેષ્ટિવાદ પણ પાંચ પ્રકારના છે—૧. પરિકર્મ ૨. સૂત્ર ૩. પ્રથમાનુયોગ ૪. પૂર્વગત અને ૫. ચૂલ્લિકા. આમાં પૂર્વગતના પણ નીચે પ્રમાણે ચૌદ ભેદ છે—૧. ઉત્પાદ પૂર્વ ૨. અગ્રાયણીપૂર્વ ૩. વીર્યાનુપ્રવાદ ૪. અસ્તિત્વાસ્તિપ્રવાદ ૫. જ્ઞાનપ્રવાદ ૬. સત્યપ્રવાદ ૭. આત્મપ્રવાદ ૮. કર્મપ્રવાદ ૯. પ્રત્યાખ્યાનનામધેય ૧૦. વિદ્યાનુપ્રવાદ ૧૧. કલ્યાણનામધેય ૧૨. પ્રાણાવાય ૧૩. ક્રિયાવિશાળ અને ૧૪ લોકબિન્દુસાર. અંગબાહ્ય દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ ભેદથી અનેક પ્રકારના છે. ઇતાં પણ તેના મુખ્યપણે નીચેના ચૌદ ભેદ બતાવ્યા છે—૧. સામાયિક ૨. ચતુર્વિશતિસત્તવ ૩. વંદના ૪. પ્રતિકમણ ૫. વૈનયિક ૬. કૃતિકર્મ ૭. દશવૈકાલિક ૮. ઉત્તરાધ્યયન ૯. કલ્યાણકલ્ય ૧૦. કલ્યાણકલ્ય ૧૧. મહાકલ્ય ૧૨. પુંડરીક ૧૩. મહાપુંડરીક અને ૧૪. નિષિદ્ધિકા (વિશેષ જાણકારી માટે ષટ્ટંડાગમ-કૃતિઅનુયોગદ્વાર (પુ. ૬) પુ. ૧૮૭-૨૨૪ જુઓ). આ બધા જ શ્રુતમાં એક માત્ર આત્માને ઉપાદેય બતાવીને બીજા બધા પદાર્થોને હેય બતાવ્યા છે. શ્રુતના અભ્યાસનું પ્રયોજન પણ એ જ છે, અન્યથા અગિયાર અંગ નવ પૂર્વોનો અભ્યાસ કરીને પણ દ્રવ્યાલિંગી મુનિ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ૧૨૬.

(ઉપજાતિ)

અલ્પાયુષામલ્પધિયામિદારીં કુતઃ સમસ્તશ્રુતપાઠશક્તિઃ ।

તદત્ત્ર મુક્તિં પ્રતિ બીજમાત્રમભ્યસ્યતામાત્મહિતં પ્રયત્નાત્ ॥૧૨૭॥

અધિકાર-૧ : ધર્મોપદેશાભૂત]

૬૩

અનુવાદ : વર્તમાન કાળમાં મનુષ્યોનું આયુષ્ય અલ્ય અને બુદ્ધિ અતિશય મંદ થઈ ગઈ છે તેથી તેમનામાં ઉપર્યુક્ત સમસ્ત શ્રુતના પાઠની શક્તિ રહી નથી. આ કારણે તેમણે અહીં એટલા જ શ્રુતનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જે મોક્ષનું બીજાભૂત થઈને આત્માનું હિત કરનાર હોય. ૧૨૭.

(સ્નાધરા)

નિશ્ચેતબ્યો જિનેન્દ્રસ્તદતુલવચસાં ગોચરેર્થ પરોક્ષે
કાર્યઃ સોર્પિ પ્રમાણં વદત કિમપરેણાલકોલાહલેન ।
સત્યાં છિદ્રસ્થતાયામિહ સમયપથસ્વાનુભૂતિપ્રબુદ્ધા
ભો ભો ભવ્યા યતથ્બં દૃગવગમનિધાવાત્મનિ પ્રીતિભાજઃ ॥૧૨૮॥

અનુવાદ : હે ભવ્ય જીવો! આપે જિનેન્દ્રદેવના વિષયમાં નિશ્ચય કરવો જોઈએ અને તેમના અનુપમ વચ્ચેનોના વિષયભૂત પરોક્ષ પદાર્થના વિષયમાં તેને જ પ્રમાણ માનવા જોઈએ. બીજા વ્યર્થ કોલાહલથી શું પ્રયોજન સિદ્ધ થશે, એ આપ જ બતાવો. તેથી છિદ્રસ્થ (અલ્યજન) અવસ્થા વિદ્યમાન હોવા છતાં સિદ્ધાંતના માર્ગે પ્રાપ્ત થયેલ આત્માનુભવવડે પ્રબોધને પામીને આપ સમ્યાદર્શન અને સમ્યજ્ઞાનની નિધિસ્વરૂપ આત્માના વિષયમાં પ્રીતિયુક્ત થઈને પ્રયત્ન કરો-તેની જ આરાધના કરો.

વિશેખાર્થ : અલ્યજનાને કારણે આપણે જે પરોક્ષ પદાર્થોના વિષયમાં કાંઈ પણ નિશ્ચય કરી શકતા નથી તેમના વિષયમાં આપણે જિનેન્દ્રદેવને કે જે રાગ-દ્વેષ રહિત હોઈને સર્વજ્ઞ પણ છે, પ્રમાણ માનવા જોઈએ. જો કે વર્તમાનમાં તે અહીં વિદ્યમાન નથી તોપણ પરંપરાપ્રાપ્ત તેમના વચ્ચન (જિનાગમ) તો વિદ્યમાન છે જ. તેના દ્વારા પ્રબોધ પ્રાપ્ત કરીને ભવ્ય જીવ આત્મકલ્યાણ કરવામાં પ્રયત્નશીલ થઈ શકે છે. ૧૨૮.

(આર્યા)

તદ્વયાયત તાત્પર્યજ્યોતિઃ સચ્ચિન્મયં વિના યસ્માત્ ।
સદપિ ન સત્ત સત્તિ યસ્મિન્ નિશ્ચિતમાભાસતે વિશ્વમ् ॥૧૨૯॥

અનુવાદ : ચૈતન્યમય તે ઉત્કૃષ્ટ જ્યોતિનું તત્પરતાથી ધ્યાન કરો, જેના વિના વિદ્યમાન વિશ્વ પણ અવિદ્યમાન સમાન પ્રતિભાસે છે તથા જે ઉપસ્થિત હોતાં તે વિશ્વ નિશ્ચિતપણે યથાર્થસ્વરૂપે પ્રતિભાસે છે. ૧૨૯.

(શાર્ડૂલવિક્રીડિત)

अज्ञो यद्वकोटिभिः क्षपयति वं कर्म तस्माद्दु
स्वीकुर्वन् कृतसंवरः स्थिरमना ज्ञानी तु तत्तत्क्षणात् ।
तीक्षणक्लेशहयाश्रितो ऽपि हि पदं नेष्टं तपःस्यन्दनो
नेयं तत्रयति प्रभुं स्फुटतरज्ञानैकसूतोऽज्ञितः ॥૧૩૦॥

અનુવાદ : અજ્ઞાની જીવ પોતાના જે કર્મ કરોડો જન્મોમાં નષ્ટ કરે છે તથા તેનાથી અનેક ગણા ગ્રહણ કરે છે તેને જ્ઞાની જીવ સ્થિરચિત થઈને સંવરને પ્રાપ્ત થતા થકા તત્ક્ષણ અર્થાત् ક્ષણમાત્રમાં નષ્ટ કરી દે છે. તે યોગ્ય જ છે—તીક્ષણ કલેશરૂપી ઘોડાનો આશ્રય લેવા છતાં પણ તપરૂપી રથ જો અતિશય નિર્મળ જ્ઞાનરૂપી અદ્વિતીય સારથી વિનાનો હોય તો તે પોતાના લઈ જવા યોગ્ય પ્રભુ (આત્મા અને રાજા) ને ઈષ્ટ સ્થાને લઈ જઈ શકતો નથી.

વિશેષાર્થ : જેમ અનુભવી સારથી (ચલાવનાર) વિના શીંગળામી ઘોડા દ્વારા ખેંચાતો રથ પણ તેમાં બેઠેલા રાજા આદિને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચાડી શકતો નથી તેવી જ રીતે સમ્યજ્ઞાન વિના કરવામાં આવેલું તપ દુઃસહ કાયકલેશોથી સંયુક્ત હોવા છતાં પણ આત્માને મોક્ષપદમાં પહોંચાડી શકતું નથી. એ જ કારણે જે કર્મો અજ્ઞાની જીવ કરોડો ભવોમાં પણ નષ્ટ કરી શકતો નથી તેમનો સમ્યજ્ઞાની જીવ ક્ષણમાત્રમાં જ નાશ કરી નાખે છે. એનું કારણ એ છે કે અજ્ઞાની જીવને નિર્જરાની સાથે સાથ નવા કર્મોનો આસ્રવ પણ થયા કરે છે, તેથી તે કર્મરહિત થઈ શકતો નથી. પરંતુ અનાથી ઉલ્ટું જ્ઞાની જીવને જ્યાં નવા કર્મનો આસ્રવ અટકી જાય છે ત્યાં પૂર્વસંચિત કર્મની નિર્જરા પણ થાય છે. તેથી જ તે શીંગ કર્મોથી રહિત થઈ જાય છે. ૧૩૦.

(સ્નાયુ)

કર્માધ્યૌ તદ્વિચિત્રોદયલહરિભરવ્યાકુલે વ્યાપ્તદુગ્ર-
ભ્રામ્યન્નક્રાદિકીર્ણે મૃતિજનનલસદ્વાવાર્તાર્ગર્તે ।
મુક્તઃ શત્ક્ર્યા હતાઙ્ગઃ પ્રતિગતિ સ પુમાન્ મજ્જનોન્મજ્જનાભ્યા-
મગ્રાય જ્ઞાનપોતં તદનુગતજડઃ પારગામી કર્થ સ્યાત् ॥૧૩૧॥

અનુવાદ : જે કર્મરૂપી સમુદ્ર પોતાના વિવિધ પ્રકારના ઉદ્યરૂપી લહરીઓના ભારથી વ્યાપ્ત છે, આપત્તિઓ રૂપ આમ તેમ ઘૂમતા મહાન् મગર આદિ જળજંતુઓથી પરિપૂર્ણ છે, તથા મૃત્યુ અને જન્મરૂપી વડવાળિન અને વમળના ખાડારૂપ

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૬૫

છે; તેમાં પડેલો તે અજ્ઞાની મનુષ્ય-જેનું શરીર પ્રત્યેક ગતિમાં (ડગલે પગલે) વારંવાર દૂબવા અને ઉપર આવવાના કારણે પિડાઈ રહ્યું છે તથા જે (સમુદ્રને) ઓળંગવાની શક્તિરહિત છે-જ્ઞાનરૂપી જહાજને પ્રાપ્ત કર્યા વિના કેવી રીતે પારગામી થઈ શકે? અર્થાત્ જ્યાં સુધી તેને જ્ઞાનરૂપી જહાજ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે કર્મરૂપી સમુદ્રનો પાર કોઈ પણ રીતે પામી શકતો નથી. ૧૩૧.

(શાર્દૂલવિક્રીડિત)

શશ્ચન્મોહમહાન્ધકારકલિતે ત્રૈલોક્યસદ્ગમન્યસૌ
જૈની વાગમલપ્રદીપકલિકા ન સ્યાદ્યદિ ઘોતિકા ।
ભાવાનામુપલબ્ધિરેવ ન ભવેત્ સમ્યક્તદિષ્ટેતર-
પ્રાપ્તિત્યાગકૃતે પુનસ્તનુભૂતાં દૂરે મતિસ્તાદ્શી ॥૧૩૨॥

અનુવાદ : જે ત્રણે લોકરૂપ ભવન સર્વદા મોહરૂપ સધન અંધકારથી વ્યાપ થઈ રહ્યું છે તેને પ્રકાશિત કરનાર જો જિનવાણી રૂપી નિર્મણ દીપકની જ્યોત ન હોય તો પદાર્થોનું સારી રીતે જ્ઞાન જ થઈ શકતું નથી તો પણી એવી અવસ્થામાં ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિત્યાગ માટે પ્રાણીઓને તે પ્રકારની બુદ્ધિ કેવી રીતે થઈ શકે? થઈ શકે નહિ. ૧૩૨.

(મન્દાક્રાન્તા)

શાન્તે કર્મણુચિતસકલક્ષેત્રકાલાદિહેતૌ
લબ્ધવા સ્વાસ્થ્યં કથમપિ લસદ્યોગમુદ્રાવશેષમ् ।
આત્મા ધર્મો યદ્યમસુખસ્ફીતસંસારગર્તા-
દુદ્ધૃત્ય સ્વં સુખમયપદે ધારયત્યાત્મનૈવ ॥૧૩૩॥

અનુવાદ : કર્મના ઉપશાન્ત થવા સાથે યોગ્ય સમસ્ત ક્ષેત્ર-કાળાદિરૂપ સામગ્રી પ્રાપ્ત થઈ જતાં કેવળ ધ્યાનમુદ્રાથી સંયુક્ત સ્વાસ્થ્ય (આત્મસ્વરૂપસ્થતા) કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરીને આ આત્મા દુઃખોથી પરિપૂર્ણ સંસારરૂપ ખાડામાંથી પોતાને કાઢીને પોતાની જાતે જ સુખમય પદ અર્થાત્ મોક્ષમાં ધારણ કરે છે તેથી તે આત્મા જ ધર્મ કહેવાય છે.

વિશેષાર્થ : ‘ઇદ્યસ્થાને ધરતિ ઇતિ ધર્મः’ આ વ્યાખ્યા પ્રમાણે જે જીવને સંસારના

દુઃખમાંથી કાઢીને ઈષ પદ (મોક્ષ)માં પ્રાપ્ત કરાવે છે તેને ધર્મ કહેવામાં આવે છે. કર્મો ઉપશાન્ત થવાથી પ્રાપ્ત થયેલી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સામગ્રી દ્વારા અનંતચુષ્ટયરૂપ સ્વાસ્થ્યનો લાભ થાય છે. આ અવસ્થામાં એક માત્ર ધ્યાનમુદ્રા જ બાકી રહે છે. બાકીના બધા સંકલ્પ-વિકલ્પ ધૂટી જાય છે. હવે આત્મા પોતાને પોતા દ્વારા જ સંસારરૂપ ખાડામાંથી કાઢીને મોક્ષમાં પહોંચાડી દે છે. તેથી ઉપર્યુક્ત વ્યાખ્યા પ્રમાણે વાસ્તવમાં આત્માનું નામ જ ધર્મ છે—તે સિવાય બીજો કોઈ ધર્મ હોઈ શકે નહિ. ૧૩૩.

(શાર્દૂલવિક્રીડિત)

નો શૂન્યો ન જડો ન ભૂતજનિતો નો કર્તૃભાવં ગતો
નૈકો ન ક્ષણિકો ન વિશ્વવિતતો નિત્યો ન ચૈકાન્તતઃ ।
આત્મા કાયમિતશ્રિદેકનિલયઃ કર્તા ચ ભોક્તા સ્વયં
સંયુક્તઃ સ્થિરતાવિનાશજનનૈઃ પ્રત્યેકમેકક્ષણે ॥૧૩૪॥

અનુવાદ : આ આત્મા એકાન્તરૂપે ન તો શૂન્ય છે, ન જડ છે, ન પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન થયો છે, ન કર્તા છે, ન એક છે, ન ક્ષણિક છે, ન વિશ્વવ્યાપક છે અને ન નિત્ય પણ છે. પરંતુ ચૈતન્ય ગુણના આશ્રયભૂત તે આત્મા પ્રાપ્ત થયેલ શરીર પ્રમાણે થતો થકો સ્વયં જ કર્તા અને ભોક્તા પણ છે. તે આત્મા પ્રત્યેક ક્ષણે સ્થિરતા (ધૌત્ય), વિનાશ (વ્યય) અને જનન (ઉત્પાદ)થી યુક્ત રહે છે.

વિશેષાર્થ : બિન્ન બિન્ન મતવાદીઓ દ્વારા આત્માના સ્વરૂપની જે વિવિધ પ્રકારે કલ્પના કરવામાં આવી છે તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમ કે—શૂન્યૈકાન્તવાદી (માધ્યમિક) કેવળ આત્માને જ નહિ પણ સમસ્ત વિશ્વને ય શૂન્ય માને છે. તેમના મતનું નિરાકરણ કરવા માટે અહીં ‘એકાન્તતઃ નો શૂન્ય’ અર્થાત્ આત્મા સર્વથા શૂન્ય નથી, એમ કહેવામાં આવ્યું છે. વેશેષિક મુજિત અવસ્થામાં બુદ્ધિ આદિ નવ વિશેષ ગુણોનો ઉચ્છેદ માનીને તેને જડ જેવો માને છે. સંસાર અવસ્થામાં પણ તેઓ તેને સ્વયં ચેતન નથી માનતા પણ ચેતન શાનના સમવાયથી તેને ચેતન સ્વીકારે છે. જે ઔપચારિક છે. આવી અવસ્થામાં તે સ્વરૂપથી જડ જ કહેવાશે. તેમના આ અભિપ્રાયનું નિરાકરણ કરવા માટે અહીં ‘ન જડઃ’ અર્થાત્ તે જડ નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ચાર્વાક મતાનુયાદી આત્માને પૃથ્વી આદિ પાંચ ભૂતોથી ઉત્પન્ન થયેલો માને છે. તેમના અભિપ્રાય પ્રમાણે તેનું અસ્તિત્વ ગર્ભથી મરણ પર્યન્ત જ રહે છે.—ગર્ભના પહેલાં અને મરણ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. તેમના આ અભિપ્રાયને દોષવાળું બતાવીને અહીં ‘નભૂતજનિતઃ’ અર્થાત્ તે પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો નથી, એમ કહેવામાં આવ્યું છે. નેયાયિક આત્માને સર્વથા કર્તા માને છે. તેમના અભિપ્રાયનું લક્ષ્ય કરીને અહીં ‘નો કર્મભાવં ગતઃ અર્થાત્ તે

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૬૭

સર્વથા કર્તૃત્વ અવસ્થાને પ્રાપ્ત નથી, એમ કહેવામાં આવ્યું છે. પુરુષાદ્વેતવાદી કેવળ પરંબ્રહ્મનો જ સ્વીકાર કરીને તેના સિવાય સમસ્ત પદાર્થોનો નિષેધ કરે છે. લોકમાં જે વિવિધ પ્રકારના પદાર્થ જોવામાં આવે છે તેનું કારણ અવિદ્યાજ્ઞનિત સંસ્કાર છે. એમના ઉપર્યુક્ત મતનું નિરાકરણ કરતાં અહીં ‘નૈકેઃ’ અર્થાત् આત્મા એક જ નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. બૌધ્ધ (સૌત્રાન્તિક) તેને સર્વથા ક્ષણિક માને છે. તેમનો અભિપ્રાય સદોષ બતાવતાં અહીં ‘ન ક્ષણિકઃ’ અર્થાત् આત્મા સર્વથા ક્ષણમાં નાશ પામનાર નથી, એમ કહ્યું છે. વૈશેષિક આદિ આત્માને વિશ્વવ્યાપક માને છે. તેમના મતને દોષપૂર્ણ બતાવીને અહીં ‘ન વિશ્વવિતતઃ’ અર્થાત્ તે સમસ્ત લોકમાં વ્યાપ્ત નથી, એવો નિર્દેશ કર્યો છે. સાંખ્યમતાનુયાયી આત્માને સર્વથા નિત્ય સ્વીકારે છે. તેમના આ અભિમતને દૂધિત ઠરાવીને અહીં ‘ન નિત્યઃ’ અર્થાત્ તે સર્વથા નિત્ય નથી, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં ‘એકાન્તતઃ’ આ પદનો સંબંધ સર્વત્ર સમજવો જોઈએ. જેમ કે—‘એકાન્તતઃ નો શૂન્યઃ, એકાન્તતઃ ન : જડઃ’ ઈત્યાદિ. જૈનમતાનુસાર આત્માનું સ્વરૂપ કેવું છે, એનો નિર્દેશ કરતાં આગળ એમ બતાવ્યું છે કે નયવિવક્ષા પ્રમાણે તે આત્મા પ્રાપ્ત શરીરની બરાબર અને ચેતન છે. તે વ્યવહારથી સ્વયં કર્માનો કર્તા અને તેમના ફળનો ભોક્તા પણ છે. પ્રકૃતિ કર્તા અને પુરુષ ભોક્તા છે, આ સાંખ્ય સિદ્ધાંત અનુસાર કર્તા એક (પ્રકૃતિ) અને ફળનો ભોક્તા બીજો (પુરુષ) હોય; એમ સંભવતું નથી. જીવાદ છ દ્રવ્યોમાંથી પ્રત્યેક ક્ષણે ક્ષણે ઉત્પાદ, વ્યય અને ધૌયથી સંયુક્ત રહે છે. કોઈ પણ દ્રવ્ય સર્વથા ક્ષણિક અથવા નિત્ય નથી. ૧૩૪.

(શાર્દૂલવિક્રીડિત)

કાત્મા તિષ્ઠતિ કીદ્ધશઃ સ કલિતઃ કેનાત્ર યસ્યેદ્ધશી
ભ્રાન્તિસ્તત્ર વિકલ્પસંભૂતમના યઃ કોऽપિ સ જ્ઞાયતામ् ।
કિંચાન્યસ્ય કુતો મતિઃ પરમિયં ભ્રાન્તાશુભાત્કર્મણો
નિત્વા નાશમુપાયતસ્તદખિલં જાનાતિ જ્ઞાતા પ્રભુઃ ॥૧૩૫॥

અનુવાદ : આત્મા ક્યાં રહે છે, તે કેવો છે તથા અહીં કોણે તેને જાણ્યો છે; આ જાતની ભાન્તિ જેને થઈ રહી છે ત્યાં ઉપર્યુક્ત વિકલ્પોથી પરિપૂર્ણ ચિત્તવાળો જે કોઈ પણ છે તેણે આત્મા જ્ઞાનવો જોઈએ. કારણ કે આ પ્રકારની બુદ્ધિ અન્ય (જડ)ને થઈ શકતી નથી. વિશોષતા કેવળ એટલી છે કે આત્માને ઉત્પન્ન થયેલો ઉપર્યુક્ત વિચાર અશુભ કર્મના ઉદ્યથી ભાંતિયુક્ત છે. આ ભાન્તિનો પ્રયત્નપૂર્વક નાશ કરીને જ્ઞાતા સમસ્ત વિશ્વને જાણે છે.

વિશોષાર્થ : આત્મા અતીન્દ્રિય છે. તેથી તેને અલ્યજ્ઞાની આ ચર્મચક્ષુઓથી જોઈ શકતા નથી. અદેશ્ય હોવાથી જ અનેક પ્રાણીઓને ‘આત્મા ક્યાં રહે છે, કેવો છે અને કોના દ્વારા જોવામાં

આવ્યો છે' ઈત્યાદિ પ્રકારનો સંદેહ ઘણું કરીને આત્માના વિષયમાં થયા કરે છે આ સંદેહ દૂર કરતાં 'અહી એમ બતાવ્યું છે કે જે કોઈનેય ઉપર્યુક્ત સંદેહ થાય છે, વાસ્તવમાં તે જ આત્મા છે કારણ કે એવો વિકલ્પ શરીર આદિ જડ પદાર્થને થઈ શકતો નથી. તે તો 'અહમ् અહમ्' અર્થાત् હું જાણું છું, હું અમુક કાર્ય કરું છું; એ રીતે 'હું હું' એ ઉલ્લેખથી પ્રતીતિમાં આવતા ચેતન આત્માને જ થઈ શકે છે. એટલું અવશ્ય છે કે જ્યાં સુધી મિથ્યાત્વ આદિ અશુભ કર્માનો ઉદ્ય રહે છે ત્યાં સુધી જીવને ઉપર્યુક્ત ભાંતિ રહી શકે છે. ત્યાર પછી તે તપશ્ચરણાદિ દ્વારા જ્ઞાનાવરણાદિને નાચ કરીને પોતાના સ્વભાવાનુસાર અભિલ પદાર્થોનો જ્ઞાતા (સર્વજ્ઞ) બની જાય છે. ૧૩૫.

(શાર્દૂલવિક્રીડિત)

આત્મા મૂર્તિવિવર્જિતો ઽપિ વપુષિ સ્થિત્વાપિ દુર્લક્ષતાં
પ્રાપ્તો�પિ સ્ફુરતિ સ્ફુર્તં યદહમિત્યુલ્લેખતઃ સંતતમ् ।
તત્કિં મુદ્ઘ્યત શાસનાદપિ ગુરોર્ભાન્તિઃ સમુત્સૃજ્યતા-
મન્તઃ પશ્યત નિશ્ચલેન મનસા તં તન્મુખાક્ષત્રજ્ઞાઃ ॥૧૩૬॥

અનુવાદ : આત્મા મૂર્તિ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ) રહિત હોવા છતાં પણ શરીરમાં સ્થિતિ હોવા છતાં પણ તથા અદેશ્ય અવસ્થાને પ્રાપ્ત હોવા છતાં પણ નિરંતર 'અહમ्' અર્થાત् 'હું' આ ઉલ્લેખથી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે. એવી અવસ્થામાં હે ભવ્ય જીવો! તમે આત્મોનુભ ઈન્દ્રિય સમૂહથી સંયુક્ત થઈને કેમ મોહને પ્રાપ્ત થાવ છો? ગુરુની આજ્ઞાથી પણ ભ્રમ છોડો અને અભ્યંતરમાં નિશ્ચળ મનથી તે આત્માનું અવલોકન કરો. ૧૩૬.

(શાર્દૂલવિક્રીડિત)

વ્યાપી નैવ શરીર એવ યદસાવાત્મા સ્ફુરત્યન્વહં
ભૂતાનન્વયતો ન ભૂતજનિતો જ્ઞાની પ્રકૃત્યા યતઃ ।
નિત્યે વા ક્ષણિકે ઽથવા ન કથમપ્યર્થક્રિયા યુજ્યતે
તત્ત્રૈકત્વમપિ પ્રમાણદૃઢ્યા ભેદપ્રતીત્યાહતમ् ॥૧૩૭॥

અનુવાદ : આત્મા વ્યાપક નથી જ કારણ કે તે નિરંતર શરીરમાં જ પ્રતિભાસિત થાય છે. તે ભૂતોથી ઉત્પન્ન પણ નથી કેમકે તેની સાથે ભૂતોનો અન્વય જીવામાં આવતો નથી તથા તે સ્વભાવથી જ્ઞાતા પણ છે. તેને સર્વથા નિત્ય અથવા ક્ષણિક સ્વીકારવાથી તેમાં કોઈ પ્રકારે અર્થ કિયા બની શકતી નથી. તેમાં એકત્વ પણ

નથી કેમકે તે પ્રમાણથી દેખતાને પામેલી ભેદ પ્રતીતિ દ્વારા બાધિત છે.

વિશેષાધ્ય : જે વૈશેષિક આદિ આત્માને વ્યાપક માને છે તેમનું લક્ષ કરીને અહીં એમ કહેવામાં આવ્યું છે કે ‘આત્મા વ્યાપક નથી’ કેમકે તે શરીરમાં જ પ્રતિભાસિત થાય છે. જો આત્મા વ્યાપક હોય તો તેની પ્રતીતિ કેવળ શરીરમાં જ કેમ થાય? બીજે પણ થવી જોઈતી હતી. પરંતુ શરીર સિવાય બીજે ક્યાંય પણ તેની પ્રાપ્તિ થતી નથી. તેથી નિશ્ચિત છે કે આત્મા શરીર પ્રમાણ જ છે, નહિ કે સર્વવ્યાપક. ‘આત્મા પાંચ ભૂતોથી ઉત્પન્ન થયો છે’ આ ચાર્વાક મતને દૂધિત બતાવતાં અહીં એમ કહું છે કે આત્મા સ્વભાવથી જ જ્ઞાતા દેખા છે તેથી તે ભૂતજનિત નથી. જો એમ હોય તો આત્મામાં સ્વભાવથી ચૈતન્યગુણ પ્રાપ્ત થવો જોઈતો ન હતો. એનું પણ કારણ એ છે કે કાર્ય પ્રાય: પોતાના ઉપાદાન કારણ અનુસાર જ ઉત્પન્ન થાય છે, જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘડામાં માટીના જ ગુણ (મૂર્તિકપણું અને અચેતનપણું આદિ) પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થયો હોત તો તેમાં ભૂતના ગુણ અચેતનપણું આદિ જ પ્રાપ્ત થવા જોઈતા હતા, નહિ કે સ્વભાવિક ચેતનત્વ આદિ. પરંતુ તેમાં અચેતનપણાની વિરુદ્ધ ચેતનપણું જ પ્રાપ્ત થાય છે, માટે સિદ્ધ છે કે તે આત્મા પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન થયો નથી. આત્માને સર્વથા નિત્ય અથવા ક્ષણિક માનતાં તેમાં ઘટની જળધારણ આદિ અર્થક્રિયાની જેમ કંઈ પણ અર્થક્રિયા ન થઈ શકે. જેમ-જો આત્માને ફૂટસ્થ નિત્ય (ત્રણે કાળે એક જ સ્વરૂપે રહેનાર) સ્વીકારવામાં આવે તો તેમાં કોઈ પણ કિયા (પરિણામ કે પરિસ્પન્દનરૂપ) થઈ શકે નહિ. એવી અવસ્થામાં કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણનો અભાવ કેવી રીતે કહી શકશે? કારણ કે જ્યાં આત્મામાં કદી કોઈ પ્રકારનો વિકાર સંભવિત જ નથી ત્યાં તે આત્મા જેવો ભોગરૂપ કાર્ય કરતી વખતે હતો તેવો જ તે તેના પહેલાં પણ હતો. તો પછી શું કારણ છે કે પહેલાં પણ ભોગરૂપ કાર્ય ન હોય? કારણ હોવાથી તે હોવું જ જોઈતું હતું અને જો તે પહેલાં ન હોય તો પછી પાછળથી પણ ઉત્પન્ન ન થવું જોઈએ. કેમ કે ભોગરૂપ કિયાનો કર્તા આત્મા સદા એકરૂપ જ રહે છે. નહિ તો તેની ફૂટસ્થ નિત્યતાનો વિધાત અવશ્ય થાય. કારણ કે પહેલાં જે તેની અકર્તાપણારૂપ અવસ્થા હતી તેનો વિનાશ થઈને કર્તાપણારૂપ નવી અવસ્થાનો ઉત્પાદ થયો છે. આ જ ફૂટસ્થ નિત્યતાનો વિધાત છે. એ જ રીતે જો આત્માને સર્વથા ક્ષણિક જ માનવામાં આવે તો પણ કોઈ પ્રકારની અર્થક્રિયા થઈ શકશે નહિ કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, અને ઈચ્છા આદિનું રહેવું આવશ્યક હોય છે. તે આ ક્ષણિક એકાન્ત પક્ષમાં સંભવ નથી. એનું પણ કારણ એ છે કે જેણે પહેલાં કોઈ પદાર્થને પ્રત્યક્ષ કરી લીધો હોય તેને જ પાછળથી તેનું સ્મરણ થાય છે અને ત્યાર પછી જ તેના ઉક્ત અનુભૂત પદાર્થના સ્મરણપૂર્વક ફરીથી પ્રત્યક્ષ થતાં પ્રત્યભિજ્ઞાન પણ થાય છે. પરંતુ જો આત્મા સર્વથા ક્ષણિક જ હોય તો જે ચિત્કષણને પ્રત્યક્ષ થયું હતું તે તો તે જ કણે નાચ થઈ ગયું છે. એવી હાલતમાં તેના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સંભાવના કેવી રીતે કરી શકાય? તથા ઉક્ત સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરવું અસંભવ છે. આ રીતે ક્ષણિક

એકાન્ત પક્ષમાં બંધ મોક્ષાદિની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી આત્મા આદિને સર્વથા નિત્ય અથવા ક્ષણિક ન માનતાં કથંચિત્ (દ્વયદૃષ્ટિએ) નિત્ય અને કથંચિત્ (પર્યાયદૃષ્ટિએ) અનિત્ય સ્વીકારવા જોઈએ. જે પુરુષાદ્વૈતવાદી આત્માને પરબ્રહ્મસ્વરૂપમાં સર્વથા એક સ્વીકારીને વિભિન્ન આત્માઓ અને અન્ય સર્વ પદાર્થોનો નિષેધ કરે છે તેમના મતનું નિરાકરણ કરતાં અહીં એમ બતાવ્યું છે કે સર્વથા એકત્વની કલ્પના પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. જ્યાં વિવિધ પ્રાણીઓ અને ઘટ-પટાદિ પદાર્થોની જુદી જુદી સત્તા પ્રત્યક્ષ જ સ્પષ્ટપણે દેખવામાં આવે છે ત્યાં ઉપર્યુક્ત સર્વથા એકત્વની કલ્પના ભલા કેવી રીતે યોગ્ય કહી શકાય છે? કદાપિ નહિ. એ જ રીતે શબ્દાદ્વૈત, વિજ્ઞાનાદ્વૈત અને ચિત્રાદ્વૈત આદિની કલ્પના પણ પ્રત્યક્ષાદિથી બાધિત હોવાના કારણે ગ્રાય નથી; એવો નિશ્ચય કરવો જોઈએ. ૧૩૭.

(શાર્ડૂલવિક્રીડિત)

કુર્યાલ્કર્મ શુભાશુભં સ્વયમસો ભુડ્યક્તે સ્વયં તત્પલં
સાતાસાતગતાનુભૂતિકલનાદાત્મા ન ચાન્યાદશઃ ।
ચિદ્રૂપઃ સ્થિતિજન્મભઙ્ગકલિતઃ કર્માવૃત્તઃ સંસૃતૌ
મુક્તૌ જ્ઞાનદ્વારકમૂર્તિરમલસ્ત્રેલોક્યચૂડામણઃ ॥૧૩૮॥

અનુવાદ : તે આત્મા સ્વયં શુભ અને અશુભ કાર્ય કરે છે અને સ્વયં તેનું ફળ પણ ભોગવે છે, કારણ કે શુભાશુભ કર્મના ફળ સ્વરૂપ સુખદુઃખનો અનુભવ પણ તેને જ થાય છે. આનાથી બિન્ન આત્માનું બીજું સ્વરૂપ હોઈ જ શકે નહિ. સ્થિતિ (ધોય), જન્મ (ઉત્પાદ) અને ભંગ (વ્યય) સહિત જે ચેતન આત્મા સંસાર અવસ્થામાં કર્માના આવરણ સહિત હોય છે તે જ મુક્તિ અવસ્થામાં કર્મભળ રહિત થઈને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર સંયુક્ત થયો થકો ત્રણે લોકમાં ચૂડામણિ રત્ન સમાન શ્રેષ્ઠ થઈ જાય છે.

વિશોધાર્થ : સાંખ્ય પ્રકૃતિને કર્તા અને પુરુષને ભોક્તા માને છે. આ જ અભિપ્રાય લક્ષમાં રાખીને અહીં એમ બતાવ્યું છે કે જે આત્મા કર્માનો કર્તા છે તે જ તેમના ફળનો ભોક્તા પણ થાય છે. કર્તા એક અને ફળનો ભોક્તા અન્ય જ હોય, એ કલ્પના યુક્તિ સંગત નથી. એ સિવાય અહીં જે બે વાર ‘સ્વયમ્’ પદનો પ્રયોગ થયો છે તેથી એ પણ જણાય છે કે જેવી રીતે ઈશ્વર કર્તૃત્વ વાદીઓના મતમાં કર્માનું કરવું અને તેમના ફળનું ભોગવવું ઈશ્વર પ્રેરણાદી થાય છે તેવું જૈન સિદ્ધાંત અનુસાર સંભવિત નથી. જૈનમત પ્રમાણે આત્મા સ્વયં કર્તા અને પોતે જ તેમના ફળનો ભોક્તા પણ છે. તથા તે જ પુરુષાર્થ પ્રગટ કરીને કર્મભળ રહિત થયો થકો સ્વયં પરમાત્મા પણ બની જાય છે. અહીં સર્વથા નિત્યપણું અથવા

અનિત્યત્વની કદ્યનાને દોષ્યુક્ત પ્રગટ કરતાં એ પણ બતાવું છે કે આત્મા આદિ પ્રત્યેક પદાર્થ સદા ઉત્પાદ, વ્યય અને ગ્રૌવ્યથી સંયુક્ત રહે છે. જેમ માટીમાંથી ઉત્પન્ન થનાર ઘટમાં માટીરૂપ પૂર્વપર્યાયનો વ્યય, ઘટરૂપ નવીન પર્યાયનો ઉત્પાદ તથા પુદ્ગલ દ્વય ઉક્ત બન્નેય અવસ્થામાં ધ્રુવ સ્વરૂપે સ્થિત રહે છે. ૧૩૮.

(વસંતતિલકા)

આત્માનમેવમધિગમ્ય નયપ્રમાણ-
નિક્ષેપકાદિભિરભિશ્રયતૈકચિત્તાઃ ।
ભવ્યા યદીચ્છત ભવાર્ણવમુત્તરીતુ-
મુત્તુઙ્ગમોહમકરોગ્રતરં ગભીરમ् ॥૧૩૯॥

અનુવાદ : આ રીતે નય, પ્રમાણ અને નિક્ષેપ આદિ દ્વારા આત્માનું સ્વરૂપ જાણીને હે ભવ્ય જીવો! જો તમે ઉન્નત મોહરૂપી ભગરોથી અતિશય ભયાનક અને ગંભીર આ સંસારરૂપ સમુદ્રથી પાર થવાની ઈચ્છા રાખતા હો તો પછી એકાગ્રચિત થઈને ઉપર્યુક્ત આત્માનો આશ્રય કરો.

વિશેષાર્થ : જ્ઞાતાના અભિપ્રાયને નય કહે છે. તાત્પર્ય એ છે કે પ્રમાણ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ વસ્તુના એકદેશ (દ્વય અથવા પર્યાય આદિમાં) માં વસ્તુનો નિશ્ચય કરવો તેને નય કહેવામાં આવે છે. તે દ્વાર્થિક અને પર્યાર્થિક નયના ભેદથી બે પ્રકારના છે. જે દ્વયની મુખ્યતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે દ્વાર્થિક તથા જે પર્યાયની પ્રધાનતાથી વસ્તુને ગ્રહણ કરે છે તે પર્યાર્થિકનય કહેવાય છે. એમાં દ્વાર્થિક નયના ત્રણ ભેદ છે—નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. જે પર્યાયકલંકથી રહિત સત્તા આદિ સામાન્યની વિવક્ષાથી સર્વમાં અભેદ (એકત્વ)ને ગ્રહણ કરે છે તે તે શુદ્ધ દ્વાર્થિક સંગ્રહનય કહેવાય છે. એનાથી વિપરીત જે પર્યાયની પ્રધાનતાથી બે આદિ અનંત ભેદરૂપ વસ્તુને ગ્રહણ કરે છે તેને અશુદ્ધ દ્વાર્થિક વ્યવહારનય કહેવામાં આવે છે. જે સંગ્રહ અને વ્યવહાર આ બન્નેય નયોના પરસ્પર મિન્ન બન્ને (અભેદ અને ભેદ) વિષયોને ગ્રહણ કરે છે તેનું નામ નૈગમનય છે. પર્યાર્થિક નય ચાર પ્રકારનો છે—અજુસૂત્ર, શષ્ટ, સમભિરૂઢ અને એવંભૂત. એમાં જે ત્રણ કાળ વિષયક પર્યાયોને છોડીને કેવળ વર્તમાનકાળ વિષયક પર્યાયને ગ્રહણ કરે છે તે અજુસૂત્રનય છે. જે લિંગ, સંખ્યા (વચન), કાળ, કારક અને પુરુષ (ઉત્તમાદિ) આદિનો વ્યભિચાર દૂર કરીને વસ્તુનું ગ્રહણ કરે છે તેને શષ્ટનય કહે છે. લિંગવ્યભિચાર-જેમ શ્રીલિંગમાં પુલિંગનો પ્રયોગ કરવો. જેમકે તારાને માટે સ્વાતિ શષ્ટનો પ્રયોગ કરવો. ઈત્યાદિ વ્યભિચાર શષ્ટનયની દસ્તિએ અગ્રાહ નથી. જે એક જ અર્થ શષ્ટભેદથી અનેક રૂપે ગ્રહે છે તેને શષ્ટનય કહે છે. જેમ એક જ વ્યક્તિ ઈન્દ્રન (શાસન) કિયાના નિમિત્તે ઈન્દ્ર, શકન (સામર્થ્યરૂપ) કિયાથી

શક તથા પુરોના (નગરોના) વિદારણ કરવાથી પુરંદર કહેવાય છે. આ નયની દેસ્થિમાં પર્યાય શબ્દોનો પ્રયોગ અગ્રાહ્ય છે કેમકે એક અર્થનો બોધક એક જ શબ્દ હોય છે.—સમાનાર્થક અન્ય શબ્દ તેનો બોધ કરાવી શકતો નથી. પદાર્થ જે ક્ષણે જે ક્રિયામાં પરિણત હોય તેને જે તે જ ક્ષણે તે જ સ્વરૂપે ગ્રહે છે તેને એવંભૂતનય કહે છે. આ નયની અપેક્ષાએ ઈન્જ જ્યારે શાસનક્રિયામાં પરિણત હોય ત્યારે જ તે ઈન્જ શબ્દનું વાચ્ય થાય, નહિ કે અન્ય સમયમાં પણ. પ્રમાણ સમ્યજ્ઞાનને કહેવામાં આવે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારનું છે. જે શાન ઈન્જિય, મન, પ્રકાશ અને ઉપદેશાદિ બાધ્ય નિમિત્તની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે તે પરોક્ષ કહેવાય છે. તેના બે ભેદ છે—મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. જે શાન ઈન્જિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનથી જાણેલી વસ્તુના વિષયમાં જે વિશેષ વિચાર ઉત્પન્ન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. —અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. એમાં જે ઈન્જિય આદિની અપેક્ષા ન કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી (પુદ્ગલ અને તેનાથી સંબંધ સંસારી પ્રાણી) પદાર્થનું ગ્રહણ કરે છે તેને અવધિજ્ઞાન કહે છે. જે જીવોના મનોગત પદાર્થને જાણે છે તે મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. સમસ્ત વિશ્વને યુગપદ ગ્રહણ કરનાર જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. આ ત્રણેય જ્ઞાન અતીન્જિય છે. નિક્ષેપ શબ્દનો અર્થ મૂકુવું થાય છે. પ્રત્યેક શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયા કરે છે. તેમાંથી ક્યા વખતે ક્યો અર્થ ઈષ્ટ છે, એ બતાવવું તે નિક્ષેપ વિધિનું કાર્ય છે. તે નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારના છે. વસ્તુમાં વિવક્ષિત ગુણ અને ક્રિયા આદિ ન હોવા છતાં પણ કેવળ લોકવ્યવહાર માટે તેનું નામ રાખવાને નામનિક્ષેપ કહેવાય છે.—જેમ કોઈ વ્યક્તિનું નામ લોકવ્યવહાર માટે દેવદત્ત (દ્વારા ન અપાવા છતાં) રાખવું, કાષ્ટકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ અને પાસાઓના નિક્ષેપ આદિમાં ‘તે આ છે’ એ પ્રકારની જે કલ્પના કરવામાં આવે છે તેને સ્થાપના નિક્ષેપ કહે છે. તે બે પ્રકારનો છે—સદ્ધભાવ સ્થાપના નિક્ષેપ અને અસદ્ધભાવ સ્થાપના નિક્ષેપ. સ્થાપ્યમાન વસ્તુના આકારવાળી કોઈ અન્ય વસ્તુમાં જે તેની સ્થાપના કરવામાં આવે છે તેને સદ્ધભાવ સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે—જેમ ઋષભ જિનેન્દ્રના આકારમૂત્ત પાણાણમાં ઋષભ જિનેન્દ્રની સ્થાપના કરવી. જે વસ્તુ સ્થાપ્યમાન પદાર્થના આકારની નથી છતાં પણ તેમાં તે વસ્તુની કલ્પના કરવી તેને અસદ્ધભાવ સ્થાપના નિક્ષેપ કહેવાય છે,—જેમ શતરંજની ગોટીમાં હાથી, ઘોડા આદિની કલ્પના કરવી. ભવિષ્યમાં થનારી પર્યાયની મુખ્યતાથી વસ્તુનું કથન કરવું તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. વર્તમાન પર્યાયથી લક્ષિત વસ્તુના કથનને ભાવનિક્ષેપ કહેવામાં આવે છે. આ રીતે આ નિક્ષેપોના વિધાનથી અપ્રકૃતનું નિરાકરણ અને પ્રકૃતનું ગ્રહણ થાય છે. ૧૩૮.

(માલિની)

ભવરિપુરિહ તાવહુઃખદો યાવદાત્મન્
તવ વિનિહિતધામા કર્મસંશ્લેષદોષઃ ।

સ ભવતિ કિલ રાગદ્રેષહેતોસ્તદાદૌ
જાટિતિ શિવસુખાર્થી યત્તતસ્તૌ જહીહિ ॥૧૪૦॥

અનુવાદ : હે આત્મન્! અહીં સંસારદ્રુપ શત્રુ ત્યાં સુધી જ દુઃખ દઈ શકે છે જ્યાં સુધી તારામાં શાનદ્રુપ જ્યોતિને નષ્ટ કરનાર કર્મબંધદ્રુપ દોષે સ્થાન પ્રાપ્ત કરેલું છે. તે કર્મબંધદ્રુપ દોષ નિશ્ચયથી રાગ અને દ્રેષના નિમિત્તે થાય છે. તેથી મોક્ષસુખનો અભિલાષી થઈને તું સર્વપ્રથમ શીધતાથી પ્રયત્નપૂર્વક તે બન્નેને છોડી દે. ૧૪૦.

(સ્નાધરા)

લોકસ્ય ત્વं ન કશ્ચિત્ત સ તવ યદિહ સ્વાર્જિતં ભુજ્યતે ક:
સંબન્ધસ્તેન સાર્ધ તદસતિ સતિ વા તત્ત્વ કૌ રોષતોષૌ ।
કાયે ઽષ્યેવં જડત્વાત્તદનુગતસુખાદાવપિ ધ્વંસભાવા-
દેવંનિશ્ચિત્ય હંસ સ્વબલમનુસર સ્થાયિ મા પશ્ય પાર્શ્વમ् ॥૧૪૧॥

અનુવાદ : હે આત્મન્! ન તો તમે લોક (કુટુંબી જન આદિ)ના કોઈ છો અને ન તે પણ તમારું કોઈ હોઈ શકે. અહીં તમે જે કાંઈ કમાયા છો તે જ (તમારે) ભોગવવું પડે છે. તમારો તે લોક સાથે ભલા શું સંબંધ છે? અર્થાત્ કાંઈ પણ નથી. તો પછી લોક ન હોય તો વિષાદ અને તે હોય તો હર્ષ શા માટે કરો છો? એવી જ રીતે શરીરમાં રાગદ્રેષ ન કરવો જોઈએ, કેમ કે તે જડ (અયેતન) છે. તથા શરીર સાથે સંબંધવાળા ઈન્દ્રિયવિષય ભોગજનિત સુખાદિકમાં પણ તમારે રાગ-દ્રેષ કરવો ઉચ્ચિત નથી, કેમ કે તે વિનશ્ચર છે. આ રીતે નિશ્ચય કરીને તમે તમારી સ્થિર આત્મશક્તિનું અનુસરણ કરો. તે નિકટવર્તી લોકને સ્થાયી ન સમજો.

વિશેષાર્થ : કુટુંબ અને ધન-ધાન્યાદિ બાધ્ય સર્વ પદાર્થોનો આત્મા સાથે કાંઈ પણ સંબંધ નથી. તે પ્રત્યક્ષ જ પોતાનાથી જુદા દેખાય છે. તેથી તેમના સંયોગમાં હર્ષિત અને વિયોગમાં ઘેદળિન થવું યોગ્ય નથી. બીજું તો શું કહીએ? જે શરીર સદા આત્માની સાથે જ રહે છે તેનો પણ સંબંધ આત્મા સાથે કાંઈ પણ નથી; કારણ કે આત્મા ચેતન છે અને શરીર અયેતન છે. સ્પર્શનાદિ ઈન્દ્રિયોનો સંબંધ પણ તે જ શરીર સાથે છે, નહિ કે તે ચેતન આત્મા સાથે. ઈન્દ્રિયવિષયભોગોથી ઉત્પન્ન થનારું સુખ વિનશ્ચર છે-સ્થાયી નથી. તેથી હે આત્મન્! શરીર અને તેની સાથે સંબંધવાળા સુખ-દુઃખાદિમાં રાગ-દ્રેષ ન કરતાં પોતાના સ્થાયી આત્મદ્રુપનું અવલોકન કર. ૧૪૧.

(શાર્ડૂલવિક્રીડિત)

આસ્તામન્યગતો પ્રતિક્ષણલસહુઃખાશ્રિતાયામહો
 દેવત્વેઽપિ ન શાન્તિરસ્તિ ભવતો રમ્યે ઽણિમાદિશ્રિયા ।
 યત્તસ્માદપિ મૃત્યુકાલકલયાધસ્તાદ્વઠાત્યાત્યસે
 તત્તબ્રિત્યપદં પ્રતિ પ્રતિદિનં રે જીવ યત્નं કુરુ ॥૧૪૨॥

અનુવાદ : હે આત્મન્! ક્ષણે ક્ષણે થતાં દુઃખના સ્થાનભૂત અન્ય નરક, તિર્યચ
 અને મનુષ્યગતિ તો દૂર રહો; પરંતુ આશ્ર્ય તો એ છે કે અણિમા આદિરૂપ લક્ષ્મીથી
 રમણીય દેવગતિમાં પણ તને શાન્તિ નથી. કારણ કે ત્યાંથી પણ તું મૃત્યુકાળ દ્વારા
 બળજોરીથી નીચે પડાય છે. તેથી તું પ્રતિદિન તે નિત્યપદ અર્થાત્ અવિનશ્બર મોક્ષ
 પ્રત્યે પ્રયત્ન કર. ૧૪૨.

(શાર્ડૂલવિક્રીડિત)

યદ્ દૃષ્ટં બહિરङ્ગનાદિષુ ચિરં તત્ત્વાનુરાગો ઽભવત्
 ભ્રાન્ત્યા ભૂરિ તથાપિ તાય્યસિ તતો મુક્ત્વા તદ્દર્શિશ ।
 ચેતસ્તત્ર ગુરો: પ્રવોધવસતે: કિંચિત્તદાકર્ણ્યતે
 પ્રાપે યત્ત્ર સમસ્તદુઃખવિરમાલાભ્યેત નિત્યં સુખમ् ॥૧૪૩॥

અનુવાદ : હે ચિત્ત! તે બાધ્ય સ્ત્રી આદિ પદાર્થોમાં જે સુખ જોયું છે તેમાં તને
 ભાંતિથી ચિરકાળ સુધી અનુરાગ થયો છે. છતાં પણ તું તેનાથી અધિક સંતપ્ત થઈ રહ્યો
 છે. તેથી તને છોડીને પોતાના અંતરાત્મામાં પ્રવેશ કર. તેના વિષયમાં સમ્યજ્ઞાનના
 આધારભૂત ગુરુ પાસેથી એવું કાંઈક સાંભળવામાં આવે છે કે જે પ્રાપ્ત થતાં સમસ્ત
 દુઃખોથી છૂટકારો પામીને અવિનશ્બર (મોક્ષ) સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૧૪૩.

(પૃષ્ઠી)

કિમાલકોલાહલૈરમલબોધસંપત્રિધે:
 સમસ્તિ યદિ કૌતુકં કિલ તવાત્સનો દર્શને ।
 નિરુદ્ધસકલેન્દ્રિયો રહસિ મુત્કસંગ્રહઃ
 કિયન્ત્યપિ દિનાન્યતઃ સ્થિરમના ભવાન् પશ્યતુ ॥૧૪૪॥

અનુવાદ : હે જીવ! જો તને નિર્મળ જ્ઞાનરૂપ સંપત્તિના આશ્રયભૂત આત્માના

દર્શનનું કૌતૂહલ હોય તો નકામા કોલાહલ (બકવાદ)થી શું? પોતાની સમસ્ત ઈન્દ્રિયોનો નિરોધ કરીને તું પરિગ્રહ પિચાશને છોડી હો. એનાથી સ્થિરચિત્ત થઈને તું કેટલાક દિવસોમાં એકાન્તમાં તે અંતરાત્માનું અવલોકન કરી શકીશ. ૧૪૪.

(શાર્દૂલવિક્રીડિત)

હે ચેતઃ કિમુ જીવ તિષ્ઠસિ કથં ચિન્તાસ્થિતં સા કુતો
રાગદ્વેષવશાત્તયો: પરિચય: કસ્માચ્ચ જાતસ્તવ |
ઇષ્ટાનિષ્ટસમાગમાદિતિ યદિ શ્વર્ભં તદાવાં ગતૌ
નોચેનુચ્ચ સમસ્તમેતદવિરાદિષ્ટાદિસંકલ્પનમ् ॥૧૪૫॥

અનુવાદ : અહીં જીવ પોતાના ચિત્તને કેટલાક પ્રશ્ન કરે છે અને તે પ્રમાણે ચિત્ત તેમનો ઉત્તર આપે છે-હે ચિત્ત! એવું સંબોધન કરતાં ચિત્ત કહે છે કે હે જીવ શું છે? ત્યારે જીવ તેને પૂછે છે કે તું કેવી રીતે રહે છે? હું ચિન્તામાં સ્થિત રહું છું. તે ચિન્તા કોનાથી ઉત્પન્ન થઈ છે? તે રાગદ્વેષના વશે ઉત્પન્ન થઈ છે. તે રાગ-દ્વેષનો પરિચય તને ક્યા કારણો થયો? તેમની સાથે મારો પરિચય ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સમાગમથી થયો. અંતે જીવ કહે છે કે હે ચિત્ત! જો એમ હોય તો આપણે બન્નેય નરક પ્રાપ્ત કરીશું. તે જો તને ઈષ્ટ ન હોય તો આ સમસ્ત ઈષ્ટ-અનિષ્ટની કલ્પના શીધતાથી છોડી હો. ૧૪૫.

(શાર્દૂલવિક્રીડિત)

જ્ઞાનજ્યોતિરુદેતિ મોહતમસો ભેદ: સમુત્પદ્યતે
સાનન્દા કૃતકૃત્યતા ચ સહસા સ્વાન્તે સમુન્મીલતિ |
યસ્યૈકસ્મૃતિમાત્રતો ઽપિ ભગવાનત્રૈવ દેહાન્તરે
દેવસ્તિષ્ઠતિ મૃગ્યતાં સરભસાદન્યત્ર કિં ધાવત ॥૧૪૬॥

અનુવાદ : જે ભગવાન આત્માના કેવળ સ્મરણમાત્રથી પણ જ્ઞાનરૂપી તેજ પ્રગટ થાય છે, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ થાય છે તથા કૃતકૃત્યતા અક્ષમાત્ર જ આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે; તે ભગવાન આત્મા આ જ શરીરમાં બિરાજમાન છે. તેનું શીધ અન્વેષણ કરો. બીજી જગ્યાએ (બાધ્ય પદાર્થો તરફ) કેમ દોડી રહ્યા છો. ૧૪૬.

(શાર્દૂલવિક્રીડિત)

જીવાજીવવિचિત્રવસ્તુવિવિધાકાર્દ્રિસ્ફૂપાદયો
રાગદ્વેષકૃતો ઽત્ર મોહવશતો દૃષ્ટાઃ શ્રુતાઃ સેવિતાઃ ।
જાતાસ્તે દૃઢબન્ધનં ચિરમતો દુઃખં તવાત્મનિદં
નૂં જાનત એવ કિં બહિરસાવદ્યાપિ ધીર્ધાવતિ ॥૧૪૭॥

અનુવાદ : હે આત્મન! અહીં જે જીવ અને અજીવરૂપ વિચિત્ર વસ્તુઓ, અનેક પ્રકારના આકાર, ઋદ્રિઓ અને રૂપ આદિ રાગ-દ્વેષ ઉત્પન્ન કરનાર છે. તે તેમને મોહને વશ થઈને જોયા છે, સાંભળ્યા છે તથા તેમનું સેવન પણ કર્યું છે. તેથી તેઓ તારા માટે ચિરકાળથી દૃઢ બંધનરૂપ થયા છે કે જેથી તને દુઃખ ભોગવવું પડે છે. આ બધું જાણવા છતાં પણ તારી તે બુદ્ધિ આજે ય કેમ બાધ્ય પદાર્થો તરફ દોડી રહી છે? ૧૪૭.

(શાર્દૂલવિક્રીડિત)

ભિત્રોઽહં વપુષો બહિર્મલંકૃતાત્ત્રાનાવિકલ્પૌઘતઃ
શબ્દાદેશ ચિદેકમૂર્તિરમલઃ શાન્તઃ સદાનન્દભાક્ ।
ઇત્યાસ્થા સ્થિરચેતસો દૃઢતરં સામ્યાદનારમ્ભિણઃ
સંસારાદ્યમસ્તિ કિં યદિ તદધ્યન્યત્ર કઃ પ્રત્યય: ॥૧૪૮॥

અનુવાદ : હું બાધ્ય મળથી (૨૪-વીર્યથી) ઉત્પન્ન થયેલા આ શરીરથી, અનેક પ્રકારના વિકલ્પોના સમુદ્દ્રાયથી તથા શબ્દાદિકથી પણ ભિન્ન છું. સ્વભાવથી હું ચૈતન્યરૂપ, અદ્વિતીય શરીરથી સંપન્ન, કર્મમળ રહિત, શાન્ત અને સદા આનંદનો ઉપભોક્તા છું. આ પ્રકારના શ્રદ્ધાનથી જેનું ચિત્ત સ્થિરતા પામી ગયું છે તથા જે સમતાભાવ ધારણ કરીને આરંભરહિત થઈ ગયું છે તેને સંસારનો શો ભય છે? કાંઈ પણ નહિ. અને જો ઉપર્યુક્ત દૃઢ શ્રદ્ધાન હોવા છતાં પણ સંસારનો ભય છે તો પછી બીજે ક્યાં વિશ્વાસ કરી શકાય? ક્યાંય નહિ. ૧૪૮.

(શાર્દૂલવિક્રીડિત)

કિં લોકેન કિમાશ્રેણ કિમથ દ્વયેણ કાયેન કિં
કિં વાગ્ભિઃ કિમુતેન્દ્રિયૈઃ કિમસુભિઃ કિં તैર્વિકલ્પૈરપિ ।

સર્વે પુદ્લપર્યયા બત પરે તત્ત્વઃ પ્રમત્તો ભવન્ન-
નાત્મન્નેભિરભિશ્રયસ્યતિ તરામાલેન કિં બન્ધનમ્ ॥૧૪૯॥

અનુવાદ : હે આત્મન! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્ર્યનું શું પ્રયોજન છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે? ઈન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈપણ પ્રયોજન નથી કારણ કે તે બધી પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાણે વશ થઈને વર્થ જ આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે. ૧૪૮.

(અનુષ્ઠાન)

સતતાભ્યસ્તભોગાનામષ્યસત્સુખમાત્મજમ્ ।
અષ્યપૂર્વ સદિત્યારસ્થા ચિત્તે યસ્ય સ તત્ત્વવિત્ ॥૧૫૦॥

અનુવાદ : જે જીવોએ નિરંતર ભોગોનો અનુભવ કર્યો છે તેમનું તે ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ અવાસ્તવિક (કલ્પિત) છે પરંતુ આત્માથી ઉત્પન્ન સુખ અપૂર્વ અને સમીયીન છે; એવો જેના હંદ્યમાં દેછ વિશ્વાસ થઈ ગયો છે તે તત્ત્વજ્ઞ છે. ૧૫૦.

(પૃષ્ઠી)

પ્રતિક્ષણમયં જનો નિયતમુગ્રદુઃखાતુરઃ.
કૃધાદિભિરભિશ્રયસ્તદુપશાન્તયે ઽગ્રાદિકમ્ ।
તદેવ મનુતે સુખં ભ્રમવશાદ્યદેવાસુખં
સમુલ્લસતિ કચ્છુકારુજિ યથા શિખિસ્વેદનમ્ ॥૧૫૧॥

અનુવાદ : આ પ્રાણી સમયે સમયે કૃધા-તૃપા આદિ દ્વારા અત્યંત તીવ્ર દુઃખથી વ્યાકુળ થઈને તેમને શાન્ત કરવા માટે અન્ન અને પાણી આદિનો આશ્રય લે છે અને તેને જ ભ્રમ વશે સુખ માને છે. પરંતુ વાસ્તવમાં તે દુઃખ જ છે. આ સુખની કલ્પના આ જાતની છે જેમ કે ખુજલીના રોગમાં અર્જિના શેકથી થતું સુખ. ૧૫૧.

(શાર્ડૂલવિક્રીડિત)

આત્મા સ્વં પરમીક્ષતે યદિ સમં તેનૈવ સંચેષ્ટતે
તસ્માયેવ હિતસ્તો ઽપિ ચ સુખી તસ્યૈવ સંબન્ધભાક્ ।

તस્મિન્નેવ ગતો ભવત્યવિરતાનન્દામૃતાભોનિધિ:
કિંचાન્યત્સકલોપદેશનિવહસ્યૈતદ્રહસ્યં પરમ् ॥૧૫૨॥

અનુવાદ : જો આત્મા પોતાની જાતને ઉત્કૃષ્ટ દેખે, તેની સાથે કીડા કરે, તેના જ માટે હિતસ્વરૂપ રહે, તેનાથી જ તે સુખી થાય, તેનો જ સંબંધ તે પામે અને તેમાં જ તે સ્થિત થાય; તો તે આનંદરૂપ અમૃતનો સમુદ્ર બની જાય છે. અધિક શું કહેવુ? સમસ્ત ઉપદેશોનું કેવળ આ જ રહસ્ય છે.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે બાબ્ય સર્વ પદાર્થોથી મમતવખુદ્ધિ છોડીને એક માત્ર પોતાના આત્મામાં લીન થવાથી અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે અવસ્થામાં કર્તા કર્મ આદિ કારકોનો કાંઈ પણ ભેદ રહેતો નથી-તે જ આત્મા કર્તા અને તે જ કર્મ આદિ સ્વરૂપ હોય છે. એ જ કારણે ગ્રન્થકર્તાએ આ શ્લોકમાં ક્રમશઃ તેના માટે સાતે વિભક્તિઓ (આત્મા, સ્વમૂ, તેન, તસ્મૈ, તતઃ, તસ્ય, તસ્મિન્) ઉપયોગ કર્યો છે. ૧૫૨.

(આર્યા)

પરમાનન્દાબજરસં સકલવિકલ્પાન્યસુમનસસ્ત્યક્ત્વા ।
યોગી સ યરય ભજતે સ્તિમિતાન્તઃકરણષટ્ટચરણઃ ॥૧૫૩॥

અનુવાદ : જેનો શાન્ત અંતઃકરણરૂપી ભ્રમર સમસ્ત વિકલ્પોરૂપ અન્ય પુષ્પોને છોડીને કેવળ ઉત્કૃષ્ટ આનંદરૂપ ક્રમણના રસનું સેવન કરે છે તે યોગી કહેવાય છે. ૧૫૩.

(શાર્દૂલવિક્રીડિત)

જાયન્તે વિરસા રસા વિઘટતે ગોષ્ઠીકથાકૌતુકં
શીર્યન્તે વિષયાસ્તથા વિરમતિ પ્રીતિઃ શરીરેડપિ ચ ।
જોષં વાગપિ ધારયત્વવિરતાનન્દાત્મશુદ્ધાત્મનઃ:
ચિન્તાયામપિ યાતુમિચ્છતિ સમં દોષૈર્મનઃ: પદ્બતામ् ॥૧૫૪॥

અનુવાદ : નિત્ય આનંદસ્વરૂપ શુદ્ધ આત્માનો વિચાર કરતાં રસ નીરસ થઈ જાય છે, પરસ્પરના સંલાપરૂપ કથાનું કુતૂહલ નાટ થઈ જાય છે, વિષય નાટ થઈ જાય છે, શરીરના વિષયમાં પણ પ્રેમ રહેતો નથી, વચન પણ મૌન ધારણ કરી લે છે તથા મન દોષો સાથે મૃત્યુ પ્રાપ્ત કરવા ઈચ્છે છે . ૧૫૪.

(સ્થાધર)

આત્મૈકઃ સોપયોગો મમ કિમપિ તતો નાન્યદસ્તીતિ ચિન્તા-
ભ્યાસાસ્તાશેષવસ્તોઃ સ્થિતપરમસુદા યદ્રતિનો વિકલ્પે ।
ગ્રામે વા કાનને વા જનજનિતસુખે નિઃસુખે વા પ્રદેશે
સાક્ષાદારાધના સા શ્રુતવિશદમતેર્વાહ્યમન્યત્સમસ્તમ् ॥૧૫૫॥

અનુવાદ : ઉપયોગ (જ્ઞાન-દર્શન) યુક્ત એક આત્મા જ મારો છે, તેના સિવાય બીજું કંઈ પણ મારું નથી; આ જાતના વિચારના અભ્યાસથી સમસ્ત બાધ્ય પદાર્થો તરફથી જેનો મોહ હટી ગયો છે તથા જેની બુદ્ધિ આગમના અભ્યાસથી નિર્મળ થઈ ગઈ છે એવા સાધુ પુરુષના મનની પ્રવૃત્તિ વિકલ્પોમાં હોતી નથી. તે ગ્રામ અને વનમાં તથા પ્રાણી માટે સુખ ઉત્પન્ન કરનારા સ્થાનમાં અને તે સુખ રહિત સ્થાનમાં પણ સમભુદ્ધિ રહે છે અર્થાત् ગ્રામ અને સુખયુક્ત સ્થાનમાં તે ઉર્ધ્વિત થતો નથી તથા એનાથી વિપરીત વન અને દુઃખયુક્ત સ્થાનમાં તે ખેદ પણ પામતો નથી. આને જ સાક્ષાત્ આરાધના કહેવામાં આવે છે, બીજું બધું બાધ્ય છે. ૧૫૫.

(શાર્ડૂલવિક્રીડિત)

યદ્યન્તર્નિહિતાનિ ખાનિ તપસા બાહ્યેન કિં ફલુના
નૈવાન્તર્નિહિતાનિ ખાનિ તપસા બાહ્યેન કિં ફલુના ।
યદ્યન્તર્બહિરન્યવસ્તુ તપસા બાહ્યેન કિં ફલુના
નૈવાન્તર્બહિરન્યવસ્તુ તપસા બાહ્યેન કિં ફલુના ॥૧૫૬॥

અનુવાદ : જો ઈન્દ્રિયો અંતરાત્માની સન્મુખ હોય તો પછી વ્યર્થના બાધ્ય તપથી કંઈ પ્રયોજન નથી અને જો તે ઈન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો પણ બાધ્ય તપ કરવું વ્યર્થ જ છે—તેનાથી કંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો અંતરંગ અને બાધ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાધ્યમાં તપથી શું પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું જો અંતરંગ અને બાધ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાધ્ય તપથી શું પ્રયોજન? અર્થાત् કંઈ પણ નથી.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જો ઈન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મસન્મુખ હોય તો ઈદ્ધ

૮૦]

[ભગવાનશ્રીકુંદુકુંદ

પ્રયોજન એટલા માત્રથી જ સિદ્ધ થઈ જાય છે, પછી તેને માટે બાધ્ય તપશ્ચરણની કાંઈ પણ આવશ્યકતા નથી રહેતી. પરંતુ ઉક્ત ઈન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મોનુભ ન હોતાં જો બાધ્ય પદાર્થો તરફ જઈ રહી હોય તો બાધ્ય તપ કરવા છતાં પણ યથાર્થ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી આ અવસ્થામાં પણ બાધ્ય તપ વ્યર્થ જ ઠરે છે. એ જ રીતે જો અંતરંગમાં અને બાધ્યમાં પર વસ્તુ પ્રત્યે અનુરાગ રહ્યો ન હોય તો બાધ્ય તપનું પ્રયોજન આ સમતાભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે, તેથી તેની આવશ્યકતા રહેતી નથી. અને જો અંતરંગ અને બાધ્યમાં પરપદાર્થો પ્રત્યેનો અનુરાગ હટયો ન હોય તો ચિત્ત રાગ-દ્વેષથી દૂષિત કહેવાને કારણો બાધ્ય તપનું આચરણ કરવા છતાં પણ તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. તેથી આ અવસ્થામાં પણ બાધ્ય તપની આવશ્યકતા રહેતી નથી. તાત્પર્ય એ છે કે બાધ્ય તપશ્ચરણ પહેલાં ઈન્દ્રિયદમન, રાગ-દ્વેષનું શમન અને મન, વચન તથા કાયાની સરળ પ્રવૃત્તિ થવી અત્યાવશ્યક છે. એ થતાં જ તે બાધ્ય તપશ્ચરણ સાર્થક થઈ શકશે, અન્યથા તેની નિરર્થકતા અનિવાર્ય છે. ૧૫૬.

(શાર્ડૂલવિક્રીડિત)

શુદ્ધं વાગતિર્તિતત્ત્વમિતરદ્વાચ्यं ચ તત્ત્વાચકं
શુદ્ધાદેશ ઇતિ પ્રભેદજનકં શુદ્ધેતરત્કફ્લિતમ् ।
તત્ત્વાદ્યં શ્રવણીયમેવ સુદૃશા શેષદ્વ્યોપાયતः
સાપેક્ષા નયસંહતિઃ ફલવતી સંજાયતે નાન્યથા ॥૧૫૭॥

અનુવાદ : શુદ્ધ તત્ત્વ વચન અગોચર છે, અનાથી વિપરીત અશુદ્ધ તત્ત્વ વચન ગોચર છે અર્થાત્ શબ્દ દ્વારા કહી શકાય છે. શુદ્ધ તત્ત્વને જે ગ્રહણ કરે છે તે શુદ્ધાદેશ કહેવાય છે અને જે ભેદને પ્રગટ કરે છે તે શુદ્ધથી ઈતર અર્થાત્ અશુદ્ધનાં કલ્પિત કરાયો છે. સમ્યગદાટિએ શેષ બે ઉપાયોમાંથી પ્રથમ શુદ્ધ તત્ત્વનો આશ્રય લેવો જોઈએ. બરાબર છે-નયોનો સમુદ્દ્રાય પરસ્પર સાપેક્ષ હોવાથી જ પ્રયોજનભૂત થાય છે. પરસ્પરની અપેક્ષા ન કરવાથી તે નિષ્ફળ જ રહે છે. ૧૫૭.

(શાર્ડૂલવિક્રીડિત)

જ્ઞાનं દર્શનમબ્યશેષવિષયં જીવસ્ય નાર્થાન્તરં
શુદ્ધાદેશવિવક્ષયા સ હિ તત્ત્વશ્રીદ્વ્ય ઇચ્છુચ્યતે ।
પયાયૈશ્ચ ગુણૈશ્ચ સાધુ વિદિતે તસ્મિન્ ગિરા સદ્ગુરો-
જ્ઞાતં કિં ન વિલોકિતં ન કિમથ પ્રાપ્તં ન કિં યોગિભિ: ॥૧૫૮॥

અનુવાદ : શુદ્ધનયની અપેક્ષાએ સમસ્ત પદાર્�ોનો વિષય કરનાર જ્ઞાન અને દર્શન જ જીવનું સ્વરૂપ છે જે તે જીવથી પૃથ્વી નથી. આથી ભિન્ન બીજું કોઈ જીવનું સ્વરૂપ હોઈ શકતું નથી. માટે તે ‘ચિદ્રૂપ’ અર્થાત્ ચેતનસ્વરૂપ એમ કહેવાય છે. ઉત્તમ ગુરુના ઉપદેશથી પોતાના ગુણો અને પર્યાયો સાથે તે જ્ઞાન-દર્શન સ્વરૂપ જીવને સારી રીતે જાણી લેતાં યોગીઓએ શું નથી જાણ્યું, શું નથી દેખ્યું અને શું નથી પ્રાપ્ત કર્યું? અર્થાત્ ઉપર્યુક્ત જીવનું સ્વરૂપ જાણી લેતાં બીજું બધું જ જાણી લીધું, જોઈ લીધું અને પ્રાપ્ત કરી લીધું છે એમ સમજવું જોઈએ. ૧૫૮.

(શાર્દૂલવિક્રીડિત)

યત્તાત્ત્તરન બહિ: સ્થિતં ન ચ દિશિ સ્થૂલં ન સૂક્ષ્મં પુમાન્
નૈવ સ્ત્રી ન નપુંસકં ન ગુરુતાં પ્રાસં ન યલ્લાઘવમ् ।
કર્મસ્પર્શશરીરગન્ધગણનાબ્યાહારવર્ણોજ્ઞિતં
સ્વચ્છં જ્ઞાનદ્વારેકમૂર્તિ તદહં જ્યોતિઃ પરં નાપરમ् ॥૧૫૯॥

અનુવાદ : હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું જે ન અંદર સ્થિત છે, ન બહાર સ્થિત છે, ન દિશામાં સ્થિત છે, ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, ન પુરુષ છે, ન સ્ત્રી છે, ન નપુંસક છે, ન ગુરુ છે, ન લધુ છે; તથા જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણાના, શબ્દ અને વર્ણ રહિત થઈને નિર્મળ અને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર ધારણ કરે છે. એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી. ૧૫૯.

(શાર્દૂલવિક્રીડિત)

જાનન્તિ સ્વયમેવ યદ્વિમનસશ્રીદૂપમાનન્દવત्
પ્રોચ્છિન્ને યદનાદ્યમન્દમસકૃન્મોહાન્ધકારે હઠત् ।
સૂર્યાચન્દ્રમસાવતીત્ય યદહો વિશ્વપ્રકાશાત્મકં
તઝીયાત્મહં સુનિષ્કલમહં શબ્દાભિધેયં મહઃ ॥૧૬૦॥

અનુવાદ : જેને અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નાચ થઈ જવાથી મનરહિત થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે, જે ચેતનસ્વરૂપ છે, આનંદ-સંયુક્ત છે, અનાદિ છે, તીવ્ર છે, નિરંતર રહેનાર છે અને જે આશ્ર્યની વાત છે કે સૂર્ય તથા ચન્દ્રમાને પણ તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે; તે ‘અહમ્’

શબ્દથી કહેવાતું શરીર રહિત સ્વાભાવિક તેજ જ્યવંત હો. ૧૬૦.

(વસંતિલકા)

યજાયતે કિમપિ કર્મવશાદસાતં
સાતં ચ યત્તદનુયાયિ વિકલ્પજાલમ् ।
જાતં મનાગપિ ન યત્ર પદં તદેવ
દેવેન્દ્રવન્દિતમહં શરણં ગતો ઽસ્મિ ॥૧૬૧॥

અનુવાદ : કર્મના ઉદ્યથી જે કંઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું અનુસરણ કરનાર જે વિકલ્પ સમૂહ પણ થાય છે તે જે પદમાં જરાય રહેતો નથી, હું દેવેન્દ્રથી વંદિત તે જ (મોક્ષ) પદના શરણે જાઉં છું. ૧૬૧.

(શાર્ડૂલવિક્રીડિત)

ધિકાન્તાસ્તનમણલં ધિગમલપ્રાલેયરોચિઃ કરાન્
ધિક્રપૂરવિમિશ્રચન્દનરસં ધિક્ર તાજ્જલાદીનપિ ।
યત્રાપ્તં ન કદાચિદત્ર તદિદં સંસારસંતાપહત્ત
લગં ચેદતિશીતલં ગુરુવચોદિવ્યામૃતં મે હૃદિ ॥૧૬૨॥

અનુવાદ : જે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું સંસારનો સંતાપ નાથ કરનાર અત્યંત શીતળ ગુરુના ઉપદેશરૂપ દિવ્ય અમૃત જો મારા હદ્યમાં સંલગ્ન છે તો પછી પતીના સ્તનમંડળને ધિક્કાર છે, નિર્મળ ચંદ્રમાના કિરણોને ધિક્કાર છે, કપૂર મિશ્રિત ચંદનરસને ધિક્કાર છે તથા અન્ય જળ આદિ શીતળ વસ્તુઓને પણ ધિક્કાર છે.

વિશેષાર્થ : શ્રીનું સ્તનમંડળ, ચંદ્રકિરણ, કપૂર સાથે મળેલો ચંદનરસ, અને બીજા પણ જે જળ આદિ શીતળ પદાર્થો લોકમાં દેખવામાં આવે છે તે બધા પ્રાણીના બાધ્ય શારીરિક સંતાપને જ થોડા સમય માટે દૂર કરી શકે છે, નહિ કે અભ્યંતર સંસાર સંતાપને. તે સંસાર સંતાપને જો કોઈ દૂર કરી શકે તો તે સદ્ગુરુના વચન જ દૂર કરી શકે છે. અમૃત સમાન અતિશય શીતળતા ઉત્પન્ન કરનાર જો તે ગુરુનો દિવ્ય ઉપદેશ પ્રાણીને પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી લોકમાં શીતળ ગણાતા તે સ્ત્રીનાં સ્તનમંડળ આદિને ધિક્કાર છે, કારણ કે આ બધા પદાર્થ તે સંતાપ નાથ કરવામાં સર્વથા અસર્મથ છે. ૧૬૨.

(મન્દક્રાન્તા)

જિત્વા મોહમહાભટં ભવપથે દત્તોગ્રદુઃખશ્રમે
વિશ્રાન્તા વિજનેષુ યોગિપથિકા દીર્ઘે ચરન્તઃ ક્રમાત् ।
પ્રાપ્તા જ્ઞાન ધનાશ્ચિરાદભિમતસ્વાત્મોપલમ્ભાલયં
નિત્યાનન્દકલત્રસંગસુખિનો યે તત્ત્વ તેભ્યો નમઃ ॥૧૬૩॥

અનુવાદ : અત્યંત તીવ્ર દુઃખ અને પરિશ્રમ ઉત્પન્ન કરનાર લાંબા સંસારના માર્ગમાં કુમશઃ ગમન કરનાર જે યોગીરૂપ પથિક મોહરૂપી મહાન યોગ્યાને જીતીને એકાન્ત સ્થાનમાં વિશ્રામ પામે છે. ત્યાર પછી જે જ્ઞાનરૂપી ધનથી સંપન્ન થયા થકા સ્વાત્મોપલબ્ધિના સ્થાનભૂત પોતાના ઈષ સ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થઈને ત્યાં અવિનશ્બર-સુખ (મુક્તિ) રૂપી સ્ત્રીનાં સંગથી સુખી થઈ જાય છે તેમને નમસ્કાર હો. ૧૬૩.

(સ્ત્રાધરા)

ઇત્યાદિર્ધ્મ એષ: ક્ષિતિપસુરસુખાનર્ધમાણિક્યકોશ:
પાથો દુઃખાનલાનાં પરમપદલસત્સૌધસોપાનરાજિઃ ।
એતન્માહાત્મ્યમીશઃ કથયતિ જગતાં કેવળી સાધ્વીતા
સર્વસ્મિન્ વાઙ્મયે ઽથ સ્મરતિ પરમહો માદ્દશસ્તસ્ય નામ ॥૧૬૪॥

અનુવાદ : ઈત્યાદિ (ઉપર્યુક્ત) આ ધર્મ, રાજી અને દેવોના સુખરૂપ અમૂલ્ય રત્નોનો ખજાનો છે, દુઃખરૂપ અભિનને શાંત કરવા માટે જીણ સમાન છે તથા ઉત્તમ પદ અર્થાત્ મોક્ષરૂપ મહેલની સીરીઓની પંક્તિ સમાન છે. તેના મહિમાનું વર્ણન તે કેવળી જ કરી શકે છે જે ત્રણે લોકના અધિપતિ હોવાથી સમસ્ત આગમમાં નિષ્ણાત છે. મારા જેવો અલ્પજ્ઞ મનુષ્ય તો કેવળ તેનું નામસ્મરણ કરે છે. ૧૬૪.

(શાર્દૂલવિક્રીડિત)

શાશ્વત્ત્રન્મજરાન્તકાલવિલસદ્દુઃખૌધસારીભવત्-
સંસારોગ્રમહારૂજોપહત્યે ઽનત્તપ્રમોદાય ચ ।
એતદ્વર્મરસાયનં નનુ બુધાઃ કર્તું મતિશ્રેત્તદા
મિથ્યાત્વાવિરતિપ્રમાદનિકરક્રોધાદિ સંત્યજ્યતામ् ॥૧૬૫॥

અનુવાદ : હે વિદ્વાનો! નિરંતર જન્મ, જરા અને ભરણરૂપ દુઃખોના સમૂહમાં સારભૂત એવા સંસારરૂપ તીવ્ર મહારોગને દૂર કરીને અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જો આપની આ ધર્મરૂપી રસાયણ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાણના સમૂહનો તથા કોધાદિ કષાયોનો પરિત્યાગ કરો. ૧૬૫.

(શાર્દૂલવિક્રીડિત)

નષ્ટं રત્નમિવામ્બુધૌ નિધિરિવ પ્રભ્રષ્ટદૃષ્ટેર્યથા
યોગો યૂપશલાકયોશ્ ગતયો: પૂર્વાપરૌ તોયધી ।
સંસારે ઽત્ર તથા નરત્વમસકૃદુઃખપ્રદે દુર્લભં
લદ્યે તત્ત્ર ચ જન્મ નિર્મલકુલે તત્ત્રાપિ ધર્મે મતિ: ॥૧૬૬॥

અનુવાદ : જેમ સમુદ્રમાં વિલીન થયેલા રત્નનું ફરીથી પ્રાપ્ત થવું દુર્લભ છે. આંધળાને નિધિ મળવાનું દુર્લભ છે તથા જુદી જુદી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત થયેલ યૂપ (યજ્ઞમાં પશુને બાંધવાનું લાકું) અને શલાકા (યજ્ઞમાં ખોડવામાં આવેલી ખીલી) નો ફરી સંયોગ થવો દુર્લભ છે; તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત્ આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ પણ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ ધર્મમાં બુદ્ધિ લાગવી, એ ઘણું જ દુર્લભ છે. ૧૬૬.

(શાર્દૂલવિક્રીડિત)

ન્યાયાદન્ધકવર્તકીયકજનાખ્યાનસ્ય સંસારિણાં
પ્રાપ્તં વા બહુકલ્પકોટિભિરિદં કૃચ્છાન્નરત્વં યદિ ।
મિથ્યાદેવગુરુસપ્દેશવિષયવ્યામોહનીચાન્વય-
પ્રાયૈ: પ્રાણભૂતાં તદેવ સહસા વैફલ્યમાગચ્છતિ ॥૧૬૭॥

અનુવાદ : સંસારી પ્રાણીઓને આ મનુષ્ય પર્યાય ‘અન્ધકવર્તકીયક’ રૂપ જન આખ્યાનના ન્યાયે કરોડો કલ્ય કાળોમાં મહા કષે પ્રાપ્ત થઈ છે, અર્થાત્ જેવી રીતે આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્યકાળમાં કોઈ પ્રકારે

પ્રાપ્ત પણ થઈ ગઈ તો તે ભિથ્યા દેવ અને ભિથ્યા ગુરુના ઉપદેશ, વિષય અનુરાગ અને નીચ કુળમાં ઉત્પત્તિ આદિ દ્વારા સહસ્રા નિષ્ઠળ જાય છે. ૧૬૭.

(વસંતતિલકા)

લબ્ધે કર્થ કથમપીહ મનુષ્યજન્મ-
ન્યઙ્ગ પ્રસંગવશતો હિ કુરુ સ્વકાર્યમુ ।
પ્રાપ્ત તુ કામપિ ગતિકુમતે તિરશ્ચાં
કર્સ્ત્વાં ભવિષ્યતિ વિબોધયિતું સમર્થઃ ॥૧૬૮॥

અનુવાદ : હે દુર્બુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પાખીને પોતાનું કાર્ય (આત્મહિત) કરી લે. નહિ તો જો તું મરીને કોઈ તિર્યંચ પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. ૧૬૮.

(શાર્દૂલવિક્રીડિત)

જન્મ ગ્રાસ્ય નરેષુ નિર્મલકુલે કલેશાન્મતે: પાટવં
ભવિતિં જૈનમતે કર્થ કથમપિ પ્રાગર્જિતશ્રેયસઃ ।
સંસારાર્ણવતારકં સુખકરં ધર્મ ન યે કુર્વતે
હસ્તપ્રાપ્તમનર્થરત્નમપિ તે મુજ્ચન્તિ દુર્બુદ્ધ્યઃ ॥૧૬૯॥

અનુવાદ : જે મનુષ્યો મનુષ્ય પર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક બુદ્ધિયાતુર્યને પાખ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદ્યથી કોઈપણ પ્રકારે જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રનો પાર કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતા નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૧૬૯.

(શાર્દૂલવિક્રીડિત)

તિષ્ઠત્વા યુરતીવ દીર્ઘમખિલાન્યઙ્ગાનિ દૂરં દૃગ-
ન્યેષા શ્રીરપિ મે વશં ગતવતી કિં વ્યાકુલત્વં મુધા ।
આયત્વાં નિરવગ્રહો ગતવયા ધર્મ કરિષ્યે ભરા-
દિત્યેવં બત ચિન્તયન્નપિ જડો યાત્યન્તકગ્રાસતામ્ ॥૧૭૦॥

અનુવાદ : મારું આયુષ્ય ધણું લાંબુ છે, હાથ પગ વગેરે બધા અવયવો ખૂબ મજબૂત છે, આ લક્ષ્મી પણ મારા વશમાં છે તો પછી હું નકામો વ્યાકુળ શા માટે થાઉં? ઉત્તર કાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિંત થઈને ખૂબ ધર્મ કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો કોળિયો બની જાય છે. ૧૭૦

(આર્યા)

**પલિતૈકદર્શનાદપિ સરતિ સતશ્ચિત્તમાશુ વૈરાગ્યમ् ।
પ્રતિદિનમિતરસ્ય પુનઃ સહ જરયા વર્ધતે તૃષ્ણા ॥૧૭૧॥**

અનુવાદ : સાધુ પુરુષનું ચિત્ત એક પાકો (શેત) વાળ દેખવાથી જ શીଘ્ર વૈરાગ્ય પામી જાય છે. પરંતુ એનાથી વિપરીત અવિવેકી મનુષ્યની તૃષ્ણા પ્રતિદિન વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત् જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૧૭૧.

(મન્દાક્રાન્તા)

આજાતેર્નસ્ત્વમસિ દયિતા નિત્યમાસન્નગાસિ
પ્રૌઢાસ્યાશો કિમથ બહુના સ્ત્રીત્વમાલમ્બિતાસિ ।
અસ્મત્કેશગ્રહણમકરોદગ્રતસ્તે જેર્યં.
મર્ષસ્યેતન્મમ ચ હતકે સ્નેહલાઘાપિ ચિત્રમ् ॥૧૭૨॥

અનુવાદ : હે તૃષ્ણા! તું અમને જન્મથી માંડીને જ પ્રિય છો, સદા પાસે રહેનારી છો, અને વૃદ્ધિ પામેલી છો. ધણું શું કહીએ? તું અમારી પત્નીની અવસ્થાને પામી છો. આ જરા (ધડપણ) રૂપ બીજી સ્ત્રી તારી સામે જ અમારા વાળ પકડી ચૂકી છે. હે ધાતક તૃષ્ણા! તું મારા આ વાળ ગ્રહણરૂપ અપમાનને સહન કરતી થકી આજે પણ સ્નેહ રાખનાર બની રહો છો એ આશ્ર્યની વાત છે.

વિશેષાર્થ : લોકમાં જોવામાં આવે છે કે જો કોઈ પુરુષ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ કરે છે તો ચિરકાળથી પ્રેમ કરનારી પણ તેની સ્ત્રી તેના તરફ વિરક્ત થઈ જાય છે-તેને છોડી દે છે. પણ ખેદની વાત છે કે તે તે તૃષ્ણારૂપ સ્ત્રી પોતાના પ્રિયતમને અન્ય જરારૂપ નારીમાં આસક્ત જોવા છતાં પણ તેને છોડતી નથી અને તેના પ્રત્યે અનુરાગ જ કરે છે. તાત્પર્ય એ છે કે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પુરુષનું શરીર શિથિલ થઈ જાય છે અને સ્મૃતિ પણ ક્ષીણ થઈ જાય છે. છતાં પણ

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૮૭

તે વિષયતૃષ્ણા છોડીને આત્મહિતમાં પ્રવૃત્ત થતો નથી, એ કેટલા ખેદની વાત છે. ૧૭૨.

(વસંતતિલકા)

રહ્ણાયતે પરિદ્ગોડપિ દૃઢોડપિ મૃત્યુ-
મભેતિ દૈવવશતઃ ક્ષણતોડત્ર લોકે ।
તત્કઃ કરોતિ મદમમ્બુજપત્રવારિ-
બિન્દૂપમૈર્ધનકલેવરજીવિતાદૈ: ॥૧૭૩॥

અનુવાદ : અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદ્યથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે. એવી અવસ્થામાં ક્યો બુદ્ધિમાન પુરુષ કુમળપત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન વિનાશ પામનાર ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ પદાર્થોના વિષયમાં વિવેકી જન કદી પણ અભિમાન કરતા નથી. ૧૭૩.

(શાર્દૂલવિક્રીડિત)

પ્રાતર્દર્ભદલાગ્રકોટિદિનાવશ્યાયબિન્દૂકર-
પ્રાયાઃ પ્રાણધનાઙ્ગુજપ્રણયિનીમિત્રાદયો દેહિનામ् ।
અક્ષાણાં સુખમેતદુગ્રવિષવદ્ર્મ વિહાય સ્ફુર્તં
સર્વ ભડ્ગુરમત્ર દુઃખદમહો મોહઃ કરોત્યન્યથા ॥૧૭૪॥

અનુવાદ : પ્રાણીઓના પ્રાણ, ધન, પુત્ર, ખી અને મિત્ર આદિ પ્રાત:કાળમાં દર્ભ ઘાસના પાંડાની આણી ઉપર રહેલ ઝકળના ટીપાઓ સમાન અસ્થિર છે. આ ઈન્દ્રિયજન્ય સુખ તીક્ષ્ણ વિષ સમાન પરિણામે દુઃખદાયક છે. તેથી એ સ્પષ્ટ છે કે અહીં ધર્મ સિવાય અન્ય સર્વ પદાર્થો વિનશ્યર અને કષ્ટદાયક છે પરંતુ આશ્રય છે કે આ સંસારી પ્રાણી મોહવશ થઈને આ વિનશ્યર પદાર્થોને સ્થિર માનીને તેમાં અનુરાગ કરે છે અને સ્થાયી ધર્મને ભૂલી જાય છે. ૧૭૪.

(શાર્દૂલવિક્રીડિત)

તાવદ્ધલાતિ વૈરિણાં પ્રતિ ચમૂસ્તાવત્પરં પૌરુષं
તીક્ષ્ણસ્તાવદસિર્ભુજો દૃઢતરૌ તાવચ્ચ કોપોદ્રમઃ: ।

ભૂપસ્યાપિ યમો ન યાવદદયઃ ક્ષુતીડિતઃ સન્મુહં
ધાવત્યન્તરિદં વિચિન્ત્ય વિદુષા તત્ત્રોધકો મૃષ્યતે ॥૧૭૫॥

અનુવાદ : જ્યાં સુધી ભૂખથી પિડાયેલ નિર્દ્ય યમરાજ (મૃત્યુ) સામે આવતા નથી ત્યાં સુધી રાજાની પણ સેના શત્રુઓ ઉપર આક્રમણ કરવા પ્રસ્થાન કરે છે, ત્યાં સુધી ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ રહે છે, ત્યાં સુધી તીક્ષ્ણ તરવાર પણ સ્થિર રહે છે, ત્યાં સુધી બન્ને હાથ પણ અતિશય દેઠ રહે છે અને ત્યાં સુધી કોધ પણ ઉદ્ય પામે છે. આમ વિચાર કરીને વિદ્વાન પુરુષ ઉક્ત યમરાજનો નિગ્રહ કરનાર તપ આદિની ખોજ કરે છે. ૧૭૫.

(માલિની)

રતિજલરમમાણો મૃત્યુકૈવર્તહસ્ત-
પ્રસૂતધનજરોરૂપોલસજાલમધ્યે ।
નિકટમપિ ન પશ્યત્યાપદાં ચક્રમુગ્રં
ભવસરસિ વરાકો લોકમીનૌઘ એષ: ॥૧૭૬॥

અનુવાદ : જેની મધ્યમાં મૃત્યુરૂપી નાવિકે પોતાને હાથે સધન જરારૂપી વિસ્તૃત જાળ ફેલાવી દીધી છે એવા સંસારરૂપી સરોવરમાં રાગરૂપી જળમાં રમણ કરનાર આ બિચારા જનરૂપી માછલીઓનો સમુદ્દર સમીપમાં આવેલી મહાન આપ્તિઓનો સમૂહ દેખતો નથી. ૧૭૬.

(શાર્દૂલવિક્રીડિત)

કુદ્ભુક્તેસ્તૃડપીહ શીતલજલાદ્ભૂતાદિકા મન્ત્રઃ
સામાદેરહિતો ગદાદ્રદગણઃ શાન્તિં નૃભર્નીયતે ।
નો મૃત્યુસ્તુ સુરેરપીતિ હિ મૃતે મિત્રે ઽપિ પુત્રે ઽપિ વા
શોકો ન ક્રિયતે બુધૈઃ પરમહો ધર્મસ્તતસ્તજ્ઞયઃ ॥૧૭૭॥

અનુવાદ : સંસારમાં મનુષ્ય ભોજનથી કુધાને, જળથી તરસને, મંત્રથી ભૂત-પિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાન્ત કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાન્ત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને વિદ્વાન् મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું

અધિકાર-૧ : ધર્મપદેશામૃત]

૮૮

જ આચરણ કરે છે અને તેનાથી જ તે ભત્યુ ઉપર વિજય મેળવે છે. ૧૭૭.

(મન્દાક્રાન્તા)

ત્વક્ત્વા દૂરં વિધુરપયસો દુર્ગતિવિલષ્ટકૃચ્છાન्
લબ્ધ્વાનન્દં સુચિરમમરશ્રીસરસ્યાં રમન્તે ।
એત્યैતસ્યા નૃપપદસરસ્યક્ષયં ધર્મપક્ષા
યાન્ત્યેતસ્માદપિ શિવપદં માનસં ભવ્યહંસા ॥૧૭૮॥

અનુવાદ : ધર્મરૂપી પાંખો ધારણ કરનાર ભવ્ય જીવરૂપ હંસ નરકાદિક દુર્ગતિઓના કલેશયુક્ત દુઃખોરૂપ પાણી વિનાના જળાશયોને દૂરથી જ છોડીને આનંદપૂર્વક દેવોની લક્ષ્મીરૂપ સરોવરમાં ચિરકાળ સુધી રમણ કરે છે. ત્યાંથી આવીને તેઓ રાજ્યપદ રૂપ સરોવરમાં રમણ કરે છે. અંતે તેઓ ત્યાંથી પણ નીકળીને અવિનશ્બર મોક્ષપદરૂપી માનસ સરોવરને પ્રાપ્ત કરે છે.

વિશેષાર્થ : જેમ ઉત્તમ, પુષ્ટ પાંખોવાળા હંસ પક્ષી જળથી ખાલી થયેલા જળાશયો છોડી દઈને કોઈ અન્ય સરોવરમાં ચાલ્યા જાય છે અને પછી અંતે તેને પણ છોડી માનસ સરોવરમાં જઈ પહોંચે છે તેવી જ રીતે ધર્માત્મા ભવ્યજીવ તે ધર્મના પ્રભાવથી નરકાદિ દુર્ગતિઓના કષ્ટથી બચીના: દેવપદ અને રાજપદના સુખ ભોગવતા થકા અંતે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. ૧૭૮.

(શાર્દૂલવિક્રીદિત)

જાયન્તે	જિનચક્રવર્તિબલમૃદ્ગોગીન્દ્રકૃષ્ણાદયો
ધમદિવ	દિગઙ્ગનઙ્ગવિલસચ્છશ્વયશશ્વનનાઃ ।
તદ્વીના	નરકાદિયોનિષુ નરા દુઃખં સહન્તે ધ્રુવં
પાપેનેતિ	પિમિતિ નો ધર્મઃ સતા સેવ્યતે ॥૧૭૯॥

અનુવાદ : જેમનું યશરૂપી ચંદન સદા દિશાઓરૂપ શ્રીઓના શરીરમાં સુશોભિત રહે છે અર્થાત્ જેમની કીર્તિ સમસ્ત દિશાઓમાં ફેલાયેલી છે એવા તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, નાગેન્દ્ર અને કૃષ્ણ (નારાયણ) આદિ પદ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. ધર્મ રહિત મનુષ્ય નિશ્ચયથી પાપના પ્રભાવથી નરકાદિક દુર્ગતિઓમાં દુઃખ સહન કરે છે. આ વાતને જાણતા થકા સજ્જન પુરુષ ધર્મની આરાધના કેમ નથી કરતા? ૧૭૯.

(શાર્દૂલવિક્રીડિત)

સ સ્વર્ગઃ સુખરામણીયકપદं તે તે પ્રદેશઃ પરાઃ
સારા સા ચ વિમાનરાજિરતુલપ્રેર્ણત્પતાકાપટા ।
તે દેવાશ્ર પદાતયઃ પરિલસત્તત્ત્વન્દનં તાઃ સ્ત્રિયઃ
શક્રત્વં તત્ત્વનિન્દ્યમેતદખિલં ધર્મસ્ય વિસ્ફૂર્જિતમ् ॥૧૮૦॥

અનુવાદ : સુખ વડે રમણીયપણું પામેલ તે સ્વર્ગનું પદ, તે તે ઉત્કૃષ્ટ સ્થાન, લહેરાતા અનુપમ ધ્વજવસ્ત્રોથી સુશોભિત તે શ્રેષ્ઠ વિમાનપંક્તિ, તે દેવ, તે પાયદળ સૈનિકો, શોભાયમાન તે નંદનવન, તે સ્ત્રીઓ તથા તે અનિન્દ્ય ઈન્દ્રપદ; આ બધું ધર્મના પ્રકાશમાં પ્રાપ્ત થાય છે. ૧૮૦.

(શાર્દૂલવિક્રીડિત)

યત્થટ્રખણ્ડમહી નવોરુનિધયો દ્વિઃસમસ્તલાનિ યત્તુ
તુઙ્ગા યદ્વદ્વિરદા રથાશ્ર ચતુરાશીતિશ્ચ લક્ષાણિ યત્તુ ।
યચ્ચાષાદશકોટ્યશ્ચ તુરગા યોષિત્સહસ્ત્રાણિ યત્તુ ।
ષડ્યુક્તા નવતિર્યદિકવિભુતા તદ્વમિ ધર્મપ્રભો: ॥૧૮૧॥

અનુવાદ : છ ખંડ (પૂર્ણ ભરત, ઐરાવત અથવા કંદ્રા આદિ ક્ષેત્રે) રૂપ પૃથ્વીનો ઉપભોગ; મહાન નવનિધિ, બે વાર સાત (૭x૨) અર્થાત્ ચૌંદ રત્ન, ઉન્તત ચોરાસી લાખ હાથી અને એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, છન્નુહજાર સ્ત્રીઓ અને એક છત્ર રાજ્ય; આ જે ચક્રવર્તીપણાની સંપત્તિ પ્રાપ્ત થાય છે તે બધી ધર્મપ્રભુના જ પ્રતાપે પ્રાપ્ત થાય છે. ૧૮૧.

(શાર્દૂલવિક્રીડિત)

ધર્મો રક્ષતિ રક્ષિતો નનુ હતો હન્તિ ધ્રુવં દેહિનાં
હન્તવ્યો ન તતઃ સ એવ શરણં સંસારિણાં સર્વથા ।
ધર્મઃ ગ્રાપ્યતીહ તત્પદમપિ ધ્યાયન્તિ યદ્યોગિનો
નો ધર્માત્સુહૃદસ્તિ નૈવ ચ સુખી નો પણ્ડિતો ધાર્મિકાત્ ॥૧૮૨॥

અનુવાદ : જો ધર્મની રક્ષા કરવામાં આવે તો તે પણ ધર્મત્બા પ્રાણીની

નરકાદિથી રક્ષા કરે છે. એનાથી વિપરીત જો તે ધર્મનો ઘાત કરવામાં આવે તો તે પણ નિશ્ચયથી પ્રાણીઓનો ઘાત કરે છે અર્થાત् તેમને નરકાદિ યોનિઓમાં પહોંચાડે છે. તેથી ધર્મનો ઘાત ન કરવો જોઈએ કારણ કે તે સંસારી પ્રાણીઓનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર તે જ છે. ધર્મ અહીં તે (મોક્ષ) પદને પણ પ્રાપ્ત કરાવે છે કે જેનું ધ્યાન યોગીઓ કરતા રહે છે. ધર્મ સિવાય બીજો કોઈ મિત્ર (હિતેચ્છક) નથી તથા ધાર્મિક પુરુષની અપેક્ષાએ બીજો કોઈ ન તો સુખી હોઈ શકે અને ન પંડિત. ૧૮૨.

(શાર્દૂલવિક્રીડિત)

નાનાયોનિજલૌઘલદ્રિઘતદિશિ કલેશોર્મિજાલાકુલે
ગ્રોદ્ભુતાદ્ભુતભૂરિકર્મમકરગ્રાસીકૃતપ્રાણિનિ ।
દુઃપર્યન્તગભીરભીષણતરે જન્માસ્બુધૌ મજ્જતાં
નો ધર્માદપરો ઽસ્તિ તારક ઇહાશ્રાન્તં યતધ્યં બુધાઃ ॥૧૮૩॥

અનુવાદ : જોશે અનેક યોનિરૂપ જણના સમૂહથી દિશાઓનું અતિકમણ કરી નાખ્યું છે, જે કલેશરૂપી લહેરોના સમૂહથી વ્યાપ્ત થઈ રહ્યો છે, જ્યાં પ્રાણી પ્રગટ થયેલ આશ્રયજનક અનેક કર્મરૂપી ભગરોના કોળિયા બની જાય છે, જેનો પાર ધણી કઠિનતાથી પ્રાપ્ત કરી શકાય છે તથા જે ગંભીર અને અતિશય ભયાનક છે; એવા જન્મરૂપી સમુદ્રમાં દૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી. તેથી હે વિદ્વાનો! આપ નિરંતર ધર્મના વિષયમાં પ્રયત્ન કરો. ૧૮૩.

(શાર્દૂલવિક્રીડિત)

જન્મોચૈઃકુલ એવ સંપદધિકે લાવણ્યવારાંનિધિ-
નીરોગં વપુરાદિરાયુરખિલં ધર્માદ્રદ્ધુવં જાયતે ।
સા ન શ્રીરથવા જગત્સુ ન સુખં તત્તે ન શુભ્રા ગુણાઃ
યૈરૂત્કણિતમાનસैરિવ નરો નાશ્રીયતે ધાર્મિકઃ ॥૧૮૪॥

અનુવાદ : નિશ્ચયથી ધર્મના પ્રભાવે અધિક સંપત્તિશાળી ઊંચ કુળમાં જ જન્મ થાય છે, સૌન્દર્યરૂપી સમુદ્ર પ્રાપ્ત થાય છે, નીરોગ શરીર આદિ પ્રાપ્ત થાય છે તથા આયુષ્ય પરિપૂર્ણ થાય છે અર્થાત् અકાળ ભરણ થતું નથી. અથવા સંસારમાં એવી કોઈ લક્ષ્મી નથી, એવું કોઈ સુખ નથી અને એવો કોઈ નિર્મળ ગુણ નથી કે જે

ઉત્કંઠાપૂર્વક ધાર્મિક પુરુષનો આશ્રય લેતા ન હોય. અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત સમસ્ત સુખની સામગ્રી એક માત્ર ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી જીવોએ સદાય તે ધર્મનું આચરણ કરવું જોઈએ. ૧૮૪.

(શાર્દૂલવિક્રીડિત)

ભૃગાઃ પુષ્પિતકેતકીમિવ મૃગ વન્યામિવ સ્વસ્થલીં
નદ્યઃ સિન્ધુમિવામ્બુજાકરમિવ શ્રેતચ્છદાઃ પક્ષિણઃ ।
શૌર્યત્યાગવિવેકવિક્રમયશઃસંપત્તસહાયાદયઃ
સર્વે ધાર્મિકમાશ્રયન્તિ ન હિતં ધર્મ વિના કિંચન ॥૧૮૫॥

અનુવાદ : જેવી રીતે ભમરા ઝૂલેલા કેતકી વૃક્ષનો આશ્રય લે છે, મૃગ જેવી રીતે પોતાના જંગલી સ્થાનનો આશ્રય લે છે, નદીઓ જેવી રીતે સમુદ્રનો સહારો લે છે અને જેવી રીતે હંસ પક્ષી સરોવરનું આલંબન લે છે; તેવી જ રીતે વીરતા, ત્યાગ, વિવેક, પરાક્રમ, ક્રીતિ, સંપત્તિ અને સહાયક આદિ બધું ધાર્મિક પુરુષનો આશ્રય લે છે. બરાબર છે—ધર્મ સિવાય બીજું કોઈ પ્રાણીને હિતકારક નથી. ૧૮૫.

(શાર્દૂલવિક્રીડિત)

સૌભાગીયસિ કામિનીયસિ સુતશ્રેણીયસિ શ્રીયસિ
પ્રાસાદીયસિ યત્સુખીયસિ સદા રૂપીયસિ પ્રીયસિ ।
યદ્વાનન્તસુખામृતમ્બુધિપરસ્થાનીયસીહ ધ્રુવં
નિર્ધૂતાખિલદુઃખદાપદિ સુહૃદ્રમે મતિર્ધાર્યતામ् ॥૧૮૬॥

અનુવાદ : હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઈચ્છા રાખતા હો, સુંદર સ્ત્રીની ઈચ્છા રાખતા હો, પુત્રોની ઈચ્છા કરતા હો, લક્ષ્મીની ઈચ્છા કરતા હો, મહેલની ઈચ્છા કરતા હો, સુખની ઈચ્છા કરતા હો, સુંદર રૂપની ઈચ્છા કરતા હો, પ્રીતિની ઈચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન (મોક્ષ)ની ઈચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુઃખદાયક આપત્તિઓનો નાશ કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૮૬.

(શાર્દૂલવિક્રીડિત)

સંછન્નं કર્મલૈર્મરાવપિ સરઃ સૌધં વને ઽપ્યુન્તતં
કામિન્યો ગિરિમસ્તકે ઽપિ સરસાઃ સારાણિ રત્નાનિ ચ ।

જાયન્તે ઽપિ ચ લેપ [ષ્ય] કાષ્ઠઘટિતા: સિદ્ધિપ્રદા દેવતા:
ધર્મશ્રેદિહ વાજ્ઞિતં તત્તુભૂતાં કિં કિં ન સંપદ્યતે ॥૧૮૭॥

અનુવાદ : ધર્મના પ્રભાવથી મરુભૂમિમાં પણ કમળોથી વ્યાપ્ત સરોવર પ્રાપ્ત થઈ જાય છે, જંગલમાં પણ ઉન્નત મહેલ બની જાય છે, પર્વતના શિખર પર પણ આનંદોત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉક્ત ધર્મના જ પ્રભાવથી ભીતાં ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક થાય છે. બરાબર છે—ધર્મ અહીં પ્રાણીઓને કયા કયા ઈષ પદાર્થ પ્રાપ્ત કરાવતો નથી? બધું જ પ્રાપ્ત કરાવે છે. ૧૮૭.

(વસંતિલકા)

દૂરાદભીષ્ટભિગચ્છતિ પુણ્યયોગાત्
પુણ્યાદ્વિના કરતલરથમણિ ગ્રયાતિ ।
અન્યત્પરં ગ્રભવતીહ નિમિત્તમાત્રં
પાત્રં બુધા ભવત નિર્મલપુણ્યરાશે: ॥૧૮૮॥

અનુવાદ : પુણ્યના યોગથી અહીં દૂરવર્તી ઈષ પદાર્થ પણ પ્રાપ્ત થઈ જાય છે અને પુણ્ય વિના હાથમાં રહેલા પદાર્થ પણ ચાલ્યા જાય છે. બીજા પદાર્થ તો કેવળ નિમિત્તમાત્ર થાય છે. તેથી હે પંડિતજનો! નિર્ભળ પુણ્ય રાશિના ભાજન થાવ, અર્થાત્ પુણ્યનું ઉપાર્જન કરો. ૧૮૮.

(શાર્દૂલવિક્રીદિત)

કોષ્યન્ધો�પિ સુલોચનો ઽપિ જરસા ગ્રસ્તો ઽપિ લાવણ્યવાનુ
નિઃપ્રાણો�પિ હરિર્વિરૂપતનુરપ્યાધુષ્યતે મન્મથ: ।
ઉદ્યોગોજ્ઞિતચેષ્ટિતો�પિ નિતરામાલિઙ્ગયતે ચ શ્રિયા
પુણ્યાદન્યમણિ પ્રશસ્તમખિલં જાયેત યદ્વિર્ઘટમ् ॥૧૮૯॥

અનુવાદ : પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્ભળ નેત્રોનું ધારક થઈ જાય છે, વૃદ્ધાવસ્થા યુક્ત મનુષ્ય પણ લાવણ્યયુક્ત (સુંદર) થઈ જાય છે, નિર્ભળ પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે, વિકૃત શરીરવાળો પણ કામદેવ સમાન સુંદર ગણવામાં આવે છે તથા ઉદ્યોગહીન યેષાવાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે

આલિંગાય છે અર્થાતું ઉદ્ઘોગ રહિત મનુષ્ય પણ અત્યંત સંપત્તિવાનું બની જાય છે. જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે તે બધા પુણ્યના ઉદ્યથી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૮.

(શાર્દૂલવિક્રીડિત)

બન્ધસ્કન્ધસમાશ્રિતાં સૃણિભૃતામારોહકાળામલં
 પૃષ્ઠે ભારસમર્પણં કૃતવતાં સંચાલનં તાડનમ્ |
 દુર્વાચં વદતામપિ પ્રતિદિનં સર્વ સહન્તે ગજા
 નિઃસ્થામનાં બલિનો ઽપિ યત્તદખિલં દુષ્ટો વિધિશ્રેષ્ટતે ॥૧૯૦॥

અનુવાદ : જે મહાવત હાથીને બાંધીને તેના સ્કંધ (કાંધ) ઉપર બેસે છે, અંકુશ ધારણ કરે છે, પીઠ ઉપર ભારે બોજો લાદે છે, સંચાલન અને તાડન કરે છે, તથા દુષ્ટ વચ્ચો પણ બોલે છે, એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત દુર્ઘટારને પણ જે હાથી બળવાન હોવા છતાં પણ પ્રતિદિન સહન કરે છે એ બધી દુર્દીવની લીલા છે, અર્થાતું એને પાપકર્મનું જ ફળ સમજું જોઈએ. ૧૯૦.

(શાર્દૂલવિક્રીડિત)

સર્પો હારલતા ભવત્યસિલતા સત્યુષ્ટદામાયતે
 સંપદેત રસાયનં વિષમપિ પ્રીતિં વિધત્તે રિપુઃ ।
 દેવા યાન્તિ વશં પ્રસન્નમનસઃ: કિં વા બહુ બ્રૂમહે
 ધર્મો યસ્ય નભોઽપિ તસ્ય સતતં રત્નૈ: પરૈર્વષ્ટતિ ॥૧૯૧॥

અનુવાદ : ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તલવાર સુંદર ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા માંડે છે અને દેવ પ્રસન્નચિત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ધણું શું કહેવું? જેની પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૯૧.

(શાર્દૂલવિક્રીડિત)

ઉગ્રગ્રીષ્મરવિપ્રતાપદહનજ્વાલાભિતપ્તશ્રિં
 યઃ પિત્તપ્રકૃતિર્મરૌ મૂર્દુતરઃ પાન્થઃ પથા પીડિતઃ ।

તદ્દ્વારા દ્રાગલબ્ધહિમાદ્રિકુઞ્જરચિતપ્રોદામયન્ત્રોલ્લસદ્-
ધારાવેશમસમો હિ સંસ્તિપથે ધર્મો ભવેદેહિનઃ ॥૧૯૨॥

અનુવાદ : મરુભૂમિ (મારવાડ)માં ચાલનાર જે પિતપ્રકૃતિવાળો સુકુમાર મુસાફર શ્રીષ્મતી તીક્ષ્ણ સૂર્યના પ્રકૃષ્ટ તાપદ્રુપ અભિનની જવાળાથી સંતપ્ત થઈને લાંબા સમયથી માર્ગના શ્રમથી પીડા પામ્યો છે તેને જેમ તરત જ હિમાલયની લતાઓથી બનેલ અને ઉત્કૃષ્ટ કુવારાઓથી શોભાયમાન ધારાગૃહ પ્રાપ્ત થતાં અપૂર્વ સુખનો અનુભવ થાય છે તેવી જ રીતે સંસારમાર્ગમાં ચાલતા પ્રાણીને ધર્મથી અભૂતપૂર્વ સુખનો અનુભવ થાય છે. ૧૯૨.

(શાર્દૂલવિક્રીડિત)

સંહારોગ્રસમીરસંહતિહતપ્રોદ્ભૂતનીરોલ્લસત્ત-
તુઙ્ગોર્મિભ્રમિતોરુનક્રમકરગ્રાહાદિભર્ભિર્ભિર્ષણે ।
અભ્રોધૌ વિધુતોગ્રબાડવશિખિજ્વાલાકરાલે પત-
જન્તોઃખે ઽપિ વિમાનમાશુ કુરુતે ધર્મઃ સમાલમ્બનમ્ ॥૧૯૩॥

અનુવાદ : જે સમુદ્ર ઘાતક તીક્ષ્ણ વાયુ (પ્રલય પવન)ના સમૂહથી આધાત પામીને જળમાં ઉત્પન્ન થનાર ઉન્નત લહરીઓથી આમતેમ ઉછળતા નક, મગર અને ગ્રાહ આદિ હિંસક જળજંતુઓથી ભય ઉત્પન્ન કરનાર છે તથા કંપિત તીક્ષ્ણ વાડવાભિનની જવાળાથી ભયાનક છે એવા તે સમુદ્રમાં પડતા જીવોને ધર્મ શીઘ્રતાથી આકાશમાં પણ આલંબનભૂત વિમાન કરી ટે છે. ૧૯૩.

(સ્ત્રાધરા)

ઉહ્યન્તે તે શિરોભિઃ સુરપતિભિરપિ સ્તૂયમાનાઃ સુરૌધૈ-
રીયન્તે કિન્નરીભિર્લલિતપદલસદ્રીતિભિર્ભવિત્તરાગાત् ।
बમ्ब्रम्प्यन्ते च तेषां दिशि दिशि विशदाः कीर्तयः का न वा स्यात्
लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम् ॥૧૯૪॥

અનુવાદ : જે મનુષ્ય સદા અદ્વિતીય ધર્મનો આશ્રય લે છે તેમને ઈન્દ્રો

પણ મસ્તક ઉપર ધારણ કરે છે, દેવોનો સમૂહ તેમની સુતિ કરે છે, કિન્નરીઓ લલિત પદોથી શોભાયમાન ગીતો દ્વારા તેમના ભક્તિપૂર્વક ગુણગાન કરે છે તથા તેમનો યશ પ્રત્યેક દિશામાં વારંવાર અમણ કરે છે અર્થાત્ તેમની ક્રીતિ બધી જ દિશામાં ફેલાઈ જાય છે. અથવા તેમને કઈ પ્રશસ્ત લક્ષ્મી પ્રાપ્ત થતી નથી? અર્થાત્ તેમને બધા જ પ્રકારની શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૪.

(શાર્દૂલવિક્રીડિત)

ધર્મः શ્રીવશમન્ત્ર એષ પરમો ધર્મશ્ર કલ્પદ્રુમો
 ધર્મः કામગવીસ્થિતપ્રદમળિર્ધર્મઃ પરં દૈવતમ् ।
 ધર્મઃ સૌખ્યપરંપરામૃતનદીસંભૂતિસત્ત્વર્વતો
 ધર્મો ભ્રાતરુપાસ્યતાં કિમપરૈઃ ક્ષુદ્રૈરસત્કલ્પનૈઃ ॥૧૯૯૫॥

અનુવાદ : આ ઉત્કૃષ્ટ ધર્મ લક્ષ્મીને વશ કરવા માટે વશીકરણ મન્ત્ર સમાન છે, આ ધર્મ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત પદાર્થ આપનાર છે, તે કામધેનુ અથવા ચિન્તામણિ સમાન ઈષ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત સમાન છે. તેથી હે ભાઈ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની આરાધના કરો. ૧૮૫.

(શાર્દૂલવિક્રીડિત)

આસ્તામસ્ય વિધાનતઃ પથિ ગતિર્ધર્મસ્ય વાર્તાપિ યૈ:
 શ્રુત્વા ચેતસિ ધાર્યતે ત્રિભુવને તેષાં ન કાઃ સંપદઃ ।
 દૂરે સञ્ચલપાનમञ્ચનસુખં શીતૈઃ સરોમારૂતૈ:
 ગ્રાસં પદ્મરજઃ સુગન્ધિભિરપિ શ્રાન્તં જનં મોદયેત્ ॥૧૯૯૬॥

અનુવાદ : આ ધર્મના અનુષ્ઠાનથી જે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તે તો દૂર રહો, પરંતુ જે મનુષ્ય તે ધર્મની વાત પણ સાંભળીને ચિત્તમાં ધારણ કરે છે તેમને ત્રણ લોકમાં કઈ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી? યોગ્ય જ છે. ઉત્તમ જળ પીવા અને તેમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારું સુખ તો દૂર રહો, પરંતુ તળાવના શીતળ

અધિકાર-૧ : ધર્મોપદેશામૃત]

૮૭

અને સુગંધી વાયુ દ્વારા પ્રાપ્ત થતી કમળની ૨૪ પણ થાકેલા મનુષ્યને આનંદિત બનાવી દે છે. ૧૯૬.

(વસંતતિલકા)

યત્પાદપદ્ભૂકજરજોભિરાપિ પ્રણામાત્
 લગ્નૈઃ શિરસ્યમલબોધકલાવતારઃ ।
 ભવ્યાત્મનાં ભવતિ તત્ક્ષણમેવ મોક્ષં
 સ શ્રીગુરુર્દિશતુ મે મુનિવીરનન્દી ॥૧૯૭॥

અનુવાદ : નમસ્કાર કરતી વખતે મસ્તકમાં લાગેલ જેમના ચરણ-કમળોની ધૂળથી ભવ્ય જીવોને તત્કાળ જ નિર્મણ સમ્યગ્જ્ઞાનરૂપ કળાની પ્રાપ્તિ થાય છે તે શ્રીમુનિ વીરનન્દી ગુરુ મને મોક્ષ પ્રદાન કરો. ૧૯૭.

(વસંતતિલકા)

દત્તાનન્દપારસંસ્તિપથશ્રાન્તશ્રમચ્છેદકૃત
 પ્રાયો દુર્લભમત્ર કર્ણપુટકૈર્ભવ્યાત્મભિઃ પીયતામ् ।
 નિર્યાતં મુનિપદ્મનન્દિવદનપ્રાલેયરશ્મે: પરં
 સ્તોકં યદ્યપિ સારતાધિકમિદં ધર્મોપદેશામૃતમ् ॥૧૯૮॥

ઇતિ ધર્મોપદેશામૃતં સમાપ્તમ् ॥૨॥

અનુવાદ : જે ધર્મોપદેશરૂપ અમૃત આનંદ આપનાર છે, અપાર સંસારના માર્ગમાં થાકેલા મુસાફરનો પરિશ્રમ દૂર કરનાર છે તથા ધાણું દુર્લભ છે, તેને ભવ્ય જીવ કાનોરૂપ અંજલિથી પીઓ અર્થાત્ કાનો દ્વારા તેનું શ્રવણ કરો. મુનિ પદ્મનાન્દિના મુખરૂપ ચંદ્રમાંથી નીકળેલ આ ઉપદેશામૃત જો કે અત્ય છે તોપણ શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે અધિક છે.

વિશોધાર્થ : જેમ અમૃતનું પાન કરવાથી પથિકનો માર્ગનો થાક દૂર થઈ જાય છે અને તેને અતિશય આનંદ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ ધર્મોપદેશ સાંભળવાથી ભવ્ય જીવોના સંસાર પરિભ્રમણનું દુઃખ દૂર થઈ જાય છે અને તેમને અનંત સુખનો લાભ થાય

છ. જેવી રીતે અમૃત દુર્લભ છે તેવી જ રીતે આ ઉપદેશ પણ દુર્લભ છે. અમૃત જો ચંદ્રમાંથી ઉત્પન્ન થાય છે તો આ ઉપદેશ તે ચંદ્રમા સમાન મુનિ પજનન્દીના મુખમાંથી ઉત્પન્ન થયો છે તથા જેમ અમૃત થોડું હોય તોપણ તે અધિક લાભકારી થાય છે તેવી જ રીતે જ આ ગ્રંથપ્રમાણની અપેક્ષાએ આ ઉપદેશ જો કે થોડો છે છતાં પણ તે લાભપ્રદ અધિક છે. આ રીતે આ ઉપદેશને અમૃત સમાન હિતકારી જાણીને ભવ્ય જીવોએ તેનું નિરન્તર મનન કરવું જોઈએ. ૧૯૮.

આ રીતે ધર્મોપદેશામૃત સમાપ્ત થયું. ૧.

દુર્લભ
મનુષ્ય.

૨. દાનનો ઉપદેશ

[૨. દાનોપદેશમ्]

(વસંતતિલક)

જીયાજીનો જગતિ નાભિનરેન્દ્રસૂનુઃ
શ્રેયો નૃપશ્રી કુરુગોત્રગૃહપ્રદીપઃ ।
યાભ્યાં બભૂવતુરિહ બ્રતદાનતીર્થ
સારક્રમે પરમધર્મરથસ્ય ચક્રે ॥૧॥

આનુવાદ : જેમના દ્વારા ઉત્તમ રીતે ચાલનારા શ્રેષ્ઠ ધર્મરૂપી રથના ચક્ર સમાન વ્રત અને દાનરૂપ બે તીર્થ અહીં પ્રગટ થયા છે તે નાભિરાજાના પુત્ર આદિ જિનેન્દ્ર અને કુરુવંશરૂપ ગૃહના દીપક સમાન રાજા શ્રેયાંસ પણ જ્યવંત હો.

વિશેષાર્� : આ ભરત ક્ષેત્રમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કાળમાં ભોગભૂમિની અવસ્થા હોય છે. તે સમયે આર્ય કહેવાતા પુરુષો અને શ્રીઓમાં ન તો વિવાહાદિ સંસ્કાર હતા કે ન વ્રતાદિક તેઓ દસ પ્રકારના કલ્યાણક્રમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા યથેચ્છ ભોગ ભોગવતા થકા કાળ નિર્ગમન કરતા હતા, કાળક્રમે જ્યારે તૃતીય કાળમાં પલ્યનો આઠમો ભાગ $\frac{1}{4}$ બાકી રહ્યો ત્યારે તે કલ્યાણક્રમની દાનશક્તિ કર્મશઃ ક્ષીણ થવા લાગી હતી. તેથી જે સમયે તે આર્યાને મુશ્કેલીઓનો અનુભવ થયો તેને યથાક્રમે ઉત્પન્ન થનાર પ્રતિશ્રુતિ આદિ ચૌદ કુલકરોએ દૂર કર્યો હતો. તેમાં અંતિમ કુલકર નાભિરાજ હતા. પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથ તેમના જ પુત્ર હતા. અત્યાર સુધી જે વ્રતોનો પ્રચાર નહોતો તેને ભગવાન આદિનાથે પોતે જ પાંચ મહાવતોનું ગ્રહણ કરીને પ્રચાલિત કર્યો. એ જ પ્રમાણે અત્યાર સુધી કોઈને દાનવિધિનું પણ પરિજ્ઞાન નહોતું. એ જ કારણે છ માસના ઉપવાસ પરિપૂર્ણ કરીને ભગવાન આદિ જિનેન્દ્રને પારણાના નિમિત્તે બીજા પણ છ માસ પર્યંત ધૂમવું પડ્યું. અંતે રાજા શ્રેયાંસને જાતિસ્મરણ દ્વારા આહાર-દાનની વિધિનું પરિજ્ઞાન થયું.

તે પ્રમાણે ત્યારે તેણે ભક્તિપૂર્વક ભગવાન આદિનાથને શેરડીના રસનો આહાર આપ્યો. બસ અહીંથી આહારાદિ દાનોની વિધિનો પણ પ્રચાર શરૂ થઈ ગયો. આ રીતે ભગવાન આદિનાથે ત્રતોનો પ્રચાર કરીને તથા શ્રેયાંસ રાજાએ દાનવિધિનો પણ પ્રચાર કરીને જગતનું કલ્યાણ કર્યું છે. તેથી ગ્રંથકાર શ્રી પદ્મનંદી મુનિએ અહીં તીર્થના પ્રવર્તક સ્વરૂપે ભગવાન આદિ જિનેન્દ્રનું તથા દાનતીર્થના પ્રવર્તક સ્વરૂપે શ્રેયાંસ રાજાનું સ્મરણ કર્યું છે. ૧.

(શાર્દૂલવિક્રીદિત)

શ્રેયોભિધસ્ય નૃપતેઃ શરદ્ભ્રશુભ્ર-
ભ્રામ્યદ્યશોભૃતજગત્તિયસ્ય તસ્ય ।
કિं વર્ણયામિ નનુ સર્વાનિ યસ્ય ભુક્તં
ત્રૈલોક્યવન્દિતપદેન જિનેશ્વરેણ ॥૨॥

અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ત્રણે લોકોથી વન્દિત ચરણોવાળા ભગવાન ઋષભદેવ જિનેન્દ્રે આહાર ગ્રહણ કર્યો અને તેથી જેનો શરદ્ભ્રતુના વાદળા સમાન ધવળ યશ ત્રણે લોકમાં ફેલાયો તે શ્રેયાંસ રાજાનું કેટલું વર્ણન કરવું? ૨.

(શાર્દૂલવિક્રીદિત)

શ્રેયાન् નૃપો જયતિ યસ્ય ગૃહે તદા ખાદેકાદ્યમુનિપુંગવપારણાયામ્ ।
સા રત્નવૃષ્ટિરભવજ્ઞગદેકચિત્રહેતુર્યયા વસુમતીત્વમિતા ધરિત્રી ॥૩॥

અનુવાદ : જે શ્રેયાંસ રાજાને ઘેર ઈન્દ્રાદિકો દ્વારા વન્દનીય એક પ્રથમ મુનિપુંગવ (તીર્થકર)ના આહાર લેવાના સમયે લોકોને અભૂતપૂર્વ આશ્રયમાં નાખનારી આકાશમાંથી તે રત્નવૃષ્ટિ થઈ કે જેના દ્વારા આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવી સાર્થક સંજ્ઞા પામી હતી; તે શ્રેયાંસ રાજા જયવંત હો.

વિશેષાર્થ : આ આગમમાં સારી રીતે પ્રસિદ્ધ છે કે જેના ઘેર કોઈ તીર્થકરનું પ્રથમ પારણું થાય છે તેમને ત્યાં પાંચ આશ્રય થાય છે. (૧) રત્નવર્ષા (૨) દુંદુભીવાદન (૩) જ્ય જ્ય શબ્દનો પ્રસાર (૪) સુગંધી વાયુનો સંચાર અને (૫) પુષ્પોની વર્ષા. (જુઓ તિ. ૫. ગાથા ૪, ૬૭૧ થી ૬૭૪). તે પ્રમાણે ભગવાન આદિનાથે જ્યારે રાજા શ્રેયાંસને ઘેર પ્રથમ પારણું કર્યું હતું. ત્યારે તેના ઘરમાં પણ રત્નોનો વરસાદ વરસ્યો હતો. તેનો જ નિર્દેશ અહીં શ્રી પદ્મનંદી મુનિએ કર્યો છે. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

પ્રાપેઽપિ દુર્લભતરે�પિ મનુષ્યભાવે
સ્વનેન્દ્રજાલસદ્ધે�પિ હિ જીવિતાદૌ ।
યે લોભકૂપકુહરે પતિતાઃ પ્રવક્ષ્યે
કારુણ્યતઃ ખલુ તદુદ્ધરણાય કિંચિત् ॥૪॥

અનુવાદ : જે મનુષ્ય પર્યાય અતિશય દુર્લભ છે તે પ્રાપ્ત થવા છતાં પણ તથા જીવન આદિ સ્વખન અને ઈન્દ્રજાળ સમાન વિનશ્ચર હોવા છતાં પણ જે પ્રાણી લોભરૂપ અંધકારયુક્ત ઝૂવામાં પડેલા છે તેમના ઉદ્ધાર માટે દ્યાળુ બુદ્ધિથી અહીં કેટલુંક દાનનું વર્ણન કર્યું છે. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

કાન્તાત્મજદ્રવિણમુખ્યપદાર્થસાર્થપ્રોત્થાતિઘોરઘનમોહમહાસમુદ્રે ।
પોતાયતે ગૃહિણિ સર્વગુણાધિકત્વાદ્વાનં પરં પરમસાત્ત્વિકભાવયુત્તમ્ ॥૫॥

અનુવાદ : જે ગૃહસ્થ જીવન સ્ત્રી, પુત્ર અને ધન આદિ પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલ અત્યંત ભયાનક અને વિસ્તૃત મોહના વિશાળ સમુદ્ર સમાન છે તે ગૃહસ્થ જીવનમાં ઉત્તમ સાત્ત્વિક ભાવથી આપવામાં આવેલું ઉત્કૃષ્ટ દાન સમસ્ત ગુણોમાં શ્રેષ્ઠ હોવાથી નૌકાનું કામ કરે છે.

વિશેખાર્થ : આ ગૃહસ્થ જીવનમાં પ્રાણીને, સ્ત્રી, પુત્ર અને ધન આદિથી સદા મોહ રહ્યા કરે છે; કે જેથી તે અનેક પ્રકારના આરંભોમાં પ્રવૃત્ત થઈને પાપનો સંચય કર્યા કરે છે. આ પાપને નાશ કરવાનો જો તેની પાસે કોઈ ઉપાય હોય તો તે દાન જ છે. આ દાન સંસારરૂપી સમુદ્રથી પાર થવાને માટે જહાજ સમાન છે. ૫.

(શાર્દૂલવિક્રીડિત)

નાનાજનાશ્રિતપરિગ્રહસંભૃતાયા:
સત્યાત્રદાનવિધિરેવ ગૃહસ્થતાયા: ।
હેતુઃ પરઃ શુભગતેર્વિષમે ભવેઽસ્મિન્
નાવઃ સમુદ્ર ઇવ કર્મઠકર્ણધારઃ ॥૬॥

અનુવાદ : આ વિષમ સંસારમાં જુદા જુદા કુટુંબી આદિ જનોના આશ્રયે પરિગ્રહથી પરિપૂર્ણ એવી ગૃહસ્થ અવસ્થાના શુભ પ્રવર્તનનું કારણ એક માત્ર સત્પાત્રદાનની વિધિ જ છે જેમ સમુદ્રથી પાર થવા માટે ચતુર નાવિકથી સંચાલિત નાવ કારણ છે.

વિશેખાર્થ : જે દાન દેવાને યોગ્ય છે તેને પાત્ર કહેવાય છે. તે ઉત્તમ, મધ્યમ અને જીવન્યના ભેદથી ત્રણ પ્રકારના છે. એમાં સકળ ચારિત્ર (મહાક્રત) ધારણ કરનાર મુનિને ઉત્તમ પાત્ર, વિકળ ચારિત્ર (દેશવત્ત) ધારણ કરનાર શ્રાવકને મધ્યમ પાત્ર અને પ્રતરહિત સમ્યગદાસ્તિને જીવન્ય પાત્ર સમજવા જોઈએ. આ પાત્રોને જો મિથ્યાદાસ્તિ જીવ આહારાદિ આપે છે તો તે યથાક્રમે (ઉત્તમ પાત્ર આદિ અનુસાર) ઉત્તમ, મધ્યમ અને જીવન્ય ભોગભૂમિના સુખ ભોગવીને ત્યાર પછી યથા સંભવ દેવપર્યાયને પ્રાપ્ત કરે છે, પણ જો ઉપર્યુક્ત પાત્રોને જ સમ્યગદાસ્તિ જીવ આહાર આદિ આપે છે તો તે નિયમથી ઉત્તમ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કારણ એ છે કે સમ્યગદાસ્તિ જીવને એક માત્ર દેવાયુનો જ બંધ થાય છે. આમના સિવાય જે જીવ સમ્યગદર્શનથી રહિત હોવા છતાં પણ પ્રતોનું પરિપાલન કરે છે તે કુપાત્ર કહેવાય છે. કુપાત્રદાનના પ્રભાવથી પ્રાણી કુભોગભૂમિઓ (અંતરદીપો)માં કુમનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે. જે પ્રાણી ન તો સમ્યગદાસ્તિ છે, અને ન પ્રતોનું પણ પાલન કરે છે તે અપાત્ર કહેવાય છે અને એવા અપાત્રને આપવામાં આવેલું દાન વર્થ જાય છે—તેનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી જેમ કે ઉજ્જવલ ભૂમિમાં વાવેલું બીજ. એટલું અવશ્ય છે કે અપાત્ર હોવા છતાં પણ જે પ્રાણી વિકલાંગ (લંગડા, આંધળા વગેરે) અથવા અસહાય છે તેમને દ્યાપૂર્વક આપવામાં આવેલું દાન (દ્યાદત્તિ) વર્થ નથી જતું. પરંતુ તેનાથી ય યથાયોગ્ય પુરુષ કર્મનો બંધ અવશ્ય થાય છે. ૬.

(વસંતતિલકા)

આયાસકોટિભિરૂપાર્જિતમઙ્ગ્લજેભ્યો
યજ્ઞીવિતાદપિ નિજાદ્યિતં જનાનામ્ ।
વિત્તસ્ય તસ્ય સુગતિઃ ખલુ દાનમેક-
મન્યા વિપત્તય ઇતિ પ્રવદન્તિ સત્તઃ ॥૭॥

અનુવાદ : કરોડો પરિશ્રમોથી સંચિત કરેલું જે ધન પ્રાણીઓને પુત્રો અને પોતાના પ્રાણોથી પણ અધિક પ્રિય લાગે છે તેનો સદ્ગુપ્યોગ કેવળ દાન દેવામાં જ થાય છે, એનાથી વિરુદ્ધ દુર્વ્યસનાદિમાં તેનો ઉપયોગ કરવાથી પ્રાણીને કષ જ ભોગવવા પડે છે; એવું સાધુજનોનું કહેવું છે. ૭.

(વસંતતિલકા)

ભુક્ત્યાદિભિઃ પ્રતિદિનं ગૃહિણો ન સમ્યડ-
નષ્ટા રમાપિ પુનરેતિ કદાચિદત્ર ।
સત્પાત્રદાનવિધિના તુ ગતાષ્ટુદેતિ
ક્ષેત્રસ્થબીજમિવ કોટિગુણં વટસ્થ ॥૮॥

અનુવાદ : લોકમાં પ્રતિદિન ભોજન આદિ દ્વારા નાશ પામેલી ગૃહસ્થની લક્ષ્મી (સંપત્તિ) અહીં ફરીથી કદી પણ પ્રાપ્ત થતી નથી. પરંતુ ઉત્તમ પાત્રોને આપવામાં આવેલ દાનની વિધિથી વ્યય પામેલી સંપત્તિ ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. જેમ ઉત્તમ ભૂમિમાં વાવેલું વડવૃક્ષનું બીજ કરોડગણું ફળ આપે છે. ૮.

(વસંતતિલકા)

યો દત્તવાનિહ મુમુક્ષુજનાય ભુક્તિં
ભક્ત્યાશ્રિતઃ શિવપથે ન ધૃતઃ સ એવ ।
આત્માપિ તેન વિદધત્સુરસઙ્ગ નૂન-
મુચ્ચૈઃ પદં બ્રજતિ તત્સહિતોऽપિ શિલ્પી ॥૯॥

અનુવાદ : જે શ્રાવકે અહીં મોક્ષાભિલાષી મુનિને ભક્તિપૂર્વક આહાર આપ્યો છે તેણે કેવળ તે મુનિને જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત નથી કર્યા પણ પોતાની જાતને પણ તેણે મોક્ષમાર્ગમાં લગાવી છે. બરાબર જ છે-મંદિર બનાવનાર કારીગર પણ નિશ્ચયથી તે મંદિરની સાથે જ ઊંચા સ્થાન ઉપર ચાલ્યો જાય છે.

વિશેષાર્થ : જેમ દેવાલયને બનાવનાર કારીગર જેમ જેમ દેવાલય ઊંચું થતું જાય છે તેમ તેમ તે પણ ઊંચા સ્થાને ચઢતો જાય છે. બરાબર એવી જ રીતે મુનિને ભક્તિપૂર્વક આહાર આપનાર ગૃહસ્થ પણ ઉક્ત મુનિની સાથે જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. ૯.

(વસંતતિલકા)

યઃ શાકપણિદમપિ ભક્તિરસાનુવિદ્ધ-
બુદ્ધિઃ પ્રયચ્છતિ જનો મુનિપુંગવાય ।
સ સ્યાદનન્તફલભાગથ બીજમુસ્ત
ક્ષેત્રે ન કિ ભવતિ ભૂરિ કૃષીવલસ્ય ॥૧૦॥

અનુવાદ : ભક્તિરસથી અનુરંજિત બુદ્ધિવાળો જે ગૃહસ્થ શ્રેષ્ઠ મુનિને શાકનો આહાર પણ આપે છે તે અનંત ફળ ભોગવનાર થાય છે. યોગ્ય છે-ઉત્તમ ખેતરમાં વાવેલું બીજ શું ખેડૂતને ધાણું ફળ નથી આપતું? અવશ્ય આપે છે. ૧૦.

(વસંતતિલકા)

સાક્ષાન્મનોવચનકાયવિશુદ્ધિશુદ્ધ:
પાત્રાય યચ્છતિ જનો નનુ ભુક્તિમાત્રમ् ।
યસ્તસ્ય સંસ્તિસમુત્તરણૈકબીજે
પુણ્યે હરિર્ભવતિ સોડપિ કૃતાભિલાષઃ ॥૧૧॥

અનુવાદ : મન, વચન અને કાયાની શુદ્ધિથી વિશુદ્ધ થયેલ જે મનુષ્ય સાક્ષાત્ પાત્ર (મુનિ આદિ)ને કેવળ આહાર જ આપે છે તેના સંસારથી પાર ઉત્તારવામાં અદ્વિતીય કારણસ્વરૂપ પુણ્યના વિષયમાં તે ઈન્દ્ર પણ અભિલાષા યુક્ત હોય છે. અભિપ્રાય એમ છે કે એનાથી જે તેને પુણ્યની પ્રાપ્તિ થવાની છે તેને ઈન્દ્ર પણ ઈચ્છે છે. ૧૧.

(વસંતતિલકા)

મોક્ષસ્ય કારણમભિષુતમત્ર લોકે
તદ્વાર્યતે મુનિભિરઙ્ગબલાત્તદન્નાત્ર ।
તદીયતે ચ ગૃહિણા ગુરુભક્તિભાજા
તસ્માદૃતો ગૃહિજનેન વિમુક્તિમાર્ગ: ॥૧૨॥

અનુવાદ : લોકમાં મોક્ષના કારણભૂત જે રત્તાર્થની સ્તુતિ કરવામાં આવે છે તે મુનિઓ દ્વારા શરીરની શક્તિથી ધારણ કરવામાં આવે છે, તે શરીરની શક્તિ ભોજનથી પ્રાપ્ત થાય છે અને તે ભોજન અતિશય ભક્તિપૂર્વક ગૃહસ્થ દ્વારા આપવામાં આવે છે. એ જ કારણે વાસ્તવમાં તે મોક્ષમાર્ગ ગૃહસ્થોએ જ ધારણ કર્યો છે. ૧૨.

(વસંતતિલકા)

નાનાગૃહબ્રતિકરાર્જિતપાપપુઞ્જૈ:
ખજીકૃતાનિ ગૃહિણો ન તથા બ્રતાનિ ।
ઉચ્ચૈ: ફલં વિદ્ધતીહ યથૈકદાપિ
પ્રીત્યાતિશુદ્ધમનસા કૃતપાત્રદાનમ् ॥૧૩॥

અનુવાદ : લોકમાં અત્યંત વિશુદ્ધ મનવાળા ગૃહસ્થદ્વારા પ્રીતિપૂર્વક પાત્રને એક વાર પણ આપવામાં આવેલું દાન જેવું ઉન્નત ફળ આપે છે તેવું ફલ ગૃહની અનેક ઝંજટોથી ઉત્પન્ન થયેલ પાપ સમૂહો દ્વારા કૂબડા અર્થાત્ શક્તિહીન કરવામાં આવેલા ગૃહસ્થના પ્રત કરતા નથી. ૧૩.

(વસંતતિલકા)

મૂલે તનુસ્તદનુ ધાવતિ વર્ધમાના
યાવચ્છિવં સરિદિવાનિશમાસમુદ્રમ् ।
લક્ષ્મી: સદ્દાષ્પુરુષસ્ય યતીન્દ્રદાન-
પુણ્યાત્પુર: સહ યશોભિરતીદ્વફેનૈ: ॥૧૪॥

અનુવાદ : સમ્યાદષ્ટિ પુરુષની લક્ષ્મી મૂળમાં અલ્ય હોવા છતાં પણ ત્યાર પછી મુનિરાજને આપવામાં આવેલ દાનથી ઉત્પન્ન થયેલ પુરુષના પ્રભાવથી ક્રીતિ સાથે નિરંતર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી થકી મોક્ષપર્યત જાય છે-જેમ-નદી મૂળમાં કૃશ હોવા છતાં પણ અતિશય તેજસ્વી ઝીણ સાથે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમુક સુધી જાય છે.

વિશેષાર્થ : જેમ નદીને ઉદ્ગમસ્થાનમાં તેનો વિસ્તાર જો કે બહુ જ થોડો હોય છે, છતાં પણ તે સમુકપર્યત પહોંચતા ઉત્તરોત્તર વધતો જ જાય છે. એની સાથે નદીના ઝીણ પણ તે જ ક્રમે વધતા જાય છે. તેવી જ રીતે સમ્યાદષ્ટિ જીવની ધન-સંપત્તિ પણ જો કે શરૂઆતમાં બહુ થોડી હોય છે તોપણ તે આગળ ભક્તિપૂર્વક કરવામાં આવેલા પાત્રદાનથી જે પુરુષબંધ થાય છે તેના પ્રભાવથી મુક્તિની પ્રાપ્ત થવા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામતી જાય છે. તેની સાથે જ ઉક્ત દાતા શ્રાવકની ક્રીતિનો પ્રસાર પણ વધતો જાય છે. ૧૪.

(વસંતતિલકા)

પ્રાય: કુતો ગૃહગતે પરમાત્મબોધ:
શુદ્ધાત્મનો ભુવિ યતઃ પુરુષાર્થસિદ્ધિ: ।
દાનાત્પુનર્નનુ ચતુર્વિધતઃ કરસ્થા
સા લીલયૈવ કૃતપાત્રજનાનુષંગાત् ॥૧૫॥

અનુવાદ : જગતમાં જે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપના જ્ઞાનથી શુદ્ધ આત્માના પુરુષાર્થની સિદ્ધિ થાય છે તે આત્મજ્ઞાન ગૃહમાં સ્થિત મનુષ્યને પ્રાય: કચાંથી થઈ

શકે? અર્થાત् થઈ શકતું નથી. પણ તે પુરુષાર્થની સિદ્ધિ પાત્ર જનોને આપવામાં આવેલ ચાર પ્રકારના દાનથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. ૧૫.

(વસંતતિલકા)

નામાપિ યઃ સ્મરતિ મોક્ષપથસ્ય સાધો-
રાશુ ક્ષયં બ્રજતિ તહુરિતિ સમસ્તમ્ |
યો ભક્તભેષજમઠાદિકૃતોપકારઃ
સંસારમુત્તરતિ સોઽત્ર નરો ન ચિત્તમ् ॥૧૬॥

અનુવાદ : જે મનુષ્ય મોક્ષમાર્ગમાં સ્થિત સાધુનું કેવળ નામસ્મરણ પણ કરે છે તેના સમસ્ત પાપ શીધ જ નાશ પામી જાય છે. વળી જે મનુષ્ય ઉક્ત સાધુને ભોજન, ઔષધ અને મઠ (ઉપાશ્રય) આદિ દ્વારા ઉપકાર કરે છે તે જો સંસારથી પાર થઈ જાય છે તો તેમાં ભલા આશ્રય જ શું છે? કાંઈ પણ નહિ. ૧૬.

(વસંતતિલકા)

કિં તે ગૃહાઃ કિમિહ તે ગૃહિણો નુ યેષા-
મન્તર્મનસુ મુનયો ન હિ સંચરન્તિ ।
સાક્ષાદથ સ્મृતિવશાચ્ચરણોદકેન
નિત્ય પવિત્રિતધરાગ્રશિરઃપ્રદેશાઃ ॥૧૭॥

અનુવાદ : જે મુનિઓ સાક્ષાત્ પોતાના પાદોદકથી ગૃહગત પૃથ્વીના અગ્રભાગને સદા પવિત્ર કરતા રહે છે એવા મુનિઓ જે ગૃહોમાં સાક્ષાત્ સંચાર કરતા નથી તે ઘર શું છે? અર્થાત् એવા ગૃહોનું કાંઈ પણ મહત્વ નથી. એ જ રીતે સ્મરણ વશે પોતાના ચરણ જીણ દ્વારા શ્રાવકોના શિર પ્રદેશોને પવિત્ર કરનાર તે મુનિઓ જે શ્રાવકોનાં મનમાં સંચાર કરતા નથી તે શ્રાવક પણ શું છે? અર્થાત્ તેમનું કાંઈ પણ મહત્વ નથી.

વિશેખાર્થ : અભિપ્રાય એવો છે કે જે ઘરોમાં આહારાદિના નિમિત્તે મુનિઓનું આવાગમન થતું રહે છે તે જ ઘર વાસ્તવમાં સફળ છે. એ જ રીતે જે ગૃહસ્થ તે મુનિઓનું મનથી ચિંતન કરે છે તથા તેમને આહારાદિ આપવામાં સદા ઉત્સુક રહે છે તે જ ગૃહસ્થ પ્રશંસાને યોગ્ય છે. ૧૭.

(વસંતતિલકા)

દેવઃ સ કિં ભવતિ યત્ત્ર વિકારભાવો
 ધર્મઃ સ કિં ન કરુણાઙ્ગિષુ યત્ત્ર મુખ્યા ।
 તત્ત્વ કિં તપો ગુરુરથાસ્તિ ન યત્ત્ર બોધઃ
 સા કિં વિભૂતિરિહ યત્ત્ર ન પાત્રદાનમ् ॥૧૮॥

અનુવાદ : જેમને કોધાદિ વિકારભાવ વિદ્યમાન છે તે શું દેવ હોઈ શકે? અર્થાત્ તે કદાપિ દેવ હોઈ શકે નહિ. જ્યાં પ્રાણીઓની બાબતમાં દ્વા મુખ્ય નથી તેને શું ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જેમાં સમ્યગ્યાન નથી તે શું તપ અને ગુરુ હોઈ શકે છે? હોઈ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું નથી તે સંપત્તિ શું સફળ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૮.

(વસંતતિલકા)

કિં તે ગુણાઃ કિમિહ તત્સુખમસ્તિ લોકે
 સા કિં વિભૂતિરથ યા ન વશં પ્રયાતિ ।
 દાનવ્રતાદિજનિતો યદિ માનવસ્ય
 ધર્મો જગત્ત્રયવશીકરણૈકમન્ત્રઃ ॥૧૯॥

અનુવાદ : જો મનુષ્યની પાસે ત્રણે લોકને વશીભૂત કરવા માટે અદ્ધ્યતીય વશીકરણમંત્ર સમાન દાન અને વ્રત આદિથી ઉત્પન્ન થયેલ ધર્મ વિદ્યમાન હોય તો એવા ક્યા ગુણ છે જે તેના વશ ન થઈ શકે? તે ક્યથું સુખ છે જે તેને પ્રાપ્ત ન થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેવ પ્રાપ્ત થઈ જાય છે. ૧૯.

(વસંતતિલકા)

સત્પાત્રદાનજનિતોન્તત્પુણ્યરાશિ-
 રેકત્ર વા પરજને નરનાથલક્ષ્મીઃ ।
 આદ્યાત્પરરસ્તદપિ દુર્ગત એવ યસ્મા-
 દાગામિકાલફલદાયિ ન તત્સ્ય કિંચિત્ ॥૨૦॥

અનુવાદ : એક મનુષ્ય પાસે ઉત્તમ પાત્રને આપેલ દાનથી ઉત્પન્ન પુષ્યનો સમૂહ છે અને બીજા મનુષ્ય પાસે રાજ્યલક્ષ્મી વિદ્યમાન છે. છતાં પણ પ્રથમ મનુષ્યની અપેક્ષાએ દ્વિતીય મનુષ્ય દરિદ્ર જ છે કારણ કે તેની પાસે આગામી કાળમાં ફળ આપનાર કાંઈ પણ બાકી નથી.

વિશેખાર્થ : અભિપ્રાય એ છે કે સુખનું કારણ એક માત્ર પુષ્યનો સંચય જ હોય છે. એ જ કારણે જે વ્યક્તિએ પાત્રદાનાદિ દ્વારા એવા પુષ્યનો સંચય કરી લીધો છે તે આગામી કાળમાં સુખી રહેશે. પણ જે વ્યક્તિએ એવા પુષ્યનો સંચય કર્યો નથી તે વર્તમાનમાં રાજ્યલક્ષ્મીથી સંપન્ન હોવા છતાં પણ ભવિષ્યમાં દુઃખી જ રહેશે. ૨૦.

(વસંતતિલકા)

દાનાય યસ્ય ન ધનं ન વપુર્વત્તાય
નैવं શ્રુતં ચ પરમોપશમાય નિત્યમ् ।
તજ્જન્મ કેવલમલં મરણાય ભૂરિ-
સંસારદુઃખમૃતિજાતિનિબન્ધનાય ॥૨૧॥

અનુવાદ : જેનું ધન દાન માટે નથી, શરીર વ્રત માટે નથી એ જ રીતે શાસ્ત્રાભ્યાસ કષાયોના ઉત્કૃષ્ટ ઉપશમ માટે નથી; તેનો જન્મ કેવળ સાંસારિક દુઃખ, મરણ અને જન્મના કારણભૂત મરણ માટે જ હોય છે.

વિશેખાર્થ : જે મનુષ્ય પોતાના ધનનો સદ્ગુપ્યોગ દાનમાં કરતો નથી, શરીરનો સદ્ગુપ્યોગ વ્રત ધારણમાં કરતો નથી તથા આગમમાં નિપુણ હોવા છતાં પણ કષાયોનું દમન કરતો નથી તે વારંવાર જન્મ-મરણ ધારણ કરતો સાંસારિક દુઃખ જ સહન કર્યા કરે છે. ૨૧.

(વસંતતિલકા)

પ્રાપ્તે નૃજન્મનિ તપઃ પરમસ્તુ જન્તો:
સંસારસાગરસમુત્તરણૈકસેતુઃ ।
મા ભૂદ્વિભૂતિરિહ બન્ધનહેતુરેવ
દેવે ગુરૌ શમિનિ પૂજનદાનહીના ॥૨૨॥

અનુવાદ : મનુષ્યજન્મ પ્રાપ્ત થતાં જીવે ઉત્તમ તપ ગ્રહણ કરવું જોઈએ કેમ કે તે સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે અપૂર્વ પુલ સમાન છે. તેની પાસે

દેવ, ગુરુ અને મુનિની પૂજા અને દાનથી રહિત વૈભવ ન હોવો જોઈએ, કેમકે એવો વૈભવ એક માત્ર બંધનું જ કારણ થાય છે. ૨૨.

(વસંતતિલકા)

ભિક્ષા વરં પરિહૃતાખિલપાપકારિ-
કાર્યાનુબન્ધવિધુરાશ્રિતચિત્તવૃત્તિઃ ।
સત્પાત્રદાનરહિતા વિતતોગ્રદુઃખ-
દુલ્લંઘદુર્ગતિકરી ન પુનવિભૂતિઃ ॥૨૩॥

અનુવાદ : પાપ ઉત્પન્ન કરનાર સમસ્ત કાર્યોના સંબંધ રહિત એવી ચિત્તવૃત્તિનો આશ્રય કરનારી ભિક્ષા કચાંય શ્રેષ્ઠ છે પણ સત્પાત્રદાન રહિત થઈને વિપુલ અને તીવ્ર દુઃખોથી પરિપૂર્ણ દુર્લઘ્ય નરકાદિરૂપ દુર્ગતિ કરનારી વિભૂતિ શ્રેષ્ઠ નથી. ૨૩.

(વસંતતિલકા)

પૂજા ન ચેજિનપતેઃ પદપઙ્કજેષુ
દાનં ન સંયતજનાય ચ ભક્તિપૂર્વમ् ।
નો દીયતે કિમુ તતઃ સદનસ્થિતાયા:
શીગ્રં જલાઞ્જલિરગાધજલે પ્રવિશ્ય ॥૨૪॥

અનુવાદ : જે ગૃહસ્થાવસ્થામાં જિનેન્દ્ર ભગવાનના ચરણ-કમળોની પૂજા કરવામાં આવતી નથી તથા ભક્તિપૂર્વક સંયમીજનોને દાન આપવામાં આવતું નથી તે ગૃહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીધ ડૂબાડી ન દેવી જોઈએ? અર્થાત્ અવશ્ય ડૂબાડી દેવી જોઈએ. ૨૪.

(વસંતતિલકા)

કાર્ય તપઃ પરમિહ ભ્રમતા ભવાદ્યૌ
માનુષ્યજન્મનિ ચિરાદતિદુઃખલબ્ધે ।
સંપદ્યતે ન તદણુત્રતિનાપિ ભાવં
જાયેત ચેદહરહઃ કિલ પાત્રદાનમ् ॥૨૫॥

અનુવાદ : અહીં સંસારરૂપ સમુદ્રમાં પરિભ્રમણ કરતાં જો ઘણાં કાળે મહાન દુઃખથી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ ગઈ છે તો તેને પામીને ઉત્કૃષ્ટ તપ કરવું જોઈએ. જો કદાચ તે તપ ન કરી શકાય તો અણુવતી જ થઈ જવું જોઈએ કે જેથી પ્રતિદિન પાત્રદાન થઈ શકે. ૨૫.

(વસંતતિલકા)

ગ્રામાન્તરં બ્રજતિ યઃ સ્વગૃહાદ્ગૃહીત્વા
પાથેયમુન્તતરં સ સુખી મનુષ્યઃ ।
જન્માન્તરં પ્રવિશતો ઽસ્ય તથા બ્રતેન
દાનેન ચાર્જિતશુભં સુખહેતુરેકમ् ॥૨૬॥

અનુવાદ : જે મનુષ્ય પોતાના ઘેરથી ઘણો નાસ્તો (માર્ગમાં ખાવા યોગ્ય પક્વાન વગેરે) લઈને બીજા કોઈ ગામ જાય છે તે જેમ સુખી રહે છે તેવી જ રીતે બીજા જન્મમાં પ્રવેશવાને માટે પ્રવાસ કરનાર આ જીવને બ્રત અને દાનથી કમાયેલું એક માત્ર પુણ્ય જ સુખનું કારણ થાય છે. ૨૬.

(વસંતતિલકા)

યતઃ કૃતોऽપિ મદનાર્થયશોનિમિત્તં
દૈવાદિહ બ્રજતિ નિષ્ફલતાં કદાચિત્ત્ર ।
સંકલ્પમાત્રમાપિ દાનવિધૌ તુ પુણ્ય
કુર્યાદસત્યપિ હિ પાત્રજને પ્રમોદાત् ॥૨૭॥

અનુવાદ : અહીં કામ, અર્થ અને યશ માટે કરવામાં આવેલો પ્રયત્ન ભાગ્યવશ કદાચ નિષ્ફળ પણ થઈ જાય છે. પરંતુ પાત્રજનના અભાવમાં પણ હર્ષપૂર્વક દાનના અનુષ્ઠાનમાં કરવામાં આવેલો કેવળ સંકલ્પ પણ પુણ્ય કરે છે. ૨૭.

(વસંતતિલકા)

સદ્ગ્રાગતે કિલ વિપક્ષજને ઽપિ સત્તઃ
કુર્વન્તિ માનમતુલં વચનાસનાદ્યૈ: ।
યત્તત્ર ચારુગુણરત્ન નિધાનભૂતै
પાત્રે મુદા મહતિ કિં ક્રિયતે ન શિષ્ટૈ: ॥૨૮॥

અધિકાર-૨ : દાનાં ઉપદેશ]

૧૧૧

અનુવાદ : પોતાના ધેર શત્રુઓ આવે તો પણ સજજન મનુષ્ય વચન અને આસનદાન વગેરે દ્વારા તેનો અનુપમ આદર-સત્કાર કરે છે. તો પછી શું ઉત્તમ ગુણોરૂપ રત્નોના આશ્રયભૂત ઉત્કૃષ્ટ પાત્ર ત્યાં પહોંચતા સજજન હર્ષથી આદર-સત્કાર નથી કરતા? અર્થાત્ તેઓ અવશ્યમેવ દાનાંદિ દ્વારા તેનું યથાયોગ્ય સન્માન કરે છે. ૨૮.

(વસંતતિલકા)

સૂનોરૂતેરાપિ દિનં ન સત્સ્તથા સ્યાદ्
બાધાકરં બત યથા મુનિદાનશૂન્યમ् ।
દુર્વારદુષ્ટવિધિના ન કૃતે હ્યકાર્યે
પુંસા કૃતે તુ મનુતે મતિમાનનિષ્ટમ् ॥૨૯॥

અનુવાદ : સજજન મનુષ્યને માટે પોતાના પુત્રના મૃત્યુનો દિવસ પણ એટલો બાધક નથી હોતો જેટલો મુનિદાનથી રહિત દિવસ તેમને માટે બાધક હોય છે. બરાબર છે-દુર્નિવાર દુષ્ટ દૈવ દ્વારા કુસ્તિત કાર્ય કરવામાં આવતા બુદ્ધિમાન મનુષ્ય તેને અનિષ્ટ નથી માનતા પરંતુ મનુષ્ય દ્વારા એવું કોઈ કામ કરવામાં વિવેકી પ્રાણી તેને અનિષ્ટ માને છે.

વિશેખાથ્ય : જો કોઈ વિવેકી મનુષ્યના ધરમાં પુત્રનું મરણ થઈ જાય તો તે શોકાકુળ થતા નથી કારણ કે તે જાણે છે કે આ પુત્ર વિયોગ પોતાના પૂર્વોપાર્જિત કર્મના ઉદ્યથી થયો છે કે જે કોઈ પણ પ્રકારે ટાળી શકાતો નથી. પરંતુ તેને ત્યાં જો કોઈ દિવસ સાથું પુરુષને આહારદાન આપવામાં આવતું નથી તો તે એના માટે પશ્ચાત્તાપ કરે છે. એનું કારણ એ છે કે તે તેની અસાવધાનીથી થયું છે, એમાં દૈવ કંઈ બાધક થયું નથી. જો તેણે સાવધાન રહીને દ્વાર પાસે પ્રતીક્ષા આદિ કરી હોત તો મુનિદાનનો સુયોગ તેને પ્રાપ્ત થઈ શક્યો હોત. ૨૯.

(વસંતતિલકા)

યे ધર્મકારણસમુલ્લસિતા વિકલ્પા-
સ્ત્યાગેન તે ધનયુતસ્ય ભવન્તિ સત્યાઃ ।
સૃષ્ટાઃ શશાઙ્કકિરણૈરમૃતં ક્ષરન્ત-
શ્વન્દોપલાઃ કિલ લભન્ત ઇહ પ્રતિષ્ઠામ् ॥૩૦॥

અનુવાદ : ધર્મના સાધન માટે જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે ધનવાન

મનુષ્યના દાન દ્વારા સત્ય બને છે. બરાબર છે—ચન્દ્રકાન્તમણિ ચન્દ્રના કિરણોનો સ્પર્શ પામીને અમૃત વહેવરાવીને જ અહીં પ્રતિષ્ઠા પામે છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પાત્રને દાન આપનાર શ્રાવક આ ભવમાં ઉક્ત દાન દ્વારા લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જેમ કે—ચન્દ્રકાન્તમણિથી બનાવેલ ભવનને જોવા છતાં પણ સાધારણ મનુષ્ય ઉક્ત ચન્દ્રકાન્ત મણિનો પરિચય પામતો નથી. પણ ચન્દ્રમાનો ઉદ્ય થતાં જ્યારે ઉક્ત ભવનમાંથી પાણીનો પ્રવાહ વહેવા લાગે છે ત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ એમ સમજી લે છે કે ઉક્ત ભવન ચન્દ્રકાન્ત મણિથી બનાવેલ છે, તેથી તે તેમની પ્રશંસા કરે છે. બરાબર એ જ રીતે વિવેકી દાતા જિનમંદિર આદિનું નિર્માણ કરાવીને પોતાની સંપત્તિનો સદ્ગુણ્યોગ કરે છે. તે જો કે પોતે પોતાની પ્રતિષ્ઠા ઈચ્છતા નથી છતાં પણ ઉક્ત જિનમંદિર આદિનું અવલોકન કરનાર અન્ય મનુષ્યો તેની પ્રશંસા કરે છે. આ તો થઈ આ જન્મની વાત. આની સાથે જ પાત્રદાનાદિ ધર્મકાર્યો દ્વારા જે તેને પુણ્યલાભ થાય છે તેનાથી તે પર જન્મમાં પણ સંપન્ન અને સુખી થાય છે. ૩૦.

(વસંતતિલકા)

મન્દાયતે ય ઇહ દાનવિધૌ ધને ઽપિ
સત્યાત્મનો વદતિ ધાર્મિકતાં ચ યત્તત્ત્વ ।
માયા હૃદિ સુરતિ સા મનુજસ્ય તસ્ય
યા જાયતે તડિદમુત્ર સુખાચલેષુ ॥૩૧॥

અનુવાદ : જે મનુષ્ય ધન હોવા છતાં પણ દાન દેવામાં ઉત્સુક તો થતો નથી પરંતુ પોતાની ધાર્મિકતા પ્રગટ કરે છે તેના હૃદયમાં જે કુટિલતા રહે છે તે પરલોકમાં તેના સુખરૂપી પર્વતોના વિનાશ માટે વીજળીનું કામ કરે છે. ૩૧.

(વસંતતિલકા)

ગ્રાસस્તદર્ધમણિ દેયમથાર્થમેવ
તસ્યાપિ સંતતમણુગ્રતિના યથર્દ્વિ ।
ઇચ્છાનુરૂપમિહ કસ્ય કદાત્ર લોકે
દ્રવ્ય ભવિષ્યતિ સદુત્તમદાનહેતુ: ॥૩૨॥

અનુવાદ : અશુશ્રતી ગૃહસ્થે નિરંતર પોતાની સંપત્તિ પ્રમાણે એક ગ્રાસ, અડધો ગ્રાસ અથવા તેનો પણ અડધો ભાગ અર્થાત્ ગ્રાસનો એક ચતુર્થાંશ પણ દેવો

અધિકાર-૨ : દાનાં ઉપદેશ]

૧૧૩

જોઈએ. કારણ એ કે અહીં લોકમાં પોતાની ઈચ્છાનુસાર દ્રવ્ય કોને ક્યારે મળશે કે જે ઉત્તમ પાત્રદાનનું કારણ થઈ શકે, એ કંઈ પણ કહી શકતું નથી.

વિશેષાર્� : જેમની પાસે અધિક દ્રવ્ય હોતું નથી તેઓ ઘણું કરીને વિચાર કર્યા કરે છે કે જ્યારે પૂર્તું ધન મળશે ત્યારે આપણો દાન કરીશું. એવા જ મનુષ્યોને લક્ષમાં રાખીને અહીં એમ કહેવામાં આવ્યું છે કે ઘણું કરીને ઈચ્છાનુસાર દ્રવ્ય કદી કોઈને પણ પ્રાપ્ત થતું નથી માટે પોતાની પાસે જે કંઈ દ્રવ્ય છે તે પ્રમાણે પ્રત્યેક મનુષ્યે પ્રતિદિન થોડું દાન આપવું જ જોઈએ. ઉ૨.

(વસંતતિલકા)

મિથ્યાદશો ઽપિ રુचિરેવ મુનીન્દ્રદાને
દ્યાત્ર પશોરપિ હિ જન્મ સુભોગભૂમૌ ।
કલ્પાઙ્ગિધ્રપા દદતિ યત્ર સદેસ્પિતાનિ
સર્વાણિ તત્ર વિદ્ધાતિ ન કિં સુદૃષ્ટે: ॥૩૩॥

અનુવાદ : મિથ્યાદશી પશુને પણ મુનિરાજને દાન આપવામાં જે કેવળ રૂચિ હોય છે તેનાથી જ તે, ઉત્તમ ભોગભૂમિમાં જન્મ લે છે કે જ્યાં કલ્પવૃક્ષ સદા તેને સર્વ પ્રકારના ઈચ્છિત પદાર્�ો આપે છે. તો પછી જો સમ્યાદાણિ તે પાત્રદાનમાં રૂચિ રાખે તો તેને શું પ્રાપ્ત ન થાય? અર્થાત્ તેને તો નિશ્ચિતપણે જ વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ઉ૩.

(વસંતતિલકા)

દાનાય યસ્ય ન સમુત્સહતે મનીષા
તદ્યોગ્યસપદિ ગૃહાભિમુહે ચ પાત્રે ।
પ્રાપ્તં ખનાવતિમહાર્થતરં વિહાય
રત્નं કરોતિ વિમતિસ્તલભૂમિભેદમ् ॥૩૪॥

અનુવાદ : દાન યોગ્ય સંપત્તિ હોવા છતાં અને પાત્ર પણ પોતાના ઘર સમીપે આવવા છતાં જે મનુષ્યની બુદ્ધિ દાન માટે ઉત્સાહિત થતી નથી તે દુબુદ્ધિ ખાણમાંથી પ્રાપ્ત થયેલ અતિશય મૂલ્યવાન રત્ન છોડી દઈને પૃથ્વીનું તળિયું વ્યર્થ ખોટે છે. ઉ૪.

(વસંતતિલકા)

નષ્ટા મળીરિવ ચિરાજીલધૌ ભવે ઇસ્મિ-
ન્નાસાદ્ય ચારુનરતાર્થજિનેશ્વરાજ્ઞાઃ ।
દાનં ન યસ્ય સ જડઃ પ્રવિશેત્તુ સમુદ્રં
સચ્છિદ્રનાવમધિરુહ્ય ગૃહીતરત્નઃ ॥૩૫॥

અનુવાદ : ધણા લાંબા સમયથી સમુદ્રમાં નષ્ટ થયેલ મણિ સમાન આ ભવમાં ઉત્તમ મનુષ્ય પર્યાય, ધન અને જિનવાળી પામીને જે દાન કરતો નથી તે મૂર્ખ રત્નો લઈને છિદ્રવાળી નૌકામાં બેસીને સમુદ્રમાં પ્રવેશ કરે છે.

વિશેષાર્થ : જેવી રીતે સમુદ્રમાં પડેલું મણિનું ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે તેવી જ રીતે મનુષ્ય પર્યાય આદિનું પણ ફરીથી પ્રાપ્ત થવું અતિશય કઠણ છે, તે જો ભાગ્યવશે કોઈને પ્રાપ્ત થઈ જાય અને છતાં પણ જો તે દાનાદિ શુભ કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તો સમજવું જોઈએ કે જેવી રીતે કોઈ મનુષ્ય ખૂબ મૂલ્યવાન રત્નો સાથે લઈને છિદ્રવાળી નાવમાં બેસે છે અને તેથી તે તે રત્નો સાથે પોતે પણ સમુદ્રમાં ઝૂભી જાય છે, આવી જ અવસ્થા ઉક્ત મનુષ્યની પણ થાય છે. કારણ કે ભવિષ્યમાં સુખી થવાનું સાધન જે દાનાદિ કાર્યોથી ઉત્પન્ન થનારું પુણ્ય હતું તેને તેણે મનુષ્ય પર્યાયની સાથે તેને યોગ્ય સંપત્તિ મેળવીને પણ કર્યું જ નહિ. ઉપ.

(વસંતતિલકા)

યસ્યાસ્તિ નો ધનવતઃ કિલ પાત્રદાન-
મસ્મિનું પરત્ર ચ ભવે યશસે સુખાય ।
અન્યેન કેનચિદનૂનસુપુણ્યભાજા
ક્ષિસ્તઃ સ સેવકનરો ધનરક્ષણાય ॥૩૬॥

અનુવાદ : જે પાત્રદાન આ ભવમાં યશનું કારણ તથા પરભવમાં સુખનું કારણ છે તેને જે ધનવાન મનુષ્ય કરતો નથી તે મનુષ્ય જાણો કોઈ બીજા અતિશય પુણ્યશાળી મનુષ્ય દ્વારા ધનના રક્ષણ માટે સેવકના રૂપમાં જ રાખવામાં આવ્યો છે.

વિશેષાર્થ : જો ભાગ્યવશ ધન-સંપત્તિની પ્રાપ્તિ થઈ તો તેનો સદ્ગુપ્યોગ પોતાની યોગ્ય આવશ્યકતાની પૂર્તિ કરતા થકા પાત્રદાનમાં કરતો જોઈએ. પરંતુ જે મનુષ્ય પ્રાપ્ત સંપત્તિનો ન તો સ્વયં ઉપભોગ કરે છે અને ન પાત્રદાન પણ કરે છે તે મનુષ્ય અન્ય ધનવાન મનુષ્ય દ્વારા પોતાના ધનની રક્ષા માટે રાખવામાં આવેલ નોકર સમાન જ છે. કારણ કે જેવી

અધિકાર-૨ : દાનનો ઉપદેશ]

૧૧૫

રીતે ધનની રક્ષા માટે રાખવામાં આવેલ દાસ (મુનીમ આદિ) સ્વયં તે ધનનો ઉપયોગ કરી શકતો નથી પણ કેવળ તેનું રક્ષણ જ કરે છે. બરાબર એ જ રીતે તે ધનવાન મનુષ્ય પણ જ્યારે તે ધન પોતાના ઉપભોગમાં ખરચતો નથી અને પાત્રદાનાદિ પણ કરતો નથી ત્યારે ભલા તે નોકરની અપેક્ષાએ આનામાં શું વિશેષતા રહે છે? કાંઈ પણ નહિ. ઉદ.

(વસંતતિલકા)

चैत्यालये च जिनसूखुधार्चने च
दाने च संयतजनस्य सुदुःखिते च ।
यद्यात्मनि स्वमुपयोगि तदेव नून-
मात्मीयमन्यदिह कस्यचिदन्यपुंसः ॥૩૭॥

અનુવાદ : લોકમાં જે ધન જિનાલયનું નિર્માણ કરાવવામાં, જિનદેવ, આર્યાર્થ અને પંડિત અર્થાત્ ઉપાધ્યાયની પૂજામાં, સંયમી જનોને દાન આપવામાં, અતિશય દુઃખી પ્રાણીઓને પણ દ્યાપૂર્વક દાન આપવામાં તથા પોતાના ઉપભોગમાં પણ કામ આવે છે. તેને જ નિશ્ચયથી પોતાનું ધન સમજવું જોઈએ. તેનાથી વિપરીત જે ધન આ ઉપર્યુક્ત કામોમાં ખરચવામાં આવતું નથી તેને કોઈ બીજા જ મનુષ્યનું ધન સમજવું જોઈએ. ઉદ.

(વસંતતિલકા)

पुण्यक्षयात्क्षयमुपैति न दीयमाना
लक्ष्मीरतः कुरुत संતતपात्रदानम् ।
कूपे न पश्यत जलं गृहिणः सમन्ता-
दाकृष्यमाणमपि वर्धत एव नित्यम् ॥૩૮॥

અનુવાદ : સંપત્તિ પુણ્યનો ક્ષય થવાથી ક્ષય પામે છે, નહિ કે દાન કરવાથી માટે હે શ્રાવકો! તમે નિરંતર પાત્રદાન કરો. શું તમે એ નથી જોતા કે કૂવામાંથી ચારે તરફથી કાઢવામાં આવતું હોવા છતાં પણ પાણી હંમેશા વધતું જ રહે છે. ઉદ.

(વસંતતિલકા)

સર્વાન્ ગુणાનિહ પરત્ર ચ હન્તિ લોભ:
સર્વસ્ય પૂજ્યજનપૂજનહાનિહેતુ: ।

અન્યત્ર તત્ત્વ વિહિતે ઽપિ હિ દોષમાત્ર-
મેકત્ર જન્મનિ પરં પ્રથયન્તિ લોકાઃ ॥૩૯॥

અનુવાદ : પૂજ્ય પુરુષોની પૂજામાં બાધા પહોંચાડનાર લોભ આ લોકમાં અને પરલોકમાં પણ બધાના બધા ગુણો નાચ કરી દે છે. તે લોભ જો ગૃહસંબંધી કોઈ વિવાહાદિ કાર્યોમાં કરવામાં આવે તો લોકો કેવળ એક જન્મમાં જ તેના દોષમાત્રને પ્રસિદ્ધ કરે છે.

વિશેષાર્થ : જો કોઈ મનુષ્ય જિનપૂજન અને પાત્રદાનાદિના વિષયમાં લોભ કરે છે તો એનાથી તેને આ જન્મમાં કીર્તિ આદિનો લાભ થતો નથી અને અન્ય ભવમાં પૂજન-દાનાદિથી ઉત્પન્ન થનાર પુષ્ય રહિત હોવાના કારણે સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતે જે વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં લોભ કરે છે તે બન્નોય લોકમાં પોતાનું અહિત કરે છે. એનાથી વિપરીત જે મનુષ્ય કેવળ વિવાહાદિરૂપ ગૃહસ્થના કાર્યોમાં લોભ કરે છે તેવો માણસ કૃપણ આદિ શબ્દો દ્વારા ફક્ત આ જન્મમાં જ તિરસ્કાર કરી શકે છે પરંતુ પરલોક તેનો સુખમય જ વીતે છે. તેથી જ ગૃહસ્થના કાર્યોમાં કરવામાં આવતો લોભ એટલો નિન્દ્ય નથી જેટલો ધાર્મિક કાર્યોમાં કરવામાં આવતો લોભ નિંદનીય છે. ૪૮.

(વસંતતિલકા)

જાતો ઽપ્યજાત ઇવ સ શ્રિયમાશ્રિતો ઽપિ
રઙ્કઃ કલઙ્કરહિતો ઽપ્યગૃહીતનામા ।
કમ્બોરિવાશ્રિતમૃતેરપિ યસ્ય પુંસ:
શબ્દઃ સમુચ્ચલતિ નો જગતિ પ્રકામમ् ॥૪૦॥

અનુવાદ : મુત્ય પામતાં શંખ સમાન જે પુરુષનું નામ સંસારમાં અતિશય પ્રચલિત થતું નથી તે મનુષ્ય જન્મ લઈને પણ નહિ જન્મ્યા બરાબર થાય છે અર્થાત્ તેનો મનુષ્ય જન્મ લેવો વ્યર્� થાય છે. કારણ કે તે લક્ષ્મી પ્રાપ્ત કરીને પણ દરિદ્રી જેવો રહે છે તથા દોષોથી રહિત હોવા છતાં પણ યશસ્વી થઈ શકતો નથી. ૪૦.

(વસંતતિલકા)

થાપિ ક્ષિતેરપિ વિભુર્જરં સ્વકીયં
કર્મોપનીતવિધિના વિદ્ધાતિ પૂર્ણમ् ।

કિંતુ પ્રશસ્યનૃભવાર્થવિવેકીતાના-
મેતત્પલં યદિહ સંતતપાત્રદાનમ् ॥૪૧॥

અનુવાદ : પોતાના કર્મ પ્રમાણે કુતરો પણ પોતાનું પેટ ભરે છે અને રાજા પણ પોતાનું પેટ ભરે છે. પણ પ્રશંસનીય મનુષ્યભવ, ધન અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહીં એ જ પ્રયોજન છે કે નિરંતર પાત્રદાન આપવામાં આવે. ૪૧.

(વસંતતિલકા)

આયાસકોટિભિરૂપાર્જિતમઙ્ગ્લજેભ્યો
યજીવિતાદપિ નિજાદ્વિતિં જનાનામ् ।
વિત્તસ્ય તસ્ય નિયતં પ્રવિહાય દાન-
મન્યા વિપત્તય ઇતિ પ્રવદન્તિ સત્તઃ ॥૪૨॥

અનુવાદ : કરોડો પરિશ્રમો દ્વારા કમાયેલું જે ધન પુત્રો અને પોતાના જીવનથી પણ લોકોને અધિક પ્રિય હોય છે નિશ્ચયથી તે ધન માટે દાન સિવાયની બીજી વિપત્તિઓ જ છે એમ સાધુપુરુષો કહે છે.

વિશેષાર્થ : મનુષ્ય ધન ઘણા કઠોર પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરે છે. તેથી તે તેમને પોતાના પ્રાણોથી પણ અધિક પ્રિય જણાય છે. જો તેઓ તેનો સદ્ગુપ્યોગ પાત્રદાનાદિમાં કરે તો તે તેમને ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પણ એનાથી ઉલ્લંઘન જો તેનો દુરૂપ્યોગ ખોટા વ્યસનાદિમાં કરવામાં આવે અથવા દાન અને ભોગરહિત કેવળ તેનો જ સંચય જ કરવામાં આવે તો તે મનુષ્યોને વિપત્તિજનક જ થાય છે. એનું કારણ એ છે કે સુખનું કારણ જે પુણ્ય છે તેનો જ સંચય તેમણે પાત્રદાનાદિરૂપ સત્કાર્યો દ્વારા કદી કર્યો જ નથી. ૪૨.

(વસંતતિલકા)

નાર્થઃ પદાત્પદમપિ વ્રજતિ ત્વદીયો
વ્યાવર્તતે પિતૃવવાન્નનુ બન્ધુવર્ગઃ ।
દીર્ઘે પથિ પ્રસવતા ભવતઃ સખૈકં
પુણ્યં ભવિષ્યતિ તતઃ ક્રિયતાં તદેવ ॥૪૩॥

અનુવાદ : તમારું ધન પોતાના સ્થાનથી એક ડગલું પણ (તમારી સાથે) જતું નથી, એ જ રીતે તમારા સગાસંબંધી સ્મરણ સુધી તમારી સાથે જઈને ત્યાંથી પાછા

આવી જાય છે. લાંબા માર્ગે પ્રવાસ કરતાં તમારા માટે એક પુષ્ય જ ભિત્ર છે. તેથી હે ભવ્ય જીવો! તમે તે જ પુષ્યનું ઉપાર્જન કરો. ૪૩.

(વસંતતિલકા)

સौભાગ્યશૌર્યસુખરૂપવિવેકિતાદ્યा
વિદ્યાવપુર્ધનગૃહાણિ કુલે ચ જન્મ ।
સંપદ્યતે ડખિલમિદં કિલ પાત્રદાનાત્ર
તસ્માત્ કિમત્ર સતતં ક્રિયતે ન યત્ન: ॥૪૪॥

અનુવાદ : સૌભાગ્ય, શૂરવીરપણું, સુખ, સુંદરતા, વિવેકબુદ્ધિ આદિ વિદ્યા, શરીર, ધન અને મહેલ તથા ઉત્તમકુળમાં જન્મ થવો, આ બધું નિશ્ચયથી પાત્રદાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. તો પછી હે ભવ્ય જન! તમે તે પાત્રદાનની બાબતમાં નિરંતર પ્રયત્ન કેમ નથી કરતા? ૪૪.

(વસંતતિલકા)

ન્યાસશ્ચ સદ્ગ ચ કરગ્રહણ ચ સૂનો-
રથેન તાવદિહ કારયિતવ્યમાસ્તે ।
ધર્માય દાનમધિકાગ્રતયા કરિષ્યે
સંચિન્તયત્ત્વપિ ગૃહી મૃતિમેતિ મૂઢઃ ॥૪૫॥

અનુવાદ : પહેલાં તો અહીં ધનમાંથી કંઈક થાપણ મૂકવી છે (જમીનમાં દાટવા વગેરે), મકાન બનાવવું છે અને પુત્રના લગ્ન કરવા છે, ત્યાર પછી જો વધારે ધન થશે તો ધર્મના નિભિતે દાન કરીશ. આમ વિચાર કરતા કરતા જ તે મૂર્ખ ગૃહસ્થ ભરણ પામી જાય છે. ૪૫.

(વસંતતિલકા)

કિ જીવિતેન કૃપણસ્ય નરસ્ય લોકે
નિર્ભોગદાનધનબન્ધનબદ્ધમૂર્તેઃ ।
તસ્માદ્બરં બલિભુગુન્તભૂરિવાગ્મિ-
વ્યાહૂતકાકુલ એવ બલિં સ ભુડ્યકે ॥૪૬॥

અનુવાદ : લોકમાં જે કંજૂસ મનુષ્યનું શરીર ભોગ અને દાન રહિત એવા ધનરૂપી બંધનથી બંધાયેલું છે તેના જીવનનું શું પ્રયોજન છે? અર્થાતું તેના જીવવાથી કંઈ પણ લાભ નથી. તેની અપેક્ષાએ તો તે કાગડો જ સારો છે જે ઊંચા અનેક વચનો (કા, કા) દ્વારા બીજા કાગડાઓને બોલાવીને જ બલિ (શ્રાદ્ધમાં અપાયેલું દ્રવ્ય) ખાય છે. ૪૬.

(વસંતતિલકા)

ઔदાર્યયુક્તજનહસ્તપરમ્પરામ-
વ્યાવર્તનપ્રસૃતખેદભરાતિખિન્નાઃ ।
અર્થા ગતાઃ કૃપણગેહમનન્તસૌખ્ય-
પૂર્ણા ઇવાનિશમવાધમતિસ્વપન્તિ ॥૪૭॥

અનુવાદ : દાની પુરુષોના હાથો દ્વારા પરંપરાથી પ્રાપ્ત થયેલ જવા-આવવાના વિપુલ ખેદના ભારથી જાણો અત્યંત વ્યાકુળ થઈને જ તે ધન કંજૂસ મનુષ્યના ધરને પ્રાપ્ત કરીને અનંત-સુખથી પરિપૂર્ણ થયું થકું નિરંતર નિર્બાધપણે સૂવે છે.

વિશેષાર્થ : દાની પુરુષ પ્રાપ્ત ધનનો ઉપયોગ પાત્રદાનમાં કર્યા કરે છે. તેથી પાત્રદાનજનિત પુષ્યના નિમિત્તે તે તેમને વારંવાર મળ્યા કરે છે, એનાથી ઉલ્લંઘન કંજૂસ મનુષ્ય પૂર્વના પુષ્યથી પ્રાપ્ત થયેલ તે ધનનો ઉપયોગ ન તો પાત્રદાનમાં કરે છે અને ન પોતાના ઉપયોગમાં ય. તે કેવળ તેનું સંરક્ષણ જ કરે છે. આ બાબતમાં ગ્રંથકાર ઉત્પ્રેક્ષા કરે છે કે તે ધન એમ વિચારી જ જાણો કે ‘મને દાની પુરુષોને ત્યાં વારંવાર જવા-આવવાનું અસીમ કષ્ટ સહન કરવું પડે છે’ કંજૂસ મનુષ્યના ધરમાં આવી ગયું છે. અહીં આવીને તે વારંવાર થતા ગમનાગમનના કષ્ટથી બચીને નિશ્ચિન્ત રીતે સૂવે છે. ૪૭.

(વસંતતિલકા)

ઉત્કૃષ્ટપાત્રમનગારમણુવ્રતાદ્યં
મધ્યં બ્રતેન રહિતં સુદૃશં જઘન્યમ् ।
નિર્દર્શનં બ્રતનિકાયયુતં કુપાત્રં
યુગ્મોજ્જિતં નરમપાત્રમિદં ચ વિદ્ધિ ॥૪૮॥

અનુવાદ : ગૃહ રહિત મુનિને ઉત્તમ પાત્ર, અણુવ્રતોથી યુક્ત શ્રાવકને મધ્યમ

પાત્ર, અવિરત સમ્યગદૃષ્ટિને જીવન્ય પાત્ર, સમ્યગદર્શન રહિત હોવા છતાં વ્રતોનું પાલન કરનાર મનુષ્યોને કુપાત્ર અને બન્ને (સમ્યગદર્શન તથા વ્રત) થી રહિત મનુષ્યને અપાત્ર સમજો. ૪૮.

(વસંતતિલકા)

તેભયઃ પ્રદત્તમિહ દાનફળં જનાના-
મેતદ્વિશેષણવિશિષ્ટમદુષ્ટભાવાત् ।
અન્યાદ્યશે ઽથ હૃદયે તદપિ સ્વભાવા-
દુચ્ચાવચં ભવતિ કિં બહુભિવયોભિઃ ॥૪૯॥

અનુવાદ : તે ઉપર્યુક્ત પાત્રોને આપવામાં આવેલ દાનનું ફળ મનુષ્યોને આ જ (ઉત્તમ, મધ્યમ, જીવન્ય, કુસ્તિત અને અપાત્ર) વિશેષણોથી વિશિષ્ટ પ્રકારનું પ્રાપ્ત થાય છે (જુઓ પાછળના શ્લોક ૨૦૪નો વિશેષાથ). અથવા ઘણું કહેવાથી શું? અન્ય પ્રકારના અર્થાત્ દૂષિત હૃદયમાં પણ તે દાનનું ફળ સ્વભાવથી અનેક પ્રકારનું પ્રાપ્ત થાય છે. ૪૯.

(વસંતતિલકા)

ચત્વારિ યાન્યભવભેષજભક્તિશાસ્ત્ર-
દાનાનિ તાનિ કથિતાનિ મહાફલાનિ ।
નાન્યાનિ ગોકનકભૂમિરથાડ્નાદિ-
દાનાનિ નિશ્ચિતમવદ્યકરાણિ યર્સ્પાત્ર ॥૫૦॥

અનુવાદ : અભયદાન, ઔષધદાન, આહારદાન અને શાસ્ત્રદાન (જ્ઞાનદાન) આ જે ચાર દાન કહેવામાં આવ્યા છે તે મહાન ફળ આપનારા છે. એનાથી ભિન્ન ગાય, સોનું, પૃથ્વી, રથ અને સ્ત્રી આદિનાં દાન મહાન ફળ આપનાર નથી; કેમ કે તે નિશ્ચયથી પાપ ઉત્પાદક છે. ૫૦.

(વસંતતિલકા)

યદીયતે જિનગૃહાય ધરાદિ કિંચિત्
તત્ત્વ સંસ્કૃતનિમિત્તમિહ પ્રસૂઢમ્ ।

આસ્તે તત્ત્વદત્તિર્ધતરં હિ કાલં
જૈનं ચ શાસનમતઃ કૃતમસ્તિ દાતુઃ ॥૫૧॥

અનુવાદ : જિનાલયના નિભિતે જે કંઈ પૃથ્વી આદિનું દાન કરવામાં આવે છે તે અહીં ધાર્મિક સંસ્કૃતિનું કારણ હોઈને અંકૃતિ થતું થકું અતિશય દીર્ઘ કાળ સુધી રહે છે. તેથી તે દાતા દ્વારા જૈન શાસન જ કરવામાં આવ્યું છે. ૫૧.

(વસંતતિલકા)

દાનપ્રકાશનમશોભનકર્મકાર્ય-
કાર્પણપૂર્ણહૃદયાય ન રોચતે ઽદઃ ।
દોષોજ્ઞિતં સકલલોકસુખપ્રદાયિ
તેજો ખેરિવિ સદા હતકૌશિકાય ॥૫૨॥

અનુવાદ : જે નિર્દોષ દાનનો પ્રકાશ સમસ્ત જનોને સુખ આપે છે તે પાપકર્મની કાર્યભૂત કૃપણતા (કંજૂસાઈ)થી પરિપૂર્ણ હૃદયવાળા પ્રાણી (કંજૂસ મનુષ્ય)ને કદી રૂચતો નથી. જેમ દોષો અર્થાત् રાત્રિના સંસર્ગ રહિત હોવાને લીધે સમસ્ત પ્રાણીઓને સુખ આપનાર સૂર્યનું તેજ નિન્દનીય ધુવડને રુચિકર લાગતું નથી. ૫૨.

(વસંતતિલકા)

દાનોપદેશનમિદં કુરુતે ગ્રમોદ-
માસન્નભવ્યપુરુષસ્ય ન ચેતરસ્ય ।
જાતિઃ સમુલ્લાસતિ દારુ ન ભૂડ્સસંગા-
દિન્દીવરં હસતિ ચન્દ્રકરૈર્ન ચાશ્મા ॥૫૩॥

અનુવાદ : આ દાનનો ઉપદેશ આસન્નભવ્ય પુરુષોને આનંદ આપનાર છે, નહિ કે અન્ય (દૂરભવ્ય અને અભવ્ય) પુરુષોને. બરાબર છે-ભમરાઓના સંસર્ગથી માલતી પુષ્પ શોભા પામે છે, પરંતુ તેમના સંસર્ગથી લાકું શોભા પામતું નથી. તેવી જ રીતે ચન્દ્રકિરણો દ્વારા શ્વેત કમળ પ્રકુલ્પિત થાય છે, પરંતુ પથર પ્રકુલ્પિત થતો નથી. ૫૩.

(વસંતતિલકા)

રલત્રયાભરણવીરમુનીન્દ્રપાદ-
પદ્મદ્વયસ્મરણસંજનિતપ્રભાવઃ ।
શ્રીપદ્મનાન્દિમુનિરાશ્રિતયુગ્મદાન-
પઞ્ચાશતં લલિતવર્ણચયં ચકાર ॥૫૪॥

અનુવાદ : રત્નત્રયરૂપ આભરણથી વિભૂષિત શ્રી વિરનન્દી મુનિરાજના ઉભય યરણકભળના સ્મરણથી ઉત્પન્ન થયેલ પ્રભાવને ધારણ કરનાર શ્રી પદ્મનાન્દી મુનિએ લલિત વર્ણાના સમૂહથી સંયુક્ત આ બે અધિક દાનપંચાશત અર્થાત્ બાવન પદ્મોવાળા દાનપ્રકરણની રૂચના કરી છે. ૫૪.

આ રીતે દાનપંચાશત પ્રકરણ સમાપ્ત થયું.

૨૬૦૯ ૨૦૧૮.





૩. અનિત્ય પંચાશત्

[૩. અનિત્યપંચાશત्]

(આર્ય)

જયતિ જિનો ધૃતિધનુષામિષુમાલા ભવતિ યોગિયોધાનામ् ।
યદ્વાકરુણામય્યપિ મોહરિપુપ્રહત્યે તીક્ષણ ॥૧॥

અનુવાદ : જે જિન ભગવાનની વાણી ધૈર્યરૂપ ધનુષ ધારણ કરનાર યોગીજનો રૂપી યોજ્ઞાઓને બાણપંક્તિ સમાન હોય છે તથા જેની તે વાણી દ્યામય હોવા છતાં પણ મોહ રૂપી શત્રુનો ઘાત કરવા માટે તીક્ષ્ણ તલવારનું કામ કરે છે તે જિન ભગવાન જ્યવંત હો .૧.

(શાર્દૂલવિક્રીડિત)

યદેકત્ર દિને વિભુક્તિરથ વા નિદ્રા ન રાત્રૌ ભવેત्
વિદ્રાત્યમ્બુજપત્રવદ્ધનતો ઽભ્યાસસ્થિતાદ્યદ્વિવમ् ।
અસ્ત્રવ્યાધિજલાદિતો ઽપિ સહસા યચ્ચ ક્ષયં ગચ્છતિ
ભ્રાતઃ કાત્ર શરીરકે સ્થિતિમતિર્નાશે�ઽસ્ય કો વિસ્મય: ॥૨॥

અનુવાદ : જો કોઈ વાર એક દિવસ ભોજન પ્રાપ્ત થતું નથી કે રાત્રે ઊંઘ આવતી નથી તો જે શરીર નિશ્ચયથી નિકટવર્તી અગ્નિથી સંતપ્ત થયેલા કમળના પાંડડાની જેમ ખ્લાનતા પામે છે તથા જે અસ્ત્ર, રોગ અને જળ આદિ દ્વારા અક્ષમાત્ર નાશ પામે છે; હે ભાઈ! તે શરીરના વિષયમાં સ્થિરતાની બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અને તેનો નાશ થઈ જાય તેમાં આશ્વર્ય જ શું છે? અર્થાત્

તને ન તો સ્થિર સમજવું જોઈએ અને ન તો નષ્ટ થતાં કંઈ આશર્ય પણ થવું જોઈએ. ૨.

(શાર્ડૂલવિક્રીડિત)

દુર્ગન્ધાશુચિધાતુભિત્તિકલિતં સંછાદિતં ચર્મણા
 વિષ્પુત્રાદિભૂતં ક્ષુધાદિવિલસદૂદુઃखાખુભિશ્ચદ્રિતમ् ।
 ક્લિષ્ટં કાયકુટીરકં સ્વયમપિ પ્રાપ્તં જરાવહિના
 ચેદેતત્તદીપિ સ્થિરં શુચિતરં મૂઢો જનો મન્યતે ॥૩॥

અનુવાદ : જે શરીરરૂપી ઝુંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓ રૂપી દીવાલો સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે, તથા ભૂખ-તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલા છિદ્રોથી સંયુક્ત છે, તે કલેશયુક્ત શરીરરૂપી ઝુંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ધેરાઈ જાય છે ત્યારે પણ આ મૂર્ખ પ્રાણી તને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. ૩.

(શાર્ડૂલવિક્રીડિત)

અમ્ભોબુદ્બુદ્ધસંનિભા તનુરિયં શ્રીરિન્દ્રજાલોપમા
 દુર્વાતાહતવારિવાહસદ્ધશા: કાન્તાર્થપુત્રાદયઃ ।
 સૌખ્યં વૈષયિકં સદૈવ તરલં મત્તાઙ્ગનાપાઙ્ગવત્ર
 તસ્માદેતદુપદ્લવાસ્પિવિષયે શોકેન કિં કિં મુદા ॥૪॥

અનુવાદ : આ શરીર પાણીના પરપોટા સમાન ક્ષણમાં નાશ પામનાર છે, લક્ષ્મી ઈન્દ્રજાળ સમાન વિનશ્ચર છે; સ્ત્રી, ધન અને પુત્ર આદિ દુષ્ટ વાયુથી તાડિત વાદળાઓ સમાન જોત જોતામાં જ વિલીન થઈ જાય છે; તથા ઈન્દ્રિયવિષયજન્ય સુખ સદાય કામોન્મત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે? કંઈ પણ નહિ. અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી અને પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૪.

(વસંતતિલકા)

દુઃખે વા સમુપસ્થિતે ઽથ મરણે શોકો ન કાર્યો બુધૈ:
સંબન્ધો યદિ વિગ્રહેણ યદયં સંભૂતિધાત્રેતયો: ।
તસ્માત્તત્પરિચિન્તનીયમનિશં સંસારદુઃખપ્રદો
યેનાસ્ય પ્રભવઃ પુરઃ પુનરાપિ ગ્રાયો ન સંભાવ્યતે ॥૫॥

અનુવાદ : જો શરીર સાથે સંબંધ હોય તો દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં વિદ્વાન પુરુષોએ શોક ન કરવો જોઈએ. કારણ એ કે તે શરીર આ બન્ને (દુઃખ અને મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાય: (ધંષું કરીને) સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

દુર્વારાર્જિતકર્મકારણવશાદિષે પ્રણષ્ટે નરે
યચ્છોકં કુરુતે તદત્ત્ર નિતરામુન્મત્તલીલાયિતમ્ ।
યસ્માત્તત્ત્ર કૃતે ન સિધ્યતિ કિમષ્યેતત્પરં જાયતે
નશ્યન્યેવ નરસ્ય મૂઢમનસો ધર્માર્થકામાદયઃ ॥૬॥

અનુવાદ : પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદ્યવશે કોઈ ઈષ મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની યેષા સમાન છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થ આદિ જ નાસ્ત થાય છે. ૬.

(ઉપેન્દ્રવજ્રા)

ઉદેતિ પાતાય રવિર્યથા તથા
શરીરમેત્તન્નુ સર્વદેહિનામ્ ।
સ્વકાલમાસાદ્ય નિજેઽપિ સંસ્થિતે
કરોતિ ક: શોકમતઃ પ્રબુદ્ધધીઃ ॥૭॥

અનુવાદ : જેમ સૂર્યનો ઉદ્ય અસ્ત થવા માટે થાય છે તેવી જ રીતે નિશ્ચયથી સમસ્ત પ્રાણીઓનું આ શરીર પણ નાથ થવાને માટે ઉત્પન્ન થાય છે. તો પછી કાળ પામીને પોતાના કોઈ બંધુ વગેરેનું મરણ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય તેને માટે શોક કરે? અર્થાત् તેને માટે કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી.

વિશેખાર્થ : જેવી રીતે સૂર્યનો ઉદ્ય અસ્તનો અવિનાભાવી છે તેવી જ રીતે શરીરની ઉત્પત્તિ પણ વિનાશની અવિનાભાવી છે. આવી સ્થિતિમાં તે વિનશ્વર શરીરનો નાશ થતાં તેના વિષયમાં શોક કરવો વિવેકહીનતાનું ઘોતક છે. ૭.

(વસંતતિલકા)

ભવન્તિ વૃક્ષેષુ પતન્તિ નૂં પત્રાણિ પુષ્પાણિ ફલાનિ યદ્વત્ ।

કુલેષુ તદ્વત્યુરૂપાઃ કિમત્ર હર્ષેણ શોકેન ચ સન્મતીનામ્ ॥૮॥

અનુવાદ : જેવી રીતે વૃક્ષોમાં પત્ર, પુષ્પ અને ફળ ઉત્પન્ન થાય છે અને તેઓ સમયાનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી જ રીતે કુળો (કુટુંબ)માં જે પુરુષો ઉત્પન્ન થાય છે તેઓ મરે પણ છે. તો પછી બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. ૮.

(શાર્દૂલવિક્રીણિત)

દુર્લભધ્યાદ્ભવિતવ્યતાબ્યતિકરાત્રાદે પ્રિયે માનુષે
યચ્છોકઃ ક્રિયતે તદત્ત્ર તમસિ ગ્રારભ્યતે નર્તનમ્ ।
સર્વ નશ્વરમેવ વસ્તુ ભુવને મત્વા મહત્વા ધિયા
નિર્ધૂતાખિલદુઃખસંતતિરહો ધર્મઃ સદા સેવ્યતામ્ ॥૯॥

અનુવાદ : દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે, એમ ઉત્તમ બુદ્ધિદ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો.

વિશેખાર્થ : જેમ અંધારામાં નૃત્યનો આરંભ કરવો નિષ્ફળ છે તેવી રીતે કોઈ પ્રિયજનનો વિયોગ થતાં તેના માટે શોક કરવો પણ નિષ્ફળ જ છે. કારણ કે સંસારના બધા જ પદાર્થ સ્વભાવથી

અધિકાર-૩ : અનિય પંચાશત्]

૧૨૭

નાશ પામે છે, એમ વિવેકબુદ્ધિથી નિશ્ચિત છે. તેથી જે ધર્મ સમસ્ત દુઃખનો નાશ કરીને અનંત સુખ (ભોક્ષ)ને પ્રાપ્ત કરાવે છે તેનું જ આરાધન કરવું જોઈએ. ૮.

(શાર્દૂલવિક્રીડિત)

પૂર્વોપાર્જિતકર્મણ વિલિખિતં યર્યાવસાનं યદા
તજ્જાયેત તદૈવ તસ્ય ભવિનો જ્ઞાત્વા તદેતદ્ધ્રુવમ् ।
શોકં મુચ્ચ મૃતે પ્રિયે ઽપિ સુખદં ધર્મ કુરુષાદરાત्
સર્પે દૂરમુપાગતે કિમિતિ ભોસ્તદ્ધ્રુષ્ટિરાહન્યતે ॥૧૦॥

અનુવાદ : પૂર્વ કુમાર્યેલ કર્મ દારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે એમ નિશ્ચિત જ્ઞાણીને કોઈ પ્રિય મનુષ્યનું મરણ થવા છતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો. ઠીક છે—જ્યારે સાપ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેના લીસોટાને ક્યો બુદ્ધિમાન પુરુષ લાઠી દ્વારા પીટે છે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો નથી. ૧૦.

(શાર્દૂલવિક્રીડિત)

યે મૂર્ખા ભુવિ તે ઽપિ દુઃખહત્યે વ્યાપારમાત્ન્યતે
સા માભૂદથવા સ્વકર્મવશતસ્તસ્માત્ તે તાદ્વશા: ।
મૂર્ખાનું મૂર્ખશિરોમળીનું નનુ વયં તાનેવ મન્યામહે
યે કુર્વન્તિ શુચં મૃતે સતિ નિજે પાપાય દુઃખાય ચ ॥૧૧॥

અનુવાદ : આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ કરવા માટે પ્રયત્ન કરે છે. છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ ન યે થાય તોપણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ખોને મૂર્ખોમાં શ્રેષ્ઠ અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઈષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને દુઃખના નિમિત્તભૂત શોકને દૂર કરે છે.

વિશેષાર્થ : લોકમાં જે પ્રાણીને મૂર્ખ સમજવામાં આવે છે તેઓ પણ દૂઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. જો કદાચ દૈવવશે તેમને પોતાના આ પ્રયત્નમાં સફળતા ન યે મળે તોપણ તેમને એટલા બધા જડ (મૂર્ખ) ગણવામાં આવતા નથી. પરંતુ જે મનુષ્ય કોઈ ઈષ્ટ જનનો વિયોગ થતાં શોક કરે છે તેમને મૂર્ખ જ નહિ પણ મૂર્ખશિરોમળિ (અતિશય જડ) ગણવામાં આવે છે. કારણ એ છે કે મૂર્ખ સમજવામાં આવતા તે પ્રાણીઓ તો આવેલું દુઃખ દૂર કરવા માટે જ કંઈ ને કંઈ

પ્રયત્ન કરે છે, પરંતુ આ મૂર્ખશિરોમણિ ઈષ્ટવિયોગમાં શોકાકુળ થઈને અને નવીન દુઃખને પણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એનું પણ કારણ એ છે કે તે શોકથી “દુઃખ-શોક-તાપાક્રન્દન-વધ-પરિદેવનાન્યાત્મ-પરોભયસ્થાન્યસદ્દેવસ્ય” આ સૂત્ર (ત. સૂ. ૬-૧૧) અનુસાર અશાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે, કે જેથી ભવિષ્યમાં પણ તેમને તે દુઃખની પ્રાપ્તિ અનિવાર્ય બની જાય છે. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

કિં જાનાસિ ન કિ શૃણોષિ ન ન કિ ગ્રત્યક્ષમેવેક્ષસે
નિઃશેષં જગદિન્દ્રજાલસદ્ધશં રમ્ભેવ સારોજિંતમ् ।
કિં શોકં કુરુષે ઽત્ર માનુષપણો લોકાન્તરસ્થે નિજે
તત્કિંચિત્કુરુ યેન નિત્યપરમાનન્દાસ્પદં ગચ્છસિ ॥૧૨॥

અનુવાદ : હે અજ્ઞાની મનુષ્ય! આ સમસ્ત જગત્ ઈન્દ્રજાળ સમાન વિનશ્વર અને કેળના થડ સમાન નિઃસાર છે; આ વાત શું તું નથી જાણતો? શું શાશ્વતમાં સાંભળ્યું નથી? અને શું પ્રત્યક્ષ નથી દેખતો? અર્થાત્ તમે એને અવશ્ય જાણો છો, સાંભળો છો અને પ્રત્યક્ષપણે દેખો છો. તો પછી ભલા અહીં પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મરણ થતાં શોક કેમ કરો છો? અર્થાત્ શોક છોડીને એવો કાંઈક પ્રયત્ન કરો કે જેથી શાશ્વત, ઉત્તમ સુખના સ્થાનભૂત મોક્ષને પામી શકો. ૧૨.

(વસંતતિલકા)

જાતો જનો મ્રિયત એવ દિને ચ મૃત્યો:
પ્રાપે પુનસ્ત્રિભુવને ઽપિ ન રક્ષકો�સ્તિ ।
તદ્યો મૃતે સતિ નિજે ઽપિ શુચં કરોતિ
પૂત્કૃત્ય રોદિતિ વને વિજને સ મૂઢઃ ॥૧૩॥

અનુવાદ : જે મનુષ્ય ઉત્પન્ન થયો છે તે મૃત્યુનો દિવસ આવતાં મરે જ છે, તે વખતે તેની રક્ષા કરનાર ત્રણે લોકમાં કોઈ પણ નથી. તેથી જે પોતાનું ઈષ્ટજ્ઞ મૃત્યુ પામે ત્યારે શોક કરે છે તે મૂર્ખ નિર્જન વનમાં બૂભો પાડીને રૂદ્ધ કરે છે. અભિપ્રાય એ છે કે જેવી રીતે જનશૂન્ય (મનુષ્ય વિનાના) વનમાં રૂદ્ધ કરનારના રોવાથી કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી તેવી રીતે કોઈ ઈષ્ટ જન મૃત્યુ પામતાં, તેના માટે શોક કરવાવાળાને પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, પરંતુ તેથી દુઃખદાયક નવીન કર્માનો જ બંધ થાય છે. ૧૩.

(વસંતતિલકા)

ઇષ્ટક્ષયો યદિહ તે યદનિષ્ટયોગ:
પાપેન તદ્ભવતિ જીવ પુરાકૃતેન ।
શોકં કરોષિ કિમુ તસ્ય કુરુ પ્રણાશં
પાપસ્ય તૌ ન ભવતઃ પુરતોડપિ યેન ॥૧૪॥

અનવાદ :—હે જીવ ! અહીં જે તને ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદ્દ્યથી થાય છે. તેથી તું શોક શા માટે કરે છે ? તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બન્ને (ઇષ્ટ વિયોગ અને અનિષ્ટસંયોગ) ન થઈ શકે. ૧૪.

(શાર્દૂલવિક્રીડિત)

નષ્ટે વસ્તુનિ શોભને ડપિ હિ તદા શોકઃ સમારભ્યતે
તલ્લાભો ઽથ યશો�થ સૌખ્યમથ વા ધર્મો ઽથ વા સ્યાધદિ ।
યદેકો ડપિ ન જાયતે કથમપિ સ્ફારૈઃ પ્રયત્નૈરપિ
પ્રાયસ્તત્ર સુધીર્મુધા ભવતિ કઃ શોકોગ્રાક્ષોવશઃ ॥૧૫॥

અનુવાદ : મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ થતી હોય ક્રીતિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય; તો તો શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી કથો બુદ્ધિમાન મનુષ્ય વર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય ? અર્થાત્ કોઈ નહીં. ૧૫.

(વસંતતિલકા)

એકદ્રુમે નિશિ વસન્તિ યથા શકુન્તા:
પ્રાતઃ પ્રયાન્તિ સહસા સકલાસુ દિક્ષુ ।
સ્થિત્વા કુલે બત તથાન્યકુલાનિ મૃત્વા
લોકાઃ શ્રીન્તિ વિદુષા ખલુ શોચ્યતે કઃ ॥૧૬॥

અનુવાદ : જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસ્ર સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૧૬.

(શાર્ડૂલવિક્રીડિત)

દુઃखવ્યાલસમાકુલં ભવવનं જાડ્યાન્ધકારાશ્રિતં
તસ્મિન્ દુર્ગતિપલિપાતિકુપથૈભ્રામ્યન્તિ સર્વે ઽદ્ધિનઃ ।
તન્મધ્યે ગુરુવાક્પ્રદીપમમલં જ્ઞાનપ્રભાભાસુરं
પ્રાપ્યાલોક્ય ચ સત્યથં સુખપદં યાતિ પ્રબુદ્ધો ધ્રુવમ् ॥૧૭॥

અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખોરૂપી સર્પોથી વ્યાપ્ત અને અજ્ઞાનરૂપી અંધકારથી પરિપૂર્ણ છે તેમાં સર્વે પ્રાણી દુર્ગતિરૂપ ભીલોની વસ્તી તરફ લઈ જતા ખોટા માર્ગ પરિભ્રમણ કરે છે. તે (સંસાર-વન)ની વર્ણે વિવેકી પુરુષ જ્ઞાનરૂપી જ્યોતિથી દેદીઘ્રભાન નિર્મળ ગુરુના વચન (ઉપદેશ) રૂપી દીપક પામીને અને તેનાથી સમીયીન માર્ગ જોઈને નિશ્ચયથી સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરી લે છે.

વિશેષાર્થ : જેવી રીતે કોઈ મુસાફર સર્પોથી ભરેલા અંધકારયુક્ત વનમાં ભૂલીને ખોટા માર્ગ ભીલોની વસ્તીમાં જઈ પહોંચે છે અને કષ્ટ સહન કરે છે. જો તેને ઉક્ત વનમાં કોઈ પ્રકારે દીવો પ્રાપ્ત થઈ જાય છે તો તે તેના સહારે યોગ્ય માર્ગની ખોજ કરીને તેના દ્વારા ઈષ્ઠ સ્થાનમાં પહોંચી જાય છે. બરાબર એવી જ રીતે આ સંસારી પ્રાણી પણ દુઃખોથી ભરેલા આ અજ્ઞાનમય સંસારમાં મિથ્યાદર્શનાદિને વશીભૂત થઈને નરકાદિ દુર્ગતિઓમાં પહોંચે છે અને ત્યાં અનેક પ્રકારના કષ્ટો સહે છે. તેને જ્યારે નિર્મળ સદ્ગુરુનો ઉપદેશ મળે છે ત્યારે તે તેમાંથી પ્રબુદ્ધ થઈને મોક્ષમાર્ગનો આશ્રય કરે છે અને તેના દ્વારા મુક્તિપુરીમાં જઈ પહોંચે છે. ૧૭.

(વસંતતિલકા)

યૈવ સ્વકર્મકૃતકાલકલાત્ર જન્તુ-
સ્તત્રૈવ યાતિ મરણ ન પુરો ન પશ્ચાત્ ।
મૂળાસ્તથાપિ હિ મૃતે સ્વજને વિધાય
શોકં પરં પ્રચુરદુઃખભુજો ભવન્તિ ॥૧૮॥

અનુવાદ : આ સંસારમાં પોતાના કર્મ દ્વારા જે મરણનો સમય નક્કી કરવામાં આવ્યો છે તે જ સમયે પ્રાણી મરણ પામે છે, તે તેનાથી ન તો પહેલાં મરે છે અને ન પછી, પણ છતાં ય મૂર્ખ મનુષ્યો પોતાના કોઈ સંબંધીનું મૃત્યુ થતાં અતિશય શોક કરીને બહુ જ હુઃખ ભોગવે છે. ૧૮.

(શાર્દૂલવિક્રીડિત)

વૃક્ષાદવૃક્ષમિવાણ્ડજા મધુલિહઃ પુષ્પાચ્ચ પુષ્પં યથા
જીવા યાન્તિ ભવાદ્વાન્તરમિહશ્રોન્તં તથા સંસ્તૂતૌ ।
તજ્જાતેઽથ મૃતેઽથ વા ન હિ મુદં શોકં ન કસ્મિન્નાપિ
પ્રાયઃ પ્રારભતે ઽધિગમ્ય મતિમાનસ્થૈર્યમિત્યઙ્ગિનામ् ॥૧૯॥

અનુવાદ : જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપર્યુક્ત પ્રકારે પ્રાણીઓની અસ્થિરતા જાણીને ધંશું કરીને કોઈ ઈષ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતા નથી અને તેનું મૃત્યુ થતાં શોક પામતાં નથી. ૧૯.

(શાર્દૂલવિક્રીડિત)

ભ્રામ્યન્ કાલમનન્તમત્ર જનને પ્રાશોતિ જીવો ન વા
માનુષ્યં યદિ દુષ્કુલે તદઘતઃ પ્રાસ્ત પુનર્નશ્યતિ ।
સજ્જાતાવથ તત્ર યાતિ વિલયં ગર્ભે ઽપિ જન્મન્યાપિ
દ્રાગબાલ્યે ઽપિ તતો ઽપિ નો વૃષ ઇતિ પ્રાસે પ્રયત્નો વરઃ ॥૨૦॥

અનુવાદ : આ જન્મ-મરણરૂપ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો જીવ મનુષ્ય પર્યાય પામે છે અથવા નથી પણ પામતો અર્થાત્ તેને તે મનુષ્ય પર્યાય ધંશી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી લે છે તો પણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ય ઉત્પન્ન થયો તોપણ ત્યાં તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા બાલ્યાવસ્થામાં પણ શીધ્ર મરણ પામી જાય છે. તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ

શક્તિ નથી. પણ જો આયુષ્યની અધિકતામાં તે ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેના વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૨૦.

(માલિની)

સ્થિરં સદપિ સર્વદા ભૃશમુદેત્યવસ્થાન્તરૈ:
પ્રતિક્ષણમિદં જગજ્જલદકૂટવન્નશ્યતિ ।
તદત્ત્ર ભવમાશ્રિતે મૃતિમુપાગતે વા જને
પ્રિયેઽપિ કિમહો મુદા કિમુ શુચા પ્રબુદ્ધાત્મનઃ ॥૨૧॥

અનુવાદ : આ વિશ્વ દ્રવ્ય અપેક્ષાએ સ્થિર (ધ્રુવ) હોવા છતાં પણ પર્યાય-અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે મેઘપટલ સમાન અન્ય-અન્ય અવસ્થાઓથી ઉત્પન્ન પણ થાય છે અને નાચ પણ અવશ્ય થાય છે. આ કારણે અહીં જ્ઞાની જીવને કોઈ પ્રિયજ્ઞનાનો જન્મ થતાં હર્ષ અને તેનું મરણ થતાં શોક કેમ થવો જોઈએ? અર્થાત્ ન થવો જોઈએ. ૨૧.

(શાર્દૂલવિક્રીડિત)

લઙ્ગુયન્તે જલરાશયઃ શિખરિણો દેશાસ્તાટિન્યો જનૈ:
સા વેલા તુ મૃતેર્નૃપક્ષમચલનસ્તોકાપિ દેવૈરાપિ ।
તત્કસ્મિન્નાપિ સંસ્થિતે સુખકરં શ્રેયો વિહાય ધ્રુવં
કઃ સર્વત્ર દુરન્તદુઃખજનકં શોકં વિદ્ધ્યાત્ર સુધીઃ ॥૨૨॥

અનુવાદ : મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે; પરંતુ મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષ માત્ર (આંખના પલકારા બરાબર) જરા પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઈષ જનનું મૃત્યુ થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર હુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાનું શોક કરતો નથી. ૨૨.

(શાર્દૂલવિક્રીડિત)

આક્રન્દं કુરુતે યદત્ત જનતા નષ્ટે નિજે માનુષે
જાતે યચ્ચ મુદં તદુન્તતધિયો જલ્યન્તિ વાતૂલતામ् ।
યજ્ઞાડયાત્કૃતદુષ્ટચેષ્ટિતભવત્કર્મપ્રબન્ધોદયાત્
મૃત્યૂત્પત્તિપરમ્પરામયમિદં સર્વ જગતસર્વદા ॥૨૩॥

અનુવાદ : સંસારમાં લોકો પોતાના કોઈ સંબંધી મનુષ્યનું મૃત્યુ થતાં જે વિલાપપૂર્વક ચીસો પાડીને રૂધન કરે છે તથા તેનો જન્મ થતાં જે હર્ષ કરે છે તેને ઉન્નત બુદ્ધિના ધારક ગણધર આદિ પાગલપણું કહે છે. કારણ કે મૂર્ખતાવશ જે ખોટી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય તેનાથી થતા કર્મના પ્રકૃષ્ટ બંધ અને તેના ઉદ્યથી સદા આ આખુંય વિશ્વ મૃત્યુ અને ઉત્પત્તિની પરંપરાસ્વરૂપ છે. ૨૩.

(શાર્ડૂલવિક્રીડિત)

ગુર્વી ભ્રાન્તિરિયં જડત્વમથ વા લોકસ્ય યસ્માદસનુ
સંસારે બહુદુઃખજાલજટિલે શોકીભવત્યાપદિ ।
ભૂતપ્રેતપિશાચફેરવચિતાપૂર્ણે શમશાને ગૃહં
કઃ કૃત્વા ભયદાદમઙ્ગલકૃતે ભાવાદ્વેચ્છદ્વિતઃ ॥૨૪॥

અનુવાદ : અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી ખોટી ભાન્તિ અથવા અશાનતા છે. બરાબર છે—જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિતાઓથી ભરેસા એવા અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી કદી શંકિત થાય? અર્થાત્ ન થાય.

વિશોધાર્થ : જેવી રીતે ભૂત-પ્રેતાદિથી વ્યાપ્ત સ્મશાનમાં ઘર બનાવીને રહેનાર મનુષ્ય કદી અન્ય પદાર્થોથી ભયભીત થતો નથી તેવી જ રીતે અનેક દુઃખોથી પરિપૂર્ણ આ જન્મ-મરણરૂપ સંસારમાં પરિભ્રમણ કરનાર જીવે પણ કોઈ ઈષ્ટવિયોગાદ્રૂપ આપત્તિ આવતાં વ્યાકુળ ન થવું જોઈએ. હતાં જો એવી આપત્તિઓ આવતાં પ્રાણી શોકાદિથી સંતપ્ત થાય છે તો એમાં તેની અશાનતા જ કારણ છે કેમ કે જ્યારે સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તો આપત્તિઓનું આવવું જવું તો રહેવાનું જ. તો પછી એમાં રહેતા થકા ભલા હર્ષ અને વિશાદ કરવાથી કચું પ્રયોજન સિદ્ધ થવાનું? ૨૪.

(માલિની)

ભ્રમતિ નભસિ ચન્દ્રઃ સંસૃતૌ શશ્વદઙ્ગી
લભત ઉદ્યમસ્તં પૂર્ણતાં હીનતાં ચ ।
કલુષિતહૃદયઃ સનુ યાતિ રાશિં ચ રાશે-
સ્તનુમિહ તનુતસ્તકાત્ર મુત્કશ્ચ શોકઃ ॥૨૫॥

અનુવાદ : જેવી રીતે ચન્દ્રમા આકાશમાં નિરંતર ચક્કર લગાવ્યા કરે છે તેવી જ રીતે આ પ્રાણી સદા સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે; જેમ ચન્દ્રમા ઉદ્ય, અસ્ત, અને કળાઓની હાનિ-વૃદ્ધિને પાખ્યા કરે છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ જન્મ-મરણ અને સંપત્તિની હાનિ-વૃદ્ધિને પાખ્યા કરે છે; જેમ ચંદ્ર મધ્યમાં કલુષિત (કાળો) રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવો જોઈએ? અર્થાત્ ન કરવા જોઈએ . ૨૫.

(માલિની)

તડિદિવ ચલમેતતુત્રદારાદિ સર્વ
કિમિતિ તદભિઘાતે ખિદ્યતે બુદ્ધિમદ્ધિઃ ।
સ્થિતિજનનવિનાશં નોષ્ણતેવાનલસ્ય
વભિચરતિ કદાચિત્સર્વભાવેષુ નૂનમ् ॥૨૬॥

અનુવાદ : આ બધા પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ જો વિજાળી સમાન ચંચળ અર્થાત્ ક્ષણિક છે તો પછી તેમનો વિનાશ થતાં બુદ્ધિમાન મનુષ્ય ખેદભિન્ કેમ થાય છે? અર્થાત્ તેમનો નશર સ્વભાવ જાણીને તેમણે ખેદભિન્ ન થવું જોઈએ. જેવી રીતે ઉષ્ણતા અભિનાનો વ્યભિચાર કરતી નથી અર્થાત્ તે સદા અભિ હોય ત્યાં હોય છે અને તેના અભાવમાં કદ્દી પણ નથી હોતી; બરાબર એવી જ રીતે સ્થિતિ (ધૌય), ઉત્પાદ અને વ્યય પણ નિશ્ચયથી પદાર્થો હોય ત્યાં અવશ્ય હોય છે અને તેમના અભાવમાં કદ્દી પણ હોતા નથી. ૨૬.

(માલિની)

પ્રિયજનમૃતિશોકઃ સેવ્યમાનો ઽતિમાત્રં
જનયતિ તદસાતં કર્મ યચ્ચાગ્રતો ઽપિ ।
પ્રસરતિ શતશાખં દેહિનિ ક્ષેત્ર ઉમં
વટ ઇવ તનુબીજં ત્યજ્યતાં સ પ્રયત્નાત્ ॥૨૭॥

અધિકાર-૩ : અનિય પંચાશત्]

૧૩૫

અનુવાદ : પ્રિયજનનું મૃત્યુ થતાં જે શોક કરવામાં આવે છે તે તીવ્ર અશાતાવેદનીય કર્મ ઉત્પન્ન કરે છે જે આગળ (ભવિષ્યમાં) પણ વિસ્તાર પામીને પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું વડનું બીજ પણ સેંકડો શાખાઓ સંયુક્ત વડવૃક્ષ રૂપે વિસ્તાર પામે છે તેથી જ આવો અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૨૭.

(આર્યા)

આયુઃક્ષતિઃ પ્રતિક્ષણમેતન્મુખમન્તકસ્ય તત્ત્ર ગતાઃ ।

સર્વે જનાઃ કિમેકઃ શોચયત્યન્ય મૃતં મૂढઃ ॥૨૮॥

અનુવાદ : પ્રત્યેક ક્ષણો જે આયુષ્યની હાનિ થઈ રહી છે એ યમરાજનું મુખ છે. તેમાં (યમરાજના મુખમાં) બધા જ પ્રાણી પહોંચે છે. અર્થાત્ બધા પ્રાણીઓનું મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કરે છે? અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે તો એક બીજા મરતાં શોક કરવો ઉચિત નથી. ૨૮.

(અનુષ્ઠભ)

યો નાત્ર ગોચરં મૃત્યોર્ગતો યાતિ ન યાસ્યતિ ।

સ હિ શોકં મૃતે કુર્વન્ન શોભતે નેતરઃ પુમાન્ ॥૨૯॥

અનુવાદ : જે મનુષ્ય અહીં મૃત્યુના વિષયને ન તો ભૂતકાળમાં પ્રાપ્ત થયો હોય, ન વર્તમાનમાં પ્રાપ્ત થતો હોય અને ન ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોય; અર્થાત્ જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકૃણ થવું અશોભનીય છે. અભિપ્રાય એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એકે બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિત નથી. ૨૯.

(માલિની)

પ્રથમમુદ્યમુદ્યૈર્દૂરમારોહલક્ષ્મી-

મનુભવતિ ચ પાતં સોઽપિ દેવો દિનેશઃ ।

યદિ કિલ દિનમધે તત્ત્વ કેષાં નરાણાં
વસતિ હૃદિ વિષાદઃ સત્ત્વવસ્થાન્તરેષુ ॥૩૦॥

અનુવાદ : જે સૂર્યદેવ એક જ દિવસમાં પ્રાતઃકાળે ઉદ્યનો અનુભવ કરે છે અને ત્યાર પછી મધ્યાહ્નમાં ખૂબ ઊંચે ચઢીને લક્ષ્મીનો અનુભવ કરે છે તે પણ જ્યારે સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે ત્યારે જન્મમરણાદિ-સ્વરૂપ બિન્ન-બિન્ન અવસ્થાઓ થતાં ક્યા મનુષ્યના હૃદયમાં વિષાદ રહે છે? અર્થાતું એવી દશામાં કોઈએ પણ વિષાદ ન કરવો જોઈએ. ૩૦.

(વસંતતિલકા)

આકાશ એવ શશિસૂર્યમરુત્ખગાદ્યા:
ભૂપૃષ્ઠ એવ શકટપ્રમુહાશ્વરાન્તિ ।
મીનાદયશ્ચ જલ એવ યમસ્તુ યાતિ
સર્વત્ર કુત્ર ભવિનાં ભવતિ પ્રયત્નઃ ॥૩૧॥

અનુવાદ : ચંદ્ર, સૂર્ય, વાયુ અને પક્ષી આદિ આકાશમાં જ ગમન કરે છે; ગાડી આદિનું આવાગમન પૃથ્વી ઉપર જ થાય છે તથા મત્સ્યાદિ જળમાં જ સંચાર કરે છે. પરંતુ યમ(મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી સંસારી પ્રાણીઓનો પ્રયત્ન ક્યાં થઈ શકે? અર્થાતું કાળ જો બધા સંસારી પ્રાણીઓનો કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૩૧.

(શાર્દૂલવિક્રીડિત)

કિં દેવઃ કિમુ દેવતા કિમગદો વિદ્યાસ્તિ કિં કિ મણિ:
કિં મન્ત્ર કિમુતાશ્રયઃ કિમુ સુહૃત્ત કિં વા સ ગન્ધો ઽસ્તિ સઃ ।
અન્યે વા કિમુ ભૂપતિપ્રભૃતયઃ સન્યત્ર લોકત્રયે
યૈ: સર્વેરપિ દેહિનઃ સ્વસમયે કર્માદિતં વાર્યતે ॥૩૨॥

અનુવાદ : અહીં ત્રણે લોકમાં શું દેવ, શું દેવી, શું ઔષધિ, શું વિદ્યા, શું ભણિ, શું મન્ત્ર, શું આશ્રય, શું ભિત્ર, શું તે સુગંધ અથવા શું અન્ય રાજી આદિ પણ એવા શક્તિશાળી છે જે બધાય પોતાના ઉદ્ય પામેલા કર્મને રોકી શકે? અર્થાતું

અધિકાર-૩ : અનિત્ય પંચાશત્તુ]

۹۳۹

ઉદ્યમાં આવેલા કર્મનું નિવારણ કરવા માટે ઉપર્યુક્ત દેવાદિમાંથી કોઈ પણ સમર્થ નથી. તરફાની.

(शार्दूलविक्रीडि॒त)

गीर्वाणा अणिमादिस्वस्थमनसः शक्ताः किमत्रोच्यते
धस्तास्ते ऽपि परम्परेण स परस्तेभ्यः कियान् राक्षसः ।
रामाख्येन च मानुषेण निहतः प्रोल्लङ्घ्य सो ऽप्यम्बुधिं
रामो ऽप्यन्तकर्गोचरः समभवत् को ऽन्यो बलीयान् विधेः ॥३३॥

અનુવાદ : અહીં અધિક શું કહેવું? અણિમા-મહિમા આદિ ઋદ્ધિઓથી સ્વસ્થ મનવાળા જે શક્તિશાળી ઈન્દ્રાદિ દેવ હતા તે પણ કેવળ એક શત્રુ દ્વારા નાશ પામ્યા છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઈન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો. વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો. અંતે તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાતું તેને પણ મૃત્યુએ ન છોડ્યા. બરાબર છે—દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાતું કોઈ પણ નથી. ઉત્ત.

(शार्दूलविक्रीडि॒त)

सर्वत्रोद्गतशोकदावदहनव्याप्तं जगत्काननं
 मुग्धास्तत्र वधूमृगीगतधियस्तिष्ठन्ति लोकैणकाः ।
 कालव्याध इमान् निहन्ति पुरतः प्राप्तान् सदा निर्दयः
 तस्माज्ञीवति नो शिशुर्न च युवा वृद्धोऽपि नो कश्चन ॥३४॥

અનુવાદ : આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ (જંગલની અભિન)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં આસક્ત થઈને રહે છે. નિર્દ્ય કાળ (મૃત્યુ) રૂપી વ્યાધ (શિકારી) સામે આવેલ આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે. તેનાથી ન કોઈ બાળક બચ્યે છે, ન કોઈ યુવક બચ્યે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ઉછ.

(वसंततिलका)

संपद्यारुलतः प्रियापरिलसद्वल्लीभिरालिङ्गितः
पूत्रादिप्रियपल्लवो रतिसुखप्रायैः फलैराश्रितः ।

જાતઃ સંસૂતિકાનને જનતરુઃ કાલોગ્રદાવાનલ-
વ્યાપ્તશ્રેષ્ઠ ભવેત્તદા બત બુધૈરન્યત્કિમાલોક્યતે ॥૩૫॥

અનુવાદ : સંસારરૂપી વનમાં ઉત્પન્ન થયેલ જે મનુષ્યરૂપી વૃક્ષ સંપત્તિરૂપી સુંદર લતા સહિત શ્રીરૂપી શોભાયમાન વેલોથી વીંટાળાયેલ પુત્ર-પૌત્રાદિરૂપી મનોહર પણ્ણોથી રમણીય તથા વિષયભોગજનિત સુખ જેવા ફળોથી પરિપૂર્ણ હોય છે; તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનણથી વ્યાપ્ત ન હોત તો વિદ્વાનો બીજું શું દેખે? અર્થાત् તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનણથી નાચ થાય જ છે. આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત્ત થતા નથી એ ખેદની વાત છે. ઉપ.

(શિખરિણી)

વાજ્ઞાન્યેવ સુખં તદત્ત વિધિના દત્તં પરં પ્રાપ્યતે
નૂં મૃત્યુમુપાશ્રયન્તિ મનુજાસ્તત્રાપ્યતો બિભ્યતિ ।
ઇથં કામભયપ્રસક્તહૃદયા મોહાન્મુધૈવ ધ્રુવં
દુઃખોર્મિપ્રચુરે પતન્તિ કુધિયઃ સંસારઘોરાણવે ॥૩૬॥

અનુવાદ : સંસારમાં મનુષ્ય સુખની ઈચ્છા કરે જ છે, પરંતુ તે તેમને ફક્ત કર્મ દ્વારા અપાયેલ પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય નિશ્ચયથી મૃત્યુ તો પામે છે પરંતુ તેનાથી ડરે છે. આ રીતે તે દુઃખુદ્ધિ મનુષ્યો હૃદયમાં ઈચ્છા (સુખની અભિલાષા) અને ભય (મૃત્યુનો ભય) ધારણ કરતાં થકાં અજ્ઞાનથી અનેક દુઃખોરૂપી લહેરોવાળા સંસારરૂપી ભયાનક સમુદ્રમાં નકામા જ પડે છે. ઉદ્દ.

(માલિની)

સ્વસુખપયસિ દીવ્યન્મૃત્યુકેવર્તહર્સત-
પ્રસૃતધનજરોરુગ્રાલ્લસજ્ઞાલમધ્યે ।
નિકટમપિ ન પશ્યત્યાપદાં ચક્રમુગ્રં
ભવસરસિ વરાકો લોકમીનૌઘ એષઃ ॥૩૭॥

અનુવાદ : આ બિચારો મનુષ્યોરૂપી માછલીઓના સમૂહ સંસારરૂપી સરોવરમાં પોતાના સુખરૂપ જળમાં કીડા કરતો થકો મૃત્યુરૂપી માછીમારના હાથે

અધિકાર-૩ : અનિય પંચાશત्]

૧૩૮

ફેલાવવામાં આવેલ વૃદ્ધતુરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર આપ્તિઓના સમૂહને પણ દેખતો નથી.

વિશેષાર્થ : જેવી રીતે માછલીઓ સરોવરમાં પાણીમાં કીડા કરતી થકી તેમાં એટલી આસકત થઈ જાય છે કે તેમને માછીમાર દ્વારા પોતાને પકડવા માટે ફેલાવવામાં આવેલી જાળનું પણ ધ્યાન રહેતું નથી તેથી તેમને તેમાં ફસાઈને મરણનું કષ્ટ સહન કરવું પડે છે. બરાબર એવી જ રીતે બિચારા આ પ્રાણીઓ પણ સંસારમાં શાતાવેદનીયજનિત અલ્ય સુખમાં એટલા અધિક મળ થઈ જાય છે કે તેને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર વૃદ્ધત્વની પ્રાપ્તિ થઈ જવા છતાં પણ તેનું ભાન નથી રહેતું અને તેથી અંતે તે કાળનો કોળિયો બનીને અસહ્ય દુઃખ સહે છે. ૩૭.

(શાર્દૂલવિક્રીડિત)

શૂણવન્તકગોচરं ગતવતः પશ્યन્બહૂન् ગચ્છતો
મોહાદેવ જનસ્તથાપિ મનુતે સ્થૈર્ય પરं હ્યાત્મનઃ ।
સંપ્રાપ્તે ઽપિ ચ વાર્ધકે સૃહ્યતિ પ્રાયો ન ધર્માય યત્તુ
તદ્ધનાત્યધિકાધિકં સ્વમસકૃત્યુત્ત્રાદિભર્વન્ધનૈः ॥૩૮॥

અનુવાદ : મનુષ્ય મરણ પામેલા જીવોના વિષયમાં સાંભળે છે તથા વર્તમાનમાં તે મરણ પામનાર ઘણા જીવોને સ્વયં દેખે પણ છે; તો પણ તે કેવળ મોહના કારણે પોતાને અતિશય સ્થિર માને છે. તેથી વૃદ્ધત્વને પ્રાપ્ત થવા છતાં પણ તે ઘણું કરીને ધર્મની અભિલાષા કરતો નથી અને તેથી જ પોતાને નિરંતર પુત્રાદિરૂપ બંધનોથી અત્યન્તપણે બાંધે છે. ૩૮.

(શાર્દૂલવિક્રીડિત)

દુશ્ચેષાકૃતકર્મશલ્પિરચિતં દુઃસન્ધિ દુર્બન્ધનં
સાપાયસ્થિતિ દોષધાતુમલવત્સર્વત્ર યન્નશ્વરમ् ।
આધિવ્યાધિજરામૃતિપ્રભૂતયો યચ્ચાત્ર ચિત્રં ન તત્તુ
તચ્ચિત્રં સ્થિરતા બુધૈરપિ વપુષ્યત્રાપિ યન્મૃગ્યતે ॥૩૯॥

અનુવાદ : જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધ્યા અને બંધનો નિંધ્ય છે, જેની સ્થિતિ વિનાશ

સહિત છે અર્થાત् જે વિનશ્વર છે; જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ છે; અને જે નાના થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને ભરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્રય નથી. પરંતુ આશ્રય તો કેવળ એમાં છે કે વિદ્વાન् મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. ૩૮.

(શાર્દૂલવિક્રીડિત)

લબ્ધા શ્રીરિહ વાઞ્છિતા વસુમતી ભુક્તા સમુદ્રાવધિ:
પ્રાપ્તાસ્તે વિષયા મનોહરતરાઃ સ્વર્ગ ઽપિ યે દુર્લભાઃ ।
પશ્ચાચ્ચેન્મૃતિરાગમિષ્યતિ તત્સત્તત્ત્વમેતદ્વિષા-
શ્લિષ્ટં ભોજ્યમિવાતિરસ્યમપિ ધિગુક્તિઃ પરં મૃગ્યતામ् ॥૪૦॥

અનુવાદ : હે આત્મા! તેં ઈચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર પર્યત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૪૦.

(શાર્દૂલવિક્રીડિત)

યુદ્ધે તાવદલં રથેભતુરગા વારાશ્ દ્વસા ભૃંશ
મન્નઃ શૌર્યમસિશ્ તાવદતુલાઃ કાર્યસ્ય સંસાધકાઃ ।
રાજ્ઞો ઽપિ ક્ષુધિતો�પિ નિર્દ્યમના યાવઞ્ચિઘત્સુર્યમઃ
ક્રુદ્ધો ધાવતિ નૈવ સન્મુખમિતો યત્નો વિધેયો બુધૈઃ ॥૪૧॥

અનુવાદ : યુદ્ધમાં રાજીના રથ, હાથી, ધોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી દુષ્ટ, ભૂખ્યો યમરાજ (મૃત્યુ) કોધિત થઈને મારવાની ઈચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી વિદ્વાન् પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત् મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ૪૧.

(શાર્ડૂલવિક્રીડિત)

રાજાપિ ક્ષણમાત્રતો વિવિધવશાદ્વાયતે નિશ્ચિતં
સર્વવ્યાધિવિર્જિતો ઽપિ તરુણો ઽપ્યાશુ ક્ષયં ગચ્છતિ ।
અન્યૈ: કિં કિલ સારતામુગપતે શ્રીજીવિતે દ્વે તયો:
સંસારે સ્થિતિરીદશીતિ વિદુષા કાન્યન્ન કાર્યો મદઃ ॥૪૨॥

અનુવાદ : ભાગ્યવશે રાજા ય ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઈ જાય છે તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય પદાર્થોના વિષયમાં તો શું કહેવું? પણ જે લક્ષ્મી અને જીવન બન્ને ય સંસારમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમની પણ જો આવી (ઉપર્યુક્ત) સ્થિતિ છે તો વિદ્વાન् મનુષ્યે બીજા કોના વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત્ અભિમાન કરવા યોગ્ય કોઈ પદાર્થ અહીં સ્થાયી નથી. ૪૨.

(શાર્ડૂલવિક્રીડિત)

હન્તિ વ્યોમ સ મુષ્ટિનાથ સરિતં શુષ્કાં તરત્યાકુલ:
તૃષ્ણાર્તો ઽથ મરીચિકા: પિવતિ ચ પ્રાય: પ્રમત્તો ભવન્ ।
પ્રોત્સુદ્ધાચલચૂલિકાગતમસુત્રેદ્વત્પ્રદીપોપમૈ:
ય: સમ્પત્સુતકામિનીપ્રભૂતિમિ: કુર્યાન્મદં માનવ: ॥૪૩॥

અનુવાદ : સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો ઊંચા પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીંગ જ નાશ પામનારા છે. છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે છે તે જાણો મુઢીથી આકાશનો નાશ કરે છે અથવા વ્યાકુળ થઈને સૂક્રી (જીજા રહિત) નથી તરે છે અથવા તરસથી પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.

વિષેખાર્થ : જેમ મુઢીથી આકાશને પ્રહાર કરવો, જીજારહિત નદીમાં તરવું અને તરસથી પીડાઈને રેતીનું પાન કરવું; આ બધા કાર્ય અસંભવ હોવાથી મનુષ્યના અજ્ઞાનના ધોતક છે તેવી જ રીતે જે સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થો દેખતા દેખતા જ નાશ થનારા છે તેમના વિષયમાં અભિમાન કરવું એ પણ મનુષ્યનું અજ્ઞાન પ્રગટ કરે છે. કારણ કે જો ઉક્ત પદાર્થો ચિરસ્થાયી હોત તો તેમના વિષયમાં અભિમાન કરવું ઉચિત કહી શકાતું હતું, પણ તેમ તો છે નહિ. ૪૩.

(શાર્દૂલવિક્રીડિત)

લક્ષ્મી વ્યાધમૃગીમતૌવ ચપલામાશ્રિત્ય ભૂપા મૃગા:
પુત્રાદીનપરાનુ મૃગાનતિરુષા નિગ્રન્તિ સેર્જ કિલ ।
સર્જીભૂતઘનાપદુન્તત્થનુઃસંલગ્રસહંછર
નો પશ્યન્તિ સમીપમાગતમપિ કુદ્રં યમં લુદ્ધકમ્ ॥૪૪॥

અનુવાદ : રાજા રૂપી મૃગ અત્યંત ચંચળ એવી લક્ષ્મી રૂપી શિકારીની હરણીનો આશ્રય લઈને ઈર્ધ્યાયુક્ત થતો થકો અતિશય કોધથી પુત્રાદિ રૂપી બીજા મૃગોનો ધાત કરે છે. તેઓ તે યમરૂપી શિકારીએ ધણી આપત્તિઓ રૂપી ધનુષ્યને સુસજ્જ કરીને તેની ઉપર સંહાર કરનાર બાણ રાખી મૂકું છે તથા જે પોતાની સમીપે આવી ગયો છે એવા તે કોધે ભરાયેલા યમરૂપી શિકારીને પણ દેખતા નથી.

વિશેષાર્થ : જેવી રીતે હરણ શિકારી દ્વારા પકડવામાં આવેલી (મરણોન્મુખ) હરણીના નિમિત્તે ઈર્ધ્યા યુક્ત થઈને બીજા હરણોનો તો ધાત કરે છે પરંતુ તેઓ તે શિકારી તરફ જોતા નથી કે જે તેમનો વધ કરવા માટે ધનુષ્ય-બાણથી સુસજ્જ થઈને સમીપમાં આવી પહોંચ્યો છે. બરાબર એવી જ રીતે રાજાઓ ચંચળ રાજ્યલક્ષ્મીના નિમિત્તે કુદ્ર બનીને બીજાઓની તો શું વાત પણ પુત્રાદિનો પણ ધાત કરે છે, પરંતુ તેઓ તે યમરાજ (મૃત્યુ) ને જોતા નથી કે જે અનેક આપત્તિઓમાં નાખીને તેમને ગ્રહણ કરવા માટે સમીપમાં આવી ગયો છે. તાત્પર્ય એ છે કે જે ધન-સંપત્તિ થોડો જ સમય રહીને નિયમથી નાચ થઈ જવાની છે તેના નિમિત્તે મનુષ્યોએ બીજા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડવું જોઈએ. પણ પોતાની જાતને ય નશર સમજીને કલ્યાણના માર્ગમાં લાગી જવું જોઈએ. ૪૪.

(શાર્દૂલવિક્રીડિત)

મृત્યોર્ગોચરમાગતે નિજજને મોહેન યઃ શોકકૃત્
નો ગન્ધોऽપિ ગુણસ્ય તસ્ય બહવો દોષાઃ પુનર્નિશ્ચિતમ् ।
દુઃખં વર્ધત એવ નશ્યતિ ચતુર્વર્ગો મતેવિભ્રમઃ
પાપં રૂક ચ મૃતિશ્ચ દુર્ગતિરથ સ્યાદીર્ઘસંસારિતા ॥૪૫॥

અનુવાદ : પોતાના કોઈ સંબંધી પુરુષનું મૃત્યુ થતાં જે અશાન વશે શોક કરે છે તેની પાસે ગુણની ગંધ (લેશમાત્ર) પણ નથી, પરંતુ દોષ તેની પાસે ધણા છે; એ નક્કી છે. આ શોકથી તેનું દુઃખ અધિક વધે છે; ધર્મ, અર્થ, કામ અને

મોક્ષરૂપ ચારે પુરુષાર્� નાથ થાય છે, બુદ્ધિમાં વિપરીતતા આવે છે તથા પાપ (અશાતાવેદનીય) કર્મનો બંધ પણ થાય છે. રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર પરિભ્રમણ લાંબુ થઈ જાય છે. ૪૫.

(આર્યા)

આપન્મયસંસારે ક્રિયતે વિદુષા કિમાપદિ વિષાદઃ ।
કસ્ત્રસ્યતિ લદ્ધનતઃ પ્રવિધાય ચતુષ્પથે સદનમ્ ॥૪૬॥

અનુવાદ : આ આપત્તિ સ્વરૂપ સંસારમાં કોઈ વિશેષ આપત્તિ પ્રાપ્ત થતાં વિદ્વાનું મનુષ્ય શું ખેદ કરે છે? અર્થાત્ નથી કરતો. બરાબર છે—ચોકમાં (જ્યાં ચારે તરફ રસ્તા જાય છે) મકાન બનાવીને કચો મનુષ્ય ઓળંગી જવાના ભયથી દુઃખી થશે? અર્થાત્ કોઈ નહિ થાય.

વિશેષાર્થ : જેવી રીતે ચોકમાં સ્થિત રહીને જો કોઈ મનુષ્ય ગાડી આદિ દ્વારા કચરાઈ જવાની આશંકા કરે તો એ તેનું અજ્ઞાન જ કહેવાય છે. બરાબર એ જ રીતે જ્યાં સંસારનું સ્વરૂપ જ આપત્તિમય છે ત્યાં ભલા એવા સંસારમાં રહીને કોઈ આપત્તિ આવતાં ખેદબિન્ન થવું, એ પણ અતિશય અજ્ઞાનપણાનું જ ઘોતક છે. ૪૬.

(વસંતતિલકા)

વાતૂલ એષ કિમુ કિં ગ્રહસંગૃહીતો
બ્રાન્તોઽથ વા કિમુ જનઃ કિમથ પ્રમત્તઃ ।
જાનાતિ પશ્યતિ શૃણોતિ ચ જીવિતાદિ
વિદ્યુચ્ચલં તદપિ નો કુરુતે સ્વકાર્યમ્ ॥૪૭॥

અનુવાદ : આ મનુષ્ય શું વાનો રોગી છે, શું ભૂત-પિશાચ આદિથી ગ્રહાયો છે, શું ભ્રાન્તિ પામ્યો છે અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે’ આ વાત જાણે છે, દેખે છે અને સાંભળે પણ છે; તો પણ પોતાનું કાર્ય (આત્મહિત) કરતો નથી. ૪૭.

(શાર્ડૂલવિક્રીડિત)

દત્તં નૌષધમસ્ય નૈવ કથિતઃ કસ્યાપ્યયં મન્ત્રિણો
નો કુર્યાચુચમેવમુન્તતમતિર્લોકાન્તરસ્થે નિજે ।
યત્ના યાન્તિ યતો ઽઙ્ગિનઃ શિથિલતાં સર્વે મૃતેઃ સંનિધૌ
બન્ધાર્થર્મવિનિર્મિતાઃ પરિલસદ્વર્ષામ્બુસિક્તા ઇવ ॥૪૮॥

અનુવાદ : કોઈ પ્રિય જન મરણ પામતાં વિવેકી મનુષ્ય ‘આને દવા આપવામાં ન આવી અથવા આના વિષયમાં કોઈ મંત્ર જાળનારને ન કહેવામાં આવ્યું’ એ પ્રકારે શોક કરતા નથી. કારણ કે મૃત્યુ પાસે આવતાં પ્રાણીઓના બધા પ્રયત્નો એવી રીતે શિથિલ થઈ જાય છે જેમ ચામડાના બનાવેલા બંધન વરસાદના પાણીમાં ભીજાઈને શિથિલ થઈ જાય છે. અર્થાત્ મૃત્યુથી બચવા માટે કરવામાં આવતો પ્રયત્ન કદી કોઈનો સર્ફણ થતો નથી. ૪૮.

(શિખરિણી)

સ્વકર્મવ્યાગ્રેણ સ્ફુરિતનિજકાલાદિમહસા
સમાગ્રાતઃ સાક્ષાચ્છરણરહિતે સંસૃતિવને ।
પ્રિયા મે પુત્રા મે દ્રવિણમણિ મે મે ગૃહમિદં.
વદન્નેવં મે મે પશુરિવ જનો યાતિ મરણમ્ ॥૪૯॥

અનુવાદ : જે સંસારરૂપી વન રક્ષકો રહિત છે તેમાં પોતાના ઉદ્યક્તાના આદિરૂપ પરાક્રમથી સંયુક્ત એવા કર્મરૂપી વાધ દ્વારા ગ્રહાયેલ આ મનુષ્યરૂપી પશુ ‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે. આ દ્રવ્ય મારું છે, અને આ ઘર પણ મારું છે.’ આમ ‘મારું મારું કહેતો મરણ પામી જાય છે.

વિશેષાર્થ : જેવી રીતે વનમાં ગંધ પામીને ચિત્તા દ્વારા પકડાયેલ બકરા વગેરે પશુનું રક્ષણ કરનાર ત્યાં કોઈ નથી—તે ‘મેં મેં’ શબ્દ કરતા થકા ત્યાં જ મરણ પામે છે—તેવી જ રીતે આ સંસારમાં કર્મને આધીન થયેલ પ્રાણીનું પણ મૃત્યુથી રક્ષણ કરનાર કોઈ નથી. છતાં પણ મોહને વશીભૂત થઈને આ મનુષ્ય તે મૃત્યુ તરફ ધ્યાન ન દેતાં જે સ્વી-પુત્રાદિ બાહ્ય પદાર્થ કદી પોતાના થઈ શકતા નથી તેમનામાં મમત્વ બુદ્ધિ રાખીને ‘મારા મારા’ (આ મારી સ્ત્રી છે, આ પુત્ર મારા છે આદિ) કરતો થકો નકામો સંકલેશ પામે છે. ૪૯.

(વસન્તતિલકા)

દિનાનિ ખણ્ડાનિ ગુરુણિ મૃત્યુના
વિહન્યમાનસ્ય નિજાયુષો ભૃશમ् ।
પતન્તિ પશ્યત્ત્રપિ નિત્યમગ્રતઃ સ્થિર-
ત્વમાત્યન્યભિમન્યતે જડઃ ॥૫૦॥

અનુવાદ : આ અજ્ઞાની પ્રાણી મૃત્યુ દ્વારા ખંડિત કરાતા પોતાના આયુષ્યના દિવસો રૂપી દીર્ઘ ટૂકડાઓને સદા પોતાની સામે પડતા જોવા છતાં પણ પોતાને સ્થિર માને છે. ૫૦.

(શાર્દૂલવિક્રીડિત)

કાલેન પ્રલયં બ્રજન્તિ નિયતં તે ઽપીન્દ્રચન્દ્રાદયઃ
કા વાર્તાન્યજનસ્ય કીટસદ્ધશો ઽશક્તેરદીર્ઘાયુષઃ ।
તસ્માન્મૃત્યુમુપાગતે પ્રિયતમે મોહં મુધા મા કથા:
કાલઃ ક્રીડતિ નાત્ર યેન સહસા તત્કિંચિદન્વિષ્ટતામ् ॥૫૧॥

અનુવાદ : જો તે ઈન્દ્ર અને ચંદ્ર આદિ પણ સમય પામીને નિશ્ચયથી મરણ પામે છે તો ભલા ક્રીડા જેવા નિર્બણ અને અલ્ય આયુવાળા અન્ય મનુષ્યોની તો વાત જ શી? અર્થાત્ તે તો નિઃસંદેહ મરણ પામશે જ તેથી હે ભવ્ય જીવ! કોઈ અત્યંત પ્રિય મનુષ્ય મરણ પામતાં વ્યર્થ મોહ ન કર. પરંતુ કોઈ એવો ઉપાય શોધ કે જેથી તે કાળ (મૃત્યુ) સહસા અહીં ક્રીડા ન કરી શકે. ૫૧.

(શાર્દૂલવિક્રીડિત)

સંયોગો યદિ વિપ્રયોગવિધિના ચેજ્ઞન્મ તન્મૃત્યુના
સમ્પદ્યોદ્વિપદા સુખં યદિ તદા દુઃખેન ભાવં ધ્રુવમ् ।
સંસારેત્ત્ર મુહુર્મુહુર્બહુવિધાવસ્થાન્તરગ્રોલસદ-
વેષાન્યત્વનટીકૃતાઙ્ઘનિ સતઃ શોકો ન હર્ષઃ ક્વચિત् ॥૫૨॥

અનુવાદ : જ્યાં પ્રાણી વારંવાર અનેક પ્રકારની અવસ્થાઓઝુપ વેશોની ભિન્નતાથી નટ સમાન આયરણ કરે છે એવા તે સંસારમાં જો ઈષ્ટનો સંયોગ

થાય છે તો વિયોગ પણ તેનો અવશ્ય થવો જોઈએ, જો જન્મ છે તો મૃત્યુ પણ અવશ્ય હોવું જોઈએ, જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ, તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજજન મનુષ્યે ઈષ્ટસંયોગાદિ થતાં તો હર્ષ અને ઈષ્ટવિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ.

વિશેષાર્થ : જેમ નટ (નાટકનું પાત્ર) આવશ્યકતા પ્રમાણે રાજી અને રંક આદિ અનેક પ્રકારના વેશોનું ગ્રહણ કરે છે; પરંતુ તે સંયોગ અને વિયોગ, જન્મ અને મરણ, સંપત્તિ અને વિપત્તિ તથા સુખ અને દુઃખ આદિમાં અંત:કરણપૂર્વક હર્ષ અને વિષાદ પામતો નથી. કારણ કે તે પોતાની યથાર્થ અવસ્થા અને ગ્રહણ કરેલા તે કૃતિમ વેશોમાં તફાવત સમજે છે. તેવી જ રીતે વિવેકી મનુષ્ય પણ ઉપર્યુક્ત સંયોગ-વિયોગ અને નર-નારકાદિ અવસ્થાઓમાં કદી હર્ષ અને વિષાદ પામતો નથી. કારણ કે તે સમજે છે કે સંસારનું સ્વરૂપ જ જન્મ-મરણ છે. એમાં પૂર્વોપાર્જિત કર્મ અનુસાર પ્રાઇસીઓને કદી ઈષ્ટનો સંયોગ અને કદી તેનો વિયોગ પણ અવશ્ય થાય છે. સંપત્તિ અને વિપત્તિ કદી કોઈના નિયત નથી. જો મનુષ્ય કોઈ વાર સંપત્તિશાળી થાય છે તો કોઈ વાર તે અશુભ કર્મના ઉદ્યથી વિપત્તિઘસ્ત પણ જોવામાં આવે છે. તેથી તેમાં હર્ષ અને વિષાદ પામવો બુદ્ધિમત્તા નથી. ૫૨.

(શાર્ડૂલવિક્રીડિત)

લોકાશ્રેતસિ ચિન્તયન્ત્યનુદિનં કલ્યાણમેવાત્મનઃ
કુર્યાત્સા ભવિતવ્યતાગતવતી તત્તત્ત્ર યદ્રોચતે ।
મોહોલ્લાસવશાદતિપ્રસરતો હિત્વા વિકલ્પાનું બહૂનું
રાગદ્વેષવિષોળ્જિતૈરિતિ સદા સદ્ગ્રિ: સુખં સ્થીયતામ् ॥૫૩॥

આનુવાદ : મનુષ્ય મનમાં પ્રતિદિન પોતાના કલ્યાણનો જ વિચાર કરે છે, પરંતુ આવેલી ભવિતવ્યતા (દૈવ) તે જ કરે છે કે જે તેને રૂચે છે. તેથી સજજન પુરુષ રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૫૩.

(વસંતતિલકા)

લોકા ગૃહપ્રિયતમાસુતરીવિતાદિ
વાતાહતધજપટાગ્રચલં સમસ્તમ् ।

વ્યામોહમત્ર પરિહૃત્ય ધનાદિમિત્રે
ધર્મે મતિં કુરુત કિં બહુભિર્વચોભિઃ ॥૫૪॥

અનુવાદ : હે ભવ્ય જનો! અધિક કહેવાથી શું લાભ? જે ગૃહ, સ્ત્રી, પુત્ર અને જીવનાદિ સર્વ પવનથી પ્રતાડિત ધજાના વલ્લના છેડા સમાન ચંચળ છે તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં બુદ્ધિ જોડો. ૫૪.

(વસંતતિલકા)

પુત્રાદિશોકશિખિશાન્તિકરી યતીન્દ્ર-
શ્રીપદ્મનન્દિવદનામ્બુધરપ્રસૂતિઃ ।
સદ્ગોધસસ્યજનની જયતાદનિત્ય-
પજ્ઞાશદુન્તાધિયામમૃતૈક વૃષ્ટિઃ ॥૫૫॥

ઇતિ અનિત્યપજ્ઞાશત् ॥૩॥

અનુવાદ : શ્રી પદ્મનન્દિ મુનીન્દ્રના મુખરૂપી મેઘથી ઉત્પન્ન થયેલ જે અનિત્યપંચાશત् (પચાસ શ્લોકમય અનિત્યતાનું પ્રકરણ) રૂપ અદ્વિતીય અમૂતની વર્ષા વિદ્વાનોને માટે પુત્રાદિના શોકરૂપી અનિને શાન્ત કરીને સમ્યજ્ઞાનરૂપ ધાન્ય ઉત્પન્ન કરે છે તે જીવંત હો. ૫૫.

આ રીતે અનિત્યપંચાશત્ર સમાપ્ત થયું. ૩.



૪. એકત્વસપ્તાતી

[૪. એકત્વસપ્તાતી]

(અનુષ્ટુભ्)

ચિદાનન્દેકસદ્ગાવં પરમાત્માનભવ્યયમ् ।
પ્રણમામિ સદા શાન્તં શાન્તયે સર્વકર્મણામ् ॥૧॥

અનુવાદ : જે પરમાત્મામાં ચેતનસ્વરૂપ અનુપમ આનંદનો સદ્ગાવ છે તથા જે અવિનશ્બર અને શાન્ત છે તેમને હું (પદ્મનંદીમુનિ) પોતાના સમસ્ત કર્મો શાન્ત કરવા માટે સદા નમસ્કાર કરું છું. ૧.

(અનુષ્ટુભ्)

ખાદિપજ્વકનિર્મુક્તં કર્માષ્ટકવિવર્જિતમ् ।
ચિદાત્મકં પરં જ્યોતિર્વંદે દેવેન્દ્રપૂજિતમ् ॥૨॥

અનુવાદ : જે આકાશાદિ પાંચ (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી) દ્રવ્યોથી અર્થાત્ શરીરથી તથા જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી પણ રહિત થયેલ છે અને દેવોના ઈન્દ્રોથી પૂજ્ય છે એવી તે ચૈતન્યસ્વરૂપ ઉત્કૃષ્ટ જ્યોતિને હું નમસ્કાર કરું છું. ૨.

(અનુષ્ટુભ्)

યદવ્યક્તમબોધાનાં વ્યક્તં સદ્ગોધચક્ષુષામ् ।
સારં યત્સર્વવસ્તૂનાં નમસ્તસ્મૈ ચિદાત્મને ॥૩॥

અનુવાદ : જે ચેતન આત્મા અજ્ઞાની પ્રાણીઓને અસ્પષ્ટ તથા સમ્યજ્ઞાનીઓને

અધિકાર-૪ : એકત્વસપ્તતિ]

૧૪૮

સ્પષ્ટ છે અને સમસ્ત વસ્તુઓમાં શ્રેષ્ઠ છે તે ચેતન આત્માને નમસ્કાર હો. ૩.

(અનુષ્ટુભ्)

ચિત્તત્વं તત્ત્વતિપ્રાણિદેહ એવ વ્યવસ્થિતમ् ।
તમશ્છન્ના ન જાનન્તિ ભ્રમન્તિ ચ બહિર્વહિઃ ॥૪॥

અનુવાદ : તે ચેતન્ય તત્ત્વ પ્રત્યેક પ્રાણીના શરીરમાં જ સ્થિત છે. પરંતુ અજ્ઞાનરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ તેને જાણતા નથી, તેથી તેઓ બહારને બહાર ઘૂમે છે અર્થાત્ વિષયભોગજનિત સુખને જ વાસ્તવિક સુખ માનીને તેને પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્નશીલ રહે છે. ૪.

(અનુષ્ટુભ्)

ભ્રમન્તો ઽપિ સદા શાસ્ત્રજાલે મહતિ કેવન ।
ન વિદન્તિ પરં તત્ત્વ દારુणીવ હૃતાશનમ् ॥૫॥

અનુવાદ : કેટલાય મનુષ્યો સદા મહાન્ શાસ્ત્રસમૂહમાં પરિભ્રમણ કરતા હોવા છતાં પણ, અર્થાત્ અનેક શાસ્ત્રોનું પરિશીલન કરતા હોવા છતાં તે ઉત્કૃષ્ટ આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અંગિન સમાન જાણતા નથી. ૫.

(અનુષ્ટુભ्)

કેવિત્કેનાપિ કારુણ્યાત્કથ્યમાનમાપિ સુફટમ् ।
ન મન્યન્તે ન શૃંગન્તિ મહામોહમલીમસાઃ ॥૬॥

અનુવાદ : જો કોઈ દ્યાથી પ્રેરાઈને તે ઉત્કૃષ્ટ તત્ત્વનું સ્પષ્ટપણે કથન કરે છે તો પણ કેટલાય પ્રાણીઓ મહામોહથી મલિન થઈને તેને માનતા ય નથી અને સાંભળતા ય નથી. ૬.

(અનુષ્ટુભ्)

ભૂરિધર્માત્મકં તત્ત્વं દુઃશ્રુતેર્મન્દબુદ્ધયઃ ।
જાત્યન્ધહસ્તિરૂપેણ જ્ઞાત્વા ન શયન્તિ કેવન ॥૭॥

અનુવાદ : જેમ જન્માંધ મનુષ્ય હાથીનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરી શકતો

નથી, પરંતુ તેના કોઈ એક જ અંગને પકડીને તેને જ હાથી માની લે છે બરાબર એવી જ રીતે કેટલાય મંદબુદ્ધિ મનુષ્યો એકાંતવાદીઓ દ્વારા પ્રકાશિત ખોટા શાસ્ત્રોના અત્યાસથી પદાર્થને સર્વથા એકરૂપ જ માનીને તેના અનેક ધર્માત્મક (અનેકાન્તાત્મક) સ્વરૂપને જાણતા નથી અને તેથી તે વિનાશ પામે છે.

વિશોધાર્થ : જેવી રીતે એક જ પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ, કુવાપણું, મામાપણું વગેરે અનેક ધર્મ ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહે છે તથા અપેક્ષાકૃત હોવાથી તેમનામાં પરસ્પર કોઈ પ્રકારનો વિરોધ પણ આવતો નથી. એવી જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહે છે. પરંતુ કેટલાય એકાંતવાદી તેમની અપેક્ષાકૃત સત્યતા ન સમજતાં તેમનામાં પરસ્પર વિરોધ બતાવે છે. તેમનું કહેવું એમ છે કે જેવી રીતે કોઈ એક જ પદાર્થમાં એક સાથે શીતપણું અને ઉષ્ણપણું આ બન્ને ધર્મ રહી શકતા નથી તેવી જ રીતે એક જ પદાર્થમાં નિત્યપણું-અનિત્યપણું, પુથકત્વ-અપુથકત્વ તથા એકત્વ-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મ પણ એક સાથે રહી શકતા નથી. પરંતુ જો આના ઉપર ગંભીર દાખિથી વિચાર કરવામાં આવે તો ઉક્ત ધર્મો રહેવામાં કોઈ પ્રકારનો વિરોધ પ્રતિભાસતો નથી. જેમ-કોઈ એક જ પુરુષમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતાપણું અને પિતાની અપેક્ષાએ પુત્રપણું આ બન્ને વિરોધી ધર્મ રહેવામાં, એક જ વસ્તુમાં શીતપણું અને ઉષ્ણપણું રહેવામાં જે વિરોધ બતાવવામાં આવે છે તેમાં પ્રત્યક્ષરૂપે બાધા આવે છે કેમકે ચિયિપિયા આદિમાં એક સાથે તે બન્ને (આગલા ભાગની અપેક્ષાએ ઉષ્ણપણું અને પાછલા ભાગની અપેક્ષાએ શીતપણું) ધર્મ પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. એ જ રીતે ઘટ-પટાદિ બધા પદાર્થોમાં દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આદિ પરસ્પર વિરોધી દેખાતા ધર્મ પણ પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે ઘડાનો નાશ થાય છે ત્યારે તે કાંઈ નિરન્યય નાશ થતો નથી. પરંતુ જે પુદ્ગલ દ્રવ્ય ઘટ પર્યાયમાં હતું તેનું પુદ્ગલપણું તે નાચ થઈ જતાં ઉત્પન્ન થયેલ ઠીકરાઓમાં પણ ટકી કહે છે. તેથી પર્યાયની અપેક્ષાએ જ તેનો નાશ કહેવાશે નહિ કે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પણ. એવી જ રીતે અન્ય ધર્મોના સંબંધમાં પણ સમજવું જોઈએ. આ રીતે જે જડબુદ્ધ પદાર્થમાં અનેક ધર્મો પ્રતીતિસિદ્ધ હોવા છતાં પણ તેમનામાંથી કોઈ એક જ ધર્મનો દુરાગ્રહ વશ થઈને સ્વીકાર કરે છે તેઓ પોતે જ પોતાનું અહિત કરે છે. ૭.

(અનુષ્ટુભ્)

કેવિત્ કિંચિત્પરિજ્ઞાય કુતશ્ચિદ્રવિતાશયાઃ ।
જગન્મન્દ પ્રપશ્યન્તો નાશ્રયન્તિ મનીષિણઃ ॥૮॥

આનુવાદ : કેટલાય જીવ કોઈ શાસ્ત્ર આદિના નિભિતે કાંઈક થોડું એક જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઈ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમજને અન્ય કોઈ પણ વિશિષ્ટ વિદ્જાનોનો આશ્રય લેતા નથી. ૮.

(અનુષ્ટુભ्)

જન્તુમુદ્ભરતે ધર્મઃ પતન્ત દુઃખસંકટે ।
અન્યથા સ કૃતો ભ્રાન્ત્યા લોકૈર્ગાહ્યઃ પરીક્ષિતઃ ॥૧॥

અનુવાદ : દુઃખરૂપ સંકુચિત માર્ગમાં (ખાડામાં) પડતા પ્રાણીનું રક્ષણ ધર્મ જ કરે છે. પરંતુ બીજાઓએ એનું સ્વરૂપ ભાન્તિવશ થઈને વિપરીત કરી દીધું છે. તેથી મનુષ્યોએ તેનું (ધર્મનું) પરીક્ષાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. ૮.

(અનુષ્ટુભ्)

સર્વવિદ્વીતરાગોત્તો ધર્મઃ સૂનૃતતાં બ્રજેત્ ।
પ્રામાણ્યતો યતઃ પુંસો વાચઃ પ્રામાણ્યમિષ્યતે ॥૧૦॥

અનુવાદ : જે ધર્મ સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવામાં આવ્યો હોય તે જ યથાર્થપણાને પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે પુરુષની પ્રમાણતાથી જ વચનમાં પ્રમાણતા માનવામાં આવે છે.

વિશેષાર્થ : વચનમાં અસત્યપણું કાં તો અલ્પજ્ઞતાને કારણે હોય છે અથવા તો પણી હંદ્ય રાગ-દ્વેષથી દૂષિત હોવાના કારણે. તેથી જે પુરુષ અલ્પજ્ઞ અને રાગ-દ્વેષ સહિત છે તેનો કહેલો ધર્મ પ્રમાણ હોઈ શકે નહિ. પરંતુ જે પુરુષ સર્વજ્ઞ હોવાની સાથોસાથ રાગ-દ્વેષથી રહિત પણ થઈ ગયા છે તેમનો જ કહેલો ધર્મ પ્રમાણ માની શકાય છે. ૧૦.

(અનુષ્ટુભ्)

બહિર્વિષયસંબંધઃ સર્વઃ સર્વસ્ય સર્વદા ।
અતસ્તદ્વિન્નચૈતન્યબોધયોગૌ તુ દુર્લભૌ ॥૧૧॥

અનુવાદ : બધા બાધ્ય વિષયોનો સંબંધ બધા પ્રાણીઓને અને તે પણ સદા કાળ રહે છે. પરંતુ તેનાથી ભિન્ન ચૈતન્ય અને સમ્યજ્ઞાનનો સંબંધ એ બન્ને દુર્લભ છે. ૧૧.

(અનુષ્ટુભ्)

લબ્ધિપञ્ચકસામગ્રીવિશેષાત્યાત્રતાં ગતઃ ।
ભવઃ સમ્યગ્વાદીનાં યઃ સ મુક્તિપથે સ્થિતઃ ॥૧૨॥

અનુવાદ :—જે ભવ્યજ્ઞવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ આ પંચ લબ્ધિઓ રૂપ વિશેષ સામગ્રીથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને

સમ્યક્યારિતરૂપ રત્નત્રય ધારણ કરવાને યોગ્ય બની ગયો છે તે મોક્ષમાર્ગમાં સ્થિત થઈ ગયો છે.

વિશેષાર્થ :—પ્રથમોપશમ સમ્યકૃતવની પ્રાપ્તિ જે પાંચ લભિઓ દ્વારા થાય છે તેમનું સ્વરૂપ આ રીતે છે.

૧. ક્ષયોપશમ લભિય :—જ્યારે પૂર્વસંચિત કર્માંના અનુભાગ સ્પર્ધકો વિશુદ્ધિ દ્વારા પ્રત્યેક સમયે ઉત્તરોત્તર અનંતગુણી હીન થતા થકા ઉદ્દીરણાને પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષયોપશમ લભિય થાય છે.

૨. વિશુદ્ધિલભિય :—પ્રતિસમય અનંતગુણી હીનતાના કમથી ઉદ્દીરણાને પ્રાપ્ત કરાવવામાં આવેલા અનુભાગ સ્પર્ધકોથી ઉત્પન્ન થયેલ જે જીવના પરિણામ શાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિઓના બંધનું કારણ તથા અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓના અબંધનું કારણ થાય છે તેને વિશુદ્ધિ કહે છે. આ વિશુદ્ધિની પ્રાપ્તિનું નામ વિશુદ્ધિલભિય છે.

૩. દેશનાલભિય :—જીવાદિ છ દ્રવ્ય તથા નવ પદાર્થોના ઉપદેશને દેશના કહેવામાં આવે છે. તે દેશનામાં લીન થયેલ આચાર્ય આદિની પ્રાપ્તિને તથા તેમના દ્વારા ઉપદિષ્ટ પદાર્થના ગ્રહણ, ધારણ અને વિચાર કરવાની શક્તિની પ્રાપ્તિને પણ દેશનાલભિય કહે છે.

૪. પ્રાયોગ્યલભિય :—બધા કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિનો ઘાત કરીને તેને અંત:કોડાકોડી માત્ર સ્થિતિમાં સ્થાપિત કરવાને તથા ઉક્ત સર્વ કર્માંના ઉત્કૃષ્ટ અનુભાગનો ઘાત કરીને તેને દ્વિસ્થાનીય (ઘાતિયા કર્માંને લતા અને લાકડારૂપ તથા અન્ય પાપ પ્રકૃતિઓને લીંબડા અને કંઢ રૂપ) અનુભાગમાં સ્થાપિત કરવાને પ્રાયોગ્યલભિય કહેવામાં આવે છે.

૫. કરણલભિય :—અધઃપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ પ્રકારના પરિણામોની પ્રાપ્તિને કરણલભિય કહે છે. જે પરિણામોમાં ઉપરિતનસમયવર્તી પરિણામ અધસ્તનસમયવર્તી પરિણામોના સમાન હોય છે તેમને અધઃપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. (વિશેષ જ્ઞાનવા માટે જુઓ ષટભંડાગમ પૃ. ૬, પૃ. ૨૧૪ વગેરે). પ્રત્યેક સમયે ઉત્તરોત્તર જે અપૂર્વ અપૂર્વ પરિણામ થાય છે તે અપૂર્વકરણ પરિણામ કહેવાય છે. આમાં બિન્ન સમયવર્તી જીવોના પરિણામ સર્વથી વિસંદેશ અને એક સમયવર્તી જીવોના પરિણામ સંદેશ અને વિસંદેશ પણ હોય છે. જે પરિણામ એક સમયવર્તી જીવોના સર્વથા સંદેશ તથા બિન્ન સમયવર્તી જીવોના સર્વથા વિસંદેશ જ હોય છે તેમને અનિવૃત્તિકરણ પરિણામ કહેવામાં આવે છે. પ્રથમોપશમ સમ્યકૃતવની પ્રાપ્તિ આ ત્રણ પ્રકારના પરિણામોના અંતિમ સમયે થાય છે. ઉપર્યુક્ત પાંચ લભિયોમાં પૂર્વની ચાર લભિયો ભવ્ય અને અભવ્ય બન્નેનેય સમાનરૂપે થાય છે. પરંતુ પાંચમી કરણલભિય સમ્યકૃત સન્મુખ થયેલા ભવ્ય જીવને જ હોય છે. ૧૨.

(અનુષ્ઠાનિક)

સમ્યગ્દ્વારોધચારિત્રિત્રિતયં મુત્કિકારણમ् ।
મુક્તાવેવ સુખં તેન તત્ત્વ યત્નો વિધીયતામ् ॥૧૩॥

અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રિ આ ત્રણે એકત્રિત રૂપે મોક્ષનાં કારણ છે. અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. તેથી તે મોક્ષના વિષયમાં પ્રયત્ન કરવો જોઈએ. ૧૩.

(અનુષ્ઠાનિક)

દર્શનં નિશ્ચયઃ પુંસિ બોધસ્તદ્વોધ ઇષ્યતે ।
સ્થિતિરત્ત્રૈવ ચારિત્રમિતિ યોગઃ શિવાશ્રયઃ ॥૧૪॥

અનુવાદ : આત્માના વિષયમાં જે નિશ્ચય થઈ જાય છે તેને સમ્યગ્દર્શન, તે આત્માનું જે જ્ઞાન થાય છે તેને સમ્યજ્ઞાન તથા તે જ આત્મામાં સ્થિર થવાને સમ્યક્યારિત્રિ કહેવામાં આવે છે. આ ત્રણેનો સંયોગ મોક્ષનું કારણ થાય છે. ૧૪.

(અનુષ્ઠાનિક)

એકમેવ હિ ચैતન્યं શુદ્ધનિશ્ચયતોऽથવા ।
કો ઽવકાશો વિકલ્પાનાં તત્ત્રાખણ્ડકવસ્તુનિ ॥૧૫॥

અનુવાદ : અથવા શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ આ (સમ્યગ્દર્શનાદિ) ત્રણે એક ચૈતન્યસ્વરૂપ જ છે. કારણ કે તે અખંડ એક વસ્તુ (આત્મા)માં ભેદોને સ્થાન જ કર્યાં છે?

વિશેષાર્થ : ઉપર જે સમ્યગ્દર્શન આદિનું પૃથ્ફ પૃથ્ફ સ્વરૂપ ભતાવવામાં આવ્યું છે તે વ્યવહારનયની અપેક્ષાએ છે. શુદ્ધ નિશ્ચયનયથી તે ત્રણેમાં કોઈ ભેદ નથી કારણ કે તે ત્રણેય અખંડ આત્માથી અભિન્ન છે. તેથી તેમનામાં ભેદની કલ્પના પણ થઈ શકતી નથી. ૧૫.

(અનુષ્ઠાનિક)

પ્રમાણનયનિક્ષેપા અર્વાચીને પદે સ્થિતાઃ ।
કેવલે ચ પુનસ્તસ્મિંસ્તદેકં પ્રતિભાસતે ॥૧૬॥

અનુવાદ : પ્રમાણ, નય અને નિક્ષેપ એ અર્વાચીન પદમાં સ્થિત છે અર્થાત્ જ્યારે વ્યવહારનયની મુખ્યતાથી વસ્તુનું વિવેચન કરવામાં આવે છે ત્યારે જ તેમનો ઉપયોગ થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દસ્તિમાં કેવળ એક શુદ્ધ આત્મા જ

પ્રતિભાસિત થાય છે. ત્યાં તે ઉપર્યુક્ત સમ્યગ્દર્શનાદિ ત્રણે પણ અભેદરૂપમાં એક જ પ્રતિભાસિત થાય છે. ૧૬.

(અનુષ્ઠાન)

નિશ્ચયૈકદીશા નિત્યં તદૈવૈકં વિદાત્મકમ् ।
પ્રપશ્યામિ ગતભ્રાન્તિર્બ્રવહારદીશા પરમ् ॥૧૭॥

અનુવાદ : હું નિશ્ચયનય રૂપ અનુપમ નેત્રથી સદા ભાંતિથી રહિત થઈને તે જ એક ચૈતન્યસ્વરૂપને દેખું છું. પરંતુ વ્યવહારનયરૂપ નેત્રથી ઉક્ત સમ્યગ્દર્શનાદિ પૃથક્ પૃથક્ સ્વરૂપે દેખું છું. ૧૭.

(અનુષ્ઠાન)

અજમેકં પરં શાન્તં સર્વોપાધિવિર્જિતમ् ।
આત્માનમાત્મના જ્ઞાત્વા તિષ્ઠેદાત્મનિ યઃ સ્થિરઃ ॥૧૮॥

(અનુષ્ઠાન)

સ એવામૃતમાર્ગस્થઃ સ એવામૃતમશ્નુતે ।
સ એવાર્હનું જગન્નાથઃ સ એવ ગ્રભુરીશ્વરઃ ॥૧૯॥

અનુવાદ : જે ભણત્વા જન્મ-મરણ રહિત, એક, ઉત્કૃષ્ટ, શાન્ત અને સર્વ પ્રકારના વિશેષણો રહિત આત્માને આત્મા દ્વારા જાણીને તે જ આત્મામાં સ્થિર રહે છે, તે જ અમૃત અર્થાત્ મોક્ષના માર્ગ સ્થિત થાય છે, તે જ મોક્ષપદને પ્રાપ્ત કરે છે તથા તે જ અર્હન્ત, ત્રણે લોકના સ્વામી, પ્રભુ અને ઈશ્વર કહેવાય છે. ૧૮-૧૯.

(અનુષ્ઠાન)

કેવળજ્ઞાનદ્વક્સૌખ્યસ્વભાવં તત્પરં મહઃ ।
તત્ત્ર જ્ઞાતે ન કિં જ્ઞાતં દૃષ્ટે દૃષ્ટં શ્રુતે શ્રુતમ् ॥૨૦॥

અનુવાદ : કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંત સુખસ્વરૂપ જે તે ઉત્કૃષ્ટ તેજ છે તેને જાણતાં બીજું શું ન જણાયું? તેને દેખી લેતાં બીજું શું ન દેખવામાં આવ્યું? અને તેને સાંભળતાં બીજું શું ન સાંભળવામાં આવ્યું? અર્થાત્ એક માત્ર તેને જાણી લેતાં બધું જ જણાઈ ગયું છે, તેને દેખી લેતાં બધું જ દેખવામાં આવી ગયું છે

અને તેને સાંભળી લેતાં બધું જ સાંભળી લીધું છે. ૨૦.

(અનુષ્ઠાનિક)

ઇતિ જ્ઞેયં તદેવૈકં શ્રવણીયં તદેવ હિ ।
દ્રષ્ટવ્યં ચ તદેવૈકં નાન્યનિશ્ચયતો બુધૈઃ ॥૨૧॥

અનુવાદ : આ કારણે વિદ્ધાનું મનુષ્યોએ નિશ્ચયથી તે જ એક ઉત્કૃષ્ટ આત્મતેજ જાણવા યોગ્ય છે, તે જ એક સાંભળવા યોગ્ય છે તથા તે જ એક દેખવા યોગ્ય છે; તેનાથી બિન્ન અન્ય કંઈ પણ ન જાણવા યોગ્ય છે, ન સાંભળવા યોગ્ય છે અને ન દેખવા યોગ્ય છે. ૨૧.

(અનુષ્ઠાનિક)

ગુરૂપદેશતો ઽભ્યાસાદૈરાગ્યાદુપલભ્ય યત્તુ ।
કૃતકૃત્યો ભવેદ્યોગી તદેવૈકં ન ચાપરમ્ય ॥૨૨॥

અનુવાદ : યોગીઓ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને વૈરાગ્યથી તે જ એક આત્મતેજ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય (મુક્ત) થાય છે, નહિ કે તેનાથી બિન્ન કોઈ અન્યને પ્રાપ્ત કરીને. ૨૨.

(અનુષ્ઠાનિક)

તત્પ્રતિપ્રીતિચિત્તેન યેન વાર્તાપિ હિ શ્રુતા ।
નિશ્ચિતં સ ભવેદ્બવ્યો ભાવિનિર્વાણભાજનમ् ॥૨૩॥

અનુવાદ : તે આત્મતેજ પ્રત્યે મનમાં પ્રેમ ધારણ કરીને જેણે તેની વાત પણ સાંભળી છે તે નિશ્ચયથી ભવ્ય છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી મુક્તિનું પાત્ર છે. ૨૩.

(અનુષ્ઠાનિક)

જાનીતે યઃ પરં બ્રહ્મ કર્મણઃ પૃથગેકતામ् ।
ગતં તદ્ગતબોધાત્મા તત્સ્વરૂપં સ ગચ્છતિ ॥૨૪॥

અનુવાદ : જે જ્ઞાનસ્વરૂપ જીવ કર્મથી પૃથક થઈને અભેદ અવસ્થાને પ્રાપ્ત થઈ તે ઉત્કૃષ્ટ આત્માને જાણે છે અને તેમાં લીન થાય છે તે પોતે જ તેના સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ પરમાત્મા બની જાય છે. ૨૪.

(અનુષ્ઠાન)

કેનાપિ હિ પરેણ સ્યાત્સંબન્ધો બન્ધકારણમ્ ।
પૈકત્વપદે શાન્તે મુક્તયે સ્થિતિરાત્મનઃ ॥૨૫॥

અનુવાદ : કોઈ પણ પરપદાર્થ સાથે જે સંબંધ થાય છે તે બંધનું કારણ થાય છે, પરંતુ શાન્ત અને ઉત્કૃષ્ટ એકત્વપદમાં જે આત્માની સ્થિતિ થાય છે તે મુક્તિનું કારણ થાય છે. ૨૫.

(અનુષ્ઠાન)

વિકલ્પોર્મિભરત્યત્તઃ શાન્તઃ કૈવત્યમાશ્રિતઃ ।
કર્માભાવે ભવેદાત્મા વાતાભાવે સમુદ્રવત્ ॥૨૬॥

અનુવાદ : કર્મના અભાવમાં આ આત્મા વાયુના અભાવમાં સમુદ્રસમાન વિકલ્પો-
ર્મિભરત્યત્તઃ લહેરોના ભારથી રહિત અને શાન્ત થઈને ડેવલ્ય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે.

વિશેષાર્થ : જેવી રીતે વાયુનો સંચાર ન થતાં સમુદ્ર લહરિયોથી રહિત, શાન્ત અને
એકત્વ અવસ્થા યુક્ત થાય છે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્માનો અભાવ થઈ જતાં આ આત્મા
સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત, શાન્ત (કોધાદિ વિકારો રહિત) અને કેવળી અવસ્થાથી યુક્ત થઈ
જાય છે. ૨૬.

(અનુષ્ઠાન)

સંયોગેન યદાયાતં મત્તસ્તત્ત્વકલં પરમ્ ।
તત્પરિત્યાગયોગેન મુક્તો ઽહમિતિ મે મતિઃ ॥૨૭॥

અનુવાદ : સંયોગથી જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે તે સર્વ મારાથી ભિન્ન છે.
તેનો પરિત્યાગ કરી દેવાના સંબંધથી હું મુક્ત થઈ ગયો છું એવો મારો નિશ્ચય છે.

વિશેષાર્થ : આ પ્રાણી સ્ત્રી, પુત્ર, ભિત્ર અને ધન સંપત્તિ આદિ પર પદાર્થોના સંયોગથી
જ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, તેથી ઉક્ત સંયોગનો જ પરિત્યાગ કરવો જોઈએ. એમ
કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૨૭.

(અનુષ્ઠાન)

કિं મે કરિષ્યતઃ કૂરૌ શુભાશુભનિશાચરૌ ।
રાગદ્વેષપરિત્યાગમહામન્ત્રેણ કીલિતૌ ॥૨૮॥

અનુવાદ : જે પુણ્ય અને પાપરૂપ બને દુષ્ટ રાક્ષસોને રાગ-દ્રેષ્ણના પરિત્યાગરૂપ મહામંત્ર દ્વારા કીલિત કરી દેવામાં આવ્યા છે તેઓ હવે મારું (આત્માનું) શું કરી શકશો? અર્થાત્ તેઓ કંઈ પણ હાનિ કરી શકશો નહિ.

વિશેષાર્થ : જે પુણ્ય અને પાપરૂપ કર્મ પ્રાણીને અનેક પ્રકારનું કષ્ટ (પરતંત્રતા આદિ) આપ્યા કરે છે તેમનો બંધ રાગ અને દ્રેષ્ણના નિમિત્તે જ થાય છે. તેથી ઉક્ત રાગ-દ્રેષ્ણનો પરિત્યાગ કરી દેવાથી તેમનો બંધ સ્વયમેવ અટકી જાય છે અને આ રીતે આત્મા સ્વતંત્ર થઈ જાય છે. ૨૮.

(અનુષ્ટુભ्)

સંબન્ધેઽપિ સતિ ત્યાજ્યૌ રાગદ્રેષૌ મહાત્માભિઃ ।

વિના તેનાપિ યે કુર્યુસ્તે કુર્યુઃ કિં ન વાતુલાઃ ॥૨૯॥

અનુવાદ : મહાત્માઓએ સંબંધ (નિમિત્ત) હોવા છતાં પણ તે રાગ-દ્રેષ્ણનો પરિત્યાગ કરવો જોઈએ. જે જીવ તે (સંબંધ) ના વિના પણ રાગ-દ્રેષ્ણ કરે છે તેઓ વાતરોગથી પિડાયેલા રોગી સમાન પોતાનું ક્રું અહિત નથી કરતા? અર્થાત્ તેઓ પોતાનું સર્વ પ્રકારે અહિત કરે છે. ૨૯.

(અનુષ્ટુભ्)

મનોવાક્યાયચેષ્ટાભિસ્તાદ્વિધં કર્મ જૃભતે ।

ઉપાસ્યતે તદેવૈકં તાભ્યો ભિન્ન મુમુક્ષુભિઃ ॥૩૦॥

અનુવાદ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે પ્રકારનું અર્થાત્ તદનુસાર પુણ્ય-પાપરૂપ કર્મ વૃદ્ધિ પામે છે. માટે મુમુક્ષુઓએ ઉક્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ભિન્ન તે જ એક આત્મતત્ત્વની ઉપાસના કર્યા કરે છે. ૩૦.

(અનુષ્ટુભ्)

દૈત્યો દૈત્યમદૈતાદદૈતં ખલુ જાયતે ।

લોહાલ્લોહમયં પાત્ર હેમ્નો હેમમય યથા ॥૩૧॥

અનુવાદ : દૈત ભાવથી નિયમથી દૈત અને અદૈતભાવથી અદૈત ઉત્પન્ન થાય છે. જેમ લોઢામાંથી લોઢાનું અને સોનામાંથી સોનાનું જ વાસણ ઉત્પન્ન થાય છે.

વિશેષાર્થ : આત્મા અને કર્મ તથા બંધ અને મોક્ષ ઈત્યાદિ પ્રકારની બુદ્ધિ તે દૈતબુદ્ધિ કહેવાય છે. એવી બુદ્ધિથી દૈતભાવ જ બની રહે છે કે જેથી સંસાર પરિભ્રમણ

અનિવાર્ય થઈ જાય છે. પરંતુ હું એક જ છું, અન્ય બાધ્ય પદાર્થો ન મારા છે અને ન હું તેમનો છું, આ જાતની બુદ્ધિ અદ્વૈતબુદ્ધિ કહેવાય છે. આ પ્રકારના વિચારથી તે અદ્વૈતભાવ સદા જગૃત રહે છે કે જેથી અંતે મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય છે. એના આટે અહીં એ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે લોળાની ધાતુમાંથી લોહમય અને સુવર્ણમાંથી સુવર્ણમય જ પાત્ર બને છે તેવી જ રીતે દૈતબુદ્ધિથી દૈતભાવ તથા અદ્વૈતબુદ્ધિથી અદ્વૈતભાવ જ થાય છે. ૩૧.

(અનુષ્ઠાન)

નિશ્ચયેન તદેકત્વમદૈતમમૃતં પરમ ।
દ્વિતીયેન કૃતં દૈતં સંસૃતિર્વચહારતઃ ॥૩૨॥

અનુવાદ : નિશ્ચયથી જે એકત્વ છે તે જ અદ્વૈત છે કે જે ઉત્કૃષ્ટ અમૃત અર્થાત્ મોક્ષસ્વરૂપ છે. પરંતુ બીજા (કર્મ કે શરીર આદિ) ના નિમિત્તે જે દૈતભાવ ઉત્પન્ન થાય છે તે વ્યવહારની અપેક્ષા રાખવાથી સંસારનું કારણ થાય છે. ૩૨.

(અનુષ્ઠાન)

બન્ધમોક્ષૌ રતિદ્રેષૌ કર્માત્માનૌ શુભાશુભૌ ।
ઇતિ દૈતાશ્રિતા બુદ્ધિરસિદ્ધિરભિધીયતે ॥૩૩॥

અનુવાદ : બંધ અને મોક્ષ, રાગ અને દ્રેષ, કર્મ અને આત્મા તથા શુભ અને અશુભ; આ જાતની બુદ્ધિ દૈતના આશ્રયે થાય છે જે સંસારનું કારણ કહેવાય છે. ૩૩.

(અનુષ્ઠાન)

ઉદ્યોગીરણા સત્તા પ્રગન્ધઃ ખલુ કર્મણઃ ।
બોધાત્મધામ સર્વેભ્યસ્તદેવૈકં પરં પરમ ॥૩૪॥

અનુવાદ : ઉદ્ય, ઉદ્દીરણા અને સત્ત્વ આ બધો નિશ્ચયથી કર્મનો વિસ્તાર છે. પરંતુ જ્ઞાનરૂપ જે આત્માનું તેજ છે તે તે બધાથી બિન્ન, એક અને ઉત્કૃષ્ટ છે.

વિશેષાર્થ : સ્થિતિ પૂર્ણ થતાં જીર્ણ થયેલું કર્મ જે ફળાનની સન્મુખ થાય છે તેને ઉદ્ય કહેવામાં આવે છે. ઉદ્યકાળ પ્રાપ્ત ન થવા છતાં પણ અપકર્ષણ દ્વારા જે કર્મનિષેક ઉદ્યમાં સ્થાપિત કરાવવામાં આવે છે, તેને ઉદ્દીરણા કહે છે. જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓના કર્મસ્વરૂપે અવસ્થિત રહેવાને સત્ત્વ કહેવામાં આવે છે. ૩૪.

(અનુષ્ઠાનિક)

ક્રોધાદિકર્મયોગે�પિ નિર્વિકારં પરં મહઃ ।
વિકારકારિભિર્મેધૈન વિકારિ નભો ભવેત્ ॥૩૫॥

અનુવાદ : કોધાદિ કર્માનો સંયોગ થવા છતાં પણ તે ઉત્કૃષ્ટ આત્મતેજ વિકાર રહિત જ હોય છે. બરાબર પણ છે-વિકાર કરનારા વાદળાઓથી કદી આકાશ વિકારયુક્ત નથી થતું.

વિશેષાર્થ : જેમ આકાશમાં વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ રહેવા છતાં પણ તે આકાશ વિકારી થતું નથી. પરંતુ સ્વભાવથી સ્વચ્છ જ રહે છે. તેવી જ રીતે આત્મા સાથે કોધાદિ કર્માનો સંયોગ રહેવા છતાં પણ આત્મામાં વિકાર ઉત્પન્ન નથી થતો, પરંતુ તે સ્વભાવથી નિર્વિકાર જ રહે છે. ઉપ.

(અનુષ્ઠાનિક)

નામાપિ હિ પરં તસ્માનિશ્ચયાત્તદનામકમ् ।
જન્મમૃત્યાદિ ચાશેષં વપુર્ધર્મ વિદુર્બુધાઃ ॥૩૬॥

અનુવાદ : આત્માનો વાચક શબ્દ પણ નિશ્ચયથી તેનાથી લિન્ન છે, કેમ કે નિશ્ચયનયની અપેક્ષાએ તે આત્મા સંજ્ઞા રહિત (અનિર્વચનીય) છે. અર્થાત્ વાચ્ય-વાચકભાવ વ્યવહારનયને આશ્રિત છે, નહિ કે નિશ્ચયનયને. વિદ્વાનો જન્મ અને મરણ આદિ બધાને શરીરનો ધર્મ સમજે છે. ઉદ્દ.

(અનુષ્ઠાનિક)

બોધેનાપિ યુતિરત્તસ્ય ચૈતન્યસ્ય તુ કલ્પના ।
સ ચ તત્ત્વ તયોરૈક્યં નિશ્ચયેન વિભાવ્યતે ॥૩૭॥

અનુવાદ : તે ચૈતન્યનો જ્ઞાન સાથે પણ જે સંયોગ છે તે કેવળ કલ્પના છે, કેમ કે જ્ઞાન અને ચૈતન્ય આ બન્નેમાં નિશ્ચયથી અભેદ માનવામાં આવે છે. ઉદ્દ.

(અનુષ્ઠાનિક)

ક્રિયાકારકસંબન્ધપ્રબન્ધોજ્ઞિતમૂર્તિ યત્ ।
એવं જ્યોતિસ્તદેવૈકં શરણ્યં મોક્ષકાડુક્ષિણામ् ॥૩૮॥

અનુવાદ : જે આત્મજ્યોતિ ગમનાદિરૂપ ક્રિયા, કર્તા આદિ કારક અને તેમના

સંબંધના વિસ્તાર રહિત છે તે જ એક માત્ર જ્યોતિ મોક્ષાભિલાષી સાધુજ્ઞનોને શરણભૂત છે. ૩૮.

(અનુષ્ઠાન)

તદેકં પરમં જ્ઞાનં તદેકં શુચિ દર્શનમ् ।
ચારિત્રં ચ તદેકં સ્યાત્ તદેકં નિર્મલં તપઃ ॥૩૯॥

અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તે જ એક આત્મજ્યોતિ નિર્મળ સમ્યગ્દર્શન છે, તે જ એક આત્મજ્યોતિ ચારિત્ર છે તથા તે જ એક આત્મજ્યોતિ નિર્મળ તપ છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થઈ જાય છે ત્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એક માત્ર આત્માનો જ અનુભવ થાય છે. તે વખતે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્યારિત્ર અને તપ આદિમાં કાંઈ પણ ભેદ નથી રહેતો. એ જ રીતે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયનો પણ કાંઈ ભેદ રહેતો નથી; કેમકે તે વખતે તે જ એક માત્ર આત્મા જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા બની જાય છે. તેથી આ અવસ્થામાં કર્તા અને કરણ આદિ કારકોનો પણ બધો ભેદ સમાપ્ત થઈ જાય છે. ૩૮.

(અનુષ્ઠાન)

નમસ્યં ચ તદેવૈકં તદેવૈકં ચ મહાલમ् ।
ઉત્તમં ચ તદેવૈકં તદેવ શરણં સતામ् ॥૪૦॥

અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ નમસ્કાર કરવા યોગ્ય છે, તે જ એક આત્મજ્યોતિ મંગળસ્વરૂપ છે, તે જ એક આત્મજ્યોતિ ઉત્તમ છે તથા તે જ એક આત્મજ્યોતિ સાધુઓને શરણભૂત છે.

વિશેષાર્થ : “ચત્તારિ મંગલં, અરહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાધુ મંગલં, કેવલિપણણતો ધર્મો મંગલં. ચત્તારિ લોગુતમા....” ઈત્યાદિ પ્રકારે જે અરહંત, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મ આ ચારને મંગળ, લોકોત્તમ તથા શરણભૂત બતાવવામાં આવ્યા છે તે વ્યવહારનયની પ્રધાનતાથી છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળ એક તે આત્મજ્યોતિ જ મંગળ, લોકોત્તમ અને શરણભૂત છે. ૪૦.

(અનુષ્ઠાન)

આચારશ્ર તદેવૈકં તદેવાવશ્યકક્રિયા ।
સ્વાધ્યાયસ્તુ તદેવૈકમપ્રમત્તસ્ય યોગિનઃ ॥૪૧॥

અધિકાર-૪ : એકત્વસપ્તાતિ]

૧૬૧

અનુવાદ : પ્રમાદ રહિત થયેલ મુનિને તે જ એક આત્મજ્યોતિ-આચાર છે, તે જ એક આત્મજ્યોતિ આવશ્યક કિયા છે તથા તે જ એક આત્મજ્યોતિ સ્વાધ્યાય પણ છે. ૪૧.

(અનુષ્ઠાનિક)

ગુણાઃ શિલાનિ સર્વાणિ ધર્મશ્શાત્યન્તનિર્મલઃ ।
સંભાવ્યન્તે પરં જ્યોતિસ્તદેકમનુતિષ્ઠતઃ ॥૪૨॥

અનુવાદ : કેવળ એ જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિનું અનુષ્ઠાન કરનાર સાધુને ગુણોની, સમસ્ત શીલોની અને અત્યન્ત નિર્મળ ધર્મની પણ સંભાવના છે. ૪૨.

(અનુષ્ઠાનિક)

તદેવૈકં પરં રત્નं સર્વશાસ્ત્રમહોદધે: ।
રમણીયેષુ સર્વેષુ તદેકં પુરતઃ સ્થિતમ् ॥૪૩॥

અનુવાદ : સમસ્ત શાસ્ત્રરૂપી મહાસમુદ્રનું ઉત્કૃષ્ટ રત્ન તે જ એક આત્મજ્યોતિ છે તથા તે જ એક આત્મજ્યોતિ સર્વ રમણીય પદાર્થોમાં આગળ સ્થિત અર્થાત् શ્રેષ્ઠ છે. ૪૩.

(અનુષ્ઠાનિક)

તદેવૈકં પરં તત્ત્વં તદેવૈકં પરં પદમ् ।
ભવ્યારાધ્યં તદેવૈકં તદેવૈકં પરં મહઃ ॥૪૪॥

અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ પદ છે, તે જ એક આત્મજ્યોતિ ભવ્ય જીવો દ્વારા આરાધવા યોગ્ય છે, તથા તે જ એક આત્મજ્યોતિ ઉત્કૃષ્ટ તેજ છે. ૪૪.

(અનુષ્ઠાનિક)

શસ્ત્રં જન્મતરુચ્છેદિ તદેવૈકં સતાં મતમ् ।
યોગિનાં યોગનિષ્ઠાનાં તદેવૈકં પ્રયોજનમ् ॥૪૫॥

અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ સાધુઓને જન્મરૂપી વૃક્ષ નષ્ટ કરનાર શશ માનવામાં આવે છે તથા સમાધિમાં સ્થિત યોગીજનોનું ઈષ્ટ પ્રયોજન તે જ એક આત્મજ્યોતિની પ્રાપ્તિ છે. ૪૫.

(અનુષ્ઠાનિક)

મુમુક્ષુણાં તદેવૈકં મુક્તે: પન્થા ન ચાપરઃ ।
આનન્દોऽપિ ન ચાન્યત્ર તદ્વિહાય વિભાવતે ॥૪૬॥

અનુવાદ : મોક્ષાભિલાષી જનોને મોક્ષનો માર્ગ તે જ એક આત્મજ્યોતિ છે, બીજો નહિ. તેના સિવાય બીજા સ્થાનમાં આનંદની પણ સંભાવના નથી. ૪૬.

(અનુષ્ઠાનિક)

સંસારઘોરધર્મેણ સદા તપ્સસ્ય દેહિનઃ ।
યન્ત્રધારાગૃહં શાન્તં તદેવ હિમશીતલમ્ ॥૪૭॥

અનુવાદ : શાન્ત અને બરફ સમાન શીતળ તે જ આત્મજ્યોતિ સંસારરૂપી ભયાનક તાપથી નિરંતર સંતાપ પામેલા પ્રાણીને યંત્રધારાગૃહ (ઝુવારાઓ સહિતનું ધર) સમાન આનંદદાયક છે. ૪૭.

(અનુષ્ઠાનિક)

તદેવૈકં પરં દુર્ગમગમ્યં કર્મવિદ્વિષામ् ।
તદેવૈતતિરસ્કારકારિ સારં નિં બલમ્ ॥૪૮॥

અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ કર્મરૂપી શત્રુઓને દુર્ગમ એવો ઉત્કૃષ્ટ દુર્ગ (કિલ્લો) છે તથા તે જ આ આત્મજ્યોતિ આ કર્મરૂપી શત્રુઓનો તિરસ્કાર કરનારી પોતાની શ્રેષ્ઠ સેના છે. ૪૮.

(અનુષ્ઠાનિક)

તદેવ મહતી વિદ્યા સ્ફુરન્મન્ત્રસ્તદેવ હિ ।
ઔષધં તદપિ શ્રેષ્ઠં જન્મવ્યાધિવિનાશનમ્ ॥૪૯॥

અનુવાદ : તે જ આત્મજ્યોતિ વિપુલ બોધ છે, તે જ પ્રકાશમાન મંત્ર છે, તથા તે જ જન્મરૂપી રોગનો નાશ કરનારી શ્રેષ્ઠ ઔષધિ છે. ૪૯.

(અનુષ્ઠાનિક)

અક્ષયસ્યાક્ષયાનન્દમહાફલભરશ્રિયઃ ।
તદેવૈકં પરં બીજં નિઃશ્રેયસલસત્તરો: ॥૫૦॥

અનુવાદ : તે જ આત્મજ્યોતિ શાશ્વત સુખરૂપી મહાફળોના ભારથી સુશોભિત એવા અવિનશ્વર મોક્ષરૂપી સુંદર વૃક્ષનું એક ઉત્કૃષ્ટ બીજ છે. ૫૦.

(અનુષ્ટુભ्)

તદેવૈકં પરં વિદ્ધિ તૈલોવયગૃહનાયકમ् ।
યેનैકેન વિના શડકે વસદપ્યેતદુદ્ધસમ् ॥૫૧॥

અનુવાદ : તે જ એક ઉત્કૃષ્ટ આત્મજ્યોતિને ત્રણો લોકરૂપી ગૃહનો નાયક સમજવો જોઈએ, જે એક વિના આ ત્રણ લોકરૂપી ગૃહ નિવાસ સહિત હોવા છતાં પણ તેના વિનાનું નિર્જન વન સમાન જણાય છે. અભિપ્રાય એ છે કે અન્ય દ્રવ્યો હોવા છતાં પણ લોકની શોભા તે એક આત્મજ્યોતિથી જ છે. ૫૧.

(અનુષ્ટુભ्)

શુદ્ધં યદેવ ચૈતન્યं તદેવાહં ન સંશયः ।
કલ્પનયાનયાયેતદ્વીનમાનન્દમન્દિરમ् ॥૫૨॥

અનુવાદ : આનંદના સ્થાનભૂત જે આ આત્મજ્યોતિ છે તે “જે શુદ્ધ ચૈતન્ય છે તે જ હું છું. એમાં સંદેહ નથી” આવી કલ્પનાથી પણ રહિત છે. ૫૨.

(અનુષ્ટુભ्)

સૃહા મોક્ષે ઽપિ મોહોત્થા તત્ત્વિષેધાય જાયતે ।
અન્યસ્મૈ તત્કર્થં શાન્તાઃ સ્પૃહયન્તિ મુમુક્ષવઃ ॥૫૩॥

અનુવાદ : મોહના ઉદ્યથી ઉત્પન્ન થયેલી મોક્ષપ્રાપ્તિની પણ અભિલાષા તે મોક્ષની પ્રાપ્તિમાં વિધન નાખનાર બને છે, તો પછી ભવા, શાન્ત મોક્ષાભિલાષી જીવ બીજી કર્દ વસ્તુની ઈચ્છા કરે? અર્થાત્ કોઈની પણ નહિ. ૫૩.

(અનુષ્ટુભ्)

અહં ચૈતન્યમેવૈકં નાન્યત્કિમપિ જાતુચિત् ।
સંબન્ધો ઽપિ ન કેનાપિ દૃઢપક્ષો મમેદશઃ ॥૫૪॥

અનુવાદ : હું એક ચૈતન્યસ્વરૂપ જ છું, તેનાથી બિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ મારું કદી પણ હોઈ શકે નહિ. કોઈ પરપરાર્થ સાથે મારો સંબંધ પણ નથી, એવો મારો દૃઢ નિશ્ચય છે. ૫૪.

(અનુષ્ઠાન)

શરીરાદિ બહિશ્ક્રિન્તાચક્રસંપર્કવર્જિતમ् ।
વિશુદ્ધાત્મસ્થિતં ચિત્તં કુર્વન્નાસ્તે નિરન્તરમ् ॥૫૫॥

અનુવાદ : જ્ઞાની સાધુ શરીરાદિ બાધ્ય પદાર્થ વિષયક ચિન્તા સમૂહના સંયોગ રહિત પોતાના ચિત્તને નિરંતર શુદ્ધ આત્મામાં સ્થિર કરીને રહે છે. ૫૫.

(અનુષ્ઠાન)

એવं સતિ યદેવાસ્તિ તદસ્તુ કિમિહાપૈ: ।
આસાધ્યાત્મન્નિદં તત્ત્વં શાન્તો ભવ સુખી ભવ ॥૫૬॥

અનુવાદ : હે આત્મા, આવી સ્થિતિ હોવાથી જે કાંઈ છે તે ભલે હોય. અહીં અન્ય પદાર્થોથી ભલા શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નહિ. આ ચૈતન્યસ્વરૂપને પામીને તું શાન્ત અને સુખી રહે. ૫૬.

(અનુષ્ઠાન)

અપારજન્મસન્તાનપથભ્રાન્તિકૃતશ્રમમ् ।
તત્ત્વામૃતમિદં પીત્વા નાશયન્તુ મનીષિણઃ ॥૫૭॥

અનુવાદ : બુદ્ધિમાન પુરુષ આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મપરંપરા (સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૭.

(અનુષ્ઠાન)

અતિસૂક્ષ્મમતિસ્થૂલમેકં ચાનેકમેવ યત્તુ ।
સ્વસંવેદ્યમવેદ્યં ચ યદક્ષરમનક્ષરમ् ॥૫૮॥

અનૌપમ્યમનિર્દેશયમપ્રમેયમનાકુલમ् ।
શૂન્યં પૂર્ણ ચ યન્ત્રિત્યમનિત્યં ચ પ્રવક્ષ્યતે ॥૫૯॥

અનુવાદ : તે આત્મજ્યોતિ અતિશય સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, એક પણ છે અને અનેક પણ છે, સ્વસંવેદ્ય પણ છે અને અવેદ્ય પણ છે તથા અક્ષર પણ છે અને અનક્ષર પણ છે. તે જ્યોતિ અનુપમ, અનિર્દેશ્ય, અપ્રમેય અને અનાકુળ હોવાથી શૂન્ય પણ કહેવાય છે અને પૂર્ણ પણ, નિત્ય પણ કહેવાય છે અને અનિત્ય પણ.

વિશેષાર્� : તે આત્મજ્યોતિ નિશ્ચયનયની અપેક્ષાએ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રહિત હોવાના કારણે સૂક્ષ્મ તથા વ્યવહારનયની અપેક્ષાએ શરીરાશ્રિત હોવાથી સ્થૂળ પણ કહેવાય છે. એ જ રીતે તે શુદ્ધ ચૈતન્યરૂપ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ એક અને વ્યવહારનયની અપેક્ષાએ બિન્ન બિન્ન શરીર આદિને આશ્રિત રહેવાથી અનેક પણ કહેવાય છે. તે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા જાણવા યોગ્ય હોવાથી સ્વસંવેદ્ય તથા ઈન્દ્રિયજનિત જ્ઞાનનો અવિષ્ય હોવાથી અવેદ્ય પણ કહેવાય છે. તે નિશ્ચયથી વિનાશરહિત હોવાથી અક્ષર તથા અકારાદિ અક્ષરોથી રહિત હોવાને કારણે અથવા વ્યવહારની અપેક્ષાએ વિનષ્ટ હોવાથી અનક્ષર પણ કહેવાય છે. તે જ આત્મજ્યોતિ ઉપમા રહિત હોવાથી અનુપમ, નિશ્ચયનયથી શબ્દનો અવિષ્ય હોવાથી અનિંદ્શ્ય (અવાચ્ય), સાંવ્યવહારિક પ્રત્યક્ષાદિ પ્રમાણોનો વિષય ન હોવાથી અપ્રમેય તથા આકૃણતા રહિત હોવાને કારણે અનાકૃણ પણ છે. એ સિવાય તે મૂર્તિક સમસ્ત બાધ્ય પદાર્થોના સંયોગથી રહિત છે માટે શુન્ય અને પોતાના જ્ઞાનાદિ ગુણોથી પરિપૂર્ણ હોવાથી પૂર્ણ પણ મનાય છે. તે દ્વાર્યાર્થિકનયની અપેક્ષાએ વિનાશરહિત હોવાથી નિત્ય તથા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય પણ કહેવાય છે. ૫૮-૫૯.

(અનુષ્ઠાનિક)

**નિઃશરીરં નિરાલમ્બं નિઃશબ્દं નિરૂપાધિ યત્તુ ।
યિદાત્મકં પરંજ્યોતિરવાઙ્માનસગોचરમ્ભ ॥૬૦॥**

અનુવાદ : તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ શરીર, આદિબન, શબ્દ અને બીજા પણ અન્ય અન્ય વિશેષણોથી રહિત છે; તેથી તે વચ્ચે અને મનને પણ અગોચર છે. ૬૦.

(અનુષ્ઠાનિક)

**ઇત્યત્ત્ર ગહને ઽત્યન્તરુલક્ષ્યે પરમાત્મનિ ।
ઉચ્યતે યત્તદાકાશં પ્રત્યાલેખ્યં વિલિખ્યતે ॥૬૧॥**

અનુવાદ : આ રીતે તે પરમાત્મા દુરધિગમ્ય અને અત્યંત દુર્લક્ષ્ય (અદેશ્ય) હોવાથી તેના વિષયમાં જે કાંઈ પણ કહેવામાં આવે છે તે આકાશમાં ચિત્રલેખન સમાન છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે અમૂર્ત આકાશમાં ચિત્રનું નિર્માણ કરવું અસંભવ છે તેવી જ રીતે અતીન્દ્રિય આત્માના વિષયમાં કાંઈ વર્ણન કરવું પણ અસંભવ જ છે. તે તો કેવળ સ્વાનુભવ ગોચર છે. ૬૧.

(અનુષ્ઠભ्)

આસ્તાં તત્ત્વ સ્થિતો યस્તુ ચિન્તામાત્રપરિગ્રહઃ ।
તસ્યાત્ર જીવિતં શ્લાધ્યં દેવૈરપિ સ પૂજ્યતે ॥૬૨॥

અનુવાદ : જે તે આત્મામાં લીન છે તે તો દૂર રહો. પણ જે તેનું ચિન્તન માત્ર કરે છે તેનું જીવન પ્રશંસાયોગ્ય છે, તે દેવો દ્વારા પણ પૂજાય છે. ૬૨.

(અનુષ્ઠભ्)

સર્વવિદ્ધિરસંસારે: સમ્યગ્જ્ઞાનવિલોચનૈ: ।
એતસ્યોપાસનોપાય: સામ્યમેકમુદુહતમ् ॥૬૩॥

અનુવાદ : જે સર્વજ્ઞાદેવ સંચારથી રહિત અર્થાત્ જીવનમુક્ત થઈને સમ્યગ્જ્ઞાનરૂપ નેત્ર ધારણ કરે છે તેમણે આ આત્માના આરાધનનો ઉપાય એક માત્ર સમતાભાવ બતાવ્યો છે. ૬૩.

(અનુષ્ઠભ्)

સામ્યં સ્વાસ્થ્યં સમાધિશ્ચ યોગશ્ચેતોનિરોધનમ् ।
શુદ્ધોપયોગ ઇત્યેતે ભવન્યેકાર્થવાચકા: ॥૬૪॥

અનુવાદ : સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ; આ બધા શબ્દ એક જ અર્થના વાચક છે. ૬૪.

(અનુષ્ઠભ્)

નાકૃતિનાક્ષરં વર્ણો નો વિકલ્પશ્ચ કશ્ચન ।
શુદ્ધં ચૈતન્યમેવૈકં યત્ત્ર તત્સામ્યમુચ્યતે ॥૬૫॥

અનુવાદ : જ્યાં ન કોઈ આકાર છે, ન અકારાદિ અક્ષર છે, ન કૃષ્ણ-નીલાદિ વર્ણ છે અને ન કોઈ વિકલ્પેય છે; પરંતુ જ્યાં કેવળ એક ચૈતન્યરૂપ જ પ્રતિભાસિત થાય છે તેને જ સામ્ય કહેવામાં આવે છે. ૬૫.

(અનુષ્ઠભ્)

સામ્યમેકં પરં કાર્ય સામ્યં તત્ત્વં પરં સ્મृતમ् ।
સામ્યં સર્વોપદેશાનામુપદેશો વિમુક્તયે ॥૬૬॥

અનુવાદ : તે સમતાભાવ એક ઉત્કૃષ્ટ કાર્ય છે. તે સમતાભાવ ઉત્કૃષ્ટ તત્ત્વ

અધિકાર-૪ : એકત્વસપ્તાતિ]

૧૬૭

માનવામાં આવ્યું છે. તે જ સમતાભાવ સર્વ ઉપદેશોનો ઉપદેશ છે જે મુક્તિનું કારણ છે, અર્થાત્ સમતાભાવનો ઉપદેશ સમસ્ત ઉપદેશોનો સાર છે કેમ કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૬૬.

(અનુષ્ઠાન)

સામ્યं સદ્ગોધનિર્માળં શશ્વદાનન્દમન્દિરમ् ।
સામ્યં શુદ્ધાત્મનો રૂપં દ્વારં મોક્ષૈકસદ્ગનઃ ॥૬૭॥

અનુવાદ : સમતાભાવ સમ્યજ્ઞાન ઉત્પન્ન કરનાર છે, તે શાશ્વતિક (નિત્ય) સુખનું સ્થાન છે. તે સમતાભાવ શુદ્ધ આત્માનું સ્વરૂપ તથા મોક્ષરૂપી અનુપમ મહેલનું દ્વાર છે. ૬૭.

(અનુષ્ઠાન)

સામ્યં નિઃશેષશાસ્ત્રાણં સારમાહુર્વિપશ્ચિતઃ ।
સામ્યં કર્મમહાકક્ષદાહે દાવાનલાયતે ॥૬૮॥

અનુવાદ : પંડિતો સમતાભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર બતાવે છે તે સમતાભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવા માટે દાવાનણ સમાન છે. ૬૮.

(અનુષ્ઠાન)

સામ્યં શરણ્યમિત્યાહુર્યોગિનાં યોગગોચરમ् ।
ઉપાધિરચિતાશેષદોષકષપણકારણમ ॥૬૯॥

અનુવાદ : જે સમતાભાવ યોગીઓને યોગનો વિષય થયો થકો બાધ્ય અને અત્યંતર પરિશ્રહના નિમિત્તે ઉત્પન્ન થયેલ સમસ્ત દોષોનો નાશ કરનાર છે તે શરણભૂત કહેવાય છે. ૬૯.

(અનુષ્ઠાન)

નિઃસ્પૃહાયાળિમાદ્યજ્ઞણે સામ્યસરોજુષે ।
હંસાય શુચયે મુક્તિહંસીદત્તદશે નમઃ ॥૭૦॥

અનુવાદ : જે આત્મારૂપી હંસ અણિમાદિ ઋદ્ધિરૂપી કમળખંડ (સ્વર્ગ)ની અભિલાષા રહિત છે, સમતારૂપી સરોવરનો આરાધક છે, પવિત્ર છે તથા મુક્તિરૂપી હંસી તરફ દૃષ્ટિ રાખે છે તેને નમસ્કાર હો. ૭૦.

(અનુષ્ઠાન)

જ્ઞાનિનોઽમૃતસંગાય મૃત્યુસ્તાપકરોઽપિ સન્ન ।
આમકુમ્ભસ્ય લોકે�સ્મિન્ ભવેત્યાકવિધિર્યથા ॥૭૧॥

અનુવાદ : જેમ આ લોકમાં કાચા ઘડાનો પરિપાક અમૃતસંગ અર્થાત્ પાણીના સંયોગને કારણે થાય છે તેવી જ રીતે અવિવેકી મનુષ્યને સંતાપ કરનાર તે મૃત્યુ પણ જ્ઞાની મનુષ્યને અમૃતસંગ અર્થાત્ શાશ્વત સુખ (મોક્ષ) નું કારણ થાય છે. ૭૧.

(અનુષ્ઠાન)

માનુષ્યં સત્કુલે જન્મ લક્ષ્મીબુદ્ધિઃ કૃતજ્ઞતા ।
વિવેકેન વિના સર્વ સદપ્યેતત્ત્ર કિંચન ॥૭૨॥

અનુવાદ : મનુષ્ય પર્યાય, ઉત્તમકુળમાં જન્મ, સંપત્તિ, બુદ્ધિ અને કૃતજ્ઞતા (ઉપકારનું સ્મરણ); આ બધી સામગ્રી હોવા છતાં પણ વિવેક વિના કાંઈ પણ કાર્યકારી નથી. ૭૨.

(અનુષ્ઠાન)

ચિદચિદ્ર દ્વે પરે તત્ત્વે વિવેકસ્તદ્વિવેચનમ् ।
ઉપાદેયમુપાદેયં હેયં હેયં ચ કુર્વતઃ ॥૭૩॥

અનુવાદ : યેતન અને અયેતન એ બન્ને બિન્ન તત્ત્વ છે. તેમના બિન્ન સ્વરૂપનો વિચાર કરવો તેને વિવેક કહેવામાં આવે છે. તેથી હે આત્મા! તું આ વિવેકથી ગ્રહણ કરવા યોગ્ય જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ગ્રહણ કર અને છોડવા યોગ્ય જરૂતાને છોડી દે. ૭૩.

(અનુષ્ઠાન)

દુઃખં કિંચિત્સુખં કિંચિચ્છિત્તે ભાતિ જડાત્મનઃ ।
સંસારે ઽત્ર પુનર્નિત્યં સર્વ દુઃખં વિવેકિનઃ ॥૭૪॥

અનુવાદ : અહીં સંસારમાં મૂર્ખ પ્રાણીના ચિત્તમાં કાંઈક તો સુખ અને કાંઈક દુઃખરૂપ પ્રતિભાસે છે. પરંતુ વિવેકી જીવના ચિત્તમાં સદા સર્વ દુઃખદાયક જ પ્રતિભાસે છે.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે અવિવેકી પ્રાણી કદી ઈષ સામગ્રી પ્રાપ્ત થતાં સુખ અને તેનો વિયોગ થઈ જતાં કદી દુઃખનો અનુભવ કરે છે. પરંતુ વિવેકી પ્રાણી ઈષ સામગ્રીની પ્રાપ્તિ અને તેના વિયોગ બન્નેને દુઃખપ્રદ સમજે છે. તેથી તે ઉક્ત બન્ને અવસ્થાઓમાં સમભાવ રાખે છે. ૭૪.

(अनुष्टुभ)

हेयं हि कर्म रागादि तत्कार्यं च विवेकिनः ।
उपादेयं परं ज्योतिरुपयोगैकलक्षणम् ॥७५॥

અનુવાદ : વિવેકી મનુષ્યે કર્મ અને તેના કાર્યભૂત રાગાદિ પણ છોડવા યોગ્ય છે અને ઉપયોગરૂપ એક લક્ષણવાળી ઉત્કૃષ્ટ જ્યોતિ ગ્રહણ કરવા યોગ્ય છે. ૭૫.

(इन्द्रवज्रा)

यदेव चैतन्यमहं तदेव तदेव जानाति तदेव पश्यति ।

तदेव चैकं परमस्ति निश्चयाद् गतोऽस्मि भावेन तदेकतां परम् ॥७६॥

અનુવાદ : જે ચૈતન્ય છે તે જ હું છું. તે જ ચૈતન્ય જાણો છે અને તે જ ચૈતન્ય દેખે પાણ છે. નિશ્ચયથી તે જ એક ચૈતન્ય ઉત્કૃષ્ટ છે. હું સ્વભાવથી કેવળ તેની સાથે એકતા પામ્યો છું. ૭૬.

(वसंततिलका)

एकत्वसप्ततिरियं सुरसिन्धुरुच्चैः
 श्रीपद्मनन्दिहिमभूधरतः प्रसूता ।
 यो गाहते शिवपदाम्बुनिधि प्रविष्टा-
 मेतां लभेत स नरः परमां विशुद्धिम् ॥७७॥

અનુવાદ : જે આ એકત્વસપ્તતિ (સીતેર પદ્યમય એકત્વવિષયક પ્રકરણ) રૂપી ગંગા ઉન્નત શ્રી પદ્મનાન્દિરુપી હિમાલય પર્વતથી ઉત્પન્ન થઈને મોક્ષપદુપી સમુદ્રમાં પ્રવેશી છે તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે (એકત્વસપ્તતિના પક્ષે-અભ્યાસ કરે છે) તે મનુષ્ય અતિશાય વિશદ્ધિ પામે છે. ૭૭.

(वसंततिलका)

संसारसागरसमुत्तरणैकसेतु-
 मेनं सतां सदुपदेशमुपाश्रितानाम् ।
 कुर्यात्पदं मललवोऽपि किमन्तरङ्गे
 सम्यक्समाधिविधिसंनिधिनिस्तरङ्गे ॥७८॥

અનુવાદ : જે સાધુ જનોએ સંસારરૂપી સમુક્ર પાર થવામાં અદ્ધિતીય પુલસ્વરૂપ આ ઉપદેશનો આશ્રય લીધો છે તેમના ઉત્તમ સમાધિવિધિની સમીપતાથી નિશ્ચલ બનેલ અંત:કરણમાં શું મળને લેશ પણ સ્થાન પ્રાપ્ત થઈ શકે છે? અર્થાતું પ્રાપ્ત થઈ શકતું નથી. ૭૮.

(મંદક્રાન્તા)

આત્મા ભિન્નસ્તદનુગતિમત્કર્મ ભિન્ન તર્યોર્યા
પ્રત્યાસત્તેર્ભવતિ વિકૃતિઃ સાપિ ભિન્ન તથૈવ ।
કાલક્ષેત્રપ્રમુહમપિ યત્તચ ભિન્ન મતં મે
ભિન્ન ભિન્ન નિજગુણકલાલંકૃતં સર્વમેતત્તુ ॥૭૯॥

અનુવાદ : આત્મા ભિન્ન છે, તેને અનુસરનાર કર્મ મારાથી ભિન્ન છે, આ બનેના સંબંધથી જે વિકારભાવ ઉત્પન્ન થાય છે તે પણ તે જ પ્રકારે ભિન્ન છે, તથા અન્ય પણ જે કાળ અને ક્ષેત્ર આદિ છે તેમને પણ ભિન્ન માનવામાં આવ્યા છે. અભિપ્રાય એ છે કે પોતાના ગુણો અને કળાઓથી પણ વિભૂષિત આ સર્વ ભિન્ન ભિન્ન જ છે. ૭૯.

(વસંતતિલકા)

યે�ભ્યાસયન્તિ કથયન્તિ વિચારયન્તિ
સંભાવયન્તિ ચ મુહુર્મુહુરાત્મતત્ત્વમ् ।
તે મોક્ષમક્ષયમનૂનમનન્તસૌખ્યં
ક્ષિપ્રં પ્રયાન્તિ નવકેવલલબ્ધિરૂપમ् ॥૮૦॥

અનુવાદ : જે ભવ્યજીવ આ આત્મતત્ત્વનો વારંવાર અભ્યાસ કરે છે, વ્યાખ્યાન કરે છે, વિચાર કરે છે તથા સન્માન કરે છે; તે શીଘ્ર જ અવિનશ્બર, સંપૂર્ણ, અનંત સુખ સંયુક્ત અને નવ કેવળલબ્ધિ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, ક્ષાયિક સમ્યક્રૂત્વ અને ક્ષાયિક ચારિત્ર) સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૮૦.

આ રીતે એકત્વસપ્તતિ પ્રકરણ સમાપ્ત થયું. ૪.



૫. યતિભાવનાષ્ટક

[૫. યતિભાવનાષ્ટકમ्]

(શાર્ડૂલવિક્રીડિત)

આદાય બ્રતમાત્મતત્વમમલં જ્ઞાત્વાથ ગત્વા વનં
નિઃશેષામણિ મોહકર્મજનિતાં હિત્વા વિકલ્પાવતિમ् ।
યે તિષ્ઠન્તિ મનોમરુચ્છિદચલૈકત્વપ્રમોદં ગતા
નિષ્કમ્પા ગિરિવિઝ્યાન્તિ મુનયસ્તે સર્વસંગૌજ્ઞિતાઃ ॥૧॥

અનુવાદ : જે મુનિ બ્રત ગ્રહણ કરીને, નિર્મળ આત્મતત્વને જાણીને વનમાં જઈને, તથા મોહનીય કર્મના ઉદ્યથી ઉત્પન્ન થતા સર્વ વિકલ્પોનો સમૂહ છોડીને મનુષી વાયુથી વિચલિત ન થનાર સ્થિર ચૈતન્યમાં એકત્વના આનંદને પામતા થકા પર્વત સમાન નિશ્ચળ રહે છે તે સંપૂર્ણ પરિગ્રહ રહિત મુનિ જ્યવંત હો. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

ચેતોવૃત્તિનિરોધનેન કરણગ્રામં વિધાયોદ્ધસં
તત્સંહત્ય ગતાગતં ચ મરુતો ધૈર્ય સમાશ્રિત્ય ચ ।
પયઙ્ક્રેન મયા શિવાય વિધિવચ્છૂન્યૈકભૂભૃદ્રા-
મધ્યસ્થેન કદા ચિરપર્િતદ્શા સ્થાતવ્યમન્તર્મુખમ् ॥૨॥

અનુવાદ : મુનિ વિચાર કરે છે કે હું મનનો વ્યાપાર રોકીને, ઈન્દ્રિયસમૂહને ઉજ્જવલ કરીને (જીતીને), વાયુના ગમન-આગમનને સંકોચીને, ધૈર્યનું અવલંબન લઈને, તથા મોક્ષપ્રાપ્તિના નિમિત્તે વિધિપૂર્વક પર્વતની એક નિર્જન ગુફાની વચ્ચે પદ્માસનમાં

સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં દેષ્ટિ રાખતો થકો
ક્યારે ચેતન આત્મામાં લીન થઈને સ્થિત થઈશ? ૨.

(શાર્દૂલવિક્રીડિત)

ધૂલીધૂસરિતં વિમુક્તવસનં પર્યઙ્કમુદ્રાગતં
શાન્તં નિર્વચનં નિમીલિતદૃશં તત્ત્વોપલમ્ભે સતિ ।
ઉત્કીર્ણ દૃષ્ટદીવ માં વનભુવિ ભ્રાન્તો મૃગાણાં ગણ:
પશ્યત્યુજ્ઞતવિસ્મયો યદિ તદા માદ્ગ્રનઃ પુણ્યવાન् ॥૩॥

અનુવાદ : તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં ધૂળથી ભલિન(સ્નાન કર્યા વગરના), વખ્ટ
રહિત, પદ્માસનમાં સ્થિત, શાન્ત, વચન રહિત અને આંખો બંધ હોય એવી અવસ્થાને
પામેલા મને જો જુંગલના પ્રદેશમાં ભમ પ્રાપ્ત થયેલ મૃગોનો સમૂહ આશ્રયચક્રિત થઈને
પથ્થરમાં કોતરેલી મૂર્તિ સમજવા લાગે તો મારા જેવો મનુષ્ય પુણ્યશાળી હશે. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

વાસઃ શૂન્યમઠે કવિન્નિવસનં નિત્યं કકુમ્મણ્ણલં
સંતોષો ધનમુદ્રતં પ્રિયતમા ક્ષાન્તિસ્તપો વર્તનમ् ।
મैત્રી સર્વશરીરિરભિઃ સહ સદા તત્ત્વૈકવિન્તાસુખં
ચેદાસ્તે ન કિમસ્તિ મે શમવતઃ કાર્ય ન કિંચિત્ પરૈ: ॥૪॥

અનુવાદ : જો કોઈ નિર્જન ઉપાશ્રયમાં મારો નિવાસ હોય, સદા દિશા સમૂહ
જ મારું વખ્ટ બની જાય, અર્થાત્ જો મારી પાસે કાંઈ પણ પરિગ્રહ ન રહે, સંતોષ
જ મારું ઉન્તત ધન થઈ જાય, ક્ષમા જ મારી ઘ્યારી સ્ત્રી બની જાય, એક માત્ર
તપ જ મારો વ્યાપાર થઈ જાય, બધા જ પ્રાણીઓ સાથે મैત્રીભાવ થઈ જાય તથા
જો હું સદાય એક માત્ર તત્ત્વવિચારથી ઉત્પન્ન થનાર સુખનો અનુભવ કરવા લાગું;
તો પછી અતિશય શાન્તિને પ્રાપ્ત થયેલ મારી પાસે શું નથી? બધું જ છે. એવી
અવસ્થામાં મને બીજાઓનું કાંઈ પણ પ્રયોજન નથી રહેતું. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

લદ્ધવા જન્મ કુલે શુચૌ વરવપુરુદ્ધવા શ્રુતં પુણ્યતો
વૈરાગ્યં ચ કરોતિ યઃ શુચિ તપો લોકે સ એકઃ કૃતી ।

તેનૈવોજ્ઞિતગૌરવેણ યદિ વા ધ્યાનામૃતં પીયતે
પ્રાસાદે કલશસ્તદા મળિમયો હૈમે સમારોપિતઃ ॥૫॥

અનુવાદ : લોકમાં જે મનુષ્ય પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ લઈને, ઉત્તમ શરીર પામીને અને આગમ જાણીને વૈરાગ્ય પામ્યા થકા નિર્મળ તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર સત્કારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. ૫.

(શાર્દૂલવિક્રીડિત)

ગ્રીષ્મે ભૂધરમસ્તકાશ્રિતશિલાં મૂલં તરોઃ પ્રાવૃષિ
પ્રોદ્ભૂતે શિશિરે ચતુષ્યથપદં પ્રાપ્તાઃ સ્થિતિं કુર્વતે ।
યે તેણાં યમિનાં યથોક્તતપસાં ધ્યાનપ્રશાન્તાત્મનાં
માર્ગે સંચરતો મમ પ્રશમિનઃ કાલઃ કદા યાસ્યતિ ॥૬॥

અનુવાદ : જે સાધુ શ્રીષ્મ ઋતુમાં પર્વતના શિખર ઉપર, સ્થિત શિલા ઉપર, વર્ષા ઋતુનાં વૃક્ષના મૂળમાં તથા શિયાળો આવતાં ચોકમાં સ્થાન પ્રાપ્ત કરીને ધ્યાનમાં સ્થિત થાય છે; જે આગમોક્ત અનશનાદિ તપનું આચરણ કરે છે અને જેમણે ધ્યાન દ્વારા પોતાના આત્માને અતિશય શાન્ત કરી લીધો છે; તેમના માર્ગ પ્રવર્તતા મારો સમય અત્યંત શાન્તિથી ક્યારે વીતશે? ૬.

(શાર્દૂલવિક્રીડિત)

ભેદજ્ઞાનવિશેષસંહતમનોવૃત્તિઃ સમાધિઃ પરો
જાયેતાદ્ભુતધામધન્યશમિનાં કેષાંચિદત્રાચલઃ ।
વજ્રે મુર્ધિન પતત્યપિ ત્રિભુવને બહિપ્રદીપે ઽપિ વા
યેણાં નો વિકૃતિર્મનાગપિ ભવેત્ પ્રાણેષુ નશ્યત્ત્વપિ ॥૭॥

અનુવાદ : મસ્તક ઉપર વજ્ર પડવા છતાં અથવા ત્રણે લોક અગ્નિથી પ્રજ્વલિત થઈ જવા છતાં અથવા પ્રાણોનો નાશ થવા છતાં પણ જેમના ચિત્તમાં થોડોય વિકારભાવ ઉત્પન્ન થતો નથી; એવા આશ્ર્યજનક આત્મતેજને ધારણ કરનાર કોઈ વિરલા જ શ્રેષ્ઠ મુનિઓને તે ઉત્કૃષ્ટ નિશ્ચળ સમાધિ હોય છે જેમાં

ભેદજ્ઞાન વિશેષદ્વારા મનનો વ્યાપાર (દુષ્ટ પ્રવૃત્તિ) અટકી જાય છે. ૭.
(શાર્ડૂલવિક્રીડિત)

અન્તસ્તત્વમુપાધિવર્જિતમહંબ્યાહારવાચ્યં પરં
જ્યોતિર્યૈ: કલિતં શ્રિતં ચ યતિભિસ્તે સન્તુ નઃ શાન્તયે ।
યેષાં તત્સદનં તદેવ શયનં તત્સંપદસ્તત્સુખં
તદ્ગ્રત્તિસ્તદપિ પ્રિયં તદખિલશ્રેષ્ઠાર્થસંસાધકમ् ॥૮॥

અનુવાદ : જે મુનિઓએ બાહ્ય-અભ્યંતર પરિગ્રહ રહિત અને ‘અહ્ં’ શબ્દ દ્વારા કહેવાતા ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ અંતસ્તત્વ અર્થાત્ અંતરાત્માનું સ્વરૂપ જાણી લીધું છે તથા તેનો જ આશ્રય પણ લીધો છે અને જે મુનિઓને તે જ આભિતત્વ ભવન છે, તે જ શય્યા છે, તે જ સંપત્તિ છે, તે જ સુખ છે, તે જ વ્યાપાર છે, તે જ ઘારું છે અને તે જ સમસ્ત શ્રેષ્ઠ પદાર્થોને સિદ્ધ કરનાર છે; તે મુનિઓ આપણને શાન્તિ આપે. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

પાપારિક્ષયકારિ દાતૃ નૃપતિસ્વર્ગાપવર્ગશ્રિયં
શ્રીમત્પદ્ભૂજનન્દિભિર્વિરચિતં ચિદ્રેતનાનન્દિભિ: ।
ભક્ત્યા યો યતિભાવનાષ્કમિદં ભવ્યસ્ત્રિસંધ્યં પઠેત્
કિં કિં સિધ્યતિ વાચ્છિતં ન ભુવને તસ્યાત્ર પુણ્યાત્મનઃ ॥૯॥

અનુવાદ : આત્મચૈતન્યમાં આનંદનો અનુભવ કરનાર શ્રીમાન् પદ્મનંદી (ભવ્ય જીવોને પ્રજ્ઞલિલત કરનાર ગણધરાદિ અથવા પદ્મનંદી મુનિ) દ્વારા રચવામાં આવેલું આ આઠ શ્લોકમય ‘યતિભાવના’ પ્રકરણ પાપરૂપ શનુનો નાશ કરીને રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી અને મોક્ષ આપનાર છે. જે ભવ્ય જીવ ત્રણે સંધ્યાકાળે (પ્રાતઃ, મધ્યાત્ર અને સાયંકાળે) ભક્તિપૂર્વક તે યતિભાવનાષ્ક વાંચે છે તે પુણ્યાત્મા જીવને અહીં લોકમાં કચા કચા ઈષ્ટ પદાર્થ સિદ્ધ નથી થતા? અર્થાત્ તેને બધા ઈષ્ટ પદાર્થ સિદ્ધ થાય છે. ૯.

આ રીતે યતિભાવનાષ્ક સમાપ્ત થયું. ૫



૬. ઉપાસક સંસ્કાર

[૬. ઉપાસક સંસ્કાર]

(અનુષ્ઠાન)

આદો જિનો નૃપ: શ્રેયાનુ વ્રતદાનાદિપુરુષૌ ।
એતદન્યોન્યસંબન્ધે ધર્મસ્થિતિરભૂદિહ ॥૧॥

અનુવાદ : આદિ જિન અર્થાતું ઋષભ જિનેન્દ્ર અને શ્રેયાંસ રાજા આ બન્ને કુમ્ભપૂર્વક વ્રતવિધિ અને દાનવિધિના આદિ પ્રવર્તક પુરુષ છે અર્થાતું વ્રતોનો પ્રચાર ‘સર્વ પ્રથમ ઋષભ જિનેન્દ્ર દ્વારા શરૂ થયો અને દાનવિધિનો પ્રચાર રાજા શ્રેયાંસથી શરૂ થયો. એમનો પરસ્પર સંબંધ થતાં અહીં ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ. ૧.

(અનુષ્ઠાન)

સમ્યગ્દર્ઘાદ્યચારિત્રિત્રિતયં ધર્મ ઉવ્યતે ।
મુક્તે: પન્થા: સ એવ સ્યાત્ પ્રમાણપરિનિષ્ઠિતઃ ॥૨॥

અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિત્ર આ ત્રણેને ધર્મ કહેવામાં આવે છે તથા તે જ મુક્તિનો માર્ગ છે જે પ્રમાણથી સિદ્ધ છે. ૨.

(અનુષ્ઠાન)

રત્નત્રયાત્મકે માર્ગે સંચરન્તિ ન યે જનાઃ ।
તેષાં મોક્ષપદં દૂરં ભવેદીર્ધતરો ભવઃ ॥૩॥

અનુવાદ : જે જીવ રત્નત્રયસ્વરૂપ આ મોક્ષમાર્ગમાં સંચાર કરતા નથી તેમને મોક્ષસ્થાન તો દૂર અને સંસાર અતિશય દીર્ઘ થઈ જાય છે. ૩.

(અનુષ્ઠાન)

સમ્પૂર્ણદિશભેદાભ્યાં સ ચ ધર્મો દ્વિધા ભવેત् ।
આદ્યે ભેદે ચ નિર્ગ્રન્થાઃ દ્વિતીયે ગૃહિણઃ સ્થિતાઃ ॥૪॥

અનુવાદ : તે ધર્મ સંપૂર્ણ ધર્મ અને દેશધર્મના ભેદથી બે પ્રકારનો છે. આમાંથી પ્રથમ ભેદમાં દિગંબર મુનિ અને બીજા ભેદમાં ગૃહસ્થ સ્થિત હોય છે. ૪.

(અનુષ્ઠાન)

સંપ્રત્યાપિ પ્રવર્તેત ધર્મસ્તેનૈવ વત્ત્મના ।
તેને તેજાપિ ચ ગણ્યન્તે ગૃહસ્થા ધર્મહેતવઃ ॥૫॥

અનુવાદ : વર્તમાનમાં પણ તે રત્નત્રયસ્વરૂપ ધર્મની પ્રવૃત્તિ તે જ માર્ગ અર્થાત્ પૂર્ણધર્મ અને દેશધર્મ સ્વરૂપે થઈ રહી છે. તેથી તે ગૃહસ્થ પણ ધર્મનું કારણ ગણ્યાય છે. ૫.

(અનુષ્ઠાન)

સંપ્રત્યત્ર કલૌ કાલે જિનગેહે મુનિસ્થિતિઃ ।
ધર્મશ્ર દાનમિત્યેષાં શ્રાવકા મૂલકારણમ् ॥૬॥

અનુવાદ : અત્યારે અહીં આ કળિકાળ અર્થાત્ પંચમકાળમાં મુનિઓનો નિવાસ જિનાલયોમાં થઈ રહ્યો છે અને તેમના જ નિમિત્તે ધર્મ અને દાનની પ્રવૃત્તિ છે. આ રીતે મુનિઓની સ્થિતિ, ધર્મ અને દાન આ ત્રણેયનું મૂળકારણ ગૃહસ્થ શ્રાવક છે. ૬.

(અનુષ્ઠાન)

દેવપૂજા ગુરુપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમસ્તપઃ ।
દાન ચેતિ ગૃહસ્થાનાં ષટ્કર્માણિ દિને દિને ॥૭॥

અનુવાદ : જિનપૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ અને તપ આ છ કર્મ ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે અર્થાત્ તે તેમના આવશ્યક કાર્ય છે. ૭.

(અનુષ્ઠાન)

સમતા સર્વભૂતેષુ સંયમે શુભભાવના ।
આર્તરોદ્રપરિત્યાગસ્તદ્વિ સામાયિકં વ્રતમ् ॥૮॥

અનુવાદ : સર્વ પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ ધારણ કરવો, સંયમના વિષયમાં શુભ વિચાર રાખવો અને આર્ત તથા રૌદ્ર ધ્યાનોનો ત્યાગ કરવો, એને સામાયિકત માનવામાં આવે છે. ૮.

(અનુષ્ટુભ्)

સામાયિકં ન જાયેત વ્યસનમ્લાનચેતસः ।
શ્રાવકેન તતઃ સાક્ષાત્ત્યાજ્ય વ્યસનસપ્તકમ् ॥૯॥

અનુવાદ : જેમનું ચિત્ત જુગાર વગેરે વ્યસનોથી મલિન થઈ રહ્યું હોય તેને ઉપર્યુક્ત સામાયિકની સંભાવના નથી. તેથી શ્રાવકે સાક્ષાત્ તે સાત વ્યસનોનો પરિત્યાગ અવશ્ય કરવો જોઈએ. ૯.

(અનુષ્ટુભ्)

ઘૂતમાંસસુરાવેશ્યાખેટચૌર્યપરાઙ્ગનાઃ ।
મહાપાપાનિ સપૈવ વ્યસનાનિ ત્યજેદ્ર બુધઃ ॥૧૦॥

અનુવાદ : જુગાર, માંસ, મધ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરખી આ સાતે ય વ્યસન મહાપાપસ્વરૂપ છે. વિવેકી મનુષ્યે એમનો ત્યાગ કરવો જોઈએ. ૧૦.

(અનુષ્ટુભ्)

ધર્માર્થિનો ઽપિ લોકસ્ય ચેદસ્તિ વ્યસનાશ્રયઃ ।
જાયતે ન તતઃ સાપિ ધર્માન્વેષણયોગ્યતા ॥૧૧॥

અનુવાદ : ધર્માભિલાષી મનુષ્ય પણ જો તે વ્યસનોનો આશ્રય લે છે તે એનાથી તેને તે ધર્મ શોધવાની યોગ્યતા પણ ઉત્પન્ન થતી નથી. ૧૧.

(અનુષ્ટુભ्)

સપૈવ નરકાણિ સ્યુસ્તરેકૈકં નિસ્પિતમ् ।
આકર્ષયનૃણામેતદ્વયસનં સ્વસમૃદ્ધયે ॥૧૨॥

અનુવાદ : નરક સાત જ છે. તેમણે જાણે પોતાની સમૃદ્ધિ માટે મનુષ્યોને આકર્ષિત કરનાર આ એક એક વ્યસનને નિયુક્ત કર્યું છે. ૧૨.

(અનુષ્ઠાન)

ધર્મશત્રુવિનાશાર્થ પાપાખ્યકૃપતેરિહ ।
સમાઙ્ગં બલવદ્રાજ્યં સમભિર્વસનૈઃ કૃતમ् ॥૧૩॥

અનુવાદ : આ સાત વ્યસનોએ જાણે ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પાપ નામથી પ્રસિદ્ધ નિકૃષ્ટ (હલકા) રાજાના સાત રાજ્યાંગો (રાજા, મંત્રી, મિત્ર, ખજાનો, દેશ, દુર્ગ અને સૈન્ય) થી યુક્ત રાજ્યને બળવાન કર્યું છે.

વિશેષાર્થ : અભિપ્રાય એનો એ છે કે આ વ્યસનોના નિમિત્તે ધર્મનો તો હાસ (નાશ) થાય છે અને પાપ વધે છે. અહીં ગ્રન્થકર્તાએ આ ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે પાપરૂપી રાજાએ પોતાના ધર્મરૂપી શત્રુનો નાશ કરવા માટે પોતાના રાજ્યને આ સાત વ્યસનોરૂપ સાત રાજ્યાંગોથી જ સુસજ્જ કરી લીધું છે. ૧૩.

(અનુષ્ઠાન)

પ્રપશ્યન્તિ જિનં ભક્ત્યા પૂજયન્તિ સ્તુવન્તિ યે ।
તે ચ દૃશ્યાશ્ર પૂજ્યાશ્ર સ્તુત્યાશ્ર ભુવનત્રયે ॥૧૪॥

અનુવાદ : જે ભવ્ય પ્રાણી ભક્તિથી જિન ભગવાનના દર્શન, પૂજન અને સ્તુતિ કરતા રહે છે તે ત્રણે લોકમાં પોતે જ દર્શન, પૂજન અને સ્તુતિ યોગ્ય બની જાય છે. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ૧૪.

(અનુષ્ઠાન)

યે જિનેન્દ્રં ન પશ્યન્તિ પૂજયન્તિ સ્તુવન્તિ ન ।
નિષ્ફલં જીવિતં તેષાં તેષાં ધિક્ ચ ગૃહાશ્રમમ् ॥૧૫॥

અનુવાદ : જે જીવ ભક્તિથી જિનેન્દ્ર ભગવાનના ન દર્શન કરે છે, ન પૂજન કરે છે અને ન સ્તુતિ પણ કરે છે તેમનું જીવન નિષ્ફળ છે; તથા તેમના ગૃહસ્થાશ્રમને ધિક્કાર છે. ૧૫.

(અનુષ્ઠાન)

પ્રાતરુથાય કર્તવ્યं દેવતાગુરુદર્શનમ् ।
ભક્ત્યા તદ્વન્દના કાર્યા ધર્મશ્રુતિરૂપાસકૈ: ॥૧૬॥

અનુવાદ : શ્રાવકોએ પ્રાતઃકાળે ઉઠીને ભક્તિથી જિનેન્દ્રદેવ તથા નિર્ગંધ ગુરુના દર્શન અને તેમની વંદના કરીને ધર્મશ્રવણ કરવું જોઈએ. ૧૬.

(અનુષ્ટુભ्)

પશ્ચાદન્યાનિ કાર્યાણિ કર્તવ્યાનિ યતો બુધૈः ।
ધર્માર્થકામમોક્ષાણામાદૌ ધર્મઃ પ્રકીર્તિઃ ॥૧૭॥

અનુવાદ : ત્યાર પછી અન્ય કાર્ય કરવા જોઈએ, કેમ કે વિદ્ઘાન પુરુષોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં ધર્મને પ્રથમ બતાવ્યો છે. ૧૭.

(અનુષ્ટુભ्)

ગુરોરેવ પ્રસાદેન લભ્યતે જ્ઞાનલોચનમ् ।
સમસ્તં દૃશ્યતે યેન હસ્તરેખેવ નિસ્તુષ્ટમ् ॥૧૮॥

અનુવાદ : ગુરુની જ પ્રસન્નતાથી તે જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપી નેત્ર પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા સમસ્ત જગત્ હાથની રેખા સમાન સ્પષ્ટપણે દેખાય છે. ૧૮.

(અનુષ્ટુભ्)

યે ગુરું નैવ મન્યન્તે તદુપાસ્તિં ન કુર્વતે ।
અન્ધકારો ભવેત્તેષામુદિતે ઽપિ દિવાકરે ॥૧૯॥

અનુવાદ : જે અજ્ઞાની જન ન તો ગુરુને માને છે અને ન તેની ઉપાસના ય કરે છે તેમને માટે સૂર્યનો ઉદ્ય હોવા છતાં પણ અંધકાર જેવું જ છે.

વિશેષાર્થ : એ ઉપર કહેવામાં આવી ગયું છે કે જ્ઞાનની પ્રાપ્તિ ગુરુના જ પ્રસાદથી થાય છે. તેથી જે મનુષ્ય આદરપૂર્વક ગુરુની સેવા-શુશ્રૂષા નથી કરતા તે અભ્યજ્ઞાની જ રહે છે. તેમનું અજ્ઞાન સૂર્યનો પ્રકાશ પણ દૂર નથી કરી શકતો. કારણ કે તે તો કેવળ સીમિત બાધ્ય પદાર્થોના અવલોકનમાં સહાયક થઈ શકે છે, નહિ કે આત્માવલોકનમાં. આત્માવલોકનમાં તો કેવળ ગુરુના નિમિત્તે પ્રાપ્ત થયેલું અધ્યાત્મજ્ઞાન જ સહાયક થાય છે. ૧૯.

(અનુષ્ટુભ्)

યે પઠન્તિ ન સચ્છાસ્ત્રં સદ્ગુરુપ્રકટીકૃતમ् ।
તે�ન્ધાઃ સચક્ષુષો�પીહ સંભાવ્યન્તે મનીષિભિઃ ॥૨૦॥

અનુવાદ : જે મનુષ્યો ઉત્તમ ગુરુ દ્વારા પ્રરૂપિત સમીચીન શાખ વાંચતા નથી તેમને બુદ્ધિમાન મનુષ્ય બન્ને આંખોવાળા હોવા છતાં આંધળા સમજે છે. ૨૦.

(અનુષ્ઠભ)

મન્યે ન પ્રાયશસ્તેષાં કર્ણાશ્ર હૃદયાનિ ચ ।
યૈરભ્યાસે ગુરો: શાસ્ત્ર ન શ્રુતં નાવધારિતમ् ॥૨૧॥

અનુવાદ : જેમણે ગુરુની સમીપે ન શાખ સાંભળ્યું છે અને ન તેને હૃદયમાં ધારણ પણ કર્યું છે તેમને ધણું કરીને ન તો કાન છે અને ન હૃદય પણ છે, એમ હું સમજું છું.

વિશેષાર્થ : કાનનો સહૃપયોગ એમાં જ છે કે તેમના દ્વારા શાખોનું શ્રવણ કરવામાં આવે-તેનાથી સહૃપદેશ સાંભળવામાં આવે. તથા મનના લાભનો પણ એ જ સહૃપયોગ છે કે તેના દ્વારા સાંભળેલા શાખોનું ચિન્તન કરાય-તેનું રહસ્ય ધારણ કરાય. તેથી જે પ્રાણી કાન અને મન મેળવીને પણ તેમને શાખના વિષયમાં જોડતા નથી તેમના તે કાન અને મન નિષ્ફળ જ છે. ૨૧.

(અનુષ્ઠભ)

દેશવ્રતાનુસારેણ સંયમો ઽપિ નિષેખતે ।
ગૃહસ્થૈર્યેન તેનૈવ જાયતે ફલવદ્વત્રતમ् ॥૨૨॥

અનુવાદ : શ્રાવક જો દેશવ્રત અનુસાર ઈન્દ્રિયોના નિગ્રહ અને પ્રાણીદ્યારૂપ સંયમનું પણ સેવન કરે છે તો તેનાથી તેમનું તે વ્રત (દેશવ્રત) સર્ફણ થઈ જાય છે. અભિપ્રાય એ છે કે દેશવ્રતના પરિપાલનની સર્ફણતા એમાં જ છે કે તેના પછી પૂર્ણ સંયમ પણ ધારણ કરવામાં આવે. ૨૨.

(અનુષ્ઠભ)

ત્યાજ્યં માંસં ચ મધ્યં ચ મધૂદુમ્બરપञ્ચકમ् ।
અષ્ટૌ મૂલગુણાઃ પ્રોત્કાઃ ગૃહિણો દૃષ્ટિપૂર્વકાઃ ॥૨૩॥

અનુવાદ : માંસ, મધ્ય, મધૂ અને પાંચ ઉદ્દુમ્બર ફળ (ઉમરડો, કહુમર, પાકર, વડ અને પીપળો) નો ત્યાગ કરવો જોઈએ. સમ્યગ્દર્શન સાથે આ આઠ શ્રાવકના મૂળગુણ કહેવામાં આવે છે.

વિશેષાર્થ : મૂળ શબ્દનો અર્થ જડ થાય છે. જે વૃક્ષના મૂળિયાં ખૂબ ઉંડા અને બળવાન

અધિકાર-૬ : ઉપાસક સંસ્કાર]

૧૮૧

હોય છે તેમની સ્થિતિ ઘણા સમય સુધી રહે છે. પરંતુ જેનાં મૂળિયાં વધારે ઉંડા અને બળવાન હોતા નથી તેમની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકતી નથી.—તે આંધી આદિ દ્વારા તરત જ ઉખાડી નખાય છે. બરાબર એ જ રીતે આ ગુણો વિના શ્રાવકના ઉત્તર ગુણો (અશુદ્ધતાદિ)ની સ્થિતિ પણ દૃઢ રહેતી નથી તેથી આ શ્રાવકના મૂળગુણ કહેવાય છે. અમની શરૂઆતમાં સમ્યગ્દર્શન અવશ્ય હોવું જોઈએ, કેમકે તેના વિના ઘણું કરીને વ્રત આદિ બધું નિષ્ફળ જ રહે છે. ૨૩.

(અનુષ્ઠાન)

અણુવ્રતાનિ પજ્જૈવ ત્રિપ્રકારં ગુણવ્રતમ् ।
શિક્ષાવ્રતાનિ ચત્વારિ દ્વાદશોત્તિ ગૃહિત્રતે ॥૨૪॥

અનુવાદ : ગૃહિત્રત અર્થાત્ દેશવ્રતમાં પાંચ અશુદ્ધત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત; આ રીતે બાર વ્રત હોય છે.

વિશેષાર્થ : હિંસા, અસત્ય વચન, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ સ્થૂળ પાપોનો પરિત્યાગ કરવો; તેને અશુદ્ધત કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારના છે. અહિંસાશુદ્ધત, સત્યાશુદ્ધત, અચૌર્યાશુદ્ધત, બ્રહ્મચર્યાશુદ્ધત અને પરિગ્રહપરિમાણાશુદ્ધત. મન, વચન અને કાયા દ્વારા કૃત, કારિત અને અનુમોદનારૂપે (નવ પ્રકારે) જે સંકલ્પપૂર્વક ત્રસ જીવોની હિંસાનો પરિત્યાગ કરવામાં આવે છે તેને અહિંસાશુદ્ધત કહે છે. સ્થૂળ અસત્ય વચન સ્વયં ન બોલવું, બીજાને એ માટે પ્રેરિત ન કરવા તથા જે સત્ય વચનથી બીજા વિપત્તિમાં પડતા હોય એવા સત્ય વચન પણ ન બોલવા, તેને સત્યાશુદ્ધત કહે છે. મૂકેલું, પડેલું અથવા ભુલાઈ ગયેલું પરધન આપ્યા વિના લેવું નહિ તે અચૌર્યાશુદ્ધત કહેવાય છે. પરલી સાથે ન તો પોતે સંબંધ રાખવો અને ન બીજાને પણ એ માટે પ્રેરિત કરવા, તેને બ્રહ્મચર્યાશુદ્ધત અથવા સ્વદારસંતોષ વ્રત કહેવાય છે. ધન-ધાન્યાદિ પરિગ્રહનું પ્રમાણ કરીને તેનાથી અધિકની ઈચ્છા ન કરવી, તેને પરિગ્રહપરિમાણાશુદ્ધત કહે છે. ગુણવ્રત ત્રણ છે-દિગ્વત, અનર્થદંડવ્રત અને ભોગોપભોગપરિમાણવ્રત. પૂર્વાદિ દશ દિશાઓમાં પ્રસિદ્ધ કોઈ સમુદ્ર, નદી, વન અને પર્વત આદિની મર્યાદા કરીને તેની બહાર ન જવાનો મરણ પર્યંત નિયમ કરી લેવો તેને દિગ્વત કહેવાય છે. જે કામોથી કોઈ પ્રકારનો લાભ ન થતાં કેવળ પાપ જ ઉત્પન્ન થાય છે તે અનર્થદંડ કહેવાય છે. અને તેના ત્યાગને અનર્થદંડવ્રત કહેવાય છે. જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે છે તે ભોગ કહેવાય છે-જેમ કે, ભોજનાદિ. તથા જે વસ્તુ એકવાર ભોગવીને ફરીવાર પણ ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહેવાય છે-જેમ કે વસ્ત્રાદિ. આ ભોગ અને ઉપભોગરૂપ ઈન્દ્રિયવિષયોનું પ્રમાણ કરીને અધિકની ઈચ્છા ન કરવી, તેને ભોગોપભોગપરિમાણ વ્રત કહે છે. આ ત્રણો વ્રત મૂળગુણોની વૃદ્ધિનાં કારણ છે, તેથી અમને ગુણવ્રત કહેવામાં આવે છે. દેશાવકાશિક, સામાચિક, પ્રોષ્ધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર

શિક્ષાવ્રત છે. દિગ્બ્રતમાં કરેલી મર્યાદાની અંદર પણ કેટલાક સમય માટે કોઈ ઘર, ગામ અને નગર આદિની મર્યાદા કરીને તેની અંદર જ રહેવાનો નિયમ કરવો તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. નિશ્ચિત સમય સુધી પાંચે પાપોનો પૂર્ણરૂપે ત્યાગ કરવો તેને સામાયિક કહે છે. આ સામાયિક જિનચૈત્યાલયાદિ રૂપ કોઈ નિર્બાધ એકાન્ત સ્થાનમાં કરવામાં આવે છે. સામાયિકમાં સ્થિર થઈને એમ વિચાર કરવો જોઈએ કે જે સંસારમાં રહું છું તે અશરણ છે, અશુભ છે, અનિત્ય છે, દુઃખસ્વરૂપ છે તથા આત્મસ્વરૂપથી ભિન્ન છે. પરંતુ એનાથી વિપરીત મોક્ષ શરણ છે, નિત્ય છે, નિરાકૃત સુખસ્વરૂપ છે અને આત્મસ્વરૂપથી અભિન્ન છે; ઈત્યાદિ. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે અન્ન, પાન (દૂધ આદિ), ખાદ્ય (લાડુ-પેંડા આદિ) અને લેહા (ચાટવા યોગ્ય રાખડી આદિ) આ ચાર પ્રકારના આહારોનો પરિત્યાગ કરવો; તેને પ્રોષ્ઠધોપવાસ કહેવાય છે. પ્રોષ્ઠધોપવાસ એ પદ પ્રોષ્ઠ અને ઉપવાસ, આ બે શબ્દોના સમાસથી નિષ્પન્ન થયું છે. એમાં પ્રોષ્ઠ શબ્દનો અર્થ એકવાર ભોજન (એકાશન) તથા ઉપવાસ શબ્દનો અર્થ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એવો છે. અભિપ્રાય એ છે કે એકાશનપૂર્વક જે ઉપવાસ કરવામાં આવે છે તે પ્રોષ્ઠધોપવાસ કહેવાય છે. જેમ કે— જો અષ્ટમીનો પ્રોષ્ઠધોપવાસ કરવો હોય તો સપ્તમી અને નવમીના દિવસે એકાશન તથા અષ્ટમીના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ રીતે પ્રોષ્ઠધોપવાસમાં સોળપહોર માટે આહારનો ત્યાગ કરવામાં આવે છે. પ્રોષ્ઠધોપવાસના દિવસે પાંચ પાપ, સ્નાન, અલંકાર તથા સર્વ પ્રકારનો આરંભ છોડીને ધ્યાન અધ્યયનાદિમાં જ સમય વીતાવવો જોઈએ. કોઈ પ્રત્યુપકાર આદિની અભિલાષા ન રાખતાં જે મુનિ આદિ સત્પાત્રોને દાન આપવામાં આવે છે, તેને વૈયાવૃત્ય કહે છે. આ વૈયાવૃત્યમાં દાન સિવાય સંયમી જનોની યથાયોગ્ય સેવા-શુશ્રૂષા કરીને તેમનું કષ્ટ પણ દૂર કરવું જોઈએ. કોઈ આચાર્યોના મત પ્રમાણે દેશાવકાશિક વ્રતનો ગુણવ્રતમાં તથા ભોગોપભોગપરિમાણવ્રતનો શિક્ષાવ્રતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૪.

(અનુષ્ટુભ्)

પર્વસ્વથ યથાશક્તિ ભુક્તિત્યાગાદિકં તત્પ: ।
વસ્ત્રપૂતં પિબેત્તોયં રાત્રિભોજનવર્જનમ् ॥૨૫॥

અનુવાદ : શ્રાવકે પર્વના દિવસો (આઠમ અને ચૌદશ આદિ) માં પોતાની શક્તિ અનુસાર ભોજનના પરિત્યાગ આદિરૂપ (અનશનાદિ) તપ કરવા જોઈએ. એની સાથોસાથ તેમણે રાત્રિભોજન છોડીને પાણી પણ વસ્ત્રથી ગાળેલું પીવું જોઈએ. ૨૫.

(અનુષ્ટુભ्)

તં દેશં તં નરં તત્સ્વं તત્કર્માણિ ચ નાશ્યેત્તુ ।
મલિનં દર્શનં યેન યેન ચ વ્રતખણ્ણનમ् ॥૨૬॥

અનુવાદ : જે દેશાદિના નિભિતો સમ્યગ્દર્શન મલિન થતું હોય અને પ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે કિયાઓનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૨૬.

(અનુષ્ટુભ्)

**ભોગોપભોગસંખ્યાનं વિધેયં વિધિવત્સદા ।
વ્રતશૂન્યા ન કર્તવ્યા કાચિત્તુ કાલકલા બુધૈઃ ॥૨૭॥**

અનુવાદ : વિદ્વાન મનુષ્યોએ નિયમાનુસાર સદા ભોગ અને ઉપભોગરૂપ વસ્તુઓનું પ્રમાણ કરી લેવું જોઈએ. તેમનો થોડોક સમય પણ વ્રત રહિત ન જવો જોઈએ.

વિશેષાર્થ : જે વસ્તુ એક જ વાર ઉપયોગમાં આવતી હોય તેને ભોગ કહેવાય છે- જેમ કે ભોજ્ય પદાર્થ અને માળા વગેરે. એનાથી ઉદ્ધું જે વસ્તુ અનેક વાર ઉપયોગમાં આવતી હોય તે ઉપભોગ કહેવાય છે.-જેમ કે વસ્તુ આદિ. આ બન્નેય પ્રકારના પદાર્થોનું પ્રમાણ કરીને શ્રાવકે તેનાથી અધિકની ઈચ્છા ન કરવી જોઈએ. ૨૭.

(અનુષ્ટુભ्)

**રત્નત્રયાશ્રયઃ કાર્યસ્તથા ભવૈરતન્દ્રિતૈઃ ।
જન્માન્તરે ઽપિ તચ્છ્રદ્ધા યથા સંવર્ધતે તરામ્ ॥૨૮॥**

અનુવાદ : ભવ્ય જીવોએ આળસ છોડીને રત્નત્રયનો આશ્રય એ રીતે કરવો જોઈએ કે જે રીતે તેમનું ઉક્ત રત્નત્રયવિષયક શ્રદ્ધાન (દેખતા) બીજા જન્મમાં પણ અતિશય વૃદ્ધિ પામતું રહે. ૨૮.

(અનુષ્ટુભ्)

**વિનયશ્ચ યથાયોગ્યં કર્તવ્યઃ પરમેષ્ઠિષુ ।
દૃષ્ટિબોધચરિત્રેષુ તદ્બત્સુ સમયાશ્રિતૈઃ ॥૨૯॥**

અનુવાદ : એ ઉપરાંત શ્રાવકોએ જિનાગમના આશ્રિત થઈને અર્હદાદિ પાંચ પરમેષ્ઠી, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્યારિત્ર તથા આ સમ્યગ્દર્શનાદિ ધારણ કરનાર જીવોનો પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. ૨૯.

(અનુષ્ટુભ्)

**દર્શનજ્ઞાનચારિતપઃપ્રભૂતિ સિધ્યતિ ।
વિનયેનેતિ તં તેન મોક્ષદ્વારં પ્રચક્ષતે ॥૩૦॥**

અનુવાદ : તે વિનય દ્વારા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ખારિત્ર અને તપ આદિની સિદ્ધિ થાય છે તેથી જ તેને મોક્ષનું દ્વાર કહેવાય છે. ૩૦.

(અનુષ્ઠાનિક)

સત્યાત્રેષુ યથાશક્તિ દાનં દેયં ગૃહસ્થિતોः ।
દાનહીના ભવેત્તેષાં નિષ્ફલैવ ગૃહસ્થતા ॥૩૧॥

અનુવાદ : ગૃહમાં સ્થિત રહેનાર શ્રાવકોએ શક્તિ પ્રમાણે ઉત્તમ પાત્રોને દાન આપવું જોઈએ કેમ કે દાન વિના તેમનો ગૃહસ્થાશ્રમ (શ્રાવકપણું) નિષ્ફળ જ થાય છે. ૩૧.

(અનુષ્ઠાનિક)

દાનं યે ન પ્રયચ્છન્તિ નિર્ગ્રન્થેષુ ચતુર્વિધમ् ।
પાશા એવ ગૃહસ્થેષાં બન્ધનાયૈવ નિર્મિતાઃ ॥૩૨॥

અનુવાદ : જે ગૃહસ્થ દિગંબર મુનિઓને ચાર પ્રકારનું દાન આપતા નથી તેમને બંધનમાં રાખવા માટે તે ઘર જાણો જાળ જ બનાવવામાં આવી છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શ્રાવક ઘરમાં રહીને અસિ-મષિ આદિરૂપ કર્મો કરે છે તેમનાથી તેને અનેક પ્રકારના પાપકર્મનો સંચય થાય છે. તેનાથી છૂટકારો મેળવવાનો ઉપાય કેવળ દાન છે. તેથી જો તે પાત્રદાન કરે નહિ તો પછી તે ઉક્ત સંચિત પાપદ્વારા સંસારમાં જ પરિભ્રમણ કરવાનો છે. આ રીતે ઉક્ત દાનહીન શ્રાવકને માટે તે બંધનના જ કારણ બની જાય છે. ૩૨.

(અનુષ્ઠાનિક)

અભયાહારમૈષજ્યશાસ્ત્રદાને હિ યત્કૃતે ।
ऋષીણાં જાયતે સૌખ્યં ગૃહી શ્લાધ્યઃ કર્થ ન સઃ ॥૩૩॥

અનુવાદ : જેના દ્વારા અભય, આહાર, ઔષધ અને શાશ્વતનું દાન આપવાથી મુનિઓને સુખ ઉત્પન્ન થાય છે તે ગૃહસ્થ કેમ પ્રશંસાને યોગ્ય ન હોય? અવશ્ય હોય. ૩૩.

(અનુષ્ઠાનિક)

સમર્થોऽપિ ન યો દયાયતીનાં દાનમાદરાત્ ।
છિનત્તિ સ સ્વયં મૂઢઃ પરત્ર સુખમાત્તનઃ ॥૩૪॥

અધિકાર-૬ : ઉપાસક સંસ્કાર]

૧૮૫

અનુવાદ : જે મનુષ્ય દાન દેવા યોગ્ય હોવા છતાં પણ મુનિઓને ભક્તિપૂર્વક દાન દેતો નથી તે મૂર્ખ પરલોકમાં પોતાના સુખને પોતે જ નાચ કરે છે. ઉ૪.

(અનુષ્ટુભ्)

દૃષ્ટાવસમો જ્ઞેયો દાનહીનો ગૃહાશ્રમઃ ।
તદારૂઢો ભવાભૌધૌ મજ્જત્વેવ ન સંશયઃ ॥૩૫॥

અનુવાદ : દાનરહિત ગૃહસ્થાશ્રમને પથ્થરની નાવ સમાન સમજવો જોઈએ. તે ગૃહસ્થાશ્રમરૂપી પથ્થરની નાવ ઉપર બેઠેલો મનુષ્ય સંસારરૂપી સમુદ્રમાં ડૂબે જ છે, એમાં સંદેહ નથી. ઉ૫.

(અનુષ્ટુભ्)

સમયસ્થેષુ વાત્સલ્યં સ્વશક્ત્વા યે ન કુર્વતે ।
બહુપાપાવૃત્તાત્માનસ્તે ધર્મસ્ય પરાડ્મસુખાઃ ॥૩૬॥

અનુવાદ : જે ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર સાધર્મી જનો પ્રત્યે પ્રેમ રાખતા નથી તે ધર્મથી વિમુખ થઈને પોતાને ઘણા પાપથી આચળાદિત કરે છે. ઉ૬.

(અનુષ્ટુભ्)

યેષાં જિનોપદેશેન કારુણ્યામૃતપૂરિતે ।
ચિત્તે જીવદ્યા નાસ્તિ તેષાં ધર્મઃ કુતો ભવેત્ ॥૩૭॥

અનુવાદ : જિન ભગવાનના ઉપદેશથી દ્યાળુતારૂપ અમૃતથી પરિપૂર્ણ જે શ્રાવકોના હૃદયમાં પ્રાણીદ્યા ઉત્પન્ન થતી નથી તેમને ધર્મ ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિએ.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે ગૃહસ્થોનું હૃદય જ્ઞાનગમનો અભ્યાસ કરવાને કારણે દ્યાથી ભીજાઈ ગયું છે તે જ ગૃહસ્થ વાસ્તવમાં ધર્માત્મા છે. પરંતુ એનાથી વિપરીત જેમનું ચિત્ત દ્યાથી ભીજાયું નથી તેઓ કદી પણ ધર્માત્મા હોઈ શકે નહિએ. કારણ કે ધર્મનું મૂળ તો તે દ્યા જ છે. ઉ૭.

(અનુષ્ટુભ्)

મૂલં ધર્મતરોરાદ્યા બ્રતાનાં ધામ સંપદામ્ ।
ગુણાનાં નિધિરિત્યદ્વિદ્યા કાર્ય વિવેકિભિઃ ॥૩૮॥

અનુવાદ : પ્રાણીદ્યા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, વ્રતોમાં મુખ્ય છે. સંપત્તિઓનું સ્થાન છે અને ગુણોનો ભંડાર છે. તેથી વિવેકીજનોએ તે અવશય કરવી જોઈએ. ૩૮.

(અનુષ્ટુભ्)

સર્વે જીવદ્યાધારા ગુણાસ્તિષ્ઠન્તિ માનુષે ।
સૂત્રાધારાઃ પ્રસૂનાનાં હારાણાં ચ સરા ઇવ ॥૩૯॥

અનુવાદ : મનુષ્યમાં બધા જ ગુણ જેમ પુષ્પોની હાર દોરાના આધારે રહે છે તેમ જીવદ્યાના આશ્રયે રહે છે.

વિશેષાર્થ : જેમ ઝૂલના હારની પંક્તિઓ દોરાના આશ્રયે સ્થિર રહે છે તેવી જ રીતે બધા ગુણોનો સમૂહ પ્રાણીદ્યાના આશ્રયે સ્થિર રહે છે જો માળાની વચ્ચેનો દોરો તૂટી જાય છે તો જેમ તેના બધા ઝૂલ વિખરાઈ જાય છે તેવી જ રીતે નિર્દ્ય મનુષ્યના તે બધા ગુણ પણ દ્યાના અભાવમાં વિખરાઈ જાય છે—નાચ થઈ જાય છે. માટે સમ્યગ્દર્શનાંદિ ગુણોના અભિલાષી શ્રાવકે પ્રાણીઓના વિષયમાં દ્યાળું અવશ્ય થવું જોઈએ. ૩૯.

(અનુષ્ટુભ्)

યતીનાં શ્રાવકાણાં ચ વ્રતાનિ સકલાન્યપિ ।
એકાહિંસાપ્રસિદ્ધર્થ કથિતાનિ જિનેશ્વરૈ: ॥૪૦॥

અનુવાદ : જિનેન્દ્રદેવે મુનિઓ અને શ્રાવકોના બધા જ વ્રત એક માત્ર અહિંસા ધર્મની જ સિદ્ધિ માટે બતાવ્યા છે. ૪૦.

(અનુષ્ટુભ्)

જીવહિંસાદિસંકલપૈરાત્મન્યપિ હિ દૂષિતે ।
પાપં ભવતિ જીવસ્ય ન પરં પરપીડનાત્ર ॥૪૧॥

અનુવાદ : જીવને કેવળ બીજા પ્રાણીઓને કષ્ટ દેવાથી જ પાપ નથી થતું, પણ પ્રાણીની હિંસા આદિના વિચાર માત્રથી પણ આત્મા દૂષિત થતાં તે પાપ થાય છે. ૪૧.

(અનુષ્ટુભ्)

દ્વાદશાપિ સદા ચિન્ત્યા અનુપ્રેક્ષા મહાત્મભિ: ।
તત્ત્વાવના ભવત્યેવ કર્મણઃ ક્ષયકારણમ् ॥૪૨॥

અનુવાદ : મહાત્મા પુરુષોએ નિરંતર બારેય અનુપ્રેક્ષાઓનું ચિન્તન કરવું જોઈએ. કારણ એ છે કે તેમની ભાવના (ચિન્તન) કર્મના ક્ષયનું કારણ થાય છે. ૪૨.

(અનુષ્ટુભ्)

અધ્રુવાશરણે ચૈવ ભવ એકત્વમેવ ચ ।
અન્યત્વમશુચિત્વં ચ તથૈવાસ્ત્રવસંવરૌ ॥૪૩॥
નિર્જરા ચ તથા લોકો બોધિ દુર્લભધર્મતા ।
દ્વાદશૈતા અનુપ્રેક્ષા ભાષિતા જિનપુરુષૈः ॥૪૪॥

અનુવાદ : અધ્રુવ અર્થાત् અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, તેવી જ રીતે આખ્રા, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ આ જિનેન્દ્ર ભગવાન દ્વારા બાર અનુપ્રેક્ષાઓ કહેવામાં આવી છે. ૪૩-૪૪.

(અનુષ્ટુભ्)

અધ્રુવાણિ સમસ્તાનિ શરીરાદીનિ દેહિનામ્ ।
તત્ત્વાશે ઽપિ ન કર્તવ્યઃ શોકો દુષ્કર્મકારણમ્ ॥૪૫॥

અનુવાદ : પ્રાણીઓનાં શરીર આદિ બધું જ નશર છે. તેથી ઉક્ત શરીર આદિનો નાશ થવા છતાં પણ શોક ન કરવો જોઈએ કારણ કે શોક પાપબંધનું કારણ છે. આ રીતે વારંવાર વિચાર કરવાનું નામ અનિત્ય ભાવના છે. ૪૫.

(અનુષ્ટુભ्)

વ્યાઘ્રેણાઘ્રાતકાયસ્ય મૃગશાવસ્ય નિર્જને ।
યથા ન શરણં જન્તોઃ સંસારે ન તથાપદિ ॥૪૬॥

અનુવાદ : જેમ નિર્જન વનમાં સિંહ દ્વારા પકડવામાં આવેલ મૃગના બચ્ચાની રક્ષા કરનાર કોઈ નથી, તેવી જ રીતે આપત્તિ (મરણ આદિ) પ્રાપ્ત થતાં તેનાથી જીવનું રક્ષણ કરનાર પણ સંસારમાં કોઈ નથી. આ રીતે વિચાર કરવો તેને અશરણભાવના કહેવામાં આવે છે. ૪૬.

(અનુષ્ટુભ्)

યત્સુખં તત્સુખાભાસં યદુઃખં તત્સદાભ્રસા ।
ભવે લોકાઃ સુખ સત્ય મોક્ષ એવ સ સાધ્યતામ્ ॥૪૭॥

અનુવાદ : સંસારમાં જે સુખ છે તે સુખનો આભાસ છે—યથાર્થ સુખ નથી, પરંતુ જે હુઃખ છે તે વાસ્તવિક છે અને સદા રહેનાર છે. સાચું સુખ મોક્ષમાં જ છે. તેથી હે ભવ્યજનો! તેને જ સિદ્ધ કરવું જોઈએ. આ રીતે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, એ સંસારભાવના છે. ૪૭.

(અનુષ્ઠાનિક)

સ્વજનો વા પરો વાપિ નો કર્શ્મિત્પરમાર્થતઃ ।
કેવલં સ્વાર્જિતં કર્મ જીવેનૈકેન ભુજ્યતે ॥૪૮॥

અનુવાદ : કોઈ પણ પ્રાણી વાસ્તવમાં ન તો સ્વજન (સ્વકીય માતા-પિતા આદિ) છે અને ન પર પણ છે. જીવ દ્વારા જે કર્મ બાંધવામાં આવ્યું છે તેને જ કેવળ તે એકલો ભોગવે છે. આ રીતે વારંવાર વિચાર કરવો, તેને એકત્વભાવના કહે છે. ૪૮.

(અનુષ્ઠાનિક)

ક્ષીરનીરવદેકત્ર સ્થિતયોર્દેહદેહિનોઃ ।
ભેદો યદિ તતોऽન્યેષુ કલત્રાદિષુ કા કથા ॥૪૯॥

અનુવાદ : જો દૂધ અને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનાર શરીર અને જીવમાં પણ ભેદ હોય તો પ્રત્યક્ષ જ પોતાનાથી ભિન્ન દેખાતા સ્ત્રી-પુત્ર આદિના વિષયમાં ભલા શું કહેવું? અર્થાત् તેઓ તો જીવથી ભિન્ન છે જ. આ રીતે વિચાર કરવો તેનું નામ અન્યત્વભાવના છે. ૪૯.

(અનુષ્ઠાનિક)

તથાશુચિરયં કાયઃ કૃમિધાતુમલાન્વિતઃ ।
યથા તસ્યૈવ સંપર્કાદન્યત્રાયપવિત્રતા ॥૫૦॥

અનુવાદ : ક્ષુદ્ર જંતુ, રસ-રધિરાદિ ધાતુઓ તથા મળસંયુક્ત આ શરીર એવું અપવિત્ર છે કે તેના જ સંબંધથી બીજી (પુષ્પમાળા આદિ) વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. આ રીતે શરીરના સ્વરૂપનો વિચાર કરવો, એ અશુચિભાવના છે. ૫૦.

(અનુષ્ઠાનિક)

જીવપોતો ભવામ્ભોધૌ મિથ્યાત્વાદિકરન્ધ્રવાન् ।
આસ્ત્રવતિ વિનાશાર્થ કર્માભઃ સુચિરં બ્રમાત્ર ॥૫૧॥

અધિકાર-૬ : ઉપાસક સંસ્કાર]

૧૮૯

અનુવાદ : સંસારરૂપી સમુદ્રમાં ભિથ્યાત્વાદિરૂપ છેદોથી સંયુક્ત જીવરૂપી નાવ ખમ (અજ્ઞાન અને પરિભ્રમણ)ના કારણે ઘણા કાળથી આત્મવિનાશ માટે કર્મરૂપી જળનું ગ્રહણ કરે છે.

વિશેષાર્થ : જેમ છિદ્રયુક્ત નાવ પરિભ્રમણ કરીને છિદ્રદ્વારા જળનું ગ્રહણ કરતી થકી અંતે સમુદ્રમાં ડૂબીને પોતાને નષ્ટ કરે છે તેવી જ રીતે આ જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો થકો ભિથ્યાત્વાદ દ્વારા કર્મોનો આસ્વચ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્ત્વ એ છે કે દુઃખનું કારણ આ કર્મોનો આસ્વચ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું નામ આસ્વચભાવના છે. ૫૧.

(અનુષ્ઠાનિક)

કર્માસ્ત્રવનિરોધોऽત્ર સંવરો ભવતિ ધ્રુવમ् ।
સાક્ષાદેતદનુષ્ઠાન મનોવાક્યાયસંવૃતિઃ ॥૫૨॥

અનુવાદ : કર્મોના આસ્વચને રોકવો, તે નિશ્ચયથી સંવર કહેવાય છે. આ સંવરનું સાચું અનુષ્ઠાન મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ રોકવી તે જ છે.

વિશેષાર્થ : જે ભિથ્યાત્વ અને અવિરતિ આદિ પરિણામો દ્વારા કર્મ આવે છે તેમને આસ્વચ તથા તેમના નિરોધને સંવર કહેવામાં આવે છે. આસ્વચ જો સંસારનું કારણ છે તો સંવર મોક્ષનું કારણ છે. તેથી આસ્વચ હેય અને સંવર ઉપાદેય છે. આ રીતે સંવરના સ્વરૂપનો વિચાર કરવો, એ સંવરભાવના કહેવાય છે. ૫૨.

(અનુષ્ઠાનિક)

નિર્જરા શાતનં પ્રોક્તા પૂર્વોપાર્જિતકર્મણામૃઃ ।
તપોભિર્બહુભિઃ સા સ્યાદૈરાગ્યાશ્રિત ચેષ્ટિતૈઃ ॥૫૩॥

અનુવાદ : પૂર્વોપાર્જિત કર્મો ધીરે ધીરે નષ્ટ કરવા, તે નિર્જરા કહેવાય છે, તે વૈરાગ્યના આલંબનથી પ્રવર્તતા ઘણા તપ દ્વારા થાય છે. આ રીતે નિર્જરાના સ્વરૂપનો વિચાર કરવો, એ નિર્જરા ભાવના છે. ૫૩.

(અનુષ્ઠાનિક)

લોકઃ સર્વોઽપિ સર્વત્ર સાપાયસ્થિતિરધ્રુવઃ ।
દુઃખકારીતિ કર્તવ્યા મોક્ષ એવ મતિઃ સત્તામૃ ॥૫૪॥

અનુવાદ : આ બધો લોક સર્વત્ર વિનાશયુક્ત સ્થિતિ સહિત, અનિત્ય અને

દુઃખદાયી છે. તેથી વિવેકી જીવોએ પોતાની બુદ્ધિ મોક્ષના વિષયમાં જ લગાવવી જોઈએ.

વિશેષાર્થ : આ ચૌદ રાજુ ઊંચો લોક અનાદિનિધન છે, એનો કોઈ કર્તા હત્તા નથી. જીવ પોતાના કર્મ અનુસાર આ લોકમાં પરિભ્રમણ કરતો થકો કોઈ વાર નારકી, કોઈ વાર તિર્યંચ, કોઈ વાર દેવ અને કોઈ વાર મનુષ્ય થાય છે. આમાં પરિભ્રમણ કરતા જીવને કદી નિરાકુળ સુખ પ્રાપ્ત થતું નથી. તે નિરાકુળ સુખ મોક્ષ પ્રાપ્ત થતાં જ ઉત્પન્ન થાય છે તેથી વિવેકી જીવે ઉક્ત મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે લોકના સ્વભાવનો વિચાર કરવો, એ લોકભાવના કહેવાય છે. ૫૪.

(અનુષ્ઠાનિક)

રત્નત્રયપરિગ્રામિરોધિઃ સાતીવ દુર્લભા ।
લબ્ધા કથં કર્થંચિચ્ચેત् કાર્યો યત્નો મહાનિહ ॥૫૫॥

અનુવાદ : સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિત્ર સ્વરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે. તે અત્યંત દુર્લભ છે. જો તે કોઈ પણ ઉપાયે પ્રાપ્ત થઈ જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે રત્નત્રયસ્વરૂપ બોધિની પ્રાપ્તિની દુર્લભતાનો વિચાર કરવો, એ બોધિદુર્લભભાવના છે. ૫૫.

(અનુષ્ઠાનિક)

જિનધરોઽયમત્યન્તં દુર્લભો ભવિનાં મતઃ ।
તથા ગ્રાહ્યો યથા સાક્ષાતામોક્ષં સહ ગચ્છતિ ॥૫૬॥

અનુવાદ : સંસારી પ્રાણીઓને માટે આ જૈનધર્મ અત્યંત દુર્લભ માનવામાં આવ્યો છે. ઉક્ત ધર્મને એ રીતે ગ્રહણ કરવો જોઈએ કે જેથી તે સાક્ષાત્ મોક્ષ પ્રાપ્ત થતાં સુધી સાથે જ આવે. ૫૬.

(અનુષ્ઠાનિક)

દુઃખગ્રાહગણાકીર્ણ સંસારકારસાગરે ।
ધર્મપોતં પરં પ્રાહુસ્તારણાર્થ મનીષિણઃ ॥૫૭॥

અનુવાદ : વિદ્વાન् પુરુષો દુઃખરૂપી હિંસક જળજંતુઓના સમૂહથી વ્યાપ્ત આ સંસારરૂપી ખારા સમુદ્રમાં તેનાથી પાર થવા માટે ધર્મરૂપી નૌકાને ઉત્કૃષ્ટ બતાવે છે.

આ રીતે ધર્મના સ્વરૂપનો વિચાર કરવો તેને ધર્મભાવના કહેવામાં આવે છે. ૫૭.
(અનુષ્ઠાન)

અનુપ્રેક્ષા ઇમા: સદ્ગ્રિઃ સર્વદા હૃદયે ધૃતા: ।
કુર્વતે તત્પરં પુણં હેતુર્યત્સ્વર્ગમોક્ષયો: ॥૫૮॥

અનુવાદ : સજ્જનો દ્વારા સદા હૃદયમાં ધારણ કરવામાં આવતી આ બાર અનુપ્રેક્ષાઓ તે ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન કરે છે કે જે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય છે. ૫૮.

(અનુષ્ઠાન)
આયોત્તમક્ષમા યત્ર યો ધર્મો દશભેદભાક્ર ।
શ્રાવકૈરપિ સેવ્યોऽસૌ યથાશક્તિ યથાગમમ् ॥૫૯॥

અનુવાદ : જે ધર્મમાં ઉત્તમ ક્ષમા સૌથી પહેલા છે તથા જે દસ ભેદોથી સંયુક્ત છે, તે ધર્મનું સેવન શ્રાવકોએ પણ પોતાની શક્તિ અને આગમ અનુસાર કરવું જોઈએ. ૫૯.

(અનુષ્ઠાન)
અન્તસ્તત્ત્વં વિશુદ્ધાત્મા બહિસ્તત્ત્વં દયાઙ્ગિષુ ।
દ્વયો: સન્મીલને મોક્ષસ્તસ્માદ્ દ્વિત્યમાશ્રયેત् ॥૬૦॥

અનુવાદ : અભ્યંતર તત્ત્વ કર્મકલંક રહિત વિશુદ્ધ આત્મા અને બાહ્ય તત્ત્વ પ્રાણીઓ પ્રત્યે દ્વારા ભાવ છે. આ બન્ને મળતાં મોક્ષ થાય છે. તેથી તે બન્નોનો આશ્રય કરવો જોઈએ. ૬૦.

(અનુષ્ઠાન)
કર્મભ્ય: કર્મકાર્યભ્ય: પૃથગ્ભૂતં ચિદાત્મકમ् ।
આત્માનં ભાવયેત્ત્રિત્વં નિત્યાનન્દપદપ્રદમ् ॥૬૧॥


અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મો તથા તેના કાર્યભૂત રાગાદિ વિભાવો અને શરીર આદિથી બિન્ન છે તે શાશ્વતિક આનંદસ્વરૂપ પદનો અર્થાત્ મોક્ષને આપનાર આત્માનો સદા વિચાર કરવો જોઈએ. ૬૧.

(અનુષ્ઠાન)

ઇત્યુપાસકસંસ્કારઃ કૃતઃ શ્રીપદ્મનાન્દિના ।
યેષામેતદનુષ્ઠાનં તેષાં ધર્મો ડત્તિનિર્મલઃ ॥૬૨॥

આનુવાદ : આ રીતે આ ઉપાસક સંસ્કાર અર્થાત્ શ્રાવકનું ચારિત્ર શ્રી પદ્મનાન્દી મુનિદ્વારા રચવામાં આવ્યું છે. જે મનુષ્ય આનું આચરણ કરે છે તેમને અત્યંત નિર્મળ ધર્મ થાય છે. ૬૨.

આ રીતે શ્રાવકાચાર સમાપ્ત થયું. ૬.



૨૦૨૪ મિયાનંદ.

૭. દેશવતોદ્યોતન

[૭. દેશવતોદ્યોતનમ्]

(શાર્ડૂલવિક્રીડિત)

બાહ્યાભ્યન્તરસંગર્જનતયા ધ્યાનેન શુક્લેન યઃ
કૃત્વા કર્મચતુષ્ટયક્ષયમગાત્ સર્વજ્ઞતાં નિશ્ચિતમ् ।
તેનોક્તાનિ વચાંસિ ધર્મકથને સત્યાનિ નાન્યાનિ તત્
ભ્રામ્યત્યત્ર મતિસ્તુ યસ્ય સ મહાપાપી ન ભવોઽથવા ॥૧॥

અનુવાદ : જે બાધ્ય અને અભ્યંતર પરિગ્રહ છોડીને તથા શુક્લ ધ્યાન દ્વારા ચાર ઘાતી કર્માંનો નાશ કરીને નિશ્ચયથી સર્વજ્ઞતાને પ્રાપ્ત થયા છે તેમના દ્વારા ધર્મના વ્યાખ્યાનમાં કહેવામાં આવેલા વચનો સત્ય છે, એનાથી ભિન્ન રાગ-દ્વેષથી દૂષિત હંદ્યવાળા કોઈ અલ્પજ્ઞના વચનો સત્ય નથી. તેથી જે જીવની બુદ્ધિ ઉક્ત સર્વજ્ઞતા વચનોમાં અમને પ્રાપ્ત થાય છે તે અતિશય પાપી છે, અથવા તે ભવ્ય જ નથી. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

એકો ઽષ્ટત્ર કરોતિ યઃ સ્થિતિમતિપ્રીતઃ શુચૌ દર્શને
સ શ્લાઘ્યઃ ખલુ દુઃખિતો ઽષ્ટુદ્યતો દુષ્કર્મણઃ ગ્રાણભૃત્ ।
અન્યૈ: કિ પ્રચુરૈરપિ પ્રમુદિતૈરત્યન્તદૂરીકૃત-
સ્ફીતાનન્દભરપ્રદામૃતપથૈર્મિથ્યાપથે ગ્રસ્થિતૈ: ॥૨॥

અનુવાદ : જે એક પણ ભવ્ય પ્રાણી અત્યંત પ્રસન્તાથી અહીં નિર્મળ સમ્યગ્દર્શનના વિષયમાં સ્થિતિ કરે છે તે પાપકર્મના ઉદ્યથી દુઃખી હોવા છતાં પણ નિશ્ચયથી પ્રશંસનીય છે. એનાથી ઉલ્લંઘ જે ભિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થઈને મહાન સુખનું પ્રદાન કરનાર મોક્ષના માર્ગથી બહુ દૂર છે તે જો સંખ્યામાં અધિક અને સુખી પણ હોય તોપણ તેમનાથી કાંઈ પ્રયોજન નથી. ૨.

વિશેષાર્� : અભિપ્રાય એ છે કે જો નિર્મળ સમ્યગદેષ્ટિ જીવ એક પણ હોય તો તે પ્રશંસા યોગ્ય છે. પરંતુ મિથ્યામાર્ગમાં પ્રવૃત્ત થયેલા પ્રાણી સંખ્યામાં જો અધિક હોય તો પણ તે પ્રશંસનીય નથી-નિન્દનીય જ છે. નિર્મળ સમ્યગદેષ્ટિ જીવનું પાપકર્મના ઉદ્યથી વર્તમાનમાં દુઃખી રહેવું એટલું હાનિકારક નથી જેટલું મિથ્યાદેષ્ટિ જીવનું પુણ્યકર્મના ઉદ્યથી વર્તમાનમાં સુખમાં સ્થિત રહેવાનું હાનિકારક છે. ૨.

(શાર્ડૂલવિક્રીડિત)

બીજાં મોક્ષતરોર્દ્ધશાં ભવતરોર્મિથ્યાત્વમાહુર્જિનાઃ
પ્રાપ્તાયાં દૃશિ તન્મુમુક્ષુભિરલં યત્નો વિધેયો બુધૈः ।
સંસારે બહુયોનિજાલજટિલે ભ્રાસ્યન् કુકર્માવૃત્તઃ
કવ પ્રાણી લભતે મહત્વયિ ગતે કાલે હિતાં તામિહ ॥૩॥

અનુવાદ : જિન ભગવાનું સમ્યગદર્શનને મોક્ષરૂપી વૃક્ષનું બીજ તથા મિથ્યાદર્શનને સંસારરૂપી વૃક્ષનું બીજ બતાવે છે. તેથી તે સમ્યગદર્શન પ્રાપ્ત થતાં મોક્ષાભિલાષી વિદ્વાનોએ તેના સંરક્ષણ આદિના વિષયમાં મહાનું પ્રયત્ન કરવો જોઈએ. કારણ એ છે કે પાપકર્મથી આઇન થઈને ઘણી (ચોરાસી લાભ) યોનિઓના સમૂહથી જટિલ આ સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રાણી દીર્ઘ કાળ વીતવા છીતાં પણ હિતકારક તે સમ્યગદર્શન ક્યાં પ્રાપ્ત કરી શકે છે? અર્થાતું પ્રાપ્ત કરી શકતો નથી. ૩.

(શાર્ડૂલવિક્રીડિત)

સમ્પ્રાપ્તે ઽત્ર ભવે કર્થ કર્થમયિ દ્રાધીયસાનેહસા
માનુષ્યે શુચિદર્શને ચ મહતા કાર્ય તપો મોક્ષદમ् ।
નો ચેલ્લોકનિષેધતો ઽથ મહતો મોહાદશક્તેરથો
સમ્પદ્યેત ન તત્ત્વા ગૃહવતાં ષટ્કર્મયોગ્ય વ્રતમ् ॥૪॥

અનુવાદ : અહીં સંસારમાં જો કોઈ પ્રકારે અતિશય દીર્ઘકાળમાં મનુષ્યભવ અને નિર્મળ સમ્યગદર્શન પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી મહાપુરુષે મોક્ષદાયક તપનું આચરણ કરવું જોઈએ. પરંતુ જો કુદુંબીજન વગેરેના રોકવાથી, મહામોહથી અથવા અશક્તિના કારણે તે તપશ્ચયરણ કરી ન શકાય તો પછી ગૃહસ્થ શ્રાવકોના છ આવશ્યક

(દેવપૂજા વગેરે) કિયાઓને યોગ્ય વ્રતનું પરિપાલન તો કરવું જ જોઈએ. ૪.

(શાર્ડૂલવિક્રીડિત)

દૃષ્ટમૂલવ્રતમષ્ઠધા
તદનુ ચ સ્યાત્પચ્છધાણુવ્રતં
શીલાખ્યં ચ ગુણવ્રતત્ત્વમતઃ શિક્ષાશ્રતસ્થઃ પરાઃ ।
રાત્રૌ ભોજનવર્જનં શુચિપટાત્ પેયં પયઃ શક્તિસ્તો
મૌનાદિવ્રતમષ્ઠનુષ્ઠિતમિં પુણ્યાય ભવ્યાત્મનામ् ॥૫॥

અનુવાદ : સમૃદ્ધશર્ણની સાથે આઈ મૂળગુણ, ત્યાર પછી પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ રીતે આ સાત શીલવ્રત, રાત્રે ભોજનનો પરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગાળેલા પાણીનું પીવું, તથા શક્તિ અનુસાર મૌનવ્રત આદિ; આ બધું આચયરણ ભવ્ય જીવોને પુણ્યનું કારણ થાય છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

હન્તિ સ્થાવરદેહિનઃ સ્વવિષયે સર્વાસ્ત્રસાન્ રક્ષતિ
બ્રૂતે સત્યમચૌર્યવૃત્તિમબલાં શુદ્ધાં નિજાં સેવતે ।
દિગ્દેશવ્રતદણ્ડવર્જનમતઃ સામાયિકં પ્રોષધં
દાનં ભોગયુગપ્રમાણમુરરીકુર્યાદગૃહીતિ વ્રતી ॥૬॥

અનુવાદ : વ્રતી શ્રાવક પોતાના પ્રયોજનના વશે સ્થાવર પ્રાણીઓનો ધાત કરતો હોવા છતાં પણ સર્વ ત્રસ જીવોની રક્ષા કરે છે, સત્ય વચન બોલે છે, ચૌર્યવૃત્તિ (ચોરી)નો પરિત્યાગ કરે છે, શુદ્ધ પોતાની જ સ્ત્રીનું સેવન કરે છે, દિગ્વ્રત અને દેશપ્રતનું પાલન કરે છે; અનર્થદંડ (પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને પ્રમાદચર્ચા)નો પરિત્યાગ કરે છે; તથા સામાયિક, પ્રોષધોપવાસ, દાન (અતિથિ સંવિભાગ) અને ભોગોપભોગ પરિમાણનો સ્વીકાર કરે છે. ૬.

(શાર્ડૂલવિક્રીડિત)

દેવારાધનપૂજનાદિવહુષુ વ્યાપારકાર્યેષુ સત્ર-
પુણ્યોપાર્જનહેતુષુ ગ્રતિદિનં સંજાયમાનેષ્વપિ ।
સંસારાર્ણવતારણે ગ્રવહણં સત્પાત્રમુદ્દિશ્ય યત્
તદેશવ્રતધારણો ધનવતો દાનં ગ્રકૃષ્ટો ગુણઃ ॥૭॥

અનુવાદ : દેશપ્રતી ધનવાન શ્રાવકને પ્રતિદિન ઉત્તમ પુણ્યોપાર્જનના કારણભૂત દેવારાધના અનેક જિનપૂજનાદિરૂપ અનેક કાર્યો હોવા છતાં પણ સંસારરૂપી સમુદ્ર પાર થવામાં નૌકાનું કામ કરનાર જે સત્પાત્રદાન છે તે તેનો મહાન ગુણ છે. અભિપ્રાય એ છે કે શ્રાવકના સમસ્ત કાર્યોમાં મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. ૭.

(શાર્ડૂલવિક્રીડિત)

સર્વો વાજ્ઞાનિ સૌખ્યમેવ તનુભૃત્તન્મોક્ષ એવ સ્ફુર્ત
દૃષ્ટ્યાદિત્રય એવ સિધ્યતિ સ તત્ત્ત્વિર્ગન્થ એવ સ્થિતમ् ।
તદ્ગૃત્તિર્વપુષો ઽસ્ય વૃત્તિરશનાત્તદીયતે શ્રાવકે:
કાલે ક્લિષ્ટરે ઽપિ મોક્ષપદવી પ્રાયસ્તતો વર્તતે ॥૮॥

અનુવાદ : સર્વ પ્રાણી સુખની જ ઈચ્છા કરે છે, તે સુખ સ્પષ્ટપણે મોક્ષમાં જ છે, તે મોક્ષ સમ્યગ્દર્શનાદિસ્વરૂપ રત્નત્રય થતાં જ સિદ્ધ થાય છે, તે રત્નત્રય દિગંબર સાધુને જ હોય છે, ઉક્ત સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, તે શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે અને તે ભોજન શ્રાવકો દ્વારા આપવામાં આવે છે. આ રીતે આ અતિશય કલેશયુક્ત કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ ઘણું કરીને તે શ્રાવકોના નિમિત્તે જ થઈ રહી છે. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

સ્વેચ્છાહારવિહારજલ્પનતયા નીરુગ્વપુર્જાયતે
સાધૂનાં તુ ન સા તત્ત્સ્તદપ્તુ ગ્રાયેણ સંભાવ્યતે ।
કુર્યાદૌષધપથ્યવારિભિરિદં ચારિત્રભારક્ષમં
યત્તસ્માદિહ વર્તતે પ્રશમિનાં ધર્મો ગૃહસ્થોત્તમાત્ર ॥૯॥

અનુવાદ : શરીર ઈચ્છાનુસાર ભોજન, ગમન અને સંભાષણથી નીરોગ રહે છે. પરંતુ આ પ્રકારની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ સાધુઓને સંભવ નથી. તેથી તેમનું શરીર ઘણું કરીને અસ્વસ્થ થઈ જાય છે. આવી દશામાં શ્રાવક તે શરીરને ઔષધ, પથ્ય ભોજન અને જળ દ્વારા પ્રતિપાલનને યોગ્ય કરે છે તેથી જ અહીં તે મુનિઓનો ધર્મ ઉત્તમ શ્રાવકના નિમિત્તે જ ચાલે છે. ૯.

(શાર્ડૂલવિક્રીડિત)

વ્યાખ્યા પુસ્તકદાનમુન્તતધિયાં પાઠાય ભવ્યાત્મનાં
ભક્ત્યા યત્ક્રિયતે શ્રુતાશ્રયમિં દાનં તદહુર્બુધાઃ ।
સિદ્ધે ઽસ્મિન્ જનનાન્તરેષુ કતિષુ ત્રૈલોક્યલોકોત્સવ-
શ્રીકારિપ્રકટીકૃતાખિલજગત્કેવલ્યભાજો જનાઃ ॥૧૦॥

અનુવાદ : ઉન્ત બુદ્ધિના ધારક ભવ્ય જીવને વાંચવા માટે ભક્તિથી જે પુસ્તકનું દાન આપવામાં આવે છે અથવા તેમને તત્ત્વનું વાખ્યાન આપવામાં આવે છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ ભવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૧૦.

(શાર્ડૂલવિક્રીડિત)

સર્વેષામભયં પ્રવૃદ્ધકરુણૌર્ધીયતે પ્રાણિનાં
દાનં સ્યાદભયાદિ તેન રહિતં દાનત્રયં નિષ્ફલમ् ।
આહારૌષધશાસ્ત્રદાનવિધિભિઃ કૃદ્રોગજાઙ્ઘાદ્રયં
યત્તત્પાત્રજને વિનશ્યતિ તતો દાનં તદેકં પરમ् ॥૧૧॥

અનુવાદ : દ્યાળું પુરુષો દ્વારા જે સર્વ પ્રાણીઓને અભય આપવામાં આવે છે અર્થાત્ તેમનો ભય દૂર કરવામાં આવે છે તે અભયદાન કહેવાય છે. તેનાથી રહિત બાકીના ત્રણ પ્રકારના દાન વર્થ જાય છે. આહાર, ઔષધ અને શાસ્ત્રદાનની વિધિથી પાત્રજીવોનો કમે ક્ષુધાનો ભય, રોગનો ભય અને અજ્ઞાનપણાનો ભય નાથ થાય છે માટે જ તે એક અભયદાન જ શ્રેષ્ઠ છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત ચાર દાનોમાં આ અભયદાન મુખ્ય છે. કારણ કે શેષ આહારાદિ દાનોની સફળતા આ અભયદાન ઉપર જ અવલંબે છે. એ સિવાય જો વિચાર કરવામાં આવે તો તે આહારાદિના દાનસ્વરૂપ બાકીના ત્રણ પણ આ અભયદાનની જ અંદર આવી જાય છે. એનું કારણ એ છે કે અભયદાનનો અર્થ છે પ્રાણીના સર્વ પ્રકારના ભય દૂર કરીને તેને નિર્ભય કરવા. આહારદાન દ્વારા પ્રાણીની ક્ષુધાનો ભય, ઔષધદાન દ્વારા રોગનો ભય અને શાસ્ત્રદાન દ્વારા તેના અજ્ઞાનપણાનો ભય જ દૂર કરવામાં આવે છે. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

આહારાતું સુખિતૌષધાદતિતરાં નીરોગતા જાયતે
શાસ્ત્રાતું પાત્રનિવેદિતાતું પરભવે પાણ્ડિત્યમત્યદ્ધુતમ્ |
એતત્સર્વગુણપ્રભાપરિકરઃ પુંસો ઽભ્યાદાનતઃ:
પર્યન્તે પુનરુત્તોન્તરપદપ્રાતિર્વિમુક્તિસ્તતઃ ॥૧૨॥

અનુવાદ : પાત્રને આપવામાં આવેલા આહારના નિમિત્તે બીજા જન્મમાં સુખ, ઔષધના નિમિત્તે અતિશય નીરોગતા, અને શાસ્ત્રના નિમિત્તે આશ્ર્યજનક વિદ્વતા પ્રાપ્ત થાય છે. અભ્યાદાનથી પુરુષને આ બધા જ ગુણોનો સમૂહ પ્રાપ્ત થાય છે તથા અંતે ઉન્નત ઉન્નત પદો (ઈન્દ્ર અને ચક્રવર્તી આદિ)ની પ્રાપ્તિપૂર્વક મુક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે. ૧૨.

(શાર્દૂલવિક્રીડિત)

કૃત્વા કાર્યશતાનિ પાપબહુલાન્યાશ્રિત્ય ખેદં પરં
ભ્રાન્ત્વા વારિધિમેખલાં વસુમતીં દુઃખેન યચ્ચાર્જિતમ્ |
તત્સુત્રાદપિ જીવિતાદપિ ધનં પ્રેયોऽસ્ય પન્થાઃ શુભો
દાનં તેન ચ દીયતામિદમહો નાન્યેન તત્સંગતિઃ ॥૧૩॥

અનુવાદ : જે ધન અતિશય ખેદના અનુભવપૂર્વક પાપપ્રચુર સેંકડો ખોટા કાર્યો કરીને તથા સમુદ્રરૂપ મેખલા સહિત અર્થાત્ સમુદ્રપર્યત પૃથ્વીનું પરિભ્રમણ કરીને ઘણા હુઃખ્યી મેળવાય છે તે ધન મનુષ્યને પોતાના પુત્ર અને પ્રાણોથી પણ અધિક ઘારું હોય છે તેને ખરચવાનો ઉત્તમ માર્ગ દાન છે. તેથી કષ્ટથી મેળવેલા તે ધનનું દાન કરવું જોઈએ. એનાથી વિપરીત બીજા માર્ગ (હુર્વસનાદિ) અપવ્યય કરવામાં આવે તો તેનો સંયોગ ફરીથી પ્રાપ્ત થઈ શકતો નથી. ૧૩.

(શાર્દૂલવિક્રીડિત)

દાનેનૈવ ગૃહસ્થતા ગુણવતી લોકદ્વયોદ્યોતિકા
સૈવ સ્યાન્ત્રનું તદ્વિના ધનવતો લોકદ્વયધંસકૃત્ |
તુર્વાપારશતેષુ સત્સુ ગૃહિણઃ પાપં યદુત્પદ્યતે
તત્ત્વાશાય શશાઙ્કશુભ્રયશસે દાનં ચ નાન્યત્પરમ् ॥૧૪॥

અનુવાદ : દાન દ્વારા જ ગુણયુક્ત ગૃહસ્થાશ્રમ બન્ને લોકને પ્રકાશિત કરે છે અર્થાત् જીવને દાનના નિમિત્તે જ આ ભવ અને પરભવ બન્નેમાં સુખ પ્રાપ્ત થાય છે. એનાથી ઉલ્લંઘન ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બન્ને લોકને નષ્ટ કરી નાંબે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ છે, તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નાછે. ૧૪.

(શાર્દૂલવિક્રીડિત)

પાત્રાણમુપયોગી યત્ક્ષિલ ધનं તદ્દીમતાં મન્યતે
યેનાનંતરુણં પરત્ર સુખદં વ્યાવર્તતે તત્પુનઃ ।
યદ્ભોગાય ગતં પુનર્ધનવતસ્તત્રષ્ટમેવ ધ્રુવં
સર્વાસામિતિ સમ્પદાં ગૃહવતાં દાને પ્રધાનં ફલમ् ॥૧૫॥

અનુવાદ : જે ધન પાત્રોના ઉપયોગમાં આવે છે તેને જ બુદ્ધિમાન મનુષ્ય શ્રેષ્ઠ માને છે કારણ કે તે અનંતગુણા સુખનું આપનાર થઈને પરલોકમાં ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત् દાનજનિત પુષ્યના અભાવમાં તે ફરી કદ્દી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૫.

(શાર્દૂલવિક્રીડિત)

પુત્રે રાજ્યમશેષમર્થિષુ ધનં દત્ત્યાભયં પ્રાણિષુ
પ્રાપ્તા નિત્યસુખાસ્પદં સુતપસા મોક્ષં પુરા પાર્થિવાઃ ।
મોક્ષસ્યાપિ ભવેત્તતઃ પ્રથમતો દાનં નિદાનં બુધૈ:
શક્ત્યા દેયમિદં સદાતિચપલે દ્રબ્યે તથા જીવિતે ॥૧૬॥

અનુવાદ : પૂર્વકાળમાં અનેક રાજાઓ પુત્રને સમસ્ત રાજ્ય આપી દઈને, યાચક જનોને ધન આપીને તથા પ્રાણીઓને અભય આપીને ઉત્કૃષ્ટ તપશ્ચરણ દ્વારા અવિનશ્યર સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત થયા છે. આ રીતે તે દાન મોક્ષનું પણ પ્રધાન કારણ છે. તેથી સંપત્તિ અને જીવન અતિશય ચપળ અર્થાત્ નશ્યર હોવાથી

વિદ્વાન પુરુષોએ શક્તિ પ્રમાણે સર્વદા તે દાન અવશ્ય આપવું જોઈએ. ૧૬.

(શાર્ડૂલવિક્રીડિત)

યે મોક્ષ ગ્રતિ નોદ્યતાઃ સુનૃભવે લખેઽપિ દુર્બુદ્ધઃ
તે તિષ્ઠન્તિ ગૃહે ન દાનમિહ ચેત્તન્મોહપાશો દૃઢઃ ।
મત્વેદ ગૃહિણા યથર્દ્વિ વિવિધં દાનं સદા દીયતાં
તત્સંસારસરિત્પતિપ્રતરણે પોતાયતે નિશ્ચિતમ् ॥૧૭॥

અનુવાદ : ઉત્તમ મનુષ્યભવ પામીને પણ જે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષના વિષયમાં ઉદ્યમ કરતા નથી તેઓ જો ઘરમાં રહેવા છતાં પણ દાન આપતા નથી તો તેમના માટે તે ઘર મોહદ્વારા નિર્મિત દેઢ જાળ જેવું જ છે એમ સમજીને ગૃહસ્થ શ્રાવકે પોતાની સંપત્તિ અનુસાર સર્વદા અનેક પ્રકારનું દાન આપવું જોઈએ. કારણ એ છે કે તે દાન નિશ્ચયથી સંસારરૂપી સમુદ્ર પાર થવામાં નાવનું કામ કરે છે. ૧૭.

(શાર્ડૂલવિક્રીડિત)

યૈર્નિત્યં ન વિલોક્યતે જિનપતિર્ન સ્મર્યતે નાર્યતે
ન સ્તૂયેત ન દીયતે મુનિજને દાનં ચ ભક્ત્યા પરમ् ।
સામર્થ્ય સતિ તદ્ગૃહાશ્રમપદં પાષાણનાવા સમં
તત્રસ્થા ભવસાગરે ઽતિવિષમે મજ્જન્તિ નશયન્તિ ચ ॥૧૮॥

અનુવાદ : જે મનુષ્ય પ્રતિદિન જિનેન્દ્રદેવનું ન તો દર્શન કરે છે, ન સ્મરણ કરે છે, ન પૂજન કરે છે, ન સ્તુતિ કરે છે અને સમર્થ હોવા છતાં પણ ભક્તિથી મુનિજનોને ઉત્તમ દાન પણ દેતા નથી; તેમનું ગૃહસ્થાશ્રમ પદ પથ્થરની નાવ સમાન છે. તેના ઉપર બેસીને તે મનુષ્યો અત્યંત ભયાનક સંસારરૂપી સમુદ્રમાં ગોથા ખાતા થકા નાશ જ પામવાના છે. ૧૮.

(શાર્ડૂલવિક્રીડિત)

વિન્તારતનસુરદુકામસુરભિસ્પર્શોપલાદ્યા ભુવિ
ખ્યાતા એવ પરોપકારકરણે દૃષ્ટા ન તે કેનચિત્ ।

તैત્રોપકૃતं ન કેષુચિદપિ પ્રાયો ન સંભાવતે
તત્કાર્યાણિ પુનઃ સદૈવ વિદધદ્વાતા પરં દૃશ્યતે ॥૧૯॥

અનુવાદ : ચિન્તામણિ, કલ્યાણ, કામધેનુ અને પારસ પથર આદિ પૃથ્વીપર પરોપકાર કરવામાં કેવળ પ્રસિદ્ધ જ છે. તેમને ન તો કોઈએ પરોપકાર કરતા જોયા છે અને ન તેમણે અહીં કોઈનો ઉપકાર કર્યો પણ છે તથા એવી સંભાવના પણ ધ્યાનું કરીને નથી. પરંતુ તેમના કાર્યો (પરોપકારાદિ) સદાય કરતા કેવળ દાતા શ્રાવક અવશ્ય જોવામાં આવે છે. તાત્પર્ય એ છે કે દાની મનુષ્ય તે પ્રસિદ્ધ ચિન્તામણિ આદિથી પણ અતિશય શ્રેષ્ઠ છે. ૧૮.

(શાર્દૂલવિક્રીડિત)

યત્ર શ્રાવકલોક એષ વસતિ સ્યાત્તત્ર ચैત્યાલયો
યાસ્મિન્ સોડસ્તિ ચ તત્ર સાન્તિ યત્યો ધર્મશ્ર તૈર્વતતે ।
ધર્મે સત્યઘસંચયો વિઘટતે સ્વર્ગાપવર્ગાશ્રયં
સૌખ્યં ભાવિ નૃણાં તત્તો ગુણવત્તાં સ્યુઃ શ્રાવકાઃ સંમતાઃ ॥૨૦॥

અનુવાદ : જે ગામમાં આ શ્રાવકો રહે છે ત્યાં ચૈત્યાલય થાય છે અને જ્યાં ચૈત્યાલય છે ત્યાં મુનિઓ રહે છે, તે મુનિઓ દ્વારા ધર્મની પ્રવૃત્તિ થાય છે તથા ધર્મ થતાં પાપના સમૂહનો નાશ થઈને સ્વર્ગ-મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી ગુણવાન મનુષ્યોને શ્રાવકો ઈષ છે. ૨૦.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જે જિનમંદિરોમાં સ્થિત થઈને મુનિઓ સ્વર્ગ-મોક્ષના સાધનભૂત ધર્મનો પ્રચાર કરે છે તે જિનમંદિર શ્રાવકો દ્વારા જ બનાવાય છે. માટે જો તે શ્રાવકો જ પરંપરાએ તે સુખના સાધન હોય તો ગુણી જનોએ તે શ્રાવકોનું યથાયોગ્ય સન્માન કરવું જ જોઈએ. ૨૦

(શાર્દૂલવિક્રીડિત)

કાલે દુઃખમસંજ્ઞકે જિનપતેધર્મે ગતે ક્ષીણતાં
તુચ્છે સામયિકે જને બહુતરે મિથ્યાન્ધકારે સતિ ।
ચૈત્યે ચૈત્યગૃહે ચ ભક્તિસહિતો યઃ સોડપિ નો દૃશ્યતે
યસ્તત્કારયતે યથાવિધિ પુનર્ભવ્યઃ સ વંદ્યઃ સતામ્ ॥૨૧॥

અનુવાદ : આ દુઃખમા નામના પંચમ કાળમાં જિનેજ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ ક્ષીણ થઈ ગયો છે. આમાં જૈનાગમ અથવા જૈનધર્મનો આશ્રય લેનાર માણસો થોડા અને અજ્ઞાનરૂપ અંધકારનો પ્રચાર ઘણો વધારે છે. એવી અવસ્થામાં જે મનુષ્ય જિનપ્રતિમા અને જિનગૃહના વિષયમાં ભક્તિ રાખતા હોય તે પણ જોવામાં આવતા નથી. છતાં પણ જે ભવ્ય વિધિપૂર્વક ઉક્ત જિનપ્રતિમા અને જિનગૃહનું નિર્માણ કરાવે છે તે સજ્જન પુરુષો દ્વારા વંદ્નીય છે. ૨૧.

(વસંતતિલકા)

બિમ્બાદલોન્તિયવોન્તિમેવ ભક્ત્યા
યે કારયન્તિ જિનસંઘ જિનાકૃતિં ચ ।
પુણ્યં તદીયમિહ વાગપિ નૈવ શક્તા
સ્તોતું પરસ્ય કિમુ કારયિતુદ્વયસ્ય ॥૨૨॥

અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિથી કુન્દરૂ વૃક્ષના પાંદડા જેવડા જિનાલય અને જીવ(દાણા)ના જેવડી જિનપ્રતિમાનું નિર્માણ કરાવે છે તેમના પુણ્યનું વર્ણન કરવા માટે અહીં વાણી (સરસ્વતી) પણ સમર્થ નથી. તો પછી જે ભવ્ય જીવ તે (જિનાલય અને જિનપ્રતિમા) બન્નેનુંય નિર્માણ કરાવે છે તેમના વિષયમાં શું કહેવું? અર્થાત્ તે તો અતિશય પુણ્યશાળી છે ૪. ૨૨.

વિશોધાર્થ : એનો અભિપ્રાય એ છે કે ભવ્ય પ્રાણી નાનામાં નાના જિનમંદિર અથવા જિનપ્રતિમાનું પણ નિર્માણ કરાવે છે તે ઘણો જ પુણ્યશાળી થાય છે. તો પછી જે ભવ્ય જીવ વિશાળ જિનભવનનું નિર્માણ કરાવીને તેમાં મનોહર જિનપ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવે છે તેને તો નિઃસંદેહ અપરિમિત પુણ્યનો લાભ થવાનો છે. ૨૨.

(શાર્દૂલવિક્રીદિત)

યાત્રાભિઃ સ્નપનૈમહોત્સવશતૈઃ પૂજાભિરુલ્લોચકै:
નૈવેદ્યૈર્બલિભિર્જશ કલશૈસ્તૂર્યત્રિકૈર્જાગ્રાયૈ: ।
ઘંટાચામરદર્પણાદિભિરપિ પ્રસ્તાર્ય શોભાં પરાં
ભવ્યાઃ પુણ્યમુપાર્જયન્તિ સતતં સત્યત્ર ચૈત્યાલયે ॥૨૩॥

અનુવાદ : સંસારમાં ચૈત્યાલય થતાં અનેક ભવ્યજીવ યાત્રાઓ, (જળયાત્રાઆદિ) અભિષેકો, સેંકડો મહાન ઉત્સવો અનેક પ્રકારના પૂજા વિધાનો, ચંદ્રવા, નૈવેદ્ય, અન્ય ભેટો, ધવજાઓ, કળશો, લૌર્યન્દ્રિકો (ગીત, નૃત્ય, વાદિત્ર), જગરણો, ધંટ, ચામર, દર્પણાદિ દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરીને નિરંતર પુષ્યનું ઉપાર્જન કરે છે. ૨૩.

(શાર્દૂલવિક્રીડિત)

તે ચાણુબ્રતધારિણો ઽપિ નિયતં યાન્ત્ર્યેવ દેવાલયં
તિષ્ઠન્ત્યેવ મહર્દ્રિકામરપદ તત્ત્રૈવ લબ્ધ્વા ચિરમ્ |
અત્રાગત્ય પુનઃ કુલે ઽતિમહતિ ગ્રાણ્ય પ્રકૃષ્ટં શુભા-
ન્માનુષ્યં ચ વિરાગતાં ચ સકલત્યાગં ચ મુક્તાસ્તતઃ ॥૨૪॥

અનુવાદ : તે ભવ્ય જીવ જો અણુબ્રતોના પણ ધારક હોય તોપણ મરીને પછી સ્વર્ગમાં જ જાય છે અને અણિમા આદિ ઋદ્ધિ સંયુક્ત દેવપદ પ્રાપ્ત કરીને દીર્ઘકાળ સુધી ત્યાં (સ્વર્ગમાં) જ રહે છે. ત્યાર પછી મહાન् પુષ્યકર્મના ઉદ્યથી મનુષ્યલોકમાં આવીને અને અતિશય પ્રશંસનીય કુળમાં ઉત્તમ મનુષ્ય થઈને વૈરાગ્ય પ્રાપ્ત થયા થકા તેઓ સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થઈ જાય છે તથા આ કંમે તેઓ અંતે મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. ૨૪.

(શાર્દૂલવિક્રીડિત)

પુંસો ઽર્થેષુ ચતુર્ષ નિશ્ચલતરો મોક્ષઃ પરં સત્સુખઃ
શેષાસ્તદ્વિપરીતધર્મકલિતા હેયા મુમુક્ષોરતઃ ।
તસ્માત્તત્પદસાધનત્વધરણો ધર્મો�પિ નો સંમતઃ
યો ભોગાદિનિમિત્તમેવ સ પુનઃ પાપં બુધૈર્મન્યતે ॥૨૫॥

અનુવાદ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં કેવળ મોક્ષ પુરુષાર્થ જ સમીયીન (બાધા રહિત) સુખ યુક્ત હોઈને સદા સ્થિર રહે છે. બાકીના ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજ્ઞનોએ છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપર્યુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે

તે પણ આપણાને ઈષ્ટ છે. પરંતુ જે ધર્મ કેવળ ભોગાદિનું જ કારણ થાય છે તેને વિદ્વાનો પાપ જ સમજે છે. ૨૫.

(શાર્ડૂલવિક્રીડિત)

ભવ્યાનામણુભિર્તૌરનણુભિઃ સાધ્યોऽત્ર મોક્ષઃ પરં
નાન્યલિકિચિદહૈવ નિશ્ચયનયાજીવઃ સુખી જાયતે ।
સર્વ તુ ગ્રતજાતમીદશધિયા સાફલ્યમેત્યન્યથા
સંસારાશ્રયકારણં ભવતિ યત્થુઃખમેવ સ્ફુર્તમ् ॥૨૬॥

અનુવાદ : ભવ્ય જીવોએ અણુવતો અને મહાવતો દ્વારા અહીં કેવળ મોક્ષ જ સિદ્ધ કરવા યોગ્ય છે, અન્ય કંઈ પણ સિદ્ધ કરવા યોગ્ય નથી. કારણ એ છે કે નિશ્ચયનયથી જીવ તે મોક્ષમાં જ સ્થિત થઈને સુખી થાય છે. તેથી આ જાતની બુદ્ધિથી જે સર્વ ગ્રતોનું પરિપાલન કરવામાં આવે છે તે સફળતા પામે છે તથા આનાથી વિપરીત તેને કેવળ તે સંસારનું કારણ થાય છે જે પ્રત્યક્ષ જ દુઃખ સ્વરૂપ છે. ૨૬.

(શાર્ડૂલવિક્રીડિત)

યત્કલ્યાણપરંપરાર્પણપરં ભવ્યાત્મનાં સંસ્તૂતૌ
પર્યન્તે યદનન્તસૌખ્યસદનં મોક્ષં દદાતિ ધ્રુવમ् ।
તજીયાદતિદુર્લભં સુનરતામુખૈર્ગુણૈઃ પ્રાપિતં
શ્રીમત્યદ્વાજનન્દિભિર્વિરચિતં દેશવ્રતોદ્યોતનમ् ॥૨૭॥

અનુવાદ : શ્રીમાન् પદ્મનાન્દી મુનિ દ્વારા રચવામાં આવેલ જે દેશવ્રતોદ્યોતન નામનું પ્રકરણ સંસારમાં ભવ્ય જીવોને કલ્યાણ પરંપરા આપવામાં તત્પર છે, અંતે જે નિશ્ચયથી અનંત સુખના સ્થાનભૂત મોક્ષ આપે છે તથા જે ઉત્તમ મનુષ્ય પર્યાય આદિ ગુણો વડે પ્રાપ્ત કરાવાય છે; એવું તે દુર્લભ દેશવ્રતોદ્યોતન જ્યવંત હો. ૨૭.

આ રીતે દેશવ્રતઉદ્યોતન સમાપ્ત થયું. ૭.



c. સિદ્ધસ્તુતિ

[c. સિદ્ધસ્તુતિઃ]

(શાર્દૂલવિક્રીડિત)

સૂક્ષ્મત્વાદણુર્દર્શિનોડવધિદશः પશ્યન્તિ નો યાન્ પરે
યત્સંવિન્મહિમસ્થિતં ત્રિભુવનં ખસ્થં ભમેકં યથા ।
સિદ્ધાનામહપ્રમેયમહસાં તેષાં લઘુર્માનુષો
મૂઢાત્મા કિમુ વચ્ચિ તત્ત્ર યદિ વા ભક્ત્યા મહત્યા વશઃ ॥૧॥

અનુવાદ : સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા અવધિશાની પણ જોઈ શકતા નથી તથા જેમના શાનમાં સ્થિત ત્રણે લોક આકાશમાં સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું વર્ણન શું મારા જેવો ભૂર્ભ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત् કરી શકતો નથી. છતાં પણ જે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તે અતિશય ભક્તિને વશ થઈને જ કરી રહ્યો છું. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

નિઃશેષામરશેખરાશ્રિતમणિશ્રેણ્યર્ચિતાઙ્ગિદ્બ્રદ્ધયા
દેવાસ્તે ઽપિ જિના યદુન્તપદપ્રાપ્તૈ યતન્તે તરામ् ।
સર્વેષામુપરિ પ્રવૃદ્ધપરમજ્ઞાનાદિભિઃ ક્ષાયિકૈ:
યુક્તા ન વ્યભિચારિભિઃ પ્રતિદિનં સિદ્ધાન્ નમામો વયમ् ॥૨॥

અનુવાદ : જેમના બન્ને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલ મણિઓની પંક્તિથી પૂજિત છે અર્થાત् જેમના ચરણોમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે, એવા તે તીર્થકર જિનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન

કરે છે; જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય વૃદ્ધિ પામેલા કેવળજ્ઞાનાદિસ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે; તે સિદ્ધોને અમે પ્રતિદિન નમસ્કાર કરીએ છીએ. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

યे લોકાગ્રવિલમ્બિનસ્તદધિકં ધર્માસ્તિકાયં વિના
નો યાતાઃ સહજસ્થિરામલલસદ્ગબોધસનૂર્તયઃ ।
સંપ્રાસાઃ કૃતકૃત્યતામસદ્ધશાઃ સિદ્ધા જગન્મઙ્ગલં
નિત્યાનન્દસુધારસસ્ય ચ સદા પાત્રાણિ તે પાન્તુ વઃ ॥૩॥

અનુવાદ : જે સિદ્ધ જીવો લોકશિખરને આશ્રિત છે, આગળ ધર્મ દ્રવ્યનો અભાવ હોવાથી જે તેનાથી વધારે ઉપર ગયા નથી, જે અવિનશ્વર સ્વાભાવિક નિર્મણ દર્શન (કેવળદર્શન) અને જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ અનુપમ શરીર ધારણ કરે છે, જે ઝૃતઝૃત્યસ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અનુપમ છે, જગતને માટે મંગળસ્વરૂપ છે, તથા અવિનશ્વર સુખરૂપ અમૃતરસના પાત્ર છે; એવા તે સિદ્ધ સદા તમારી રક્ષા કરો. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

યે જિત્વા નિજકર્પકર્કશરિપૂનું પ્રાસાઃ પદં શાશ્વતં
યેષાં જન્મજરામૃતિપ્રભૃતિભિઃ સીમાપિ નોલ્લઙ્ઘયતે ।
યેષૈશ્ર્વયમચિન્ત્યમેકમસમજ્ઞાનાદિસંયોજિતં
તે સન્તુ ત્રિજગચ્છિખાગ્રમણયઃ સિદ્ધા મમ શ્રેયસે ॥૪॥

અનુવાદ : જે સિદ્ધ પરમેષ્ઠી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને નિત્ય (મોક્ષ) પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે; જન્મ, જરા અને ભરણ આદિ પણ જેમની સીમા ઓળંગી શકતા નથી, અર્થાત્ જે જન્મ, જરા અને ભરણથી મુક્ત થઈ ગયા છે; તથા જેમનામાં અસાધારણ જ્ઞાનાદિ દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંતચુષ્ટયસ્વરૂપ ઐશ્વર્યનો સંયોગ કરાવવામાં આવ્યો છે; એવા તે ત્રણે લોકના ચૂડામણિ સમાન સિદ્ધ પરમેષ્ઠી મારું કર્ત્યાણ કરો. ૪.

(શાર્ડૂલવિક્રીડિત)

સિદ્ધો બોધમિતિઃ સ બોધ ઉદિતો જ્ઞેયપ્રમાણો ભવેત્
જ્ઞેયં લોકમલોકમેવ ચ વદન્ત્યાત્મેતિ સર્વસ્થિતઃ ।
મૂષાયાં મદનોજ્જિતે હિ જઠરે યાદ્ગ્ર નભસ્તાદશઃ
પ્રાકાયાત્ કિમપિ પ્રહીણ ઇતિ વા સિદ્ધઃ સદાનન્દતિ ॥૫॥

અનુવાદ : સિદ્ધ જીવ પોતાના શાનપ્રમાણ છે અને તે શાન જ્ઞેય (શાનના વિષય) પ્રમાણ કહેવામાં આવ્યું છે. તે જ્ઞેય પણ લોક અને અલોકસ્વરૂપ છે. તેથી જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. બીબા (જેમાં થાળીને પાત્ર અને આભૂષણ વગેરે બનાવવામાં આવે છે)માંથી મીણ જુદું પડી જતાં તેની અંદર જેવું શુદ્ધ આકાશ બાકી રહી જાય છે એવા આકારને ધારણ કરનાર તથા પહેલાના શરીરથી કંઈક અલ્યુ એવા તે સિદ્ધ પરમેષ્ઠી સદા આનંદનો અનુભવ કરે છે.

વિશેખાર્થ : સિદ્ધોનું શાન અપરિમિત છે જે સમસ્ત લોક અને અલોકનો વિષય કરે છે. આ રીતે લોક અને અલોકરૂપ અપરિમિત જ્ઞેયનો વિષય કરનાર તે શાનથી આત્મા અભિન્ન છે—તે સ્વરૂપ છે; આ જ અપેક્ષાએ આત્માને વ્યાપક કહેવામાં આવે છે. વાસ્તવમાં તો તે પૂર્વ શરીરથી કંઈક ન્યૂન રહીને પોતાના સીમિત ક્ષેત્રમાં જ રહે છે. પૂર્વના શરીરથી કંઈક ન્યૂન કહેવાનું કારણ એ છે કે શરીરના ઉપાંગભૂત જે નાસિકા વગેરેના છિદ્રાણ હોય છે ત્યાં આત્મપ્રદેશોનો અભાવ હોય છે. શરીરનો સંબંધ છૂટતાં અમૂર્તિક સિદ્ધાત્માનો આકાર કેવો રહે છે તે બતાવતાં અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માટી વગેરેથી બનાવેલ પૂતળામાં મીણ ભરી દેવામાં આવ્યું હોય, અને ત્યાર પછી તેને અનિનાં સંયોગ પ્રાપ્ત થતાં જેમ તે મીણ ગળી જાય અને ત્યાં તે આકારમાં શુદ્ધ આકાશ બાકી રહી જાય છે તેવી જ રીતે શરીરનો સંબંધ છૂટી જતાં તેના આકારે શુદ્ધ આત્મપ્રદેશ બાકી રહી જાય છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

દ્વારોધૌ પરમૌ તદાવૃત્તિહતે: સૌખ્યં ચ મોહક્ષયાત્
વીર્ય વિઘ્નવિઘાતતો ઽપ્રતિહતં મૂર્તિન્ નામક્ષતે: ।
આયુર્નાશવશાન્ જન્મમરણે ગોત્રે ન ગોત્રં વિના
સિદ્ધાનાં ન ચ વેદનીયવિરહાદુઃખં સુખં ચાક્ષજમ् ॥૬॥

અનુવાદ : સિદ્ધોને દર્શનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ દર્શન (ક્રેવળદર્શન), શાનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ શાન (ક્રેવળશાન), મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ,

અંતરાયના વિનાશથી અંતવીર્ય, નામકર્મના ક્ષયથી તેમને મૂર્તિનો અભાવ થઈને અમૂર્તપણું (સૂક્ષ્મત્વ), આયુષ્ય કર્મ નાટ થઈ જવાથી જન્મ-મરણનો અભાવ થઈ અવગાહનત્વ, ગોત્ર કર્મ ક્ષીણ થઈ જવાથી ઉચ્ચ અને નીચ ગોત્રોનો અભાવ થઈને અગુરુલધૃત્વ, તથા વેદનીય કર્મ નાટ થઈ જવાથી ઈન્દ્રિયજન્ય સુખ-દુઃખનો અભાવ થઈને અવ્યાબાધત્વ ગુણ પ્રગટ થાય છે. ૬.

(शार्दूलविक्रीडि॒त)

यैर्दुःखानि समाप्तवन्ति विधिवज्जानन्ति पश्यन्ति नो
 वीर्यं नैव निजं भजन्त्यसुभृतो नित्यं स्थिताः संसृतौ ।
 कर्माणि प्रहतानि तानि महता योगेन यैस्ते सदा
 सिद्धा नित्यचतुष्यामृतसरिग्नाथा भवेर्युर्न किम् ॥७॥

અનુવાદ : જે કર્માના નિભિતો નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા હુઃખો પામ્યા કરે છે, વિધિવત् આત્મસ્વરૂપને જાગ્રતો નથી, દેખતો નથી અને પોતાના સ્વાભાવિક વીર્ય (સામર્થ્ય) નો પણ અનુભવ કરતો નથી; તે કર્માને જે સિદ્ધોએ મહાન યોગ અર્થાત્ શુક્લધ્યાન દ્વારા નાચ કરી દીધા છે તે સિદ્ધ ભગવાન અવિનશ્વર અનંતયતુષ્ટયરૂપ અમૃતની નદીના અધિપતિ (સમુક્ર) શું નહિ થાય? અર્થાત્ અવશ્ય થશે. ૭.

(शार्दूलविक्रीडि॒त)

एकाक्षाद्विकर्मसंवृतमतेद्यक्षादिजीवाः सुख-
ज्ञानाधिक्ययुता भवन्ति किमपि क्लेशोपशान्तेरिह ।
ये सिद्धास्तु समस्तकर्मविषमधान्तप्रबन्धच्युताः
सद्बोधाः सुखिनश्च ते कथमहो न स्युस्त्रिलोकाधिपाः ॥८॥

અનુવાદ : સંસારમાં જે એકેન્દ્રિય જીવની ખુલ્લિ કર્મના ઘણા આવરણ સહિત છે તેની અપેક્ષાએ દીન્દ્રિય આદિ જીવ અધિક સુખી અને અધિક જ્ઞાનવાનું છે કારણ કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. તો પછી ભાઈ, જે સિદ્ધ જીવ સમસ્ત કર્મરૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે તે ત્રણે લોકના અધિપતિ થઈને ઉત્તમ જ્ઞાન (ક્રેવળજ્ઞાન) અને અનંત સુખ સંપત્તિ કેમ ન હોય? અવશ્ય હોય.

વિશેષાર્� : એકેન્દ્રિય જીવને જેટલી અધિક માત્રામાં જ્ઞાનાવરણાદિ કર્માનું આવરણ છે તેનાથી ઉત્તરોત્તર દીન્દ્રિયાદિ જીવને તે કાંઈક કરું છે. તેથી એકેન્દ્રિયોની અપેક્ષાએ દીન્દ્રિય અને

તેની અપેક્ષાએ ત્રીન્દ્રિયાદિ જીવ ઉત્તરોત્તર અધિક જ્ઞાનવાન् અને સુખી જોવામાં આવે છે. વળી જો તે જ કર્માનું આવરણ સિદ્ધોને પૂર્ણપણે નાચ થઈ ગયું છે તો પછી તેમને અનંતજ્ઞાની અને અનંતસુખી થઈ જવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

યः કેનાપ્યતિગાઢગાઢમભિતો દુઃખપ્રદैઃ પ્રગ્રહૈઃ
બદ્ધોऽન્યૈશ્ નરો રૂષા ઘનતરૈરાપાદમામસ્તકમ् ।
એકસ્મિન્ શિથિલે ઽપિ તત્ત્વ મનુતે સૌખ્યં સ સિદ્ધાઃ પુનઃ
કિં ન સ્યુઃ સુખિનઃ સદા વિરહિતા બાહ્યાન્તરૈર્બન્ધનૈઃ ॥૧॥

અનુવાદ : જે મનુષ્ય કોઈ બીજા મનુષ્યદ્વારા કોધને વશ થઈને પગથી માંડીને મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દેફટર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય તે તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતાં સુખનો અનુભવ કરે છે. તો પછી જે સિદ્ધ જીવ બાધ અને અભ્યંતર બન્યેય બંધનોથી રહિત થઈ ગયા છે તેઓ શું સદા સુખી નહિ હોય? અર્થાત્ અવશ્ય હશે. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

સર્વજાઃ કુરુતે પરં તનુભૂતઃ પ્રાચુર્યતઃ કર્મણાં
રેણૂનાં ગણનં કિલાધિવસતામેકં પ્રદેશં ઘનમ् ।
ઇત્યાશાસ્વખિલાસુ બદ્ધમહસો દુઃખં ન કસ્માન્મહ-
નુક્તસ્યાસ્ય તુ સર્વત્રઃ કિમિતિ નો જાયેત સૌખ્યં પરમ ॥૧૦॥

અનુવાદ : જીવના એક પ્રદેશમાં સધનરૂપે સ્થિત કર્માના પ્રચુર પરમાણુઓની ગણતરી ફક્ત સર્વજા જ કરી શકે છે. તો પછી જો બધી દિશાઓમાં અર્થાત્ સર્વ તરફથી આ જીવનું આત્મતેજ કર્માથી સંબંધ (રોકાયેલું) હોય તો તેને મહાન દુઃખ કેમ ન થાય? અવશ્ય થાય. એનાથી વિપરીત જે આ સિદ્ધ જીવ બધી તરફથી જ ઉક્ત કર્માથી રહિત થઈ ગયા છે તેમને ઉત્કૃષ્ટ સુખ ન હોય શું? અર્થાત્ અવશ્ય હોય.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ સંસારી પ્રાણીને એક જ આત્મપ્રદેશો એટલા બધા કર્મ પરમાણુ બંધાયેલા છે કે તેમની ગણતરી કેવળ સર્વજા જ કરી શકે છે, આપણા

જેવા કોઈ અલ્પક્ષ જીવ નહિ. એવી રીતે આ જીવને બધા જ (અસંખ્યાત) આત્મપ્રદેશ તે કર્મ પરમાણુઓથી બંધાયેલા છે. હવે ભલા વિચાર કરો કે આટલા અનંતાનંત કર્મ પરમાણુઓથી બંધાયેલો આ સંસારી જીવ કેટલો બધો દુઃખી અને તે બધાથી રહિત થઈ ગયેલા સિદ્ધ જીવ કેટલા બધા સુખી હશે. ૧૦.

(શાર્દૂલવિક્રીડિત)

યેષાં કર્મનિદાનજન્યવિવિધકુત્તુણુખા વ્યાધયઃ
તેષામન્ત્રજલાદિકૌષધગણસ્તચાન્તયે યુજ્યતે ।
સિદ્ધાનાં તુ ન કર્મ તત્કૃતરૂજો નાતઃ કિમન્તાદિભિ:
નિત્યાત્મોત્થસુખામૃતામ્બુધિગતાસ્તૃપ્તાસ્ત એવ ધ્રુવમ् ॥૧૧॥

અનુવાદ : જે જીવને કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની ભૂખ-તરસ વગેરે વ્યાધિઓ થયા કરે છે તેમને આ વ્યાધિઓની શાંતિ માટે અન્, જળ અને ઔષધ વગેરે લેવું ઉચિત છે. પરંતુ જે સિદ્ધ જીવને ન કર્મ છે અને તેથી ન તેનાથી ઉત્પન્ન થતી વ્યાધિઓ પણ છે તેમને આ અન્નાદિ વસ્તુઓથી શું પ્રયોજન છે? અર્થાત્ તેમને આનું કાંઈપણ પ્રયોજન રહ્યું નથી. તેઓ તો નિશ્ચયથી અવિનશ્વર આત્મમાત્રજન્ય (અતીન્દ્રિય) સુખરૂપી અમૃતના સમુદ્રમાં મળ્ણ રહીને સદાય તૃપ્ત રહે છે. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

સિદ્ધજ્યોતિરતીવ નિર્મલતરજ્ઞાનૈકમૂર્તિ સ્ફુરદ્-
વર્તિર્દીપમિવોપસેવ્ય લભતે યોગી સ્થિરं તત્પરમ् ।
સદ્બુધ્યાથ વિકલ્પજાલરહિતસ્તદ્વપતામાપતં-
સ્તાદ્વજાયત એવ દેવવિનુતસ્ત્રૈલોક્યચૂડામણિ: ॥૧૨॥

અનુવાદ : જેવી રીતે બતી દીપકની સેવા કરીને તેનું પદ પ્રાપ્ત કરી લે છે, અર્થાત્ દીપક સ્વરૂપે પરિણમી જાય છે તેવી જ રીતે અત્યંત નિર્મળ જ્ઞાનરૂપ અસાધારણ મૂર્તિસ્વરૂપ સિદ્ધજ્યોતિની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર પદ (સિદ્ધપદ) ને પ્રાપ્ત કરી લે છે. અથવા તે સમ્યગ્જ્ઞાન દ્વારા વિકલ્પોથી રહિત થયા થકા સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થઈને એવા થઈ જાય છે કે ત્રણે લોકના ચૂડામણિ રત્ન સમાન તેમને દેવો પણ નમસ્કાર કરે છે. ૧૨.

(શાર્ડૂલવિક્રીડિત)

યત્સૂક્ષ્મं ચ મહ્ય શૂન્યમણિ યજ્ઞો શૂન્યમુત્પદ્યતે
નશ્યત્યેવ ચ નિત્યમેવ ચ તથા નાસ્ત્યેવ ચાસ્ત્યેવ ચ ।
એકં યદ્યદનેકમેવ તદપિ પ્રાપ્તં પ્રતીતિં દૃઢાં
સિદ્ધજ્યોતિરમૂર્તિ ચિત્સુખમયં કેનાપિ તત્ત્વલક્ષ્યતે ॥૧૩॥

અનુવાદ : જે સિદ્ધજ્યોતિ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, શૂન્ય પણ છે અને પરિપૂર્ણ પણ છે, ઉત્પાદ-વિનાશવાળી પણ છે અને નિત્ય પણ છે, સદ્ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે તથા એક પણ છે અને અનેક પણ છે; એવી તે દેહ પ્રતીતિને પ્રાપ્ત થયેલી અમૂર્તિક, યેતન અને સુખસ્વરૂપ સિદ્ધજ્યોતિ કોઈ વિરલા જ યોગી પુરુષદ્વારા દેખવામાં આવે છે.

વિશેષાર્થ : અહીં જે સિદ્ધજ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતાં અનેક ધર્માથી સંયુક્ત બતાવવામાં આવેલ છે તે વિવક્ષાભેદથી બતાવેલ છે. જેમ કે-તે સિદ્ધજ્યોતિ અતીન્દ્રિય છે માટે જ સૂક્ષ્મ કહેવાય છે. પરંતુ તેમાં અનંતાનંત પદાર્થ પ્રતિભાસે છે તેથી એ અપેક્ષાએ તે સ્થૂળ પણ કહેવાય છે. તે પર (પુદ્ગલાદિ) દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય તથા અનંતચતુષ્ય સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. પર્યાર્થિકનયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી ઉત્પાદ-વિનાશવાળી તથા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે સદ્ભાવ સ્વરૂપ તથા પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાસિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે એવી તે સિદ્ધજ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજ્ઞ જ તેનું ચિંતન કરે છે. ૧૩.

(શાર્ડૂલવિક્રીડિત)

સ્યાચ્છબ્દામૃતગર્ભિતાગમમહારલાકરસ્નાનતો
ધૌતા યસ્ય મતિઃ સ એવ મનુતે તત્ત્વં વિમુક્તાત્મનઃ ।
તત્ત્સ્યૈવ તદેવ યાતિ સુમતેઃ સાક્ષાતુપાદેયતાં
ભેદેન સ્વકૃતેન તેન ચ વિના સ્વં રૂપમેકં પરમ ॥૧૪॥

અનુવાદ : ‘સ્યાત્’ શર્વરૂપ અમૃતથી ગર્ભિત આગમ (અનેકાન્ત સિદ્ધાંત)

રૂપી મહાસમુક્તમાં સ્નાન કરવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે તે જ સિદ્ધ આત્માનું રહસ્ય જાણી શકે છે. તેથી તે જ સુભુદ્ધિ જીવને જ્યાંસુધી પોતાની જાતે કરવામાં આવેલા ભેદ (સંસારી અને મુક્ત સ્વરૂપ) વિદ્યમાન છે, ત્યાં સુધી તે જ સિદ્ધસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) થાય છે. ત્યાર પછી ઉપર્યુક્ત ભેદબુદ્ધ નાણ થઈ જતાં કેવળ એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિભાસિત થાય છે-તે વખતે તે ઉપાદાન-ઉપાદેય ભાવ પણ નાણ થઈ જાય છે.

વિશેષાર્થ : આ ભવ્ય જીવ જ્યારે અનેકાન્તમય પરમાગમનો અભ્યાસ કરે છે ત્યારે તે વિવેકબુદ્ધિ પામીને સિદ્ધાનું યથાર્થ સ્વરૂપ જાણી લે છે. તે વખતે તે પોતાની જાતને કર્મકલંકથી લિપ્ત જાણીને તે જ સિદ્ધસ્વરૂપને ઉપાદેય (ગ્રાણ) માને છે. પરંતુ જેવું તેને સ્વરૂપાચરણ પ્રગટ થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિધ્યક ભેદબુદ્ધિ પણ નાણ થઈ જાય છે-તે વખતે તેને ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનો ભેદ જ રહેતો નથી. ત્યારે તેને સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે. ૧૪.

(શાર્ડૂલવિક્રીડિત)

દાસ્તિસ્તત્ત્વવિદः કરોત્યવિરતં શુદ્ધાત્મરૂપે સ્થિતા
શુદ્ધं તત્પદમેકમુલ્બણમતેરન્યત્ર ચાન્યાદશમ् ।
સ્વર્ણાત્તન્મયમેવ વસ્તુ ઘટિતં લોહાચ્ચ મુક્ત્યર્થિના
મુક્ત્વા મોહવિજૃસ્થિતં નનુ પથા શુદ્ધેન સંચર્યતામ् ॥૧૫॥

અનુવાદ : નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્ત્વજ્ઞ પુરુષની દેષ્ટિ નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને એક માત્ર શુદ્ધ આત્મપદ અર્થાત્ મોક્ષપદને કરે છે. પરંતુ અજ્ઞાની પુરુષની દેષ્ટિ અશુદ્ધ આત્મસ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત થઈને સંસાર વધારે છે. ઠીક છે-સોનામાંથી બનાવાયેલ વસ્તુ (કટક-કુંડળ આદિ) સુવાર્ણમય તથા લોઢામાંથી બનાવાયેલ વસ્તુ (ઇરી આદિ) લોહમય જ હોય છે. તેથી મુમુક્ષુ જીવે મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ-સમૂહને હોડીને શુદ્ધ મોક્ષમાર્ગમાં ચાલવું જોઈએ. ૧૫.

(શાર્ડૂલવિક્રીડિત)

નિર્દોષશ્રુતચક્ષુષા ષડપિ હિ દ્રવ્યાણિ દૃષ્ટવા સુધી-
રાદત્તે વિશદં સ્વમન્યમિલિતં સ્વર્ણ યથા ધાવકઃ ।

અધિકાર-૮ : સિદ્ધસુતિ]

૨૧૩

યઃ કશ્ચિત् કિલ નિશ્ચિનોતિ રહિતઃ શાસ્ત્રેણ તત્ત્વં પરં
સોડન્થો રૂપનિરૂપણં હિ કુરુતે પ્રાપ્તો મનઃશૂન્યતામ् ॥૧૬॥

અનુવાદ : જેવી રીતે સોની તાંબા વગેરેથી ભિશ્ચિત સોનું જોઈને તેમાંથી તાંબા વગેરેને જુદુ કરીને શુદ્ધ સુવર્ણનું ગ્રહણ કરે છે તેવી જ રીતે વિવેકી પુરુષ નિર્દોષ આગમરૂપ નેત્રથી છ યે દ્વયોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્ત્વનું ગ્રહણ કરે છે. જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન (વિવેક) રહિત હોવા છતાં ય રૂપનું અવલોકન કરવા ઈચ્છનાર અંધ સમાન છે. ૧૬.

(શાર્દૂલવિક્રીડિત)

યો હેયેતરખોધસંભૂતમતિર્પુજ્વન् સ હેયં પરં
તત્ત્વં સ્વીકુરુતે તદેવ કથિતં સિદ્ધત્વબીજં જિનૈઃ ।
નાન્યો ભ્રાન્તિગતઃ સ્વતોઽથ પરતો હેયે પરેઽર્થે�સ્ય તદ્
દુષ્ણાપં શુચિ વર્ત્મ યેન પરમં તદ્વામ સંપ્રાપ્યતે ॥૧૭॥

અનુવાદ : જેની બુદ્ધિ હેય અને ઉપાદેય તત્ત્વના શાનથી પરિપૂર્ણ છે તે ભવ્ય જીવ હેય પદાર્થ છોડીને ઉપાદેયભૂત ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે કારણ કે જિનેન્દ્રદેવે તેને જ મુક્તિનું બીજ બતાવ્યું છે. એનાથી વિપરિત જે જીવ હેય અને ઉપાદેય તત્ત્વના વિષયમાં સ્વત: અથવા પરના ઉપદેશથી ભ્રમને પ્રાપ્ત થાય છે, તે ઉક્ત આત્મતત્ત્વનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તેને તે નિર્મળ મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે કે જેના દ્વારા તે ઉત્કૃષ્ટ મોક્ષપદ પ્રાપ્ત કરાય છે. ૧૭.

(શાર્દૂલવિક્રીડિત)

સાઙ્ગોપાઙ્ગમપિ શ્રુતં બહુતરં સિદ્ધત્વનિષ્પત્તયે
યે ઽન્યાર્થ પરિકલ્પયન્તિ ખલુ તે નિર્વાણમાર્ગચુતાઃ ।
માર્ગ ચિન્તયતો ઽન્યેન તમતિક્રમ્યાપરેણ સ્ફુર્ત
નિઃશેષં શ્રુતમેતિ તત્ત્વ વિપુલે સાક્ષાદ્વિચારે સતિ ॥૧૮॥

અનુવાદ : અંગો અને ઉપાંગો સહિત પુષ્ટ શ્રુત (આગમ) મુક્તિની પ્રાપ્તિનું સાધન છે. જે જીવ તે શ્રુતની અન્ય સાંસારિક પ્રયોજનો માટે કલ્પના કરે છે તેઓ ખરેખર

મોક્ષમાર્ગથી ભાગ છે. તેનું અતિક્રમણ કરીને (અન્ય સાંસારિક પ્રયોજનો છોડીને) અપર અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા (પરંપરાગત દ્રવ્યશ્રુત વડે) જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતાં, સમસ્ત શ્રુત સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. ૧૮.

(શાર્દૂલવિક્રીદિત)

**નિઃશેષશ્રુતસંપદः શમનિધેરારાધનાયાઃ ફળं
પ્રાપ્તાનાં વિષયે સદૈવ સુખિનામલ્પૈવ મુક્તાત્મનામ् ।
ઉત્કા ભક્તિવશાન્મયાધ્યવિદુષા યા સાપિ ગીઃ સાંપ્રતં
નિઃશ્રેणિર્ભવતાદનન્તસુખતદ્વામારુરુક્ષોર્મમ ॥૧૯॥**

અનુવાદ : જે સમસ્ત શ્રુતરૂપ સંપત્તિ સહિત અને શાંતિના સ્થાનભૂત એવા આત્મતત્ત્વની આરાધનાના ફળને પ્રાપ્ત થઈને શાશ્વત સુખ પામી ચુક્યા છે એવા તે મુક્તાત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજો જે ભક્તિવશે થોડું કાંઈક કથન કર્યું છે તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઈચ્છા કરનાર એવા મારા માટે નિસરણી સમાન થાય. ૧૮.

(શાર્દૂલવિક્રીદિત)

**વિશ્વં પશ્યતિ વેત્તિ શર્મ લભતે સ્વોત્પત્રમાત્યન્તિકં
નાશોત્પત્તિયુતં તથાધ્યવિચલં મુક્તર્થિનાં માનસે ।
એકીભૂતમિદં વસત્યવિરતં સંસારભારોજ્જિતં
શાન્તં જીવઘન દ્વિતીયરહિતં મુક્તાત્મરૂપં મહઃ ॥૨૦॥**

અનુવાદ : આ સિદ્ધાત્મારૂપ તેજ વિશ્વને દેખે અને જાણો છે, માત્ર આત્માથી ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે, નાશ અને ઉત્પાદ યુક્ત હોવા છતાં પણ નિશ્ચળ (ધ્રુવ) છે, મુમુક્ષુઓના હદ્યમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, સંસારના ભારરહિત છે, શાન્ત છે, સઘન આત્મપ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. ૨૦

(શાર્દૂલવિક્રીદિત)

**ત્વક્ત્વાન્યાસનયપ્રમાણવિવૃતીઃ સર્વ પુનઃ કારકં
સંબન્ધં ચ તથા ત્વમિત્યહમિતિ પ્રાયાન્ વિકલ્પાનપિ ।**

સર્વોપાધિવિવર્જિતાત્મનિ પરં શુદ્ધેકબોધાત્મનિ
સ્થિત્વા સિદ્ધિમુપાશ્રિતો વિજયતે સિદ્ધઃ સમૃદ્ધો ગુણૈः ॥૨૧॥

અનુવાદ : જે નિક્ષેપ, નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા વિવરણો, કર્તા આદિ સમસ્ત કારકો, કારક અને ક્રિયા આદિના સંબંધ, તથા ‘તમે’ અને ‘હું’ ઈત્યાદિ વિકલ્પાને પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ તથા સમસ્ત ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈને સિદ્ધિ પામ્યા છે એવા તે અનંત જ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી જ્યવંત હો. ૨૧.

(શાર્દૂલવિક્રીડિત)

તૈરેવ પ્રતિપદ્યતે�ત્ત્ર રમણીસ્વર્ણાદિવસ્તુ પ્રિય
તત્સિદ્ધૈકમહઃ સદન્તરદ્વશા મન્દૈરન યૈર્દ્યયતે ।
યે તત્ત્વરસપ્રભિન્નહદ્યાસ્તેષામશેષં પુનઃ
સામ્રાજ્યં તૃણવદ્ધપુશ્ચ પરવદ્ધોગાશ્ચ રોગ ઇવ ॥૨૨॥

અનુવાદ : સંસારમાં જે મૂર્ખ જીવો ઉત્તમ અભ્યંતર નેત્ર (જ્ઞાન) થી તે સમીયીન સિદ્ધાત્મારૂપ અદ્વિતીય તેજને દેખતા નથી તેઓ જ અહીં ખી અને સુવર્ણ આદિ વસ્તુઓને પ્રિય માને છે. પરંતુ જેમનું હૃદય તે સિદ્ધાત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ ગયું છે તેમને સમસ્ત સામ્રાજ્ય (ચક્રવર્તિપણું) તૃણ સમાન તુચ્છ લાગે છે, શરીર બીજા જેવું (અથવા શત્રુ જેવું) પ્રતિભાસે છે, તથા ભોગ રોગ સમાન જણાય છે. ૨૨.

(શાર્દૂલવિક્રીડિત)

વન્દ્યાસ્તે ગુણિનસ્ત એવ ભુવને ધન્યાસ્ત એવ ધ્રુવં
સિદ્ધાનાં સ્મૃતિગોচરં રુचિવશાન્તામાપિ યૈર્નીયતે ।
યે ધ્યાયન્તિ પુનઃ પ્રશસ્તમનસસ્તાન્ દુર્ગભૂભૂદરી-
મધ્યસ્થાઃ સ્થિરનાસિકાગ્રિમહશસ્તેષાં કિમુ બ્રૂમહે ॥૨૩॥

અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે છે તે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે, તેઓ જ ગુણવાન છે અને તેઓ જ પ્રશંસા યોગ્ય છે. તો પછી જે સાધુજ્ઞનો દુર્ગ (દુર્ગમ સ્થાન) અથવા પર્વતની ગુઝની મધ્યમાં સ્થિત રહીને અને નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી

તે સિદ્ધોનું ધ્યાન કરે છે તેમના વિષયમાં અમે શું કહીએ? અર્થાત् તેઓ તો અતિશય ગુણવાન અને વંદનીય છે જ. ૨૩.

(શાર્દૂલવિક્રીડિત)

ય: સિદ્ધે પરમાત્મનિ પ્રવિતતજ્ઞાનૈકમૂર્તૌ કિલ
જ્ઞાની નિશ્ચયતઃ સ એવ સકળપ્રજ્ઞાવતામગ્રણી: ।
તર્કવ્યાકરણાદિશાસ્ત્રસહિતૈ: કિં તત્ત્વ શૂન્યૈર્યતો
યદોગં વિદ્ધાતિ વેધ્યવિષયે તદ્વાણમાવર્ણતે ॥૨૪॥

અનુવાદ : જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત શાનદાર અદ્વિતીય શરીરના ધારક સિદ્ધ પરમાત્માના વિષયમાં શાનવાનું છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. પરંતુ જે સિદ્ધાત્મવિષયક શાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે.

વિશોધાર્થ : જે બાણ પોતાના લક્ષ્યને વીધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે, પણ જે બાણ પોતાનું લક્ષ્ય વીધવામાં અસર્મથ રહે છે તે વાસ્તવમાં બાણ કહેવરાવવાને યોગ્ય નથી. એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોનાં પ્રકંડ વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિન્દાને પાત્ર છે. કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ બાર અંગના પાઠી હોવા છતાં પણ અભવ્યસેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનાથી વિપરીત શિવભૂતિ (ભાવ-પ્રાભૃત-પર-પત) મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ તુષ્પ-માષ સમાન આત્મપરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. ૨૪.

(શાર્દૂલવિક્રીડિત)

સિદ્ધાત્મા પરમ: પરં પ્રવિલસદ્બોધ: પ્રબુદ્ધાત્મના
યેનાજ્ઞાયિ સ કિં કરોતિ બહુભિઃ શાસ્ત્રૈર્બહિર્વાચકૈ: ।
યસ્ય પ્રોદ્ધતરોચિરુજ્વલતનુર્ભાનુઃ કરસ્થો ભવેત્
ધ્વાન્તધંસવિધૌ સ કિં મૃગયતે રત્નપ્રદીપાદિકાનુ ॥૨૫॥

અનુવાદ : જે વિવેકી પુરુષે સમ્યગ્જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું

પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તે બાબ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી શું કરે? અર્થાત્ તેને આમનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે-જેના હાથમાં કિરણોના ઉદ્યથી સંયુક્ત ઉજ્જવળ શરીરવાળો સૂર્ય સ્થિત રહે છે તે શું અંધકારને નષ્ટ કરવા માટે રત્ના દીપક આદિ ગોતે છે? અર્થાત્ ગોતતા નથી. ૨૫.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વત્ર ચ્યુતકર્મબન્ધનતયા સર્વત્ર સદ્રશના:
સર્વત્રાખિલવસ્તુજાતવિષયવ્યાસત્કોધત્વિષઃ ।
સર્વત્ર સ્ફુરદુન્તોન્ત્રતસદાનન્દાત્મકા નિશ્ચલા:
સર્વત્રૈવ નિરાકુલાઃ શિવસુખં સિદ્ધાઃ પ્રયચ્છન્તુ નઃ ॥૨૬॥

અનુવાદ : જે સિદ્ધ જીવ સમસ્ત આત્મપ્રદેશોમાં કર્મબંધનથી રહિત થઈ જવાને કારણે સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત સમીયીન દર્શન સહિત છે, જેમની સમસ્ત વસ્તુઓને વિષય કરનારી જ્ઞાનજ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે અર્થાત્ જે સર્વજ્ઞ થઈ ગયા છે. જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખસ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ નિરાકુણ છે. આવા તે સિદ્ધ અમને મોક્ષસુખ પ્રદાન કરો. ૨૬.

(શાર્દૂલવિક્રીડિત)

આત્મોત્તુઙ્ગગૃહં પ્રસિદ્ધ બહિરાદ્યાત્મપ્રભેદક્ષણ
બહ્વાત્માધ્યવસાનસંગતલસત્સોપાનશોભાન્વિતમ् ।
તત્ત્રાત્મા વિભુરાત્મનાત્મસુહૃદો હસ્તાવલમ્બી સમા-
રુહ્યાનન્દકલત્રસંગતભુવં સિદ્ધઃ સદા મોદતે ॥૨૭॥

અનુવાદ : જે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદોરૂપ ખંડો (માળ) થી સહિત તથા આત્માના પરિણામોરૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા સંયુક્ત છે તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મારૂપ રાજા આનંદરૂપ ખીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચઢીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે.

વિશેષાર્થ : જેમ અનેક સીડીઓથી સુશોભિત પાંચ સાત માળવાળા ભવનમાં મનુષ્ય કોઈ મિત્રના હાથનો સહારો લઈને તે સીડીઓના આશ્રયે અનાયાસે જ ઉપર અભીષ્ટ સ્થાનમાં પહોંચીને આનંદ પામે છે. તેવી જ રીતે આ જીવ અધઃપ્રવૃત્તકરણાદિ પરિણામોરૂપ સીડીઓ ઉપરથી

બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપ પત્ર ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને (આત્મલીન થઈને) શાશ્વત સુખ સંયુક્ત તે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે. ૨૭.

(શાર્દૂલવિક્રીડિત)

સैવૈકા સુગતિસ્તદેવ ચ સુખં તે એવ દ્વારોધને
સિદ્ધાનામપરં યદસ્તિ સકલં તન્મે પ્રિયં નેતરત્તુ ।
ઇત્યાલોચ્ય દઢં ત એવ ચ મયા ચિત્તે ધૃતાઃ સર્વદા
તદૂપં પરમં પ્રયાતુમનસા હિત્વા ભવં ભીષણમ् ॥૨૮॥

અનુવાદ : સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. તેમનું જે સુખ છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમનાં જે જ્ઞાન-દર્શન છે તે જ યથાર્થ જ્ઞાનદર્શન છે તથા બીજું પત્ર જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. એના સિવાય બીજું કાંઈ પત્ર મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતાં મેં ભ્યાનક સંસાર છોડીને અને તે સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ દેખતા પૂર્વક ધારણા કર્યા છે. ૨૮.

(શાર્દૂલવિક્રીડિત)

તે સિદ્ધાઃ પરમેષ્ઠિનો ન વિષયા વાચામતસ્તાનુ પ્રતિ.
પ્રાયો વચ્ચિ યદેવ તત્ખલુ નભસ્યાલેખ્યમાલિખ્યતે ।
તત્ત્વામાપિ મુદે સ્મૃતં તત ઇતો ભક્ત્યાથ વાચાલિત-
સ્તેષાં સ્તોત્રમિદં તથાપિ કૃતવાનમ્ભોજનન્દી મુનિઃ ॥૨૯॥

અનુવાદ : તે સિદ્ધ પરમેષ્ઠી વચ્ચનોના વિષય નથી તેથી જ ધણું કરીને તેમના લક્ષ્યે જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. છતાં પત્ર તેમના નામમાત્રનું સ્મરણોય આનંદ ઉત્પન્ન કરે છે, તેથી ભક્તિવિશે વાચાળ થઈને મેં-પદ્ધનંદી મુનિએ-તેમનું આ સ્તોત્ર કર્યું છે. ૨૯.

આ રીતે સિદ્ધસુતિ સમાપ્ત થઈ. ૮.



૬. આલોચના

[૧. આલોચના]

(શાર્ડૂલવિક્રીડિત)

યદ્યાનન્દનિધિં ભવન્તમમલં તત્વं મનો ગાહતે સિદ્ધસ્તુતિઃ
ત્વન્નમસ્મૃતિલક્ષણો યદિ મહામન્ત્રો ઽસ્ત્યનન્તપ્રભઃ ।
યાનં ચ ત્રિત્યાત્મકે યદિ ભવેન્માર્ગે ભવદ્વર્ષિતે
કો લોકે�ત્ર સત્તામભીષ્ટવિષયે વિદ્ધો જિનેશ પ્રભો ॥૧॥

અનુવાદ : હે જિનેન્દ્રદેવ! જો સજ્જનોનું મન આનંદના સ્થાનભૂત આપના નિર્મળ સ્વરૂપનું અવગાહન કરે છે, જો અનંત દીપિ સંપન્ન આપના નામ સ્મરણરૂપ મહામંત્ર પાસે છે અને જો આપના દ્વારા બતાવવામાં આવેલ રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગમાં ગમન છે; તો પછી અહીં લોકમાં તે સજ્જનોને પોતાના ઈષ્ટ વિષયમાં વિધન કર્યું હોઈ શકે? અર્થાતુ તેમને ઈષ્ટ વિષયમાં કોઈ બાધા ઉપસ્થિત થતી નથી. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

નિઃસંગત્વમરાગિતાથ સમતા કર્મક્ષયો બોધનં
વિશ્વબ્યાપિ સમં દૃશા તદતુલાનન્દેન વીર્યેણ ચ ।
ઈદ્વદેવ તવૈવ સંસૃતિ પરિત્યાગાય જાતઃ ક્રમઃ
શુદ્ધસ્તેન સદા ભવચ્ચરણયોઃ સેવા સતાં સંમતા ॥૨॥

અનુવાદ : હે દેવ! પરિગ્રહત્યાગ, વીતરાગતા, સમતા, કર્મનો ક્ષય, ક્રેવળદર્શન સહિત સમસ્ત પદાર્થોને એક સાથે વિષય કરનારું જ્ઞાન (ક્રેવળજ્ઞાન), અનંત સુખ અને અનંતવીર્ય; આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત

થવા માટે આપની જ થયેલી છે. તેથી સજજનોને સદા આપના ચરણોની આરાધના ઈષ્ટ છે. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

યદેતસ્ય દ્વા મમ સ્થિતિરભૂત્વત્સેવયા નિશ્ચિતં
તૈલોક્યેશ બલીયસોऽપિ હિ કુતઃ સંસારશત્રોર્ભયમ् ।
પ્રાપ્તસ્યામृતવર્ષહર્ષજનકं સદ્યન્ત્રધારાગૃહં
પુંસઃ કિં કુરુતે શુચૌ ખરતરો મધ્યાહ્નકાલાતપઃ ॥૩॥

અનુવાદ : હે ત્રિલોકીનાથ! જો આપની આરાધનાથી નિશ્ચયથી મારી એવી દૃઢ સ્થિતિ થઈ ગઈ છે તો પછી મને અતિશય બળવાનું સંસારરૂપ શત્રુથી પણ ભય કેમ હોય? અર્થાત્ ન હોય. ઠીક છે—અમૃતવર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ કુવારા યુક્ત ગૃહને પ્રાપ્ત થયેલ પુરુષને શું શ્રીષ્ય ઋતુમાં મધ્યાહ્નકાલીન સૂર્યનો અત્યંત તીક્ષ્ણ સંતાપ પણ શું દુઃખી કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

ય: કશ્ચિત્ત્રિપુણો જગત્વયગતાનર્થાનશેષાંશ્ચિરં
સારાસારાવિવેચનૈકમનસા મીમાંસતે નિસ્તુષ્ટમ् ।
તસ્ય ત્વં પરમેક એવ ભગવનું સારો દ્વાસારં પરં
સર્વ મે ભવદાશ્રિતસ્ય મહતી તેનાભવત્ત્રિવૃત્તિઃ ॥૪॥

અનુવાદ : હે ભગવાન! જે કોઈ ચતુર પુરુષ સાર અને અસાર પદાર્થોનું વિવેચન કરનાર અસાધારણ મન દ્વારા નિર્દોષ રીતે ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો ધણા કાળ સુધી વિચાર કરે છે તેને કેવળ એક આપ જ સારભૂત અને અન્ય સર્વ અસારભૂત છે તેથી આપના શરણો આવેલા મને મહાનું આનંદ પ્રાપ્ત થાય છે. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

જ્ઞાનं દર્શનમપ્યશેષવિષયં સૌખ્યં તથાત્યન્તિકં
વીર્ય ચ પ્રભુતા ચ નિર્મલતરા રૂપં સ્વકીયં તવ ।
સમ્યગ્યોગદૃશા જિનેશ્વર ચિરાત્તેનોપલબ્ધે ત્વયિ
જ્ઞાતં કિં ન વિલોકિતં ન કિમથ પ્રાપ્તં ન કિં યોગિભિઃ ॥૫॥

અનુવાદ : હે જિનેશ્વર! આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય કરનાર છે, આપનાં સુખ અને વીર્ય અનંત છે, તથા આપનું પ્રભુત્વ અતિશય નિર્મળ છે; આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે. તેથી જે યોગીજનોએ સમ્યક્ ધ્યાનરૂપ નેત્ર દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું? શું નથી જોયું, અને શું નથી પ્રાપ્ત કરી લીધું? અર્થાત્ એક માત્ર આપને જાણી લેવાથી તેમણે બધું જ જાણી લીધું, ટેઝી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

ત્વામેકં ત્રિજગત્પતિं પરમહં મન્યે જિનં સ્વામિનં
ત્વામેકં પ્રણમામિ ચેતસિ દધે સેવે સ્તુવે સર્વદા ।
ત્વામેકં શરણં ગતોऽસ્મિ બહુના પ્રોક્તેન કિંચિદ્ગ્રવે-
દિત્થં તત્ત્વવતુ પ્રયોજનમતો નાન્યેન મે કેનચિત્ ॥૬॥

અનુવાદ : હું એક આપને જ ત્રણે લોકના સ્વામી, ઉત્કૃષ્ટ, જિન અને પ્રભુ માનું છું. હું એક આપને જ સર્વદા નમસ્કાર કરું છું, આપને જ ચિત્તમાં ધારણ કરું છું, આપની જ સેવા કરું છું, આપની જ સ્તુતિ કરું છું, તથા એક આપના જ શરણને પ્રાપ્ત થયો છું. ધારું કહેવાથી શું લાભ? આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું હોય તે થાવ. મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. ૬.

(શાર્ડૂલવિક્રીડિત)

પાપં કારિતવાન् યદત્ર કૃતવાનન્યૈ: કૃતં સાધ્વિતિ
ભ્રાન્ત્યાહં પ્રતિપત્રવાંશ મનસા વાચા ચ કાયેન ચ ।
કાલે સંપ્રતિ યજ્ઞ ભાવિનિ નવસ્થાનોદ્ઘતં યત્યુન-
સ્તન્મિથ્યાખિલમસ્તુ મે જિનપતે સ્વં નિન્દતસ્તે પુરઃ ॥૭॥

અનુવાદ : હે જિનેન્દ્રદેવ! મન, વચન અને કાયાથી મેં અહીં જે કાંઈ પણ અજ્ઞાનવશે પાપ કર્યું હોય, અન્ય દ્વારા કરાવ્યું હોય અને બીજાઓ દ્વારા કરાતાં ‘સારું કર્યું’; એમ સ્વીકાર કર્યો હોય અર્થાત્ અનુમોદના કરી હોય; એ ઉપરાંત આ જ નવ સ્થાનો (૧ મનકૃત, ૨ મન કારિત, ૩ મન અનુમોદિત, ૪ વચનકૃત, ૫ વચનકારિત, ૬ વચનાનુમોદિત, ૭ કાયકૃત, ૮ કાયકારિત અને કાયાનુમોદિત) દ્વારા બીજા પણ

જે પાપ વર્તમાનકાળમાં કરી રહ્યો છું, અને ભવિષ્યકાળમાં કરીશ તે સર્વ મારા પાપ આપની સામે આત્મનિંદા કરવાથી મિથ્યા થાવ. ૭.

(શાર્દૂલવિક્રીડિત)

લોકાલોકમનન્તપર્યયુતં કાલત્રયીગોચરં
ત્વં જાનાસિ જિનેન્દ્ર પશ્યસિ તરાં શશ્વત્સમં સર્વતઃ ।
સ્વામિન્ન વેત્સિ મમૈકજન્મજનિતં દોષં ન કિંચિત્કુતો
હેતોસ્તે પુરતઃ સ વાચ્ય ઇતિ મે શુદ્ધ્યર્થમાલોચિતમ્ ॥૮॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપ ત્રિકાળવર્તી અનંત પર્યાયો સહિત લોક અને અલોકને સદા સર્વ તરફથી યુગપત્ર જાણો અને દેખો છો. તો પછી હે સ્વામી! આપ મારા એક જન્મમાં ઉત્પન્ન દોષોને ક્યા કારણે નથી જાણતા? અર્થાત્ અવશ્ય જાણો છો. છતાં પણ હું આલોચના પૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ કરું છું. ૮.

(શાર્દૂલવિક્રીડિત)

આશ્રિત્ય વ્યવહારમાર્ગમથવા મૂલોત્તરાખ્યાન् ગુણાન्
સાધોર્ધારયતો મમ સ્મृતિપથપ્રસ્થાયિ યદ્રદૂષણમ् ।
શુદ્ધ્યર્થ તદપિ પ્રભો તવ પુરઃ સર્જોऽહમાલોચિતું
નિઃશલ્યં હૃદયં વિધેયમજડૈર્ભવૈર્યતઃ સર્વથા ॥૯॥

અનુવાદ : વ્યવહાર માર્ગનો આશ્રય કરીને અથવા મૂળ અને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂધણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ માટે હે પ્રભો ! હું આપની પાસે આલોચના કરવા માટે ઉધત થયો છું. કારણ એ છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્યરહિત કરવું જોઈએ. ૯.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વો ઽષ્ટત્ર મુહુર્હર્જિનપતે લોકેરસંખૈર્મિત-
વ્યક્તાવ્યક્તવિકલ્પજાલકલિતઃ પ્રાણી ભવેત્ર સંસ્તૂતૌ ।

તત્ત્વાવદ્ધિરયં સદૈવ નિચિતો દોષેર્વિકલ્પાનુગૈ:
પ્રાયશ્રિત્તમિયત્ત કુતઃ શ્રુતગતં શુદ્ધિર્ભવત્તસંનિધે: ॥૧૦॥

અનુવાદ : હે જિનેન્દ્રદેવ! અહીં સંસારમાં સર્વ પ્રાણી વારંવાર અસંખ્યાત લોકપ્રમાણ સ્પષ્ટ અને અસ્પષ્ટ વિકલ્પોના સમૂહથી સંયુક્ત હોય છે. તથા ઉક્ત વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર એટલા (અસંખ્યાત લોક પ્રમાણ) જ દોષોથી વ્યાપ્ત હોય છે. આટલું પ્રાયશ્રિત ભલા, આગમપ્રમાણે ક્યાંથી થઈ શકે? અર્થાત્ થઈ શકતું નથી. માટે તે દોષોની શુદ્ધિ આપની નિકટતા અથવા આરાધનાથી થાય છે. ૧૦.

(શાર્ડૂલવિક્રીડિત)

ભાવાન્તઃકરણેન્દ્રિયાણિ વિધિવત્તસંહત્ય બાહ્યાશ્રયા-
દેકીકૃત્ય પુનર્સ્ત્વયા સહ શુચિજ્ઞાનેકસનૂર્તિના ।
નિઃસંગઃ શ્રુતસારસંગતમતિઃ શાન્તો રહઃ પ્રાત્તવાન્
યસ્ત્વાં દેવ સમીક્ષતે સ લભતે ધન્યો ભવત્તસંનિધિમ् ॥૧૧॥

અનુવાદ : હે દેવ! જે ભવ્ય જીવ ભાવમન અને ભાવેન્દ્રિયોને નિયમાનુસાર બાહ્ય વસ્તુઓ તરફથી ખસેડીને તથા નિર્મળ અને શાનદાર અદ્વિતીય ઉત્તમ મૂર્તિના ધારક આપની સાથે એકમેક કરીને પરિગ્રહરહિત, આગમના રહસ્યના શાંતા, શાન્ત અને એકાન્ત સ્થાનને પ્રાપ્ત થતા થકા આપને દેખે છે તે પ્રશંસનીય છે. તે જ આપની સમીપતા પ્રાપ્ત કરે છે. ૧૧.

(શાર્ડૂલવિક્રીડિત)

ત્વામાસાદ્ય પુરા કૃતેન મહતા પુણ્યેન પૂજ્યં પ્રભું
ब्रह्माद्यैरपि यत्पदं न सुलभं तल्लभ्यते निश्चितम् ।
અહંનાથ પરं કરોમિ કિમહં ચેતો ભવત્તસંનિધા-
વદ્યાપિ શ્રિયમાણમણ્યતિતરામેતદ્વાહિર્ધાવતિ ॥૧૨॥

અનુવાદ : હે અર્હત્ત દેવ! પૂર્વકૃત મહાન् પુણ્યના ઉદ્યથી પૂજવાને યોગ્ય આપ જેવા સ્વામીને પામીને જે પદ બ્રહ્મા આદિને માટે પણ દુર્લભ છે તે નિશ્ચિતપણે

પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે નાથ! હું શું કરું? આપની સમીપમાં બળપૂર્વક લગાવવા છતાં પણ આ ચિત્ત હજુ યે બાધ્ય પદાર્થો તરફ દોડે છે. ૧૨.

(શાર્દૂલવિક્રીડિત)

સંસારો બહુદુઃखદઃ સુખપદં નિર્વાણમેતત્કૃતે
ત્યક્ત્વાર્થાદિ તપોવનં વયમિતાસ્તત્રોજ્ઞિતઃ સંશયઃ ।
એતસ્માદપિ દુષ્કરત્વતિધેર્નાયાપિ સિદ્ધિર્યતો
વાતાલીતરલીકૃતં દલમિવ ભ્રાસ્યત્યદો માનસમ् ॥૧૩॥

અનુવાદ : સંસાર બહુ દુઃખદાયક છે, પરંતુ મોક્ષ સુખનું સ્થાન છે. આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અમે ધન-સંપત્તિ આદિ છોડીને તપોવનમાં આવ્યા છીએ અને તેના વિષયમાં અમે સર્વ પ્રકારનો સંદેહ પણ છોડી દીધો છે. પરંતુ આ કઠિન વ્રતવિધાનથી પણ હજુ સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એનું કારણ એ છે કે વાયુસમૂહ દ્વારા ચંચળ કરવામાં આવેલા પાંડા સમાન આ મન ભ્રમિત થઈ રહ્યું છે. ૧૩.

(શાર્દૂલવિક્રીડિત)

જ્ઞાન્યાઃ કુર્વદિતસ્તતઃ પરિલસદ્વાહ્યાર્થલાભાદ-
નિત્યં વ્યાકુલતાં પરાં ગતવતઃ કાર્ય વિનાયાત્મનઃ ।
ગ્રામં વાસયદિન્દ્રિયં ભવકૃતો દૂરં સુહૃત્ત કર્મણઃ
ક્ષેમં તાવદિહાસ્તિ કુત્ર યમિનો યાવન્મનો જીવતિ ॥૧૪॥

અનુવાદ : જે મન આમતેમ ભટક્યા કરે છે, બાધ્ય પદાર્થોની પ્રાપ્તિથી હર્ષ પામે છે, કોઈ પણ પ્રયોજન વિના નિરંતર જ્ઞાનમય આત્માને અતિશય વ્યાકુળ કરે છે, ઈન્દ્રિય સમૂહને વસાવે છે તથા સંસારના કારણભૂત કર્મનો પરમ ભિત્ર છે; એવું તે મન જ્યાં સુધી જીવિત છે ત્યાંસુધી અહીં સંયમીનું કલ્યાણ કર્યાણ થઈ શકે? અર્થાત્ થઈ શકતું નથી.

વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જ્યાંસુધી મન શાન્ત થતું નથી ત્યાંસુધી સંયમનું પરિપાલન કરવા છતાં પણ કદી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. કારણ એ છે કે મનની અસ્થિરતાથી બાધ્ય ઈષ્ટાનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષની પ્રવૃત્તિ બની રહે છે અને જ્યાં સુધી રાગ-દ્વેષનું પરિણામન છે ત્યાંસુધી કર્મનો બંધ પણ અનિવાર્ય છે. તથા જ્યાંસુધી નવા નવા કર્મનો બંધ

થતો રહે ત્યાંસુધી દુઃખમય આ જન્મ-મરણરૂપ સંસારની પરંપરા પણ ચાલુ જ રહે છે. આ હાલતમાં આત્માને કદી શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મકલ્યાણની ઈચ્છા કરનાર ભવ્ય જીવોએ સૌથી પહેલાં પોતાનું ચંચળ મન વશ કરવું જોઈએ. મન વશ થતાં તેના ઈશારે ચાલતી ઈન્દ્રિયો સ્વયમેવ વશ થઈ જાય છે. તો એવી અવસ્થામાં બન્ધનો અભાવ થઈ જવાથી મોક્ષ પણ કાંઈ દૂર રહેતો નથી. ૧૪.

(શાર્દૂલવિક્રીડિત)

નૂનं મृત્યુભૂપैતि યાતમમતં ત્વાં શુદ્ધબોધાત્મકં
ત્વતસ્તેન બહિર્ભર્મત્યવિરતં ચેતો વિકલ્પાકુલમ् ।
સ્વામિન् કિં ક્રિયતે ઽત્ર મોહવશતો મૃત્યોર્ન ભીઃ કર્ય તત્
સર્વાનર્થપરંપરાકૃદહિતો મોહઃ સ મે વાર્યતામ् ॥૧૫॥

અનુવાદ : હે સ્વામિન्! આ ચિત્ત નિર્મળ અને શુદ્ધચૈતન્યરૂપ આપને પ્રાપ્ત થયું થકું નિશ્ચયથી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તે વિકલ્પોથી વ્યાકુળ થતું થકું આપના તરફથી ખસીને નિરંતર બાહ્ય પદાર્થોમાં પરિભ્રમણ કરે છે. શું કરીએ? મોહના વશે અહીં મૃત્યુનો ભય ભલા કોને નથી હોતો? અર્થાત્ તેનો ભય ઘણું કરીને બધાને હોય છે. તેથી હે પ્રત્ભો! સમસ્ત અનર્થોની પરંપરાના કારણભૂત મારા આ મોહરૂપ શત્રુનું નિવારણ કરો. ૧૫.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વેષામપિ કર્મણામતિતરાં મોહો બલીયાનસૌ
ધત્તે ચञ્ચલતાં બિભેતિ ચ મૃતેસ્તસ્ય પ્રભાવાન્મનઃ ।
નો ચેઝીવતિ કો મ્રિયેત ક ઇહ દ્રવ્યત્વતઃ સર્વદા
નાનાત્વં જગતો જિનેન્દ્ર ભવતા દૃષ્ટં પરં પર્યૈઃ ॥૧૬॥

અનુવાદ : બધા કર્મોમાં તે મોહ અતિશય બળવાન છે. તેના જ પ્રભાવથી મન ચપળતા ધારણ કરે છે અને મૃત્યુથી ડરે છે. જો એમ ન હોત તો પછી સંસારમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ જીવે છે અને કોણ મરે છે? હે જિનેન્દ્ર! આપે ફક્ત પર્યાયોની અપેક્ષાએ જ સંસારની વિવિધતા જોઈ છે.

વિશેષાર્થ : જો નિશ્ચયનયથી વિચાર કરવામાં આવે તો શુદ્ધ ચૈતન્યરૂપ આ આત્મા

અનાદિ-નિધન છે. તેનો ન કદી જન્મ થાય છે અને ન કદી મરણ. તેના જન્મ-મરણની કલ્પના વ્યવહારી જન પર્યાયની પ્રધાનતાથી કેવળ મોહના નિભિતે કરે છે. જેનો તે મોહ નાચ થઈ જાય છે તેનું મન ચપળતા છોડીને સ્થિર થઈ જાય છે. તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે તેને યથાર્થ આત્મસ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે અને ત્યારે તે તરત જ પરમાનંદભય અવિનશ્બર પદને પ્રાપ્ત કરી લે છે. ૧૬.

(શાર્દૂલવિક્રીડિત)

વાતવ્યાસમુક્તવારિલહરીસંઘાતવત્સર્વદા
સર્વત્ર ક્ષણભડ્ગુરં જગદિદં સંચિન્ત્ય ચેતો મમ ॥
સંપ્રત્યેતદશેષજન્મજનકવ્યાપારપારસ્થિતં
સ્થાતું વાજ્ઞતિ નિર્વિકારપરમાનન્દે ત્વયિ બ્રહ્મણિ ॥૧૭॥

અનુવાદ : આ વિશ્વ વાયુથી તાડિત થયેલા સમુક્તના જળમાં ઉત્પન્ન થતી લહેરોના સમૂહ સમાન સદા અને સર્વત્ર ક્ષણનશ્બર છે, એવો વિચાર કરીને આ મારું મન અત્યારે જન્મ-મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર પહોંચીને અર્થાત્ આવી ક્રિયાઓ છોડીને નિર્વિકાર અને પરમાનંદસ્વરૂપ આપ પરમાત્મામાં સ્થિત થવાની ઈચ્છા કરે છે. ૧૭.

(શાર્દૂલવિક્રીડિત)

એનઃ સ્યાદશુભોપયોગત ઇતઃ પ્રાપ્નોતિ દુઃખં જનો
ધર્મઃ સ્યાચ્ચ શુભોપયોગત ઇતઃ સૌખ્યં કિમષ્યાશ્રયેત् ।
દ્વન્દ્વં દ્વન્દ્વમિદં ભવાશ્રયતયા શુદ્ધોપયોગાત્યુન-
ર્નિત્યાનન્દપદં તદત્ત્ર ચ ભવાનહ્નહં તત્ત્ર ચ ॥૧૮॥

અનુવાદ : અશુભ ઉપયોગથી પાપ ઉત્પન્ન થાય છે અને એનાથી પ્રાણી દુઃખ પ્રાપ્ત કરે છે તથા શુભ ઉપયોગથી ધર્મ થાય છે અને એનાથી પ્રાણી કોઈ વિશેષ સુખ પ્રાપ્ત કરે છે. સુખ અને દુઃખનું આ કલહકારી જોડું સંસારની સહાયથી ચાલે છે. પરંતુ એનાથી વિપરીત શુદ્ધ ઉપયોગથી તે શાશ્વત સુખનું સ્થાન અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થાય છે. હે અરહંત જિન! આ પદ (મોક્ષ)માં તો આપ સ્થિત છો અને હું તે પદમાં અર્થાત્ શાતા, અશાતા વેદનીયજનિત ક્ષણિક સુખ-દુઃખના સ્થાનભૂત સંસારમાં સ્થિત છું. ૧૮.

(શાર્ડોલવિક્રીડિત)

યજ્ઞાન્તરન બહિ: સ્થિતં ન ચ દિશિ સ્થૂલં ન સૂક્ષ્મં પુમાનુ
નૈવ સ્ત્રી ન નપુંસકં ન ગુરુતાં પ્રાપ્તં ન યલ્લાઘવમુ ।
કર્મસ્પર્શશરીરસગન્ધગણનાવ્યાહારવર્ણોજ્ઞિતં
સ્વચ્છજ્ઞાનદ્વારેકમૂર્તિ તદહં જ્યોતિઃ પરં નાપરમુ ॥૧૯॥

અનુવાદ : જે ઉત્કૃષ્ટ જ્યોતિ (ચૈતન્ય) ન તો અંદર સ્થિત છે અને ન બહાર સ્થિત છે, જે દિશાવિશેષમાં સ્થિત નથી, જે ન સ્થૂળ છે અને ન સૂક્ષ્મ છે; જે ન પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુંસક છે; જે ન ગુરુતાને પ્રાપ્ત છે અને ન લધુતાને પ્રાપ્ત છે; જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણાના, શબ્દ અને વર્ણરહિત છે; તથા જે નિર્મળ જ્ઞાન અને દર્શાનની મૂર્તિ છે; તે જ ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું-એનાથી બિન્ન બીજું કોઈ પણ સ્વરૂપ મારું નથી.

વિશોધાર્થ : અભિપ્રાય એ છે કે ભેદબુદ્ધિ રહે ત્યાંસુધી શરીર અને સ્વ અને પરની કલ્યાના થાય છે. અંદર-બહાર; સ્થૂળ-સૂક્ષ્મ તથા પુરુષ-સ્ત્રી આદિ ઉપર્યુક્ત બધા વિકલ્ય એક તે શરીરના આશ્રયે જ થયા કરે છે. પણ જ્યારે તે ભેદબુદ્ધિ નાના થઈ જાય છે અને અભેદબુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નાના થઈ જાય છે. તે વખતે અખંડ ચિંતિંડસ્વરૂપ એક માત્ર આત્મજ્યોતિનો જ પ્રતિભાસ થાય છે. ત્યાંસુધી કે આ નિર્વિકલ્ય અવસ્થામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્યારિત્ર આદિનો પણ ભેદ નાના થઈ જાય છે. ૧૮.

(શાર્ડોલવિક્રીડિત)

એતેનૈવ ચિદુન્તતિક્ષયકૃતા કાર્ય વિના વैરિણ
શાશ્વતકર્મખલેન તિષ્ઠતિ કૃતં નાથાવયોરન્તરમુ ।
એષોડહં સ ચતે પુરઃ પરિગતો દુષ્ટો ઽત્ર નિઃસાર્યતાં
સદ્રક્ષેતરાનિગ્રહો નયવતો ધર્મઃ પ્રભોરીદ્ધઃ ॥૨૦॥

અનુવાદ : હે સ્વામિન્! કોઈ પ્રયોજન વિના જ વૈરભાવ પામીને ઉન્નત ચૈતન્ય- સ્વરૂપનો ધાત કરનાર આ કર્મરૂપ દુષ્ટ શત્રુ દ્વારા આપણા બન્ને વચ્ચે ઉત્પન્ન કરવામાં આવેલો ભેદ સ્થિત છે. આ હું અને તે કર્મશત્રુ બન્ને ય આપની સામે હાજર છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો કારણ કે, સજજનનું રક્ષણ કરવું

અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે. ૨૦.

(શાર્દૂલવિક્રીદિત)

આધિવ્યાધિજરામૃતિપ્રભુતયઃ સંબન્ધિનો વર્ષણ-
સ્તદ્વિન્નસ્ય મમાત્મનો ભગવતઃ કિં કર્તૃમીશા જડાઃ ।
નાનાકારવિકારકારિણ ઇમે સાક્ષાત્ત્રભોમણડલે
તિષ્ઠન્તો ઽપિ ન કુર્વતે જલમુચસ્તત્ર સ્વરૂપાન્તરમ् ॥૨૧॥

અનુવાદ : આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), જરા અને મૃત્યુ આદિ શરીર સાથે સંબંધ રાખનાર છે. હું ભગવાનું આત્મા તે શરીરથી ભિન્ન છું, મારે તે શરીર સંબંધી જડ આધિ-વ્યાધિ આદિ મારું શું કરી શકે? અર્થાત્ એ આત્માનું કંઈ પણ નુકશાન કરી શકતા નથી. યોગ્ય પણ છે-પ્રત્યક્ષ અનેક આકારો અને વિકારો કરનારા આ વાદળા આકાશમંડળમાં રહેવા છતાં પણ આકાશના સ્વરૂપમાં કંઈ પણ અંતર કરતા નથી. ૨૧.

(શાર્દૂલવિક્રીદિત)

સંસારાતપદહ્યમાનવપુષા દુઃખં મયા સ્થીયતે
નિત્યં નાથ યથા સ્થલસ્થિતિમતા મત્સ્યેન તામ્યન્મનઃ ।
કારુણ્યામृતસંગશીતલતરે ત્વત્પાદપદ્ભૂકેરુહે
યાવદેવ સમર્પયામિ હૃદયં તાવત્પરં સૌખ્યવાનુ ॥૨૨॥

અનુવાદ : જેમ પાણી સુકાઈ જતાં સ્થળ ઉપર રહેલું માછલું મનમાં અતિશય કષ્ટ પામે છે તેવી જ રીતે સંસારરૂપ ગરમીથી જલતા શરીરને ધારણ કરતો થકો અહીં રહીને હું પણ અતિશય કષ્ટ પામી રહ્યો છું. હે દેવ! જ્યાં સુધી હું દ્યારૂપ અમૃતના સંબંધથી અતિશય શીતળતાને પ્રાપ્ત થયેલ આપના ચરણ-કમળોમાં મારું હૃદય સમર્પિત કરું છું. ત્યાં સુધી અતિશય સુખનો અનુભવ કરું છું. ૨૨.

(શાર્દૂલવિક્રીદિત)

સાક્ષગ્રામમિદં મનો ભવતિ યદ્વાહાર્થસંબન્ધભાક્ર
તત્કર્મ પ્રવિજૃમ્ભતે પૃથગહં તસ્માત્સદા સર્વથા ।

ચૈતન્યાત્ત્વ તત્ત્વેતિ યદિ વા તત્ત્વાપિ તત્કારણં
શુદ્ધાત્મનુ મમ નિશ્ચયાત્યુનરિહ ત્વયેવ દેવ સ્થિતિઃ ॥૨૩॥

અનુવાદ : હે શુદ્ધ આત્મનુ! ઈન્દ્રિયસમૂહ સાથે આ મન બાધ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, માટે જ તેનાથી કર્મ વધે છે. હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન છું અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત (ચૈતના-ચૈતનત્વ) કારણ છે. હે દેવ! મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. ૨૩.

(શાર્ડૂલવિક્રીડિત)

કિં લોકેન કિમાશ્યેણ કિમુત દ્રવ્યેણ કાયેન કિં
કિં વાગ્ભિઃ કિમુતેન્દ્રિયૈઃ કિમસુભિઃ કિં તૈર્વિકલ્પૈરાપિ ।
સર્વે પુદ્ગલપર્યયા બત પરે ત્વત્તઃ પ્રમત્તો ભવ-
ન્નાત્મન્નેભિરભિશ્રયસ્યતિતરામાલેન કિં બન્ધનમ્ ॥૨૪॥

અનુવાદ : હે આત્મનુ! તારે લોકથી, આશ્રયથી, દ્રવ્યથી, શરીરથી, વચનોથી, ઈન્દ્રિયોથી, પ્રાણોથી અને તે વિકલ્પોથી પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી તારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પુદ્ગલની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે. ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે? ૨૪.

(શાર્ડૂલવિક્રીડિત)

ધર્માધર્મનભાંસિ કાલ ઇતિ મે નૈવાહિતં કુર્વતે
ચત્વારોડપિ સહાયતામુપગતાસ્તિષ્ઠન્તિ ગત્યાદિષુ ।
એકઃ પુદ્ગલ એવ સંનિધિગતો નોકર્મકર્માકૃતિ-
વૈરી બન્ધકૃદેષ સંપ્રતિ મયા ભેદાસિના ખણ્ડિતઃ ॥૨૫॥

અનુવાદ : ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારે દ્રવ્ય મારું કાંઈ પણ અહિત કરતા નથી. તે ચારે તો ગતિ આદિ (સ્થિતિ, અવકાશ અને વર્તના) માં સહાયક થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નોકર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પુદ્ગલરૂપ શત્રુ જ મારું સાનિધ્ય પામીને બંધનું કારણ થાય છે. તેથી મેં તેને આ વખતે ખેદ (વિવેક) રૂપ તલવારથી ખંડિત કરી દીધું છે. ૨૫.

(શાર્દૂલવિક્રીડિત)

રાગદ્વેષકૃતૈર્યથા પરિણમેદ્રૂપાન્તરૈઃ પુદ્ગલો
 નાકાશાદિચતુષ્ટયં વિરહિતં મૂર્ત્યા તથા પ્રાણિનામ् ।
 તાભ્યાં કર્મઘનં ભવેદવિરતં તસ્માદિયં સંસૃતિ-
 સ્તસ્યાં દુઃખપરંપરેતિ વિદુષા ત્યાજ્યૌ પ્રયત્નેન તૌ ॥૨૬॥

અનુવાદ : જેમ રાગ અને દ્વેષ દ્વારા કરવામાં આવેલા પરિણામાન્તરોથી પુદ્ગલ દ્વય પરિણમે છે તેવી રીતે તે અમૂર્તિક આકાશાદિ ચાર દ્વય ઉક્ત પરિણામાન્તરોથી પરિણમતા નથી. ઉક્ત રાગ અને દ્વેષથી નિરંતર પ્રાણીઓને સદા કઠોર કર્મનો બંધ થાય છે તેનાથી (કર્મબંધથી) આ સંસાર થાય છે અને તે સંસારમાં દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે. આ કારણે વિદ્વાન પુરુષે પ્રયત્નપૂર્વક ઉક્ત રાગ અને દ્વેષનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૬.

(શાર્દૂલવિક્રીડિત)

કિં બાહ્યેષુ પરેષુ વસ્તુષુ મનઃ કૃત્વા વિકલ્પાન્ બહૂન્
 રાગદ્વેષમયાન્ મુધૈવ કુરુષે દુઃખાય કર્મશુભમ् ।
 આનન્દામૃતસાગરે યદિ વસ્યાસાદ્ય શુદ્ધાત્મનિ
 સ્ફીતં તત્સુખમેકતામુપગતં ત્વં યાસિ રે નિશ્ચિતમ् ॥૨૭॥

અનુવાદ : રે મન! તું બાહ્ય પર પદાર્થોમાં ઘણા રાગ-દ્વેષરૂપ વિકલ્પો કરીને વ્યર્� જ દુઃખના કારણભૂત અશુભ કર્મ શા માટે કરે છે? જો તું એકત્વ (અદ્વૈતભાવ)ને પ્રાપ્ત થઈને આનંદરૂપ અમૃતના સમુદ્રભૂત શુદ્ધાત્મામાં નિવાસ કરે તો નિશ્ચયથી જ મહાન સુખ પામી શકીશ. ૨૭.

(શાર્દૂલવિક્રીડિત)

ઇત્યાસ્થાય હંડિ સ્થિરં જિન ભવત્યાદપ્રસાદાત્સતી-
 મધ્યાત્મૈકતુલામયં જન ઇતઃ શુદ્ધયર્થમારોહતિ ।
 એનં કર્તુમમી ચ દોષિણમિતઃ કર્મારયો દુર્ધરા-
 સ્તિષ્ઠન્તિ પ્રસભં તદત્ત્ર ભગવન્ મધ્યસ્થસાક્ષી ભવાન્ ॥૨૮॥

અનુવાદ : હે જિન! હૃદયમાં આવો સ્થિર વિચાર કરીને આ મનુષ્ય શુદ્ધિ માટે આપના ચરણોના પ્રસાદથી નિર્દોષ અધ્યાત્મરૂપી અદ્વિતીય ત્રાજવામાં એક તરફ ચે અને બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જ્ય કર્મરૂપી શત્રુ બળપૂર્વક સ્થિત છે. તેથી હે ભગવાનુ! આ વિષયમાં આપ મધ્યસ્થ (નિષ્પક્ષ) સાક્ષી છો. ૨૮.

(શાર્દૂલવિક્રીડિત)

દૈતં સંસૃતિરેવ નિશ્ચયવશાદદૈતમેવામૃતં-
સંક્ષેપાદુભ્યત્ર જલ્લિતમિદં પર્યન્તકાષાગતમ् ।
નિર્ગત્યાદિપદાચ્છનૈઃ શબલિતાદન્યત્સમાલમ્બતે
યઃ સો ઽસંજ્ઞ ઇતિ સ્ફુર્તં વ્યવહૃત્બ્રહ્માદિનામેતિ ચ ॥૨૯॥

અનુવાદ : નિશ્ચયથી દૈત (આત્મ-પરનો ભેદ) જ સંસાર અને અદૈત જ મોક્ષ છે. આ એ બન્નેના વિષયમાં સંક્ષેપથી કથન છે જે ચરમ સીમાને પ્રાપ્ત છે. જે ભવ્ય જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ (દૈત) પદથી નીકળીને બીજા (અદૈત) પદનો આશ્રય કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્ય-વાચ્યકભાવનો અભાવ થઈ જવાના કારણે સંજ્ઞા(નામ) રહિત થઈ જાય છે; છતાં પણ વ્યવહારથી તે પ્રલિય આદિ (પરબ્રહ્મ, પરમાત્મા) નામને પ્રાપ્ત કરે છે. ૨૯.

(શાર્દૂલવિક્રીડિત)

ચારિત્રં યદમાणિ કેવલદૃશા દેવ ત્વયા મુક્તયે
પુંસા તત્ખલુ માદ્શેન વિષમે કાલે કલૌ દુર્ધર્સમ् ।
ભક્તિર્યા સમભૂદિહ ત્વયિ દૃઢા પુણ્યૈઃ પુરોપાર્જિતૈઃ
સંસારાર્ણવતારણે જિન તતઃ સૈવાસ્તુ પોતો મમ ॥૩૦॥

અનુવાદ : હે જિનદેવ! કેવળજ્ઞાની! આપે જે મુક્તિ માટે ચારિત્ર બતાવ્યું છે તેને નિશ્ચયથી મારા જેવા પુરુષ આ વિષમ પંચમ કાળમાં ધારણ કરી શકતો નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન્ પુણ્યથી અહીં જે મારી આપના વિષયમાં દેઢ ભક્તિ થઈ છે તે જ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન થાય. ૩૦.

(શાર્દૂલવિક્રીડિત)

ઇન્દ્રત્વं ચ નિગોદતાં ચ બહુધા મધ્યે તથા યોનયઃ
સંસારે ભ્રમતા ચિરં યદખિલાઃ પ્રાપ્તા મયાનન્તશઃ ।
તત્ત્વાપૂર્વમિહાસ્તિ કિંચિદપિ મે હિત્વા વિમુક્તિપ્રદાં
સમ્યગ્દર્શનબોધવૃત્તિપદવીં તાં દેવ પૂર્ણા કુરુ ॥૩૧॥

અનુવાદ : હે દેવ! મેં ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર ઈન્દ્રપદ, નિગોદ પર્યાય તથા વચ્ચમાં પણ બીજા જે સમસ્ત અનંત ભવ પ્રાપ્ત કર્યા છે તેમાં મુક્તિ આપનાર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ક્યારિત્રસ્પ પરિણતિ સિવાય બીજા કોઈ પણ અપૂર્વ નથી. તેથી રત્નત્રયસ્ત્રસ્પ જે પદવી હજી સુધી મેં કદી પ્રાપ્ત કરી નથી તે અપૂર્વ પદવી પૂર્ણ કરો. ૩૧.

(શાર્દૂલવિક્રીડિત)

શ્રીવીરેણ મમ પ્રસત્ત્રમનસા તત્કિંચિદુચ્ચૈ: પદ-
પ્રાપ્તય પરમોપદેશવચનં ચિત્તે સમારોપિતમ् ।
યેનાસ્તામિદમેકભૂતલગતં રાજ્યં ક્ષણધ્વંસિ યત्
ત્રૈલોક્યસ્ય ચ તત્ત્વ મે પ્રિયમિહ શ્રીમંજ્ઞિનેશ પ્રભો ॥૩૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! શ્રી વીર ભગવાને (અથવા શ્રી વીરનન્દી ગુરુએ) પ્રસન્નચિત થઈને ઉચ્ચ પદ (મોક્ષ)ની પ્રાપ્તિ માટે જે મારા ચિત્તમાં થોડા ઉત્તમ ઉપદેશરૂપ વચ્ચનોનું આરોપણ કર્યું છે તેના પ્રભાવથી ક્ષણનશ્વર જે એક પૃથ્વીનું રાજ્ય છે તે તો દૂર રહો, પરંતુ મને તે નણ લોકનું રાજ્ય પણ અહીં પ્રિય નથી. ૩૨.

(શાર્દૂલવિક્રીડિત)

સૂરે: પઙ્કજનાન્દિન: કૃતિમિમામાલોચનામહતા-
મગ્રે ય: પઠતિ ત્રિસંધ્યમમલશ્રદ્ધાનતાઙ્ગો નર: ।
યોગીન્દ્રશ્રિકાલસુદૃતપસા યત્નેન યન્મૃગ્યતે
તત્ત્વાપ્રોતિ પરં પદં સ મતિમાનાનન્દસદ્ગ ધ્રુવમ् ॥૩૩॥

અનુવાદ : જે બુદ્ધિમાન મનુષ્ય નિર્મળ શ્રદ્ધાથી પોતાના શરીરને નમ્રીભૂત કરીને ત્રણે સંધ્યાકાળે અર્હતુ ભગવાન આગળ શ્રી પદ્મનાનિ સૂર્ય દ્વારા વિરચિત આ આલોચનારૂપ પ્રકરણ ભણે છે તે નિશ્ચયથી આનંદના સ્થાનભૂત તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરે છે જેને યોગીશ્વર તપશ્ચરણ દ્વારા પ્રયત્નપૂર્વક ચિરકાળથી શોધ્યા કરે છે. ૩૩.

આ રીતે આલોચના અધિકાર સમાપ્ત થયો. ૮.



સુલો વિદેશ.

૮૮૪

૧૦. સદ્ગોધ ચંદ્રોદય

[૧૦. સદ્ગોધચંદ્રોદયः]

(શાર્દૂલવિક્રીડિત)

યજ્ઞાનન્નપિ બુદ્ધિમાનપિ ગુરુઃ શક્તો ન વત્તું ગિરા
પ્રોક્તં ચેત્ત તથાપિ ચેતસિ નૃણાં સંમાતિ ચાકાશવત् ।
યત્ર સ્વાનુભવસ્થિતે ઽપિ વિરલા લક્ષ્યં લભન્તે ચિરા-
ત્તન્મોક્ષૈકનિવન્ધનં વિજયતે ચિત્તત્વમત્યદ્ભુતમ् ॥૧॥

અનુવાદ : જે ચેતન તત્ત્વને જાણવા છતાં પણ અને બુદ્ધિમાન ગુરુ પણ વાણી દ્વારા કહેવાને સમર્થ નથી તથા જો કહેવામાં આવે તો પણ જે આકાશ સમાન મનુષ્યોના હૃદયમાં સમાતું નથી તથા જેના સ્વાનુભવમાં સ્થિત હોવા છતાં પણ વિરલા મનુષ્યો જ ચિર કાળે લક્ષ્ય (મોક્ષ) ને પ્રાપ્ત કરી શકે છે; તે મોક્ષના અદ્વિતીય કારણભૂત આશ્ર્યજનક ચેતનતત્ત્વ જ્યવંત હો. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

નિત્યાનિત્યતયા મહત્તનુત્યાનેકૈકરૂપત્વવત्
ચિત્તત્વં સદસત્તયા ચ ગહનં પૂર્ણ ચ શૂન્યં ચ યત् ।
તર્જીયાદખિલશ્રુતાશ્રયશુચિજ્ઞાનપ્રભાભાસુરો
યસ્મિન્ વસ્તુવિચારમાર્ગચતુરો યઃ સો ઽપિ સંમુદ્ધ્યતિ ॥૨॥

અનુવાદ : જે ચેતન તત્ત્વ નિત્ય અને અનિત્ય સ્વરૂપે, સ્થૂળ અને કૃશ સ્વરૂપે, અનેક અને એક સ્વરૂપે, સત્ત અને અસત્ત સ્વરૂપે તથા પૂર્ણ અને શૂન્ય સ્વરૂપે ગણન છે; તથા જેના વિષયમાં સમસ્ત શ્રુતનો વિષય કરનારી એવી નિર્મળ જ્ઞાનરૂપ

અધિકાર-૧૦ : સદ્ભોધ ચંદ્રોદય]

૨૩૫

જ્યોતિથી દેણિયું મનુષ્ય પણ મોહ પામે છે તે ચેતન તત્ત્વ જીવિત રહે.

વિશેષાર્� : તે ચિદ્રૂપ તત્ત્વ (સમજવું) ઘણું અધરું છે કારણ કે ભિન્ન ભિન્ન અપેક્ષાએ તેનું સ્વરૂપ અનેક પ્રકારનું છે. જેમ કે-ઉક્ત ચિદ્રૂપ તત્ત્વ જો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે તો પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય પણ છે. જો તે અનાન્ત પદાર્થોનો વિષય કરવાને કારણો સ્થળ છે તો મૂર્તિ રહિત હોવાના કારણો સૂક્ષ્મ પણ છે, જો તે સામાન્ય સ્વરૂપે એક છે તો વિશેષ સ્વરૂપે અનેક પણ છે, જો તે સ્વકીય દ્રવ્યાદિ ચતુષ્યની અપેક્ષાએ સત્ત છે તો પરકીય દ્રવ્યાદિચતુષ્યની અપેક્ષાએ અસત્ત પણ છે તથા જો તે અનાન્તચતુષ્ય આદિ ગુણોથી પરિપૂર્ણ છે તો રૂપ-રસાદિ રહિત હોવાના કારણો શુન્ય પણ છે. આ રીતે તેનું સ્વરૂપ ગંભીર હોવાથી કદી સમસ્ત શુતના પારગામી પણ તેના વિષયમાં મોહ પામી જાય છે. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વસ્મિન્નિમાદિપદ્ભૂજવને રમ્યેઽપિ હિત્વા રતિં
યો દૃષ્ટિં શુચિમુત્કિહંસવનિતાં પ્રત્યાદરાદત્તવાન્ ।
ચેતોવૃત્તિનિરોધલબ્ધપરમબ્રહ્મપ્રમોદાન્બુભૂત્ -
સમ્યક્ સામ્યસરોવરસ્થિતિજુષે હંસાય તસ્મૈ નમઃ ॥૩॥

અનુવાદ : અણિમા-મહિમા આદિ આઠ ઋષિઓરૂપ રમણીય સમસ્ત કમળવન રહેવા છતાં પણ જે આત્મારૂપ હંસ તેના વિષયમાં અનુરક્ત ન થતાં આદરથી મુક્તિરૂપ હંસી ઉપર જ પોતાની દસ્તિ રાખે છે તથા જે ચિત્તવૃત્તિના નિરોધથી પ્રાપ્ત થયેલ પરબ્રહ્મસ્વરૂપ આનંદરૂપી જળથી પરિપૂર્ણ એવા સમીયીન સમતાભાવરૂપ સરોવરમાં નિવાસ કરે છે તે આત્મારૂપ હંસને નમસ્કાર હો. ૩.

(રથોદ્ધતા)

સર્વભાવવિલયે વિભાતિ યત્ત સત્તસમાધિભરનિર્ભરાત્મનઃ ।
ચિત્સ્વરૂપમભિતઃ પ્રકાશકં શર્મધામ નમતાદ્ભૂતં મહઃ ॥૪॥

અનુવાદ : જે આશ્ર્યજનક ચિત્સ્વરૂપ તેજ રાગ-દેખાદિરૂપ વિભાવ પરિણામો નાના થતાં સમ્યક્ સમાધિના ભારને ધારણા કરનાર યોગીને શોભાયમાન થાય છે, જે સર્વ પદાર્થોનું પ્રકાશક છે તથા જે સુખનું કારણ છે તે ચિત્સ્વરૂપ તેજને નમસ્કાર કરો. ૪.

(રથોદૃતા)

વિશ્વવસ્તુવિધૃતિક્ષમં લાસજ્ઞાલમન્તપરિવર્જિતં ગિરામ् ।
અસ્તમેત્યખિલમેકહેલયા યત્ર તજ્જ્યતિ ચિન્મયં મહઃ ॥૫॥

અનુવાદ : જે ચિદૂપ તેજ સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરવામાં સમર્થ છે, દેણીએયમાન છે, અંત રહિત અર્થાત્ અવિનશ્બર છે તથા જેના વિષયમાં સમસ્ત વચ્ચનોનો સમૂહ કીડામાત્રથી જ નાશ પામે છે અર્થાત્ જે વચ્ચનો અવિષય છે; તે ચિદૂપ તેજ જ્યવંત હો. ૫.

(રથોદૃતા)

નો વિકલ્પરહિતં ચિદાત્મકં વસ્તુ જાતુ મનસો ઽપિ ગોચરમ् ।
કર્મજાશ્રિતવિકલ્પરૂપિણઃ કા કથા તુ વપુષો જડાત્મનઃ ॥૬॥

અનુવાદ : તે ચૈતન્યરૂપ તત્ત્વ સર્વ પ્રકારના વિકલ્પ રહિત છે અને ત્યાં તે મન કર્મજનિત રાગ-દેખના આશ્રયે થનારા વિકલ્પ સ્વરૂપ છે. તેથી જ્યારે તે ચૈતન્ય તત્ત્વ તે મનનો પણ વિષય નથી તો પછી જડસ્વરૂપ (અયેતન) શરીરની તો વાત જ શી છે?—તેનો તો વિષય તે કદી થઈ જ શકતું નથી. ૬.

(રથોદૃતા)

ચેતસો ન વચ્ચસો�પિ ગોચરસ્તર્હિ નાસ્તિ ભવિતા ખુપુષ્પવત् ।
શઙ્કનીયમિદમત્ત્ર નો યતઃ સ્વાનુભૂતિવિષયસ્તતો ઽસ્તિ તત् ॥૭॥

અનુવાદ : જો તે ચૈતન્યરૂપ તેજ મન અને વચ્ચનો પણ વિષય ન હોય તો તે આકાશના ઝૂલ સમાન અસત્ત થઈ જશે એવી પણ અહીં આશંકા ન કરવી જોઈએ કારણ કે તે સ્વાનુભવનો વિષય છે. તેથી તે સત્ત જ છે, નહિ કે અસત્ત. ૭.

(રથોદૃતા)

નૂનમત્ત્ર પરમાત્મનિ સ્થિતં સ્વાન્તમન્તમુપયાતિ તદ્દહિઃ ।
તં વિહાય સતતં ભ્રમત્યદઃ કો બિભેતિ મરણાત્મ ભૂતલે ॥૮॥

અનુવાદ : અહીં પરમાત્મામાં સ્થિત થયેલું મન નિશ્ચયથી મરણને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તે તેને (પરમાત્માને) છોડીને નિરંતર બાધ્ય પદાર્થોમાં વિચરે છે.

અધિકાર-૧૦ : સદ્ભોધ ચંદ્રોદય]

૨૩૭

બરાબર છે-આ પૃથ્વી ઉપર મૃત્યુથી કોણ ઉરતું નથી? અર્થાત્ તેનાથી બધા જ ઉરે છે. ૮.

(રથોદ્ધતા)

તત્ત્વમાત્મગતમેવ નિશ્ચિતં યો ઽન્યદેશનિહિતં સમીક્ષતે ।

વસ્તુ મુષ્ટિવિધૃતં પ્રયત્નતઃ કાનને મૃગયતે સ મૂઢધીઃ ॥૧॥

અનુવાદ : ચૈતન્યતત્ત્વ નિશ્ચયથી પોતામાં જ સ્થિત છે, તે ચૈતન્યરૂપ તત્ત્વને જે અન્ય સ્થાનમાં સ્થિત સમજે છે તે મૂર્ખ મુઠીમાં રાખેલી વસ્તુને જાણે પ્રયત્નપૂર્વક વનમાં શોધે છે. ૯.

(રથોદ્ધતા)

તત્પરઃ પરમયોગસંપદાં પાત્રમત્ર ન પુનર્વહિર્ગતઃ ।

નાપરેણ ચલિ [ત] તો યથોપ્સિતઃ સ્થાનલાભવિભવો વિભાવ્યતે ॥૧૦॥

અનુવાદ : જે ભવ્ય જીવ આ પરમાત્મતત્ત્વમાં તલ્લીન થાય છે તે સમાધિરૂપ સંપત્તિઓનું પાત્ર થાય છે, પરંતુ જે બાધ્ય પદાર્થમાં મુગ્ધ રહે છે તે તેમનું પાત્ર થતો નથી. યોગ્ય છે-જે બીજા માર્ગે ચાલી રહ્યો છે તેને ઈચ્છાનુસાર સ્થાનની પ્રાપ્તિરૂપ સંપત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. ૧૦.

(રથોદ્ધતા)

સાધુલક્ષ્યમનવાય ચિન્મયે યત્ર સુષ્ટુ ગહને તપસ્વિનઃ ।

અપ્રતીતિભુવમાશ્રિતા જડા ભાન્તિ નાટ્યગતપાત્રસંનિભાઃ ॥૧૧॥

અનુવાદ : જે તપસ્વી અતિશય ગહન તે ચૈતન્યસ્વરૂપ તત્ત્વના વિષયમાં લક્ષ્ય (વેધ) ન પામીને અતત્ત્વશ્રદ્ધાન (મિથ્યાત્વ) રૂપ ભૂમિકાનો આશ્રય લે છે તે મૂઢબુદ્ધિ જીવ નાટકના પાત્ર સમાન લાગે છે.

વિશેષાર્થ : જેમ નાટકના પાત્ર રાજા, રંક અને સાધુ આદિનો વેશ લઈને તથા તે પ્રમાણે જ તેમનું ચરિત્ર બતાવીને જોનારાઓને જો કે મુગ્ધ કરી લે છે, છતાં પણ તેઓ યથાર્થ રાજા વગેરે હોતા નથી. બરાબર એ જ રીતે જે બાધ્ય તપશ્ચરણાદિ તો કરે છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત હોવાના કારણે તે ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરી શકતા નથી. તેઓ યોગીનો વેશ લઈને પણ વાસ્તવિક યોગી થઈ શકતા નથી. ૧૧.

(રથોદૃતા)

ભૂરિધર્મયુતમપ્યબુદ્ધિમાનન્ધહસ્તિવિધિનાવબુધ્ય યત્ ।
પ્રામ્યતિ પ્રચુરજન્મસંકટે પાતુ વસ્તદતિશાયિ ચિન્મહઃ ॥૧૨॥

અનુવાદ : અણાની જીવ અનેક ધર્મોવાળા જે ચેતન તત્ત્વને અંધ-હસ્તિ ન્યાયથી જાણીને અનેક જન્મ-મરણથી ભયાનક આ સંસારમાં પરિભ્રમણ કરે છે તે અનુપમ ચેતન તત્ત્વરૂપ તેજ આપ સર્વનું રક્ષણ કરો.

વિશેષાર્થ : જેવી રીતે આંધળો મનુષ્ય હાથીનો યથાર્થ આકાર ન જાણતાં તેના જે અવયવ (પગ કે સૂંધ વગેરે) નો સ્પર્શ કરે છે તેને જ હાથી સમજી લે છે, તેવી જ રીતે મિથ્યાદેષ્ટિ જીવ અનેક ધર્મયુક્ત તે ચેતન તત્ત્વને યથાર્થ સ્વરૂપે ન જાણતાં એકાંતે કોઈ એક જ ધર્મસ્વરૂપ સમજી લે છે. એ જ કારણે તે જન્મ-મરણસ્વરૂપ આ સંસારમાં જ પરિભ્રમણ કરીને દુઃખ સહન કરે છે. ૧૨.

(રથોદૃતા)

કર્મવન્ધકલિતો ઽપ્યવન્ધનો રાગદ્વેષમલિનો ઽપિ નિર્મલઃ ।
દેહવાનપિ ચ દેહવર્જિતશ્ચિત્રમેતદખિલં કિલાત્મનઃ ॥૧૩॥

અનુવાદ : આ આત્મા કર્મબંધ સહિત હોવા છતાં પણ બંધન રહિત છે, રાગ-દ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મળ છે તથા શરીર સાથે સંબંધવાળો હોવા છતાં પણ તે શરીર રહિત છે. આ રીતે આ બધું આત્માનું સ્વરૂપ આશ્રયજનક છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્માને ન રાગ-દ્વેષ પરિણામ છે, ન કર્માનો બંધ છે અને ન શરીરે ય છે. તે વાસ્તવમાં વીતરાગ, સ્વાધીન અને અશરીર હોઈને સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયસ્વરૂપે તે કર્મબંધ સહિત હોઈને રાગ-દ્વેષથી મલિન અને શરીર સહિત માનવામાં આવે છે. ૧૩.

(રથોદૃતા)

નિર્વિનાશમપિ નાશમાશ્રિતં શૂન્યમપ્યતિશયેન સંભૃતમ् ।
એકમેવ ગતમપ્યનેકતાં તત્ત્વમીદ્યગપિ નો વિરુધ્યતે ॥૧૪॥

અનુવાદ : તે આત્મતત્ત્વ વિનાશ રહિત હોવા છતાં પણ નાશને પ્રાપ્ત છે, શૂન્ય હોવા છતાં પણ અતિશયથી પરિપૂર્ણ છે તથા એક હોવા છતાં પણ અનેકતાને પ્રાપ્ત છે. આ રીતે નયવિવક્ષાથી એમ માનવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. ૧૪.

(રથોદ્ધતા)

વિસ્મૃતાર્થ પરિમાર્ગણં યથા યસ્તથા સહજચેતનાશ્રિતઃ ।
સ ક્રમેણ પરમેકતાં ગતઃ સ્વસ્વરૂપપદમાશ્ર્યેદ્ભુવમ् ॥૧૫॥

અનુવાદ : જેવી રીતે મૂર્ચિષ્ઠ મનુષ્ય સ્વાભાવિક ચેતના પામીને (હોશણાં આવીને) પોતાની ભૂલાયેલી વસ્તુની શોધ કરવા માંડે છે તેવી જ રીતે જે ભવ્ય પ્રાણી પોતાના સ્વાભાવિક ચૈતન્યનો આશ્રય લે છે તે ક્રમે કરીને એકત્વ પામી પોતાના સ્વાભાવિક ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને નિશ્ચિતપણે જ પ્રાપ્ત કરી લે છે. ૧૫.

(રથોદ્ધતા)

યદ્યદેવ મનસિ સ્થિતં ભવેત્ તત્ત્વદેવ સહસા પરિત્યજેત્ ।

ઇત્યુપાધિપરિહારપૂર્ણતા સા યદા ભવતિ તત્પરં તત્ત્વદં તત્ત્વદા ॥૧૬॥

અનુવાદ : જે જે વિકલ્પ આવીને મનમાં સ્થિત થાય છે તેને શીધ જ છોડી દેવો જોઈએ. આ રીતે જ્યારે તે વિકલ્પોનો ત્યાગ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે તે મોક્ષ પદ પણ પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.

(રથોદ્ધતા)

સંહતેષુ ખમનો ઽનિલેષુ યદ્ભાતિ તત્ત્વમમલાત્મનઃ પરમ् ।

તદ્રતં પરમનિસ્તરઙૃતામગ્નિરુગ્ર ઇહ જન્મકાનને ॥૧૭॥

અનુવાદ : ઈન્દ્રિય, મન અને શાસોચ્છ્વાસ નાટ થઈ ગયા પછી જે નિર્મળ આત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તે અતિશય સ્થિરતા પામીને અહીં જન્મ (સંસાર) રૂપ વનને બાળવા માટે તીક્ષ્ણ અભિન સમાન હોય છે. ૧૭.

(રથોદ્ધતા)

મુક્ત ઇત્યાપિ ન કાર્યમજ્જસા કર્મજાલકલિતો ઽહમિત્યાપિ ।

નિર્વિકલ્પ પદવીમુપાશ્ર્યન् સંયમી હિ લભતે પરં પદમ् ॥૧૮॥

અનુવાદ : વાસ્તવમાં ‘હું મુક્ત છું’ એ જાતનો વિકલ્પ પણ ન કરવો જોઈએ. તથા ‘હું કર્મોના સમૂહથી સંબંધ છું’ એવો વિકલ્પ પણ ન કરવો જોઈએ. કારણ એ છે કે સંયમી પુરુષ નિર્વિકલ્પ પદવી પામીને જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ મોક્ષપદ પામે છે. ૧૮.

(રથોદ્ધતા)

કર્મ ચાહમિતિ ચ દ્વયે સતિ દ્વૈતમેતદિહ જન્મકારણમ् ।

એક ઇત્યાપિ મતિઃ સતી ન યત્સાધુપાધિરચિતા તदઙ્ગભૂત્ ॥૧૯॥

અનુવાદ : હે પ્રાણી! ‘કર્મ અને હું’ આવા પ્રકારની બે પદાર્થોની કલ્પના થતાં જે અહીં દ્વૈતબુદ્ધિ થાય છે તે સંસારનું કારણ છે. તથા ‘હું એક છું’ એ જાતનો વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે તે પણ ઉપાધિથી નિર્ભિત હોવાના કારણે સંસારનું જ કારણ થાય છે. ૧૯.

(રથોદ્ધતા)

સંવિશુદ્ધપરમાત્મભાવના સંવિશુદ્ધપદકારણं ભવેત् ।

સેતરેતકૃતે સુવર્ણતો લોહતશ્ વિકૃતીસ્તદાશ્રિતે ॥૨૦॥

અનુવાદ : અતિશય વિશુદ્ધ પરમાત્મતત્ત્વની જે ભાવના છે તે અતિશય નિર્ભળ મોક્ષપદનું કારણ થાય છે. તથા એનાથી વિપરીત જે ભાવના છે તે સંસારનું કારણ થાય છે. બરાબર છે—સુવર્ણથી જે પર્યાપ્ત ઉત્પન્ન થાય છે તે સુવર્ણમય અને લોહથી જે પર્યાપ્ત ઉત્પન્ન થાય છે તે લોહમય હોય છે. ૨૦.

(રથોદ્ધતા)

કર્મ ભિન્નમનિર્ણ સ્વતો ઽખિલં પશ્યતો વિશદબોધચક્ષુપા ।

તત્કૃતે ઽપિ પરમાથ્વેદિનો યોગિનો ન સુખદુઃખકલ્પના ॥૨૧॥

અનુવાદ : સમસ્ત કર્મ મારથી ભિન્ન છે, આ રીતે નિરંતર નિર્ભળ શાન્દુપ નેત્રથી દેખનારા અને યથાર્થ સ્વરૂપના વેતા યોગીને કર્મકૃત સુખ-દુઃખ હોવા છતાં પણ તેને ઉક્ત સુખ-દુઃખની કલ્પના હોતી નથી. ૨૧.

(રથોદ્ધતા)

માનસસ્ય ગતિરસ્તિ ચેન્નિરાલમ્બ એવ પથિ ભાસ્વતો યથા ।

યોગિનો દ્વારાધકારકઃ સંનિધિર્ન તમસાં કદાચન ॥૨૨॥

અનુવાદ : જો યોગીના મનની ગતિ સૂર્ય સમાન નિરાધાર માર્ગમાં જ હોય તો તેને જોવામાં બાધા ઉત્પન્ન કરનાર અંધકાર (અજ્ઞાન) ની સમીપતા કદી પણ હોઈ શકે નહિ.

વિશેષાર્� : જેવી રીતે નિરાધાર આકાશમાર્ગ ગમન કરનાર સૂર્ય રહે ત્યારે અંધકાર કોઈ રીતે બાધા પહોંચાડી શકતો નથી તેવી જ રીતે સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત આત્મતત્ત્વમાં સંચાર કરનાર યોગીના તત્ત્વદર્શનમાં અજ્ઞાન-અંધકાર પણ બાધા પહોંચાડી શકતો નથી. ૨૨.

(રથોદૃતા)

રુજરાદિવિકૃતિર્ન મે ઽજ્જસા સા તનોરહમિતઃ સદા પૃથક् ।

મીલિતેઽપિ સતિ ખે વિકારિતા જાયતે ન જલદૈર્વિકારિભિઃ ॥૨૩॥

આનુવાદ : રોગ અને જરા આછિ રૂપ વિકાર વાસ્તવમાં મારા નથી, તે તો શરીરના વિકાર છે અને હું તે શરીરથી સંબંધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી સર્વદા ભિન્ન છું. ઠીક છે-વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ સાથે આકાશનો મેળાપ થવા છતાં પણ તેમાં કોઈ પ્રકારનો વિકારભાવ ઉત્પન્ન થતો નથી. ૨૩.

(રથોદૃતા)

વ્યાધિનાઙ્ઘમભિભૂયતે પરં તદ્દતો ઽપિ ન પુનશ્ચિદાત્મકઃ ।

ઉત્થિતેન ગૃહમેવ દદ્યતે વહિના ન ગગનं તદાશ્રિતમ् ॥૨૪॥

આનુવાદ : રોગ કેવળ શરીરને પરાધીન કરે છે પણ તેમાં સ્થિત હોવા છતાં ચેતન આત્માને પરાધીન કરતો નથી. બરાબર છે-ઉત્પન્ન થયેલી અજ્ઞાન કેવળ ધરને જ બાળો છે, પરંતુ તેના આશ્રયભૂત આકાશને બાળતી નથી. ૨૪

(રથોદૃતા)

બોધરૂપમખિલैરુપાધિભર્જિતં કિમપિ યત્તદેવ નઃ ।

નાન્યદલ્યમપિ તત્ત્વમીદ્શં મોક્ષહેતુરિતિ યોગનિશ્ચયઃ ॥૨૫॥

આનુવાદ : સમસ્ત ઉપાધિથી રહિત જે કાંઈ પણ જ્ઞાનરૂપ છે તે જ અમારું સ્વરૂપ છે, તેનાથી ભિન્ન જરાય તત્ત્વ અમારું નથી; આ જીતનો યોગનો નિશ્ચય મોક્ષનું કારણ થાય છે. ૨૫.

(રથોદૃતા)

યોગતો હિ લભતે વિબન્ધનં યોગતો ઽપિ કિલ મુચ્યતે નરઃ ।

યોગવર્ત્મ વિષમં ગુરોર્ગરા બોધ્યમેતદખિલં મુમુક્ષુણા ॥૨૬॥

અનુવાદ : મનુષ્ય યોગના નિમિત્તે વિશેષ બંધન પ્રાપ્ત કરે છે તથા યોગના નિમિત્તે જ તેનાથી મુક્ત પણ થાય છે. આ રીતે યોગનો માર્ગ વિષમ છે. મોક્ષાભિલાધી ભવ્ય જીવે આ સમસ્ત યોગમાર્ગનું શાન ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરવું જોઈએ. ૨૬.

(રથોદૃતા)

શુદ્ધબોધમયમાસ્તિ વસ્તુ યદ્ સ્મર્ણીયકપદં તદેવ નઃ ।
સ પ્રમાદ ઇહ મોહજઃ કવચિત્કલ્યતે વદ પરો [રી] ઽપિ રમ્યતા ॥૨૭॥

અનુવાદ : જે શુદ્ધ જ્ઞાનરૂપ વસ્તુ છે તે જ અમારું રમણીય પદ છે. એનાથી ઉદ્દું જે અન્ય કોઈ બાધ્ય જરૂર વસ્તુમાં પણ રમણીયતાની કલ્પના કરવામાં આવે છે તે કેવળ મોહજનિત પ્રમાદ છે. ૨૭.

(રથોદૃતા)

આત્મબોધશુચિતીર્થમદ્ભૂતં સ્નાનમત્ર કુરુતોત્તમં બુધાઃ ।
યત્ત યાત્યપરતીર્થકોટિભિઃ ક્ષાલયત્વપિ મલં તદાન્તરમ् ॥૨૮॥

અનુવાદ : આત્મજ્ઞાનરૂપ પવિત્ર તીર્થ આશ્રમજનક છે. હે વિદ્વાનો! આપ એમાં ઉત્તમ રીતે સ્નાન કરો. જે અભ્યંતર મળ બીજા કરોડો તીર્થોથી પણ જતો નથી તેને પણ આ તીર્થ ધોઈ નાખે છે. ૨૮.

(રથોદૃતા)

ચિત્સમુદ્રતટબદ્ધસેવયા જાયતે કિમુ ન રત્નસંચયઃ ।
દુઃખહેતુમુતસ્તુ દુર્ગતિઃ કિં ન વિષ્ણવમુપैતિ યોગિનઃ ॥૨૯॥

અનુવાદ : ચૈતન્યરૂપ સમુદ્રના તટથી સંબંધિત સેવા દ્વારા શું રત્નોનો સંચય નથી થતો? અવશ્ય થાય છે. તથા તેનાથી દુઃખના કારણભૂત યોગીની દુર્ગતિ શું નાશ નથી પામતી? અર્થાત્ તે અવશ્યમેવ નાશ પામે છે.

વિશેષાર્� : જેવી રીતે સમુદ્રના કિનારે રહેનારા માણસો પાસે કોઈ બહુમૂલ્ય રત્નોનો સંચય થઈ જાય છે તથા એનાથી તેની દુર્ગતિ (નિર્ધનતા) નાશ પામે છે તેવી જ રીતે ચૈતન્યરૂપ સમુદ્રના તटની આરાધના કરનાર યોગીને પણ અમૂલ્ય રત્નો (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ) નો સંચય થઈ જાય છે અને એનાથી તેની દુર્ગતિ (નારક પર્યાય આદિ) પણ નાશ

થઈ જાય છે. આ રીતે તેને નારકાદિ પર્યાય જનિત હુઃખ નાણ થઈ જવાથી અપૂર્વ શાંતિનો લાભ થાય છે. ૨૮.

(રથોદ્ધતા)

**નિશ્ચયાવગમનસ્થિતિત્રયં રત્નસંચિતિરિયં પરાત્મનિ ।
યોગદાસ્તિવિષયીભવન્નસૌ નિશ્ચયેન પુનરેક એવ હિ ॥૩૦॥**

અનુવાદ : પરમાત્માના વિષયમાં જે નિશ્ચય, શાન અને સ્થિરતા થાય છે; એ ત્રણેનું નામ જ રત્નસંચય છે. તે પરમાત્મા યોગરૂપ નેત્રનો વિષય છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે રત્નત્રયસ્વરૂપ આત્મા એક જ છે, તેમાં સમ્યગ્દર્શનાદિનો ભેદ પણ દણ્ણિગોચર થતો નથી.

વિશેષાર્થ : સમ્યગ્દર્શનાદિના સ્વરૂપનો વિચાર નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારે કરવામાં આવે છે. જેમ કે-જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. એ વ્યવહાર સમ્યગ્દર્શન છે. ઉક્ત જીવાદિ તત્ત્વોનું જે યથાર્થ જ્ઞાન હોય છે, તેને વ્યવહાર સમ્યગ્જ્ઞાન કહે છે. પાપરૂપ કિયાઓના પરિત્યાગને વ્યવહાર સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. આ વ્યવહારની અપેક્ષાએ તેમના સ્વરૂપનો વિચાર થયો. નિશ્ચયનયની અપેક્ષાએ તેમનું સ્વરૂપ આ રીતે છે. શુદ્ધ આત્માના વિષયમાં રૂચિ ઉત્પન્ન થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ આત્માના સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને ઉક્ત આત્મામાં જ લીન થવું એ નિશ્ચય ચારિત્ર કહેવાય છે. આમાં વ્યવહાર જ્યાં સુધી નિશ્ચયનો સાધક છે ત્યાંસુધી જ તે ઉપાદેય છે, વાસ્તવમાં તે અસત્યાર્થ હોવાથી હેય જ છે. ઉપાદેય કેવળ નિશ્ચય જ છે, કેમકે તે યથાર્થ છે. અહીં નિશ્ચય રત્નત્રયના સ્વરૂપનું જ દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે નિર્મળ ધ્યાનની અપેક્ષા રાખે છે. ૩૦.

(રથોદ્ધતા)

**પ્રેરિતાઃ શ્રુતગુણેન શોમુષીકામુકેણ શરવદ્ દૃગાદયઃ ।
બાહ્યવેધ્યવિષયે કૃતશ્રમાશ્ચિદ્રણે પ્રહતકર્મશત્રવઃ ॥૩૧॥**

અનુવાદ :—આગમરૂપ દોરીથી સંયુક્ત એવા બુદ્ધરૂપ ધનુષ્યથી પ્રેરિત સમ્યગ્દર્શનાદિરૂપ બાણ ચૈતન્યરૂપ રણમાં બાહ્ય પદાર્થરૂપ લક્ષ્યના વિષયમાં પરિશ્રમ કરીને કર્મરૂપ શત્રુઓનો નાશ કરી નાખે છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે રણભૂમિમાં દોરીથી સુસજ્જ ધનુષ્ય દ્વારા છોડવામાં આવેલ બાણ લક્ષ્યભૂત શત્રુઓને વીંધીને તેમનો નાશ કરી નાખે છે તેવી જ રીતે અહીં

ચૈતન્યરૂપી રણભૂમિમાં આગમાત્યાસરૂપી દોરીથી બુદ્ધરૂપી ધનુષ્ણને સજજ કરી તેની પ્રેરણાથી પ્રાપ્ત થયેલા સમ્બંધર્ણનાદિરૂપી બાળો દ્વારા કર્મરૂપી શત્રુ પણ નષ્ટ કરી દેવામાં આવે છે. ૩૧.

(રથોદ્ધતા)

ચિત્તવાચ્યકરણીયવર્જિતા નિશ્ચયેન મુનિવૃત્તિરીદ્ધશી ।
અન્યથા ભવતિ કર્મગૌરવાત્ સા પ્રમાદપદવીમુપેયુષઃ ॥૩૨॥

અનુવાદ : નિશ્ચયથી મુનિની વૃત્તિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રહિત એવી હોય છે. તાત્પર્ય એ છે કે તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત હોય છે. પરંતુ પ્રમાદ અવસ્થા પામેલા મુનિને કર્મની અધિકતાને કારણે તે (મુનિવૃત્તિ) આનાથી વિપરીત અર્થાત્ ઉપર્યુક્ત ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. ૩૨.

(રથોદ્ધતા)

સત્ત્વમાધિશશલાજ્ઞનોદયાદુલ્લસત્યમલબોધવારિધિઃ ।
યોગિનો ઽણુસદ્વશં વિભાવ્યતે યત્ત્ર મગ્નમખિલં ચરાચરમ् ॥૩૩॥

અનુવાદ : સમીયીન સમાધિરૂપ ચન્દ્રમાના ઉદ્યથી હર્ષિત થઈને યોગીનો નિર્મણ જ્ઞાનરૂપ સમુદ્ર વૃદ્ધિ પામે છે, જેમાં ઝૂબેલું આ સમસ્ત ચરાચર વિશ્વ અણુ-સમાન પ્રતિભાસે છે. ૩૩.

(રથોદ્ધતા)

કર્મશુષ્કતૃણરાશિરુન્તો ઽષ્ટુદ્ધતે શુચિસમાધિમારુતતાત્ ।
ભેદબોધદહને હૃદિ સ્થિતે યોગિનો ઝાટિતિ ભસ્મસાદ્ધવેત् ॥૩૪॥

અનુવાદ : પવિત્ર સમાધિરૂપ વાયુ દ્વારા યોગીના હૃદયમાં સ્થિત ભેદજ્ઞાનરૂપી અભિન પ્રજ્વલિત થતાં તેમાં કર્મરૂપી સૂક્ષ્મ ધાસનો ઊંચો ઠગલો પણ તરત જ ભસ્મ થઈ જાય છે. ૩૪.

(રથોદ્ધતા)

ચિત્તમત્તકરિણા ન ચેદ્ધતો દુષ્ટબોધવહિનાથવા ।
યોગકલ્પતરુરેષ નિશ્ચિતં વાજ્ઞિતં ફલતિ મોક્ષસત્કલમ् ॥૩૫॥

અનુવાદ : જો તે યોગરૂપી કલ્પવૃક્ષ ઉન્મતા હાથી દ્વારા અથવા

અધિકાર-૧૦ : સદ્ભોધ ચંદ્રોદય]

૨૪૫

મિથ્યાજ્ઞાનરૂપી અજિન દ્વારા નષ્ટ કરવામાં ન આવે તો તે નિશ્ચયથી ઈષ્ટ મોક્ષરૂપી ઉત્તમ ફળ ઉત્પન્ન કરે છે. ઉપ.

(રથોદ્ધતા)

તાવદેવ મતિવાહિની સદા ધાવતિ શ્રુતગતા પુરઃ પુરઃ ।
યાવદત્ર પરમાત્મસંવિદા ભિદ્યતે ન હૃદયં મનીષિણઃ ॥૩૬॥

અનુવાદ : અહીં વિદ્ઘાન સાધુની બુદ્ધિરૂપી નદી આગમમાં સ્થિત થઈને નિરંતર ત્યાં સુધી જ આગળ આગળ દોડે છે જ્યાં સુધી તેનું હૃદય ઉતૃષ્ટ આત્મતત્ત્વના જ્ઞાનથી ભેદાતું નથી.

વિશેષાર્� : આનો અભિપ્રાય એ છે કે વિદ્ઘાન સાધુને જ્યારે ઉતૃષ્ટ આત્માનું સ્વરૂપ સમજવામાં આવી જાય છે ત્યારે તેને શ્રુતના પરિશીલનની વિશેષ આવશ્યકતા નથી રહેતી. કારણ એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ તો આગમના અભ્યાસનું ફળ છે, અને તે તેને પ્રાપ્ત થઈ જ ગયું છે. હવે તેને મોક્ષપદ કાંઈ દૂર નથી. ઉદ્દેશ.

(રથોદ્ધતા)

યઃ કષાયપવનैરચુમ્બિતો બોધવહ્નિરમલોલ્લસદ્ધશः ।
કિં ન મોહતિમિરં વિખણ્ડયન્ ભાસતે જગતિ ચિત્પ્રદીપકઃ ॥૩૭॥

અનુવાદ : જે ચૈતન્યરૂપી દીપક કષાયરૂપી વાયુથી સ્પર્શાયો નથી, જ્ઞાનરૂપી અજિન સહિત છે તથા પ્રકાશમાન નિર્મળ દશાઓ (દ્રવ્ય પર્યાયો) રૂપ દશા (બતી) થી સુશોભિત છે, તે શું સંસારમાં મોહરૂપી અંધકારને નષ્ટ કરતો પ્રતિભાસિત નથી થતો? અર્થાત્ અવશ્ય જ પ્રતિભાસિત થાય છે. ઉદ્દેશ.

(રથોદ્ધતા)

બાધ્યશાસ્ત્રગહને વિહારિણી યા મતિર્બહુવિકલ્પધારિણી ।
ચિત્સ્વરૂપકુલસદ્ધનિર્ગતા સા સતી ન સદ્ધશી કુયોષિતા ॥૩૮॥

અનુવાદ : જે બુદ્ધિરૂપી શ્રી બાધ્ય શાખરૂપી વનમાં ફરનારી છે, અનેક વિકલ્પો ધારણ કરે છે તથા ચૈતન્યરૂપી કુલીન ધરમાંથી નીકળી ચુકી છે, તે પતિત્રતા સમાન સમીયીન નથી, પરંતુ દુરાચારિણી શ્રી સમાન છે. ઉદ્દેશ.

(રથોદ્ધતા)

યस્તુ હેયમિતરચ્ચ ભાવયન્નાયતો હિ પરમાસુમીહતે ।
તસ્ય બુદ્ધિસુપદેશતો ગુરોરાશ્રયેત્ત્વપદમેવ નિશ્ચલમ् ॥૩૯॥

અનુવાદ : જે ભવ્ય જીવ હેય અને ઉપાદેયનો વિચાર કરતો થકો પહેલાની (હેયની) અપેક્ષાએ બીજી (ઉપાદેય) ને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેની બુદ્ધિ ગુરુના ઉપદેશથી સ્થિર આત્મપદ (મોક્ષ)ને જ પ્રાપ્ત કરે છે. ૩૯.

(રથોદ્ધતા)

સુસ એષ બહુમોહનિદ્રયા લડ્દિયતઃ સ્વમબલાદિ પશ્યતિ ।
જાગ્રતોચ્ચવચસા ગુરોર્ગતં સંગતં સકલમેવ દૃશ્યતે ॥૪૦॥

અનુવાદ : મોહરૂપી ગાઢ નિદ્રાને વશીભૂત થઈને સૂતેલો આ જીવ સ્ત્રી-પુત્રાદિ બાધ્ય વસ્તુઓને પોતાની સમજે છે. તે જ્યારે ગુરુના ઊંચા વચન અર્થાત્ ઉપદેશથી જાગી ઉઠે છે ત્યારે સંયોગને પ્રાપ્ત થયેલ તે બધા જ બાધ્ય પદાર્થાને નશ્વર સમજવા માંડે છે. ૪૦.

(રથોદ્ધતા)

જલ્પિતેન બહુના કિમાશ્રયેદ્ર બુદ્ધિમાનમલયોગસિદ્ધયે ।
સામ્યમેવ સકલૈરૂપાધિભિ: કર્મજાલજનિતૌર્વિર્વર્જિતમ् ॥૪૧॥

અનુવાદ : ધણું કહેવાથી શું? બુદ્ધિમાન મનુષ્યે નિર્મળ યોગની સિદ્ધિ માટે કર્મસમૂહથી ઉત્પન્ન થયેલ સમસ્ત ઉપાધિ રહિત એક માત્ર સમતાભાવનો જ આશ્રય કરવો જોઈએ. ૪૧.

(રથોદ્ધતા)

નામમાત્રકથયા પરાત્મનો ભૂરિજન્મકૃતપાપસંક્ષયઃ ।
બોધ વૃત્તરુચયસ્તુ તદ્ભતાઃ કુર્વતે હિ જગતાં પતિં નરમ् ॥૪૨॥

અનુવાદ : પરમાત્માના નામ માત્રની કથાથી જ અનેક જન્મોમાં સંચિત કરેલા પાપોનો નાશ થાય છે. તથા ઉક્ત પરમાત્મામાં સ્થિત જ્ઞાન, ચારિત્ર અને સમ્યગુર્દર્શન મનુષ્યને જગતનો અધીશ્વર બનાવી દે છે. ૪૨.

(રથોદ્ધતા)

ચિત્સ્વરૂપપદલીનમાનસો યઃ સદા સ કિલ યોગિનાયકઃ ।

જીવરાશિરખિલશ્રિદાત્મકો દર્શનીય ઇતિ ચાત્મસંનિભિઃ ॥૪૩॥

અનુવાદ : જે મુનિનું મન ચૈતન્યસ્વરૂપમાં લીન થાય છે તે યોગીઓમાં શ્રેષ્ઠ થઈ જાય છે. સમસ્ત જીવરાશિ ચૈતન્યસ્વરૂપ છે માટે તેમને પોતાના સમાન જ ગણવા જોઈએ. ૪૩.

(રથોદ્ધતા)

અન્તરઙ્ગબહિરઙ્ગયોગતઃ કાર્યસિદ્ધિરખિલેતિ યોગિના ।

આસિતબ્યમનિશં પ્રયત્નતઃ સ્વં પરં સદ્દશમેવ પશ્યતા ॥૪૪॥

અનુવાદ : સર્વ કાર્યોની સિદ્ધિ અંતરંગ અને બહિરંગ યોગથી થાય છે. તેથી યોગીએ નિરંતર પ્રયત્નપૂર્વક સ્વ અને પરને સમદંદિથી દેખતા રહેવું જોઈએ.

વિશેષાર્થ : યોગ શબ્દના બે અર્થ છે—મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને સમાધિ. એમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ જે યોગ છે તે બે પ્રકારનો છે—શુભ અને અશુભ. આમાં શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપનો આસ્ત્ર થાય છે અને તે પ્રમાણે જ જીવને સાંસારિક સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બન્નેય પ્રકારના યોગ શરીર સાથે સંબંધ હોવાના કારણે બહિરંગ કહેવાય છે. અંતરંગ યોગ સમાધિ છે. એનાથી જીવને અવિનશ્બર પદની પ્રાપ્તિ થાય છે. અહીં ગ્રન્થકર્તાએ સ્વ અને પરમાં સમભુદ્ધિ રાખતા યોગીને આ અંતરંગ યોગમાં સ્થિત રહેવા તરફ સંકેત કર્યો છે. ૪૪.

(રથોદ્ધતા)

લોક એષ બહુભાવભાવિતઃ સ્વાર્જિતેન વિવિધેન કર્મણા ।

પશ્યતોઽસ્ય વિકૃતીર્જડાત્મનઃ ક્ષોભમેતિ હૃદયં ન યોગિનઃ ॥૪૫॥

અનુવાદ : આ જનસમૂહ પોતાના કમાયેલા અનેક પ્રકારના કર્મ અનુસાર અનેક અવસ્થાઓ પામે છે. તે અજ્ઞાનીના વિકારો જોઈને યોગીનું મન ક્ષોભ પામતું નથી. ૪૫.

(રથોદ્ધતા)

સુસ એષ બહુમોહનિદ્રયા દીર્ઘકાલમવિરામયા જનઃ ।

શાસ્ત્રમેતદધિગમ્ય સાંપ્રતં સુપ્રબોધ ઇહ જાયતામિતિ ॥૪૬॥

અનુવાદ : આ પ્રાણી નિરંતર રહેનારી મોહરૂપ ગાઢ નિદ્રાથી ઘણા કાળ સુધી સૂતો છે. હવે તેણે અહીં આ શાખનો અભ્યાસ કરીને જાગૃત (સમ્યજ્ઞાની) થઈ જવું જોઈએ. ૪૬.

(રથોદ્ધતા)

ચિત્તસ્વરૂપગાને જયત્યસાવેકદેશવિષયાપિ રમ્યતા ।

ઇષદુદ્ધતવચઃકરૈ: પરૈ: પદ્મનાન્દિવદનેન્દુના કૃતા ॥૪૭॥

અનુવાદ : પદ્મનંદી મુનિના મુખરૂપ ચંદ્રમા દ્વારા કિંચિત્ ઉદ્ય પામેલા ઉત્કૃષ્ટ વચનરૂપ કિરણોથી કરવામાં આવેલી તે રમણીયતા એક દેશનો વિષય કરતી હોવા છતાં પણ ચૈતન્યરૂપ આકાશમાં જયવંત હો. ૪૭.

(શાર્ડૂલવિક્રીડિત)

ત્યક્તાશેષપરિગ્રહઃ શમધનો ગુપ્તિત્રયાલંકૃતઃ

શુદ્ધાત્માનમુપાશ્રિતો ભવતિ યો યોગી નિરાશસ્તતઃ ।

મોક્ષો હસ્તગતો ઽસ્ય નિર્મલમતેરેતાવતૈવ ધ્રુવં

પ્રત્યૂહં કુરુતે સ્વભાવવિષમો મોહો વ વૈરી યદિ ॥૪૮॥

અનુવાદ : જે યોગીએ સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે, જે શાંતિરૂપ સંપત્તિ સહિત છે, ત્રણ ગુપ્તિઓથી અલંકૃત છે તથા શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને આશા રહ્યા હોય (દીથણા કે તૃણા રહ્યા હોય) થઈ ગયા છે તેના માર્ગમાં સ્વભાવથી દુષ્ટ તે મોહરૂપી શત્રુ જો વિધન ન કરે તો એટલા માત્રથી જ મોક્ષ આ નિર્મણબુદ્ધિ યોગીના હાથમાં સ્થિત (છે અભે) સમજવું જોઈએ. ૪૮.

(શાર્ડૂલવિક્રીડિત)

તૈલોક્યે કિમિહાસ્તિ કો ઽપિ સ સુરઃ કિં વા નરઃ કિં ફળી

યસ્માદ્વીર્મમ યામિ કાતરતયા યસ્યાશ્રયં ચાપદિ ।

ઉત્તં યત્પરમેશ્વરેણ ગુરુણા નિઃશેષવાઞ્છાભયં

ભ્રાન્તિકલેશહરં હદિ સુરતિ ચેતતત્ત્વમત્યદ્ભુતમ् ॥૪૯॥

અનુવાદ : મહાન પરમેશ્વર દ્વારા કહેવામાં આવેલું જે ચૈતન્યતત્ત્વ સમસ્ત દીથણા, ભય, ભ્રાન્તિ અને કલેશ દૂર કરે છે તે આશર્વજનક ચૈતન્યતત્ત્વ જો હદ્યમાં

પ્રકાશમાન છે તો પછી ત્રણે લોકમાં અહીં શું એવો કોઈ દેવ છે, એવો કોઈ મનુષ્ય છે અથવા એવો કોઈ સર્વ છે; જેનાથી મને ભય ઉત્પન્ન થાય અથવા આપત્તિ આવતાં હું ડરી જઈને તેના શરણે જાઉં? અર્થાત્ ઉપર્યુક્ત ચૈતન્યસ્વરૂપ હદ્યમાં સ્થિત રહેતાં કદી કોઈનો ભય રહેતો નથી અને તેથી કોઈના શરણે જવાની પણ આવશ્યકતા રહેતી નથી. ૪૮.

(શાર્ડૂલવિક્રીડિત)

તત્ત્વજ્ઞાનસુધાર્ણવં લહરિભર્દૂરં સમુલ્લાસયન્
તૃષ્ણાપત્રવિચિત્રચિત્તકમલે સંકોચમુદ્રાં દધત્ત્ર ।
સદ્વિદ્યાશ્રિતભવ્યકૈરવકુલે કુર્વન્ વિકાસશ્રીયં
યોગીન્દ્રોદયભૂધરે વિજયતે સદ્બોધચન્દોદયઃ ॥૫૦॥

અનુવાદ : જે સદ્બોધચન્દોદય (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રનો ઉદ્ય) તત્ત્વજ્ઞાનરૂપી અમૃતના સમુદ્રને તત્ત્વવિચારરૂપ લહેરો દ્વારા દૂરથી જ પ્રગટ કરે છે, તૃષ્ણારૂપી પાંદડાઓથી વિચિત્ર એવા ચિત્તરૂપી કુમળને સંકોચે છે તથા સમ્યગ્જ્ઞાનનો આશ્રય પામેલા ભવ્ય જીવો રૂપ કુમુદોના સમૂહને વિકસિત કરે છે; તે સદ્બોધ ચન્દોદય (આ પ્રકરણ) મુનીન્દ્રરૂપી ઉદ્યાયળ પર્વત ઉપર જીવંત થાય છે. ૫૦.

આ રીતે સદ્બોધચન્દોદય અધિકાર સમાપ્ત થયો. ૧૦.



૧૧. નિશ્ચયપંચાશત्

[૧૧. નિશ્ચયપંચાશત्]

(આર્યા)

દુર્લક્ષયં જયતિ પરં જ્યોતિર્વાચાં ગણઃ કવીન્દ્રાણામ્ ।
જલમિવ વત્તે યસ્મિન્તલબ્ધમધ્યા બહિલુઠતિ ॥૧॥

અનુવાદ : જેવી રીતે જળ વજની મધ્યમાં પ્રવેશ ન પામતાં બહાર જ દડી પડે છે તેવી જ રીતે જે ઉત્કૃષ્ટ જ્યોતિની મધ્યમાં મહાકવિઓના વચનોનો સમૂહ પણ પ્રવેશ ન પામતાં બહાર જ રહી જાય છે, અર્થાત્ જેનું વર્ણન મહાકવિ પણ પોતાની વાણી દ્વારા કરી શકતા નથી તથા જે ઘણી મુશ્કેલીથી દેખી શકાય છે તે ઉત્કૃષ્ટ જ્યોતિ જ્યવંત હો. ૧.

(આર્યા) *મિદાનં એ.*

મનસો ઽચિન્ત્યં વાચામગોચરં યનમહસ્તનોર્ભિન્નમ્ ।
સ્વાનુભવમાત્રગમ્યં ચિદ્રૂપમમૂર્તમવ્યાદઃ ॥૨॥

અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજના વિષયમાં મનથી કાંઈ વિચાર કરી શકતો નથી, વચનથી કાંઈ કહી શકતું નથી તથા જે શરીરથી ભિન્ન, અનુભવ માત્રથી ગમ્ય અને અમૂર્ત છે; તે ચૈતન્યરૂપ તેજ આપ લોકોની રક્ષા કરો. ૨.

(આર્યા)

વૃપુરાદિપરિત્યક્તે મજ્ઞત્યાનન્દસાગરે મનસિ ।
પ્રતિભાતિ યત્તદેકં જયતિ પરં ચિન્મયં જ્યોતિઃ ॥૩॥

અનુવાદ : મનથી બાધ શરીરાદિ તરફથી ખરીને આનંદરૂપ સમુદ્રમાં દૂબી જતાં

જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ યૈતન્યસ્વરૂપ જ્યોતિ જ્યવંત હો. ૩.
(આર્યા)

સ જયતિ ગુરુર્ગરીયાનું યસ્મામલવચનરાશિમભિજ્ઞગિતિ ।
નશ્યતિ તન્મોહતમો યદવિષયો દિનકરાદીનામુ ॥૪॥

અનુવાદ : જે અજ્ઞાનરૂપ અંધકાર સૂર્યાદિ દ્વારા નષ્ટ કરી શકતો નથી તે જે ગુરુના નિર્મળ વચનરૂપ કિરણોદ્વારા શીંગ જ નષ્ટ થઈ જાય છે તે શ્રેષ્ઠ ગુરુ જ્યવંત હો. ૪.

(આર્યા)

આસ્તાં જરાદિદુઃખં સુખમાપિ વિષયોઽદ્વં સતાં દુઃખમુ ।
તैર્મન્યતે સુખં યત્તન્મુક્તૌ સા ચ દુઃસાધ્યા ॥૫॥

અનુવાદ : વૃદ્ધત્વ આદ્ધિના નિમિત્તે ઉત્પન્ન થનારું દુઃખ તો દૂર જ રહે, પરંતુ વિષયભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાસિત થાય છે. તેઓ જેને વાસ્તવિક સુખ માને છે તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. ૫.

(આર્યા)

શ્રુતપરિચિતાનુભૂતં સર્વ સર્વસ્ય જન્મને સુચિરમુ ।
ન તુ મુક્તયે�ત્ત્ર સુલભા શુદ્ધાત્મજ્યોતિરુપલબ્ધિઃ ॥૬॥

અનુવાદ : લોકમાં સર્વ પ્રાણીઓએ ચિરકાળથી જન્મ-મરણરૂપ સંસારના કારણભૂત વસ્તુઓના વિષયમાં સાંભળ્યું છે, પરિચય પ્રાપ્ત કર્યો છે તથા અનુભવ પણ કર્યો છે. પરંતુ જે શુદ્ધ આત્માની જ્યોતિ મુક્તિના કારણભૂત છે તેની ઉપલબ્ધિ તેમને સુલભ નથી. ૬.

(આર્યા)

બોધો�પિ યત્ત્ર વિરલો વૃત્તિર્વાચામગોચરે બાઢમુ ।
અનુભૂતિસ્તત્ત્ર પુનર્દુર્લક્ષ્યાત્મનિ પરં ગહનમુ ॥૭॥

અનુવાદ : જે આત્મા વચનોથી અગોચર છે-વિકલ્પાતીત છે-તે આત્મતત્ત્વના

વિષયમાં પ્રાય: શાન જ થતું નથી. તેના વિષયમાં સ્થિતિ તો વિશેષ કઠિન છે અને તેનો અનુભવ તો દુર્લભ જ છે. તે આત્મતત્ત્વ અત્યંત દુર્ગમ છે. ૭.

(આર્યા)

વ્યવહૃતિરબોધજનબોધનાય કર્મક્ષયાય શુદ્ધનયઃ ।
સ્વાર્થ મુમુક્ષુરહમિતિ વક્ષ્યે તદાશ્રિતં કિંचિત् ॥૮॥

અનુવાદ : વ્યવહારનય અજ્ઞાનીજનોને પ્રતિબોધ કરવા માટે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કર્માંતા નાશનું કારણ છે. તેથી મોક્ષની અભિલાષા રાખનાર હું (પદ્મનંદી) સ્વના નિમિત્તે શુદ્ધ નિશ્ચયનયના આશ્રયે પ્રયોજનભૂત આત્મસ્વરૂપનું વર્ણન કરું છું. ૮.

(આર્યા)

વ્યવહારો ઽભૂતાર્�ો ભૂતાર્થો દેશિતસ્તુ શુદ્ધનયઃ ।
શુદ્ધનયમાશ્રિતા યે પ્રાપુવન્તિ યતયઃ પદં પરમમ् ॥૯॥

અનુવાદ : વ્યવહારનયને અસત્ય પદાર્થનો વિષય કરનાર અને નિશ્ચયનયને યથાર્થ વસ્તુનો વિષય કરનાર કહેવામાં આવેલ છે. જે મુનિ શુદ્ધ નિશ્ચયનયનો આશ્રય લે છે તે ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે છે. ૯.

(આર્યા)

તત્ત્વं વાગતિર્વિતિ વ્યવહૃતિમાસાદ્ય જાયતે વાચ્યમ् ।
ગુણપર્યયાદિવિવૃતે: પ્રસરતિ તચ્ચાપિ શતશાખ્યમ् ॥૧૦॥

અનુવાદ : વસ્તુનું યથાર્થ સ્વરૂપ વચન અગોચર છે અર્થાત્ તે વચન દ્વારા કહી શકતું નથી. તે વ્યવહારનો આશ્રય લઈને જ વચન દ્વારા કહેવાને યોગ્ય બને છે તે પણ ગુણો અને પર્યાયો આદિના વિવરણથી સેંકડો શાખાઓમાં વિસ્તાર પામે છે. ૧૦.

(આર્યા)

મુખ્યોપચારવિવૃતિં વ્યવહારોપાયતો યતઃ સત્તઃ ।
જ્ઞાત્વા શ્રયન્તિ શુદ્ધં તત્ત્વમિતિ વ્યવહૃતિઃ પૂજ્યા ॥૧૧॥

અનુવાદ : સજ્જન મનુષ્ય વ્યવહારનયના આશ્રયે જ મુખ્ય અને ઉપચારભૂત

કથન જાણીને શુદ્ધ સ્વરૂપનો આશ્રય લે છે તેથી તે વ્યવહાર (પૂજય) ગ્રાહ્ય છે. ૧૧.
(આર્યા)

આત્મનિ નિશ્ચયબોધસ્થિતયો રત્નત્રયં ભવક્ષતયે ।
ભૂતાર્થપથપ્રસ્થિતબુદ્ધેરાત્મૈવ તત્ત્વિતયમ् ॥૧૨॥

અનુવાદ : આત્માના વિષયમાં દેખતા (સમ્યગ્દર્શન), જ્ઞાન અને સ્થિતિ (ચારિત્ર)નું રત્નત્રય સંસારના નાશનું કારણ છે. પરંતુ જેની બુદ્ધિ શુદ્ધ નિશ્ચયનયના માર્ગમાં પ્રવૃત્ત થઈ ચુકી છે તેને તે ત્રણો (સમ્યગ્દર્શનાદિ) એક આત્મસ્વરૂપ જ છે- તેનાથી ભિન્ન નથી. ૧૨.

(આર્યા)

સમ્યક્સુખબોધદૃશાં ત્રિત્યમખણ્ડં પરાત્મનો રૂપમ् ।
તત્ત્વ તત્પરો યઃ સ એવ તલ્લાદ્વિકૃતકૃત્યઃ ॥૧૩॥

અનુવાદ : સમ્યક્ સુખ (ચારિત્ર), જ્ઞાન અને દર્શન આ ત્રણોની એકતા પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. તેથી જે જીવ ઉપર્યુક્ત પરમાત્મસ્વરૂપમાં લીન થાય છે તે જ તેમની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૩.

(આર્યા)

અગનાવિવોષ્ણભાવઃ સમ્યગ્બોધો ઽસ્તિ દર્શનં શુદ્ધમ् ।
જ્ઞાતં પ્રતીતમાભ્યાં સત્ત્વાસ્થ્યં ભવતિ ચારિત્રમ् ॥૧૪॥

અનુવાદ : જેવી રીતે અભેદ સ્વરૂપે અજ્ઞિનમાં ઉષ્ણતા રહે છે તેવી જ રીતે આત્મામાં જ્ઞાન છે. આ પ્રકારની પ્રતીતિનું નામ શુદ્ધ સમ્યગ્દર્શન અને તે જ પ્રકારે જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ બન્નેની સાથે ઉક્ત આત્માના સ્વરૂપમાં સ્થિત થવાનું નામ સમ્યક્યારિત્ર છે. ૧૪.

(આર્યા)

વિહિતાભ્યાસા બહિર્થવેધસંવન્ધિનો દ્વારાદિશરાઃ ।
સફળાઃ શુદ્ધાત્મરણે છિન્દિતકર્મારિસંઘાતાઃ ॥૧૫॥

અનુવાદ : જે સમ્યગ્દર્શન આદિરૂપ બાણ બાહ્ય વસ્તુરૂપ વેધ (લક્ષ્ય)

૨૫૪

[પદ્મનાનિઃપંચવિંશતિ:

સાથે સંબંધ રાખે છે તથા જેમણે આ કાર્યનો અભ્યાસ પણ કર્યો છે તે સમ્યગ્દર્શનાદિરૂપ બાણ શુદ્ધ આત્મારૂપ રણમાં કર્મરૂપ શત્રુઓના સમૂહનો નાશ કરીને સફળ થાય છે. ૧૫.

(આર્યા)

હિંસોજીસ્ત એકાકી સર્વોપદ્રવસહો વનસ્થો ઽપિ ।
તરુરિવ નરો ન સિધ્યતિ સમ્યગ્બોધાદતે જાતુ ॥૧૬॥

અનુવાદ : જે મનુષ્ય વૃક્ષ સમાન હિંસા કર્મ રહિત છે, એકલો છે અર્થાત् કોઈ સહાયકની અપેક્ષા રાખતો નથી, સમસ્ત ઉપદ્રવો સહન કરે છે તથા વનમાં સ્થિત પણ છે છતાં પણ તે સમ્યગ્જ્ઞાન વિના કદી પણ સિદ્ધ થઈ શકતો નથી.

વિશેષાર્થ : વનમાં એકલું રહેલ જે વૃક્ષ ઢંડી અને ગરમી આદિના ઉપદ્રવો સહન કરે છે તથા સ્થાવર હોવાના કારણે હિંસાકર્મથી પણ રહિત છે છતાં ય સમ્યગ્જ્ઞાન રહિત હોવાના કારણે જેમ તે કદી મુક્તિ પામી શકતું નથી તે જ રીતે મનુષ્ય સાધુ થઈને સર્વ પ્રકારના ઉપદ્રવો અને પરિષહો સહન કરે છે, ઘર છોડીને વનમાં એકાકીપણે રહે છે તથા પ્રાણીઓના ઘાતથી વિરત છે; છતાં પણ જો તેણે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તો તે પણ કદી મુક્ત થઈ શકતો નથી. ૧૬.

(આર્યા)

અસ્પૃષ્ટમબદ્ધમનન્યમયુતમવિશેષભ્રમોપેતઃ ।
યઃ પશ્યત્યાત્માનં સ પુમાનું ખલું શુદ્ધનયનિષ્ઠઃ ॥૧૭॥

અનુવાદ : જે ભવ્ય જીવ ભ્રમરહિત થઈને પોતાને કર્મથી અસ્પૃષ્ટ, બંધરહિત, એક, પરના સંયોગ રહિત તથા પર્યાયના સંબંધ રહિત શુદ્ધ દ્રવ્યસ્વરૂપને દેખે છે તેને નિશ્ચયથી શુદ્ધ નયમાં નિષ્ઠા રાખનાર સમજવો જોઈએ. ૧૭.

(આર્યા)

શુદ્ધાચ્છુદ્ધમશુદ્ધં ધ્યાયન્નાપ્રોત્યશુદ્ધમેવ સ્વમ् ।
જનયતિ હેમ્નો હૈમં લોહાલ્લો [લૌ] હં નરઃ કટકમ् ॥૧૮॥

અનુવાદ : જીવ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે તથા વ્યવહારનયનું અવલંબન લઈને અશુદ્ધ આત્માનો વિચાર કરતો અશુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે-મનુષ્ય સોનામાંથી સોનામય કરું અને લોઢામાંથી લોહમય કરું જ ઉત્પન્ન કરે છે. ૧૮.

(આર્યા)

સાનુષાનવિશુદ્ધે દૃગ્બોધે જૃમ્ભિતે કુતો જન્મ ।
ઉદિતે ગભસ્તિમાલિનિ કિં ન વિનશ્યતિ તમો નૈશમ્ર ॥૧૯॥

અનુવાદ : ચારિત્ર સહિત વિશુદ્ધ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વૃદ્ધિ પામતાં ભલા જન્મ-મરણરૂપ સંસાર ક્યાંથી રહી શકે? અર્થાતું રહી શકતો નથી. ઠીક છે-સૂર્યનો ઉદ્ય થતાં શું રાત્રિનો અંધકાર નાથ નથી થતો? અવશ્ય જ તે નાથ થઈ જાય છે. ૧૮.

(આર્યા)

આત્મભુવિ કર્મબીજાચિત્તતરૂર્યત્કલં ફલતિ જન્મ ।
મુક્ત્યર્થિના સ દાહ્યો ભેદજ્ઞાનોગ્રદાવેન ॥૨૦॥

અનુવાદ : આત્મારૂપ પુણી ઉપર કર્મરૂપ બીજથી ઉત્પન્ન થયેલ આ ચિત્તરૂપ વૃક્ષ જે સંસારરૂપ ફળ ઉત્પન્ન કરે છે તેને મોક્ષાભિલાષી જીવે ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણ તીવ્ર અજિન દ્વારા બાળી નાખવું જોઈએ. ૨૦.

(આર્યા)

અમલાત્મજલં સમલં કરોતિ મમ કર્મકર્દમસ્તદાપિ ।
કા ભીતિઃ સતિ નિશ્ચિતભેદકરજ્ઞાનકતકફલે ॥૨૧॥

અનુવાદ : જોકે કર્મરૂપી ક્રીયડ મારા નિર્મળ આત્મારૂપ જળને મલિન કરે છે તો પણ નિશ્ચિત ભેદને પ્રગટ કરનાર જ્ઞાન (ભેદજ્ઞાન) રૂપ નિર્મળી ફળ હોતાં મને તેનાથી ભય શાનો? અર્થાતું કાંઈ પણ ભય નથી.

વિશેષાર્થ : જેમ ક્રીયડથી મલિન કરવામાં આવેલું પાણી નિર્મળી ફળ (ફટકડી) નાખતાં સ્વચ્છ થઈ જાય છે તેવી જ રીતે કર્મના ઉદ્યથી ઉત્પન્ન દુષ્ટ કોધાદિ વિકારો દ્વારા મલિન થયેલ આત્મા સ્વ-પરના ભેદજ્ઞાન દ્વારા નિશ્ચયથી નિર્મળ થઈ જાય છે. તેથી વિવેકી (ભેદજ્ઞાની) જીવને કર્મકૃત તે મલિનતાનો કાંઈ પણ ભય રહેતો નથી. ૨૧.

(આર્યા)

અન્યોऽહમન્યમેતચ્છરીરમપિ કિં પુનર્ બહિર્રથાઃ ।
વ્યાભિચારી યત્ર સુતસ્તત્ર કિમરયઃ સ્વકીયાઃ સ્યુઃ ॥૨૨॥

અનુવાદ : જો હું અન્ય છું અને આ શરીર પણ અન્ય છે તો શું પ્રત્યક્ષ ભિન્ન દેખાતાં બાધ્ય પદાર્થ (શ્રી-પુત્ર આદિ) મારાથી ભિન્ન નથી? અર્થાત् તેઓ તો અવશ્ય જ ભિન્ન છે. બરાબર છે જ્યાં પોતાનો પુત્ર જ વ્યભિચારી હોય અર્થાત્ પોતાને અનુકૂળ ન હોય ત્યાં શું શત્રુ પોતાને અનુકૂળ હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૨૨.

(આર્યા)

વ્યાધિસ્તુદત્તિ શરીરં ન મામમૂર્તિ વિશુદ્ધબોધમયમ् ।
અગ્નિર્દહતિ કુટીરં ન કુટીરાસક્તમાકાશમ् ॥૨૩॥

અનુવાદ :-રોગ શરીરને પીડા કરે છે, તે અમૂર્ત અને નિર્મળ જ્ઞાનસ્વરૂપ મને (આત્માને) પીડા કરતો નથી. યોગ્ય છે—અગ્નિ ઝુંપડીને જ બાળે છે, નહિ કે ઝુંપડી સાથે આકાશને પણ. ૨૩.

(આર્યા)

વૃપુરાશ્રિતમિદમખિલં ક્ષુધાદિભિર્ભવતિ કિમપિ યદસાતમ् ।
નો નિશ્ચયેન તન્મે યદહં બાધાવિનિર્મુક્તઃ ॥૨૪॥

અનુવાદ : ભૂખ—તરસ વગેરે દ્વારા જે કંઈ પણ હુઃખ થાય છે તે બધું શરીરાશ્રિત છે. નિશ્ચયથી તે (હુઃખ) મને નથી કારણ કે હું સ્વભાવે બાધા રહિત છું. ૨૪.

(આર્યા)

નૈવાત્મનો વિકારः ક્રોધાદિઃ કિંતુ કર્મસંબન્ધાત् ।
સ્ફટિકમणેરિવ રક્તત્વમાશ્રિતાત્પુષ્પતો રક્તાત् ॥૨૫॥

અનુવાદ : કોધ આદિ વિકાર આત્માના નથી, પરંતુ તેઓ કર્મ સાથે સંબંધવાળા હોવાને લીધે તેનાથી ભિન્ન છે. જેમ—લાલ ફૂલના આશ્રયે સ્ફટિકમણિને પ્રાપ્ત થયેલ લાલિમા વાસ્તવમાં તેની નથી હોતી. ૨૫.

(આર્યા)

કુર્યાત્કર્મ વિકલ્પં કિ મમ તેનાતિશુદ્ધરૂપસ્ય ।
મુખસંયોગજવિકૃતેર્ન વિકારી દર્પણો ભવતિ ॥૨૬॥

અનુવાદ : કર્મ વિકલ્પ ભલે કરે, અતિશય શુદ્ધ સ્વરૂપ યુક્ત એવા મારી તેના દ્વારા શી હાનિ થઈ શકે? કાંઈ પણ નહિ. બરાબર છે-મુખના સંયોગથી ઉત્પન્ન થયેલ વિકારના કારણે કાંઈ દર્પણ વિકારયુક્ત થઈ જતું નથી. ૨૬.

(આર્યા)

આસ્તાં બહિરૂપધિચયસ્તનુવચનવિકલ્પજાતમયપરમ् ।
કર્મકૃતત્વાન્મત્તઃ કુતો વિશુદ્ધસ્ય મમ કિંचિત् ॥૨૭॥

અનુવાદ : બાધ્ય ઉપાધિઓનો સમૂહ (શ્રી-પુત્ર-ધનાદિ) તો દૂર જ રહે, પરંતુ શરીર અને વચન સંબંધી વિકલ્પોનો સમૂહ પણ કર્મકૃત હોવાના કારણે મારાથી ભિન્ન છે. હું સ્વભાવે શુદ્ધ હું તેથી કોઈ પણ વિકાર મારો ક્યાંથી હોઈ શકે? ન હોઈ શકે. ૨૭.

(આર્યા)

કર્મ પરં તત્કાર્ય સુખમસુખં વા તદેવ પરમેવ ।
તસ્મિન્ હર્ષવિષાદૌ મોહી વિદધાતિ ખલુ નાન્યઃ ॥૨૮॥

અનુવાદ : કર્મ ભિન્ન છે તથા તેના કાર્યભૂત જે સુખ અને દુઃખ છે તે પણ ભિન્ન છે. કર્મના કાર્યભૂત તે સુખ અને દુઃખમાં નિશ્ચયથી અજ્ઞાની જીવ જ હર્ષ અને વિષાદ કરે છે, નહિ કે જ્ઞાની જીવ. ૨૮.

(આર્યા)

કર્મ ન યથા સ્વરૂપં ન તથા તત્કાર્યકલ્પનાજાતમ् ।
તત્ત્રાત્મમતિવિહીનો મુમુક્ષુરાત્મા સુખી ભવતિ ॥૨૯॥

અનુવાદ : જેવી રીતે કર્મ આત્માનું સ્વરૂપ નથી તેવી જ રીતે તેના કાર્યભૂત વિકલ્પોનો સમૂહ પણ આત્માનું સ્વરૂપ નથી. તેથી તેમનામાં આત્મબુદ્ધિ અર્થાત્ મમત્વબુદ્ધિથી રહિત થયેલ મોક્ષાભિલાષી જીવ સુખી થાય છે. ૨૯.

(આર્યા)

કર્મકૃતકાર્યજાતે કર્મેવ વિધૌ તથા નિષેધે ચ ।
નાહમતિશુદ્ધબોધો વિધૂતવિશોપધિર્નિત્યમ् ॥૩૦॥

અનુવાદ : કર્મકૃત કાર્યસમૂહ (રાગ-દેખાદિ) અને તેની વિધિ તથા નિષેધમાં કર્મ જ કારણ છે. હું (આત્મા) નથી. હું તો સદા અતિશય નિર્મળ જ્ઞાનસ્વરૂપ હોઈને સમસ્ત ઉપાધિ રહિત છું. ૩૦.

(આર્યા)

બાહ્યાયામપि વિકૃતૌ મોહી જાગર્તિ સર્વદાત્મેતિ ।
કિં નોપભુક્તહેમો હેમ ગ્રાવાણમપિ મનુતે ॥૩૧॥

અનુવાદ : અજ્ઞાની જીવ કર્મકૃત બાહ્ય વિકારમાં પણ નિરંતર ‘હું છું’ એમ માને છે. બરાબર છે.-જોણે ધતૂરાનું ફળ ખાદું હોય તે શું પથ્થરને પણ સુવર્ણ નથી માનતો? માને જ છે.

વિશેષાર્થ : જેવી રીતે ધતૂરાનું ફળ ખાઈને મનુષ્ય તેના ઉન્માદથી પથ્થરને પણ સુવર્ણ માને છે તેવી જ રીતે મિથ્યાજ્ઞાની જીવ મિથ્યાત્વના પ્રભાવથી જે બાહ્ય વિકાર (રાગ-દેખ, શ્રી, પુત્ર અને ધન આદિ) કર્મજનિત હોઈને આત્માથી બિન્ન છે તેમને તે પોતાના માને છે. ૩૧.

(આર્યા)

સતિ દ્વિતીયે ચિન્તા કર્મ તત્ત્વેન વર્તતે જન્મ ।
એકો ઽસ્મિ સકલચિન્તારહિતો ઽસ્મિ મુમુક્ષુરિતિ નિયતમ્ ॥૩૨॥

અનુવાદ : આત્માથી બિન્ન કોઈ બીજો પદાર્થ હોતાં તેને માટે ચિન્તા ઉત્પન્ન થાય છે, તેનાથી કર્મનો બંધ થાય છે તથા તે કર્મબંધથી ફરી જન્મ પરંપરા ચાલે છે. પરંતુ હું નિશ્ચયથી એક છું અને તેથી સમસ્ત ચિન્તાઓથી રહિત થયો થકો મોક્ષનો અભિલાષી છું. ૩૨.

(આર્યા)

યાદશયપિ તદ્દશયપિ પરતશ્ચિન્તા કરોતિ ખલુ બન્ધમ્ ।
કિં મમ તયા મુમુક્ષો: પરેણ કિં સર્વદૈકસ્ય ॥૩૩॥

અનુવાદ : અન્ય પદાર્થના નિભિતે જે કોઈ પણ પ્રકારની ચિન્તા થાય છે તે નિશ્ચયથી કર્મબંધ કરે છે. મોક્ષના ઈચ્છુક મારે તે ચિન્તાથી અને પરવસ્તુઓથી પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી મારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ છે કે હું એમનાથી બિન્ન હોઈને સર્વદા એક સ્વરૂપ છું. ૩૩.

(આર્યા)

મયિ ચેતઃ પરજાતં તચ્ચ પરં કર્મ વિકૃતિહેતુરતઃ ।
કિં તેન નિર્વિકારઃ કેવળમહમમલબોધાત્મા ॥૩૪॥

અનુવાદ : ભારામાં જે ચિત્ત છે તે પરથી ઉત્પન્ન થયેલ છે અને તે પર (જેનાથી ચિત્ત ઉત્પન્ન થયું છે) કર્મ છે કે જે વિકારનું કારણ છે. તેથી ભારે તેનાથી શું પ્રયોજન છે? કાંઈ પણ નથી. કારણ કે હું વિકાર રહિત, એક અને નિર્મળ જ્ઞાનસ્વરૂપ છું. ઉ૪.

(આર્યા)

ત્યાજ્યા સર્વા ચિન્તેતિ બુદ્ધિરાવિષ્કરોતિ તત્ત્વમ્ ।
ચન્દ્રોદયાયતે યચ્છૈતન્યમહોદધૌ ઝાગિતિ ॥૩૫॥

અનુવાદ : સર્વ ચિન્તા ત્યાગવા યોગ્ય છે. આ જ્ઞાતની બુદ્ધિ તે તત્ત્વને પ્રગટ કરે છે કે જે ચૈતન્યસ્વરૂપ મહાસમુક્રની વૃદ્ધિમાં શીધ જ ચન્દ્રમાનું કામ કરે છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે ચન્દ્રમાનો ઉદ્ય થતાં સમુક્ર વૃદ્ધિ પામે છે તેવી જ રીતે ‘સર્વ પ્રકારની ચિન્તા હેય છે’ આ ભાવનાથી ચૈતન્યસ્વરૂપ પણ વૃદ્ધિ પામે છે. ઉ૫.

(આર્યા)

ચૈતન્યમસંપૃક્તં કર્મવિકારેણ યત્તદેવાહમ્ ।
તસ્ય ચ સંસ્કૃતિજન્મપ્રભૂતિ ન કિંચિત્કૃતશ્રિન્તા ॥૩૬॥

અનુવાદ : જે ચેતન તત્ત્વ કર્મકૃત વિકારના સંસર્ગ રહિત છે તે જ હું છું. તેને (ચૈતન્યસ્વરૂપ આત્માને) સંસાર અને જન્મ-મરણાદિ કાંઈ પણ નથી. તો પછી ભલા ભારે (આત્માને) ચિન્તા કર્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ઉ૬.

(આર્યા)

ચિત્તેન કર્મણા ત્વં બદ્ધો યદિ બધ્યતે ત્વયા તદતઃ ।
પ્રતિબન્દીકૃતમાત્મન્ મોચયતિ ત્વાં ન સંદેહ: ॥૩૭॥

અનુવાદ : હે આત્મન્! તું મન દ્વારા કર્મથી બંધાયો છો, જો તું તે મનને

બાંધી દે અર્થात् તેને વશ કરી લે તો એનાથી તે પ્રતિબંધી સ્વરૂપ થઈને તને છોડાવી દેશો, એમાં શંકા નથી. ૩૭.

(આર્યા)

**નૃત્વતરોર્વિષયસુખચ્છાયાલાભેન કિં મનઃપાન્થ ।
ભવદુઃખક્ષુત્પીડિત તુષ્ટોઽસિ ગૃહાણ ફલમમૃતમ् ॥૩૮॥**

અનુવાદ : હે સાંસારિક દુઃખરૂપ ક્ષુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય પર્યાપ્તરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર.

વિશેષાર્થ : જેમ સૂર્યના તાપથી સંતપ્ત કોઈ મુસાફર માર્ગમાં છાયાયુક્ત વૃક્ષ મેળવીને તેની કેવળ છાયાથી જ સંતુષ્ટ થઈ જાય છે, જો તે તેમાં લાગેલા ફળોનું ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે તો તેને એનાથી પણ ક્યાંય અધિક સુખ પ્રાપ્ત થઈ શકે. બરાબર એ જ પ્રમાણે આ જીવ મનુષ્ય પર્યાપ્ત પામીને તેનાથી પ્રાપ્ત થતા વિષયસુખનો અનુભવ કરતો થકો એટલા માત્રથી જ સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ તે અજ્ઞાનવશ એમ નથી વિચારતો કે આ મનુષ્ય પર્યાપ્તથી તો તે અજર-અમર પદ (મોક્ષ) પ્રાપ્ત કરી શકાય છે કે જે અન્ય દેવાદિ પર્યાપ્તથી (મેળવવું) દુર્લભ છે. તેથી અહીં મનને સંબોધન કરીને એ ઉપદેશ આપવામાં આવ્યો છે કે તું આ દુર્લભ મનુષ્ય પર્યાપ્ત પામીને તે અસ્થિર વિષય સુખમાં જ સંતુષ્ટ ન થા, પરંતુ સ્થિર મોક્ષસુખ પ્રાપ્ત કરવાનો ઉદ્ઘમ કર. ૩૮.

(આર્યા)

**સ્વાન્ત ધ્વાન્તમશેષં દોષોજ્જિતકર્મવિમ્બમિવ માર્ગે ।
વિનિહન્તિ નિરાલમ્બે સંચરદનિશં યતીશાનામ્ ॥૩૯॥**

અનુવાદ : મુનિઓનું મન સૂર્યબિંબ સમાન આલંબન રહિત માર્ગ નિરંતર સંચાર કરતું થકું દોષ રહિત થઈને સમસ્ત અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે.

વિશેષાર્થ : જેમ સૂર્યનું બિંબ નિરાધાર આકાશમાર્ગ ગમન કરતું થકું દોષા (રાત્રિ) ના સંબંધ રહિત થઈને સમસ્ત અંધકારનો નાશ કરી નાખે છે તેવી જ રીતે મુનિઓનું મન અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ આશ્રય રહિત મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈને દોષોના સંસર્ગ રહિત થતું થકું સમસ્ત અજ્ઞાનનો નાશ કરી નાખે છે. ૩૯.

(આર્યા)

સંવિચ્છિખિના ગલિતે તનુમૂષાકર્મમદનમયવપુષિ ।
સ્વમિવ સ્વં ચિદ્રૂપં પશ્યન્ યોગી ભવતિ સિદ્ધઃ ॥૪૦॥

અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપ અદ્વિતીયાના નિમિત્તે શરીરરૂપ બીબામાંથી કર્મરૂપ મીણનું શરીર ગળી જતાં આકાશ સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપને દેખનાર યોગી સિદ્ધ થઈ જાય છે.

વિશેષાર્થ : જેમ અદ્વિતીયાના સંબંધથી બીબામાં રહેલું મીણ ગળી જતાં ત્યાં શુદ્ધ આકાશ જ બાકી રહી જાય છે તેવી જ રીતે સમ્યગ્જ્ઞાન દ્વારા શરીરમાંથી કાર્મણ પિંડ નિષ્ઠાર્થ થઈ જતાં પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તેનું અવલોકન કરતા યોગી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ૪૦.

(આર્યા)

અહમેવ ચિત્તસ્વરૂપશ્રીદ્રૂપસ્યાશ્રયો મમ સ એવ ।
નાન્યત્ર કિમપિ જડત્વાત્ત્રીતિઃ સદ્ધશેષુ કલ્યાણી ॥૪૧॥

અનુવાદ : હું જ ચિત્તસ્વરૂપ છું અને ચિત્તસ્વરૂપ જે હું છું તેથી મારો આશ્રય પણ તે જ ચિત્તસ્વરૂપ છે. તેના સિવાય જડ હોવાથી બીજો કોઈ મારે આધાર હોઈ શકે નહિ એ યોગ્ય પણ છે કેમ કે સમાન વ્યક્તિઓમાં જે પ્રેમ હોય છે તે જ કલ્યાણકારક થાય છે. ૪૧.

(આર્યા)

સ્વપરવિભાગાવગમે જાતે સમ્યક્ પરે પરિત્યક્તે ।
સહજૈકબોધરૂપે તિષ્ઠત્યાત્મા સ્વયં સિદ્ધઃ ॥૪૨॥

અનુવાદ : સ્વ અને પરના વિભાગનું (ભેદનું) જ્ઞાન થઈ જતાં આ આત્મા સારી રીતે પરને છોડીને સ્વયં સિદ્ધ થયો થકો એક પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. ૪૨.

(આર્યા)

હેયોપાદેયવિભાગભાવનાકથ્યમાનમપિ તત્ત્વમ् ।
હેયોપાદેયવિભાગભાવનાવર્જિતં વિદ્ધિ ॥૪૩॥

અનુવાદ : હેય અને ઉપાદેયના વિભાગની ભાવનાથી કહેવામાં આવતું તત્ત્વ પણ તે હેય-ઉપાદેયવિભાગની ભાવના રહિત છે એમ જાણવું જોઈએ.

વિશેષાર્થ : પર પદાર્થ હેય છે અને ચૈતન્યમય આત્માનું સ્વરૂપ ઉપાદેય છે, એ રીતે વ્યવહારનયની અપેક્ષાએ હેય-ઉપાદેય વિભાગની ભવનાથી જોકે આત્મતત્ત્વનું વર્ણન કરવામાં આવે છે; છતાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમસ્ત વિકલ્પોથી રહિત હોવાને કારણે ઉક્ત હેય-ઉપાદેયવિભાગની ભાવનાથી પણ રહિત છે. ૪૩.

(આર્યા)

પ્રતિપદ્યમાનમાપિ ચ શ્રુતાદ્વિશુદ્ધં પરાત્મનસ્તત્ત્વમ् ।
ઉર્રીકરોતુ ચેતસ્તદપિ ન તચ્ચેતસો ગમ્યમ् ॥૪૪॥

અનુવાદ : જો કે મન આગમની સહાયથી વિશુદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણીને જ તેનો સ્વીકાર કરે છે છતાં પણ તે આત્મતત્ત્વ વાસ્તવમાં તે મનનો વિષય નથી.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આત્મતત્ત્વનું પરિશ્શાન આગમ દ્વારા થાય છે અને તે આગમના વિચારમાં મન કારણ છે કારણ કે મન વિના કોઈ પ્રકારનો ય વિચાર સંભવિત નથી. આ રીતે તે આત્મતત્ત્વનો સ્વીકાર કરવામાં જો કે મન કારણ થાય છે, છતાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે આત્મતત્ત્વ કેવળ સ્વાનુભવ દ્વારા જ ગમ્ય છે, નહિ કે અન્ય મન આદિ દ્વારા. ૪૪.

(આર્યા)

અહમેકાક્યદૈતં દૈતમહં કર્મકલિત ઇતિ બુદ્ધેः ।
આદ્યમનપાયિ મુક્તેરિતરવિકલ્પં ભવસ્ય પરમ् ॥૪૫॥

અનુવાદ : “હું એકલો છું.” આ પ્રકારની બુદ્ધિથી અદૈત તથા “હું કર્મ સંયુક્ત છું” આ પ્રકારની બુદ્ધિથી દૈત થાય છે. આ બન્નેમાંથી પ્રથમ વિકલ્પ (અદૈત) અવિનશ્ચર મુક્તિનું કારણ અને દ્વિતીય (દૈત) વિકલ્પ કેવળ સંસારનું કારણ છે. ૪૫.

(આર્યા)

બદ્ધો મુક્તો ઽહમથ દૈતે સતિ જાયતે નનુ દૈતમ् ।
મોક્ષાયેત્સુભ્યમનોવિકલ્પરહિતો ભવતિ મુક્તઃ ॥૪૬॥

અનુવાદ : હું બદ્ધ છું અથવા મુક્ત છું, આ પ્રકારની દૈતબુદ્ધિ થતાં નિશ્ચયથી

અધિકાર-૧૧ : નિશ્ચયપંચાશત्]

૨૬૩

દેત થાય છે. તેથી જે યોગી મોક્ષના નિભિતે આ બન્ને વિકલ્પોથી રહિત થઈ ગયા છે તે મુક્ત થઈ જાય છે. ૪૬.

(આર્યા)

ગતભાવિભવદ્ભાવાભાવપ્રતિભાવભાવિતં ચિત્તમ् ।
અભ્યાસાચ્છિદ્રૂપं પરમાનન્દાન્વિતં કુરુતે ॥૪૭॥

અનુવાદ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થના અભાવની ભાવનાથી પરિપૂર્ણ ચિત્ત અભ્યાસના બળથી ચૈતન્યસ્વરૂપને ઉત્કૃષ્ટ આનંદથી સહિત કરી દે છે.

વિશેષાર્થ : નિશ્ચયથી હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું, તેના સિવાય બીજો કોઈ પણ પદાર્થ મારો ન તો થયો હતો, ન વર્તમાનમાં છે અને ન ભવિષ્યમાં થવાનો; આ પ્રકારે જ્યારે આ મન અદેતની ભાવનાથી દેખતા પામી જાય છે ત્યારે જીવને પરમાનંદસ્વરૂપ પદ પ્રાપ્ત થાય છે. ૪૭.

(આર્યા)

બદ્ધं પશ્યનું બદ્ધો મુક્તં મુક્તો ભવેત્સદાત્માનમ् ।
યાતિ યદીયેન પથા તદેવ પુરમશ્નુતે પાન્થઃ ॥૪૮॥

અનુવાદ : જે જીવ આત્માને નિરંતર કર્મથી બંધાયેલો દેખે છે તે કર્મથી બંધાયેલો જ રહે છે પરંતુ જે તેને મુક્ત દેખે છે તે મુક્ત થઈ જાય છે. બરાબર છે-મુસાફર જે નગરના માર્ગો ચાલે છે તે જ નગરમાં તે પહોંચે છે. ૪૮.

(આર્યા)

મા ગા બહિરન્તર્વા સામ્યસુધાપાનવર્ધિતાનન્દ ।
આસ્વ યથૈવ તથૈવ ચ વિકારપરિવર્જિતઃ સતતમ् ॥૪૯॥

અનુવાદ : હે સમતારૂપી અમૃતના પાનથી વૃદ્ધિગત આનંદને પ્રાપ્ત આત્મનું તું બાધ્ય તત્ત્વ અથવા અંતસ્તત્ત્વમાં ન જા. તું જે રીતે નિરંતર વિકાર રહિત થવાય તે જ પ્રકારે સ્થિત થઈ જા. ૪૯.

(આર્યા)

તજ્જયતિ યત્ર લઘે શ્રુતભુવિ મત્યાપગાતિધાવન્તી ।
વિનિવૃત્તા દૂરાદપિ ઝગિતિ સ્વસ્થાનમાશ્રયતિ ॥૫૦॥

અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત થતાં આગમરૂપ પૃથ્વી ઉપર વેગથી દોડતી બુદ્ધિરૂપી નદી દૂરથી પાછી વળીને તરત જ પોતાના સ્થાનનો આશ્રય લે છે તે ચૈતન્યસ્વરૂપ જ્યવંત રહે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાં સુધી ચૈતન્યસ્વરૂપની ઉપલબ્ધ નથી થતી ત્યાં સુધી જ બુદ્ધિ આગમના અભ્યાસમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જેવો ઉક્ત ચૈતન્યસ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થાય છે કે તરત જ તે બુદ્ધિ આગમ તરફથી વિમુખ થઈને તે ચૈતન્યસ્વરૂપમાં જ લીન થઈ જાય છે. એનાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૫૦.

(આર્યા)

તત્ત્વમત ગૃહિતાખિલકાલત્રયગતજગત્વયવ્યાપ્તિ ।
યત્રાસ્તમેતિ સહસા સકલોऽપિ હિ વાક્યરિસ્પન્દઃ ॥૫૧॥

અનુવાદ : જે આત્મજ્યોતિમાં ત્રણે ક્રાણ અને ત્રણે લોકના બધા જ પદાર્થો પ્રતિભાસિત થાય છે તથા જે પ્રગટ થવાથી બધી જ વચન પ્રવૃત્તિ સહસા નષ્ટ થઈ જાય છે તે આત્મજ્યોતિને નમસ્કાર કરો. ૫૧.

(આર્યા)

તત્ત્વમત વિનષ્ટાખિલવિકલ્પજાલદ્રુમાણિ પરિકલિતે ।
યત્ર વહન્તિ વિરધા દર્ઘવનાનીવ હૃદયાનિ ॥૫૨॥

અનુવાદ : જે આત્મતેજને જાણી લેતાં ચતુર જનો બળેલા વન સમાન વિનાશ પામેલા સમસ્ત વિકલ્પસમૂહરૂપ વૃક્ષો યુક્ત હૃદયો ધારણ કરે છે તે આત્મતેજને નમસ્કાર કરો.

વિશેષાર્થ : જેમ વનમાં અજિન લાગતાં સર્વ વૃક્ષો બળીને નાશ પામી જાય છે તેવી જ રીતે વિવેકી મનુષ્યના હૃદયમાં આત્મતેજ પ્રગટ થઈ જતાં સમસ્ત વિકલ્પસમૂહ નષ્ટ થઈ જાય છે. આવા આત્મતેજને નમસ્કાર કરવા જોઈએ. ૫૨.

(આર્યા)

બદ્ધો વા મુક્તો વા ચિદ્રૂપો નયવિચારવિધિરેષઃ ।
સર્વનયપક્ષારહિતો ભવતિ હિ સાક્ષાત્સમયસારઃ ॥૫૩॥

અનુવાદ : ચૈતન્ય સ્વરૂપ બદ્ધ છે અથવા મુક્ત છે, એ તો નયોને આશ્રિત

વિચારનું વિધાન છે. વાસ્તવમાં સમયસાર (આત્મસ્વરૂપ) સાક્ષાત્ આ બધા નયપક્ષોથી રહિત છે. ૫૩.

(આર્યા)

નયનિક્ષેપપ્રમિતિપ્રભૂતિવિકલ્પોજ્ઞિત પરં શાન્તમ् ।
શુદ્ધાત્માનુભૂતિગોचરમહમેકં ધામ ચિદ્રૂપમ् ॥૫૪॥

અનુવાદ : જે ચૈતન્ય સ્વરૂપ તેજ નય, નિક્ષેપ અને પ્રમાણ આદિ વિકલ્પો રહિત, ઉત્કૃષ્ટ, શાન્ત, એક અને શુદ્ધ અનુભવનો વિષય છે તે જ હું છું. ૫૪.

(આર્યા)

જ્ઞાતે જ્ઞાતમશેષં દૃષ્ટે દૃષ્ટં ચ શુદ્ધચિદ્રૂપે ।
નિઃશેષબોધ્યવિષયૌ દૃગ્બોધ્યૌ યત્ત્ર તત્ત્વિન્નૌ ॥૫૫॥

અનુવાદ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં બધું જ જણાઈ જાય છે તથા તેને જોઈ લેતાં બધું જ દેખવામાં આવી જાય છે. કારણ એ કે સમસ્ત જ્ઞેય પદાર્થોનો વિષય કરનાર દર્શન અને જ્ઞાન ઉક્ત ચૈતન્યસ્વરૂપથી ભિન્ન નથી. ૫૫.

(આર્યા)

ભાવે મનોહરેઽપિ ચ કાચિન્નિયતા ચ જાયતે પ્રીતિઃ ।
અપિ સર્વાઃ પરમાત્મનિ દૃષ્ટે તુ સ્વયં સમાપ્યન્તે ॥૫૬॥

અનુવાદ : મનોહર પદાર્થના વિષયમાં પણ કંઈક નિયમિત (મર્યાદિત) જ પ્રીતિ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્માના દર્શન થતાં સર્વ પ્રકારની પ્રીતિ સ્વયમેવ નાથ થઈ જાય છે. ૫૬.

(આર્યા)

સત્ત્વાયસન્નિવ વિદાં જનસામાન્યો ઽપિ કર્મણો યોગઃ ।
તરણપદ્મનામૃદ્ધઃ પથિકાનામિવ સરિત્પૂરઃ ॥૫૭॥

અનુવાદ : જેમ તરવામાં કુશળ મુસાફરો માટે વૃદ્ધિગત થયેલો નદીનો પ્રવાહ હોવા છતાં પણ ન હોવા બરાબર છે—તેને તેઓ કંઈ પણ બાધક માનતા નથી—તેવી જ રીતે વિદ્વાનોને જનસાધારણમાં રહેતો કર્મનો સંબંધ વિદ્યમાન હોવા છતાં પણ અવિદ્યમાન જેવો લાગે છે. ૫૭.

(આર્યા)

મૃગયમાળેન સુચિરં રોહણભુવિ રત્નમીસિતં ગ્રાષ ।
હેયાહેયશ્રુતિરપિ વિલોક્યતે લબ્ધતત્ત્વેન ॥૫૮॥

અનુવાદ : જેમ લાંબા કાળથી રોહણ પર્વતની ભૂમિમાં ઈચ્છિત રત્ન ગોતનાર મનુષ્ય તેને મેળવીને હેય અને ઉપાદેયની શ્રુતિનું પણ અવલોકન કરે છે—આ ગ્રહણ કરવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય, એ પ્રકારનો વિચાર કરે છે—તેવી જ રીતે તત્ત્વજ્ઞ પુરુષ આત્મારૂપ રોહણભૂમિમાં ચિરકાળથી ઈચ્છિત આત્મતત્ત્વરૂપ રત્નને ગોતતો થકો તેને પ્રાપ્ત કરીને હેય—ઉપાદેય શ્રુતિનું પણ અવલોકન કરે છે. ૫૮.

(આર્યા)

કર્મકલિતો ઽપિ મુક્તઃ સશ્રીકો દુર્ગતો ઽપ્યહમતીવ ।
તપસા દુઃખ્યપિ ચ સુખી શ્રીગુરુપાદપ્રસાદેન ॥૫૯॥

અનુવાદ : હું કર્મથી સંયુક્ત હોવા છતાં પણ શ્રીગુરુદેવના ચરણોના પ્રસાદથી મુક્ત જેવો જ છું, અત્યંત દરિદ્ર હોવા છતાં પણ ધનવાન છું, તથા તપથી દુઃખી હોવા છતાં પણ સુખી છું.

વિશેષાર્થ : તત્ત્વજ્ઞ જી વિચાર કરે છે કે જો કે હું પર્યાયની અપેક્ષાએ કર્મથી બંધાયેલો છું, દરિદ્રી છું અને તપથી દુઃખી પણ છું તો પણ ગુરુએ જે મને શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ કરાવ્યો છે તેથી હું એ જાણી ગયો છું કે વાસ્તવમાં ન હું કર્મથી બંધાયો છું, ન દરિદ્રી છું અને ન તપથી દુઃખી પણ છું. કારણ એ છે કે નિશ્ચયથી હું કર્મબંધ રહિત, અનંત યતુષ્યરૂપ લક્ષ્મીસહિત અને પરમાનંદથી પરિપૂર્ણ છું. આ પરપદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપર કાંઈ પણ પ્રભાવ પાડી શકતા નથી. ૫૯.

(આર્યા)

બોધાદસ્તિ ન કિંचિત્કાર્ય યદ્વદ્દશ્યતે મલાત્તન્મે ।
આકૃષ્યન્ત્રસૂત્રાદારુનરઃ સુરતિ નટકાનામ् ॥૬૦॥

અનુવાદ : મારે જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કાર્ય નથી. બીજું જો કાંઈ પણ દેખાય છે તે કર્મમળથી દેખાય છે. જેમ-નટોનો કાષ્મય પુરુષ (કઠપુત્રી) યંત્રની દોરી ખેંચવાથી નાચે છે.

વિશોધાર્થ : જેમ નટ દ્વારા કઠપુતલીના યંત્રની દોરી બેંચવામાં આવતાં તે કઠપુતળી નાચ્યા કરે છે તેવી જ રીતે પ્રાણી કર્મરૂપ દોરીથી પ્રેરિત થઈને ચાર ગતિસ્વરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, નિશ્ચયથી જોવામાં આવે તો જીવ કર્મબંધ રહિત શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, તેને કોઈ પણ બાહ્ય પર પદાર્થ સાથે પ્રયોજન નથી. ૬૦.

(आर्या)

निश्चयपञ्चाशत् पद्मनन्दिनं सूरिमाश्रिभिः कैश्चित् ।

शब्दैः स्वशक्तिसुचितवस्तुगुणैर्विरचितेयमिति ॥६१॥

અનુવાદ : પદ્મનાની મુનિનો આશ્રય લઈને પોતાની શક્તિથી (વાચક શક્તિથી) વસ્તુના ગુણોને સૂચિત કરનાર કેટલાક શબ્દો દ્વારા આ ‘નિશ્ચય પંચાશત्’ પ્રકરણ રચવામાં આવ્યું છે. ૬૧.

(उपेन्द्रवज्रा)

तृणं नृपश्रीः किमु वच्चि तस्यां न कार्यमाखण्डत्संपदोऽपि ।

अशेषवाञ्छाविलयैकरूपं तत्त्वं परं चेतसि चेन्ममास्ते ॥६२॥

અનુવાદ : જો મારા મનમાં સમસ્ત ઈચ્છાઓના અભાવરૂપ અનુપમ સ્વરૂપવાળું ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ સ્થિત હોય તો પછી રાજ્યલક્ષ્મી તૃણ સમાન તુચ્છ છે. તેના વિષયમાં તો શું કહું? પરંતુ મને તો ત્યારે ઈન્દ્રની સંપત્તિનું ય કાંઈ પ્રયોજન નથી. ૬૩.

આ રીતે નિશ્ચયપંચાશતુ અધિકાર સમાપ્ત થયો. ૧૧.



ચેદું

૧૨. બ્રહ્મચર્યરક્ષાવર્તિ

[૧૨. બ્રહ્મચર્યરક્ષાવર્તિઃ]

(શાર્દૂલવિક્રીડિત)

ભૂક્ષેપેણ જયન્તિ યે રિપુકુલં લોકાધિપાઃ કેવન
દ્રાક્ર તેષામણિ યેન વક્ષસિ દૃઢં રોપઃ સમારોપિતઃ ।
સોડપિ પ્રોદ્ધતવિક્રમઃ સ્મરભટઃ શાન્તાત્મભિર્લીલયા
યૈઃ શસ્ત્રગ્રહર્જિતૈરપિ જિતસ્તેભ્યો યતિભ્યો નમઃ ॥૧॥

અનુવાદ : જે કેટલાય રાજા ભૂકુટિની વક્તાથી જ શત્રુઓને જીતી કે છે તેમના પણ વક્ષસ્થળમાં જેણે દેઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી કામદેવરૂપ સુભટને જે શાન્ત મુનિઓએ શર્શ્વ વિના જ સહેલાઈથી જીતી લીધો છે તે મુનિઓને નમસ્કાર હો. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

આત્મા બ્રહ્મ વિવિક્તબોધનિલયો યત્તત્ર ચર્ય પરં
સ્વાઙ્ગાસંગવિવર્જિતૈકમનસ્તદ્બ્રહ્મચર્ય મુનેઃ ।
એવं સત્યબલાઃ સ્વમાતૃભગિનીપુત્રીસમાઃ પ્રેક્ષતે
ગૃદ્ધાદ્ય વિજિતેન્દ્રિયો યદિ તદા સ બ્રહ્મચારી ભવેતુ ॥૨॥

અનુવાદ : બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તે આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જે મુનિનું મન પોતાના શરીર સંબંધે પણ મમત્વ રહિત થઈ ગયું છે તેને જ તે બ્રહ્મચર્ય હોય છે. આમ થતાં જો ઈન્દ્રિયવિજયી થઈને વૃદ્ધા વગેરે (યુવતી, બાળા) શ્રીઓને કમશઃ પોતાની માતા, બહેન અને પુત્રી સમાન સમજે છે તો તે બ્રહ્મચારી થાય છે.

વિશેષાર્થ : વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાએ ખ્રિસ્તીયર્થના બે ભેદ કરી શકાય છે. આમાં મૈથુન ક્રિયાના ત્યાગને વ્યવહાર ખ્રિસ્તીયર્થ કહેવામાં આવે છે. તે પણ અણુવ્નત અને મહાવ્રતના ભેદથી બે પ્રકારનું છે. પોતાની પત્નીને છોડીને બાકીની બધી સ્ત્રીઓને યથાયોગ્ય માતા, બહેન અને પુત્રી સમાન માનીને તેમના પ્રત્યે રાગપૂર્વક વ્યવહાર ન કરવો; તેને ખ્રિસ્તીયર્થાણુવ્નત અથવા સ્વદારસંતોષ પણ કહેવામાં આવે છે. તથા અન્ય સ્ત્રીઓની જેમ પોતાની પત્નીના વિષયમાં પણ અનુરાગબુદ્ધિ ન રાખવી, એ ખ્રિસ્તીયર્થ મહાવ્રત કહેવાય છે જે મુનિને હોય છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણ કરવાનું નામ નિશ્ચય ખ્રિસ્તીયર્થ છે. આ તે મહામુનિઓને હોય છે જે અન્ય બાળ પદાર્થોના વિષયમાં તો શું, પરંતુ પોતાના શરીરના વિષયમાં પણ નિઃસ્પૃહ થઈ ગયા છે. આ જાતના ખ્રિસ્તીયર્થનું જ સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

સ્વપ્રે સ્યાદતિચારિતા યદિ તદા તત્ત્વાપિ શાસ્ત્રોદિતં
પ્રાયશ્રિત્તવિધિં કરોતિ રજનીભાગાનુગત્યા મુનિઃ ।
રાગોદ્રેકતયા દુરાશયતયા સા ગૌરવાત્ કર્મણ:
તસ્ય સ્યાધદિ જાગ્રતોऽપિ હિ પુનસ્તસ્યાં મહછોધનમ् ॥૩॥

અનુવાદ : જો સ્વખનમાં પણ કદાચ ખ્રિસ્તીયર્થના વિષયમાં અતિચાર (દોષ) ઉત્પન્ન થાય છે તો મુનિ તેના વિષયમાં પણ રાત્રિવિભાગ અનુસાર વિધિપૂર્વક પ્રાયશ્રિત કરે છે. અને જો કર્માદ્યવશ રાગની પ્રબળતાથી અથવા દુષ્ટ અભિપ્રાયથી જાગૃત અવસ્થામાં તેવો અતિચાર થાય તો તેમને મહાન પ્રાયશ્રિત કરવું પડે છે. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

નિત્યં ખાદતિ હस્તિસૂકરપલં સિંહો બલી તદ્રતિ-
વર્ષણેકદિને શિલાકણચરે પારાવતે સા સદા ।
ન બ્રહ્મવ્રતમેતિ નાશમથવા સ્યાત્રેવ ભુત્કેર્ગુણા-
તદ્રક્ષાં દઠ એક એવ કુરુતે સાધોર્મનઃ સંયમઃ ॥૪॥

અનુવાદ : જે બળવાન સિંહ નિરંતર હાથી અને સુવ્વરનું માંસ ખાય છે તેને અનુરાગ (સંભોગ) વર્ષમાં કેવળ એક દિવસને માટે હોય છે. એનાથી ઉલ્લંઘન કર્યું તર કંકરા ખાય છે તેને તે અનુરાગ નિરંતર રહ્યા કરે છે. અથવા ભોજનના ગુણથી-ગરિષ્ઠ ભોજન અથવા લૂખું સૂકું ભોજન કરવા અથવા ઉપવાસ કરવાથી-

તે બ્રહ્મચર્યનો ન તો નાશ થાય છે અને ન રક્ષા ય થાય છે. તેની રક્ષા તો દેખતાથી નિગ્રહ પ્રાપ્ત કરાવવામાં આવેલ એક સાધુનું મન જ કરે છે. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

ચેતઃ સંયમનં યથાવદવનં મૂલપ્રતાનાં મતં
શેષાણાં ચ યથાવલં પ્રભવતાં બાહ્યં મુનેજ્ઞાનિનઃ ।
તજ્જન્યં પુનરાન્તરં સમરસીભાવેન ચિચ્છેતસો
નિત્યાનન્દવિધાયિ કાર્યજનકં સર્વત્ર હેતુદ્વયમ् ॥૫॥

અનુવાદ : મૂળગુણોનું તથા શક્તિ અનુસાર ઉત્પન્ન થતાં શેષ (ઉત્તર) ગુણોનું વિધિપૂર્વક રક્ષણ કરવું, એ જ્ઞાની મુનિનો બાહ્ય મનોસંયમ કહેવાય છે. આનાથી ફરી તે અંતરંગ સંયમ ઉત્પન્ન થાય છે જે ચૈતન્ય અને ચિત્તના એકરૂપ થઈ જવાથી શાશ્વત સુખ ઉત્પન્ન કરે છે. બરાબર છે—સર્વ બાહ્ય અને અભ્યંતર આ બન્નેય કારણ કાર્યના જનક થાય છે. ૫.

(શાર્દૂલવિક્રીડિત)

ચેતોભ્રાન્તિકરી નરસ્ય મદિરાપીતિર્યથા સ્ત્રી તથા
તત્સંગેન કુતો મુનેર્વતવિધિઃ સ્તોકોऽપિ સંભાવ્યતે ।
તસ્માત્સંસ્તુતિપાતભીતમતિભિઃ પ્રાસૈસ્તપોભૂમિકાં
કર્તવ્યો વ્રતિભિઃ સમસ્તયુવતિત્યાગે પ્રયત્નો મહાન् ॥૬॥

અનુવાદ : જેમ મધ્યપાન મનુષ્યનું ચિત્ત ભાન્તિયુક્ત કરી મૂકે છે તેવી જ રીતે શ્રી પણ તેના ચિત્તને ભાન્તિયુક્ત કરી મૂકે છે. તો પછી ભલા તેના સંગથી મુનિને થોડાય પ્રતાચરણની સંભાવના ક્યાંથી હોઈ શકે? ન હોઈ શકે. તેથી જેમની બુદ્ધિ સંસાર પરિભ્રમણથી ભય પામી છે તથા જે તપનું અનુષ્ઠાન કરે છે તે સંયમી મનુષ્યોએ સમસ્ત સ્ત્રીઓના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ. ૬.

(શાર્દૂલવિક્રીડિત)

મુદ્રકર્ત્તારિ દૃઢાર્ગલા ભવતરોઃ સેકે ઽઙ્ગના સારિણી
મોહવ્યાધવિનિર્મિતા નરમૃગસ્યાબન્ધને વાગુરા ।

યત્સંગેન સતામપિ પ્રસરતિ પ્રાણાતિપાતાદિ તત્
તદ્વાર્તાપિ યતેર્યતિવહતયે કુર્યાન્ન કિં સા પુનઃ ॥૭॥

અનુવાદ : જે શ્રી મોક્ષરૂપી મહેલના દ્વારની મજબૂત ભોગળ (બને બારણાને રોકનાર ખાસ લાકું આગળિયા) સમાન છે, જે સંસારરૂપ વૃક્ષને સીંચવા માટે સારિથી (નાની નદી કે ઝારી) સમાન છે, જે પુરુષરૂપ હરણને બાંધવા માટે જાળ સમાન છે તથા જેના સંગથી સજજનોને પણ પ્રાણધાતાદિ (હિંસાદિ) દોષ વધે છે; તે શ્રીનું નામ લેવું પણ જો મુનિપ્રતના નાશનું કારણ થતું હોય તો ભલા તે સ્વયં શું ન કરી શકે? અર્થાત્ તે બધા પ્રત-નિયમાદિનો નાશ કરે છે. ૭.

(શાર્ડૂલવિક્રીડિત)

તાવત્પૂજ્યપદસ્થિતિઃ પરિલસત્તાવદ્યશો જૃમ્ભતે
તાવચ્છુભ્રતરા ગુણાઃ શુચિમનસ્તાવત્તપો નિર્મલમ् ।
તાવદ્ર્મકથાપિ રાજતિ યતેસ્તાવત્તસ દૃશ્યો ભવેદ્
યાવન્ન સ્મરકારિ હારિ યુવતે રાગાન્મુખં વીક્ષતે ॥૮॥

અનુવાદ : જ્યાં સુધી કામનું ઉદ્દીપન કરનાર યુવાન શ્રીનું મનોહર મુખ અનુરાગ પૂર્ણ દૃષ્ટિ દેખતા નથી ત્યાંસુધી જ મુનિની પૂજ્ય પદમાં સ્થિતિ રહી શકે છે. ત્યાં સુધી જ તેમની મનોહર ક્રીતિનો વિસ્તાર થાય છે. ત્યાંસુધી જ તેના નિર્મળ ગુણ વિદ્યમાન રહે છે. ત્યાંસુધી જ તેનું મન પવિત્ર રહે છે, ત્યાંસુધી જ નિર્મળ તપ રહે છે, ત્યાંસુધી જ ધર્મકથા સુશોભિત રહે છે અને ત્યાંસુધી જ તે દર્શનને યોગ્ય રહે છે. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

તેજોહાનિમપૂતતાં બ્રતહર્તિં પાપં પ્રપાતં પથો
મુક્તે રાગિતયાઙ્ગનાસ્મૃતિરપિ કલોશં કરોતિ ધ્રુવમ् ।
તત્સાંનિધ્યવિલોકનપ્રતિવચઃસ્પર્શાદયઃ કુર્વતે
કિં નાનર્થપરંપરામિતિ યતેસ્ત્યાજ્યાબલા દૂરતઃ ॥૯॥

અનુવાદ : રાગબુદ્ધિથી કરવામાં આવેલું સ્વીનું સ્મરણ પણ જો નિશ્ચયથી મુનિના તેજની હાનિ, અપવિત્રતા, વ્રતનો વિનાશ, પાપ, મોક્ષમાર્ગથી પતન અને કદેશ કરે છે. તો ભલા તેની સમીપતા, દર્શન, વાર્તાલાપ અને સ્પર્શ આદિ શું અનર્થોની નવી પરંપરા નથી કરતાં? અર્થાતું અવશ્ય કરે છે. તેથી સાધુએ એવી સ્વીનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

વેશ્યા સ્યાદ્ધનતસ્તદસ્તિ ન યતેશ્વેદસ્તિ સો સ્યાત્ કુતો
 નાત્મીયા યુવતિર્યતિત્વમભવત્તત્યાગતો યત્યુરા ।
 પુંસોઽન્યસ્ય ચ યોષિતો યદિ રતિશિષ્ઠો નૃપાત્તત્પતે:
 સ્યાદાપઞ્ચનનદ્વયક્ષયકરી ત્યાજ્યૈવ યોષા યતે: ॥૧૦॥

અનુવાદ : વેશ્યા ધનથી પ્રાપ્ત થાય છે અને ધન મુનિ પાસે હોતું નથી. કદાચ જો તે ધન પણ તેની પાસે હોય તો ય તે ક્યાંથી પ્રાપ્ત થાય? અર્થાતું તેની પ્રાપ્તિ દુર્લભ છે. એ સિવાય જો પોતાની જ સ્વી મુનિ પાસે હોય તો એ પણ સંભવિત નથી; કારણ કે પૂર્વે તેનો ત્યાગ કરીને તો મુનિધર્મનો સ્વીકાર કર્યો છે. જો કોઈ બીજા પુરુષની સ્ત્રી સાથે અનુરાગ કરવામાં આવે તો રાજા દ્વારા તથા તે સ્વીના પતિ દ્વારા ઈન્દ્રિય છેદન આદિ કષ્ટને પ્રાપ્ત થાય છે તેથી સાધુએ બન્ને લોકનો નાશ કરનારી સ્વીનો ત્યાગ જ કરવો જોઈએ. ૧૦.

(શાર્ડૂલવિક્રીડિત)

દારા એવ ગૃહં ન ચેષ્ટકચિત તત્તૌર્ગૃહસ્થો ભવેત्
 તત્યાગે યત્તિરાદધાતિ નિયતં સ બ્રહ્મચર્ય પરમ् ।
 વૈકલ્યં કિલ તત્ત્ર ચેત્તદપરં સર્વ વિનષ્ટં વ્રતં
 પુસ્તેન વિના તદા તદુભ્યભ્રષ્ટત્વમાપદ્યતે ॥૧૧॥

અનુવાદ : સ્વી જ ધર છે, ઈટોથી નિર્ભિત ધર વાસ્તવમાં ધર નથી. તે સ્વીરૂપ ધરના સંબંધથી જ શ્રાવક ગૃહસ્થ થાય છે અને તેનો ત્યાગ કરીને સાધુ નિયમિત ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ધારણ કરે છે. જો તે બ્રહ્મચર્યના વિષયમાં વિકળતા (દોષ) હોય તો પછી અન્ય સર્વ વ્રત નષ્ટ થઈ જાય છે. આ રીતે તે બ્રહ્મચર્ય વિના પુરુષ બન્નેય

આધિકાર-૧૨ : પ્રત્યાર્થરક્ષાવર્તિ]

૨૭૩

લોકમાંથી ભ્રષ્ટ થાય છે અર્થાત् તેનો આ લોક અને પરલોક બન્નેય બગડે છે. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

સંપદેત દિનદ્વયં યદિ સુખં નો ભોજનાદેસ્તદા
સ્ત્રીણામષ્ટતિસ્તપગર્વિતધિયામઙ્ગં શવાઙ્ગાયતે ।
લાવળ્યાદ્યપિ તત્ત્વ ચચ્ચલમિતિ શ્લિષ્ટં ચ તત્ત્વદ્વત્તાં
દૃષ્ટ્વા કુઙ્કુમકાજલાદિરચનાં મા ગચ્છ મોહં મુને ॥૧૨॥

અનુવાદ : જો બે દિવસ જ ભોજન આદિનું સુખ પ્રાપ્ત ન થાય તો પોતાના સૌન્દર્યનું અત્યંત અભિમાન કરનારી તે સ્ત્રીઓનું શરીર મૃત શરીર સમાન થઈ જાય છે. સ્ત્રીના શરીરમાં સંબદ્ધ લાવળ્ય આદિ પણ વિનશ્યર છે તેથી હે મુને! તેના શરીર ઉપર લગાડેલ કુમકુમ અને કાજળ આદિની રચના જોઈને તું મોહ ન પામ. ૧૨.

(શાર્દૂલવિક્રીડિત)

રમ્ભાસ્તમ્ભમૃણાલહેમશશભૃતીલોત્પલાદૈ: પુરા
યસ્ય સ્ત્રીવપુષ: પુર: પરિગતૈ: પ્રાપ્તા પ્રતિષ્ઠા ન હિ ।
તત્પર્યન્તદશાં ગતં વિધિવશાલ્કિસ્તં ક્ષતં પક્ષિભિ-
ર્ભીતૈશ્છાદિતનાસિકૈ: પિતૃવને દૃષ્ટં લઘુ ત્યજ્યતે ॥૧૩॥

અનુવાદ : પૂર્વ જે સ્ત્રી-શરીરની આગળ કેળનું થડ, કમળનાળ, સુવર્ણ, ચન્દ્રમા અને નીલકમળ આદિ પ્રતિષ્ઠા પામી શક્યા નથી તે શરીર જ્યારે દૈવવશે ભરણ અવસ્થાને પ્રાપ્ત થતાં સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે અને પક્ષી તેને આમતેમ ખોતરીને છિન્ન બિન્ન કરી નાખે છે ત્યારે આવી અવસ્થામાં તેને જોઈને ભય પામેલા લોકો નાક બંધ કરીને તરત જ છોડી દે છે—ત્યારે તેના ઉપર અનુરાગ કરવો તો દૂર રહ્યો પણ તે અવસ્થામાં તેઓ તેને જોઈ પણ શકતા નથી. ૧૩.

(શાર્દૂલવિક્રીડિત)

અઙ્ગં યદ્યપિ યોષિતાં પ્રવિલસત્તારુણ્યલાવળ્યવદ્
ભૂષાવત્તદપિ પ્રમોદજનકં મૂઢાત્મનાં નો સત્તામ્ ।
ઉચ્છૂનૈર્બહુભિઃ શવૈરતિતરાં કીર્ણ શમશાનરથલં
લબ્ધ્વા તુષ્યતિ કૃષણકાકનિકરો નો રાજહંસવ્રજઃ ॥૧૪॥

અનુવાદ : જો કે શોભાયમાન યૌવન અને સૌન્દર્યથી પરિપૂર્ણ શ્રીઓના શરીર આભૂષણોથી વિભૂષિત છે તો પણ તે મૂર્ખજનોને જ આનંદ ઉત્પન્ન કરે છે, નહિ કે સજજન મનુષ્યોને. બરાબર છે-ધડા સડી-ગળી ગયેલા મૃત શરીરોથી અત્યંત વ્યાપ્ત સ્મશાનભૂમિમાં આવીને કાળા કાગડાઓનો સમૂહ જ સંતુષ્ટ થાય છે, નહિ કે રાજહંસોનો સમૂહ. ૧૪.

(શાર્દૂલવિક્રીડિત)

યૂકાધામ કચા: કપાલમજિનાચ્છન્ન મુખં યોષિતાં
તચ્છિદ્રે નયને કુચૌ પલભરૌ બાહૂ તતે કીકસે ।
તુન્દં મૂત્રમલાદિસદ્ગ જધનં પ્રસ્યન્દિવર્ચોગૃહં
પાદસ્થૂણમિદં કિમત્ર મહતાં રાગાય સંભાવ્યતે ॥૧૫॥

અનુવાદ : શ્રીઓના વાળ જુઓનું ધર છે, મસ્તક અને મુખ ચામડાથી ઢંકાયેલું છે, બન્ને આંખ તે મુખના છિદ્ર છે, બન્ને સ્તન માંસથી પરિપૂર્ણ છે, બન્ને ભૂજાઓ લાંબા હાડકાં છે, પેટ મળ-મૂત્રાદિનું સ્થાન છે. યોનિ વહેતા મળનું ધર છે અને પગ થાંબલા સમાન છે. આવી અવસ્થામાં આ શ્રીનું શરીર અહીં શું મહાન् પુરુષોને અનુરાગનું કારણ હોઈ શકે? અર્થાત્ તેમને માટે તે અનુરાગનું કારણ પણ હોતું નથી. ૧૫.

(શાર્દૂલવિક્રીડિત)

કાર્યકાર્યવિચારશૂન્યમનસો લોકસ્ય કિં બ્રૂમહે
યો રાગાન્ધતયાદરેણ વનિતાવકત્રસ્ય લાલાં પિવેતુ ।
શ્લાઘ્યાસ્તે કવય: શશાઙ્કવદિતિ પ્રવ્યક્તવાગ્ડમ્બરૈ-
શ્ર્માનદ્વકપાલમેતદપિ યૈર્ગ્રે સતાં વર્ણતે ॥૧૬॥

અનુવાદ : જેનું મન કર્તવ્ય અને અકર્તવ્યના વિચાર રહિત છે અને તેથી જે રાગમાં અંધ બનીને ઉત્સુકતાથી શ્રીના મુખની લાળ પીએ છે, તે મનુષ્યના વિષયમાં અમે શું કહીએ? પરંતુ જે કવિઓ પોતાના સ્પષ્ટ વચ્ચનોના વિસ્તારથી સજજનો આગળ ચામડાથી આચ્છાદિત આ કપાળયુક્ત મુખને ચંદ્રમા સમાન સુંદર બતાવે છે તેઓ પણ પ્રશંસનીય ગણાય છે-જે વાસ્તવમાં નિંદાને પાત્ર છે. ૧૬.

(શાર્ડૂલવિક્રીડિત)

એષ સ્ત્રીવિષયે વિનાપિ હિ પરગ્રોક્તોપદેશં ભૃશં
રાગાન્ધો મદનોદયાદનુચિતં કિં કિં ન કુર્યાજ્ઞનઃ ।
અયેતત્પરમાર્થવોધવિકલઃ પ્રોઢં કરોતિ સ્ફુરત-
શૃઙ્ગારં પ્રવિધાય કાવ્યમસકૃલ્લોકસ્ય કશ્ચિત્કવિઃ ॥૧૭॥

અનુવાદ : આ જનસમૂહ બીજાઓના ઉપદેશ વિના પણ કામ ઉદ્દીપન થવાથી રાગથી અંધ બનીને ખીના વિષયમાં કૃંચું કૃંચું નિન્દ્ય કાર્ય નથી કરતા? અર્થાત્ ઉપદેશ વિના જ તે ખીની સાથે અનેક પ્રકારની નિન્દનીય ચેષ્ટાઓ કરે છે. વળી હેય-ઉપાદેયના જ્ઞાન રહિત હોઈ કવિ નિરંતર શૃંગાર રસથી પરિપૂર્ણ કાવ્ય રચીને તે લોકોના ચિત્તને વિશેષપણે રાગથી પુષ્ટ કરે છે. ૧૭.

(શાર્ડૂલવિક્રીડિત)

દારાર્થાદિ પરિગ્રિહઃ કૃતગૃહવ્યાપારસારો ઽપિ સન્ન
દેવઃ સો�પિ ગૃહી નરઃ પરધનસ્ત્રીનિસ્પૃહઃ સર્વદા ।
યસ્ય સ્ત્રી ન તુ સર્વથા ન ચ ધનં રત્નત્રયાલઙ્કૃતો
દેવાનામપિ દેવ એવ સ મુનિઃ કેનાત્ર નો મન્યતે ॥૧૮॥

અનુવાદ : જે ગૃહસ્થ સ્ત્રી અને ધન આદિ પરિગ્રહ સહિત હોઈને ઘરના ઉત્તમ વ્યાપાર આદિ કાર્યો કરતો થકો પણ કદી પરધન અને પરસ્તીની ઈચ્છા કરતો નથી તે ગૃહસ્થ મનુષ્ય (હોવા છતાં) પણ દેવ (પ્રશંસનીય) છે. વળી જેમની પાસે સર્વથા ન તો સ્ત્રી છે અને ન ધન પણ છે તથા જે રત્નત્રયથી વિભૂષિત છે તે મુનિ તો દેવોના પણ દેવ (દેવોથી પણ પૂજ્ય) છે. તેમને ભલા અહીં કોણ માનતું નથી? અર્થાત્ તેમની બધા જ પૂજા કરે છે. ૧૮.

(શાર્ડૂલવિક્રીડિત)

કામિન્યાદિ વિનાત્ર દુઃખહતયે સ્વીકૃત્વતે તત્ત્વ યે
લોકાસ્તત્ર સુખં પરાશ્રિતત્ત્યા તદ્દુઃખમેવ ધ્રુવમ् ।
હિત્વા તદ્વિષયોત્થમન્તવિરસં સ્તોકં યદાધ્યાત્મિકં
તત્ત્વૈકદૃશાં સુખં નિરૂપમં નિત્યં નિજં નીરજમ् ॥૧૯॥

અનુવાદ : અહીં સ્ત્રી આદિ વિના જે દુઃખ થાય છે તેને નષ્ટ કરવા માટે લોકો ઉક્ત સ્ત્રી આદિનો સ્વીકાર કરે છે પરંતુ તે સ્ત્રી આદિના નિમિત્તે જે સુખ થાય છે તે વાસ્તવમાં પરને આધીન હોવાથી દુઃખ જ છે. તેથી વિવેકી જનો પરિણામે અહિતકારક અને પ્રમાણમાં અલ્ય તે વિષયજન્ય સુખ છોડીને તત્ત્વદર્શીઓના તે અનુપમ સુખનો સ્વીકાર કરે છે જે જે આત્માધીન, નિત્ય, આત્મિક (સ્વાધીન) અને પાપરહિત છે. ૧૮.

(શાર્દૂલવિક્રીડિત)

સૌભાગ્યાદિગુણપ્રમોદસદનૈ: પુણ્યરૂપતાસ્તે હૃદ
સ્ત્રીણાં યે સુચિરં વસન્તિ વિલસત્તારુણ્યપુણ્યશ્રિયામ् ।
જ્યોતિર્બોધમયં તદન્તરદ્વશા કાયાતૃથક્ પશ્યતાં
યેષાં તા ન તુ જાતુ તે ઽપિ કૃતિનસ્તેભ્યો નમઃ કુર્વતે ॥૨૦॥

અનુવાદ : જે મનુષ્ય શોભાયમાન યૌવનની પવિત્ર શોભાથી સંપન્ન એવી સ્ત્રીઓના હદ્યમાં ચિરકાળ સુધી નિવાસ કરે છે તે સૌભાગ્યાદિ ગુણો અને આનંદના સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ છે. પરંતુ અભ્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના હદ્યમાં તે સ્ત્રીઓ કદી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને તે પૂર્વોક્ત (સ્ત્રીઓના હદ્યમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૨૦.

(શાર્દૂલવિક્રીડિત)

તુષ્ણાપં બહુદુઃખરાશિરશુચિ સ્તોકાયુરત્પજ્ઞતા-
જ્ઞાતપ્રાન્તદિનં જરાહતમતિઃ પ્રાયો નરત્વં ભવે ।
આસ્મિન્નેવ તપસ્તતઃ શિવપદં તત્ત્વૈવ સાક્ષાત્મુખં
સૌખ્યાર્થીતિ વિચિન્ત્ય ચેતસિ તપઃ કુર્યાન્નરો નિર્મલમ् ॥૨૧॥

અનુવાદ : સંસારમાં જે મનુષ્યપર્યાય દુર્લભ છે, ઘણા દુઃખોના સમૂહથી વ્યાપ છે, અપવિત્ર છે, અલ્ય આયુસહિત છે, જેના અંત (મરણ)નો દિવસ અલ્પજણતાને કારણે જાણી શકતો નથી, તથા જેમાં વૃદ્ધાવસ્થાને કારણે બુદ્ધિ પ્રાય: કુંઠિત થઈ જાય છે; તે મનુષ્ય પર્યાયમાં જ તપ કરી શકાય છે અને મોક્ષપદની

અધિકાર-૧૨ : બ્રહ્મચર્યરક્ષાવર્તી]

૨૭૭

પ્રાપ્તિ આ તપથી થાય છે અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. મનમાં આવો વિચાર કરીને મોક્ષસુખાભિલાષી મનુષ્યે આ દુર્લભ મનુષ્ય પર્યાયમાં નિર્મળ તપ કરવું જોઈએ. ૨૧.

(શાર્દૂલવિક્રીડિત)

ઉત્કેં મુનિ પદ્મનન્દિભિષજા દ્વાભ્યાં યુતાયાઃ શુભા
સદ્ગૃત્તૌષધવિંશતેરુચિતવાગર્થાભ્યસા વર્તિતા ।
નિર્ગ્રન્થૈ: પરલોકદર્શનકૃતે પ્રોદ્યત્તપોવાધકૈ-
શ્રેતશ્વક્ષુરનઙ્ગ્રોગશમની વર્તિઃ સદા સેવ્યતામ् ॥૨૨॥

અનુવાદ : બાવીશ ઉત્તમ છન્દો (પદ્મો) રૂપ ઔષધિ (બાવીશ શ્લોકમાં રચિત આ બ્રહ્મચર્ય પ્રકરણ) ની જે આ બતી પદ્મનન્દી મુનિરૂપ વૈદ્ય દ્વારા બતાવવામાં આવી છે, શ્રેષ્ઠ છે, યોગ્ય શબ્દ અને અર્થરૂપ જગ્યાની જેનું ઉદ્વર્તન કરવામાં આવ્યું છે તથા જે ચિત્તરૂપ ચક્ષુના કામરૂપ રોગને શાંત કરે છે, તેનું સેવન તપોવૃદ્ધ સાધુઓએ પરલોકદર્શન માટે નિરંતર કરવું જોઈએ.

વિશેષાર્થ : અહીં શ્રી પદ્મનન્દી મુનિએ જે આ બાવીશ શ્લોકમય બ્રહ્મચર્ય પ્રકરણ રચ્યું છે તેને તેમણે ઔષધિની બતી (રૂમાં ઔષધ રેડીને આંખમાં નાખવા માટે બનાવેલી વાટ અથવા અંજનશલાકા) ની ઉપમા આપી છે. અભિપ્રાય તેનો એ છે કે જેમ ઉત્તમ વૈદ્ય દ્વારા બતાવાયેલ શ્રેષ્ઠ આંજણ સણી દ્વારા આંખોમાં આંજતાં મનુષ્યની આંખોનો રોગ (કુલું વગેરે) દૂર થઈ જાય છે અને પછી તે બીજા લોકોને સ્પષ્ટ જોવા લાગે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવ પદ્મનન્દિ મુનિ દ્વારા ઉત્તમોત્તમ શબ્દો અને અર્થનો આશ્રય લઈને રચાયેલ આ બ્રહ્મચર્ય પ્રકરણનું મનન કરે છે તેમના ચિત્તનો કામરોગ (વિષય વાંછા) નાટ થઈ જાય છે અને ત્યારે તે મુનિક્રત ધારણ કરીને પરલોક (બીજો ભવ) જોવામાં સર્મર્થ થઈ જાય છે. તાત્પર્ય એ કે આમ કરવાથી દુર્ગતિનું દુઃખ નાટ થઈને તેમને કાં તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો બીજા ભવમાં દેવાદિની ઉત્તમ પર્યાય પ્રાપ્ત થાય છે. ૨૨.

આ રીતે બ્રહ્મચર્યરક્ષાવર્તી નામનો અધિકાર સમાપ્ત થયો. ૧૨.



૧૩. ઋષભસ્તોત્ર

[૧૩. ઋષભસ્તોત્રમ्]

(આર્યા)

જય ઉસહ ણાહિણંદણ તિહુવણણિલએકદીવ તિત્થયર ।
જય સયલજીવવચ્છલ ણિમ્મલગુણરયણણિહિ ણાહ ॥૧॥

અનુવાદ : હે ઋષભ જિનેન્ર ! નાભિ રાજાના પુત્ર, આપ ત્રણ લોકરૂપ ગૃહને પ્રકાશિત કરવા માટે અદ્વિતીય દીપક સમાન છો, ધર્મતીર્થના પ્રવર્તક છો, સમસ્ત પ્રાણીઓના વિષયમાં વાત્સલ્યભાવ ધારણ કરો છો તથા નિર્મળ ગુણરૂપ રત્નોનાં સ્થાન છો. આપ જ્યવંત હો. ૧.

(આર્યા)

સયલસુરાસુરમણિમઉડકિરણકબુરિયપાયપીઠ તુમં ।
ધણા પેચ્છંતિ થુણંતિ જવંતિ ઝાયંતિ જિણણાહ ॥૨॥

અનુવાદ : નમસ્કાર કરતાં સર્વ દેવો અને અસુરોના ભણિમય મુગટોના કિરણોથી જેમની પાદપીઠ (પગ રાખવાનું આસન) વિચિત્ર વર્ણની થઈ રહી છે, એવા હે ઋષભ જિનેન્ર ! પુણ્યાત્મા જીવ આપના દર્શન કરે છે, સ્તુતિ કરે છે, જપ કરે છે અને ધ્યાન પણ કરે છે. ૨.

(આર્યા)

ચમ્મચિણા વિ દિદ્દે તઙ્ત તઙ્લોએ ણ માઇ મહહરિસો ।
ણાણચિણા ઉણો જિણ ણ-યાણિમો કિં પરફુરઙ ॥૩॥

અનુવાદ : હે જિન ! ચર્મમય નેત્રથી પણ આપના દર્શન થતાં જે મહાન

અધિકાર-૧૩ : ઋષભસ્તોત્ર]

૨૭૮

હર્ષ ઉત્પન્ન થાય છે તે ત્રણે લોકમાં સમાતો નથી. તો પછી જ્ઞાનરૂપ નેત્રથી આપના દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય, એ અમે જાણતાં નથી. ઉ.

(આર્યા)

તં જિણ ણાણમળંતં વિસર્જકયસયત્તલવત્યુવિત્થારં ।
જો થુણઙ્ડ સો પયાસઙ્ડ સમુદ્દ્રકહમવડસાલૂરો ॥૪॥

અનુવાદ : હે જિનેન્દ્ર! જે જીવ સમસ્ત વસ્તુઓના વિસ્તારનો વિષય કરનાર આપના અનંત જ્ઞાનની સ્તુતિ કરે છે તે પોતાને પેલા કૂપમંડુક (કૂવામાં રહેનાર દેડકા) સમાન પ્રકટ કરે છે જે કૂવામાં રહેવા છતાં પણ સમુદ્રના વિસ્તારાદિ બતાવે છે.

વિશેષાર્થ : જેમ કૂવામાં રહેનારો તુચ્છ દેડકો કદી સમુદ્રનો વિસ્તાર આદિ બતાવી શકતો નથી તેવી જ રીતે અલ્યુઝ મનુષ્ય આપના તે અનંત જ્ઞાનની સ્તુતિ કરી શકતો નથી કે જેમાં સમસ્ત દ્રવ્યો અને તેમના અનંત ગુણ તથા પર્યાયો યુગપત્ર પ્રતિભાસિત થઈ રહ્યા છે. ૪.

(આર્યા)

અમ્હારિસાણ તુહ ગોત્તકિત્તગેણ વિ જિણેસ સંચરઙ્ડ ।
આએસ મગંતી પુરાઓ હિયઙ્ગચ્છિયા લચ્છી ॥૫॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપના નામના કીર્તનથી-કેવળ નામના સ્મરણ માત્રથી પણ અમારા જેવા મનુષ્યોની સામે મનચાહી લક્ષ્યી આજ્ઞા માગતી ઉપસ્થિત થાય છે. ૫.

(આર્યા)

જાસિ સિરી તઙ્ડ સંતે તુવ અવઙ્ગણમિ તીએ ણદ્વાએ ।
સંકે જળિયાળિદ્વા દિદ્વા સવદ્વસિદ્વી વિ ॥૬॥

અનુવાદ : હે ભગવન्! આપ સર્વાર્થસિદ્ધિમાં સ્થિત હતા તે વખતે તેની જે શોભા હતી તે આપનો અહીં અવતાર થતાં નષ્ટ થઈ ગઈ. તેથી મને એવી આશંકા થાય છે કે તે વખતે સર્વાર્થસિદ્ધિ પણ એવી દેખવામાં આવી કે જાણે તેનું અનિષ્ટ જ થઈ ગયું હોય.

વિશેષાર્થ : જે વખતે ભગવાન ઋષભ જિનેન્દ્રનો જીવ સર્વાર્થસિદ્ધિમાં વિદ્યમાન હતો તે વખતે ભાવિતીર્થકર ત્યાં રહેવાથી તેની શોભા નિરાણી જ હતી. પછી જ્યારે તે ત્યાંથી ચ્યુત

થઈને મરુદેવી માતાના ગર્ભમાં અવતર્યા ત્યારે સર્વાર્થસિદ્ધિની તે શોભા નષ્ટ થઈ ગઈ હતી. આ બાબતમાં અહીં એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે ભગવાનું ઋષભ જિનેજ્ર ચ્યુત થતાં તે સર્વાર્થસિદ્ધિ જાણે વિધવા જ થઈ ગઈ હતી તેથી તે વખતે તે સૌભાગ્યશ્રી વિનાની દેખાઈ. ૬.

(આર્યા)

ણાહિઘરે વસુહારાવડણ જં સુઝરમિહં તુહોયરણ ા।
આસિ ણહાહિ જિણેસર તેણ ધરા વસુમર્ઝ જાયા ॥૭॥

અનુવાદ : હે જિનેશ્વર! આપે અવતાર લેવાથી નાભિ રાજાના ધેર આકાશમાંથી જે લાંબા સમય સુધી (પંદર માસ સુધી) ધનની ધારાનો વરસાદ થયો—રત્નોની વર્ષા થઈ—તેથી આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવા સાર્થક નામવાળી બની. ૭.

(આર્યા)

સ ચ્ચિય સુરણવિયપ્યા મરુએવી પહુ ઠિઓ સિ જંગબ્ધે ।
પુરાઓ પદ્મો બજ્જાઇ મજ્જો સે પુત્તવંતીણ ॥૮॥

અનુવાદ : હે ભગવાનું! જે મરુદેવીના ગર્ભમાં તમારા જેવા પ્રભુ સ્થિત હતા તેમના જ ચરણોમાં તે વખતે દેવોએ નમસ્કાર કર્યા હતા. તે વખતે પુત્રવતી શ્રીઓમાં તેમની સમક્ષ તેમને પહુ બાંધવામાં આવ્યો હતો અર્થાતું સમસ્ત પુત્રવતી શ્રીઓની વચ્ચે તીર્થકર જેવા પુત્રરત્નને જન્મ આપનાર એક તે જ મરુદેવીને પુત્રવતી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ૮.

(આર્યા)

અંકલ્યે તઙ્ દિદ્દે જંતેણ સુરાયલં સુરિંદેણ ।
અણિમેસત્તબહૃતં સયલં ણયણાણ પડિવળ્ણં ॥૯॥

અનુવાદ : હે જિનેજ્ર! સુમેરુ પર્વત ઉપર જતી વખતે ઈન્દ્રને ખોળામાં બેઠેલા આપના દર્શન થતાં તે પોતાના નેત્રોની નિર્નિમેષતા (પલકારાનો અભાવ) અને અધિકતા (હજારની સંખ્યા) ને સફળ સમજવા લાગ્યાં.

વિશોધાર્થ : એ આગમ પ્રસિદ્ધ વાત છે કે દેવોના નેત્ર નિર્નિમેષ (પલકારા વિનાના) હોય છે. તે પ્રમાણે ઈન્દ્રના નેત્ર નિર્નિમેષ તો હતા જ, સાથોસાથ તેમની સંખ્યા પણ એક હજાર હતી. ઈન્દ્ર જ્યારે આ નેત્રોથી પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમણે તેને સફળ માન્યા. આ સુયોગ અન્ય

અધિકાર-૧૩ : ઋષભસ્તોત્ર]

૨૮૧

મનુષ્ય આદિને પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમને બે જ નેત્ર હોય છે અને તે પણ સનિમેષ. તેથી તેઓ જ્યારે ત્રિલોકીનાથના દર્શન કરે છે ત્યારે તેમને વચ્ચે વચ્ચે પલક બીડાઈ જવાથી એકાગ્રતા પણ રહેતી નથી. તેઓ તે દેવોની જેમ ઘણા સમય સુધી એકટક દેખિથી ભગવાનના દર્શન કરી શકતા નથી. ૬.

(આર્યા)

તિત્થત્તણમાવળ્ણો મેસુ તુહ જમ્મણહાણજલજોએ ।
તં તસ્સ સૂરપમુહા પયાહિણ જિણ કુણંતિ સયા ॥૧૦॥

અનુવાદ : હે જિન! તે વખતે મેરુ પર્વત આપના જન્માભિષેકના જણના સંબંધથી તીર્થસ્વરૂપ બની ગયો હતો તેથી જ જાણે સૂર્ય-ચન્દ્રાદિ જ્યોતિષી દેવ નિરંતર તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. ૧૦.

(આર્યા)

મેરુસિરે પડણુચ્છલિયણીરતાડણપણદુદેવાણ ।
તં વિત્તં તુહ ણહાણ તહ જહ ણહમાસિ સંકિણણ ॥૧૧॥

અનુવાદ : જન્માભિષેક વખતે મેરુ પર્વતના શિખર ઉપરથી નીચે પડીને ઊંચે ઊંચે ઊછળતા જણના આઘાતથી કાંઈક ખેદ પામેલા દેવો દ્વારા આપનો તે જન્માભિષેક એવી રીતે સંપન્ન થયો કે જેથી આકાશ તે દેવો અને જણથી ભરાઈ ગયું. ૧૧.

(આર્યા)

ણાહ તુહ જમ્મણહાણે હરિણો મેરુમ્મિ ણચ્ચમાણસ્સ ।
વેલ્લિરભુયાહિ ભગા તઙ્ગ અજ વિ ભંગુરા મેહા ॥૧૨॥

અનુવાદ : હે નાથ! આપના જન્માભિષેક મહોત્સવમાં મેરુ પર્વત ઉપર નૃત્ય કરતા ઈન્દ્રની ચંચળ ભુજાઓથી નાશ પામેલા વાદળા અત્યારે પણ ભંગુર (વિનશ્વર) જોવામાં આવે છે. ૧૨.

(આર્યા)

જાણ બહુએહિં વિત્તી જાયા કપ્પદુમેહિં તેહિં વિણા ।
એકેણ વિ તાણ તએ પયાણ પરિકપ્પિયા ણાહ ॥૧૩॥

અનુવાદ : હે નાથ! ભોગભૂમિના સમયમાં જે પ્રજાજનોની આજીવિકા ઘણાં કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થઈ હતી તેમની તે આજીવિકા તે કલ્પવૃક્ષોના અભાવમાં એક માત્ર આપના દ્વારા સંપન્ન (પ્રદર્શિત) કરવામાં આવી હતી.

વિશોધાર્થ : પૂર્વે અહીં (ભરતક્ષેત્રમાં) જ્યારે ભોગભૂમિની પ્રવૃત્તિ હતી ત્યારે પ્રજાજનોની આજીવિકા ઘણા (દસ પ્રકારનાં) કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થતી હતી. પરંતુ જ્યારે ત્રીજા કાળનો અંત આવવામાં પલ્યનો આઠમો ભાગ બાકી હતો ત્યારે તે કલ્પવૃક્ષ ધીરે ધીરે નાન્દ થઈ ગયા હતા. તે વખતે ભગવાન् આદિ જિનેન્દ્ર તેમને કર્મભૂમિને યોગ્ય અસિ--મસિ આદિ આજીવિકાના સાધનોનું શિક્ષણ આપ્યું હતું. જેમ કે શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વામીએ કહું પણ છે-પ્રજાપતિર્યા પ્રથમં જિજીવિષુ : શશાસ કૃષ્ણાદિષુ કર્મસુ પ્રજાઃ । પ્રબુદ્ધતત્ત્વઃ પુનરદ્ભૂતોદયો મમત્વતો નિર્વિવિદે વિદાંવરઃ ॥ અભિપ્રાય એ છે કે જે જે જે ઋષભ જિનેન્દ્ર પહેલાં કલ્પવૃક્ષો નાન્દ થઈ જતાં આજીવિકા નિમિત્તે વ્યાકુળતા પામેલી પ્રજાને પ્રજાપતિ રૂપે કૃષિ આદિ છ કર્મોનું શિક્ષણ આપ્યું હતું તે જ ઋષભ જિનેન્દ્ર પછી વસ્તુસ્વરૂપ જાણીને સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થતાં થકા આશ્રયજનક અભ્યુદયને પ્રાપ્ત થયા અને સર્વ વિદ્વાનોમાં અગ્રેસર થઈ ગયા. બૃ. સ્વ. સ્તો. ૨. આ રીતે જે પ્રજાજન ભોગભૂમિના સમયમાં અનેક કલ્પવૃક્ષોથી આજીવિકા સમ્પન્ન કરતા હતા તેમણે કર્મભૂમિના પ્રારંભમાં એકમાત્ર ઉક્ત ઋષભ જિનેન્દ્રથી જ તે આજીવિકા સમ્પન્ન કરી હતી. તેઓ ઋષભ જિનેન્દ્ર પાસેથી અસિ, મસિ અને કૃષિ આદિ કર્મોનું શિક્ષણ મેળવીને આનંદપૂર્વક આજીવિકા મેળવવા લાગ્યા હતા. ૧૩.

(આર્યા)

પહુણા તાએ સણાહા ધરાસિ તીએ કહણાહા વૂઢો ।

ણવધણસમયસમુલ્લસિયસાસછમ્મેણ રોમંચો ॥૧૪॥

અનુવાદ : હે ભગવન્! તે વખતે પૃથ્વી આપ જેવા પ્રભુને પામીને સનાથ થઈ હતી. જો એમ ન થયું હોય તો પછી તે નવીન વર્ષકાળના સમયે પ્રગટ થયેલા ધાન્યાંકુરોના બજાને રોમાંચ કેવી રીતે ધારણ કરી શકત? ૧૪.

(આર્યા)

વિજુ બ ઘણે રંગે દિદૃપણદ્વા પણચ્ચિરી અમરી ।

જઇયા તઇયા વિ તાએ રાયસિરી તારિસી દિદ્વા ॥૧૫॥

અનુવાદ : હે ભગવન્! જ્યારે આપે વાદળાની વચ્ચે ક્ષણમાં નાનારી વીજળી સમાન રંગભૂમિ ઉપર જોતામાં મૃત્યુ પામનારી નૃત્ય કરતી નીલાંજના

અધિકાર-૧૩ : ઋષભસ્તોત્ર]

૨૮૩

અપ્સરાને જોઈ હતી ત્યારે આપે રાજ્યલક્ષ્મીને પણ એ જ રીતે ક્ષણભંગુર સમજી લીધી હતી.

વિશેષાર્� : કોઈ વખતે ભગવાનું ઋષભ જિનેન્દ્ર અનેક રાજા મહારાજાઓથી વીંટળાઈને સિંહાસન ઉપર બિરાજમાન હતા. તે વખતે તેમની સેવા કરવા માટે ઈન્દ્ર અનેક ગંધર્વો અને અપ્સરાઓ સાથે ત્યાં આવ્યા. તેણે ભક્તિવશે ત્યાં અપ્સરાઓનું નૃત્ય શરૂ કરાવ્યું. તેણે ભગવાનને રાજ્યભોગથી વિરક્ત કરવાની ઈચ્છાથી આ કાર્યમાં એવા પાત્રની (નીલાંજનાની) નિમણુંક કરી કે જેનું આયુષ્ય તરત જ પૂર્ણ થવાનું હતું. તે પ્રમાણે નીલાંજના રસ, ભાવ અને લય સાથે નૃત્ય કરી રહી હતી કે એટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું. અને તે દેખતાં દેખતાં ક્ષણવારમાં અદેશ્ય થઈ ગઈ. જોકે ઈન્દ્રે રસભંગના ભયથી ત્યાં બીજી તેવી જ અપ્સરા તત્કાળ ખડી કરી દીધી હતી, છતાં પણ ભગવાન ઋષભ જિનેન્દ્ર એનાથી અજાણ ન રહ્યા. આથી તેમના હદ્યમાં ઘણો વૈરાગ્ય થયો. (આ. પુ. ૧૭, ૧-૧૧.) ૧૫.

(આર્યા)

વેરગદિણે સહસા વસુહા જુણં વ જં મુઢા ।
દેવ તએ સા અઞ્ચ વિ વિલવઙ્સ સરિજલરવા વરાઈ ॥૧૬॥

અનુવાદ : હે દેવ! આપે વૈરાગ્યના દિવસે પૃથ્વીને જીર્ણ તૃણ સમાન એકાએક જ છોડી દીધી હતી, તેથી તે બિચારી આજ પણ નદીજળના ધ્વનિના બ્હાને વિલાપ કરી રહી છે. ૧૬.

(આર્યા)

અઝસોહિઓ સિ તઝય કાઉસસગદ્ધિઓ તુમં ણાહ ।
ધમિકધરારંભે ઉદ્ભીકયમૂલખંભો વ્બ ॥૧૭॥

અનુવાદ : હે નાથ! આપ કાર્યોત્સર્ગમાં સ્થિત થઈને એવા અત્યંત શોભતા હતા, જાણે ધર્મરૂપી અદ્વિતીય મહેલના નિર્માણમાં ઉપર ખડો કરવામાં આવેલો મૂળ સંભ જ હોય! ૧૭.

(આર્યા)

હિયયત્થજ્ઞાણસિહિડજ્ઞમાણ સહસા સરીરધૂમો વ્બ ।
સહઙ જિણ તુજ્જ સીસે મહુયરકુલસંણિહો કેસભરો ॥૧૮॥

અનુવાદ : હે જિન! આપના શિર ઉપર જે ભમરાઓના સમૂહ સમાન કાળા

કેશોનો ભાર છે તે એવો શોભે છે જાણે હદ્યમાં રહેલી ધ્યાનરૂપી અજિનથી સહસા
બળનાર શરીરનો ધૂમાડો જ હોય! ૧૮.

(આર્યા)

કર્મકલંકચउકે ણટે ણિમ્મલસમાહિભૂર્જા ।
તુહ ણાણદપ્પણે ચ્ચિય લોયાલોયં પડિષ્ફળિયં ॥૧૯૯॥

અનુવાદ : હે ભગવાન! નિર્મણ ધ્યાનરૂપ સંપત્તિથી ચાર ધાતિ કર્મરૂપ કલંક
નાટ થઈ જતાં પ્રગટ થયેલ આપના જ્ઞાન (કેવલજ્ઞાન) રૂપ દર્પણમાં જ લોક અને
અલોક પ્રતિબિંબિત થવા લાગ્યા હતા. ૧૯.

(આર્યા)

આવરણાઈણિ તએ સમૂલમુમૂલિયાઇ રદ્દૂણ ।
કર્મચઉકેણ મું વ ણાહ ભીએણ સેસેણ ॥૨૦॥

અનુવાદ : હે નાથ! તે વખતે જ્ઞાનાવરણાદિ ચાર ધાતી કર્માને મૂળમાંથી
નાટ થયેલાં જોઈને શેષ (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) ચાર આધાતી કર્મ
ભયથી જ જાણે મરેલા સમાન (અનુભાગથી ક્ષીણા) થઈ ગયા હતા. ૨૦.

(આર્યા)

ણાણામણિણિમાણે દેવ ઠિઓ સહસિ સમવસરણમિ ।
ઉવરિં વ સંણિવિદ્વો જિયાણ જોઈણ સવાણં ॥૨૧॥

અનુવાદ : હે દેવ! વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત સમવસરણમાં સ્થિત
આપ જીતી લેવામાં આવેલા સર્વ યોગીઓની ઉપર બેઠેલા જેવા સુશોભિત થાવ છો.

વિશોધાર્થ : જિનેજ્ર ભગવન્ સમવસરણ સત્ત્વામાં ગંધકૂટીમાં સ્વભાવથી જ સર્વથી ઉપર
વિરાજમાન રહે છે. એ બાબત ઉપર અહીં એ ઉત્પેક્ષા કરવામાં આવી છે કે તેમણે પોતાની
અભ્યંતર અને બાધ્ય લક્ષ્યી દ્વારા સર્વ યોગીઓને જીતી લીધા હતા. તેથી તેઓ જાણે તે બધા
યોગીઓની ઉપર સ્થિત હતા. ૨૧.

(આર્યા)

લોઉત્તરા વિ સા સમવસરણસોહા જિણેસ તુહ પાએ ।
લહિઝણ લહિ મહિમં રવિણો ણલિણિ વ કુસુમદ્વા [ડઢા] ॥૨૨॥

અનુવાદ : હે જિનેશ! તે સમવસરણની શોભા જો કે અલૌકિક હતી, છતાં પણ તે આપના પાદ (ચરણો) ને પ્રાપ્ત કરીને એવી મહિમા પામી કે જેથી પુષ્પોથી વ્યાપ્ત કર્મલિની સૂર્યના પાદ (કિરણો) ને પામીને મહિમા પ્રાપ્ત કરે છે. ૨૨.

(આર્યા)

ણિદ્રોસો અકલંકો અજડો ચંદો બ્ર સહસિ તં તહ વિ ।

સીહાસણાયલત્થો જિણિદ કયકુવલયાણંદો ॥૨૩॥

અનુવાદ : હે જિનેન્દ્ર! સિંહાસનરૂપ ઉદ્યાચળ ઉપર સ્થિત આપ ચન્દ્રમા સમાન કુવલય (પૃથ્વીમંડળ, ચંદ્રપક્ષે કુમુદ) ને આનંદિત કરો છો; તેથી જ તે ચન્દ્રમા સમાન સુશોભિત થાવ છો, તો પણ આપમાં તે ચન્દ્રમાની અપેક્ષાએ વિશેષતા છે-કારણ કે જેવી રીતે આપ અજ્ઞાનાદિ દોષોથી રહિત હોવાને કારણે નિર્દોષ છો તેવી રીતે ચન્દ્રમા નિર્દોષ નથી-તે સદોષ છે કારણ કે તે દોષો (રાત્રિ) સાથે સંબંધ રાખે છે. આપ કર્મમળ રહિત હોવાના કારણે અકલંક છો, પરંતુ ચન્દ્રમા કલંક (કાળા ચિહ્ન) સહિત જ છે. આપ જડતા (અજ્ઞાનતા) રહિત હોવાને કારણે અજડ છો પરંતુ ચન્દ્રમા અજડ નથી, પણ જડ છે-હિમગ્રસ્ત છે. ૨૩.

(આર્યા)

અચ્છંતુ તાવ ઇયરા ફુરિયવિવેયા ણમંતસિરસિહરા ।

હોઇ અસોઓ રૂક્ખો વિ ણાહ તહ સંણિહાણત્થો ॥૨૪॥

અનુવાદ : હે નાથ! જેમને વિવેક પ્રગટ થયો છે તથા જેમનું શિરરૂપ શિખર આપને નમસ્કાર કરવામાં નમ્રીભૂત થાય છે એવા બીજા ભવ્ય જીવ તો દૂર જ રહ્યા પરંતુ આપની સમીપમાં સ્થિત વૃક્ષ પણ અશોક થઈ જાય છે.

વિશેષાર્થ : અહીં ગ્રન્થકર્તા ભગવાન ઋષભ જિનેન્દ્રની સ્તુતિ કરતાં તેમની સમીપે રહેલ આઠ પ્રાતિહાર્યોમાંથી પ્રથમ અશોક વૃક્ષનો ઉલ્લેખ કરે છે તે વૃક્ષ જો કે નામથી જ ‘અશોક’ પ્રસિદ્ધ છે, છતાં પણ તેઓ પોતાના શષ્ટ્યાતુર્યથી એમ વ્યક્ત કરે છે કે જો જિનેન્દ્ર ભગવાનની કેવળ સમીપતા જ પામીને તે સ્થાવર વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ જાય છે તો ભલા જે વિવેકી જીવ તેમની સમીપમાં રહીને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર આદિ કરે છે તેઓ શોક રહિત કેમ ન થાય? અવશ્ય જ તેઓ શોક રહિત થઈને અનુપમ સુખ પ્રાપ્ત કરશે. ૨૪.

(આર્યા)

છત્તતયમાલાંબિયણિમ્મલમુત્તાહલચ્છલા તુજ્જા ।
જણલોયણેસુ વરિસઇ અમયં પિ વ ણાહ બિંદૂહિં ॥૨૫॥

અનુવાદ : હે નાથ! આપના ત્રણ છત્ર લટકતા નિર્મળ મોતિઓના બ્હાને જાણે બિંદુઓ દ્વારા ભવ્યજનોનાં નેત્રોમાં અમૃતની વર્ષા જ કરે છે.

વિશેખાર્થ : ભગવાન ઋષભ જિનેન્દ્રના શિર ઉપર જે ત્રણ છત્ર અવસ્થિત હતા તેમની ચારે તરફ જે સુન્દર મોતી લટકતા હતા તે લોકોના નેત્રોમાં એવા લાગતા હતા કે જાણે તે ત્રણ છત્ર તે મોતીઓના બ્હાને અમૃતબિંદુઓની જ વર્ષા કરી રહ્યા હોય. ૨૫.

(આર્યા)

કયલોયલોયગુણ્ણલહરિસાઇ સુરેસહ્યચલિયાઇ ।
તુહ દેવ સરય હરકિરણકયાઇ વ ચમરાઇ ॥૨૬॥

અનુવાદ : હે દેવ! લોકોનાં નેત્રોરૂપ નીલકમળોને હર્ષિત કરનાર જે ચમર ઈન્દ્રના હાથે આપના ઉપર ઢોળવામાં આવતા હતા તે શરદ કાળના ચન્દ્રમાના કિરણોથી કરવામાં આવ્યા હોય તેવા લાગતા હતા. ૨૬.

(આર્યા)

વિહલીકયપચસરે પંચસરો જિણ તુમમ્મિ કાઊણ ।
અમરકયપુષ્ફવિદ્ધિચ્છલા બહૂ મુવઇ કુસુમસરે ॥૨૭॥

અનુવાદ : હે જિન આપના વિષયમાં પોતાના પાંચ બાણોને વર્થ જોઈને તે કામદેવ દેવો દ્વારા કરવામાં આવતી પુષ્પવૃષ્ટિનાં બ્હાને જાણે આપના ઉપર ઘણાં પુષ્પમય બાણો છોડી રહ્યા છે.

વિશેખાર્થ : કામદેવનું એક નામ પંચશર પણ છે જેનો અર્થ થાય છે પાંચ બાણોવાળા આ બાણ પણ તેમના લોહમય ન હોતા પુષ્પમય માનવામાં આવે છે. તે આ જે બાણો દ્વારા કેટલાય અવિવેકી પ્રાણીઓને જીતીને તેમને વિષયાસકત કર્યા કરે છે. મૂળમાં અહીં ભગવાન ઋષભજિનેન્દ્ર ઉપર જે દેવોદ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી તેની ઉપર આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તે પુષ્પવર્ષા નથી પણ જ્યારે ભગવાનને પોતાને વશ કરવા માટે તે કામદેવ તેમની ઉપર પોતાના પાંચે બાણ ચલાવ્યા અને છતાં પણ તેઓ તેને વશ ન થયા ત્યારે તેણે જાણે તેમના ઉપર એક સાથે ઘણા બાણો છોડવા જ શરૂ કર્યા હતા. ૨૭.

(આર્યા)

એસ જિણો પરમપ્યા ણાણી અણાણ સુણહ મા વયરં ।
તુહ દુંદુહી રસંતો કહઇ વ તિજયસ્સ મિલિયસ્સ ॥૨૮॥

અનુવાદ :—હે ભગવન् ! શબ્દ કરતી થકી તમારી ભેરી ત્રણે લોકના સર્વ પ્રાણીઓને જાણે એમ કહી રહી હતી કે હે ભવ્ય જીવો ! આ જિનદેવ જ શાની પરમાત્મા છે, બીજા કોઈ પરમાત્મા નથી; તેથી એક જિનેન્દ્રદેવ સિવાય તમે બીજાઓનો ઉપદેશ ન સાંભળો. ૨૮.

(આર્યા)

રવિણો સંતાવયરં સસિણો ઉણ જહૃયાયરં દેવ ।
સંતાવજડતહરં તુજ્જ ચ્છિય પહુ પહાવલયં ॥૨૯॥

અનુવાદ :—હે દેવ ! સૂર્યનું પ્રભામંડળ તો સંતાપ કરનાર છે અને ચંદ્રનું પ્રભામંડળ જડતા (શીતપણું) ઉત્પન્ન કરે છે. પરંતુ હે પ્રભો ! સંતાપ અને જડતા (અજ્ઞાનતા) આ બન્નેને દૂર કરનાર પ્રભામંડળ એક આપનું જ છે. ૨૯.

(આર્યા)

મંદરમહિંદ્રમાણંબુરાસિણિઘોસસંણિહા તુજ્જા ।
વાણી સુહા ણ અણા સંસારવિસસ્સ ણાસયરી ॥૩૦॥

અનુવાદ :—મેરુ પર્વત વડે મથવામાં આવતા સમુદ્રની ધ્વનિ સમાન ગંભીર આપની ઉત્તમ વાણી અમૃત સ્વરૂપ હોઈને સંસારરૂપ વિષને નાદ કરનાર છે, એના સિવાય બીજા કોઈની વાણી તે સંસારરૂપ વિષને નાદ કરી શકતી નથી.

વિશેષાર્થ :—જિનેન્દ્ર ભગવાનની જે દિવ્યધ્વનિ ખરે છે તે તાળવું, કંઠ અને હોઠ આદિના વ્યાપારરહિત નિરક્ષાર હોય છે. તેનો અવાજ સમુદ્ર અથવા મેધગર્જના સમાન ગંભીર હોય છે. તેમાં એક આ વિશેષતા હોય છે કે જેથી શ્રોતાગણને એવું જ લાગે છે કે ભગવાન આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે તે દિવ્યધ્વનિ હોય છે તો નિરક્ષાર જ, પણ તેને માગધેવ અર્ધમાગધી ભાષામાં પરિણમાવે છે. તે દિવ્યધ્વનિ સ્વત્બાવથી ત્રણે સંધ્યાકાળે નવ મુહૂર્ત સુધી જ ખરે છે. પરંતુ ગણધર, ઈન્દ્ર અને ચક્રવર્તી આદિના પ્રશ્ન અનુસાર કોઈ વાર તે અન્ય સમયમાં પણ ખરે છે. તે એક યોજન સુધી સંભળાય છે.

ભગવાન જિનેન્દ્ર વીતરાગ અને સર્વજ્ઞ હોય છે તેથી તેમના દ્વારા નિર્દિષ્ટ તત્ત્વના વિષયમાં કોઈ પ્રકારનો સંદેહ આદિ કરી શકતો નથી. કારણ એ છે કે વચ્ચેનમાં અસત્યપણું કાં તો કથાયવશ જોવામાં આવે છે અથવા તો અલ્પજ્ઞતાને કારણો, અને તે જિનેન્દ્ર ભગવાનમાં રહ્યા નથી. માટે તેમની વાણીને અહીં અમૃત સમાન સંસાર વિષનાશક બતાવવામાં આવી છે. ૩૦.

(આર્યા)

પત્તાણ સારણિ પિવ તુજ્જ ગિરં સા ગર્ડ જડાણં પિ ।
જા મોક્ખતરુદ્વાણે અસરિસફલકારણં હોઇ ॥૩૧॥

અનુવાદ :—હે જિનેન્દ્રદેવ! ક્યારી સમાન તમારી વાણીને પ્રાપ્ત થયેલ અજ્ઞાની જીવોની પણ તે અવસ્થા થાય છે જે મોક્ષરૂપ વૃક્ષના સ્થાનમાં અનુપમ ફળનું કારણ થાય છે.

વિશેષાર્થ :—જેવી રીતે ઉત્તમ ક્યારી બનાવીને તેમાં લગાવવામાં આવેલું વૃક્ષ જળસિંયન પામીને ઈચ્છિત ફળ આપે છે તેવી જ રીતે જે ભવ્ય જીવ મોક્ષરૂપ વૃક્ષની ક્યારી સમાન તે જિનવાણી પામીને (સાંભળીને) તે પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે તેમને અવશ્ય જ તેનાથી અનુપમ ફળ (મોક્ષસુખ) પ્રાપ્ત થાય છે. ૩૧.

(આર્યા)

પોયં પિવ તુહ વયણં સંલીણા ફુડમહોકયજડોહં ।
હેલાએ ચિય જીવા તરંતિ ભવસાયરમણંત્ત ॥૩૨॥

અનુવાદ :—જેવી રીતે જલૌધ અર્થાત્ પાણીના સમૂહને અધઃકૃત (નીચે કરનારી) નૌકાનો આશ્રય લઈને પ્રાણી અનાયાસ જ અપાર સમુદ્રનો પાર પામી જાય છે, તેવી જ રીતે જડૌધ અર્થાત્ અજ્ઞાન સમૂહને અધઃકૃત (તિરસ્કૃત) કરનારી આપની વાણીરૂપ નૌકાનો આશ્રય લઈને ભવ્ય જીવ પણ અનાયાસે જ અનંત સંસારરૂપ સમુદ્રને પાર થઈ જાય છે, એ સ્પષ્ટ છે. ૩૨.

(આર્યા)

તુહ વયણં ચિય સાહિ ણૂળમણેયંતવાદવિયડવહં ।
તહ હિયયપર્ઝઅરં સવ્વત્તણમપ્પણો ણાહ ॥૩૩॥

અનુવાદ :—હે નાથ! હૃદયમાં પ્રતીતિ ઉત્પન્ન કરનારી આપની વાણી જ

નિશ્ચયથી અનેકાન્તવાદરૂપ કઠિન માર્ગને તથા આત્માના સર્વજ્ઞત્વને પણ સિદ્ધ કરે છે. ઉત્ત.

(આર્યા)

વિષણવિજાઈ જો તુહ ગિરાએ મદ્દસુઝબલેણ કેવલિણો ।
વરદ્વિદ્વિદ્વિણહજંતપવિખગણણે વિ સો અંધો ॥૩૪॥

અનુવાદ :—હે ભગવાન! જે મનુષ્ય પોતાના મતિજ્ઞાન અને શુત્રજ્ઞાનના બળ ઉપર આપના જેવા કેવળીની વાણીના વિષયમાં-તેના દ્વારા નિરૂપિત તત્ત્વસ્વરૂપમાં-વિવાદ (સંદેહાદિ) પામે છે, તેનું આ આચરણ તે અંધ મનુષ્ય સમાન છે, જે કોઈ નિર્મળ નેત્રોવાળા અન્ય મનુષ્ય દ્વારા દેખવામાં આવેલા એવા આકાશમાં સંચાર કરતાં પક્ષીઓની ગણતરી (સંઘ્યા)માં વિવાદ કરે છે. ઉત્ત.

(આર્યા)

ભિષ્ણાણ પરણયાણ એકેકમસંગ્યા ણયા તુજ્જા ।
પાવંતિ જયમ્મિ જયં મજ્જામ્મિ રિઝણ કિં ચિત્તં ॥૩૫॥

અનુવાદ :—હે ભગવન्! જગતમાં આપના પૃથ્વે પૃથ્વે એક એક નય શત્રુભૂત ભિન્ન ભિન્ન પરમતોની મધ્યમાં જો જ્ય પામે છે તો એમાં આશ્રય શું છે! કંઈ પણ નહિ. ઉત્પ.

(આર્યા)

અણણસ્સ જએ જીહા કસ્સ સયાણસ્સ વણણે તુજ્જા ।
જત્થ જિણ તે વિ જાયા સુગુરુપમુહા કર્ડ કુંઠા ॥૩૬॥

અનુવાદ :—હે જિન! જગતમાં તમારા વર્ણનમાં જે બૃહસ્પતિ આદિ કવિ પણ કુંઠિત (અસમર્થ) થઈ ગયા છે તેમાં ભલા અન્ય કચા બુદ્ધિમાનની જીબ સમર્થ થઈ શકે? અર્થાત્ આપના ગુણોનું કીર્તન જ્યાં બૃહસ્પતિ આદિ પણ કરી શક્યા નથી તો પછી બીજો કચો એવો કવિ છે જે આપના તે ગુણોનું પૂર્ણપણે કીર્તન કરી શકે? ઉત્ત.

(આર્યા)

સો મોહથેણરહિઓ પયાસિઓ પહુ સુપહો તએ તઝયા ।
તેણજ્ઞ વિ ર્યણજુયા ણિવિગ્ધં જંતિ ણિવાણં ॥૩૭॥

અનુવાદ :—હે પ્રભો! તે વખતે આપે મોહરૂપ ચોર રહિત તે સુમાર્ગ (મોક્ષમાર્ગ) પ્રગટ કર્યો હતો કે જેથી આજે પણ મનુષ્ય રત્નો (રત્તત્રય) સહિત થઈને નિર્બાધપણે મોક્ષમાં જાય છે.

વિશેષાર્થ :—જેમ શાસનના સારા પ્રબંધથી ચોર રહિત કરવામાં આવેલા માર્ગો મનુષ્ય ઈચ્છિત ધન લઈને નિર્બાધપણે ગમનાગમન કરે છે, તેવી જ રીતે ઋષભદેવ ભગવાને પોતાના દિવ્ય ઉપદેશ દ્વારા જે મોક્ષમાર્ગને મોહરૂપ ચોરથી રહિત કરી દીધો હતો તેના ઉપર ચાલીને સાધુ પુરુષો અત્યારે પણ સમ્યગ્દર્શનાદિરૂપ અનુપમ રત્નો સાથે નિર્વિદ્ધનપણે ઈચ્છિત સ્થાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૩૭.

(આર્યા)

ઉમ્મુદ્દિયમિ તમ્મિ હુ મોક્ષળિહાણમિ ગુણિહાણ તએ ।

કેહિં ણ જુણન્તિણાઇ વ ઇયરણિહાણેહિં ભુવણમિ ॥૩૮॥

અનુવાદ :—હે ગુણનિધાન! આપના દ્વારા તે મોક્ષરૂપ નિધિ (ખજાનો) ખોલી નાખવામાં આવતા લોકમાં ક્યા ભવ્ય જીવોએ રત્ન-સુવર્ણાદિ રૂપ બીજા ખજાના જીણું ધાસ સમાન છોડ્યા નહોતા? અર્થાત્ ધાણાએ તેમનો ત્યાગ કરી જિનદીક્ષાનો સ્વીકાર કર્યો હતો. ૩૮.

(આર્યા)

મોહમહાફળિડકો જણો વિરાયં તુમં પમુતૂણ ।

ઇયરણાએ કહ પહુ વિચેયણો ચેયણં લહઝ ॥૩૯॥

અનુવાદ :—હે પ્રભુ! મોહરૂપી મહા સર્પદ્વારા કરડાવાથી મૂર્ખર્ય પામેલો મનુષ્ય આપ વીતરાગને છોડીને બીજાની આજા (ઉપદેશ)થી કેવી રીતે ચેતના પામી શકે? અર્થાત્ પામી શકે નહિએ.

વિશેષાર્થ :—જેમ સર્પ કરડાવાથી મૂર્ખર્ય પામેલો મનુષ્ય મંત્ર જાણનારના ઉપદેશથી નિર્વિષ બનીને ચેતનપણું પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે મોહરી ગ્રસાયેલ સંસારી પ્રાણી આપના સદ્ગુપ્તદેશથી અવિવેક છોડીને પોતાનું ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૩૯.

(આર્યા)

ભવસાયરમિ ધમ્મો ધરઝ પડંતં જણં ચ્યેય ।

સવરર્સ વ પરમારણકારણમિયરાણ જિણાહ ॥૪૦॥

અનુવાદ :—હે જિનેન્દ્ર! સંસારરૂપ સમુદ્રમાં પડતા પ્રાણીનું રક્ષણ આપનો જ ધર્મ કરે છે. બીજાઓનો ધર્મ તો ભીલના ધર્મ (ધનુષ્ય) સમાન અન્ય જીવોને મારવાનું જ કરણ થાય છે. ૪૦.

(આર્યા)

અણો કો તુહ પુરાઓ વગદ ગરુયત્તણ પ્યાસંતો ।

જમ્મિ તદ્દ પરમિયત્તં કેસણહાણં પિ જિણ જાયં ॥૪૧॥

અનુવાદ :—હે જિન! જે આપના વાળ અને નખ પણ પરિમિતતા પામ્યા અર્થાત્ વૃદ્ધિરહિત થઈ ગયા હતા તેવા આપની આગળ બીજો કોણ પોતાનો મહિમા પ્રગટ કરતો થકો જઈ શકે? અર્થાત્ કોઈ જઈ શકે નહિ.

વિશેષાર્થ :—કેવળજ્ઞાન પ્રગટતાં નખ અને વાળની વૃદ્ધિ થતી નથી. એ બાબત ઉપર અહીં એમ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તે નખકેશની વૃદ્ધિનો અભાવ જાણો એમ સૂચન કરતો હતો કે આ જિનેન્દ્ર ભગવાન સર્વશ્રેષ્ઠ છે, એમની આગળ બીજા કોઈનો પ્રભાવ રહી શકતો નથી. ૪૧.

(આર્યા)

સહદ શરીરં તુહ પછુ તિહુયણજણણયણબિંબવિચુરિયં ।

પડિસમયમચ્ચિયં ચારુતરલણીલુપ્પલેહિં ॥૪૨॥

અનુવાદ :—હે પ્રભો! આપના શરીર ઉપર જે ત્રણો લોકના પ્રાણીઓના નેત્રોનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તેનાથી વ્યાપ્ત તે શરીર એવું લાગતું હતું કે જાણો તે નિરંતર સુંદર અને ચંચળ નીલકમળો દ્વારા પૂજા પામી રહ્યું હોય. ૪૨.

(આર્યા)

અહમહમિયાએ ણિવડંતિ ણાહ છુહિયાલિણો બ હરિચક્ખૂ ।

તુજ્જન ચ્ચિય ણહપહસરમજ્જદ્વિયચલણકમલેસું ॥૪૩॥

અનુવાદ :—હે નાથ! તમારા જ નખોની કાન્તિરૂપ સરોવરની મધ્યમાં સ્થિત ચરણરૂપ કમળો ઉપર જે ઈન્દ્રના નેત્રો પડે છે તે એવા દેખાય છે કે જાણો અહમહમિકા અર્થાત્ હું પહેલાં પહોંચું, હું પહેલાં પહોંચું, આ રૂપે ભૂખ્યા ભ્રમર જ તેમની ઉપર પડી રહ્યા હોય. ૪૩.

(આર્યા)

કણયકમલાણમુવરિં સેવા તુહ વિબુહકપ્પિયાણ તુહં ।
અહિયસિરીણં તત્તો જુત્તં ચરણાણ સંચરણં ॥૪૪॥

અનુવાદ :—હે ભગવન् ! આપની સેવા માટે દેવો દ્વારા રચવામાં આવેલા સુવર્ણમય કમળો ઉપર જે આપના ચરણોનો સંચાર થતો હતો તે યોગ્ય જ હતું કેમ કે આપના ચરણોની શોભા તે કમળો કરતાં વધારે હતી. ૪૪.

(આર્યા)

સઙ્ગ-હરિકયકળણસુહો ગિજ્જિ અમરેહિં તુહ જસો સગે ।
મળ્ણે તં સોઉમળો હરિણો હરિણંકવમલ્લીણો ॥૪૫॥

અનુવાદ :—હે જિનેન્દ્ર ! સ્વર્ગમાં ઈન્દ્રાણી અને ઈન્દ્રના કાનોને સુખ આપનાં જે દેવોદ્વારા આપનું યશોગાન કરવામાં આવે છે તે સાંભળવા માટે ઉત્સુક થઈને જ જાણે હરણો ચન્દ્રનો આશ્રય લીધો છે, એમ હું સમજું છું. ૪૫.

(આર્યા)

અલિયં કમલો કમલા કમકમલે તુહ જિણિંદ સા વસઙ્ગ ।
ણહકિરણણિહેણ ઘડંતિ ણયજણે સે કડકખષ્ઠડા ॥૪૬॥

અનુવાદ :—હે જિનેન્દ્ર ! કમળમાં લક્ષ્મી રહે છે એમ કહેવું અસત્ય છે; કારણ કે તે તો આપના ચરણકમળમાં રહે છે, તેથી જ તો નમસ્કાર કરતા જનો ઉપર આપના નખોના ક્રિરણોના બ્ધાને તેના નેત્રકટાક્ષોની કાન્તિ સંગ પામી શકે છે. ૪૬.

(આર્યા)

જે કયકુવલયહરિસે તુમમ્મિ વિદ્વેસિણો સ તાણ પિ ।
દોસો સસિમ્મિ વા આહ્યાણ જહ વાહિઆવરણ ॥૪૭॥

અનુવાદ :—હે જિનેન્દ્ર ! કુવલય અર્થાત્ ભૂમંડળને હર્ષિત કરનાર આપના વિષયમાં જે વિદ્વેષ રાખે છે તે તેમનો જ દોષ છે. જેમ-કુવલય (કુમુદ)ને પ્રફુલ્લિત કરનાર ચન્દ્રના વિષયમાં જે મૂર્ખ બહારનું આવરણ કરે છે તો તે તેમનો જ દોષ હોય છે, નહિ કે ચન્દ્રનો. અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ચન્દ્રનો પ્રકાશ

(ચાંદની) રોકવા માટે જો બાધ્ય આવરણ કરે છે તો તે તેનો જ દોષ ગણવામાં આવે છે, નહિ કે ચન્દ્રનો, કારણ કે તે તો સ્વભાવે પ્રકાશક અને આહૃતાદજનક જ છે. એવી જ રીતે જો કોઈ અશાની જીવ આપને પામીને પણ આત્મહિત કરતો નથી તો એ તેનો જ દોષ છે, નહિ કે આપનો. કારણ કે આપ તો સ્વભાવથી બધા જ પ્રાણીઓના હિતકારક છો. ૪૭.

(આર્યા)

કો ઇહ હિ ઉવ્વરંતો જિણ જયસંહરણમરણવણસિહિણો ।

તુહ પયથુઇણિજ્ઞારણી વારણમિણમો ણ જઇ હોંતિ ॥૪૮॥

અનુવાદ :—હે જિન! જો આપના ચરણોની સ્તુતિરૂપ આ નદી રોકનારી (ઓલવનારી) ન હોત તો પછી અહીં જગતનો સંહાર કરનારી મૃત્યુરૂપ દાવાનિથી કોણ બચી શકતું હતું? અર્થાત્ કોઈ બાકી ન રહી શકત. ૪૮.

(આર્યા)

કરજુવલકમલમઉલે ભાલત્થે તુહ પુરો કાએ વસદ્દ ।

સગાપવગકમલા કુર્ણંતિ તં તેણ સપ્પુરિસા ॥૪૯॥

અનુવાદ :—હે ભગવન્! આપની આગળ નમસ્કાર કરતી વખતે મસ્તક ઉપર સ્થિત બન્ને હાથરૂપ કમળની કળીમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી નિવાસ કરે છે, તેથી સજજન પુરુષ તેને (બન્ને હાથ કપાળ ઉપર સ્થિત) કર્યા કરે છે. ૪૯.

(આર્યા)

વિયલદ મોહણધૂલી તુહ પુરાઓ મોહઠગપરદુવિયા ।

પણવિયસીસાઓ તાા પણવિયસીસા બુહા હોંતિ ॥૫૦॥

અનુવાદ :—હે જિનેન્દ્ર! તમારી આગળ નમ્રીભૂત થયેલા શિરથી મોહરૂપ ઠગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મોહનધૂળ (મોહ પમાડનારી ધૂળ) નાશ પામી જાય છે, તેથી વિદ્વાનો શિર નમાવીને આપને નમસ્કાર કરે છે. ૫૦.

(આર્યા)

વંભષ્પમુહા સણણ સવા તુહ જે ભરંતિ અણસ્સ ।

સસિજોણહા ખજ્ઝોએ જડેહિ જોડિઝ્ઝે તેહિં ॥૫૧॥

અનુવાદ :—હે ભગવન્! જે લોકો આપના બ્રહ્મા આદિ સર્વ નામોને બીજા (વિધાતા આદિ) ના બતાવે છે તે મૂર્ખ જાણે ચંદ્રની ચાંદનીને આગિયા સાથે જોડે છે.

વિશેષાર્થ :—જેમ આગિયાનો પ્રકાશ કદી ચાંદની સમાન થઈ શકતો નથી તેવી જ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઈત્યાદિ જે આપના સાર્થક નામ છે તે દેવરૂપે મનાતા બીજાઓના કદી થઈ શકતા નથી. તે સર્વ તો આપના જ નામ છે. જેમ કે-ત્વામવ્ય વિભુમચિન્નસંખ્યમાદ્ય બ્રહ્માણમીશ્રમનન્તમનઙ્ગકેતુમ્! યોગીશ્વરં વિદિત્યોગમનેકમેકં જ્ઞાનસ્વરૂપમમલં પ્રવદન્તિ સત્તઃ॥ બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિતબુદ્ધિબોધાત્ત્વ શંકરોડસિ ભુવનત્રયશંકરત્વાત્ । ધાતાસિ ધીર શિવમાર્ગવિધેર્વિધાનાદ્ વ્યક્તં ત્વમેવ ભગવન્ પુરુષોત્તમોડસિ [ભક્તામર૦ ૨૪-૨૫]॥ ૫૧.

(આર્યા)

તં ચેવ મોક્ખપયવી તં ચિય સરણ જણસ્સ સબ્વસ્સ ।
તં ણિક્વારણવિજ્ઞો જાઇજરામરણવાહિહરો ॥૫૨॥

અનુવાદ :—હે જિનેન્દ્ર! તમે જ મોક્ષમાર્ગ છો. તમે જ સર્વ પ્રાણીઓને શરણભૂત છો; તથા તમે જ જન્મ, જરા અને મરણરૂપ વ્યાધિને નષ્ટ કરનાર નિસ્વાર્થ વૈદ્ય છો. ૫૨.

(આર્યા)

કિછાહિં સમુવલદ્ધે કયકિચ્ચા જમ્મિ જોડણો હોંતિ ।
તં પરમકારણ જિણ ણ તુમાહિંતો પરો અસ્થિ ॥૫૩॥

અનુવાદ :—હે અર્હન્! જે આપને કષ્ટપૂર્વક પ્રાપ્ત કરીને (જાણીને) યોગીજન કૃતકૃત્ય થઈ જાય છે તે તમે જ તે કૃતકૃત્યતાના ઉત્કૃષ્ટ કારણ છો, તમારા સિવાય બીજા કોઈ તેનું કારણ થઈ શકતું નથી. ૫૩.

(આર્યા)

સુહમો સિ તહ ણ દીસસિ જહ પહુ પરમાણુપેચ્છએહિ પિ ।
ગુરુવો તહ બોહમએ જહ તઝ સબ્વ પિ સંમાયં ॥૫૪॥

અનુવાદ :—હે પ્રભો! તમે એવા સૂક્ષ્મ છો કે જેથી પરમાણુને દેખનારા પણ તમને દેખી શકતા નથી તથા તમે એવા સ્થૂળ છો કે જેથી અનંત જ્ઞાનસ્વરૂપ આપમાં આખું ય વિશ્વ સમાઈ જાય છે. ૫૪.

(આર્યા)

ણીસેસવત્થુસત્થે હેયમહેયં ણિરુવમાણસ્સ |
તં પરમપ્યા સારો સેસમસારં પલાલં વા ॥૫૫॥

અનુવાદ :—હે ભગવન્! સમસ્ત વસ્તુઓના સમૂહમાં આ હેય છે અને આ ઉપાદેય છે, એવું નિરૂપણ કરનાર શાશ્વતો સાર તમે પરમાત્મા જ છો, બાકી બધું પરાળ (પૂળા) સમાન નિઃસાર છે. ૫૫.

(આર્યા)

ધરદી પરમાણુલીલં જગદ્ભે તિહુયં પિ તં પિ ણહં ।
અંતો ણાણસ્સ તુહ ઇયરસ્સ ણ એરિસી મહિમા ॥૫૬॥

અનુવાદ :—હે સર્વજ્ઞ! જે આકાશના ગર્ભમાં ત્રણે ય લોક પરમાણુની લીલા ધારણ કરે છે અર્થાત् પરમાણુ સમાન જ્ઞાય છે, તે આકાશ પણ આપના જ્ઞાનમાં પરમાણુ જેવું લાગે છે. આવો મહિમા બ્રહ્મા-વિષ્ણુ વગેરે કોઈ બીજાનો નથી. ૫૬.

(આર્યા)

ભુવણત્થુય થુણદ જડ જાએ સરરસર્ડ સંતયં તુહં તહ વિ ।
ણ ગુણંતં લહદ તહિ કો તરદી જડો જણો અણો ॥૫૭॥

અનુવાદ :—હે ભુવનસ્તુત! જો સંસારમાં તમારી સ્તુતિ સરસ્વતી પણ નિરંતર કરે તો પણ તે જો તમારા ગુણોનો અંત પામતી નથી તો પછી બીજો ક્યો મૂર્ખ મનુષ્ય તે ગુણસમૂહમાં તરી શકે? અર્થાત् આપના સર્વ ગુણોની સ્તુતિ કોઈ પણ કરી શકતું નથી. ૫૭.

(આર્યા)

ખયરિ વ સંચરંતી તિહુયણગુરુ તુહ ગુણોહગયણમ્મિ ।
દૂરં પિ ગયા સુઇરં કરસ્સ ગિરા પત્તપેરંતા ॥૫૮॥

અનુવાદ :—હે ત્રિભુવનપતે! આપના ગુણસમૂહરૂપ આકાશમાં પદ્ધિણી (અથવા વિદ્યાધરી) સમાન ચિરકાળથી સંચાર કરનારી કોઈની વાણીએ દૂર જઈને પણ શું તેનો (આકાશનો, ગુણસમૂહનો) અંત મેળવ્યો છે? અભિપ્રાય એ છે કે જેમ

પક્ષી ચિરકાળ સુધી ગમન કરીને પણ આકાશનો અંત પામતું નથી તેવી જ રીતે ચિરકાળ સુધી સ્તુતિ કરીને પણ કોઈની વાણી આપના ગુણોનો અંત પામી શકતી નથી. ૫૮.

(આર્યા)

જત્થ અસકો સકો અણીસરો ઈસરો ફળીસો વિ ।
તુહ થોતે તત્થ કર્ઝ અહમમર્ઝ તં ખમિજાસુ ॥૫૯॥

અનુવાદ :—હે ભગવન् ! તમારા જે સ્તોત્રના વિષયમાં ઈન્દ્ર અશક્ત છે, ઈશ્વર (મહાદેવ) અનીશ્વર (અસમર્થ) છે તથા ધરણેન્દ્ર પણ અસમર્થ છે; તે તારા સ્તોત્રના વિષયમાં હું નિર્બુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું? અર્થાતુ થઈ શકું નહિ. તેથી ક્ષમા કરો. ૫૮.

(આર્યા)

તં ભવપોમણંદી તેયણિહી ણેસરુ ક્વ ણિદ્વોસો ।
મોહંધ્યારહરણે તુહ પાયા મમ પસીયંતુ ॥૬૦॥

અનુવાદ :—હે જિન ! તમે સૂર્ય સમાન પદ્મનાન્દી અર્થાતુ ભવ્યજીવોરૂપ કમળોને આનંદિત કરનાર, તેજના ભંડાર અને નિર્દોષ અર્થાતુ અજ્ઞાનાદિ દોષરહિત (સૂર્યના પક્ષે-દોષો રહિત) છો. તમારા પાદ (ચરણ) સૂર્યના પાદ (કિરણો) સમાન મારા મોહરૂપ અંધકારનો નાશ કરવામાં પ્રસન્ન થાવ. ૬૦.

આ રીતે ઋષભસ્તોત્ર સમાપ્ત થયું. ૧૩.



૧૪. જિનવર સ્તવન

[૧૪. જિનવરસ્તવનમ्]

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર સહલીહૂઆઇં મજ્જા ણયણાઇં ।
ચિત્તં ગત્ત ચ લહું અમિએણ વ સિંચિયં જાયં ॥૧॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં મારા નેત્ર સફળ થઈ ગયા તથા
મન અને શરીર તરત જ અમૃત સિંચાઈ ગયા હોય તેમ શાન્ત થઈ ગયા છે. ૧.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર દિદ્દુહરાસેસમોહતિમિરેણ ।
તહ ણદું જડ દિદું જહદુંયં તં મએ તચ્ચં ॥૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં દર્શનમાં બાધા પહોંચાડનાર
સમસ્ત મોહ (દર્શનમોહ) રૂપ અંધકાર એવી રીતે નાચ થઈ ગયો છે કે જેથી મેં
જેવું છે તેવું તત્ત્વ જોઈ લીધું છે—સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું છે. ૨.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર પરમાણદેણ પૂરિયં હિયં ।
મજ્જા તહા જહ મણે મોક્ખં પિવ પત્તમષ્ણાણં ॥૩॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારું અંત:કરણ એવા ઉત્કૃષ્ટ
આનંદથી પરિપૂર્ણ થઈ ગયું છે કે જેથી હું મને મુક્તિ પ્રાપ્ત થયેલ જ સમજું
છું. ૩.

(આર્યા)

દિદ્દે તુમમિ જિણવર ણદું ચિય મળણિયં મહાપાવં ।
રવિઉગ્ઘે ણિસાએ ઠાડ તમો કિત્તિયં કાલં ॥૪॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં હું ભહાપાપને નાટ થયેલું જ માનું છું. બરાબર છે—સૂર્યનો ઉદ્ય થતાં રાત્રિનો અંધકાર ભલા કેટલો વખત ટકી શકે છે? અર્થાતું ટકતો નથી, તે સૂર્યનો ઉદ્ય થતાં જ નાટ થઈ જાય છે. ૪.

(આર્યા)

દિદ્દે તુમમિ જિણવર સિજ્જાઇ સો કો વિ પુણ્ણપદ્ભારો ।
હોડ જણો જેણ પહુ ઇહપરલોયથસિદ્ધીણં ॥૫॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં એવો કોઈ અપૂર્વ પુણ્ણનો સમૂહ સિદ્ધ થાય છે કે જેથી પ્રાણી આ લોક અને પરલોક સંબંધી ઈષ સિદ્ધિઓનો સ્વામી બની જાય છે. ૫.

(આર્યા)

દિદ્દે તુમમિ જિણવર મણે તં અપ્પણો સુકયલાહં ।
હોહી સો જેણાસરિસસુહણિહી અક્ખઓ મોક્ખો ॥૬॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં હું મને એવા પુણ્ણલાભવાળો માનું છું કે જેથી મને અનુપમ સુખના ભંડારસ્વરૂપ તે અવિનશ્બર મોક્ષ પ્રાપ્ત થશે. ૬.

(આર્યા)

દિદ્દે તુમમિ જિણવર સંતોસો મજ્જ તહ પરો જાઓ ।
ઇંદવિહ્વો વિ જણા ણ તણ્હાલેસં પિ જહ હિયએ ॥૭॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મને એવો ઉત્કૃષ્ટ સંતોષ ઉત્પન્ન થયો છે કે જેથી મારા હૃદયમાં ઈન્દ્રનો વૈભવ પણ લેશમાત્ર તૃષ્ણા ઉત્પન્ન કરતો નથી. ૭.

(આર્યા)

દિદ્દે તુમમિ જિણવર વિયારપડિવજ્ઞિએ પરમસંતે ।
જસ્સ ણ હિદ્દી દિદ્દી તસ્સ ણ ણવજમ્મવિચ્છેઓ ॥૮॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! રાગાદિ વિકાર રહિત અને અતિશય શાંત એવા આપના દર્શન થતાં જેની દણ્ઠિ હર્ષ પામતી નથી તેને નવીન જન્મનો નાશ થઈ શકતો નથી અર્થાત્ તેની સંસાર પરંપરા ચાલતી જ રહેશે. ૮.

(આર્યા)

દિદ્રે તુમમ્મિ જિણવર જં મહ કળ્ઞતરાઉલં હિયં ।
કઇયા વિ હવઙ્સ પુબજીયસ્ય કમ્મસ્સ સો દોસો ॥૧॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થયા પછી ય જો મારું હદ્ય કોઈવાર બીજા કોઈ મહાન્ન કાર્યથી વ્યાકુળ થાય છે તો તે પૂર્વોપાર્જિત કર્મના દોષથી થાય છે. ૯.

(આર્યા)

દિદ્રે તુમમ્મિ જિણવર અચ્છજ જમંતરં મમેહાવિ ।
સહસા સુહેહિં ઘડિયં દુક્ખેહિં પલાઇયં દૂરં ॥૧૦॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપના દર્શન થતાં અન્ય જન્મના સુખની ઈચ્છા તો દૂર રહો, પરંતુ તેનાથી આ લોકમાં પણ મને અક્ષમાત્ર સુખ પ્રાપ્ત થયું છે અને સર્વ દુઃખો દૂર ભાગી ગયા છે. ૧૦.

(આર્યા)

દિદ્રે તુમમ્મિ જિણવર બજ્જાઇ પદ્દો દિણમ્મિ અન્નયણે ।
સહલત્તણેણ મજ્જે સબ્વદિણાણં પિ સેસાણં ॥૧૧॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપના દર્શન થતાં બાકીના બધા જ દિવસોમાં આજના દિવસે સફળતાનો પડું બાંધવામાં આવ્યો છે. અભિપ્રાય એમ છે કે આટલા દિવસોમાં આજનો આ મારો દિવસ સફળ થયો છે કારણ કે આજ મને ચિરસંચિત પાપનો નાશ કરનારું આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ૧૧.

(આર્યા)

દિદ્રે તુમમ્મિ જિણવર ભવણમિણં તુજ્જ મહ મહગ્ધતરં ।
સબ્વાણં પિ સિરીણં સંકેયઘરં વ પડિહાઇ ॥૧૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં આ તમારું મહા-મૂલ્યવાન ધર (જિનમંદિર) મને બધી લક્ષ્મીઓના સંકેતગૃહ સમાન પ્રતિભાસે છે. અભિપ્રાય એ કે અહીં દર્શન કરતાં મને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થશે. ૧૨.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ભત્તિજલોલ્લં સમાસિયં છેત્તં ।
જં તં પુલયમિસા પુણ્યબીયમંકુરિયમિવ સહદ્દ ॥૧૩॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં ભક્તિરૂપ જળથી ભીજાયેલા ખેતર (શરીર) ને જે પુણ્યરૂપ બીજ પ્રાપ્ત થયું હતું તે જાણે રોમાંચના બ્હાને અંકુરિત થઈને જ શોભી રહ્યું છે. ૧૩.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર સમયામયસાયરે ગહીરમ્મિ ।
રાયાઇડોસકલુસે દેવે કો મણણે સયાણો ॥૧૪॥

અનુવાદ : હે જિનેન્દ્ર! સિદ્ધાન્તરૂપ અમૃતના સમુક્ર અને ગંભીર એવા આપના દર્શન થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય રાગાદિ-દોષોથી મલિનતાને પ્રાપ્ત થયેલ દેવોને માને? અર્થાતું કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તેમને દેવ માનતો નથી. ૧૪.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર મોક્ખો અદ્દુલ્લહો વિ સંપદદ્દ ।
મિચ્છત્તમલકલંકી મણો ણ જદુ હોડુ પુરિસસ્ ॥૧૫॥

અનુવાદ : હે જિનેન્દ્ર! જો પુરુષનું મન મિથ્યાત્વરૂપ ભળથી મલિન ન હોય તો આપનું દર્શન થતાં અત્યંત દુર્લભ મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. ૧૫.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ચમ્મમણણચ્છિણા વિ તં પુણ્ણં ।
જં જણદુ પુરો કેવલદંસણણાઙ્દિં ણયણાઙ્દિં ॥૧૬॥

અનુવાદ : હે જિનેન્દ્ર! ચર્મભય નેત્રથી પણ આપનું દર્શન થતાં તે પુણ્ય પ્રાપ્ત થાય છે કે જે ભવિષ્યમાં કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપ નેત્રોને ઉત્પન્ન કરે છે. ૧૬.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર સુકયત્થો મળણાઓ ણ જેણપ્પા ।
સો બહુયબુહુણુખુહુણાં ભવસાયરે કાહી ॥૧૭॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં જે જીવ પોતાને અતિશય કૃતાર્થ (કૃતકૃત્ય) માનતો નથી તે સંસારરૂપ સમુદ્રમાં અનેકવાર ગોથા ખાશે. ૧૭.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ણિચ્છયદિદ્દીએ હોઇ જં કિં પિ ।
ણ ગિરાએ ગોચરં તં સાણુભવત્થં પિ કિં ભણિમો ॥૧૮॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં જે કાંઈ પણ થાય છે તે નિશ્ચયદેષ્ટિએ વચ્ચના વિષય નથી, તે તો કેવળ સ્વાનુભવનો જ વિષય છે. તેથી તે વિષયમાં ભલા અમે શું કહી શકીએ? અર્થાત્ કાંઈ કહી શકતા નથી-તે અનિર્વચનીય છે. ૧૮.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર દદ્દુબ્બાવહિવિસેસરુવમ્મિ ।
દંસણસુદ્ધીએ ગયં દાણિં મહ ણત્થિ સવ્વત્થા ॥૧૯॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! દેખવા યોગ્ય પદાર્થોના સીમાવિશેષ સ્વરૂપ (સર્વથી અધિક દર્શનીય) આપનું દર્શન થતાં જે દર્શનવિશુદ્ધિ થઈ છે તેનાથી આ વખતે એ નિશ્ચય થયો છે કે સર્વ બાધ્ય પદાર્થ મારા નથી. ૧૯.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર અહિયં સુહિયા સમુજ્જલો હોઇ ।
જણદિદ્દી કો પેચ્છિ તદ્વંસણસુહયરં સૂરં ॥૨૦॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં લોકોની દેષ્ટિ અતિશય સુખયુક્ત અને ઉજ્જવળ થઈ જાય છે. પછી ભલા ક્યો બુદ્ધિમાન મનુષ્ય તે દેષ્ટિને સુખકારક એવા સૂર્યનું દર્શન કરે? અર્થાત્ કોઈ કરે નહિ. ૨૦.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર બુહમ્મિ દોસોજીયમ્મિ વીરમ્મિ ।
કસ્સ કિર રમઝ દિદ્દી જડમ્મિ દોસાયરે ખત્થે ॥૨૧॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! શાની, દોષરહિત અને વીર એવા આપને જોઈ લીધા પછી કોની દસ્તિ ચન્દ્રમા તરફ રમે ? અર્થાત્ આપનું દર્શન કરીને પછી કોઈને ય ચન્દ્રમાના દર્શનની ઈચ્છા રહેતી નથી. કારણ કે તેનું સ્વરૂપ આપનાથી વિપરીત છે- આપ શાની છો, પરંતુ તે જડ (મૂર્ખ, શીતળ) છે. આપ દોષોજિત અર્થાત્, અજ્ઞાનાદિ દોષોથી રહિત છો. પરંતુ તે દોષાકર (દોષોની ખાણ, રાત્રિ કરનાર) છે તથા આપ વીર અર્થાત્ કર્મશત્રુઓને જીતનાર સુભટ છો પરંતુ તે ખસ્થ (આકાશમાં સ્થિત) અર્થાત્ ભયભીત થઈને આકાશમાં છુપાઈને રહેનાર છે. ૨૧.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ચિંતામણિકામધેણુકપ્પતરુ ।
ખજ્યોય વ્ય પહાએ મજ્જ મણે ણિપ્પહા જાયા ॥૨૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ પણ એવી રીતે કાન્તિહીન (ફીક્કા) થઈ ગયા છે જેમ પ્રભાત થઈ જતાં આગિયા કાન્તિહીન થઈ જાય છે. ૨૨.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર રહસરસો મહ મણમ્મિ જો જાઓ ।
આણંદસુમિસા સો તત્તો ણીહરઙ બહિરંતો ॥૨૩॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં મારા મનમાં જે હર્ષરૂપ જળ ઉત્પન્ન થયું છે તે જાણો હર્ષના કારણે ઉત્પન્ન થયેલ અંસુઓના બહાને અંદરની બહાર જ નીકળી રહ્યું છે. ૨૩.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર કલ્લાણપરંપરા પુરો પુરિસે ।
સંચરઙ અણાહૂયા વિ સસહરે કિરણમાલ વ્ય ॥૨૪॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં કલ્યાણની પરંપરા (સમૂહ) બોલાવ્યા વિના જ પુરુષની આગળ એવી રીતે ચાલે છે જેમ ચન્દ્રમાની આગળ તેના કિરણોનો સમૂહ ચાલે છે. ૨૪.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર દિસવલ્લીઓ ફલંતિ સવાઓ ।

ઇદું અહુલ્લિયા વિ હુ વરિસિ સુણ્ણ પિ સ્યણેહિ ॥૨૫॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં સર્વ દિશાઓરૂપ વેલ ફૂલો વિના પણ ઈષ ફળ આપે છે તથા ખાલી આકાશ પણ રત્નોની વર્ષા કરે છે. ૨૫.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ભવો ભયવજ્ઞિઓ હવે ણવરં ।

ગયણિદં ચિય જાયિ જોણહાપસરે સરે કુમુયં ॥૨૬॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં ભવ્ય જીવ સહસા ભય અને નિદ્રાથી એ રીતે રહિત (પ્રબુદ્ધ) થઈ જાય છે, જેમ ચાંદનીનો વિસ્તાર થતાં સરોવરમાં કુમુદ (સફેદકમળ) નિદ્રારહિત (પ્રદુલ્લિખિત) થઈ જાય છે. ૨૬.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર હિયણં મહ સુહં સમુલ્લસિયં ।

સરિણાહેણિવ સહસા ઉગમિએ પુણિમાંદે ॥૨૭॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં મારું હૃદય સહસા એવી રીતે સુખપૂર્વક હર્ષ પાખ્યું છે જેમ પૂર્ણિમાના ચન્દ્રનો ઉદ્ય થતાં સમુદ્ર આનંદ (વૃદ્ધિ) પામે છે. ૨૭.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર દોહિમિ ચક્રખૂહિં તહ સુહી અહિય ।

હિયએ જહ સહસચોહોમિ તિ મણોરહો જાઓ ॥૨૮॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! બે જ આંખો વડે આપના દર્શન થતાં હું એટલો બધો સુખી થયો છું કે જેથી મારા હૃદયમાં એવો મનોરથ ઉત્પન્ન થયો છે કે હું સહસ્રાક્ષ (હજાર નેત્રોવાળો) અર્થાત્ ઈન્દ્ર બનીશ. ૨૮.

(આર્યા)

દિદે તુમમિ જિણવર ભવો વિ મિતતણં ગઓ એસો ।
એયમિ ઠિયસ્સ જાઓ જાં તુહ દંસણં મજ્જા ॥૨૯॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં આ સંસાર પણ મિત્રતાને પ્રાપ્ત થયો છે. એનું કારણ એ છે કે તેમાં સ્થિત રહેવા છતાં પણ મને આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ૨૮.

(આર્યા)

દિદે તુમમિ જિણવર ભવાણં ભૂરિભત્તિજુત્તાણં ।
સવાઓ સિદ્ધિઓ હોંતિ પુરો એકલીલાએ ॥૩૦॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં અતિશય ભક્તિયુક્ત ભવ્ય જીવો પાસે બધી સિદ્ધિઓ એક રમત માત્રમાં જ (અનાયાસે જ) આવીને પ્રાપ્ત થાય છે. ૩૦.

(આર્યા)

દિદે તુમમિ જિણવર સુહગઇસંસાહણેકબીયમિ ।
કંઠગયજીવિયસ્સ વિ ધીરં સંપજ્ઞાએ પરમં ॥૩૧॥

અનુવાદ : હે જિનેન્દ્ર! શુભ ગતિ સાધવામાં અનુપમ બીજભૂત એવા આપનું દર્શન થતાં મરણોનુભ પ્રાણીને પણ ઉત્કૃષ્ટ ધૈર્ય પ્રાપ્ત થાય છે. ૩૧.

(આર્યા)

દિદે તુમમિ જિણવર કમમિ સિદ્ધે ણ કિ પુણો સિદ્ધં ।
સિદ્ધિયરં કો ણાણી મહિ ણ તુહ દંસણં તમ્હા ॥૩૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શનથી આપના ચરણ સિદ્ધ થતાં શું ન સિદ્ધ થયું? અર્થાત્ આપના ચરણોના પ્રસાદથી બધું જ સિદ્ધ થઈ જાય છે તેથી કચો જ્ઞાની પુરુષ સિદ્ધ આપનાર આપના દર્શનને ચાહતો નથી? અર્થાત્ બધા જ વિવેકીજનો આપના દર્શનની અભિવાધા કરે છે. ૩૨.

(આર્યા)

દિદે તુમમિ જિણવર પોમ્મકયં દંસણત્યુઇં તુજ્જા ।
જો પહુ પઢ્હ તિયાલં ભવજાલં સો સમોસરઙ્ ॥૩૩॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપનું દર્શન થતાં જે ભવ્ય જીવ પદ્ધનન્દી મુનિદ્વારા રચવામાં આવેલી આપની આ દર્શન સ્તુતિ ત્રણે સંધ્યાકાળે વાંચે છે, તે હે પ્રભો ! પોતાના સંસાર સમૂહનો નાશ કરે છે. ઉત્ત.

(આર્યા)

દિદ્દે તુમમ્મિ જિણવર ભણિયમિણ જણિયજણમણાણંદ ।
સવેહિં પદ્ધિંતં ણંદઉ સુઝરં ધરાવીઠે ॥૩૪॥

અનુવાદ : હે જિનેન્દ્ર ! આપના દર્શન કરીને મેં ભવ્યજનોના મનને આનંદિત કરનાર જે દર્શન સ્તોત્ર કહ્યું છે તે સર્વને વાંચવાનો વિષય બનીને પૃથ્વીતળ ઉપર ચિરકાળ સુધી સમૃદ્ધિ પામો. ઉત્ત.

આ રીતે જિનદર્શનસ્તુતિ સમાપ્ત થઈ. ૧૪.

મુખ્ય
માનને.

૧૫. શ્રુતદેવતા સ્તુતિ

[૧૫. શ્રુતદેવતાસ્તુતિ]

(વંશસ્થ)

જયત્યશેષામરમौલિલાલિતં સરસ્વતિ ત્વત્પદપઙ્કુજદ્વયમ् ।
હદિ સ્થિતં યજ્ઞનજાડ્યનાશનં રજોવિમુક્તં શ્રયતીત્યપૂર્વતામ् ॥૧॥

અનુવાદ : હે સરસ્વતી! જે તારાં બન્ને ચરણ-કમળ હૃદયમાં સ્થિત થઈને લોકોની જડતા (અજ્ઞાન) નષ્ટ કરનાર તથા ૨૪ (પાપરૂપ ધૂળ) રહિત થતાં થકાં તે જડ અને ધૂળવાળા કમળની અપેક્ષાએ અપૂર્વતા (વિશેષતા) પામે છે તે તારાં બન્ને ચરણકમળ સર્વ દેવોના મુકુટોથી સ્પર્શિત થયા થકા જ્યવંત હો. ૧.

(વંશસ્થ)

અપેક્ષતે યજ્ઞ દિનં ન યામિનીં ન ચાન્તરં નૈવ બહિશ્ર ભારતિ ।
ન તાપકૃજ્ઞાડ્યકરં ન તન્મહઃ સ્તુતે ભવત્યાઃ સકલપ્રકાશકમ् ॥૨॥

અનુવાદ : હે સરસ્વતી! જે તારું તેજ ન દિવસની અપેક્ષા રાખે છે કે ન રાત્રિની ય અપેક્ષા રાખે છે, ન અભ્યંતરની અપેક્ષા રાખે છે અને ન બાહ્યની પણ અપેક્ષા રાખે છે, તથા ન સંતાપ કરે છે ન જડતા પણ કરે છે; તે સમસ્ત પદાર્થને પ્રકાશિત કરનાર તારા તેજની હું સ્તુતિ કરું છું.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ અધિક શ્રેષ્ઠ છે. એનું કારણ એ છે કે સૂર્યનું તેજ જ્યાં દિવસની અપેક્ષા રાખે છે ત્યાં ચન્દ્રમાનું તેજ રાત્રિની અપેક્ષા રાખે છે, એવી જ રીતે સૂર્યનું તેજ જો સંતાપ કરે છે તો ચન્દ્રનું તેજ જડતા (શીતળતા) કરે છે. એ સિવાય આ બન્નેય તેજ કેવળ બાહ્ય અર્થને અને તેને પણ અખ્ય માત્રામાં જ પ્રકાશિત કરે છે, નહિ કે અંતઃ તત્ત્વને. પરંતુ સરસ્વતીનું તેજ દિવસ અને રાત્રિની અપેક્ષા ન કરતાં સર્વદા વસ્તુઓને પ્રકાશિત કરે છે. તે ન તો સૂર્યપ્રકાશ સમાન મનુષ્યને સંતપ્ત કરે છે અને

અધિકાર-૧૫ : શ્રુતકેવતા સ્તુતિ]

૩૦૭

ન ચન્દ્રપ્રકાશ સમાન જડતા ય કરે છે, પરંતુ તે લોકોનો સંતાપ નાથ કરીને તેમની જડતા (અજ્ઞાન) પણ દૂર કરે છે. એ સિવાય તે જેવી રીતે બાહ્ય પદાર્થને પ્રકાશિત કરે છે તેવી જ રીતે અંતઃતત્ત્વને પણ પ્રગટ કરે છે. તેથી તે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ અધિક શ્રેષ્ઠ હોવાના કારણે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.

(વંશસ્થ)

તવ સ્તવે યત્કવિરસ્મિ સાંપ્રતં ભવત્રસાદાદપિ લબ્ધપાટવઃ ।

સવિત્રિ ગડ્ઘાસરિતે ઽર્ધદાયકો ભવામિ તત્તજ્ઞલપૂરિતાજ્જલિઃ ॥૩॥

અનુવાદ : હે સરસ્વતી માતા! તારા જ પ્રસાદથી નિપુણતા પ્રાપ્ત કરીને જે હું આ વખતે તારી સ્તુતિના વિષયમાં કવિ થયો છું અર્થાત् કવિતા કરવાને ઉદ્ઘત થયો છું તે આ પ્રમાણે છે કે જેમ જાણો હું ગંગા નદીનું પાણી ખોખામાં ભરીને તેનાથી તે જ ગંગા નદીને અર્ધ આપવા માટે જ ઉદ્ઘત થયો હોઉં. ૩.

(વંશસ્થ)

શ્રુતાદિકેવલ્યપિ તાવકોં શ્રિયં સુવન્નશક્તો ઽહમિતિ પ્રપદ્યતે ।

જયેતિ વર્ણદ્વયમેવ માદૃશા વદન્તિ યદેવિ તદેવ સાહસમ् ॥૪॥

અનુવાદ : હે દેવી! જ્યારે તારી લક્ષ્મીની સ્તુતિ કરતાં શ્રુતકેવળીઓ પણ એ સ્વીકાર કરે છે કે ‘અમે સ્તુતિ કરવામાં અસમર્થ છીએ’ તો પછી મારા જેવો અલ્યુન્ન મનુષ્ય જે તારા વિષયમાં ‘જ્ય’ અર્થાત् ‘તું જ્યવંત હો’ એવા બે જ અક્ષર કહે છે તેને પણ સાહસ જ સમજવું જોઈએ. ૪.

(વંશસ્થ)

ત્વમત્ર લોકત્રયસર્વાનિ સ્થિતા પ્રદીપિકા બોધમયી સરસ્વતી ।

તદન્તરસ્થાખિલવસ્તુસંચયં જનાઃ પ્રપશ્યન્તિ સદૃષ્યો ઽષ્ટતઃ ॥૫॥

અનુવાદ : હે સરસ્વતી! તમે ત્રણ લોકરૂપ ભવનમાં સ્થિત તે શાનમય દીપક છો કે જેના દ્વારા દેષ્ટિહીન (અંધ) મનુષ્યોની સાથે દેષ્ટિયુક્ત (દેખતા) મનુષ્ય પણ ઉક્ત ત્રણ લોકરૂપ ભવનમાં સ્થિત સમસ્ત વસ્તુઓના સમૂહને દેખે છે.

વિશેષાર્થ : અહીં સરસ્વતીને દીપકની ઉપમા આપીને તેનાથી પણ કંઈક વિશેષતા પ્રગટ કરવામાં આવી છે. તે આ રીતે-દીપક દ્વારા કેવળ સદેષિ (આંખોવાળા) પ્રાણીઓને જ

પદાર્થનું દર્શન થાય છે, નહિ કે દષ્ટિહીન મનુષ્યોને પણ. પરંતુ સરસ્વતીમાં આ વિશેષતા છે કે તેના પ્રસાદથી જેવી રીતે દષ્ટિયુક્ત મનુષ્ય પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દષ્ટિહીન (અંધ) મનુષ્ય પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી કે સરસ્વતીની ઉત્કર્ષતાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સમસ્ત વિશ્વને પણ દેખવામાં સમર્થ બની જાય છે કે જે દીપક દ્વારા સંભવ નથી. ૫.

(વંશસ્થ)

નભઃસમં વર્ત્મ તવાતિનિર્મલં પૃથુ ગ્રયતં વિબુધૈર્ન કૈરિહ ।
તથાપિ દેવિ ગ્રતિભાસતે તરાં યદેતદક્ષુણમિવ ક્ષણેન તુ ॥૬॥

અનુવાદ : હે દેવી! તારો માર્ગ આકાશ સમાન અત્યંત નિર્મળ અને વિસ્તૃત છે, આ માર્ગે ક્યા વિદ્વાને ગમન નથી કર્યું? અર્થાત્ તે માર્ગે અનેક વિદ્વાનો ચાલતા રહ્યા છે. છતાં પણ એ ક્ષણ વાર માટે અતિશય અનભ્યસ્ત જેવો (પરિયય ન હોય તેવો) જ પ્રતિભાસે છે.

વિશેષાર્થ : જ્યારે કોઈ વિશિષ્ટ નગર આદિના પાર્થિવ રસ્તે જનસમૂહ ગમનાગમન કરે છે ત્યારે તે અક્ષુણણ ન રહેતાં તેમના પગલાં આદિથી અંકિત થઈ જાય છે, તે સિવાય તે સંકુચિત થવાથી થોડા જ મનુષ્ય તેના ઉપરથી આવી જઈ શકે છે, એક સાથે અનેક માણસો નહિ. પરંતુ સરસ્વતીનો માર્ગ આકાશ સમાન નિર્મળ અને વિશાળ છે. જેમ આકાશ માર્ગ જો કે અનેક વિબુધ (દેવો) અને પક્ષી આદિ એકી સાથે પ્રતિદિન નિર્બધપણે ગમનાગમન કરે છે, તો પણ તે તૂટ-કૂટથી રહિત હોવાને કારણે વિકૃત થતો નથી, અને તેથી એવું લાગે છે કે જાણે અહીંથી કોઈનો સંચાર જ થયો નથી. એવી જ રીતે સરસ્વતીનો પણ માર્ગ એટલો વિશાળ છે કે તેના ઉપરથી અનેક વિદ્વાનો કેટલે ય દૂર કેમ ન જાય છતાં પણ તેનો ન તો અંત આવે છે અને ન તેમાં કોઈ પ્રકારનો વિકાર પણ થઈ જાય છે. તેથી તે સદાય અક્ષુણણ બની રહે છે. ૬.

(વંશસ્થ)

તદસ્તુ તાવત્કવિતાદિકં નૃણાં તવ પ્રભાવાત્કૃતલોકવિસ્મયમ् ।
ભવેત્તદપ્યાશુ પદં યદીક્ષતે તપોભિરુગ્રૈર્મનિભિર્મહાત્મભિઃ ॥૭॥

અનુવાદ : હે દેવી! તારા પ્રભાવથી મનુષ્ય જે લોકોને આશ્રય ઉત્પન્ન કરનારી કવિતા આદિ કરે છે તે તો દૂર જ રહો, કારણ કે તેનાથી તો તે પદ (મોક્ષ) પણ શીଘ્ર પ્રાપ્ત થઈ જાય છે કે જેને મહાત્મા મુનિજનો તીવ્ર તપશ્ચરણ દ્વારા દેખી શકે છે. ૭.

(વંશસ્થ)

ભવત્કલા યત્ર ન વાણિ માનુષે ન વેત્તિ શાસ્ત્રે સ ચિરં પઠન્નપિ ।
મનાગપિ પ્રીતિયુતેન ચક્ષુષા યમીક્ષસે કૈર્ન ગુણૈ: સ ભૂષ્યતે ॥૮॥

અનુવાદ : હે વાણી! જે મનુષ્યમાં આપની કળા નથી તે ચિરકાળ સુધી વાંચવા છતાં પણ શાસ્ત્ર જાણી શકતો નથી અને તમે જેની તરફ પ્રીતિયુક્ત નેત્રથી જરાક પણ દેખો છો તે ક્યા ક્યા ગુણોથી વિભૂષિત નથી થતા? અર્થાત્ તે અનેક ગુણોથી સુશોભિત થઈ જાય છે. ૮.

(વંશસ્થ)

સ સર્વવિત્પશ્યતિ વેત્તિ ચાખિલં ન વા ભવત્યા રહિતો ઽપિ બુધ્યતે ।
તદત્ત્ર તત્સ્યાપિ જગત્ત્રયપ્રભોસ્ત્વમેવ દેવિ પ્રતિપત્તિકારણમ् ॥૯॥

અનુવાદ : હે દેવી! જે સર્વજ્ઞ સમસ્ત પદાર્થોને દેખે અને જાણે છે તે પણ તમારા વિના રહીને નથી દેખતા-જાણતા. તેથી ત્રણે લોકના અધિપતિ તે સર્વજ્ઞને પણ જ્ઞાનનું કારણ તમે જ છો. ૯.

(વંશસ્થ)

ચિરાદતિકલોશશતૈર્ભવામ્બુધૌ પરિભ્રમન્ ભૂરિ નરત્વમશ્નુતે ।
તનૂભૃદેતત્પુરુષાર્થસાધનં ત્વયા વિના દેવિ પુનઃ પ્રણશ્યતિ ॥૧૦॥

અનુવાદ : હે દેવી! દીર્ઘકાળથી સંસારરૂપ સમુક્રમાં પરિભ્રમણ કરતાં પ્રાણી સેંકડો મહાન કષ્ટો સહન કરીને પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ના સાધનરૂપ જે મનુષ્યપર્યાય પ્રાપ્ત કરે છે તે પણ તારા વિના નાણ થઈ જાય છે. ૧૦.

(વંશસ્થ)

કદાચિદમ્બ ત્વદનુગ્રહં વિના શ્રુતે હ્યાધીતે ઽપિ ન તત્ત્વનિશ્ચયઃ ।
તતઃ કુતઃ પુંસિ ભવદ્વિવેકિતા ત્વયા વિમુક્તસ્ય તુ જન્મ નિષ્ફલમ् ॥૧૧॥

અનુવાદ : હે માતા! જો કદાચ મનુષ્ય તારા અનુગ્રહ વિના શાસ્ત્રનું અધ્યયન પણ કરે તો પણ તેને તત્ત્વનો નિશ્ચય થઈ શકતો નથી. તો આવી અવસ્થામાં ભલા તેને વિવેક બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. હે દેવી! તારા વિના તો પ્રાણીનો જન્મ નિષ્ફળ થાય છે. ૧૧.

(વંશસ્થ)

વિધાય માતઃ પ્રથમં ત્વદાશ્રયં શ્રયન્તિ તન્મોક્ષપદं મહર્ષયઃ ।

પ્રદીપમાશ્રિત્ય ગૃહે તમસ્તતે યદીપ્સિતં વસ્તુ લભેત માનવઃ ॥૧૨॥

અનુવાદ : હે માતા! મહામુનિ જ્યારે પહેલાં તારું અવલંબન લે છે ત્યારે જ તે મોક્ષપદનો આશ્રય લે છે. બરાબર છે—મનુષ્ય અંધકારથી વ્યાપ્ત ઘરમાં દીપકનો આશ્રય લઈને જ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. ૧૨.

(વંશસ્થ)

ત્વયિ પ્રભૂતાનિ પદાનિ દેહિનાં પદં તદેકં તદપિ પયચ્છસિ ।

સમસ્તશુક્લાપિ સુવર્ણવિગ્રહા ત્વમત્ર માતઃ કૃતવિત્રવેદિતા ॥૧૩॥

અનુવાદ : હે માતા! તમારા વિષયમાં પ્રાણીઓનાં અનેક પદ છે, અર્થાત् પ્રાણી અનેક પદો દ્વારા તમારી સ્તુતિ કરે છે, તો પણ તમે તેમને તે એક જ પદ (મોક્ષ) આપો છો. તમે સમ્પૂર્ણ રીતે શ્વેત હોવા છતાં પણ ઉત્તમ વર્ણમય (અકારાદિ અક્ષર સ્વરૂપ) શરીરવાળા છો. હે દેવી! તમારી આ પ્રવૃત્તિ અહીં આશ્રય ઉત્પન્ન કરે છે.

વિશેષાર્થ : સરસ્વતી પાસે મનુષ્યનાં અનેક પદ છે, પરંતુ તે તેમને એક જ પદ આપે છે; આ રીતે જો કે અહીં શબ્દથી વિરોધ લાગે છે, પરંતુ યથાર્થપણે વિરોધ નથી. કારણ એ કે અહીં ‘પદ’ શબ્દના બે અર્થ છે.—શબ્દ અને સ્થાન. તેથી અહીં એ ભાવ નીકળે છે કે મનુષ્ય અનેક શબ્દો દ્વારા જે સરસ્વતીની સ્તુતિ કરે છે તેથી તે તેમને અદ્વિતીય મોક્ષપદનું પ્રદાન કરે છે. એવી જ રીતે સરસ્વતી પૂર્ણપણે ધવલ (શ્વેત) છે તે સુવર્ણ જેવા શરીરવાળી કેવી રીતે હોઈ શકે? એ પણ જો કે વિરોધ લાગે છે, પરંતુ વાસ્તવમાં વિરોધ અહીં કાંઈ પણ નથી. કારણ એ કે શુક્લ શબ્દથી અભિપ્રાય અહીં નિર્મળનો અને વર્ણ શબ્દથી અભિપ્રાય અકારાદિ અક્ષરોનો છે. તેથી જ અનો ભાવ એ થયો કે અકારાદિ ઉત્તમ વર્ણરૂપ શરીરવાળી તે સરસ્વતી પૂર્ણપણે નિર્મળ છે. ૧૩.

(વંશસ્થ)

સમુદ્રધોષાકૃતિરહીતિ પ્રભૌ યદા ત્વમુત્કર્ષમુપાગતા ભૃશમ્ ।

અશેષભાષાત્મતયા ત્વયા તદા કૃતં ન કેષાં હૃદિ માતરદ્ભુતમ્ ॥૧૪॥

અનુવાદ : હે માતા! જ્યારે તમે અર્હત્તું ભગવાનના વિષયમાં સમુદ્રના શબ્દ સમાન આકાર ધારણ કરીને અતિશય ઉત્કર્ષ પામો છો ત્યારે સમસ્ત ભાષાઓમાં

અધિકાર-૧૫ : શુદ્ધિકારી સ્તુતિ]

૩૧૧

પરિણમીને તમે ક્યા જીવોના હૃદયમાં આશ્રય નથી કરતા? અર્થાત્ સર્વે જીવોને આશ્રયચક્રિત કરો છો.

વિશેષાર્� : જિનેન્દ્ર ભગવાનની જે સમુક્રના શબ્દ સમાન ગંભીર દિવ્યધ્વનિ ખરે છે એ જ વાસ્તવમાં સરસ્વતીની સર્વોત્કૃષ્ટતા છે. એને જ ગણધરદેવ બાર અંગોમાં ગૂંઘે છે, તેમાં આ અતિશય વિશેષ છે કે જેનાથી તે સમુક્રના શબ્દ સમાન અક્ષરમય ન હોવા છતાં પણ શ્રોતાજીનોને પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રતીત થાય છે અને તેથી તેને સર્વભાષાત્મક કહેવામાં આવે છે. ૧૪.

(વંશસ્થ)

સચક્ષુરાષ્ટ્રે જનસ્ત્વયા વિના યદન્ધ એવેતિ વિભાવ્યતે બુધૈઃ ।

તદસ્ય લોયત્રિતયસ્ય લોચનं સરસ્વતિ ત્વં પરમાર્થદર્શને ॥૧૫॥

અનુવાદ : હે સરસ્વતી! આ મનુષ્ય તમારા વિના આંખો સહિત હોવા છતાં પણ વિદ્વાનો દ્વારા અંધ (અજ્ઞાની) જ ગણાય છે. તેથી ત્રણે લોકના પ્રાણીઓને યથાર્થ તત્ત્વનું દર્શન (શાન) કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૫.

(વંશસ્થ)

ગિરા નરપ્રાણિતમેતિ સારતાં કવિત્વવકૃતૃત્વગુણેન સા ચ ગીઃ ।

ઇદં દ્વયં દુર્લભમેવ તે પુનઃ પ્રસાદલેશાદાપિ જાયતે નૃણામ् ॥૧૬॥

અનુવાદ : જેમ વાણી દ્વારા મનુષ્યોનું જીવન શ્રેષ્ઠત્વ પામે છે તેવી જ રીતે તે વાણી પણ કવિત્વ અને વકૃતૃત્વ ગુણો દ્વારા શ્રેષ્ઠતા પામે છે. આ બન્ને (કવિત્વ અને વકૃતૃત્વ) જો કે દુર્લભ જ છે, તો પણ હે દેવી! તારી થોડીક પ્રસન્નતાથી ય તે બન્ને ગુણ મનુષ્યોને પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.

(વંશસ્થ)

નૃણાં ભવતસંનિધિસંસ્કૃતં શ્રવો વિહાય નાન્યદ્વિતમક્ષયં ચ તત્ ।

ભવેદ્વિવેકાર્થમિદ પરં પુનર્વિમૂઢતાર્થ વિષયં સ્વર્પયત् ॥૧૭॥

અનુવાદ : હે સરસ્વતી! તમારી સમીપતાથી સંસ્કાર પામેલા શ્રવણ (કાન) સિવાય મનુષ્યોનું બીજું કોઈ અવિનશ્શર હિત નથી. તમારી સમીપતાથી સંસ્કાર પામેલ આ શ્રવણ વિવેકનું કારણ થાય છે અને પોતાને વિષય તરફ પ્રવૃત્તિ કરાવનારા બીજું શ્રવણ અવિવેકનું કારણ થાય છે.

વિશેષાર્� : અભિપ્રાય આનો એ છે કે જે મનુષ્ય પોતાના કાને જિનવાણીનું શ્રવણ કરે છે તેમના કાન સફળ છે. એનાથી તેમને અવિનશ્શર સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે મનુષ્ય તે કાનોથી જિનવાણી ન સાંભળતાં અન્ય રાગવર્ધક કથા આદિ સાંભળે છે તે વિવેક રહિત બનીને વિષયભોગમાં પ્રવૃત્ત થાય છે અને આ રીતે અંતે અસત્ય દુઃખ ભોગવે છે. ૧૭.

(વંશસ્થ)

કૃતાપિ તાલ્વોષ્ઠપુટાદિભિર્ણાં ત્વમાદિપર્યન્તવિર્જિતસ્થિતઃ ।

ઇતિ ત્વયાપિદૃશર્ધર્મયુક્ત્વા સ સર્વથૈકાન્તવિધિર્વિર્ચૂર્ણિતઃ ॥૧૮॥

અનુવાદ : હે ભારતી! જો કે તું મનુષ્યોના તાળવું અને હોઠ આદિ દ્વારા ઉત્પન્ન કરાયેલી છે તો પણ તારી સ્થિતિ આદિ અંત રહિત છે, અર્થાત્ તું અનાદિનિધન છે. આ જાતના ધર્મ (અનેકાન્ત) યુક્ત તે સર્વથા એકાન્તવિધાનને નાચ કરી નાખ્યું છે.

વિશેષાર્થ : વાણી કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય પણ છે. તે વર્ણપદ વાક્યરૂપ વાણી તાળવું અને હોઠ આદિ સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે તેથી જ પર્યાય સ્વરૂપે અનિત્ય છે. સાથે જ દ્રવ્યસ્વરૂપે તેનો વિનાશ સંભવિત નથી તેથી દ્રવ્યસ્વરૂપે અથવા અનાદિપ્રવાહથી તે નિત્ય પણ છે. આ રીતે અનેકાન્તસ્વરૂપ તે વાણી સમસ્ત એકાન્તમતોનું નિરાકરણ કરે છે. ૧૮.

(વંશસ્થ)

અપિ પ્રયાતા વશમેકજન્મનિદ્યુધેનુચિન્તામણિકલ્પાદપાઃ ।

ફલાન્તિ હિ ત્વં પુનરત્વ વા પરે ભવે કર્થ તૈરૂપમીયસે બુધૈઃ ॥૧૯॥

અનુવાદ : કામધેનુ, ચિન્તામણિ અને કલ્પવૃક્ષ એ આધીન થઈને એક જન્મમાં જ ફળ આપે છે, પરંતુ હે દેવી! તું આ ભવમાં અને પરભવમાં પણ ફળ આપે છે. તો પછી ભલા વિદ્ધાન મનુષ્યો તને આમની ઉપમા કેવી રીતે આપે? અર્થાત્ તું એમની ઉપમાને યોગ્ય નથી—તેમનાથી શ્રેષ્ઠ છે. ૧૯.

(વંશસ્થ)

અગોચરો વાસરકૃત્ત્રિશાકૃતોર્જનસ્ય યચ્ચેતસિ વર્તતે તમઃ ।

વિભિદ્યતે વાગધિદેવતે ત્વયા ત્વમુત્તમજ્યોતિરિતિ ગ્રણીયસે ॥૨૦॥

અનુવાદ : હે વાગધિદેવતે! લોકોના ચિત્તમાં જે અંધકાર (અજ્ઞાન) સ્થિત છે તે સૂર્ય અને ચન્દ્રનો વિષય નથી અર્થાત् તેને ન તો સૂર્ય નષ્ટ કરી શકે છે અને ન ચન્દ્ર પણ. પરંતુ હે દેવી! તેને (અજ્ઞાન અંધકારને) તું નષ્ટ કરે છે. તેથી તેને 'ઉત્તમ જ્યોતિ' અર્થાત् સૂર્ય-ચન્દ્રથી પણ શ્રેષ્ઠ દીપિ ધારણ કરનાર કહેવામાં આવે છે. ૨૦.

(વંશસ્થ)

જિનેશ્વરસ્વચ્છસરઃ સરોજિની ત્વમઙ્ગપૂર્વાદિસરોજરાજિતા ।

ગણેશાહંસત્રજસેવિતા સદા કરોષિ કેષાં ન મું પરામિહ ॥૨૧॥

અનુવાદ : હે સરસ્વતી! તમે જિનેન્દ્રરૂપ સરોવરની કમલિની થઈને અંગપૂર્વાદિરૂપ કમળોથી શોભાયમાન અને નિરંતર ગણધરરૂપ હંસોના સમૂહની સેવા પામતી થકી અહીં કયા જીવોને ઉત્કૃષ્ટ હર્ષ નથી આપતી? અર્થાત् સર્વ જીવોને આનંદિત કરો છો. ૨૧.

(વંશસ્થ)

પરાત્મતત્ત્વપ્રતિપત્તિપૂર્વકં પરં પદં યત્ર સતિ ગ્રસિક્ષયતિ ।

કિયત્તતસ્તે સ્ફુરતઃ ગ્રભાવતો નૃપત્વસૌભાગ્યવરાઙ્ગનાદિકમ્ ॥૨૨॥

અનુવાદ : હે દેવી! જ્યાં તારા પ્રભાવથી આન્મા અને પર (શરીરાદિ)નું જ્ઞાન થઈ જવાથી પ્રાણીને ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) સિદ્ધ થઈ જાય છે ત્યાં તે તારા દેદીઘ્યમાન પ્રભાવ આગળ રાજાપણું, સૌભાગ્ય અને સુંદર શ્રી આદિ શી વસ્તુ છે? અર્થાત્ કાંઈ પણ નથી.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જિનવાણીની ઉપાસનાથી જીવને હિત અને અહિતનો વિવેક ઉત્પન્ન થાય છે અને એથી તેને સર્વોત્કૃષ્ટ મોક્ષપદ પણ પ્રાપ્ત થઈ જાય છે. આવી અવસ્થામાં તેની ઉપાસનાથી રાજ્યપદ આદિ પ્રાપ્ત થવામાં ભલા શી કઠિનાઈ હોય? કાંઈ પણ નહિ. ૨૨.

(વંશસ્થ)

ત્વદદિગ્ધપદ્મદ્વયભક્તિભાવિતે તૃતીયમુન્મીલાતિ બોધલોચનમ્ ।

ગિરામધીશે સહ કેવલેન યત્ત સમાશ્રિતં સ્પર્ધમિવેક્ષતે ઽખિલમ્ ॥૨૩॥

અનુવાદ : હે વચ્ચનોની અધીશ્વરી! જે તારા બન્ને ચરણોરૂપ કમળોની

ભક્તિથી પરિપૂર્ણ છે તેને પૂર્ણ શુત્રાનરૂપ તે ત્રીજું નેત્ર પ્રગટ થાય છે કે જે જાણે કેવળજ્ઞાન સાથે સ્પર્ધા પામીને જ તેના વિષયભૂત સમસ્ત વિશ્વને દેખે છે.

વિશેષાર્� : અભિપ્રાય એ છે કે જિનવાણીની આરાધનાથી દ્વારાશાંગરૂપ પૂર્ણ શુત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જે વિષયની અપેક્ષાએ કેવળજ્ઞાનની સમાન જ છે. વિશેષતા બન્નેમાં કેવલ એ જ છે કે જ્યાં શુત્રાન તે બધા પદાર્થોને પરોક્ષ (અવિશાદ) સ્વરૂપે જાણે છે. ત્યાં કેવળજ્ઞાન તેમને પ્રત્યક્ષ (વિશાદ) સ્વરૂપે જાણે છે. આ જ વાતને લક્ષ્યમાં રાખીને એમ કહેવામાં આવ્યું છે કે તે શુત્રાનરૂપ ત્રીજું નેત્ર જાણે કેવળજ્ઞાન સાથે સ્પર્ધા જ કરે છે. ૨૩.

(વંશસ્થ)

ત્વમેવ તીર્થ શુચિબોધવારિમિત્ર સમસ્તલોકત્રયશુદ્ધિકારણમ् ।

ત્વમેવ ચાનન્દસમુદ્રવર્ધને મૃગાઙ્કલૂર્તિઃ પરમાર્થદર્શિનામ् ॥૨૪॥

અનુવાદ : હે દેવી! નિર્મળ જ્ઞાનરૂપજ્ઞાનથી પરિપૂર્ણ તમે જ તે તીર્થ છો કે જે ત્રણે લોકના સમસ્ત પ્રાણીઓને શુદ્ધ કરે છે. તથા તત્ત્વના યથાર્થસ્વરૂપને દેખનાર જીવોના આનંદરૂપ સમુદ્રને વધારવામાં ચન્દ્રમાની મૂર્તિ ધારણ કરનાર પણ તમે જ છો. ૨૪.

(વંશસ્થ)

ત્વયાદિબોધઃ ખલું સંસ્કૃતો બ્રજેત् પરેષુ ગોધેષ્વખિલેસુ હેતુતામ् ।

ત્વમક્ષિ પુંસામતિદૂરદર્શને ત્વમેવ સંસારતરોઃ કુઠારિકા ॥૨૫॥

અનુવાદ : હે વાણી! તમારા દ્વારા સંસ્કાર પામેલ પ્રથમજ્ઞાન (મતજ્ઞાન) અથવા અક્ષરબોધ બીજા સમસ્ત (શુત્રાનાદિ) જ્ઞાનોમાં કારણ બને છે. હે દેવી! તમે મનુષ્યોને દૂર ક્ષેત્રે રહેલી વસ્તુઓ દેખાડવામાં નેત્ર સમાન બનીને તેમનું સંસારરૂપ વૃક્ષ કાપવા માટે કુહાડીનું કામ કરો છો. ૨૫.

(વંશસ્થ)

યથાવિધાનં ત્વમનુસ્મતા સતી ગુરુપદેશો ઽયમવર્ણભેદતઃ ।

ન તાઃ શ્રિયસ્તે ન ગુણા ન તત્પદં યચ્છસિ ગ્રાણભૂતે ન યચ્છુભે ॥૨૬॥

અનુવાદ : હે શુભે! જે પ્રાણી તારું વિધિપૂર્વક સ્મરણ કરે છે—અધ્યયન કરે છે—તેને એવી કોઈ લક્ષ્મી નથી, એવા કોઈ ગુણ નથી તથા એવું કોઈ પદ નથી, જેને તું વર્ણભેદ વિના—ભ્રાત્રાણત્વ આદિની અપેક્ષા ન કરતાં—ન આપતી હો. આ ગુરુનો

અધિકાર-૧૫ : શુદ્ધદેવતા સ્તુતિ]

૩૧૫

ઉપદેશ છે. અભિપ્રાય એ છે કે તું તારું સ્મરણ કરનારા (જિનવાણીના ભક્તો)ને સમાનરૂપે અનેક પ્રકારની લક્ષ્મી, અનેક ગુણો અને ઉત્તમપદનું પ્રદાન કરે છે. ૨૬.

(વંશસ્થ)

અનેકજન્માર્જિતપાપપર્વતો વિવેકવગ્રેણ સ યેન ભિદ્યતે ।

ભવદ્વપુઃશાસ્ત્રધનાન્નિરેતિ તત્સદદથવાક્યામૃતભારમેદુરાત્ ॥૨૭॥

અનુવાદ : હે ભારતી! જે વિવેકરૂપ વજદ્વારા અનેક જન્મોમાં કમાયેલ તે પાપરૂપ પર્વત ખંડિત કરાય છે તે વિવેકરૂપ વજ સમીયીન અર્થ સંપન્ન વાક્યો રૂપ અમૃતના ભારથી પરિપૂર્ણ એવા તારા શુતમય શરીર મેઘ વડે પ્રગટે છે.

વિશેષાર્થ : અહીં વિવેકમાં વજનો આરોપ કરીને એમ બતાવવામાં આવ્યું છે કે જેવી રીતે વજ દ્વારા મોટા મોટા પર્વત ખંડિત કરવામાં આવે છે તેવી જ રીતે વિવેકરૂપ વજ દ્વારા બળવાન્ન કર્મરૂપ પર્વત નાચ કરવામાં આવે છે. વજ જેમ જણ ભરપૂર વાદળામાં ઉત્પન્ન થાય છે તેવી જ રીતે આ વિવેક પણ સમીયીન અર્થના બોધક વાક્યરૂપ જણથી પરિપૂર્ણ એવા સરસ્વતીના શરીરભૂત શાસ્ત્રરૂપ મેઘમાંથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જિનવાણીના પરિશીલનથી તે વિવેકબુદ્ધિ પ્રગટ થાય છે જેના પ્રભાવથી નવીન કર્માનો સંવર અને પૂર્વસંચિત કર્માની નિર્જરા થઈને અવિનશ્બર સુખ પ્રાપ્ત થઈ જાય છે. ૨૭.

(વંશસ્થ)

તમાંસિ તેજાંસિ વિજિત્ય વાડ્યમયં પ્રકાશયદ્યત્પરમં મહન્મહઃ ।

ન લુધ્યતે તૈર્ન ચ તૈઃ પ્રકાશ્યતે સ્વતઃ પ્રકાશાત્મકમેવ નન્દતુ ॥૨૮॥

અનુવાદ : શબ્દમય શાસ્ત્ર (દ્રવ્યશુત) અંધકાર અને તેજ (સૂર્ય-ચન્દ્રાદિની પ્રભા) ને જીતી ને જે ઉત્કૃષ્ટ મહાન્ન તેજ પ્રગટ કરે છે તે ન અંધકાર દ્વારા લુપ્ત કરી શકાય છે અને ન અન્ય તેજ દ્વારા પ્રકાશિત પણ કરી શકાય છે. તે સ્વસંવેદનસ્વરૂપ તેજ વૃદ્ધિ પામો.

વિશેષાર્થ : જિનવાણીના અભ્યાસથી અજ્ઞાનભાવ નાચ થઈને કેવળજ્ઞાનરૂપ જે અપૂર્વ જ્યોતિ પ્રગટ થાય છે તે સૂર્ય-ચન્દ્રાદિના પ્રકાશની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. એનું કારણ એ છે કે સૂર્ય-ચન્દ્રાદિનો પ્રકાશ નિયમિત (કમશઃ દિવસ અને રાત્રિ) સમયમાં રહીને સીમિત પદાર્થોને જ પ્રગટ કરે છે. પરંતુ તે કેવળજ્ઞાનરૂપ પ્રકાશ દિવસ અને રાત્રિની અપેક્ષા ન કરતાં-સર્વકાળે રહીને-ત્રણે લોક અને ત્રણે કાળનાં સમસ્ત પદાર્થોને પ્રગટ કરે છે. આ કેવળજ્ઞાનરૂપ પ્રકાશને નાચ કરવામાં અંધકાર (કર્મ) સમર્થ નથી-તે સ્વ-પરપ્રકાશકસ્વરૂપે સાઠા સ્થિર રહે છે. ૨૮.

(વંશસ્થ)

તવ પ્રસાદઃ કવિતાં કરોત્યતઃ કથં જડસ્તત્ર ઘટેત માદૃશઃ ।
પ્રસીદ તત્ત્રાપિ મયિ સ્વનન્દને ન જાતુ માતા વિગુણે ઽપિ નિષુરા ॥૨૯॥

અનુવાદ : હે સરસ્વતી! તારી પ્રસાન્તા જ કવિતા કરે છે કારણ કે મારા જેવો મૂર્ખ મનુષ્ય ભલા તે કવિતા કરવા કેવી રીતે યોગ્ય થઈ શકે? થઈ શકતો નથી. તેથી તું મૂર્ખ એવા મારા ઉપર પણ પ્રસાન્ત થા, કારણ કે માતા પોતાના ગુણ વિનાના પુત્ર પ્રત્યે પણ કઠોર થતી નથી. ૨૮.

(વંશસ્થ)

ઇમામધીતે શ્રુતદેવતાસ્તુતિં કૃતિં પુમાન् યો મુનિપદ્મનાન્દિનઃ ।
સ યાતિ પરાં કવિતાદિસદ્ગુણપ્રબન્ધસિદ્ધોઃ ક્રમતો ભવસ્ય ચ ॥૩૦॥

અનુવાદ : જે મનુષ્ય પદ્મનાની મુનિની કૃતિસ્વરૂપ આ શ્રુતદેવીની સ્તુતિ વાંચે છે તે કવિતાદિ ઉત્તમોત્તમ ગુણોના વિસ્તારરૂપ સમુદ્રના તથા ક્રમે કરીને સંસારના પણ પારને પ્રાપ્ત થઈ જાય છે. ૩૦.

(શાર્દૂલવિક્રીડિત)

કુણઠાસ્તે ઽપિ બૃહસ્પતિપ્રભૂતયો યાસ્મન् ભવન્તિ ધ્રુવં
તસ્મિન્ન દેવિ તવ સ્તુતિબ્યતિકરે મન્દા નરાઃ કે વયમ् ।
તદ્વાક્વાપલમેતદશ્રુતવતામસ્માકમમ્બ
ક્ષન્તાબ્ય મુખરત્વકારણમસૌ યેનાતિભક્તિગ્રહઃ ॥૩૧॥

અનુવાદ : હે દેવી! જે તારા સ્તુતિ સમૂહની બાબતમાં નિશ્ચયથી તે બૃહસ્પતિ આદિ પણ કુંઠિત (અસમર્થ) થઈ જાય છે તેના વિષયમાં અમારા જેવા મંદબુદ્ધિ મનુષ્ય કોણ હોય? અર્થાત્ અમારા જેવા તો તારી સ્તુતિ કરવામાં સર્વથા અસમર્થ છે. તેથી હે માતા! શાસ્ત્રજ્ઞાન રહિત અમારી જે આ વચ્ચનોની ચંચળતા, અર્થાત્ સ્તુતિરૂપ વચ્ચનપ્રવૃત્તિ છે, તેને તું ક્ષમા કર. કારણ એ છે કે આ વાચાળતા (ખકવાદ)નું કારણ તે તારી અતિશય ભક્તિરૂપ ગ્રહ (પિશાચ) છે. અભિપ્રાય એ કે હું એને યોગ્ય ન હોવા છતાં પણ જે આ સ્તુતિ કરી છે તે કેવળ તારી ભક્તિને વશ થઈને જ કરી છે. ૩૧.

આ રીતે સરસ્વતીસ્તોત્ર સમાપ્ત થયું. ૧૫.

*

૧૬. સ્વયંભૂસ્તુતિ

[૧૬. સ્વયંભૂસ્તુતિ]

(વંશસ્થ)

સ્વયંભુવા યેન સમુદ્ધતં જગઞ્ઞડત્વકૂપે પતિતં પ્રમાદતઃ ।
પરાત્મતત્વપ્રતિપાદનોલ્લસદ્વચોગુણેરાદિજિનઃ સ સેવ્યતામુ ॥૧॥

અનુવાદ : સ્વયંભૂ અર્થાત્ પોતે જ પ્રબોધને પ્રાપ્ત થયેલા જે આદિ (ઋષભ) જિનેન્દ્રે, પ્રમાદને વશ થઈને અશાનતારૂપ કૂવામાં પડેલા જગતના પ્રાણીઓનો પરતત્વ અને આત્મતત્વ (અથવા ઉત્કૃષ્ટ આત્મતત્વ)ના ઉપદેશમાં શોભાયમાન વચનરૂપ ગુણોથી ઉદ્ઘાર કર્યો છે, તે આદિ જિનેન્દ્રની આરાધના કરવી જોઈએ.

વિશેખાર્થ : અહીં શ્લોકમાં યોજાયેલી ગુણ શબ્દના બે અર્થ છે—હિતકારત્વ આદિ ગુણ અને દોરદું. તેનો અભિપ્રાય એ છે કે જેમ કોઈ મનુષ્ય જો અસાવધાનીથી કૂવામાં પડી જાય છે તો બીજા દયાળુ મનુષ્ય કૂવામાં દોરદું નાખીને તેની મદદથી તેમને બહાર કાઢી લે છે. એ જ રીતે ભગવાન આદિ જિનેન્દ્રે જે અનેક પ્રાણી અશાન વશ થઈને ધર્મના માર્ગથી વિમુખ થઈ રહ્યા થકા કષ્ટ ભોગવી રહ્યા હતા તેમનો હિતોપદેશ દ્વારા ઉદ્ઘાર કર્યો હતો—તેમને મોક્ષમાર્ગમાં લગાવ્યા હતા. તેમણે તેમને એવા વચનો દ્વારા પદાર્થનું સ્વરૂપ સમજાવ્યું હતું કે જે હિતકારક હોવા ઉપરાંત તેમને મનોહર પણ લાગતું હતું. ‘હિતં મનોહારિ ચ દુર્લભं વચઃ’ આ કથન અનુસાર એ સર્વ સાધારણને સુલભ નથી. ૧.

(વંશસ્થ)

ભવારિરેકો ન પરાડસ્તિ દેહિનાં સુહૃદ્ય રત્નત્રયમેક એવ હિ ।
સ દુર્જયો યેન જિતસ્તદાશ્રયાત્તતોડજિતાન્મે જિનતોડસ્તુ સત્સુખમુ ॥૨॥

અનુવાદ : પ્રાણીઓનો સંસાર જ એક ઉત્કૃષ્ટ શત્રુ તથા રત્નત્રય જ એક

ઉત્કૃષ્ટ ભિત્ર છે. એના સિવાય બીજા કોઈ શત્રુ અથવા ભિત્ર નથી. જેણે તે રત્નત્રયરૂપ ભિત્રના અવલંબનથી તે દુર્જ્ય સંસારરૂપ શત્રુને જીતી લીધો છે તે અજિત જિનેન્દ્રથી મને સમીચીન સુખ પ્રાપ્ત થાવ. ૨.

(વંશસ્થ)

પુનાતુ નઃ સંભવતીર્થકૃજિનઃ પુનઃ પુનઃ સંભવદુઃखદુઃખિતાઃ ।
તર્દર્તિનાશાય વિમુક્તિવર્તમનઃ પ્રકાશકં યં શરણ પ્રપેદિરે ॥૩॥

અનુવાદ : વારંવાર જન્મ-મરણરૂપ સંસારના દુઃખથી પીડિત પ્રાણી તે પીડા દૂર કરવા માટે મોક્ષમાર્ગ પ્રકાશિત કરનાર જે સંભવનાથ તીર્થકરના શરણને પામ્યા હતા તે સંભવ જિનેન્દ્ર અમને પવિત્ર કરો. ૩.

(વંશસ્થ)

નિજેરુણેરપ્રતિમૈર્મહાનજો ન તુ ત્રિલોકીજનતાર્ચનેન યઃ ।
યતો હિ વિશ્વં લઘુ તં વિમુક્તયે નમામિ સાક્ષાદભિનન્દનં જિનમુ ॥૪॥

અનુવાદ : અજ અર્થાત્ જન્મ-મરણ રહિત જે અભિનંદન જિનેન્દ્ર પોતાના અનુપમ ગુણો દ્વારા ભાગ્યમા પામ્યા છે, નહિ કે ત્રણે લોકના પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી પૂજાથી; તથા જેની આગળ વિશ્વ તુચ્છ છે અર્થાત્ જે પોતાના અનન્તજ્ઞાન દ્વારા સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે-દેખે છે તે અભિનંદન જિનને હું મુક્તિની પ્રાપ્તિ માટે નમસ્કાર કરું છું. ૪.

(વંશસ્થ)

નયપ્રમાણાદિવિધાનસદ્ગટં પ્રકાશિતં ત તત્ત્વમતીવ નિર્મલમુ ।
યતસ્ત્વયા તત્સુમતેજ્ત્ર તાવકં તદન્વયં નામ નમો ઽસ્તુ તે જિનઃ ॥૫॥

અનુવાદ : હે સુમતિ જિનેન્દ્ર! આપે નય અને પ્રમાણ આદિની વિધિથી સંગત તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) અતિશય નિર્દોષ રીતે પ્રકાશિત કર્યું હતું, માટે જ આપનું સુમતિ (સુ શોભના મતિર્યસ્યાસૌ સુમતિઃ=ઉત્તમ બુદ્ધિમાન) એ નામ સાર્થક છે. હે જિન! આપને નમસ્કાર હો. ૫.

(વંશસ્થ)

રાજ પર્યાભતીર્થકૃત્સદસ્યશેષલોકત્રયલોકમધ્યગઃ ।
નભસ્યુદ્ગ્રાત્યુતઃ શશી યથા વચો ઽમૃતૈર્વર્ષતિ યઃ સ પાતુનઃ ॥૬॥

અધિકાર-૧૬ : સ્વયંભૂસૃતિ]

૩૧૮

અનુવાદ : જેમ આકાશમાં તારાઓના સમૂહથી યુક્ત થઈને ચંદ્ર શોભે છે તેવી જ રીતે જે પદ્મપ્રભ તીર્થકરના સમવસરણ સમામાં ત્રણે લોકના સમસ્ત પ્રાણીઓની વચ્ચે સ્થિત થઈને શોભાયમાન થયા હતા તથા જેમણે ત્યાં વચ્ચનરૂપી અમૃતની વર્ષા કરી હતી તે પદ્મપ્રભ જિનેન્દ્ર અમારી રક્ષા કરો. ૬.

(વંશસ્થ)

નરામરાહીશ્વરપીડને જયી ધૃતાયુધો ધીરમના જ્ઞાષધ્વજઃ ।
વિનાપિ શસ્ત્રવૈરન્નુ યેન નિર્જિતો જિનં સુપાર્શ્વ પ્રણમામિ તં સદા ॥૭॥

અનુવાદ : જે સાહસી મીનકેતુ (કામદેવ) શાખ ધારણ કરી ચક્કવર્તી, ઈન્દ્ર અને ધરણેન્દ્રને પણ પીડિત કરીને તેમના ઉપર વિજય મેળવે છે એવા તે કામદેવ સુભટને પણ જેમણે શાખ વિના જ જીતી લીધો તે સુપાર્શ્વ જિનને હું સદા પ્રણામ કરું છું.

વિશેષાર્થ : સંસારમાં કામદેવ (વિષય વાસના) અત્યંત પ્રબળ મનાય છે. બીજાઓની તો વાત જ શી છે? પરંતુ ઈન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્કવર્તી આદિ પણ તેને વશ (થયેલા) દેખવામાં આવે છે. એવા સુભટ તે કામદેવ ઉપર તેઓ જ વિજય મેળવી શકે છે જેમના હૃદયમાં આત્મ-પરનો વિવેક જાગૃત છે. ભગવાન સુપાર્શ્વ એવા જ વિવેકી મહાપુરુષ હતા. તેથી તેમને ઉક્ત કામદેવ ઉપર વિજય મેળવવા માટે કોઈ શાખાદિની પણ જરૂર ન પડી. તેમણે એક માત્ર વિવેકબુદ્ધિથી તેને હરાવી દીધો હતો. માટે તે નમસ્કાર કરવાને યોગ્ય છે. ૭.

(વંશસ્થ)

શશિપ્રભો વાગમૃતાંશુભિઃ શશી પરં કદાચિત્ત્ર કલઙ્કસંગતઃ ।
ન ચાપિ દોષાકરતાં યયૌ યતિર્જયત્યસૌ સંસૃતિતાપનાશનઃ ॥૮॥

અનુવાદ : ચન્દ્રમા સમાન પ્રભાવાળા ચન્દ્રપ્રભ જો કે વચ્ચનરૂપ અમૃતના કિરણોથી ચન્દ્રમા હતા, પરંતુ જેમ ચન્દ્રમા કલંક (કળા ચિહ્ન) સહિત છે તેમ તેઓ કલંક (પાપ-મળ) સહિત કદી નહોતા, તથા જેમ ચન્દ્રમા દોષકર (રાત્રિ કરનાર) છે તેમ તેઓ દોષકર (દોષોની ખાણ) નહોતા. અર્થાત્ તેઓ અજ્ઞાનાદિ સર્વ દોષરહિત હતા. તે સંસારનો સંતાપ નાટ કરનાર ચન્દ્રપ્રભ મુનીન્દ્ર જયવંત હો. ૮.

(વંશસ્થ)

યદીયપાદદ્વિત્યપ્રણામતઃ પતત્વધો મોહનધૂલિરઙ્કિનામ् ।
શિરોગતા મોહટકપ્રયોગતઃ સ પુષ્પદંતઃ સતતં પ્રણમ્યતે ॥૯॥

અનુવાદ : જેના બન્ને ચરણોમાં નમસ્કાર કરતી વખતે મોહરુપ ઠગના પ્રયત્નથી પ્રાણીઓના શિરમાં સ્થિત થયેલ મોહન ધૂળ (મોહજનક પાપરજ) નીચે પડી જાય છે તે પુષ્પદંત ભગવાનને હું નિરન્તર પ્રણામ કરું છું.

વિશેષાર્થ : પ્રાણીઓના મસ્તકમાં જે અજ્ઞાનતાને કારણે અનેક પ્રકારના દુર્વિચાર ઉત્પન્ન થાય છે તે જિનેન્દ્ર ભગવાનના નામસ્મરણ, ચિન્તન અને વંદનથી નાના થઈ જાય છે. અહીં ઉપર્યુક્ત દુર્વિચારોમાં મોહ દ્વારા સ્થાપિત ધૂળનો આરોપ કરીને આ ઉત્ત્રેક્ષા કરવામાં આવી છે કે મોહદ્વારા જે પ્રાણીઓના મસ્તક ઉપર મોહનધૂળ સ્થાપવામાં આવે છે તે જાણો કે પુષ્પદંત જિનેન્દ્રને પ્રણામ કરવાથી (મસ્તક નમાવવાથી) અનાયાસે જ નાના થઈ જાય છે. ૬.

(વંશસ્થ)

સતાં યદીયં વચનं સુશીતલં યદેવ ચન્દ્રાદપિ ચન્દ્રનાદપિ ।

તદત્ત્ર લોકે ભવતાપહારિ યત્તુ પ્રણાયતે કિં ન સ શીતલો જિનઃ ॥૧૦॥

અનુવાદ : લોકમાં જેમના વચન સજજન પુરુષોને માટે ચન્દ્ર અને ચન્દ્રનથી પણ અધિક શીતળ તથા સંસારનો તાપ નાના કરનાર છે તે શીતલ જિનને શું પ્રણામ ન કરવા જોઈએ? અર્થાત્ અવશ્ય જ તે પ્રણામ કરવા યોગ્ય છે. ૧૦.

(વંશસ્થ)

જગત્ત્રયે શ્રેય ઇતો હ્યાયાદિતિ પ્રાસિદ્ધનામા જિન એષ વન્દતે ।

યતો જનાનાં બહુભક્તિશાલિનાં ભવન્તિ સર્વે સફળા મનોરથાઃ ॥૧૧॥

અનુવાદ : ત્રણો લોકમાં પ્રાણીઓ આ શ્રેયાંસ જિન દ્વારા શ્રેય અર્થાત્ કલ્યાણને પ્રાપ્ત થયા છે, તેથી જે ‘શ્રેયાનુ’ એવા સાર્થક નામે પ્રસિદ્ધ છે તથા જેના નિભિતે અનેક ભક્તિ કરનાર મનુષ્યોના સર્વ મનોરથ (અભિલાષાઓ) સફળ થાય છે તે શ્રેયાંસ જિનેન્દ્રને પ્રણામ કરું છું. ૧૧.

(વંશસ્થ)

પદાબજયુગ્મે તવ વાસુપૂર્જ્ય તઝ્રનસ્ય પુણ્ય પ્રણતસ્ય તદ્બવેત્ત ।

યતો ન સા શ્રીરિહ હિ ત્રિવિષ્ટ્યે ન તત્સુખં યત્ત્ર પુરઃ પ્રધાવતિ ॥૧૨॥

અનુવાદ : હે વાસુપૂર્જ્ય! તારા ચરણ યુગલમાં પ્રણામ કરતાં પ્રાણીને તે પુણ્ય ઉત્પન્ન થાય છે જેનાથી ત્રણો લોકમાં અહીં એવી કોઈ લક્ષ્મી નથી અને એવું કોઈ સુખ પણ નથી કે જે તેની આગળ દોડતું ન હોય.

વિશેષાર્� : અભિપ્રાય એ છે કે વાસુપૂજ્ય જિનેન્દ્રના ચરણક્રમળમાં નમસ્કાર કરવાથી જે પુણ્યબંધ થાય છે તેનાથી સર્વ પ્રકારની લક્ષ્મી અને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ૧૨.

(વંશસ્થ)

મલેર્વિમુક્તો વિમલો ન કૈર્જિનો યર્થાર્થનામા ભુવને નમસ્કૃતઃ ।

તદસ્ય નામસ્મૃતિરાયસંશયં કરોતિ વૈમલ્યમધાત્મનામપિ ॥૧૩॥

અનુવાદ : જે વિમળ જિનેન્દ્ર કર્મ-મળ રહીત થઈને 'વિમળ' એવું સાર્થક નામ ધારણ કરે છે તેમને લોકમાં ભલા ક્રય ભવ્ય જીવોએ નમસ્કાર નથી કર્યા? અર્થાત્ બધા ભવ્ય જીવોએ તેમને નમસ્કાર કર્યા છે. તેથી તેમના નામનું સ્મરણ પણ નિશ્ચયથી પાપી જીવોને પણ તે પાપ-મળ નષ્ટ કરીને તેમને વિમળ (નિર્મળ) કરે છે. ૧૩.

(વંશસ્થ)

અનત્તબોધાદિચતુષ્ટયાત્મકં દધામ્યનત્તં હદિ તદ્ગુણાશયા ।

ભવેદ્યદર્થી નનુ તેન સેવ્યતે તદન્વિતો ભૂરિતૃષેવ સત્તસરઃ ॥૧૪॥

અનુવાદ : જે અનંતજિન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આ અનંતચતુષ્ટયસ્વરૂપ છે તેને હું તે જ ગુણો (અનંતચતુષ્ટય) પ્રાપ્ત કરવાની ઈચ્છાથી હૃદયમાં ધારણ કરું છું. બરાબર પણ છે-જે જે ગુણના અભિલાષી હોય છે તે તે જ ગુણયુક્ત મનુષ્યની સેવા કરે છે. જેમ કે-અતિશય તરસવાળો અર્થાત્ પાણીનો અભિલાષી મનુષ્ય ઉત્તમ તળાવની સેવા કરે છે. ૧૪.

(વંશસ્થ)

નમોऽસ્તુ ધર્માય જિનાય મુક્તયે સુર્ધર્મતીર્થપ્રવિધાયિને સદા ।

યમાશ્રિતો ભવ્યજનો ઽતિદુર્લભાં લભેત કલ્યાણપરંપરાં પરામ् ॥૧૫॥

અનુવાદ : જે ધર્મનાથ જિનેન્દ્રના શરણે ગયેલા ભવ્ય જીવ અતિશય દુર્લભ ઉત્કૃષ્ટ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે એવા તે ઉત્તમ ધર્મતીર્થના પ્રવર્તક ધર્મનાથ જિનેન્દ્રને હું મુક્તિપ્રાપ્તિની ઈચ્છાથી નમસ્કાર કરું છું. ૧૫.

(વંશસ્થ)

વિધાય કર્મક્ષયમાત્મશાન્તિકૃજ્ઞગત્સુ યઃ શાન્તિકરસ્તતો ઽભવત् ।

ઇતિ સ્વમન્ય પ્રતિ શાન્તિકારણં નમામિ શાન્તિ જિનમુન્તતશ્રિયમ् ॥૧૬॥

અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્ર કર્માનો નાશ કરીને પ્રથમ તો પોતે પોતાની શાન્તિ કરનાર થયા અને ત્યાર પછી જગત્ના બીજા પ્રાણીઓને પણ શાન્તિનું કારણ થયા. આ રીતે જે સ્વ અને પર બન્નેની ય શાન્તિનું કારણ છે તે ઉત્કૃષ્ટ લક્ષ્મી (સમવસરણાદિરૂપ બાખ્ય તથા અનંતચતુષ્યસ્વરૂપ અંતરંગ લક્ષ્મી) યુક્ત શાન્તિનાથ જિનેન્દ્રને હું નમસ્કાર કરું છું. ૧૬.

(વંશસ્થ)

દ્યાઙ્કિનાં ચિદ્ દ્વિત્યં વિમુક્તયે પરિગ્રહદ્બવિમોચનેન તત્ત્વ ।
વિશુદ્ધમાસીદિહ યસ્ય માદૃશાં સ કુન્થુનાથો ઽસ્તુ ભવપ્રશાન્તયે ॥૧૭॥

અનુવાદ : સંસારમાં જે કુન્થુનાથ જિનેન્દ્રને મુક્તિ માટે અંતરંગ અને બાખ્ય બન્ને ય પ્રકારના પરિગ્રહ છોડી દેવાથી પ્રાણીઓની દયા અને ચૈતન્ય (કેવળજ્ઞાન) આ બે વિશુદ્ધ ગુણ પ્રગટ થયા હતા તે કુન્થુનાથ જિનેન્દ્ર મારા જેવા છભરસ્થ પ્રાણીઓને સંસારની શાન્તિ (નાશ)નું કારણ થાવ. ૧૭.

(વંશસ્થ)

વિભાન્તિ યસ્યાઙ્કિત્રનખા નમત્સુરસ્ફુરચ્છિરોરત્નમહો ઽધિકગ્રભા: ।
જગદ્ગૃહે પાપતમોવિનાશના ઇવ પ્રદીપા: સ જિનો જયત્યર: ॥૧૮॥

અનુવાદ : નમસ્કાર કરતા દેવોના પ્રકાશમાન શિરોરત્ન (ચૂડામણિ)ની કાન્તિથી અધિક કાન્તિવાળા જેના પગોના નખ, સંસારરૂપ ધરમાં પાપરૂપ અંધકાર નષ્ટ કરનાર દીપક સમાન શોભાયમાન થાય છે તે અરનાથ જિનેન્દ્ર જ્યવંત હો. ૧૮.

(વંશસ્થ)

સુહત્સુખી સ્યાદહિત: સુદુ:ખિત: સ્વતો ઽષ્ટુદાસીનતમાદપિ પ્રભો: ।
યત: સ જીયાઙ્નિનમલિલેકતાં ગતો જગદ્વિસ્મયકારિચેષ્ટિત: ॥૧૯॥

અનુવાદ : અત્યંત ઉદાસીનતા (વીતરાગતા) ને પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ જે ભલિલ પ્રભુના નિમિત્તે ભિત્ર સ્વયં સુખી અને શત્રુ સ્વયં અતિશય દુઃખી થાય છે, આ રીતે જેમની પ્રવૃત્તિ વિશ્વને માટે આશ્ર્યજનક છે તથા જે અદ્વૈતભાવને પ્રાપ્ત થયા છે તે ભલિલ જિનેન્દ્ર જ્યવંત થાવ.

અધિકાર-૧૬ : સ્વયંભૂસુતિ]

૩૨૩

વિશેષાર્� : જે પ્રાણી શત્રુને દુઃખી અને મિત્રને સુખી કરે છે તે કદી ઉદાસીન રહી શકતો નથી. પરંતુ મહિલા જિનેન્દ્ર ન તો શત્રુ પ્રત્યે દ્વેષ રાખતા હતા અને ન મિત્ર પ્રત્યે અનુરાગ. છતાં પણ તેમનો ઉત્કર્ષ જોઈને તેઓ સ્વભાવથી જ કમશા: દુઃખી અને સુખી થતા હતા. તેથી અહીં તેમની પ્રવૃત્તિને આશ્રયકારી કહેવામાં આવી છે. ૧૬.

(વંશસ્થ)

વિહાય નૂં તૃણવત્ત્વસંપદં મુનિર્વત્તૈર્યો ઽભવદત્ત સુવ્રતઃ ।

જગામ તદ્વામ વિરામવર્જિતં સુબોધદૃદ્દમે સ જિનઃ પ્રસીદતુ ॥૨૦॥

અનુવાદ : જે મુનિસુવ્રત અહીં પોતાની સંપત્તિ તૃણ સમાન છોડીને વ્રતો (મહાવતો) દ્વારા સુવ્રત (ઉત્તમ વ્રતોના ધારક) મુનિ થયા હતા અને ત્યારપછી તે અવિનશ્ચર પદ (મોક્ષ) પણ પામ્યા હતા તે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનથી વિભૂષિત મુનિસુવ્રત જિનેન્દ્ર મારા ઉપર પ્રસન્ન થાવ. ૨૦.

(વંશસ્થ)

પરं પરાયત્તતયાતિર્દુર્બલં ચલં ખસૌખ્યં યદસૌખ્યમેવ તત્ ।

અદઃ પ્રમુચ્યાત્મસુખે કૃતાદરો નમિર્જિનો યઃ સ મમાસ્તુ મુક્તયે ॥૨૧॥

અનુવાદ : જે ઈન્દ્રિયસુખ પર (કર્મ) ને આધીન હોવાના કારણે આત્માથી પર અર્થાત્ ભિન્ન છે, અતિશય દુર્બળ છે તથા વિનશ્ચર છે તે વાસ્તવમાં દુઃખરૂપ જ છે. જેણે તે ઈન્દ્રિયસુખ છોડીને આત્મિક સુખના વિષયમાં આદર કર્યો હતો તે નેમિનાથ જિનેન્દ્ર મારા માટે મુક્તિનું કારણ થાવ. ૨૧.

(વંશસ્થ)

અરિષ્ટસંકર્તનચક્રનેમિતામ્ ઉપાગતો ભવ્યજનેષુ યો જિનઃ ।

અરિષ્ટનેમિર્જગતીતિ વિશ્રુતઃ સ ઊર્જયન્તે જયતાદિતઃ શિવમ્ ॥૨૨॥

અનુવાદ : જે અશુભકર્મ કાપવા માટે ચકની ધાર સમાન હોવાથી જગતમાં ભવ્ય જીવો વચ્ચે ‘અરિષ્ટનેમિ’ એવા સાર્થક નામથી પ્રસિદ્ધ થઈને ગિરનાર પર્વત ઉપરથી મુક્તિ પામ્યા છે તે નેમિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૨૨.

(વંશસ્થ)

યદૂધદિશે નભસિ ક્ષણાદહિપ્રભો: ફણારત્કરૈ: પ્રથાવિતમ્ ।

પદાતિભિર્વા કમઠાહતે: કૃતે કરોતુ પાર્શ્વઃ સ જિનો મમામૃતમ્ ॥૨૩॥

અનુવાદ : જેની ઉપર આકાશમાં ધરણેન્નની કેણો સંબંધી રત્નોના કિરણ કમઠના આઘાત માટે અર્થાત્ તેનો ઉપદ્રવ વ્યર્થ કરવા માટે ક્ષણમાત્રમાં પાયદળ સેનાની જેમ દોડ્યા હતા તે પાર્શ્વનાથ જિનેન્દ્ર મને અમૃત અર્થાત્ મોક્ષ આપો. ૨૩.

(વંશસ્થ)

ત્રિલોકલોકેશ્વરતાં ગતો ઽપિ યઃ સ્વકીયકાયે�પિ તથાપિ નિઃસ્પૃહઃ ।

સ વર્ધમાનો ઽન્ત્યજિનો નતાય મે દદાતુ મોક્ષ મુનિપદ્મનાન્દિને ॥૨૪॥

અનુવાદ : ત્રણ લોકના પ્રાણીઓમાં પ્રભુતાને પ્રાપ્ત હોવા છતાં પણ જે પોતાના શરીરના વિષયમાં પણ મમત્વ ભાવ રહિત છે તે વર્ધમાન અંતિમ તીર્થકર નભીભૂત થયેલ મને પદ્મનાન્દીને મોક્ષ પ્રદાન કરો. ૨૪.

આ રીતે સ્વયંભૂસ્તોત્ર સમાપ્ત થયું. ૧૬.

૨૬૦ મિનાનંદ.

૧૭. સુપ્રભાતાષ્કમ્

[૧૭. સુપ્રભાતાષ્કમ્]

(શાર્ડૂલવિક્રીડિત)

નિઃશેષાવરણદ્વયસ્થિતિનિશાપ્રાન્તે ઇન્તરાયક્ષયા[યો]-
દ્રયોતે મોહકૃતે ગતે ચ સહસા નિદ્રાભરે દૂરતઃ ।
સમ્યગ્જ્ઞાનદૃગક્ષિયુગ્મમભિતા વિસ્ફારિતં યત્ત
લલબ્ધં યૈરિહ સુપ્રભાતમચલં તેભ્યો જિનેભ્યો નમઃ ॥૧॥

અનુવાદ : જે સુપ્રભાતમાં સમસ્ત શાનાવરણ અને દર્શનાવરણ આ બે આવરણ કર્માની સ્થિતિરૂપ રાત્રિનો અંત થઈને અન્તરાય કર્મના ક્ષયરૂપી પ્રકાશ થઈ જતાં તથા શીધ જ મોહકર્મથી નિર્ભિત નિદ્રાભાર સહસા દૂર થઈ જતાં સમીયીન શાન અને દર્શનરૂપ નેત્રયુગલ સર્વ તરફ વિસ્તાર પામ્યા છે અર્થાત્ ખૂલી ગયાં છે એવા તે સ્થિર સુપ્રભાતને જેમણે પ્રાપ્ત કરી લીધું છે તે જિનેન્દ્રદેવોને નમસ્કાર હો.

વિશેષાર્થ : જેમ પ્રભાત થઈ જતાં રાત્રિનો અંત થઈને ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાવા માંડે છે તથા લોકોની નિદ્રા દૂર થઈને તેમના નેત્રયુગલ ખૂલી જાય છે કે જેથી તે સર્વ તરફ જોવા લાગી જાય છે. બરાબર એ જ રીતે જિનેન્દ્રદેવોને જે અપૂર્વ પ્રભાતનો લાભ થયા કરે છે તેમાં રાત્રિ સમાન તેમના શાનાવરણ અને દર્શનાવરણ કર્માની સ્થિતિનો અંત થાય છે, અન્તરાયકર્મનો ક્ષય જ પ્રકાશ છે, મોહકર્મજનિત અવિવેકરૂપ નિદ્રાનો ભાર નષ્ટ થઈ જાય છે. ત્યારે તેમના કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ બન્ને નેત્રો ખૂલી જાય છે જેથી તેઓ સમસ્ત વિશ્વને સ્પષ્ટપણે જાણવા અને દેખવા લાગે છે. એવા તે અલોકિક, અવિનશ્વર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રોને અહીં નમસ્કાર કરવામાં આવ્યા છે. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

યત્સચ્ચક્રસુખપ્રદં યદમલં જ્ઞાનપ્રભાભાસુરં
લોકાલોકપદપ્રકાશનવિધિપ્રૌઢં પ્રકૃદં સકૃત્ ।

ઉદ્ભૂતે સતિ યત્ર જીવિતમિવ પ્રાપ્તં પરં પ્રાણિભિ:
તૈલોક્યાધિપતેર્જિનસ્ય સતતં તત્સુપ્રભાતં સ્તુવે ॥૨॥

અનુવાદ : જે સુપ્રભાત સત્યક અર્થात् સજ્જનોને સુખ આપનાર (અથવા ઉત્તમ ચક્વાક પક્ષીઓને સુખ આપનાર અથવા સમીચીન ચક્રતન ધારણ કરનાર ચક્વર્તીને સુખ આપનાર), નિર્મળ, જ્ઞાનની પ્રભાથી પ્રકાશમાન, લોક અને અલોકરૂપ સ્થાનને પ્રકાશિત કરવાની વિધિમાં ચતુર અને ઉત્કૃષ્ટ છે તથા જે એકવાર પ્રગટ થતાં જાણે પ્રાણી ઉત્કૃષ્ટ જીવનને જ પ્રાપ્ત કરી લે છે; એવા તે ત્રણ લોકના અધિપતિસ્વરૂપ જિનેન્દ્ર ભગવાનના સુપ્રભાતની હું નિરંતર સ્તુતિ કરું છું. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

એકાન્તોદ્ભૂતવાદિકૌશિકશતૈર્નષ્ટં ભયાદાકુલે-
જાતં યત્ર વિશુદ્ધખેચરનુતિવ્યાહારકોલાહલમ્ ।
યત્સદ્ધર્મવિધિપ્રવર્ધનકરં તત્સુપ્રભાતં પરં
મન્યે ઽહૃત્પરમેષ્ટિનો નિરૂપમં સંસારસંતાપહત્ ॥૩॥

અનુવાદ : જે સુપ્રભાતમાં સર્વથા એકાન્તવાદથી ઉદ્ભૂત સેંકડો પ્રવાદીરૂપ ધૂવડ પક્ષી ભયથી વ્યાકુળ થઈને નાશ થઈ ગયા છે, જે આકાશગામી વિદ્યાધરો અને દેવો દ્વારા કરવામાં આવતી વિશુદ્ધ સ્તુતિના શબ્દથી શબ્દાયમાન છે, જે સમીચીન ધર્મવિધિને વધારનાર છે, ઉપમા સહિત અર્થાત् અનુપમ છે અને સંસારનો સંતાપ નાશ કરનાર છે, એવા તે અરહંત પરમેષ્ઠીના સુપ્રભાતને જ હું ઉત્કૃષ્ટ સુપ્રભાત માનું છું. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

સાનન્દं સુરસુન્દરીભિરભિતઃ શક્રૈર્યદા ગીયતે
પ્રાતઃ પ્રતરધીશ્વરં યદ્તુલં વैતાલિકૈઃ પઠ્યતે ।
યચ્ચાશ્રાવિ નભશ્વરૈશ્વ ફળિભિઃ કન્યાજનાદ્નાયત-
સત્દન્દે જિનસુપ્રભાતમાખિલતૈલોક્યહર્ષપ્રદમ् ॥૪॥

અનુવાદ : ઈન્દ્રો સાથે દેવાંગનાઓ જે સુપ્રભાતનું આનંદપૂર્વક સર્વ તરફ ગાન

કરે છે, ભાટચારણો પોતાના સ્વામીનું લક્ષ્ય રાખીને જે અનુપમ સુપ્રભાતની સ્તુતિ કરે છે તથા જે સુપ્રભાત વિષે વિદ્યાધર અને નાગકુમાર જાતિના દેવ ગાતી કન્યાઓ પાસેથી સાંભળે છે; આ રીતે સમસ્ત ત્રણે લોકને હર્ષિત કરનાર તે જિન ભગવાનના સુપ્રભાતને હું વંદન કરું છું. ૪.

(શાર્ડૂલવિક્રીડિત)

ઉદ્યોતે સતિ યત્ર નશ્યતિ તરાં લોકે ઽઘચૌરો ઽચિરં
દોષેશો ઽન્તરતીવ યત્ર મલિનો મન્દગ્રભો જાયતે ।
યત્રાનીતિતમસ્તતેર્વિઘટનાજ્ઞાતા દિશો નિર્મલા
વચ્ચં નન્દતુ શાશ્વતં જિનપતેસ્તત્સુપ્રભાતં પરમ્ ॥૫॥

અનુવાદ : જે સુપ્રભાતનો પ્રકાશ થતાં લોકમાં પાપરૂપી ચોર અત્યંત જલ્દી નાદ થઈ જાય છે, જે સુપ્રભાતના પ્રકાશમાં દોષેશ અર્થાત્ મોહરૂપ ચન્દ્રમા અંદર અતિશય મલિન થઈને મન્દ તેજવાળો થઈ જાય છે તથા જે સુપ્રભાત થતાં અન્યાયરૂપ અંધકારનો સમૂહ ન થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે; એવા તે વંદનીય અને અવિનશ્યર જિન ભગવાનનું ઉત્કૃષ્ટ સુપ્રભાત વૃદ્ધિને પ્રાપ્ત થાવ.

વિશેષાર્થ : પ્રભાતનો સમય થતાં રાત્રે સંચાર કરનાર ચોર ભાગી જાય છે, દોષેશ (રાત્રિનો સ્વામી ચન્દ્રમા) મલિન અને ઝાંખા પ્રકાશવાળો (ઝીક્કો) થઈ જાય છે અને રાત્રિજનિત અંધકાર નાદ થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે. એ જ રીતે જિન ભગવાનને જે અનુપમ સુપ્રભાતનો લાભ થાય છે તે થતાં ચોર સમાન ચિરકાલીન પાપ તરત જ નાદ થઈ જાય છે, દોષેશ (દોષોના સ્વામી મોહ) કાન્નિષીન થઈને દૂર ભાગી જાય છે તથા અન્યાય અને અત્યાચાર નાદ થઈ જવાથી બધી બાજુએ પ્રસન્નતા છવાઈ જાય છે. તે જિનેન્દ્રદેવનું સુપ્રભાત વંદનીય છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

માર્ગ યત્પ્રકટીકરોતિ હરતે દોષાનુષ્ઠાનસ્થિતિં
લોકાનાં વિદ્ધાતિ દૃષ્ટિમચિરાદર્થાવલોકણમામ્ ।
કામાસક્તધિયામપિ કૃશયતિ પ્રીતિં પ્રિયાયામિતિ
પ્રાતસ્તુલ્યતયાપિ કો ઽપિ મહિમાપૂર્વઃ પ્રભાતો ઽહૃતામ્ ॥૬॥

અનુવાદ : અરહંતોનું પ્રભાત માર્ગ પ્રગટ કરે છે. દોષોના સંબંધની સ્થિતિ

નાથ કરે છે, લોકોની દૃષ્ટિ તરત જ પદાર્થોને દેખવામાં સમર્થ બનાવે છે તથા વિષયભોગમાં આસક્ત બુદ્ધિવાળા પ્રાણીઓની સ્ત્રીવિષયક પ્રીતિ કૃશ (નિર્બણ) કરે છે. આ રીતે તે અરહંતોનું પ્રભાત જો કે પ્રભાતકાળ તુલ્ય જ છે, છતાં પણ તેનો કોઈ અપૂર્વ જ મહિમા છે.

વિશેષાર્થ : જેવી રીતે પ્રભાત થતાં માર્ગ પ્રગટ દેખાવા માંડે છે તેવી જ રીતે અરહંતોના આ પ્રભાતમાં પ્રાણીઓને મોક્ષનો માર્ગ દેખાવા લાગે છે, જેમ પ્રભાત દોષા (રાત્રિના) સંગાનો નાશ કરે છે તેવી જ રીતે આ અરહંતોનું પ્રભાત રાગદ્વેષાદિરૂપ દોષોની સંગતિ નાથ કરે છે. જેમ પ્રભાત લોકોની દૃષ્ટિને તરત જ ઘટ-પટાઈ પદાર્થો દેખવામાં સમર્થ કરી દે છે તેવી જ રીતે આ અરહંતોનું પ્રભાત પ્રાણીઓની દૃષ્ટિ (જ્ઞાન) ને જીવાદિ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ દેખવા-જાણવામાં સમર્થ કરી દે છે તથા જેમ પ્રભાત થઈ જતાં કામી જનની સ્ત્રીવિષયક પ્રીતિ ઓછી થઈ જાય છે તેવી જ રીતે તે અરહંતોના પ્રભાતમાં પણ કામીજનની વિષયેચ્છા ઓછી થઈ જાય છે. આ રીતે અરહંતોનું તે પ્રભાત પ્રસિદ્ધ પ્રભાત સમાન હોઈને પણ અપૂર્વ જ મહિમા ધારણ કરે છે. ૬.

(શાર્દૂલવિક્રીડિત)

યद્ધાનોરપિ ગોચરં ન ગતવાન્ન ચિત્તે સ્થિતં તત્તમો
 ભવ્યાનાં દલયત્તથા કુવલયે કુર્યાદ્વિકાશશ્રિયમ् ।
 તેજઃ સૌખ્યહતેરકર્તૃ યદિદં નવતંચરાણામપિ
 ક્ષેમં વો વિદધાતુ જૈનમસમં શ્રીસુપ્રભાતં સદા ॥૭॥

અનુવાદ : ભવ્ય જીવોના હદ્યમાં સ્થિત જે અંધકાર સૂર્યગોચર થયો નથી અર્થાત્ જેને સૂર્ય પણ નાથ કરી શક્યો નથી તેને જે જિન ભગવાનનું સુપ્રભાત નાથ કરે છે, જે કુવલય (ભૂમંડળ) ના વિષયમાં વિકાસલક્ષ્મી (પ્રમોદ) કરે છે-લોકના સર્વે પ્રાણીઓને ઉર્ધ્વિત કરે છે તથા જે નિશાચરો (ચન્દ્ર અને રાક્ષસ આદિ) ના પણ તેજ અને સુખનો ધાત કરતું નથી; તે જિન ભગવાનનું અનુપમ સુપ્રભાત સર્વદા આપ સૌનું કલ્યાણ કરો.

વિશેષાર્થ : લોકપ્રસિદ્ધ પ્રભાતની અપેક્ષાએ જિનભગવાનના આ સુપ્રભાતમાં અપૂર્વતા છે. તે આ રીતે-પ્રભાતનો સમય કેવળ રાત્રિનો અંધકાર નાથ કરે છે, તે જીવોના અભ્યંતર અંધકાર (અજ્ઞાન) ને નાથ કરી શકતો નથી; પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત ભવ્ય જીવોના હદ્યમાં સ્થિત તે અજ્ઞાનાંધકારને પણ નાથ કરે છે, લોકપ્રસિદ્ધ પ્રભાત કુવલય (સર્કેદ કમળ) ને વિકસિત નથી

અધિકાર-૧૭ : સુપ્રભાતાષ્ટકમ्]

૩૨૮

કરતું પણ મુકૃલિત જ કરે છે (બીડાઈ જાય છે); પરંતુ જિન ભગવાનનું સુપ્રભાત તે કુવલય (ભૂમંડળના સમસ્ત જીવો) ને વિકસિત (પ્રમુદિત) જ કરે છે. લોકપ્રસિદ્ધ પ્રભાત નિશાયરો (ચન્દ્ર, ચોર અને ધૂવડ વગેરે)ના તેજ અને સુખનો નાશ કરે છે પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત તેમના તેજ અને સુખનો નાશ નથી કરતું. આ રીતે તે જિન ભગવાનનું અપૂર્વ સુપ્રભાત સર્વ પ્રાણીઓને માટે કલ્યાણકારી છે. ૭.

(શાર્દૂલવિક્રીદિત)

**ભવામ્ભોરુહનન્દિકેવલરવિઃ પ્રાપ્નોતિ યત્રોદયં
 દુષ્કર્મોદયનિદ્રયા પરિહૃતં જાગર્તિ સર્વ જગત् ।
 નિત્ય યૈઃ પરિપદ્યતે જિનપતેરેતત્ત્વભાતાષ્ટકં
 તેષામાશુ વિનાશમેતિ દુરિતં ધર્મઃ સુખ વર્ધતે ॥૮॥**

અનુવાદ : જે સુપ્રભાતમાં ભવ્યજીવોરૂપ કમળોને આનંદિત કરનાર કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદ્ય પામે છે તથા સંપૂર્ણ જગત્ (જગતના જીવ) પાપકર્મના ઉદ્યરૂપ નિદ્રાથી ઘૂટકારો પામીને જાગે છે અર્થાત્ પ્રબોધ પામે છે તે જિન ભગવાનના સુપ્રભાતની સુતું સ્વરૂપ આ પ્રભાતાષ્ટક જે જીવ નિરંતર ભાગે છે તેમના પાપ તરત જ નાશ પામે છે તથા ધર્મ અને સુખ વૃદ્ધિ પામે છે.

વિશેષાર્થ : જેમ સુપ્રભાત થતાં કમળોને પ્રકૃલિત કરનાર સૂર્ય ઉદ્ય પામે છે તેવી જ રીતે જિન ભગવાનના તે સુપ્રભાતમાં ભવ્ય જીવોને પ્રકૃલિત કરનાર કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદ્ય પામે છે તથા જેમ પ્રભાત થતા જગતના પ્રાણી નિદ્રા રહિત થઈને જાગી ઉઠે છે તેવી જ રીતે જિન ભગવાનના પ્રભાતમાં જગતના સર્વ પ્રાણી પાપકર્મના ઉદ્યસ્વરૂપ નિદ્રારહિત થઈને જાગી જાય છે-પ્રબોધ પામી જાય છે આ રીતે આ જિન ભગવાનનું સુપ્રભાત અનુપમ છે. તેના વિષયમાં જે શ્રી પદ્મનાભી મુનિએ આઠ શ્લોકોમાં આ સુતું કરી છે તે વાંચવાથી પ્રાણીઓના પાપનો વિનાશ અને ધર્મ તથા સુખની અભિવૃદ્ધિ થાય છે. ૮.

આ રીતે સુપ્રભાતાષ્ટક સમાપ્ત થયું. ૧૭.



૩૮૮

૧૮. શાન્તિનાથ સ્તોત્ર

[૧૮. શાન્તિનાથ સ્તોત્રમ्]

(શાર્દૂલવિક્રીડિત)

તૈલોક્યાધિપતિત્વસૂચનપરં લોકેશ્વરૈરૂદ્ધતં
યસ્યોપર્યુપરીન્દુમણ્ડલનિભં છત્રત્રયં રાજતે ।
અશ્રાન્તોદ્ધતકેવલોજ્વલરુચા નિર્ભત્તિતાર્કપ્રભં
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૧॥

અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનના એક એક ઉપર ઈન્દ્રો દ્વારા ધારણ કરવામાં આવતા ચન્દ્રમંડળ સમાન ત્રણ છત્ર ત્રણે લોકની પ્રભુતા સૂચિત કરતા નિરન્તર ઉદ્યમાન રહેનાર કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ દ્વારા સૂર્યના પ્રકાશને તિરસ્કૃત કરીને સુશોભિત થાય છે તે પાપરૂપ કાલિમાંથી રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

દેવઃ સર્વવિદેષ એષ પરમો નાન્યસ્ત્રિલોકીપતિઃ
સન્ત્યસ્યૈવ સમસ્તતત્ત્વવિષયા વાચઃ સતાં સંમતાઃ ।
એતद્ઘોષયતીવ યસ્ય વિબુધૈરાસ્ફાલિતો દુન્દુભિઃ
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૨॥

અનુવાદ : જેની ભેરી દેવો દ્વારા તારિત થઈને જાણે એ જ ઘોષણા કરે છે કે ત્રણે લોકના સ્વામી અને સર્વજ્ઞ આ શાન્તિનાથ જિનેન્દ્ર જ ઉત્કૃષ્ટ દેવ છે અને બીજા નથી; તથા સમસ્ત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર એમના જ

અધિકાર-૧૮ : શાન્તિનાથ સ્તોત્ર]

૩૩૧

વચન સજજનોને ઈષ્ટ છે, બીજા કોઈના ય વચન તેમને ઈષ્ટ નથી; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

દિવ્યસ્ત્રીમુખપદ્મજૈકમુકુરપ્રોલલાસિનાનામणિ-
સ્ફારીભૂતવિચિત્રરશ્મિરચિતાનપ્રામરેન્દ્રાયુધૈ: ।
સચ્ચિત્રીકૃતવાતવર્ત્મનિ લસત્સિંહાસને યઃ સ્થિતઃ:
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૩॥

અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્ર દેવાંગનાઓના મુખકમળરૂપ અનુપમ દર્પણમાં દેદીઘ્રમાન અનેક મણિઓના ફેલાતાં વિચિત્ર કિરણો દ્વારા રચવામાં આવેલા કેટલાક નમ્રીભૂત મેઘધનુષ્યો દ્વારા આકાશને સમીચીનપણે વિચિત્ર (અનેક વર્ણમય) કરનાર સિંહાસન ઉપર સ્થિત છે તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ ભગવાન સદા આપણી રક્ષા કરો. ૩.

(શાર્દૂલવિક્રીડિત)

ગન્ધાકૃષ્ટમધુત્રતજરૂતૈવ્યાપારિતા કુર્વતી
સ્તોત્રાણીવ દિવઃ સુરઃ સુમનસાં વૃદ્ધિર્યદગ્રે ઽભવત् ।
સેવાયાતસમસ્તવિષ્પપતિસ્તુત્યાશ્રયસ્પર્દ્યા
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૪॥

અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્રની આગળ દેવો દ્વારા વ્યાપારિત થયેલી અર્થાત્ કરવામાં આવતી જે આકાશમાંથી ઝૂલોની વર્ધા થઈ હતી તે ગન્ધદ્વારા આકર્ષેલા ભ્રમરસમૂહના શબ્દોથી જાણે સેવાના નિમિત્તે આવેલા સમસ્ત લોકના સ્વામી દ્વારા કરવામાં આવતી સ્તુતિના નિમિત સ્પર્ધા પામીને સ્તુતિઓ જ કરી રહી હતી, તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

ખદ્યોતૌ કિમુતાનલસ્ય કળિકે શુભ્રાભ્રલેશાવથ
સૂર્યાચન્દ્રમસાવિતિ પ્રગુણિતૌ લોકાક્ષિયુગ્મૈ: સુરૈ: ।

તવર્યેતે હિ યદગ્રતો ઽતિવિશદં તદ્યસ્ય ભામણ્ડલં
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૫॥

અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનનું અત્યંત નિર્મળ તે ભામણ્ડળ છે કે જેની આગળ લોકોના બન્ને નેત્ર તથા દેવ સૂર્ય અને ચન્દ્રના વિષયમાં એવી કલ્પના કરે છે કે આ શું બે આગિયા છે અથવા અભિનના બે તણાખા છે, અથવા સફેદ વાદળના બે ટૂકડા છે, તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ભગવાન શાન્તિનાથ જિનેન્દ્રનું પ્રભામણ્ડળ એટલું નિર્મળ અને દેશીષ્યમાન હતું કે તેની આગળ સૂર્ય-ચન્દ્ર લોકોને આગિયા, અભિનક્ષણ અથવા સફેદ વાદળના ટૂકડા સમાન કાન્તિહીન લાગતા હતા. ૫.

(શાર્દૂલવિક્રીડિત)

યસ્યાશોકતરુર્વિનિદ્રસુમનોગુચ્છપ્રસક્તાઃ ક્વણ્દ-
ભૃઙ્ગ-ર્ભક્તિયુતઃ પ્રભોરહરહર્ગાયન્નિવાસ્તે યશઃ ।
શુભ્રં સાભિનયો મરુચ્ચલલતાપર્યન્તપાણિશ્રિયા
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૬॥

અનુવાદ : જે શ્રી શાન્તિનાથ જિનેન્દ્રનું અશોકવૃક્ષ વિકસિત પુષ્પોના ગુચ્છોમાં આસક્ત થઈને શબ્દ કરનાર ભમરા દ્વારા જાણે ભક્તિયુત થઈને પ્રતિદિન પ્રભુના ધવલ યશનું ગાન કરતું તથા વાયુથી ચંચળ લતાઓના પર્યન્તભાગરૂપ ભુજાઓની શોભાથી જાણે અભિનય (નૃત્ય) કરતું સ્થિત છે તે પાપરૂપ કાલિમારહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૬.

(શાર્દૂલવિક્રીડિત)

વિસ્તીર્ણાખિલવસ્તુતત્ત્વકથનાપારપ્રવાહોઝલા
નિઃશેષાર્થિષેવિતાતિશિશિરા શૈલાદિવોતુઙ્ગતઃ ।
પ્રોદ્ભૂતા હિ સરસ્વતી સુરનુતા વિશ્વ પુનાના યતઃ
સો ઽસ્માનું પાતુ નિર૜નો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૭॥

અનુવાદ : ઉન્ત પર્વત સમાન જે શાન્તિનાથ જિનેન્દ્રથી ઉત્પન્ન થયેલી દિવ્ય વાણીરૂપ સરસ્વતી નામની નદી (અથવા ગંગા) વિસ્તીર્ણ સમસ્ત વસ્તુસ્વરૂપના વ્યાખ્યાનરૂપ અપાર પ્રવાહથી ઉજ્જવળ, સર્વ યાચકો વડે સેવિત, અતિશય શીતળ, દેવોથી સુતિ પામેલ અને વિશ્વને પવિત્ર કરનારી છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.

વિશેષાર્થ : અહીં ભગવાન શાન્તિનાથની વાણીની સરસ્વતી નદી સાથે તુલના કરતાં એમ બતાવવામાં આવ્યું છે કે જેવી રીતે સરસ્વતી નદી અપાર નિર્મળ જળપ્રવાહથી યુક્ત છે તેવી જ રીતે ભગવાનની વાણી વિસ્તીર્ણ સમસ્ત પદાર્થોના સ્વરૂપના કથનરૂપ પ્રવાહથી સંયુક્ત છે, જેમ સ્નાનાદિના અભિવાધી જનો તે નદીની સેવા કરે છે તેવી જ રીતે તત્ત્વના જિજ્ઞાસુ જીવો ભગવાનની તે વાણીની પણ સેવા કરે છે, જેમ નદી ગરભીથી પિડાયેલા પ્રાણીઓને સ્વભાવથી શીતળ કરનારી છે તેવી જ રીતે ભગવાનની તે વાણી પણ પ્રાણીઓના સંસારરૂપ સંતાપનો નાશ કરીને તેમને શીતળ કરનારી છે, નદી જો ઊંચા પર્વત ઉપરથી ઉત્પન્ન થાય છે તો તે વાણી પર્વત સમાન ગુણોથી ઉન્તતિ પામેલા જિનેન્દ્ર ભગવાનથી ઉત્પન્ન થઈ છે, જો દેવ નદીની સુતિ કરે છે તો તેઓ ભગવાનની તે વાણીની પણ સુતિ કરે છે; તથા જો નદી શારીરિક બાધ મળ દૂર કરીને વિશ્વને પવિત્ર કરે છે તો તે ભગવાનની વાણી પ્રાણીઓના અભ્યંતર મળ (અજ્ઞાન અને રાગ-દ્રેષ્ટ) ને દૂર કરીને તેમને પવિત્ર કરે છે. આ રીતે તે શાન્તિનાથ જિનેન્દ્રની વાણી નદી સમાન હોવા છતાં પણ તેનાથી ઉત્કૃષ્ટ છે, કારણ કે તે તો કેવળ પ્રાણીઓના બાધ મળ જ દૂર કરી શકે છે પરંતુ તે ભગવાનની વાણી તેમનો અભ્યંતર મળ પણ દૂર કરે છે. ૭.

(શાર્દૂલવિક્રીડિત)

લીલોદ્વેલિતબાહુકદ્વણરણત્કાપ્રહૃષ્ટૈः સુરૈः
ચચ્ચચ્ચન્દ્રમરીચિસંચયસમાકારૈશ્વલચ્છામરૈઃ ।
નિત્યં યઃ પરિવીજ્યતે ત્રિજગતાં નાથસ્તથાષ્પસ્પૃહઃ
સો ઽસ્માન् પાતુ નિરજનો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૮॥

અનુવાદ : ત્રણે લોકોના સ્વામી જે શાન્તિનાથ જિનેન્દ્રની ઉપર રમતમાત્રમાં ઉંચકેલી ભુજાઓમાં સ્થિત કંકણના શબ્દથી હર્ષ પામેલા દેવ સદા પ્રકાશમાન ચન્દ્રકિરણોના સમૂહ સમાન આકારવાળા ચંચળ યામરો ઢોળે છે, તો પણ જે ઈચ્છારહિત છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૮.

(શાર્ડૂલવિક્રીડિત)

નિઃશેષશ્રુતબોધવૃદ્ધમતિભિ: પાયૈરુદારૈપિ
સ્તોત્રૈયસ્ય ગુણાર્ણવસ્ય હરિભિ: પારો ન સંપ્રાપ્તતે ।
ભવ્યાભ્યોરુહનન્દિકેવલરવિર્ભક્ત્યા મયાપિ સ્તુત:
સો ઽસ્માનુ પાતુ નિરઘનો જિનપતિઃ શ્રીશાન્તિનાથઃ સદા ॥૧॥

આનુવાદ : સમસ્ત શાખજ્ઞાનથી વૃદ્ધિ પામેલી બુદ્ધિવાળા ઈન્દ્રો પણ અનેક મહાન સ્તોત્રો દ્વારા જે શાન્તિનાથ જિનેન્દ્રના ગુણસમૂહનો પાર પામતા નથી તે ભવ્ય જીવોરૂપ કુમળોને પ્રફુલ્લિત કરનાર એવા કેવળજ્ઞાનરૂપ સૂર્ય સંયુક્ત જિનેન્દ્રની મેં જે સ્તુતિ કરી છે તે કેવળ ભક્તિને વશ થઈને જ કરી છે. તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૮.

આ રીતે શાન્તિનાથ સ્તોત્ર સમાપ્ત થયું. ૧૮.



૧૯. શ્રીજિનપૂજાષ્ક

[૧૯. શ્રીજિનપૂજાષ્કમ्]

(વસંતતિલકા)

જાતિર્જરામરણમિત્યનલત્રયસ્ય
જિવાશ્રિતસ્ય બહુતાપકૃતો યથાવત્તુ ।
વિધ્યાપનાય જિનપાદયુગાગ્રભૂમૌ
ધારાત્રયં પ્રવરવારિકૃતં ક્ષિપામિ ॥૧॥

અનુવાદ : જન્મ, જરા અને મરણ આ જીવના આશ્રયે રહેનાર ત્રણ અગ્નિઓ
બહુ સંતાપ કરનારી છે. હું તેમને શાન્ત કરવા માટે જિન ભગવાનના ચરણ યુગલ
આગળ વિધિપૂર્વક ઉત્તમ જીણથી નિર્મિત ત્રણ ધારાઓનું ક્ષેપણ કરું છું. ૧. જીણધારા.

(વસંતતિલકા)

યદ્ધદ્વચો જિનપતેર્ભવતાપહારિ
નાહં સુશીતલમપીહ ભવામિ તદ્ધત્તુ ।
કર્પૂરચન્દનમિતીવ મયાર્પિતં સત્તુ
ત્વત્પાદપદ્ભૂજસમાશ્રયણં કરોતિ ॥૨॥

અનુવાદ : જેવી રીતે જિન ભગવાનની વાણી સંસારનો સંતાપ દૂર કરનારી
છે તેવી રીતે શીતળ હોવા છતાં પણ હું તે સંતાપ દૂર કરી શકતો નથી, આ જીતના
વિચારથી જ જાણે મારા દ્વારા ભેટ કરવામાં આવેલ કપૂર મિશ્રિત તે ચન્દન હે
ભગવાન્! આપના ચરણકુમળોનો આશ્રય કરે છે. ૨. ચંદન.

(વસંતતિલકા)

રાજત્યસૌ શુચિતરાક્ષતપુજ્ઞરાજિ-
ર્દત્તાધિકૃત્ય જિનમક્ષતમક્ષધૂતૈત્તેઃ ।
વીરસ્ય નેતરજનસ્ય તુ વીરપદ્મો
બદ્ધઃ શિરસ્યતિતરાં શ્રિયમાતનોતિ ॥૩॥

અનુવાદ : ઈન્દ્રિયરૂપ ધૂર્તોદ્વારા બાધા નહીં પામેલા એવા જિન ભગવાનના આશ્રયે આપવામાં આવેલી તે અતિશય પવિત્ર અક્ષતના પુંજની પંક્તિ સુશોભિત થાય છે. બરાબર છે-પરાક્રમી પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ વીરપદ્મ જેમ અત્યંત શોભા વિસ્તારે છે તેમ કાયર પુરુષના શિર ઉપર બાંધવામાં આવેલ તેવી શોભા વિસ્તારતો નથી. ૩. અક્ષત.

(વસંતતિલકા)

સાક્ષાદપુષ્પશર એવ જિનસ્તદેનં
સંપૂજયામિ શુચિપુષ્પશરૈર્મનોજૈઃ ।
નાન્યं તદાશ્રયતયા કિલ યત્ત્ર યત્ત્ર
તત્તત્ત્ર રમ્યમધિકાં કુરુતે ચ લક્ષ્મીમૂ ॥૪॥

અનુવાદ : આ જિનેન્દ્ર પ્રત્યક્ષ અપુષ્પશર અર્થાત્ પુષ્પશર (કામ) રહિત છે, તેથી હું તેની મનોહર અને પવિત્ર પુષ્પશરો (પુષ્પના હારો) થી પૂજા કરું છું. અન્ય (બ્રહ્મા આદિ) કોઈની પણ હું તેમનાથી પૂજા કરતો નથી. કારણ કે તે પુષ્પશર અર્થાત્ કામને આધીન છે. બરાબર છે-જે રમણીય વસ્તુ જ્યાં ન હોય તે ત્યાં અધિક શોભા આપે છે.

વિશેષાર્થ : પુષ્પશરના બે અર્થ થાય છે, પુષ્પરૂપ બાળોના ધારક કામદેવ તથા પુષ્પમાળા. અહીંશ્લેષની મુખ્યતાથી ઉક્ત બન્ને અર્થની વિવક્ષા કરીને એમ બતાવવામાં આવ્યું છે કે જિન ભગવાન પાસે પુષ્પશર (કામવાસના) નથી, તેથી હું તેની પુષ્પશરોથી (પુષ્પમાળાઓથી) પૂજા કરું છું. અન્ય હરિ, હર અને બ્રહ્મા આદિ પુષ્પશર સહિત છે; માટે તેમની પુષ્પશરોથી પૂજા કરવામાં કાંઈ પણ શોભા નથી. એ જ વાત પુષ્પ કરવા માટે એમ પણ કહી દેવામાં આવ્યું છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં જ તે વસ્તુ મૂકવાથી શોભા થાય

અધિકાર-૧૮ : શ્રી જિનપૂજાએક]

૩૩૭

છે, નહિ કે જ્યાં તે વસ્તુ વિદ્યમાન હોય ત્યાં મૂકવાથી. તાત્પર્ય એ છે કે જિનેન્દ્ર ભગવાન જ જગત્વિજ્ઞી કામદેવ રહિત હોવાના કારણે પુષ્પો દ્વારા પૂજવાને યોગ્ય છે, નહિ કે ઉકેલ કામ પીડિત હરિ-હર આદિ. કારણ એ છે કે પૂજક જેમ કામરહિત જિનેન્દ્રની પૂજાથી સ્વયં પણ કામરહિત થઈ જાય છે તેવી રીતે કામ પીડિત અન્યની પૂજા કરવાથી તે કદી પણ તેનાથી રહિત થઈ શકતા નથી. ૪. પુષ્પ.

(વસંતતિલકા)

દેવો ઽયમિન્દ્રિયબલપ્રલયં કરોતિ
નૈવેદ્યમિન્દ્રિયબલપ્રદ્ખાયમેતત् ।
ચિત્રં તથાપિ પુરતઃ સ્થિતમહૃતો ઽસ્ય
શોભાં બિભર્તિ જગતો નયનોત્સવાય ॥૫॥

અનુવાદ : આ ભગવાન ઈન્દ્રિયનું બળ નષ્ટ કરે છે અને આ નૈવેદ્ય ઈન્દ્રિયનું બળ આપનાર ખાદ્ય (ભક્ષય) છે છતાં પણ આશ્રય છે કે આ અરહંત ભગવાનની આગળ સ્થિત તે નૈવેદ્ય જગતુના પ્રાણીઓના નેત્રોને આનંદાયક શોભા ધારણ કરે છે. ૫. નૈવેદ્ય.

(વસંતતિલકા)

આરાર્તિકં તરલવહિશિખં વિભાતિ
સ્વચ્છે જિનસ્ય વૃપુષિ પ્રતિબિન્ધિતં સત્ત ।
ધ્યાનાનલો મૃગયમાણ ઇવાવશિષ્ટ
દગ્ધું પરિભ્રમતિ કર્મચયં પ્રચણઃ ॥૬॥

અનુવાદ : યંચળ અર્જિનાશિખાથી સંયુક્ત આરતીનો દીપક જિન ભગવાનના સ્વર્ણ શરીરમાં પ્રતિબિન્ધિત થઈને એવો શોભે છે કે જાણો તે બાકી રહેલા (અધાતિ) કર્મસમૂહને બાળવા માટે શોધતી તીવ્ર ધ્યાનરૂપ અર્જિન જ ફરી રહી હોય. ૬. દીપ.

(વસંતતિલકા)

કસ્તૂરિકારસમયીરિવ પત્રવલ્લી:
કુર્વનુ મુખેષુ ચલનैરિહ દિગ્વધૂનામ् ।

હર્ષાદિવ પ્રભુજિનાશ્રયણે વાત-
પ્રેષ્ઠદ્વર્પુર્નટતિ પશ્યત ધૂપધૂમઃ ॥૭॥

અનુવાદ : જીએ, વાયુથી કંપતા શરીરવાળો ધૂપનો ધૂમાડો પોતાના કંપનથી (ચંચળતાથી) જાણે અહીં દિશાઓરૂપ સ્ત્રીઓના મુખમાં કસ્તૂરીના રસમાંથી બનાવેલી પત્રવલ્લી (ગાલ ઉપર કરવામાં આવતી રચના) ને કરતો થકો જિન ભગવાનના આશ્રયથી પ્રાપ્ત થયેલ હર્ષથી નાચી જ રહ્યો છે. ૭. ધૂપ.

(વસંતતિલકા)

ઉચ્ચૈઃફલાય પરમામૃતસંજ્ઞકાય
નાનાફલैર્જિનપતિ પરિપૂજયામિ ।
તદ્વક્તિરેવ સકલાનિ ફલાનિ દત્તે
મોહેન તત્તદાપી યાચત એવ લોકઃ ॥૮॥

અનુવાદ : હું ઉત્કૃષ્ટ અમૃત નામનું ઉન્ત ફળ (મોક્ષ) પ્રાપ્ત કરવા માટે અનેક ફળોથી જિનેન્દ્રદેવની પૂજા કરું છું. જો કે જિનેન્દ્રની ભક્તિ જ સમસ્ત ફળો આપે છે, તો પણ મનુષ્ય અજ્ઞાનથી ફળની યાચના કર્યા કરે છે. ૮. ફળ.

(વસંતતિલકા)

પૂજાવિધિં વિધિવદત્ત વિધાય દેવે
સ્તોત્રં ચ સંમદરસાશ્રિતચિત્તવૃત્તિઃ ।
પુષ્પાઙ્જલિં વિમલકેવલલોચનાય
યચ્છામિ સર્વજનશાન્તિકરાય તસ્મૈ ॥૯॥

અનુવાદ : હર્ષરૂપ જળથી પરિપૂર્ણ મનોવ્યાપાર સહિત હું અહીં વિધિપૂર્વક જિનભગવાનના વિષયમાં પૂજાવિધાન અને સ્તુતિ કરીને નિર્મળ કેવળજ્ઞાનરૂપ નેત્ર સંયુક્ત થઈને સર્વ જીવોને શાન્તિ પ્રદાન કરનાર તે જિનેન્દ્રને પુષ્પાંજલિ આપું છું. ૯. અર્ધ.

(વસંતતિલકા)

શ્રીપદ્મનાન્દિતગુણૌધ ન કાર્યમસ્તિ
પૂજાદિના યદપિ તે કૃતકૃત્યતાયાઃ ।

**સ્વશ્રેયસે તદપિ તત્કુરુતે જનોરહ્નુ
કાર્યા કૃષિઃ ફલકૃતે ન તુ ભૂપકૃતૈ ॥૧૦॥**

અનુવાદ : મુનિ પદમ (પદ્મનાભ) દ્વારા જેના ગુણ સમૂહની સુનિ કરવામાં આવી છે એવા હે અરહંતદેવ! જો કે કૃતકૃત્યતા પામી જવાથી તમને પૂજા આદિથી કાંઈ પણ પ્રયોજન રહ્યું નથી, તો પણ મનુષ્ય પોતાના કલ્યાણ માટે તમારી પૂજા કરે છે. બરાબર પણ છે-ખેતી પોતાનું જ પ્રયોજન સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે, નહિ કે રાજાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે.

વિશેષાર્થ : જેમ ખેડૂત જે ખેતી કરે છે તેમાંથી તે કેટલોક ભાગ જો કે કરુંપે રાજાને પણ આપે છે તો પણ તે રાજાના નિમિત્તે કાંઈ ખેતી કરતો નથી પરંતુ પોતાના જ પ્રયોજન (કુદુંબ પરિપાલન આદિ) ને સાધવા માટે તે કરે છે. બરાબર એવી જ રીતે ભક્તજનો જે જિનેન્દ્ર આદિની પૂજા કરે છે તે કાંઈ તેમને પ્રસન્ન કરવા માટે કરતા નથી, પરંતુ પોતાના આત્મપરિણામોની નિર્મણતા માટે જ કરે છે. કારણ એ છે કે જિન ભગવાન તો વીતરાગ (રાગ-દ્વેષ રહિત) છે, તેથી તેનાથી તેમની પ્રસન્નતા તો સંભવતી નથી; છતાં પણ તેનાથી પૂજા કરનારાને પરિણામોમાં જે નિર્મણતા ઉત્પન્ન થાય છે તેનાથી તેના પાપકર્માનો રસ ક્ષીણ થાય છે અને પુણ્યકર્માનો અનુભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે દુઃખનો વિનાશ થઈને તેને સુખની પ્રાપ્તિ સ્વયંમેવ થાય છે. આચાર્યપ્રવર શ્રી સમન્તભદ્ર સ્વામીએ પણ એમ જ કહ્યું છે-ન પૂજયાર્થસ્ત્વયિ વીતરાગે ન નિન્દ્યા નાથ વિવાન્તવૈરે। તથાપિ તે પુણ્યગુણસ્મૃતિર્નઃ પુનાતુ ચિત્ત દુર્સિતાજ્જનેભ્યઃ ॥ અર્થાત હે ભગવન્! આપ વીતરાગ છો તેથી આપને પૂજાનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા આપ વૈરભાવ (દ્વેષ બુદ્ધિ) થી પણ રહિત છો તેથી નિન્દાનું પણ આપને કાંઈ પ્રયોજન રહ્યું નથી. છતાં પણ પૂજા આદિ દ્વારા થતું આપના પવિત્ર ગુણનું સ્મરણ અમારા ચિત્તને પાપરૂપ કાલિમાથી બચાવે છે. [સ્વયંભૂ સ્તોત્ર. ૫૭]. ૧૦.

આ રીતે જિનપૂજાષ્ક સમાપ્ત થયું. ૧૮.



૨૦. શ્રી કરુણાષ્ટક

[૨૦. કરુણાષ્ટમુ]

(આર્યા)

ત્રિભુવનગુરો જિનેશ્વર પરમાનન્દૈકકારણ કૃષ્ણ ।
મયિ કિંકરેઽત્ર કરુણાં તથા યથા જાયતે મુક્તિઃ ॥૧॥

અનુવાદ : ત્રણે લોકના ગુરુ અને ઉત્કૃષ્ટ સુખના અદ્વિતીય કારણ એવા હે જિનેશ્વર! આ દાસ ઉપર એવી કૃપા કરો કે જેથી મને મુક્તિ પ્રાપ્ત થઈ જાય. ૧.

(આર્યા)

નિર્વિણ્ણો ઽહં નિતરામહન્ન બહુદુઃখયા ભવાસ્થિત્યા ।
અપુનર્ભવાય ભવહર કુરુ કરુણામત્ર મયિ દીને ॥૨॥

અનુવાદ : હે સંસારના નાશક અરહંત! હું અનેક દુઃખ ઉત્પન્ન કરનાર આ સંસારવાસનાથી અત્યંત વિરક્ત થયો છું. આપ આ દીન ઉપર એવી કૃપા કરો કે જેથી મારે ફરી જન્મ ન લેવો પડે અર્થાત્ હું મુક્ત થઈ જાઉં. ૨.

(આર્યા)

ઉદ્ધર માં પતિતમતો વિષમાદ્બવકૂપતઃ કૃપાં કૃત્વા ।
અર્હન્નલમુદ્ધરણે ત્વમસીતિ પુનઃ પુનર્વાચ્મિ ॥૩॥

અનુવાદ : હે અરહંત! આપ કૃપા કરીને આ ભયાનક સંસારરૂપ કૂવામાં પડેલા મારો તેનાથી ઉદ્ધાર કરો. આપ તેમાંથી ઉદ્ધાર કરવા માટે સમર્થ છો. તેથી હું વારંવાર આપને નિવેદન કરું છું. ૩.

(આર્યા)

ત्वं કારુણિકઃ સ્વામી ત્વમેવ શરણ જિનેશ તેનાહમ્ |
મોહરિપુદલિતમાનઃ પૂત્કારં તવ પુરઃ કુર્વે ॥૪॥

અનુવાદ : હે જિનેશ! તમે જ દ્યાળુ છો, તમે જ પ્રભુ છો, અને તમે જ રક્ષક છો. તેથી મોહરુપ શત્રુદ્વારા જેનું માનમર્દન કરવામાં આવ્યું છે એવો હું આપની પાસે પોકારીને કહું છું. ૪.

(આર્યા)

ગ્રામપતેરપિ કરુણા પરેણ કેનાષુપદ્ગુતે પુંસિ ।
જગતાં પ્રભોર્ન કિં તવ જિન મયિ ખલકર્મભિઃ પ્રહતે ॥૫॥

અનુવાદ : હે જિન! જે એક ગામના સ્વામી હોય છે તે પણ કોઈ બીજા દ્વારા પીડિત મનુષ્ય ઉપર દ્યા કરે છે. તો પછી જો આપ ત્રણે ય લોકના સ્વામી છો તો શું દુષ્ટ કર્મો દ્વારા પીડિત મારા ઉપર દ્યા નહિ કરો? અર્થાત् અવશ્ય કરશો. ૫.

(આર્યા)

અપહર મમ જન્મ દયાં કૃત્વેત્યેકત્ત્ર વચસિ વક્તવ્યે ।
તેનાતિદાધ ઇતિ મે દેવ બભૂવ પ્રલાપિત્વમ् ॥૬॥

અનુવાદ : હે દેવ! આપ કૃપા કરીને મારા જન્મ (જન્મ-મરણરૂપ સંસાર)નો નાશ કરો, એ જ એક વાત મારે આપને કહેવાની છે. પરંતુ હું તો જન્મથી અતિશય બળેલો છું અર્થાત् પીડિત છું તેથી હું ધર્મો બકવાઈ બન્યો છું. ૬.

(આર્યા)

તવ જિનચરણાબ્જયુગં કરુણામૃતસંગશીતલં યાવત્ ।
સંસારાતપત્પઃ કરોમિ હદિ તાવદેવ સુખી ॥૭॥

અનુવાદ : હે જિન! સંસારરૂપ તડકાથી સંતાપ પામેલો હું જ્યાંસુધી દ્યારૂપ અમૃતની સંગતિથી શીતળતા પામેલા તમારા બન્ને ચરણકમળોને હદ્યમાં ધારણ કરું છું ત્યાંસુધી જ સુખી રહું છું. ૭.

(આર્યા)

જગદેકશરણ ભગવત્તસમશ્રીપદ્મનાન્દિતગુણૌઘ ।
કિં બહુના કુરુ કરુણામ् અત્ર જને શરણમાપત્રે ॥૮॥

અનુવાદ : જગતના પ્રાણીઓના અદ્વિતીય રક્ષક તથા અસાધારણ લક્ષ્મી સંપન્ન અને મુનિ પદ્મનંદી દ્વારા સ્તુતિ કરાયેલ ગુણસમૂહ સહિત એવા હે ભગવન્! હું વધારે શું કહું? શરણે આવેલા આ જન (મારા) ઉપર આપ દયા કરો. ૮.

આ રીતે કરુણાષ્ટક સમાપ્ત થયું. ૨૦.

દુર્ગા મિલન.

૨૧. ક્રિયાકાણ્ડચૂલિકા

[૨૧. ક્રિયાકાણ્ડચૂલિકા]

(શાર્દૂલવિક્રીડિત)

સમ્પર્દર્શનબોધવૃત્તસમતાશીલક્ષમાદૈઘનૈ:
સંકેતાશ્રયવળ્ણિનેશ્વર ભવાનું સર્વેર્ગુણોરાશ્રિતઃ ।
મન્યે ત્વયવકાશલબ્ધિરહિતૈઃ સર્વત્ર લોકે વયં
સંગ્રહ્યા ઇતિ ગવિતૈઃ પરિહૃતો દોષૈરશેષૈરપિ ॥૧॥

અનુવાદ : હે જિનેશ્વર! સમ્પર્દર્શન, સમ્પર્જણાન, સમ્પ્રક્ષારિત્ર, સમતા, શીલ અને ક્ષમા આદિ સર્વ ગુણોએ જે સંકેતગૃહ સમાન આપનો સધનરૂપે આશ્રય કર્યો છે; તેથી મને એમ લાગે છે આપનામાં સ્થાન પ્રાપ્ત ન થવાથી ‘લોકમાં અમે સર્વત્ર સંગ્રહ કરવાને યોગ્ય છીએ’ એ જાતનું અભિમાન પામીને જ જાણો કે બધા દોષોએ આપને છોડી દીધા છે.

વિશેષાર્થ : જિન ભગવાનમાં સમ્પર્દર્શન, આદિ બધા ઉત્તમોત્તમ ગુણો હોય છે. પરંતુ દોષ તેમનામાં એક પણ હોતો નથી. તેથી ગ્રન્થકારે અહીં આ ઉત્પ્રેક્ષા કરી છે કે તેમની અંદર એટલા બધા ગુણો પ્રવેશી ચુક્યા હતા કે દોષોને માટે ત્યાં સ્થાન જ રહ્યું નહોતું. તેથી જાણો તેમનાથી તિરસ્કૃત થવાને કારણે દોષોને એ અભિમાન જ ઉત્પન્ન થયું હતું કે લોકમાં અમારો સંગ્રહ તો બધા જ કરવા ઈચ્છે છે તો પછી જો આ જિન અમારી ઉપેક્ષા કરે છે તો અમે એમની પાસે કદી પણ નહિ જઈએ. આ અભિમાનને કારણે જ તે દોષોએ જિનેન્દ્રદેવને છોડી દીધા હતા. ૧.

(વસંતતિલકા)

યસ્ત્વામનન્તગુણમેકવિભું ત્રિલોક્યા:
સ્તૌતિ પ્રભૂતકવિતાગુણગર્વિતાત્મા ।

આરોહતિ દુમશિરઃ સ નરો નભો ઽન્ત
ગન્તું જિનેન્દ્ર મતિવિભ્રમતો બુધો ઽપિ ॥૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર! કવિતા કરવા યોગ્ય અનેક ગુણો હોવાથી અભિમાન પામેલો જે મનુષ્ય અનંત ગુણો સહિત અને ત્રણે લોકના અદ્વિતીય પ્રભુસ્વરૂપ તમારી સ્તુતિ કરે છે તે વિદ્વાન હોવા છતાં પણ જાણો બુદ્ધિની વિપરીતતાથી (મૂર્ખતાથી) આકાશનો અંત પામવા માટે વૃક્ષના શિખર ઉપર જ ચડે છે.

વિશેષાર્થ : જેમ અનંત આકાશનો અંત પામવો અસંભવ છે તેવી જ રીતે ત્રિલોકીનાથ (જિનેન્દ્ર)ના અનંત ગુણોનો પણ સ્તુતિ દ્વારા અંત પામવો અસંભવ જ છે. છતાં પણ જે વિદ્વાન કવિ સ્તુતિ દ્વારા તેમના અનંત ગુણોનું કીર્તન કરવા ઈચ્છે છે, તો એમ સમજવું જોઈએ કે તે પોતાના કવિત્વ ગુણના અભિમાનથી જ તેમ કરવાને ઉદ્યત થયો છે. ૨.

(વસંતતિલકા)

શવનોતિ કર્તુમિહ કઃ સ્તવનં સમસ્ત-

વિદ્યાધિપસ્ય ભવતો વિબુધાર્ચિતાઙ્ગ્રેઃ ।

તત્ત્રાપિ તચ્છિનપતે કુરુતે જનો યત્તુ

તચ્છિત્તમધ્યગતભક્તિનિવેદનાય ॥૩॥

અનુવાદ : જે સમસ્ત વિદ્યાઓના સ્વામી છે તથા જેમના ચરણ દેવો દ્વારા પૂજવામાં આવ્યા છે એવા આપની સ્તુતિ કરવા માટે અહીં કોણ સમર્થ છે? અર્થાત્ કોઈપણ સમર્થ નથી. છતાં પણ હે જિનેન્દ્ર! જે મનુષ્ય આપની સ્તુતિ કરે છે તે પોતાના ચિત્તમાં રહેતી ભક્તિ પ્રગટ કરવા માટે જ કરે છે. ૩.

(વસંતતિલકા)

નામાપિ દેવ ભવતઃ સ્તુતિગોચરત્વં

વાગ્ગોચરત્વમથ યેન સુભક્તિભાજા ।

નીતં લભેત સ નરો નિખિલાર્થસિદ્ધિं

સાધ્વી સ્તુતિર્ભવતુ માં કિલ કાત્ર ચિન્તા ॥૪॥

અનુવાદ : હે દેવ! જે મનુષ્ય અતિશય ભક્તિપુક્ત થઈને આપના નામને

અધિકાર-૨૧ : કિયાકાંડચૂલિકા]

૩૪૫

પણ સમૃતિનો વિષય અથવા વચનનો વિષય બનાવે છે-મનથી આપના નામનું ચિન્તન તથા વચનથી કેવળ તેનું ઉચ્ચારણ જ કરે છે-તેના સર્વ પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય છે. એવી હાલતમાં મારે શી ચિન્તા છે? અર્થાત્ કંઈ પણ નથી. તે ઉત્તમ સ્તુતિ જ પ્રયોજન સિદ્ધ કરનારી થાવ. ૪.

(વસંતતિલકા)

એતાવતૈવ મમ પૂર્યત એવ દેવ
સેવાં કરોમિ ભવતશ્રારણદ્વયસ્ય ।
અત્રૈવ જન્મનિ પરત્ર ચ સર્વકાલં
ન ત્વામિતઃ પરમહં જિન યાચયામિ ॥૫॥

અનુવાદ : હે દેવ! હું આ જન્મમાં તથા બીજા જન્મમાં પણ નિરંતર આપના ચરણયુગલની સેવા કરતો રહ્યું, એટલા માત્રથી જ મારું પ્રયોજન પૂર્ણ થઈ જાય છે. હે જિનેન્દ્ર! એથી અધિક હું આપની પાસે બીજું કંઈ માગતો નથી. ૫.

(વસંતતિલકા)

સર્વાગમાવગમતઃ ખલુ તત્ત્વબોધો
મોક્ષાય વૃત્તમાપિ સંપ્રતિ દુર્ઘટં નઃ ।
જાય્યાત્તથા કુતનુતસ્ત્વયિ ભક્તિરેવ
દેવાસ્તિ સૈવ ભવતુ ક્રમતસ્તદર્થમ् ॥૬॥

અનુવાદ : હે દેવ! મુક્તિના કારણભૂત જે તત્ત્વજ્ઞાન છે તે નિશ્ચયથી સમસ્ત આગમો જાણી લેવાથી પ્રાપ્ત થાય છે અને તે અમે જડબુદ્ધિ હોવાથી અમારે માટે દુર્ભાગ્ય જ છે. એ જ રીતે તે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તે પણ શરીરની દુર્ભાગ્યતાથી આ વખતે અમને પ્રાપ્ત થઈ શકતું નથી એ કારણે આપના વિષયમાં જે મારી ભક્તિ છે તે જ ક્રમશઃ મને મુક્તિનું કારણ થાવ. ૬.

(માલિની)

હરતિ હરતુ વૃદ્ધં વાર્ધકં કાયકાન્તિં
દધતિ દધતુ દૂરં મન્દતામિન્દ્રિયાળિ ।

ભવતિ ભવતુ દુઃખં જાયતાં વા વિનાશः
પરમિહ જિનનાથે ભક્તિરેકા મમાસ્તુ ॥૭॥

આનુવાદ : વૃદ્ધિને પ્રાપ્ત થયેલ વૃદ્ધાવસ્થા જો શરીરની કાંતિ નષ્ટ કરે છે તો કરો, જો ઈન્દ્રિયો અત્યંત શિથિલતા ધારણ કરે છે તો કરો, જો દુઃખ થાય છે તો થાવ તથા જો વિનાશ થાય છે તો પણ ભલે થાય. પરંતુ અહીં મારી એક માત્ર જિનેન્દ્રના વિષયમાં ભક્તિ બની રહો. ૭.

(વસંતતિલકા)

અસ્તુ ત્રયં મમ સુદર્શનબોધવૃત્ત-
સંબન્ધિ યાન્તુ ચ સમસ્તદુરીહિતાનિ ।
યાચે ન કિંचિદપરં ભગવન् ભવત્તં
નાપ્રાપ્તમસ્તિ કિમપીહ યતસ્ત્રિલોક્યામ् ॥૮॥

આનુવાદ : હે ભગવાન्! મને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સંબંધી ત્રણ અર્થાત્ રત્નત્રય પ્રાપ્ત થાવ. તથા મારી સમસ્ત દુશ્શેષાઓ નષ્ટ થઈ જાવ, એથી અધિક હું આપની પાસે બીજું કાંઈ નથી માગતો; કારણ કે ત્રણે લોકમાં હજુ સુધી જે પ્રાપ્ત ન થયું હોય એવું અન્ય કાંઈ પણ નથી.

વિશેષાર્થ : અહીં જિનેન્દ્ર ભગવાન પાસે કેવળ એક એ જ યાચના કરવામાં આવી છે કે આપની કૃપાથી મારી દુષ્ટ વૃત્તિ નષ્ટ થઈને મને રત્નત્રયની પ્રાપ્તિ થાવ, એ સિવાય બીજી કોઈ પણ યાચના કરવામાં આવી નથી. એનું કારણ એ આપવામાં આવ્યું છે કે અનંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએ ઈન્દ્ર અને ચક્રવર્તી આદિના પદ તો અનેક વાર પ્રાપ્ત કરી લીધાં, પરંતુ રત્નત્રયની પ્રાપ્તિ તેને હજુ સુધી કદી થઈ નથી. તેથી તે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલા રત્નત્રયની જ અહીં યાચના કરવામાં આવી છે. નીતિકાર પણ એ જ કહે કે લોકો ‘હાભિનવપ્રિયઃ’ અર્થાત્ જનસમૂહ નવી નવી વસ્તુ પ્રત્યે જ અનુરાગ કર્યા કરે છે. ૮.

(વસંતતિલકા)

ધન્યો ઽસ્મિ પુણ્યનિલયો ઽસ્મિ નિરાકુલો ઽસ્મિ
શાન્તો ઽસ્મિ નષ્ટવિપદસ્મિ વિદસ્મિ દેવ ।

શ્રીમજ્જિનેન્દ્ર ભવતો ઽદ્ધિધ્રયું શરણ્ય
પ્રાપ્તો ઽસ્મિ ચેદહમતીન્દ્રિયસૌખ્યકારિ ॥૧॥

અનુવાદ : હે શ્રીમદ્ જિનેન્દ્રદેવ! હું અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) કરનાર, આપના ચરણયુગલનું શરણ પ્રાપ્ત કરી ચૂક્યો છું; માટે હું ધન્ય છું, પુણ્યનું સ્થાન છું, આકુળતા રહિત છું, શાન્ત છું, વિપત્તિઓ રહિત છું અને શાતા પણ છું. ૮.

(વસંતતિલકા)

રત્નત્રયે તપસિ પદ્ગ્રિક્તવિધે ચ ધર્મે
મૂલોત્તરેષુ ચ ગુણેષ્ઠ ગુણિકાર્યે ।
દર્પાત્રમાદત ઉતાગસિ મે પ્રવૃત્તે
મિથ્યાસ્તુ નાથ જિનદેવ તવ પ્રસાદાત् ॥૧૦॥

અનુવાદ : હે નાથ! હે જિનદેવ! રત્નત્રય, તપ, દસ પ્રકારના ધર્મ, મૂળગુણ, ઉત્તરગુણ અને ગુણિતૃપ કાર્ય; આ બધાના વિષયમાં અભિમાનથી અથવા પ્રમાદથી મારી સદોષ પ્રવૃત્તિ થઈ હોય તે આપના પ્રસાદથી મિથ્યા થાવ. ૧૦.

(ઉપેન્દ્રવજ્રા)

મનોવચો ઽઙ્ગૈ: કૃતમઙ્ગિપીડનં
પ્રમોદિતં કારિતમત્ત્ર યન્મયા ।
પ્રમાદતો દર્પત એતદાશ્રયં
તઽસ્તુ મિથ્યા જિન દુષ્કૃતં મમ ॥૧૧॥

અનુવાદ : હે જિન! પ્રમાદથી અથવા અભિમાનથી જે મેં અહીં મન, વચન અને શરીરથી પ્રાણીઓનું પીડન સ્વયં કર્યું હોય, બીજાઓ પાસે કરાવ્યું હોય અથવા પ્રાણીને પીડા ઉપજાવતા જીવને જોઈને હર્ષ પ્રગટ કર્યો હોય; તેના આશ્રયે થનાર મારું તે પાપ મિથ્યા થાવ. ૧૧.

(શાર્દૂલવિક્રીડિત)

ચિન્તાદુષ્પરિણામસંતતિવશાદુન્માર્ગગાયા ગિર:
કાયાત્સંવૃતિવર્જિતાદનુચિતં કર્માર્જિતં યન્મયા ।

તત્ત્વાશં બ્રજતુ પ્રભો જિનપતે તૃત્યાદપદ્બસ્મતે-
રેષા મોક્ષફળપ્રદા કિલ કર્થ નાસ્મિન્ સમર્થા ભવેતુ ॥૧૨॥

અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! ચિન્તાને કારણે ઉત્પન્ન થયેલ અશુભ પરિણામોને વશ થઈને અર્થાત્ મનની દુષ્ટ વૃત્તિથી, કુમાર્ગમાં પ્રવૃત્ત થયેલી વાણી અર્થાત્ સાવધ વચન દ્વારા તથા સંવર રહિત શરીર દ્વારા જે મેં અનુચિત (પાપ) કર્મ ઉત્પન્ન કર્યું છે તે તમારા ચરણ-કુમળના સ્મરણથી નાશ પાંચો. બરાબર પણ છે જે તમારા ચરણ-કુમળનું સ્મરણ મોક્ષરૂપ ફળ આપે છે તે આ (પાપવિનાશ) કાર્યમાં કેમ સમર્થ ન થાય? અવશ્ય થશે. ૧૨.

(વસંતતિલકા)

વાણી પ્રમાણમિહ સર્વવિદસ્ત્રિલોકી-
સદ્ગ્નયસૌ પ્રવરદીપશિખાસમાના ।
સ્યાદ્વાદકાન્તિકલિતા નૃસુરાહિવન્દ્યા
કાલત્રયે પ્રકટિતાખિલવસ્તુતત્વા ॥૧૩॥

અનુવાદ : જે સર્વજની વાણી (જિનવાણી) ત્રણ લોકરૂપ ઘરમાં ઉત્તમ દીપકની શિખા સમાન થઈને સ્યાદ્વાદરૂપ પ્રભા સહિત છે; મનુષ્ય, દેવ અને નાગકુમારોથી વંદનીય છે; તથા ત્રણે કાળની વસ્તુઓના સ્વરૂપને પ્રગટ કરનારી છે; તે અહીં પ્રમાણ (સત્ય) છે.

વિશેષાર્થ : અહીં જિનવાણીને દીપશિખા સમાન બતાવીને તેના કરતાં પણ તેમાં કંઈક વિશેષતા પ્રગટ કરવામાં આવી છે. જેમ કે-દીપશિખા ઘરની અંદરની જ વસ્તુઓને પ્રકાશિત કરે છે પણ જિનવાણી ત્રણે લોકની અંદરની બધી જ વસ્તુઓને પ્રકાશિત કરે છે. દીપક જો પ્રભાસહિત હોય છે તો તે વાણી પણ અનેકાન્તરૂપ પ્રભાસહિત છે; દીપશિખાને જો કેટલાક મનુષ્યો જ વંદન કરે છે તો જિનવાણીને મનુષ્યો, દેવો અને અસુરો પણ વંદન કરે છે; તથા દીપશિખા જો વર્તમાનની કેટલીક જ વસ્તુઓને પ્રગટ કરે છે તો તે જિનવાણી ત્રણેય કાળની સમસ્ત વસ્તુઓને પ્રગટ કરે છે. આ રીતે દીપશિખા સમાન હોવા છતાં પણ તે જિનવાણીનું સ્વરૂપ અપૂર્વ જ છે. ૧૩.

(પણ્ણી)

ક્ષમસ્વ મમ વાણિ તજ્જિનપતિશ્રુતાદિસ્તુતૌ
યદૂનમભવન્મનોવચનકાયવૈકલ્યતઃ ।

અનેકભવસંભવૈર્જડિમકારણૈ: કર્મભિ:
કુતોઽત્ર કિલ માટશે જનનિ તાદ્શં પાટવમ् ॥૧૪॥

અનુવાદ : હે વાણી! જિનેન્દ્ર અને સરસ્વતી આદિની સુતિના વિષયમાં મન, વચન અને શરીરની વિકળતાના કારણે જે કંઈ ખામી રહી હોય તેને હે માતા! તું ક્ષમા કર. કારણ એ છે કે અનેક ભવોમાં ઉપાર્જિત અને અજ્ઞાન ઉત્પન્ન કરનાર કર્માનો ઉદ્ય રહેવાથી મારા જેવા મનુષ્યમાં તેવી નિપુણતા ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૧૪.

(અનુષ્ઠભ)

પલ્લવો ઽયં ક્રિયાકાણ્ડકલ્પશાખાગ્રસંગતઃ ।
જીયાદશેષભવ્યાનાં પ્રાર્થિતાર્થફલપ્રદઃ ॥૧૫॥

અનુવાદ : સમસ્ત ભવ્ય જીવોને ઈષ ફળ આપનાર આ કિયાકંડરૂપ કલ્પવૃક્ષની શાખાના અગ્રભાગે લાગેલ નવીન પત્ર જ્યવંત હો. ૧૫.

(ભુજાગયાલપ્રયાલ)

ક્રિયાકાણ્ડસંબન્ધિની ચૂલિકેયં
નરો: પદ્યતે યૈસ્ત્રિસંધ્યં ચ તેષામુ ।
વુપુર્ભારતીચિત્તવैકલ્પ્યતો યા
ન પૂર્ણા ક્રિયા સાપિ પૂર્ણત્વમેતિ ॥૧૬॥

અનુવાદ : જે મનુષ્ય કિયાકંડ સંબંધી આ ચૂલિકા ત્રણે સંધ્યાકાળે ભણે છે તેમની શરીર, વાણી અને મનની વિકળતાને કારણે જે કિયા પૂર્ણ ન થઈ હોય તે પણ પૂર્ણ થઈ જાય છે. ૧૬.

(પૃષ્ઠી)

જિનેશ્વર નમો ઽસ્તુ તે ત્રિભુવનૈકચૂડામણે
ગતો ઽસ્મિ શરણ વિભો ભવભિયા ભવત્તં પ્રતિ ।
તદાહતિકૃતે બુધૈરકથિ તત્ત્વમતન્મયા-
શ્રિતં સુદૃઢેતસા ભવહરસ્ત્વમેવાત્ર યત્ર ॥૧૭॥

અનુવાદ : હે જિનેશ્વર! હે ત્રણ લોકના ચૂડામણિ વિભો! તમને નમસ્કાર હો. હું સંસારના ભયથી આપના શરણો આવ્યો છું. વિદ્વાનોએ તે સંસારનો નાશ કરવા માટે આ જ તત્ત્વ બતાવ્યું છે, તેથી મેં દૃઢચિત્ત કરીને આનું જ આલંબન લીધું છે કારણ એ છે કે અહીં સંસારનો નાશ કરનાર તમે જ છો. ૧૭.

(વસંતતિલકા)

અર્હન્દ સમાશ્રિતસમસ્તનરામરાદિ-
ભવ્યાબ્જનન્દિવચનાંશુરવેસ્તવાગ્રે ।
મૌખ્યમેતદબુધેન મયા કૃતં યત્ર-
તદ્ભૂરભક્તિરભસારથિતમાનસેન ॥૧૮॥

અનુવાદ : હે અરહંત! જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સમસ્ત કમળોને પ્રઝુલ્લિત કરે છે તેવી જ રીતે આપ પણ સભા (સમવસરણ) માં આવેલ સમસ્ત મનુષ્ય અને દેવ આદિ ભવ્ય જીવો રૂપ કમળોને પોતાના વચનરૂપ કિરણો દ્વારા પ્રઝુલ્લિત કરો છો. આપની આગળ જે વિદ્વતા વિનાના મેં આ વાચાળતા (સુતિ) કરી છે તે કેવળ આપની મહાન ભક્તિના વેગમાં મન સ્થિત હોવાથી અર્થાત્ મનમાં અતિશય ભક્તિ હોવાથી જ કરી છે. ૧૮.

આ રીતે કિયાકંડચૂલિકા સમાપ્ત થઈ. ૨૧.



૨૨. એકત્વભાવનાદશક

[૨૨. એકત્વભાવનાદશકમ्]

(અનુષ્ટુભ्)

સ્વાનુભૂત્યૈવ યદ્રમ્યં રમ્યં યદ્યાત્મવેદિનામ् ।
જલ્યે તત્પરમં જ્યોતિરવાડ્યમાનસગોচરમ् ॥૧॥

અનુવાદ : જે પરમ જ્યોતિ કેવળ સ્વાનુભવથી જ ગમ્ય (પ્રાપ્ત કરવા યોગ્ય) તથા આત્મજ્ઞાનીઓને રમણીય છે તે વચ્ચન અને મનના અવિષ્યભૂત પરમ (ઉત્કૃષ્ટ) જ્યોતિના વિષયમાં હું કાંઈક કહું છું . ૧.

(અનુષ્ટુભ्)

એકત્વૈકપદપ્રાપ્તમાત્મતત્ત્વમવैતિ યઃ ।
આરાધ્યતે સ એવાન્યેસ્તસ્યારાધ્યો ન વિદ્યતે ॥૨॥

અનુવાદ : જે ભવ્ય જીવ એકત્વ (અદ્વૈત) રૂપ અદ્વિતીયપદને પામેલ આત્મતત્ત્વને જાણો છે તે પોતે જ બીજાઓ દ્વારા આરાધાય છે અર્થાત् બીજા પ્રાણી તેની જ આરાધના કરે છે, તેના આરાધ્ય (પૂજનીય) બીજું કોઈ રહેતું નથી. ૨.

(અનુષ્ટુભ्)

એકત્વજ્ઞો બહુભ્યો ઽપિ કર્મભ્યો ન બિભેતિ સः ।
યોગી સુનૌગતો ઽમ્ભોધિજલેભ્ય ઇવ ધીરધીઃ ॥૩॥

અનુવાદ : જેમ ઉત્કૃષ્ટ નાવને પ્રાપ્ત થયેલ ધીરભુદ્ધિ (સાહસી) મનુષ્ય સમુક્રના અપરિમિત જળથી ડરતો નથી તેવી જ રીતે એકત્વનો જાણકાર તે યોગી ઘણા કર્મોથી પણ ડરતો નથી. ૩.

(અનુષ્ઠાનિક)

ચैતન્યૈકત્વસંવિત્તિરૂલભા સૈવ મોક્ષદા ।
લભા કર્થ કર્થંચિદ્ધેચિન્તનીયા મુહુર્મુહુ: ॥૪॥

અનુવાદ : ચैતન્યરૂપ એકત્વનું જ્ઞાન દુર્લભ છે, પરંતુ મોક્ષ આપનાર તે જ છે. જો તે કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થઈ જાય તો તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ. ૪.

(અનુષ્ઠાનિક)

મોક્ષ એવ સુખં સાક્ષાત્તચ્ચ સાધ્યં મુમુક્ષુભિઃ ।
સંસારે ઽત્ર તુ તત્ત્વાસ્તિ યદસ્તિ ખલુ તત્ત્વ તત્ત્વ ॥૫॥

અનુવાદ : વાસ્તવિક સુખ મોક્ષમાં છે અને તે મુમુક્ષુજનો દ્વારા સિદ્ધ કરવા યોગ્ય છે. અહીં સંસારમાં તે સુખ નથી. અહીં જે સુખ છે તે નિશ્ચયથી યથાર્થ સુખ નથી. ૫.

(અનુષ્ઠાનિક)

કિંचિત્સંસારસંબન્ધિ બન્ધુરં નેતિ નિશ્ચયાત્ર ।
ગુરુપદેશતો ઽસ્માકં નિઃશ્રેયસપદં પ્રિયમ् ॥૬॥

અનુવાદ : સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ રમણીય નથી, આ જાતનો અમને ગુરુના ઉપદેશથી નિશ્ચય થઈ ગયો છે. એ જ કારણે અમને મોક્ષપદ ઘારું છે. ૬.

(અનુષ્ઠાનિક)

મોહોદ્યવિષાક્રાન્તમાપિ સ્વર્ગસુખં ચલમ् ।
કા કથાપરસૌખ્યાનામલં ભવસુખેન મે ॥૭॥

અનુવાદ : મોહના ઉદ્યરૂપ વિષથી મિશ્રિત સ્વર્ગનું સુખ પણ જો નશ્વર હોય તો ભલા બીજા તુચ્છ સુખોના સંબંધોમાં શું કહેવું? અર્થાત્ તે તો અત્યંત વિનશ્વર અને હેય છે જ. તેથી મને એવા સંસારસુખથી બસ થાવ-હું એવું સંસારસુખ ચાહતો નથી. ૭.

(અનુષ્ઠાનિક)

લક્ષ્યીકૃત્ય સદાત્માનં શુદ્ધબોધમયં મુનિઃ ।
આસ્તે યઃ સુમતિશાત્ર સો ઽપ્યમુત્ર ચરન્નપિ ॥૮॥

અનુવાદ : જે નિર્મળ બુદ્ધિ ધારણ કરનાર મુનિ આ લોકમાં નિરંતર શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનું લક્ષ્ય રાખીને રહે છે તે પરલોકમાં સંચાર કરવા છતાં પણ તે જ રીતે રહે છે. ૮.

(અનુષ્ટુભ्)

વીતરાગપથે સ્વસ્થઃ પ્રસ્થિતો મુનિપુઙ્ગ્રવઃ ।
તસ્ય મુક્તિસુખપ્રાપ્તે: ક: પ્રત્યુહો જગત્ત્રયે ॥૧॥

અનુવાદ : જે શ્રેષ્ઠ મુનિ આત્મલીન થઈને વીતરાગમાર્ગ અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરી રહ્યો છે તેને મોક્ષસુખની પ્રાપ્તિમાં ત્રણે લોકમાં કોઈ પણ વિધ ઉપસ્થિત થઈ શકતું નથી. ૯.

(અનુષ્ટુભ्)

ઇત્યેકાગ્રમના નિત્યં ભાવયન્ ભાવનાપદમ્ ।
મોક્ષલક્ષ્મીકટાક્ષાલિમાલાસંગ સ જાયતે ॥૧૦॥

અનુવાદ : આ રીતે એકાગ્રમન થઈને જે મુનિ સર્વદા આ ભાવનાપદ (એકત્વ ભાવના) ને ભાવે છે તે મુક્તિરૂપ લક્ષ્મીની કટાક્ષ પંક્તિઓની માળાનું સ્થાન બની જાય છે, અર્થાત્ તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ૧૦.

(અનુષ્ટુભ्)

એતજ્ઞન્મફલં ધર્મઃ સ ચેદસ્તિ મમામલઃ ।
આપદ્યાપિ કૃતશ્ચિત્તા મૃત્યોરાપિ કુતો ભયમ્ ॥૧૧॥

અનુવાદ : આ મનુષ્ય જન્મનું ફળ ધર્મની પ્રાપ્તિ છે. તે નિર્મળ ધર્મ જો મારી પાસે છે તો પછી મને આપત્તિના વિષયમાં પણ શી ચિન્તા છે તથા મૃત્યુથી પણ શો ડર છે? અર્થાત્ તે ધર્મ હોતાં ન તો આપત્તિની ચિન્તા રહે છે અને ન મરણનો ડર પણ રહે છે. ૧૧.

આ રીતે એકત્વભાવના દશક અધિકાર સમાપ્ત થયો. ૨૨.



૩૪૪

૨૩. પરમાર્થવિંશતિ

[૨૩. પરમાર્થવિંશતિ :]

(શાર્ડૂલવિક્રીડિત)

મોહદેષરતિશ્રિતા વિકૃતયો દૃષ્ટાઃ શ્રુતાઃ સેવિતાઃ
વારંવારમનન્તકાલવિચરત્સર્વાઙ્ગિભિઃ સંસ્તૂતૌ ।
અદ્વૈતં પુનરાત્મનો ભગવતો દુર્લક્ષ્યમેકં પરં
વીજં મોક્ષતરોરિદં વિજયતે ભવ્યાત્મભિર્વન્દિતમ् ॥૧॥

અનુવાદ : સંસારમાં અનંતકાળથી વિચરણ કરતાં સર્વ પ્રાણીઓએ મોહ,
દ્વેષ અને રાગના નિમિત્તે થતાં વિકારો વારંવાર જોયા છે, સાંભળ્યા છે અને
સેવ્યા પણ છે. પરંતુ ભગવાન આત્માનું એક અદ્વૈત જ કેવળ દુર્લક્ષ્ય છે અર્થાતુ
તેને હજુ સુધી જોયો નથી, સાંભળ્યો નથી અને સેવન પણ કર્યું નથી. ભવ્ય
જીવોથી વંદિત મોક્ષરૂપ વૃક્ષના બીજભૂત આ અદ્વૈત જ્યવંત હો. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

અન્તર્વાહ્યાવિકલ્પજાલરહિતાં શુદ્ધૈકચિદૂપણીં
વન્દે તાં પરમાત્મનઃ પ્રણયિનીં કૃત્યાન્તગાં સ્વસ્થતામ્ ।
યત્રાનન્તચતુષ્યામૃતસરિત્યાત્માનમન્તર્ગતં
ન પ્રાગ્રોતિ જરાદિદુઃસહશિખો જન્મોગ્રદાવાનલઃ ॥૨॥

અનુવાદ : જે સ્વસ્થતા અંતરંગ અને બાહ્ય વિકલ્પોના સમૂહ રહિત છે,
શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ સહિત છે, પરમાત્માની વલ્લભા (પ્રિયતમા) છે, કૃત્ય

અધિકાર-૨૩ : પરમાર્થવિશિષ્ટિ]

૩૫૫

(કાર્ય) નો અંત પામી ચૂકી છે અર્થાત् કૃતકૃત્ય છે તથા અનંતયતુષ્ટયરૂપ અમૃતની નદી સમાન હોવાથી જેની અંદર પ્રાપ્ત થયેલ આત્માને જરા (વૃદ્ધત્વ) આદિરૂપ અસહ્ય જવાળાવાળી જન્મ (સંસાર) રૂપ તીક્ષ્ણ વનાંનિ પ્રાપ્ત થતી નથી; એવી તે અનંતયતુષ્ટયરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું. ૨.

(શાર્ડૂલવિક્રીડિત)

એકત્વસ્થિતયે મતિર્યદનિંશં સંજાયતે મે તયા-
યાનન્દઃ પરમાત્મસંનિધિગતઃ કિંચિત્તસમુન્મીલાતિ ।
કિંચિત્કાલમવાય સૈવ સકલैઃ શીલૈર્ગુણૈરાશ્રિતાં
તામાનન્દકલાં વિશાલવિલસદ્ભોધાં કરિષ્યત્વસૌ ॥૩॥

અનુવાદ : એકત્વ (અદ્વૈત) માં સ્થિતિ, માટે જે મારી નિરંતર બુદ્ધિ થાય છે તેના નિમિત્તે પરમાત્માની સમીપતાને પ્રાપ્ત થયેલ આનંદ થોડો એક પ્રગટ થાય છે. તે જ બુદ્ધિ થોડો કાળ પામીને અર્થાત् થોડા જ સમયમાં સમસ્ત શીલ અને ગુણોના આધારભૂત અને પ્રગટ થયેલ વિપુલ જ્ઞાન (કેવળજ્ઞાન) સંપન્ન તે આનંદની કળા ઉત્પન્ન કરશે. ૩.

(શાર્ડૂલવિક્રીડિત)

કેનાયસ્તિ ન કાર્યમાશ્રિતવતા મિત્રેણ ચાચ્યેન વા
પ્રેમાઙ્ગે ઽપિ ન મેઝસ્તિ સંપ્રતિ સુખી તિષ્ઠામ્યહં કેવલઃ ।
સંયોગેન યદત્ત કષ્ટમભવત્સંસારચક્રે ચિરં
નિર્વિષ્ણઃ ખલુ તેન તેન નિતરામેકાકિતા રોચતે ॥૪॥

અનુવાદ : મારે આશ્રયમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ મિત્ર અથવા શત્રુનું પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ સુખી છું. અહીં સંસાર પરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ થયું છે તેનાથી હું વિરક્ત થયો છું તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત રૂચે છે. ૪.

(શાર્દૂલવિક્રીડિત)

યો જાનાતિ સ એવ પશ્યતિ સદા ચિદૂપતાં ન ત્યજેતુ
સો ઽહં નાપરમસ્તિ કિંચિદપિ મે તત્ત્વં સદેતત્પરમ્ |
યચ્ચાન્યત્તદશેષમન્યજનિતં ક્રોધાદિ કાયાદિ વા
શ્રુત્વા શાસ્ત્રશતાનિ સંપ્રતિ મનસ્યેતચ્છુતં વર્તતે ॥૫॥

અનુવાદ : જે જાણો છે તે જ દેખે છે અને તે નિરંતર યૈતન્યસ્વરૂપને છોડતો નથી. તે જ હું છું, અનાથી ભિન્ન બીજું મારું કોઈ સ્વરૂપ નથી. આ સમીયીન ઉત્કૃષ્ટ તત્ત્વ છે. યૈતન્યસ્વરૂપથી ભિન્ન જે કોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેકંડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૫.

(શાર્દૂલવિક્રીડિત)

હીનं સંહનનં પરીષહસહં નાભૂદિં સાંપ્રતં
કાલે દુઃખ[ષ]મસંજ્ઞકે ઽત્ર યદપિ પ્રાયો ન તીવ્રં તપઃ ।
કશ્ચિન્નાતિશયસ્તથાપિ યદસાવાર્તાં હિ દુષ્કર્મણા-
મન્તઃ શુદ્ધચિદાત્મગુપ્તમનસઃ સર્વं પરં તેન કિમ् ॥૬॥

અનુવાદ : જો કે અત્યારે આ સંહનન (હાડકાનું બંધન) પરીષહો (ક્ષુધા, તૃષ્ણા આદિ) સહન કરી શકતું નથી અને આ દુઃખમા નામના પાંચમા કાળે તીવ્ર તપ પણ સંભવિત નથી, તો પણ એ કોઈ ખેદની વાત નથી, કેમ કે એ અશુભ કર્મોની પીડા છે. અંદર શુદ્ધ યૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને તે કર્મકૃત પીડાથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નથી. ૬.

(શાર્દૂલવિક્રીડિત)

સદ્ગ્રબોધમયં વિહાય પરમાનન્દસ્વરૂપં પરં
જ્યોતિર્નાન્યદહં વિચિત્રવિલસત્કર્મેકતાયામપિ ।
કાર્ણો કૃષ્ણપદાર્થસંનિધિવશાઙ્કાતે મણૌ સ્ફાટિકે
યત્તસ્માતૃથગેવ સ દ્વયકૃતો લોકે વિકારો ભવેતુ ॥૭॥

અનુવાદ : અનેક પ્રકારના વિલાસવાળા કર્મો સાથે મારી એકતા હોવા છતાં પણ જે ઉત્કૃષ્ટ જ્યોતિ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને ઉત્કૃષ્ટ આનંદસ્વરૂપ છે તે જ હું છું, તેના સિવાય હું બીજું નથી. બરાબર પણ છે-સ્ફટિકમણિમાં કાળા પદાર્થના સંબંધથી કાળાશ ઉત્પન્ન થવા છતાં પણ તે તે મણિથી ભિન્ન જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કાંઈ વિકાર થાય છે તે બે પદાર્થોના નિભિત્તે જ થાય છે.

વિશોધાર્થ : જો કે સ્ફટિકમણિમાં કોઈ બીજા કાળા પદાર્થના નિમિત્તે કાલિમા અને જ્યાપુષ્પના સંસર્ગથી લાલિમા અવશ્ય જોવામાં આવે છે પરંતુ તે વાસ્તવિક રીતે તેની નથી હોતી તે સ્વભાવથી નિર્મળ અને શ્વેતવર્ણનો જ રહે છે. જ્યાં સુધી તેની પાસે કોઈ અન્ય રંગની વસ્તુ રહે છે ત્યાં સુધી તેમાં બીજો રંગ જોવામાં આવે છે અને તે ત્યાંથી ખસી જતાં પછી સ્ફટિકમણિમાં તે વિકૃત રંગ રહેતો નથી. બારાબર એ જ રીતે આત્માની સાથે જ્ઞાનાવરણાદિ અનેક કર્માંનો સંયોગ રહે ત્યાંસુધી જ તેમાં અજ્ઞાન અને રાગ-દ્રેષ આદિ વિકારભાવ જોવામાં આવે છે. પરંતુ તે વાસ્તવમાં તેના નથી, તે તો સ્વભાવથી શુદ્ધ જ્ઞાન-દર્શન-સ્વરૂપ જ છે. વસ્તુમાં જે વિકારભાવ થાય છે તે કોઈ બીજા પદાર્થના નિમિત્તે જ થાય છે. માટે તે તેનો કહી શકાતો નથી, કારણ કે તે થોડા જ વખત સુધી રહે છે જેમ— અજિનના સંયોગથી જળમાં રહેતી ઉષ્ણતા થોડા સમય (અજિન સંયોગ) સુધી જ રહે છે, ત્યારપછી શીતળતા જ તેમાં રહે છે, જે સદા રહેનારી છે. ૭.

(शार्दूलविक्रीडित) मैरीज.

आपत्सापि यतेः परेण सह यः संगो भवेत्केनचित्
 सापत्सुषु गरीयसी पुनरहो यः श्रीमतां संगमः ।
 यस्तु श्रीमद्मध्यपानविकलैरुतानितास्यैनृपैः
 संपर्कः स मुमुक्षुवेतसि सदा मृत्योरपि क्लेशकृत ॥८॥

અનુવાદ : સાધુને કોઈ પરવસ્તુ સાથે જે સંયોગ થાય છે તે પણ તેમને આપત્તિસ્વરૂપ લાગે છે, વળી જે શ્રીમાનો (ધનવાનો) સાથે તેમનો સમાગમ થાય છે તે તો તેમને અતિશય મહાન આપત્તિસ્વરૂપ લાગે છે. એ ઉપરાંત સંપત્તિના અભિમાનરૂપ મધ્યપાનથી વિકળ થઈને ઊંચું મુખ રાખનારા એવા રાજાઓ સાથે જે સંયોગ થાય છે તે તો તે મોક્ષાભિલાષી સાધુના મનમાં નિરંતર મૃત્યુથી પણ અધિક કષ્ટકારક હોય છે. ૮.

(શાર્દૂલવિક્રીડિત)

સ્નિગ્ધા મા મુનયો ભવન્તુ ગૃહિણો યચ્છન્તુ મા ભોજનं
મા કિંचિદ્ધનમસ્તુ મા વપુરિદં રુગ્વર્જિતં જાયતામ् ।
નગનં મામવલોક્ય નિન્દતુ જનસ્તત્રાપિ ખેદો ન મે
નિત્યાનન્દપદપ્રદં ગુરુવચો જાગર્તિ ચેચેતસિ ॥૧॥

અનુવાદ : જો મારા હૃદયમાં નિત્ય આનંદપ્રદ અર્થાતું મોક્ષપ્રદ આપનારી ગુરુની વાણી જાગે છે તો મુનિજનો સ્નેહ કરનાર ભલે ન હોય, ગૃહસ્થો જો ભોજન ન આપે તો ન આપો, મારી પાસે કાંઈ પણ ધન ન હોય, આ શરીર રોગ રહિત ન હો અર્થાતું રોગવાળું પણ હો તથા મને નગન જોઈને લોકો નિન્દા પણ કરો; તો પણ મને તેમાં જરાય ખેદ નહિ થાય. ૮.

(શાર્દૂલવિક્રીડિત)

દુઃખઘ્યાલસમાકુલે ભવવને હિંસાદિદોષદ્વારે
નિત્ય દુર્ગતિપલિપાતિકુપથે બ્રામ્યન્તિ સર્વે ઽદ્ધિનઃ ।
તન્મધ્યે સુગુરુપ્રકાશિતપથે પ્રારબ્ધયાનો જનઃ
યાત્યાનન્દકરં પરં સ્થિરતરં નિર્વાણમેકં પરમ् ॥૧૦॥

અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખરૂપ સર્પો (અથવા હાથીઓ) થી વ્યાપ્ત છે. હિંસા આદિ દોષરૂપ વૃક્ષો સહિત છે તથા નરકાદિ દુર્ગતિરૂપ ભીલ વસ્તી તરફ જતા કુમાર્ગથી યુક્ત છે, તેમાં સર્વ પ્રાણી સદા પરિભ્રમણ કરે છે. ઉક્ત સંસારરૂપી વનની અંદર જે મનુષ્ય ઉત્તમ ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગો (મોક્ષમાર્ગમાં) ગમન શરૂ કરી હે છે તે તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ આપનાર છે, ઉત્કૃષ્ટ છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) પણ છે. ૧૦.

(શાર્દૂલવિક્રીડિત)

યત્સાતં યદસાતમદ્ધિષુ ભવેત્તત્કર્મકાર્ય તત-
સ્તત્કર્મૈવ તદન્યદાત્મન ઇદં જાનન્તિ યે યોગિનઃ ।
ઇદ્વાભેદવિભાવનાશ્રિતધિયાં તેષાં કુતો ઽહં સુખી
દુઃખી ચેતિ વિકલ્પકલ્પષકલા કુર્યાત્યદં ચેતસિ ॥૧૧॥

અનુવાદ : પ્રાણીઓને જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તે કર્મ (શાતા અને અશાતા વેદનીય)નું કાર્ય છે તેથી તે કર્મ જ છે અને તે આત્માથી ભિન્ન છે આ વાત જે યોગી જાણે છે તથા જેમની બુદ્ધિ આ જાતના ભેદની ભાવનાનો આશ્રય લઈ ચૂકી છે તે યોગીઓના મનમાં ‘હું સુખી છું, અથવા હું દુઃખી છું’ આ પ્રકારના વિકલ્પથી મલિન કળા ક્યાંથી સ્થાન પ્રાપ્ત કરી શકે? અર્થાત્ તે યોગીઓના મનમાં તેવો વિકલ્પ કદ્દી ઉત્પન્ન થતો નથી. ૧૧.

(શાર્ડૂલવિક્રીદિત)

દેવं તત્પતિમાં ગુરું મુનિજનં શાસ્ત્રાદિ મન્યામહે
સર્વ ભક્તિપરા વયં વ્યવહૃતે માર્ગે સ્થિતા નિશ્ચયાત્ર ।
અસ્માકં પુનરેકતાશ્રયણતો વ્યક્તિભવચ્છિદ્ગુણ-
સ્ફારીભૂતમતિપ્રવન્ધમહસામાત્મેવ તત્ત્વં પરમ ॥૧૨॥

અનુવાદ : વ્યવહારમાર્ગમાં સ્થિત અમે ભક્તિમાં તત્પર થઈને જિનદેવ, જિનપ્રતિમા, ગુરુ, મુનિજન અને શાસ્ત્ર આદિ સર્વેને માનીએ છીએ. પરંતુ નિશ્ચયથી અભેદ (અદ્વૈત)નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્યગુણથી પ્રકાશમાં આવેલી બુદ્ધિના વિસ્તારારૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ તત્ત્વ રહે છે.

વિશેષાર્થ : જીવ જ્યાંસુધી વ્યવહારમાર્ગમાં સ્થિત રહે છે ત્યાં સુધી તે જિન ભગવાન અને તેમની પ્રતિમા આદિને પૂજ્ય માનીને યથાયોગ્ય તેમની પૂજા આદિ કરે છે. એથી તેને પુણ્યકર્મનો બંધ થાય છે જે નિશ્ચયમાર્ગની પ્રાપ્તિનું સાધન થાય છે. પછી જ્યારે તે નિશ્ચયમાર્ગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ અભેદ (અદ્વૈત)નો આશ્રય લઈ લે છે. તે એમ સમજવા લાગે છે કે સ્ત્રી, પુત્ર અને મિત્ર તથા જે શરીર નિરંતર આત્મા સાથે સંબંધવાળું રહે છે તે પણ મારું નથી; હું ચૈતન્યનો એક પિંડ છું-તેના સિવાય અન્ય કાંઈ પણ મારું નથી. આ અવસ્થામાં તેને પૂજ્ય-પૂજકભાવનું દેત પણ રહેતું નથી. કારણ એ છે કે પૂજ્ય-પૂજકભાવરૂપ બુદ્ધિ પણ રાગની પરિણતિ છે જે પૂજ્યબંધનું કારણ થાય છે. આ પુણ્યકર્મ પણ જીવને દેવેન્દ્ર અને ચક્રવર્તી આદિના પદોમાં સ્થિત કરીને સંસારમાં જ પરતંત્ર રાખે છે. માટે આ દસ્તિએ તે પૂજ્ય-પૂજકભાવ પણ હેય છે. ઉપાદેય કેવળ એક સચ્ચિદાનંદમય આત્મા જ છે. પરંતુ જ્યાંસુધી પ્રાણીને આ પ્રકારની દેખતા પ્રાપ્ત નથી થતી ત્યાંસુધી તેણે વ્યવહારમાર્ગનું આવંબન લઈને જિનપૂજનાદિ શુભ કાર્યો કરવા જ જોઈએ, નહિ તો તેનો સંસાર દીર્ઘ થઈ શકે છે. ૧૨.

(શાર્ડૂલવિક્રીડિત)

વર्ष હર્ષમપાકરોતુ તુદતુ સ્ફીતા હિમાની તનું
ઘર્મઃ શર્મહરો ઽસ્તુ દંશમશકં ક્લેશાય સંપદ્યતામ् ।
અન્યૈર્વા બહુભિઃ પરીષહભૈરારભ્યતાં મે મૃતિ-
મોક્ષં ગ્રત્યુપદેશનિશ્ચલમતેનાત્રાપિ કિંચિદ્બ્રયમ् ॥૧૩॥

અનુવાદ : જો હું મોક્ષવિષયક ઉપદેશથી બુદ્ધિની સ્થિરતા પ્રાપ્ત કરી લઉં છું તો ભલે વર્ષાકાળ મારો હર્ષ નાસ્ત કરે, વિસ્તૃત મહાન् શીત શરીરને પીડિત કરે, ધામ (સૂર્યનો તાપ) સુખનું અપહરણ કરે, ડાંસ-માચ્છર કલેશનું કારણ થાય અથવા બીજા પણ અનેક પરીષહરૂપ સુભટ મારા મરણની પણ શરૂઆત કરી દે; તો પણ એમનો મને કાંઈ પણ ભય નથી. ૧૩.

(શાર્ડૂલવિક્રીડિત)

ચક્ષુર્મુખ્યહૃષીકકર્ષકમયો ગ્રામો મૃતો મન્યતે
ચેદ્રૂપાદિકૃષિકસ્માં બલવતા બોધારિણ ત્યાજિતઃ ।
તચ્ચિન્તાં ન ચ સો ઽપિ સંપ્રતિ કરોત્યાત્મા પ્રભુઃ શક્તિમાનું
યત્કિંચિદ્બવિતાત્ર તેન ચ ભવો ઽયાલોક્યતે નષ્ટવત્ત ॥૧૪॥

અનુવાદ : જે શક્તિશાળી આત્મારૂપ પ્રભુ ચક્ષુ આદિ ઈન્દ્રિયોરૂપ કિસાનોથી નિર્મિત ગામને મરેલું સમજે છે તથા જે શાનરૂપ બળવાન શત્રુ દ્વારા રૂપાદિ વિષયરૂપ ખેતીની ભૂમિથી ભાસ્ત કરવામાં આવ્યું છે, છતાં પણ જે કાંઈ થવાનું છે તેના વિષયમાં અત્યારે ચિન્તા કરતો નથી. આ રીતે સંસારને નાસ્ત થયા સમાન હેઠે છે.

વિશેષાર્થ : જેમ કોઈ શક્તિશાળી ગામના સ્વામીની જો અન્ય પ્રબળ શત્રુ દ્વારા ખેતી યોગ્ય જમીન છીનવી લેવામાં આવે તો તે પોતાના ખેડૂતોથી પરિપૂર્ણ તે ગામને મરેલા જેવું માને છે. છતાં પણ તે ભવિતવ્યને મુખ્ય માનીને તેની કાંઈ ચિંતા કરતો નથી. બરાબર એ જ પ્રમાણે સર્વ શક્તિમાન આત્માને જ્યારે સમ્યજ્ઞાનરૂપ શત્રુ દ્વારા રૂપ-રસાદિરૂપ ખેતી યોગ્ય ભૂમિથી ભાસ્ત કરી દેવામાં આવે છે-વિવેકબુદ્ધિ ઉત્પન્ન થતાં જ્યારે તે રૂપ-રસાદિરૂપ ઈન્દ્રિયવિષયોમાં અનુરાગ રહિત થઈ જાય છે, ત્યારે તે પણ તે ઈન્દ્રિયરૂપ કિસાનોના ગામને મરેલું સમજે છે અને તેની કાંઈ પણ ચિંતા કરતો નથી. પરંતુ ત્યારે તે પોતાના સંસારને નાસ્ત

અધિકાર-૨૩ : પરમાર્थવિંશતિ]

૩૬૧

થયેલા જેવો સમજવા લાગે છે. તાત્પર્ય એ છે કે એકત્વબુદ્ધિ ઉત્પન્ન થતાં જીવને ઈન્દ્રિય વિષયોમાં અનુરાગ રહેતો નથી. તે વખતે તે ઈન્દ્રિયોને નષ્ટ થયા સમાન માનીને મુક્તિને હાથમાં આવેલી જ સમજે છે. ૧૪.

(શાર્ડૂલવિક્રીડિત)

કર્મકષત્યુપશાન્તિકારણવશાત્સદેશનાયા ગુરો-
રાત્મૈકત્વવિશુદ્ધબોધનિલયો નિઃશેષસંગોળ્જિતઃ ।
શશ્વત્તદ્રત્તભાવનાશ્રિતમના લોકે વસ્ત્ર સંયમી
નાવદ્યેન સ લિપ્યતે ઽબ્જદલવત્તોયેન પદ્માકરે ॥૧૫॥

અનુવાદ : જે સંયમી કર્મના ક્ષય અથવા ઉપશમના કારણ વશે તથા ગુરુના સદ્ગદેશથી આત્માની એકતા વિષય નિર્મળ જ્ઞાનનું સ્થાન બની ગયા છે, જેમણે સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તથા જેમણું મન નિરંતર આત્માની એકતાની ભાવનાને આશ્રિત રહે છે; તે સંયમી પુરુષ લોકમાં રહેવા છતાં પણ એ રીતે પાપથી લેપાતા નથી જેવી રીતે તળાવમાં સ્થિત ક્રમણપત્ર પાણીથી લેપાતું નથી. ૧૫.

(શાર્ડૂલવિક્રીડિત)

ગુર્વદ્ધિદ્વયદત્તમુક્તિપદવીગ્રાસ્યર્થનિર્ગન્થતા-
જાતાનન્દવશાન્મમેન્દ્રિયસુખં દુઃખં મનો મન્યતે ।
સુસ્વાદુઃ પ્રતિભાસતે કિલ ખલસ્તાવત્સમાસાદિતો
યાવત્તો સિતશર્કરાતિમધુરા સંતર્પણી લભ્યતે ॥૧૬॥

અનુવાદ : ગુરુના ચરણયુગલ દ્વારા મુક્તિ પદવી પ્રાપ્ત કરવા માટે જે નિર્ગન્થતા (દિગંબરત્વ) આપવામાં આવ્યું છે તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ આનંદના પ્રભાવથી માર્દ મન ઈન્દ્રિયવિષયજ્ઞનિત સુખને દુઃખરૂપ જ માને છે. બરાબર છે- પ્રાપ્ત થયેલો ખોળ (તેલ કાઢી લીધા પછી જે તલ આદિનો ભાગ શેષ રહે છે) ત્યાં સુધી જ સ્વાદિષ્ટ લાગે છે જ્યાંસુધી અતિશય મીઠી સફેદ સાકર (મિશ્રી) તૃપ્ત કરનાર પ્રાપ્ત થતી નથી. ૧૬.

(શાર્ડૂલવિક્રીડિત)

નિર્ગન્થત્વમુદા મમોઽવલતરધ્યાનાશ્રિતસ્ફીતયા
દુર્ઘાનાશસુખં પુનઃ સૃતિપથપ્રસ્થાયાયિ સ્યાત્કૃતઃ ।

निर्गत्योद्भूतवात् बोधितशि खिज्वालाकरालाद् गृहा-
च्छीतां प्राप्य च वापिकां विशति कस्त्रैव धीमान् नरः ॥१७॥

અનુવાદ : અતિશય નિર્મળ ધ્યાનના આશ્રયે વિસ્તાર પામેલ નિર્ગંધતા જનિત આનંદ પ્રાપ્ત થઈ જતાં ખોટા ધ્યાનથી ઈન્ડ્રિયસુખ સ્મરણનો વિષય ક્યાંથી થઈ શકે? અર્થાતું નિર્ગંધતાજન્ય સુખની સામે ઈન્ડ્રિયવિષયજન્ય સુખ તુચ્છ લાગે છે, તેથી તેની ચાહ નાચ થઈ જાય છે. બરાબર છે-ઉત્પન્ન થયેલ વાયુ દ્વારા પ્રગટ કરવામાં આવેલ અર્જિનની જીવાળાથી ભયાનક એવા ઘરની અંદરથી નીકળીને શીતળ વાવને પ્રાપ્ત કરતો કંયો બુદ્ધિમાન પુરુષ ફરીથી તે જ જલતા ઘરમાં પ્રવેશ કરે? અર્થાતું કોઈ કરતો નથી. ૧૭.

(शार्दूलविक्रीडि॒त)

जायेतोद्भूतमोहतो ऽभिलषिता मोक्षे ऽपि सा सिद्धिहृत्
 तद् भूतार्थपरिग्रहो भवति किं क्वापि स्फृहालुर्मुनिः ।
 इत्यालोचनसंगतैकमनसा शुद्धात्मसंबन्धिना
 तत्त्वज्ञानपरायणे न सततं स्थात् व्यमग्राहिणा ॥१८॥

અનુવાદ : મોહના ઉદ્યથી જે મોક્ષના વિષયમાં પણ અભિલાષા થાય છે તે સિદ્ધિ (મુક્તિ)ને નાચ કરે છે તેથી ભૂતાર્થ (સત્યાર્થ) અર્થાત્ નિશ્ચયનયને ગ્રહણ કરનાર મુનિ શું કોઈ પણ પદાર્થના વિષયમાં ઈચ્છાયુક્ત હોય છે? અર્થાત્ નથી હોતો. આ રીતે મનમાં ઉપર્યુક્ત વિચાર કરીને શુદ્ધ આત્મા સાથે સંબંધ રાખતા મુનિએ પરિગ્રહ રહીત થઈને નિરંતર તત્ત્વજ્ઞાનમાં તત્પ્રવાર રહેવું જોઈએ. ૧૮.

(शार्दूलविक्रीडि॒त)

जायन्ते विरसा रसा विघटते गोष्ठीकथाकौतुकं
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरे ऽपि च ।
मौनं च प्रतिभासते ऽपि च रहः प्रायो मुमुक्षोऽश्चितः
चिन्तायामपि यातूमिच्छति समं दोषेमनः पञ्चताम् ॥१९॥

અનુવાદ : ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતનમાં મુમુક્ષુ જનોના રસ નીરસ થઈ

જાય છે, ભેગા મળીને પરસ્પર ચાલતી કથાઓનું કુતૂહલ નાટ થઈ જાય છે, ઈન્દ્રિયવિષય વિલીન થઈ જાય છે, શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય છે, એકાંતમાં મૌન પ્રતિભાસિત થાય છે તથા તેવી દશામાં દોષોની સાથે મન પણ મરવાની ઈચ્છા કરે છે.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાંસુધી પ્રાણીનું આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય નથી હોતું ત્યાંસુધી તેને સંગીત સાંભળવામાં, નૃત્ય પરિપૂર્ણ નાટક આદિ દેખવામાં, પરસ્પર કથા-વાર્તા કરવામાં તથા શુંગારાદિપૂર્ણ નવલકથા આદિ વાંચવા-સાંભળવામાં આનંદ આવે છે. પરંતુ જેવો તેના હદ્યમાં આત્મસ્વરૂપનો બોધ ઉદ્ઘય પામે છે તેવો જ તેને ઉપર્યુક્ત ઈન્દ્રિયવિષયોના નિમિત્તે પ્રાપ્ત થતો રસ (આનંદ) નીરસ પ્રતિભાસવા લાગે છે. અન્ય ઈન્દ્રિય વિષયોની તો વાત જ શું, પરંતુ તે વખતે તેને પોતાના શરીર ઉપર પણ અનુરાગ રહેતો નથી. તે એકાંતસ્થાનમાં મૌનપૂર્વક સ્થિત થઈને આત્માનંદમાં મળન રહે છે અને આ રીતે તે અજ્ઞાનાદિ દોષો અને સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત થઈને અજર-અમર બની જાય છે. ૧૮.

(શાર્દૂલવિક્રીડિત)

તત્ત્વं વાગતિવર્તિ શુદ્ધનયતો યત્સર્વપક્ષચ્યુતં
 તદ્વાચ્યં વ્યવહારમાર્ગપતિતં શિષ્યાર્પણે જાયતે ।
 ગ્રાગલભ્યં ન તથાસ્તિ તત્ત્વ વિવૃતૌ ગોધો ન તાદ્ગ્નિયઃ
 તેનાયં નનુ માટ્શો જડમતિર્મોનાશ્રિતસ્તિષ્ઠતિ ॥૨૦॥

અનુવાદ : જે તત્ત્વ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ વચ્ચનનો અવિષય (અવકટવ્ય) તથા નિત્યત્વાદિ સર્વ વિકલ્પો રહિત છે તે જ શિષ્યોને આપવાના વિષયમાં અર્થાત્ શિષ્યોને પ્રબોધ કરાવવા માટે વ્યવહારમાર્ગમાં પડીને વચ્ચનનો વિષય પણ થાય છે. તે આત્મતત્ત્વનું વિવરણ કરવા માટે ન તો મારામાં તેવી પ્રતિભાશાલિતા (નિપુણતા) છે અને ન તે પ્રકારનું જ્ઞાનેય છે. માટે મારા જેવો મન્દબુદ્ધિ મનુષ્ય મૌનનું અવલંબન લઈને જ સ્થિત રહે છે.

વિશેષાર્થ : જો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો તે વચ્ચનો દારા કહી જ શકાતું નથી. પરંતુ તેનું પરિજ્ઞાન શિષ્યોને પ્રાપ્ત થાય, તે માટે વચ્ચનોનો આશ્રય લઈને તેમના દારા તેમને બોધ કરાવવામાં આવે છે. આ વ્યવહારમાર્ગ છે, કારણ કે વાચ્ય-વાચ્યકનો આ દૈત્યભાવ ત્યાં જ સંભવે છે, નહિ કે નિશ્ચયમાર્ગમાં. ગ્રન્થકર્તા શ્રી પદ્મનાન્દિ મુનિ પોતાની લધુતા પ્રગટ કરતાં અહીં કહે છે કે


શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦

૩૬૪

[પદ્ધતિ-પંચવિંશતિ:

યવહારમાર્ગનું અવલંબન લઈને પણ જે પ્રતિભા અથવા જ્ઞાન દ્વારા શિષ્યોને તે આત્મતત્ત્વનો બોધ કરાવી શકાય છે તે મારામાં નથી, તેથી હું તેનું વિશેષ વિવરણ ન કરતાં મૌનનો જ આશ્રય લઉં છું. ૨૦.

આ રીતે પરમાર્થવિંશતિ અધિકાર સમાપ્ત થયો. ૨૩.



૨૪. શરીરાષ્ટક

[૨૪. શરીરાષ્ટકમ्]

(શાર્ડૂલવિક્રીડિત)

દુર્ગન્ધાશુચિધાતુભિત્તિકલિતં સંછાદિતં ચર્મણા
 વિષ્મૂત્રાદિભૃતં ક્ષુધાદિવિલસદૂદુઃ�ાખુભિશ્છદ્રિતમ् ।
 વિલાસં કાયકુટીરકં સ્વયમપિ પ્રાપ્તં જરાવહિના
 ચેદેતત્તદપિ સ્થિરં શુચિતરં મૂળો જનો મન્યતે ॥૧॥

અનુવાદ : જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગધયુક્ત અપવિત્ર રસ, રૂધિર અને અસ્થિ આદિ ધાતુઓરૂપ ભીતો (દીવાલો) ને આશ્રિત છે, ચામડાથી વિંટળાયેલ છે, વિષા અને મૂત્રાદિથી પરિપૂર્ણ છે તથા પ્રગટ થયેલ ભૂખ, તરસ આદિ દુઃખોરૂપ ઉંદરોદ્વારા છિદ્રોવાળી કરવામાં આવી છે; આવી તે શરીરરૂપ ઝૂંપડી જો કે પોતે જ વૃદ્ધત્વરૂપ અનિન્દ્રા પ્રાપ્ત કરાય છે તો પણ અજ્ઞાની મનુષ્ય તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે.

વિશેષાર્� : અહીં શરીરને ઝૂંપડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે કે જેમ વાંસ આદિથી નિર્મિત ભીતોના આશ્રયે રહેતી ઝૂંપડી ઘાસ કે પાંદડાઓથી ઢંકાયેલી રહે છે. એમાં ઉંદરો દ્વારા જે અહીં તહીં છિદ્રો કરવામાં આવે છે તેનાથી તે નબળી થઈ જાય છે. તેમાં જો કદાચ આગ લાગી જાય તો તે જોતજોતામાં જ ભસ્મ થઈ જાય છે. બરાબર એ જ જાતનું આ શરીર પણ છે—એમાં ભીતોના સ્થાને દુર્ગધવાળી અને અપવિત્ર રસ-રૂધિરાદિ ધાતુઓ છે, ઘાસ આદિના સ્થાને એને ઢાંકનાર ચામડું છે. તથા અહીં ઉંદરોના સ્થાને ભૂખ—તરસ આદિથી થતું વિપુલ દુઃખ છે જે તેને નિરંતર નિર્બળ બનાવે છે. આ રીતે ઝૂંપડી સમાન હોવા છીતાં પણ તેના કરતાં શરીરમાં એ વિશેષતા છે કે તે તો સમય પ્રમાણે નિયમથી વૃદ્ધત્વ (બુઢાપા) થી વ્યાપ્ત થઈને નાશ પામવાનું છે. પરંતુ તે ઝૂંપડી તો કદાચ જ અસાવધાનીને કારણે અનિન્દ્રાદિ વ્યાપ્ત થઈને નાશ થાય

છે. આવી અવસ્થા હોવા છતાં પણ આશ્ર્ય એ જ કે અજ્ઞાની પ્રાણી તેને સ્થિર અને પવિત્ર સમજીને તેના નિમિત્તે અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. ૧.

(શાર્ડૂલવિક્રીડિત)

દુર્ગન્ધં કૃમિકીટજાલકલિતં નિત્યं સ્વદ્દૂરસં
શૌચસ્નાનવિધાનવારિવિહિતપ્રકાલનં રૂભૂતમ् ।
માનુષ્યં વપુરાહુરુન્તરધિયો નાડીવ્રણં ભેષજં
તત્ત્વાન્નં વસનાનિ પદ્મકમહો તત્ત્વાપિ રાગી જનઃ ॥૨॥

અનુવાદ : જે આ મનુષ્યનું શરીર દુર્ગન્ધ સહિત છે, લટ અને ક્ષુદ્ર જંતુઓના સમૂહથી વ્યાપ્ત છે, નિરંતર વહેતા પરસેવા અને નાક આદિના દૂષિત રસથી પરિપૂર્ણ છે, પવિત્રતા સૂચક સ્નાનને સિદ્ધ કરનાર જળથી જેને ધોવામાં આવે છે, છતાં પણ જે રોગોથી પરિપૂર્ણ છે; એવા તે મનુષ્યના શરીરને ઉત્કૃષ્ટ બુદ્ધિના ધારક વિદ્ઘાનો નસ સાથે સંબંધવાળા ગૂમડા આદિના જઘમ સમાન બતાવે છે. તેમાં અન્ન (આહાર) તો ઔષધ સમાન છે અને વખ્ત પાટા સમાન છે છતાં પણ આશ્ર્ય છે કે તેમાં પણ મનુષ્ય અનુરાગ કરે છે.

વિશેષાર્થ : અહીં મનુષ્યના શરીરને જઘમ સમાન બતાવીને બન્નેમાં સમાનતા બતાવવામાં આવી છે. જેમ કે-જેવી રીતે ધાવ દુર્ગંધસહિત હોય છે તેવી જ રીતે આ શરીર પણ દુર્ગન્ધ યુક્ત છે, ધાવમાં જેવી રીતે કૃમિ અને બીજા નાના નાના જંતુઓનો સમૂહ રહે છે તેવી જ રીતે શરીરમાં પણ તે રહે જ છે. ધાવમાંથી જો નિરંતર પરુ અને લોહી વગેરે વધ્યા કરે છે તો આ શરીરમાંથી પણ નિરંતર પરસેવો વગેરે વધ્યા જ કરે છે. ધાવને જો જળથી ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે તો આ શરીરને પણ જળથી સ્નાન કરાવીને સ્વચ્છ કરવામાં આવે છે, ધાવ જેમ રોગથી પૂર્ણ છે તેવી જ રીતે શરીર પણ રોગોથી પરિપૂર્ણ છે. ધાવને રૂઝવા માટે જો દવા લગાડવામાં આવે છે તો શરીરને ભોજન આપવામાં આવે છે, તથા જો ધાવને પાટાથી બાંધવામાં આવે છે તો આ શરીરને પણ વખ્યોથી ઠાંકવામાં આવે છે. આ રીતે શરીરમાં ધાવની સમાનતા હોવા છતાં પણ આશ્ર્ય એક એ જ છે કે ધાવને તો મનુષ્ય ઈચ્છિતો નથી પરંતુ આ શરીરમાં તે અનુરાગ કરે છે. ૨.

(ઉપજાતિ)

નૃણામશેષાણિ સદૈવ સર્વથા વપુંષિ સર્વાશુચિભાજ્જિ નિશ્ચિતમ् ।
તતઃ ક એતેષુ બુધઃ ગ્રપદ્યતે શુચિત્વમબુલુતિવન્દનાદિભિ: ॥૩॥

અધિકાર-૨૪ : શારીરાષ્ટક]

૩૬૭

અનુવાદ : મનુષ્યોના સમસ્ત શરીર સદા અને સર્વ પ્રકારે નિયમથી અપવિત્ર રહે છે. તેથી આ શરીરોના વિષયમાં કયો બુદ્ધિમાન મનુષ્ય જળનિર્મિત સ્નાન અને ચન્દન આદિ દ્વારા પવિત્રતાનો સ્વીકાર કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય સ્વભાવથી અપવિત્ર તે મનુષ્ય શરીરને સ્નાનાદિ દ્વારા શુદ્ધ માની શકતા નથી. ૩.

(શાર્દૂલવિક્રીદિત)

તિક્ષેષા [ક્ષવા]કુફલોપમં વપુરિદં નૈવોપભોગ્યં નૃણાં
સ્યાચ્ચેન્મોહકુજન્મરન્ધ્રહિતં શુષ્કં તપોઘર્મતઃ ।
નાન્તર્ગૌરવિતં તદા ભવનદીતારે ક્ષમં જાયતે
તત્તત્ત્ર નિયોજિતં વરમથાસારં સદા સર્વથા ॥૪॥

અનુવાદ : આ મનુષ્યોનું શરીર કડવી તુંબડી સમાન છે, તેથી તે ઉપભોગ યોગ્ય નથી, જો તે મોહ અને કુજન્મરૂપ છિદ્રોરહિત, તપરૂપ ધામ(તડકા) શી શુષ્ક (સૂક્ષ્માયેલ) અને અંદર ગુરુત્વા રહિત હોય તો સંસારરૂપ નદી પાર કરાવવામાં સમર્થ થાય છે. માટે તેને મોહ અને કુજન્મરહિત કરીને તપમાં લગાવવું તે ઉત્તમ છે. એ વિના તે સદા અને સર્વ પ્રકારે નિઃસાર છે.

વિશોધાર્થ : અહીં મનુષ્યના શરીરને કડવી તુંબડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે કે જેમ કડવી તુંબડી ખાવા યોગ્ય હોતી નથી તેવી જ રીતે આ શરીર પણ અનુરાગ યોગ્ય નથી. જો તે તુંબડી છેદ રહિત, તડકામાં સૂક્ષ્માયેલ અને વચ્ચમાં ગૌરવ (ભારેપણા) રહિત હોય તો નદીમાં તરવાના કામમાં આવે છે. બરાબર એ જ રીતે જો આ શરીર પણ મોહ અને દુષ્કુળરૂપ છેદ રહિત, તપથી ક્ષીણ અને ગૌરવ (અભિમાન) રહિત હોય તો તે સંસારરૂપી નદી પાર થવામાં સહાયક થાય છે. તેથી જે ભવ્ય પ્રાણી સંસારરૂપ નદીથી પાર થઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા દૂર્ભે છે તેમણે આ દુર્લભ મનુષ્ય શરીરને તપ આદિમાં લગાવવું જોઈએ. નહિતર તેને ફરીથી પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ થશે. ૪.

(માલિની)

ભવતુ ભવતુ યાદ્ક તાદ્ગોતદ્વપુર્મે
હદિ ગુરુવચનં ચેદસ્તિ તત્ત્વર્દર્શિ ।
ત્વરિતમસમસારાનન્દકન્દાયમાના
ભવતિ યદ્નુભાવાદક્ષયા મોક્ષલક્ષ્મીઃ ॥૫॥

આનુવાદ : જો હૃદયમાં જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરનાર ગુરુનો ઉપદેશ સ્થિત હોય તો મારું જેવું આ શરીર હોય તે તેવું બની રહો અર્થાત્ તેનાથી મને કોઈ જાતનો ખેદ નથી. એનું કારણ એ છે કે ઉક્ત ગુરુના ઉપદેશના પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદના કારણભૂત અવિનશ્વર મોક્ષલક્ષ્મી શીଘ્ર જ પ્રાપ્ત થાય છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

પર્યન્તે કૃમયો ઽથ વહિનવશતો ભર્મૈવ મત્સ્યાદનાત्
વિષા સ્યાદથવા વૃપુઃપરિણતિસ્તસ્યેદશી જાયતે ।
નિત્યં નૈવ રસાયનાદિભિરાપિ ક્ષયેવ યત્તલ્કૃતે
કઃ પાપં કુરુતે બુધો ઽત્ર ભવિતા કષ્ટા યતો દુર્ગતિઃ ॥૬॥

આનુવાદ : આ શરીર અંતે અર્થાત્ પ્રાણરહિત થતાં ક્રીડાસ્વરૂપ અથવા અજિનને વશ થઈને ભસ્મસ્વરૂપ અથવા માછલીઓએ ખાવાથી વિષા (મળ) સ્વરૂપ થઈ જાય છે, તે શરીરનું પરિણામન એવું જ થાય છે. ઔષધિ આદિ દ્વારા પણ નિત્ય નથી. પરંતુ વિનશ્વર જ છે, તો ભલા ક્યો વિદ્વાન્ મનુષ્ય એના વિષયમાં પાપકાર્ય કરે? અર્થાત્ કોઈ પણ વિદ્વાન્ તેના નિભિત્તે પાપકર્મ કરતો નથી. કારણ એ છે કે તે પાપથી નરકાદિ દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૬.

(શાર્ડૂલવિક્રીડિત)

સંસારસ્તનુયોગ એષ વિષયો દુઃखાન્યતો દેહિનો
વહ્નેરોહસમાશ્રિતસ્ય ઘનતો ઘાતાધ્યતો નિષુરાત્ ।
ત્યાજ્યા તેન તનુર્મુક્ષુભિરિયં યુક્ત્વા મહત્યા તયા
નો ભૂયો ઽપિ યયાત્મનો ભવકૃતે તત્સંનિધિર્જાયતે ॥૭॥

આનુવાદ : આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય છે જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે-લોઢાનો આશ્રય લેનાર અજિનને કઠોર ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન્ યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે ફરીથી ન થઈ શકે.

વિશેષાર્� : પહેલાં લોઢાને અજિનમાં ખૂબ તપાવવામાં આવે છે. પછી તેને ઘણથી ટીપી-ટીપીને તેના સાધનો બનાવવામાં આવે છે. આ કાર્યમાં જોમ લોઢાની સંગતિથી નકામા જ અજિનને પણ ઘણથી કરાતા ઘા સહેવા પડે છે તેવી જ રીતે શરીરની સંગતિથી આત્માને પણ તેની સાથે અનેક પ્રકારના દુઃખ સહેવા પડે છે. તેથી ગ્રન્થકાર કહે છે કે તપ આદિ દ્વારા તે શરીરને આ રીતે છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. કે જેથી ફરીથી તેની પ્રાપ્તિ ન થાય. કારણ એ છે કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરીને જો તેના દ્વારા સાધ્ય સંયમ અને તપ આદિનું આચરણ ન કર્યું તો પ્રાણીને તે શરીર ફરી ફરી પ્રાપ્ત થતું જ રહેશે અને તેથી શરીરની સાથે કષ્ટો પણ સહન કરવા જ પડશે. ૭.

(શાર્દૂલવિક્રીદિત)

રક્ષાપોષવિધૌ જનો ઽસ્ય વપુષઃ સર્વઃ સદૈવોદ્યતઃ
કાલદિષ્ટજરા કરોત્યનુદિનં તજ્રર્જરં ચાનયોઃ ।
સ્પર્ધામાશ્રિતયોર્દ્ધયોર્વિજયિની સૈકા જરા જાયતે
સાક્ષાત્કાલપુરઃસરા યદિ તદા કાસ્થા સ્થિરત્વે નૃણામ् ॥૮॥

અનુવાદ : સર્વ પ્રાણી આ શરીરના રક્ષણ અને પોષણમાં નિરંતર પ્રયત્નશીલ રહે છે, ત્યાં કાળદ્વારા આદિષ્ટ જરા-મૃત્યુથી પ્રેરિત વૃદ્ધાવસ્થા તેને પ્રતિદિન નિર્બળ કરે છે. આ રીતે જાણે પરસ્પર સ્પર્ધા પામેલા જ આ બન્નેમાં એક પેલી વૃદ્ધાવસ્થા જ વિજયી થાય છે કારણ કે તેની આગળ સાક્ષાત્કાળ (યમરાજ) સ્થિત છે. આવી હાલતમાં જ્યાં શરીરની આ સ્થિતિ છે તો પછી તેની સ્થિરતામાં મનુષ્યોનો ક્યો પ્રયત્ન ચાલી શકે? અર્થાત્ તેનો કોઈ પણ પ્રયત્ન ચાલી શકતો નથી. ૮.

આ રીતે શરીરાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૪.



૨૫. સ્નાનાષ્ક

[૨૫. સ્નાનાષ્કમ्]

(શાર્દૂલવિક્રીડિત)

સન્માલ્યાદિ યદીયસંનિધિવશાદસ્પૃશ્યતામાશ્રયેદ
 વિષ્ણુત્રાદિભૂતં રસાદિઘટિતં બીભત્સુ યત્પૂતિ ચ ।
 આત્માનં મલિનં કરોત્યપિ શુચિં સર્વાશુચિનામિદં
 સંકેતૈકગૃહં નૃણાં વપુરપાં સ્નાનાત્કર્થં શુદ્ધયતિ ॥૧॥

અનુવાદ : જે શરીરની સમીપતાને કારણે ઉત્તમ માળા આદિ અડવાને પણ યોગ્ય રહેતાં નથી, જે મળ અને મૂત્ર આદિથી ભરેલું છે, રસ અને રૂધિર આદિ સાત ધાતુઓથી રચાયેલું છે, ભયાનક છે; દુર્ગંધયુક્ત છે અને જે નિર્મળ આત્માને પણ મલિન કરે છે; એવું સમસ્ત અપવિત્રતાઓના એક સંકેતગૃહ સમાન આ મનુષ્યોનું શરીર જળના સ્નાનથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. ૧.

(શાર્દૂલવિક્રીડિત)

આત્માતીવ શુચિઃ સ્વભાવત ઇતિ સ્નાનં વૃથાસ્મિન્ પરે
 કાયશ્ચાશુચિરેવ તેન શુચિતામભેતિ નો જાતુચિત્ત ।
 સ્નાનસ્યોભયથેત્યભૂદ્વિફલતા યે કુર્વતે તત્પુનસ्-
 તેષાં ભૂજલકીટકોટિહનનાત્પાપાય રાગાય ચ ॥૨॥

અનુવાદ : આત્મા તો સ્વભાવથી અત્યંત પવિત્ર છે, તેથી તે ઉત્કૃષ્ટ આત્માના વિષયમાં સ્નાન વ્યર્થ જ છે; તથા શરીર સ્વભાવથી અપવિત્ર જ છે. તેથી તે પણ કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બન્નેય પ્રકારે સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક,

જણકાયિક અને અન્ય જંતુઓની હિંસાનું કારણ હોવાથી પાપ અને રાગનું જ કારણ થાય છે.

વિશેષાર્થ : અહીં સ્નાન આવશ્યકતાનો વિચાર કરતાં આ પ્રેરણ ઉપસ્થિત થાય છે કે તેનાથી શું આત્મા પવિત્ર થાય છે કે શરીર? તેના ઉત્તરમાં વિચાર કરતાં એ ચોક્કસ પ્રતીત થાય છે કે ઉક્ત સ્નાન દ્વારા આત્મા તો પવિત્ર થતો નથી કારણ કે તે પોતે જ પવિત્ર છે. વળી તેનાથી શરીરની શુદ્ધિ થતી હોય, તો એ પણ કંઈ શકતું નથી; કારણ કે તે સ્વભાવથી જ અપવિત્ર છે. જેમ કોલસાને પાણીથી ઘસી ઘસીને ધોવા છતાં પણ તે કંઈ કાળાપણું છોડી શકતો નથી અથવા મળથી ભરેલો ઘડો કંઈ બહાર સાઝ કરવાથી શુદ્ધ થઈ શકતો નથી. તેવી જ રીતે મળ-મૂત્રાદિથી પરિપૂર્ણ આ સપ્તધાતુમય શરીર પણ કંઈ સ્નાન દ્વારા શુદ્ધ થઈ શકતું નથી. આ રીતે બન્નેય પ્રકારે સ્નાનની વ્યર્થતા સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો સ્નાન કરે છે તેઓ જણકાયિક, પૃથ્વીકાયિક અને અન્ય ત્રસ જીવોનો પણ તેના દ્વારા ઘાત કરે છે; માટે તે કેવળ હિંસાજનિત પાપના ભાગીદાર થાય છે. તે સિવાય તેઓ શરીરની બાધ્ય સ્વચ્છતામાં રાગ પણ રાખે છે, એ પણ પાપનું જ કારણ છે. અભિપ્રાય એ છે કે નિશ્ચયદટાણિથી વિચાર કરતાં સ્નાન દ્વારા શરીર તો શુદ્ધ થતું નથી, ઉદ્દું જીવહિસા અને આરંભ આદિ જ તેનાથી થાય છે. એ જ કારણે મુનિઓના મૂળગુણોમાં જ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ વ્યવહારની અપેક્ષાએ તે અનાવશ્યક નથી, પરંતુ ગૃહસ્થને માટે તે આવશ્યક પણ છે. કારણ કે તેના વિના શરીર તો મલિન રહે જ છે. સાથે મન પણ મલિન રહે છે. સ્નાન વિના જિનપૂજાદિ શુભ કાર્યોમાં પ્રસન્નતા પણ રહેતી નથી. હા, એ અવશ્ય છે કે બાધ્ય શુદ્ધિની સાથે જ અભ્યંતર શુદ્ધિનું પણ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો અંતરંગમાં મદ-માત્સર્યાદિ ભાવ હોય તો કેવળ આ બાધ્ય શુદ્ધિ કાર્યકારી નહિ થાય. ૨.

(શાર્દૂલવિક્રીડિત)

ચિત્તે પ્રાભવકોટિસંચિતરજઃસંબન્ધિતાવિર્ભવન્-
મિથ્યાત્વાદિમલબ્યપાયજનકઃ સ્નાન વિવેકઃ સત્તામ્ |
અન્યદ્વારિકૃતં તુ જન્તુનિકરબ્યાપાદનાત્પાપકૃ-
ન્નો ધર્મો ન પવિત્રતા ખલુ તતઃ કાયે સ્વભાવાશુચૌ ॥૩॥

અનુવાદ : ચિત્તમાં પૂર્વના કરોડો ભવોમાં સંચિત થયેલી પાપકર્મરૂપી ધૂળના સંબંધથી પ્રગટ થતા મિથ્યાત્વ આદિરૂપ મળને નષ્ટ કરનાર જે વિવેકબુદ્ધિ ઉત્પન્ન થાય છે તે જ વાસ્તવમાં સજજન પુરુષોનું સ્નાન છે. એનાથી બિન્ન જે જળકૃત સ્નાન છે તે પ્રાણીસમૂહને પીડાજનક હોવાથી પાપ કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૩.

(શાર્ડૂલવિક્રીડિત)

સમ્યગ્બોધવિશુદ્ધવારિણિ લસત્સદર્શનોર્મિવ્રજે
 નિત્યાનન્દવિશેષશૈત્યસુભગે નિઃશેષપાપદુહિ ।
 સતીર્થે પરમાત્મનામનિ સદા સ્નાનં કુરુધ્વં બુધાઃ
 શુદ્ધચર્થ કિમુ ધાવત ત્રિપથગામાતપયાસાકુલાઃ ॥૪॥

અનુવાદ : હે વિદ્વાનો! જે પરમાત્મા નામનું સમીયેન તીર્થ સમ્યજ્ઞાનરૂપ નિર્મળ જળથી પરિપૂર્ણ છે, શોભાયમાન સમ્યક્કદર્શનરૂપ લહેરોના સમૂહથી વ્યાપ્ત છે, અવિનશ્બર આનંદવિશેષરૂપ (અનંતસુખ) શૈત્યથી મનોહર છે તથા સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે. તેમાં તમે નિરંતર સ્નાન કરો. વર્થ પરિશ્રમથી વ્યાકુળ થઈને શુદ્ધિ માટે ગંગા તરફ કેમ દોડો છો? અર્થાત્ ગંગા આદિમાં સ્નાન કરવાથી કાંઈ અંતરંગ શુદ્ધિ થઈ શકતી નથી, તે તો પરમાત્માના સ્મરણ અને તેના સ્વરૂપ ચિંતન આદિથી જ થઈ શકે છે, માટે તેમાં જ અવગાહન કરવું જોઈએ. ૪.

(શાર્ડૂલવિક્રીડિત)

નો દૃષ્ટઃ શુચિતત્વનિશ્ચયનદો ન જ્ઞાનરત્નાકરઃ
 પાપૈः ક્વાપિ ન દૃશ્યતે ચ સમતાનામાતિશુદ્ધો નદી ।
 તેનૈતાનિ વિહાય પાપહરણે સત્યાનિ તીર્થાનિ તે
 તીર્થાભાસસુરાપગાદિષુ જડ મજાન્તિ તુષ્યાન્તિ ચ ॥૫॥

અનુવાદ : પાપી જીવોએ ન તત્વના નિશ્ચયરૂપ પવિત્ર નદી (વિશેષ નદી) જોયેલ છે અને ન જ્ઞાનરૂપ સમુદ્ર પણ જોયો છે તેઓ સમતા નામની અતિશય પવિત્ર નદી પણ ક્યાંક જોતા નથી તેથી તે મૂર્ખાઓ પાપનો નાશ કરવાના વિષયમાં યર્થાર્થભૂત આ સમીયેન તીર્થો છોડીને તીર્થ જેવા જણાતા ગંગા આદિ તીર્થાભાસોમાં સ્નાન કરીને સંતુષ્ટ થાય છે. ૫.

(શાર્ડૂલવિક્રીડિત)

નો તીર્થ ન જલં તદસ્તિ ભુવને નાન્યક્તિમધ્યસ્તિ તત્
 નિઃશેષાશુચિ યેન માનુષવુઃ સાક્ષાદિદં શુદ્ધ્યતિ ।

આધિવ્યાધિ જરામૃતિપ્રભૃતિભિર્વાસં તથૈતત્યુનઃ
શશ્વત્તાપકરં યથાસ્ય વપુષો નામાપ્યસહં સતામ્ ॥૬॥

અનુવાદ : સંસારમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ જળ નથી તથા અન્ય પણ એવી કોઈ વસ્તુ નથી; જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં શુદ્ધ થઈ શકે, આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), ઘડપણ (વૃદ્ધાવસ્થા) અને ભરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતપ્તકારક છે કે સજજનોને તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૬.

(શાર્દૂલવિક્રીડિત)

સર્વેસ્તીર્થજલૈરપિ પ્રતિદિનં સ્નાતં ન શુદ્ધં ભવેત્
કર્પૂરાદિવિલેપનૈરપિ સદા લિસ્તં ચ દુર્ગંધભૂત્ ।
યત્નેનાપિ ચ રક્ષિતં ક્ષયપથપ્રસ્થાયિ દુઃખપ્રદં
યત્તસ્માદ્વપુષઃ કિમન્યદશુભ્ કષ્ટં ચ કિં પ્રાણિનામ્ ॥૭॥

અનુવાદ : જો આ શરીરને પ્રતિદિન સમસ્ત તીર્થોના જણથી પણ સ્નાન કરાવવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકતું નથી, જો એને કપૂર અને કુંકુમ આદિ સુગંધી લેપો દ્વારા લેપ પણ કરવામાં આવે તો પણ તે દુર્ગંધ ધારણ કરે છે તથા જો એનું પ્રયત્નપૂર્વક રક્ષણ પણ કરવામાં આવે તો પણ તે ક્ષયના માર્ગે જ પ્રસ્થાન કરશે અર્થાત્ નાચ થશે. આ રીતે જે શરીર સર્વ પ્રકારે દુઃખ આપે છે તેનાથી વધારે પ્રાણીઓને બીજું કૃયું અશુભ અને કષ્ટ હોઈ શકે? અર્થાત્ પ્રાણીઓને સૌથી અધિક અશુભ અને કષ્ટ આપનાર આ શરીર જ છે, અન્ય કોઈ નથી. ૭.

(શાર્દૂલવિક્રીડિત)

ભવ્યા ભુરિભવાર્જિતોદિતમહ્રદ્ભૂમોહસર્પોલ્લસન-
મિથ્યાબોધવિષપ્રસંગવિકલા મન્દીભવદ્વદ્ધાયઃ ।
શ્રીમત્પદ્ભૂજનન્દિવત્તશશભૃદ્વિમ્બપ્રસૂતં પરં
પીત્વા કર્ણપુટેર્ભવન્તુ સુખિનઃ સ્નાનાષ્ટકાખ્યામૃતમ् ॥૮॥

અનુવાદ : જે ભવ્ય જીવ અનેક જન્મોમાં ઉપાર્જિત થઈને ઉદ્યને પ્રાપ્ત થયેલ

એવા દર્શનમોહનીયરૂપ મહાસર્પથી પ્રગાટ થયેલ મિથ્યાજ્ઞાનરૂપ વિષના સંસર્ગથી વ્યાકુળ છે, તથા એ જ કારણે જેમની સમ્યગ્દર્શનરૂપ દેખિ અતિશય મંદ થઈ ગઈ છે તે ભવ્ય જીવ શ્રીમાન् પદ્ધતિનિષ્પત્તિ મુનિના મુખરૂપ ચંદ્રબિંબથી ઉત્પન્ન થયેલ આ ઉત્કૃષ્ટ ‘સ્નાનાષ્ટક’ નામનું અમૃત કાનવડે પીને સુખી થાં.

વિશેષાર્થ : જો કોઈ વાર કોઈ પ્રાણીને જેરી સર્પ કરડી જાય છે તો તે શરીરમાં ફેલાતા તેના વિષથી અત્યંત વ્યાકુળ થઈ જાય છે તથા તેની દેખિ (નજર) મંદ પડી જાય છે. સૌભાગ્યવશે જો તે વખતે ચંદ્રબિંબમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની પ્રાણિ થઈ જાય, તો તે તેને પીને વિષરહિત થયો થકો પૂર્વ ચેતના પ્રાપ્ત કરી લે છે. બરાબર એવી જ રીતે જે પ્રાણી સર્પ સમાન અનેક ભવોમાં ઉપાર્જિત દર્શનમોહનીયના ઉદ્યથી મિથ્યાભાવને પ્રાપ્ત થયેલ જ્ઞાન (મિથ્યાજ્ઞાન) દ્વારા વિવેકશૂન્ય થઈ ગયા છે તથા જેમનું સમ્યગ્દર્શન મંદ પડી ગયું છે તેઓ જો પદ્ધતિનિષ્પત્તિ મુનિએ રચેલ આ ‘સ્નાનાષ્ટક’ પ્રકરણ કાનો વડે સાંભળો તો અવિવેક નાચ થઈ જવાથી તેઓ અવશ્યમેવ પ્રબોધ પામે, કારણ કે આ સ્નાનાષ્ટક પ્રકરણ અમૃત સમાન સુખ આપનાર છે. ૮.

આ રીતે સ્નાનાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૫.

૨૬૦૯ મિનિટ.



૨૭. બ્રહ્મચર્યાષ્ટક

[૨૬. બ્રહ્મચર્યાષ્ટકમ्]

(દ્રુતવિલાસિત)

ભવવિવર્ધનમેવ યતો ભવેદધિકદુઃખકરં ચિરમદ્ધિનામ् ।
ઇતિ નિજાઙ્ગનયાપિ ન તત્ત્વતં મતિમતાં સુરતં કિમુતો ઽન્યથા ॥૧॥

અનુવાદ : મૈથુન (સ્વીસેવન) પ્રાણીઓનો સંસાર વધારીને તેમને ચિરકાળ સુધી અધિક દુઃખ આપે છે તેથી બુદ્ધિમાન મનુષ્યોને જ્યાં પોતાની સ્ત્રી સાથે પણ તે મૈથુન કર્મ ઈષ્ટ નથી તો પછી ભલા અન્ય પ્રકારે અર્થાત્ પરસ્તી આદિની સાથે તો તે તેમને ઈષ્ટ કેમ હોય? અર્થાત્ તેની તો બુદ્ધિમાન મનુષ્ય કદ્દિ ઈષ્ટા જ કરતા નથી. ૧.

(દ્રુતવિલાસિત)

પશવ એવ રતે રતમાનસા ઇતિ બુધૈः પશુકર્મ તદુચ્યતે ।
અભિધયા નનુ સાર્થકયાનયા પશુગતિઃ પુરતો ઽસ્ય ફલં ભવેત् ॥૨॥

અનુવાદ : આ મૈથુનકર્મમાં પશુઓનું જ મન અનુરક્ત રહે છે, તેથી વિદ્વાન મનુષ્ય તેને પશુકર્મ એ સાર્થક નામે કહે છે. તથા આગળના ભવમાં એનું ફળ પણ પશુગતિ અર્થાત્ તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે.

વિશોધાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે મનુષ્ય નિરંતર વિષયાસકત રહે છે તે પશુઓથી પણ હલકાં છે. કારણ કે પશુઓને તો ધણું કરીને એને માટે કાંઈક નિશ્ચિત સમય જ રહે છે; પરંતુ આવા મનુષ્યોને એના માટે કોઈ પણ સમય નિશ્ચિત હોતો નથી-તેઓ નિરંતર કામાસકત રહે છે. એનું ફળ એ થાય છે કે આગામી ભવમાં તેમને તે તિર્યંચ

પર્યાયની પ્રાપ્તિ જ થાય છે જ્યાં ધારું કરીને હિતાહિતનો કોઈ પણ વિવેક રહેતો નથી. તેથી શાસ્ત્રકારોએ પરસ્પરના વિરોધ રહિત જ ધર્મ, અર્થ અને કામ-આ ત્રણે પુરુષાર્થોના સેવનનું વિધાન કર્યું છે. ૨.

(દ્રુતવિલાન્બિત)

યदિ ભવેદબલાસુ રતિઃ શુભા કિલ નિજાસુ સતામિહ સર્વથા ।
કિમિતિ પર્વસુ સા પરિવર્જિતા કિમિતિ વા તપસે સતતં બુદ્ધે: ॥૩॥

અનુવાદ : જો લોકમાં સજજન પુરુષોને પોતાની સ્ત્રીના વિષયમાં પણ કરવામાં આવતો અનુરાગ શ્રેષ્ઠ લાગતો હોય તો પછી વિદ્વાન् પર્વ (આઠમ, ઘૌદશ વગેરે) ના દિવસોમાં અથવા તપના નિભિતે તેનો નિરંતર ત્યાગ કેમ કરાવેત? અર્થાત્ ન કરાવેત.

વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પરસ્તી આદિની સાથે કરવામાં આવતું મૈથુનકર્મ તો સર્વથા નિન્દનીય છે જ, પરંતુ સ્વસ્ત્રીની સાથે કરવામાં આવતું તે કર્મ નિન્દનીય જ છે. હા, એટલું જરૂર છે કે તે પરસ્તી આદિની અપેક્ષાએ કાંઈક ઓછું નિન્દનીય છે. એ જ કારણે વિવેકી ગૃહસ્થ આઠમ-ઘૌદશ વગેરે પર્વના દિવસોમાં સ્વસ્ત્રીસેવનનો પણ ત્યાગ કરતા રહે છે તથા મુમુક્ષુ જનો તો તેનો સર્વથા જ ત્યાગ કરીને તપનું ગ્રહણ કરે છે. ૩.

(દ્રુતવિલાન્બિત)

રતિપતેરુદ્યાન્નરયોષિતોરશુચિનોર્વપુષો: પરિધૃણાત્ ।
અશુચિ સુષ્ટુતરં તદિતો ભવેત્સુખલવે વિદુષ: કથમાદર: ॥૪॥

અનુવાદ : કામ (વેદ)ના ઉદ્યથી પુરુષ અને સ્ત્રીના અપવિત્ર શરીરો (જનનેન્દ્રિયો) ધસાવાથી જે અત્યંત અપવિત્ર મૈથુનકર્મ તથા તેનાથી જે અથ્ય સુખ થાય છે તેના વિષયમાં ભલા વિવેકી જીવને કેવી શીતે આદર થઈ શકે? અર્થાત્ થઈ શકતો નથી. ૪.

(દ્રુતવિલાન્બિત)

અશુચિનિ પ્રસભં રતકર્મणિ પ્રતિશરીરિ રતિર્યદપિ સ્થિતા ।
ચિદરિમોહવિજૃભ્રણદૂષણાદિયમહો ભવતીતિ નિબોધિતા ॥૫॥

અનુવાદ : પ્રત્યેક પ્રાણીમાં જે અપવિત્ર મૈથુનકર્મના વિષયમાં બળપૂર્વક

અધિકાર-૨૬ : પ્રભાયર્થક]

૩૭૭

અનુરાગ સિથત રહે છે તે ચેતનના શત્રુભૂત મોહના વિસ્તારરૂપ દોષથી થાય છે. એનું કારણ અવિવેક છે. ૫.

(દ્રુતવિલઘિત)

નિરવશેષયમદ્વારાખણે શિતકુઠારહતિર્નનુ મૈથુનમ् ।
સતતમાત્મહિતિં શુભમિચ્છતા પરિહતિર્વતિનાસ્ય વિધીયતે ॥૬॥

અનુવાદ : નિશ્ચયથી આ મૈથુનકર્મ સમસ્ત સંયમરૂપ વૃક્ષને ખંડિત કરવામાં તીક્ષ્ણ કુષારીના આધાત સમાન છે. તેથી નિરંતર ઉત્તમ આત્મહિતની ઈચ્છા કરનાર સાધુ એનો ત્યાગ કરે છે. ૬.

(દ્રુતવિલઘિત)

મધુ યથા પિબતો વિશ્રતિસ્તથા વૃજિનકર્મભૂતઃ સુરતે મતિઃ ।
ન પુનરેતદભીષ્ટમિહાઙ્કિનાં ન ચ પરત્ર યદાયતિ દુઃખદમ् ॥૭॥

અનુવાદ : જેમ મધુ પીનાર પુરુષને વિકાર થાય છે તેવી જ રીતે પાપ કર્મ ધારણ કરનાર પ્રાણીને મૈથુનના વિષયમાં બુદ્ધિ થાય છે. પરંતુ એ પ્રાણીઓને ન આ લોકમાં ઈષ છે અને ન પરલોકમાં ય. કારણ કે તે ભવિષ્યમાં દુઃખદાયક છે. ૭.

(દ્રુતવિલઘિત)

રતિનિષેધવિધૌ યત્તાં ભવેચ્ચપલતાં પ્રવિહાય મનઃ સદા ।
વિષયસૌખ્યમિદં વિષસંનિભં કુશલમાસ્તિ ન ભુક્તવતસ્તવ ॥૮॥

અનુવાદ : હે મન, તું ચંચળતા છોડીને નિરંતર મૈથુનના પરિત્યાગની વિધિમાં પ્રયત્ન કર, કારણ કે આ વિષયસુખ વિષસમાન દુઃખદાયક છે. તેથી એને ભોગવતાં તારું કલ્યાણ થઈ શકશે નહીં.

વિશોધાર્થ : જેમ વિષના ભક્ષણથી પ્રાણીને મરણજન્ય દુઃખ ભોગવવું પડે છે તેવી જ રીતે આ મૈથુનવિષયક અનુરાગથી પણ પ્રાણીને જન્મ-મરણના અનેક દુઃખ સહન કરવા પડે છે. તેથી અહીં મનને સંભોધિત કરીને એમ કહેવામાં આવ્યું છે કે હે મન! તું આ લોક અને પરલોક બન્ને ય લોકમાં દુઃખ આપનાર તે વિષયભોગને છોડવાનો પ્રયત્ન કર, નહિ તો તારું અહિત અનિવાર્ય છે. ૮.

(દ્રુતવિલાસિત)

યુવતિસંગતિવર્જનમષ્ટકં પ્રતિ મુમુક્ષુજનં ભળિતં મયા ।
સુરતરાગસમુદ્રગતા જનાઃ કુરુત મા ક્રુધ્મત્ર મુનૌ મયિ ॥૧॥

અનુવાદ : મેં શ્રી સંસર્જના પરિત્યાગવિષયક જે આ આઠ શ્લોકોનું પ્રકરણ રચ્યું છે તે મોક્ષાભિલાષી જનોનું લક્ષ્ય કરીને રચ્યું છે. તેથી જે પ્રાણી મૈથુનના અનુરાગરૂપ સમુદ્રમાં મળે થઈ રહ્યા છે, તે મારા (પદ્મનાન્દિ મુનિ) ઉપર કોધ ન કરો. ૮.

આ રીતે પ્રભ્રયર્થક સમાપ્ત થયું. ૨૬.

આ રીતે પદ્મનાન્દિ મુનિ દ્વારા વિરચિત ‘પદ્મનાન્દિ-પંચવિંશતિ’ ગ્રન્થ સમાપ્ત થયો.

૨૬૦
પદ્મનાન્દિ.